

:: અનુક્રમણિકા ::									
ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.નં.	૨૨.	૩	૪૫	અષાડાભૂતિનું નાટક	૧૪૫
			“શ્રી સમરાઈચ્ય કહા.”		૨૩.	૩	૪૫	સિંહકુમારને વૈરાગ્ય	૧૪૧
૧.	૩	૨૮	વિશ્વાસધાત	૨	૨૪.	૩	૪૭	પુત્રનું નામ આનંદ : પિતા,...	૧૬૭
૨.	૩	૨૮	સમાધિની સુંદરતા	૮	૨૫.	૩	૪૭	ફીરનું દાખાન્ત	૧૭૧
૩.	૩	૨૮	સદ્ગુરુની બલિહારી	૯	૨૬.	૩	૪૭	સિંહરાજાની મનનીય વિચારણા	૧૭૪
૪.	૩	૩૦	ત્રીજા ભવે હાથી-પોપટ	૧૨	૨૭.	૩	૪૭	સાચી મોટાઈના ઉપાય	૧૮૩
૫.	૩	૩૩	પાંચમે ભવે ચક્કટેવ	૨૩	૨૮.	૩	૪૭	શૌચવાદી બ્રાહ્મણનું દાખાન્ત	૧૮૪
૬.	૩	૩૩	પારધી અને પંખીનું દાખાન્ત	૩૨	૨૯.	૩	૪૭	કુમારપાલનું લશ્કર ફૂટ્યું	૧૮૭
૭.	૩	૩૪	ઉદારતા	૩૮	૩૦.	૩	૪૮	ખોટા ગુમાન તૃણા	૧૯૮
૮.	૩	૩૫	ચંદનની વિશેષતા	૪૩	૩૧.	૪	૬	મરણ એ ઉત્સવ શાથી ?	૨૦૮
૯.	૩	૩૬	ચન્દ્રસાર-અનધક	૬૪	૩૨.	૪	૬	સમાધિના બે મહાસાધન	૨૧૬
૧૦.	૩	૩૮	કામલતાની કરુણ કથની	૭૨	૩૩.	૪	૭	સમરાદિત્ય ત્રીજો ભવ શિખી અને જાલિની	૨૧૮
૧૧.	૩	૩૮	ચાર ચોર	૭૬	૩૪.	૪	૭	સમરાદિત્ય અહીં ત્રીજા ભવમાં શિખીકુમાર	૨૨૪
૧૨.	૩	૪૦	સમ્પર્કત્વનો પ્રકાશ	૮૪	૩૫.	૪	૧૯	ચાર કષાયનું મંથન કેમ ?	૨૩૨
૧૩.	૩	૪૦	ગુણસાધવાની ચાવી	૮૮	૩૬.	૪	૨૧	બાર પ્રકારે તપ્ય શા માટે કરવો ?	૨૩૭
૧૪.	૩	૪૧	જિનશાસનમાં અભય શાથી ?	૯૫	૩૭.	૪	૨૨	તપ્ય કરો તો લાભ	૨૩૮
૧૫.	૩	૪૧	આત્મજાગ્રત્તિ	૧૦૩	૩૮.	૪	૨૨	તપ્ય ન કરો તો નુકશાન	૨૩૯
૧૬.	૩	૪૧	લક્ષ્ય શુદ્ધિનું મહત્વ	૧૦૭	૪૦.	૪	૨૩	વિજ્યસિંહ આચાર્ય ભગવંતનું ચરિત્ર	૨૪૫
૧૭.	૩	૪૨	ચન્દ્રસાર રૂપે સ્વર્ગે,...	૧૦૮	૪૧.	૪	૨૮	વિજ્યસિંહ આચાર્યના પૂર્વભવ	૨૪૬
૧૮.	૩	૪૨	અનંગદેવ અને ધનદેવ	૧૧૧	૪૨.	૪	૨૮	ઉદ્યકાળ	૨૬૪
૧૯.	૩	૪૩	વીરદેવ-દ્રોષક	૧૨૦	૪૩.	૪	૨૮	સમુદ્રદાત અને મંગળ	૨૬૭
૨૦.	૩	૪૩	નંદયંતી-(પૂર્ણભદ્ર) અમરગુપ્ત	૧૩૨	૪૪.	૪	૨૮	સંસારીના કોડ	૨૭૬
૨૧.	૩	૪૫	મન પર ચોકી	૧૪૧	૪૫.	-	-	વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા	૨૮૦
								જ્લાનસેવા અને શુરુસેવા	૩૦૭

કરીએ નમન પ્રેમ સ્વીકારો, ઓ ગુરુવર વંદના

સૂરિ પ્રેમના ઓ લાડીલા, જે ભુવનમાં ભાનુ સમા,
તપ, ત્યાગ ને વૈરાગ્ય કેરો, ઝોત વહેતો વાણીમાં,
એવા ગુરુવર ભુવનભાનુ સૂરિ તણા પદ પદ્મમાં,
કરીએ નમન પ્રેમે સ્વીકારો, ઓ ગુરુવર વંદના.૧

કરુણા હતી તુજ આંખમાં તો, હદ્યમાં વિશાળતા,
મુખ પર રમે પ્રસાન્તતા ને, અંતરે હતી સૌમ્યતા,
દેતા સદા સહુ સાધુને હિત શિક્ષા સંયમ ધર્મની,
તુજ વાણી સુણતા દૂર થાતી, આપદાઓ કર્મની.૨

ઝંખના હતી તુજ અંતરે, જિન ધર્મના રસિયા કરું,
વળી કામના ને કીરતી કેરી, ઝંખનાથી પર કરું,
પરમાત્માની ભક્તિમાં, મશગુલ સદા સહુયે બને,
ઘનઘાતી કર્મ વિદારીને, પામે સહુ શિવ ધામને.૩

ઝંખી રહ્યો છે આજ ગુરુવર, શિષ્ય તવ દર્શન વિશે,
તલસી રહ્યા છે વાટ જોઈ, આપના મિલન વિશે,
તડપી રહ્યું છે હદ્ય ગુરુવર, આપના વિયોગથી,
આપો દરિશન આવીને, એક વાર સુરના લોકથી.૪

‘શ્રી સમરાઈચ્ય કહા’

સંસારમાં જુઓ તો શું છે ? :- જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા સંબંધ, જૂઠો વ્યવહાર, બધું જૂઠું ! કેમ જૂઠું ? જુઓને નિકટનો પણ સગો કોઈ જો મરી જાય તો શોક ચાર દિવસ, આઈ દિવસ... પછી કેમ ? વાર તહેવારે શીરાપૂરી ખાય કે નહીં ? કોઈના લગ્નાદિમાં લહાવા લે કે નહિ ? તો માયા-મમતા ક્યાં ગઈ ? જૂઠી માયા એનું નામ. કાયા કેવીક જૂઠી ? ઘડીકમાં સારી, ઘડીમાં રોગી ! દુનિયાની આવી પરિસ્થિતિ છે; ત્યાં પાછું આવા ઉચ્ચ માનવકણમાં એનું એજ પિંજણ ! અરે જીવને કહો કે ‘એના એ ભૂસા ફૂટવામાં શું નીકળવાનું હતું ? દેવ-ગુરુ-ધર્મની સાધના ખૂબ ખૂબ કરો, પરમાત્માનું મુખ પાંચ મિનિટ જોતાં હો તો દસ મિનિટ જુઓ, બે વાર જોતાં હો તો પાંચવાર જુઓ. ગુરુની જે સેવા કરતાં હો એમાં હિન્મતિદિન વધારો કરો. દાન-શીલ-તપ-ભાવના ધર્મમાં એવા રચ્યાપચ્યા રહો કે એમાં વૃદ્ધિ થતી જ જાય. વધારે ને વધારે અરિહંતનો જપ, નવકારવાળી, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય ધ્યાન વગેરે કરો. આવું કરશો તો જૈન માનવભવ સંઝળ થશે. બાકી તો અંતે મીઠું છે.’

સોમા ફૂલની માળા લેવા જાય છે :- શુદ્ધ સ્વરૂપમાં આત્મા બિલકુલ નિષ્પાંચ છે, નિષ્ઠપાય છે. છતાં આત્માની અનાદિકણતી જે કુપ્રવૃત્તિઓ છે, અનાદિકણના કષાયોનો જે કુઅભ્યાસ છે, તેના પરિણામે આવો સુંદર મનુષ્યભવ પ્રાપ્ત કરવા છતાં આપણામાં કામ-કોધાદિ એનું એ જ અનાદિકણથી ચાલી આવતું તોફાન કરે છે ! ત્યાં વિચારો કે ‘ગુરુસો કે દેખ કરવાનો મારો સ્વભાવ છે કે કુટેવ છે ?’ જેમ કોઈ કુળવાનનો છોકરો ઊંધા રસે ચઢી ગયો હોય, પણ હોય વિવેકી તો એ શું વિચારે ? “મારા કુળમાં આવા આડે માર્ગ ચાલવાનો રિવાજ છે ? ના, નથી. મારા પિતા, દાદા બધા સારા માર્ગ ચાલનારા અને પ્રતિષ્ઠાવાળા હતા. તો આ તો હું જ મોટો હુંગુણી મર્યો હું ને ?” શું છે આ ? એ સાવધાની કે આડા માર્ગ જવાની પ્રવૃત્તિ એ ઉચ્ચ-ભાનદાન કુળનો આચાર ન હોય. પરંતુ જીવ જો બાળપણથી બૂરી આદતોમાં સંડોવાઈ ગયો, તો પછી મોટો થવા છતાં એ બૂરાઈઓ કર્યે જ જાય છે. એવી જ રીતે આત્માની બાબતમાં વિચારવું જોઈએ કે “સિદ્ધશિલા પર અનંતા સિદ્ધ ભગવાનોના પણ આત્માઓ છે, તેમનામાં કોઈ પ્રાંચ કે કોઈ હુંગુણ ભુવનભાનુ અન્સાઈકલોપીયિા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

નથી; કેમકે એ પ્રાંચ કે હુંગુણ આત્માના અસલી સ્વરૂપમાં જ નથી ! પણ હું મારા આત્માની દશા જોઉં તો એ કેઈ જન્મોથી બૂરી આદતમાં ચાલ્યો આવે છે; તો હવે એ આદત ક્યારે ટળશો ?...” દુદ્રેવને આવો કોઈ જ્યાલ નહોતો. એણે તો ઘડામાં સર્પને પૂરીને, ઘડો અંદરના અંધારિયા ઓરાડામાં મૂકી દીધો હતો. એ સાંજ પડ્યે પત્ની સોમાને કહે છે કે “અંદરમાંથી જરા પેલી ફૂલની માળા લાવો ને. ઘડામાં મૂકેલી છે...” ભોળેભાવે સોમા તો બિચારી ગઈ અંદર, અને ઘડાનું ઢાંકણ ઉઠાવી લઈ તરત જ નિઃશંકપણે હાથ નાખ્યો અંદર !

સોમાને સર્પદંશ અને પતિનો દંબ :- સોમા કોણ છે ? અવધિજ્ઞાની અમરગુપ્ત મહર્ષિનો જીવ. એ જ અમરગુપ્ત આચાર્ય મહારાજ કહે છે, “ફૂલની માળા હાથમાં આવતાં મેં તો અંદરમાના સાપને હાથથી પકડ્યો ! પરંતુ એને પકડીને ક્યાં ઊભી રહી શકું ? સર્પે જોરથી મારા હાથ પર ઉંખ લગાવી દીધો. આખા શરીરે જણણણાટી વ્યાપી ગઈ; હાથ બેંચી લીધો, પણ આખા શરીરમાં જેર વ્યાપી ગયું. હું દોડતી પતિની પાસે પહોંચી ગઈ... બૂમ પાડીને કહ્યું “મને સાપે કરડી...” મારું શરીર કંપી રહ્યું હતું. અવાજમાં ખૂબ જ દર્દ હતું. આંખે ચક્કર આવતા હતા. ધબ દઈને પડી નીચે. પરંતુ પતિ દુદ્રેવ કે જેણે સમજી-વિચારીને જ આ કામ કર્યું હતું તેણે હોણા કરી મૂકી. ‘કોઈ સર્પનું વિષ ઉતારવાની કોશિશ કરે એ પહેલાં જ હું મરી જાઉં - એ માટે એણે ફોગટનો કોલાહલ મચાવી મૂક્યો. આ બાજુ ઝેરની ઘેરી અસરથી મારું શરીર શિથિલ પડી ગયું. આવું મકાન ચકર ચકર ફરી રહ્યું હોય તેમ મને દેખાવા લાગ્યું. અંદરના જ્ઞાનતંતુઓ-નસો વગેરેમાં એવી જ્ઞાલિમ પીડા શરૂ થઈ કે હું જમીન પર ઢળી પડી... એવી અસંઘ પીડામાં પણ એક મહાત્વની વાત એ હતી કે મેં સાધીજ મહારાજ પાસેથી જે સમકિત મેળવ્યું હતું, તેના પ્રતાપે શુભધ્યાનમાં મરીને પહેલાં સૌધર્મ દેવલોકમાં મારો જન્મ થયો. ત્યાં હું એક પલ્યોપમના આયુવાળો દેવ થયો.’

અહીં બે ત્રણ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવાની છે.

(૧) એક તો જગતમાં વિશ્વાસધાતની કેવી સુલભતા છે.

(૨) બીજું આવા કારમા, દુઃખની પીડા વખતે પણ મનમાં સમાધિ કેવી શક્ય છે, અને એનું કેવું ઊંચું ફળ છે !

(૩) ગ્રીજું, એવો મહાન ઉપકાર કરનારા સદગુરુની કેવી બલિહારી છે !

● ૧. વિશ્વાસધાત ●

વિશ્વાસધાતની સુલભતા :- પહેલું જુઓ દુદ્રેવે કરેલો વિશ્વાસધાત એના

મનુષ્યપણાને લજવનારો હતો. અપેક્ષાએ વિચારો તો વિશ્વાસધાતી પણ કરતાં પણ વધારે નીચ કોટિનો વિશ્વાસધાત માણસ કરે છે. બિલાડી અંધારામાં છૂપાઈ રહીને ઉદરને તાકે છે, ત્યાં ઉદર નિભયતા સમજ બહાર નીકળે છે અને બિચારો બિલાડીનો ભોગ બને છે ! પરંતુ અહીં એટલું છે કે બિલાડી ઉદરને એમ સમજાવવા નથી જતી કે આમંત્રવા નથી જતી કે તું ખુશીથી બહાર નીકળ અહીં તને સારો ખોરાક મળશે. અમે તો તારા હિતેથી હોઈ તને મારીએ નહિએ... આવું કાઈ બિલાડી ઉદરને સમજાવતી નથી. પરંતુ રુદ્રદેવે તો જાણે એવું સમજાવ્યું કે ‘હું તારો હિતેથી પતિ હોઈ તને મારું નહિએ;’ અને મોઢે કહ્યું કે ‘ધડામાં ફૂલની માળા છે તે લઈ આવ.’ બિલાડી અંધારામાં છૂપાઈ રહી છે ખરી, પણ ઉદરને તાણતી નથી. ઉદરને આવવું હોયતો પકડવા તૈયાર છે, પણ ન આવવું હોય તો કાઈ એના દરમાં પેસતી નથી. વળી ઉદર કદાચ બહાર નીકળે તો શંકા ય થાય કે રખેને અંધારામાં દુશ્મન હોય. અહીં તો રુદ્રદેવ સોમાને તાણે છે અને એટલી બધી દંભી બોલવાની ફબમાં વિશ્વાસ આપે છે કે સોમાને શંકા ખાવાનું સહેજે ય ન રહે. તો મનુષ્યપણાની જેટલી ઉચ્ચતા ગણાય એટલા પ્રમાણમાં બિલાડી વગેરે વિશ્વાસધાતની પ્રાણીઓ કરતાં ય વધુ નીચતા કેળવવાની ? પરંતુ માણસ જ્યારે સ્વાર્થની પ્રબળ લાલસાવાળો બને છે ત્યારે એને નીચતાનો કોઈ સીમાડો અને અફસોસ રહેતો નથી. એને એ ભાન નથી કે અનાદિના ભયંકર મેલા સંસ્કારોને ભૂસી નાખી મહાન પવિત્ર સંસ્કારોથી પવિત્ર ભાવનાઓથી અને પવિત્ર આદર્શોથી હૃદયમંદિરને શોભાવી દેવાનો આશમોલ અવસર અહીં મળ્યો છે. જગતના સંયોગો તો લોભાવનાર છે. ત્યાં ગુસ્સો, અહંકાર, ઈર્ઝા, વગેરે દુર્ગુણોમાં ફસાવું સહેલું અને સુલભ છે. એટલે વિશ્વાસધાતના પાપમાં પડવાનું સુલભ જ હોય ને ? માટે જ સંયોગોથી ચેતવાનું છે. રખેને એ આપણાને દુર્ગુણના ભોગ ન બનાવી જાય. સંયોગ તો કર્મના અનુસારે મળવાના. આપણો એ પુરુષાર્થ જગતો રાખવાનો છે કે એવા સંયોગમાં પણ દુર્ગુણને વશ ન બનીએ. દિવસની ચોવીસેય કલાકની જીવન-ચર્ચામાં આટલું સાચવ્યે જઈએ કે સંયોગો ગમે તે વર્તો, પણ આપણે કોધ, ને ઈર્ઝા, ને રાગ, ને તૃષ્ણા, ને પ્રપંચ... એવા એવા દુર્ગુણોને આપણા મનમાં પણ હવે જરાય સ્થાન ન આપીએ. સંયોગો ગમે તે વર્તો, પણ હવે આવા ઉચ્ચતાની ટોચે આવેલા માનવભવને પામીને અસત્ય, અનીતિ, દુરાચાર, કલેશ, કુસંપ, કુદ્રતા, સ્વાર્થધતા વગેરે દુષ્કૃત્યોને જરાય ન આચરીએ. શું ? તપાસ્યા કરજો જીવનમાં, આવું આવું મેલું ઓછું કરાય છે ? કે હજી વધારે ને વધારે મેલું ભેગું કર્યે જવાય છે ?

આત્માની ટકાવશક્તિ Power of Resisting :- દુર્ગુણો અને દુષ્કૃત્યોની

ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૩

સંસ્કારધારાનું કહ્યિંગ કરવા માટે, એ ધારાને કાપવા માટે માનવ અવતાર એ સુવર્ણ અવસર છે. તમે તો આત્માનું મહત્વ સમજતા લાગતા નથી. એનામાં અજબ રેઝિસ્ટ્રીંગ પાવર છે ! સોનું હોય છે ને ? તેની આગળ અભિના તાપ ગમે તેવા મૂકો, પણ જાંખું પડવાની કે નાશ પામવાની વાત નહિ. પાણીમાં કે માટીમાં એને એક હજાર વર્ષ દાટી રાખો, છતાં જરાય કોહવાટ, ઘસાવાની કે બગડવાની વાત નહિ. કેમ વાંદું ? એનામાં અંગ્રેજમાં જેને રેઝિસ્ટ્રિંગ પાવર (Resisting Power) કહે છે, અર્થાત્ વિરોધી સંયોગોની સામે ટકવાની શક્તિ જે કહેવાય છે, તે હોય છે. કુદરતના એવા ઘણા પદાર્થોમાં ઘણી જતની ટકવાની શક્તિ હોય છે. એવી રીતે આપણા આત્મામાં કોધ-અભિમાનાદિ દુર્ગુણો અને અસત્ય-અનીતિ આદિ દુષ્કૃત્યોની સામે કે એના સંયોગો સામે રેઝિસ્ટ્રિંગ પાવર યાને ટકાવશક્તિ છે કે જેથી આત્મામાં વિકાર ન થાય. પરંતુ એ શક્તિ ખીલવવાની છે. સંયોગો ચાચ્ય તેવા હોય પણ એ આપણા આત્મામાં દોષોના વિકાર (બિગાડો) ઉત્પન્ન ન કરી શકે, એટલું મન પાંકું કરવાનું છે. મુંજાશો નહિ કે દુર્ગુણ અને દુષ્કૃત્યો નહિ સેવીએ તો આપણે લુંટાઈ જ જઈશું ! તો આપણાં બધું નાશ પામી જશે ! તો મહાન દુઃખમાં પડી જઈશું ! આવો આવો ભય રાખશો નહિ. ત્યાં પુણ્ય-પાપના ડિસાબ ઉપર શક્તા રાખજો; ધર્મસાધનામાં આગળ વધવાથી પાપો તૂટી જ રહ્યા છે અને પુણ્ય વધી જ રહ્યું છે, એનો અટલ વિશ્વાસ ધરજો. પણી આ ટકાવ-શક્તિથી ગમે તેવા સંયોગોમાં જરૂર દુર્ગુણ-દુષ્કૃત્યોને અટકાવી શકશે.

વિશ્વાસધાત કેમ સુલભ ? :- આપણી વાત ચાલતી હતી વિશ્વાસધાતની, એની સુલભતાની. વિશ્વાસધાત એવી ખરાબ વસ્તુ છે કે (૧) એમાં કેઠ સુધી સામાનો સારાપો લઈ શકીએ અને છતાં વિશ્વાસધાત આચરી શકાય ! જ્યાં સારાપો મળે એવી સ્થિતિમાં અનાથી પાછા હઠવું કેટલું બધું મુશ્કેલ ! (૨) બીજી ખરાબી એ, કે એને આચરવા પહેલાં કેટલાય દીર્ઘ કાળથી હૈયું મેલું ઘાણ બનતું જ આવે. એનું ફળ ? અતિ દીર્ઘ ભવિષ્ય સુધી એ દુઃખો અને પાપો આપ્યા કરે ! ત્યાં એમ થાય કે બિલાડા-વાધ જેવા કુરૂ પશુઓ એને આચરે એ સહજ છે, કેમકે એને વિશ્વાસધાતની ખરાબીની ખબર નથી; પણ હું તો સમજદાર, તો અવશ્ય વિશ્વાસધાત ન કરું. રુદ્રદેવે મનુષ્ય ભવમાં કરેલો વિશ્વાસનો ઘાત, નરક અપાવ્યા પછી, હવે પોપટના ભવમાં પાછો એ દોષ સેવરાવે છે. એટલે ફરી પાછું સોમાના જીવ હાથી પર્યે રુદ્રદેવના જીવ પોપટને વિશ્વાસધાત કરવાનું મન થયું. જો જો કે અહીંય એ કેટલો ભયંકર વિશ્વાસધાત અજમાવે છે. હવે તો આ તિર્યં પંખી છે, એને પૂર્વનું કંઈ યાદ નથી, છતાં અજ્ઞાનપણે હાથીને ફસાવવા પ્રેરાય છે. પણ

૪

ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“વિશ્વાસધાત” (ભાગ-૨૨)

માણસ જેવા માણસ જે સજ્ઞાન અને સમજુ ગણાય, તે ભયંકર વિશ્વાસધાત અને ખૂન કરવા તૈયાર થાય ત્યારે કેટલી હુંખદ સ્થિતિ ! વર્તમાનકાળે બનેલો એક પ્રસંગ છે.

● વર્તમાનમાં વિશ્વાસધાતનો બનેલો એક કરૂણ પ્રસંગ ●

એક મોટા શહેરમાં એક કુટુંબ રહે છે. કુટુંબમાં ત્રણ માણસ-પતિ,-પત્ની અને એમની એક પુત્રી. ત્રણેય જણા લાયક માણસ હતા. પુત્રી મોટી થઈ અને દૂર દેશમાં પરણાવવામાં આવી. બાપ કાંઈ લાખોપતિ નહોતો. છતાં પાસે બે પૈસા ઠીક હતા; એટલે મનને એમ થયું કે ‘આય છેવટે છોકરીને જ આપીને જવું છે, તો લાવને અત્યારે ય એને થોડું ઘણું આપીએ.’ એમ વિચારીને બાપે રૂપિયા પચીસ હજારના દાંગીના છોકરીને આપ્યા.

અહીં જ તમને પ્રશ્ન કરવામાં આવે કે બાપે આ ઉદારતા કરી તે સારું કર્યું ને ? બીજું, છોકરીનાં ભાગ્ય ઉઘડી ગયા ને ? તો આ બે પ્રશ્નનો ઉત્તર હકરમાં જ આપો ને ? કારણ ? તમે તો તત્કાલ લક્ષીના સુખ જેનારા છો. તમને ક્યાં ખબર છે કે કેટલીય વાર એ લક્ષી જ અનર્થ મચાવે છે ? લક્ષીથી અનર્થ મચ્યા પછી એમ થાય છે કે આના કરતાં લક્ષી ન આપી હોત કે ન મળી હોત તો શું ખોટું ? ડહાપણ એટલું હોવું જોઈએ કે આ વિચાર પહેલેથી આવવો જોઈએ. બાપ ઉદારતા કરવા ગયો, પરંતુ બાપને ખબર નથી કે આના જ યોગે ભાવિ કેવું ભયંકર રચાવાનું છે ! માણસોના ધાર્યામાં શું છે ? એના ધાર્યા મુજબ શું બને છે ? એ તો ફોગટનો પોતાના હાથની, પોતાના કાબુની જે વસ્તુ નહિ, એવી વસ્તુ પાછળ મુખ્યાદીથી અસત્ય, અનીતિ, કલેશ, કંકાસ, વગેરેના ઘોર પાપ આચરે છે.

પતિને કથ્ય :- છોકરી સાસરે રહી છે. ત્યાં થોડા જ વખતમાં એના પતિને કથ રોગ લાગુ પડ્યો. જુઓ કર્મની કઠણાઈ ! માબાપ જાણે કે છોકરીને પરણાવીને સુખી કરી દઈએ ! ત્યારે ભીતરના કર્મ જૂદું જ કાર્ય કરે છે ! આ જગતની આવી વિચિત્ર ઘટનાઓ સૂચવે છે કે તમારા હાથનું તમે બધું ભલે શોભાભર્યું કર્યું હોય પરંતુ કર્મના કોપ આગળ તે બધું જ રદ-બાતલ છે. એટલે સમજ્યા ને ? છોકરીને સંસારના કાર્યમાં બરાબર હોશિયાર બનાવતા હો, એ માટે ક્રમસર દિનપ્રતિદિન કેળવણી આપીને વર્ષો સુધી બરાબર ઘડતા હો; પછી મુરતિયો (વર) શોધવામાં બરાબર ચોકસાઈ રાખી ચારે કોર તપાસ કરી હોય,-આજ તો તમારે વર શોધવાની જરૂર નહિ, છોકરાછોકરી જ પસંદ કરી લે છે; કેમ ? બેર ! પણ લગ્ન તો તમારે જ કરાવવા પડે છે ને ? એમાંય લજનવિધિની નાનામાં નાની બાબતથી માંડી

મોટમોટી બાબત સુધીનું તમે સારામાં સારું સાચવ્યું હોય; કેમ એમ ? કારણ કે અહીં તો તમે માનો છો કે “બધું શોભાભર્યું થવું જોઈએ; આવા ટાણાં કાંઈ વારે વારે નથી આવતા. એક પણ વસ્તુ એવી ન થવી જોઈએ કે લોકનો કે વેવાઈનો અપજશ મળે.” તે ક્યાં સુધીનું સાચવો ? “જાનૈયાને પાણી આપવાના પવાલાં પણ સારાં ચક્યકાટ ઊજળાં જોઈએ... છોકરીને કપું-લતું ઘરેણું ભલે કદાચ આપણું તેટલું ગરું ન હોય તો દેવું કરીને ય પણ સારું સુંદર આપવું જોઈએ.” ઠેઠ ગર્ભથી માંડી અહીં સુધીની તમે આવી બધી ચોકસાઈ રાખી હોય, છતાં આ બધું કર્યા-કારવ્યાના માથે કોપેલાં કર્મ શું કરે છે ? એકો કલમે છોકરીને ભયંકર રોગ ! કસુવાડ ! પહેલી સુવાડમાં ગંભીર સ્થિતિ ! પતિનો દ્વેષ ! સાસુ માથાભારે ! નણંદનો ગાસ ! જેઠાણી-દેરાણી ઝગડાખોર ! પતિને ભયંકર રોગ ! ધંધો ખતમ ! દેવાળું !... સંસારમાં આવું આવું કેટલું ? આમાં ફેરફાર નથી ને ? ફેરફાર હોય તો કહેજો.

સંસારવ્યવહારના પ્રસંગમાં શિખામણ :- ફેરફાર જો નથી તો આમાંથી કાંઈ શિખામણ લઈ શકો છો ? શિખામણ લેવા જેટલું ભેજું છે કે નહિ ? શું ખર્ચમાં મફતના તૂટી મરવાનું કે દેવું કરવાનું ડહાપણભર્યું છે ? પ્રસંગ કરીને મેં બીજી કરતાં બહુ સારું કર્યું એમ ફુલાઈ મરવાનું કાર્ય સારું નહિ એમ નથી લાગતું ? આધ્યાત્મિક શિક્ષા આપવાની અગત્યની બાબતો ભૂલીને પવાલાં ચક્યકાટની ફાસકુસી વાતોમાં અટવાઈ મરવાનું, આંગણો આવેલાને આપણા જૈનપણાનો કોઈ ભાસ ન કરાવતાં આપણું જગતનું ડહાપણ દેખાડવાનું... વગેરે વગેરે તદ્દન ખોટું છે, એવું સમજાય છે ? અરે ! આગળ વધીને શું એ વિચારવું જરૂરી લાગે છે કે જ્યારે મારી બધી મહેનત પર કર્મ પાણી ફેરવી નાખે એવો સંશય છે, તો લાવ એના કરતાં છોકરીને એકલા અધ્યાત્મમાર્ગ કાં ન વાળું ? ચારિત્ર માર્ગ કાં ન દોરું ? આમેય છોકરી ક્યાં મારું ધન છે ? ક્યાં એ મારી સેવા કરવાની છે ? ત્યારે એની પાસે પારકાની વેઠ અને પારકાની ગુલામી કરાવવા કરતાં પરમાત્માની વેઠ ગુલામી ન કરાવું ?

તમારા માનેલા ભગવાન માટે તમારું શું સમર્પિત છે ? :- ત્રણ ખંડના રાજાધિરાજ કૂષ્ણો આ વિચાર્યુ હતું. કહો જો એની છોકરીઓ કેવી ? ગોરી ગુલામી અને સુંવાળી ? કે ભીલણ છોકરીઓ જેવી કાળી અને જાડી ચામડીવાળી ? દેવાંગના જેવી ને ? એને ક્યાં મોકલી કૂષ્ણવાસુદેવે ? પોતાના શ્રી નેમિનાથ ભગવાનના શરણે સાધીપણામાં ! તમારે પણ ભગવાન છે ને ? ભગવાન તમારા છે કે ભગવાન ત્રાહિત છે ? તમારા માનેલા ભગવાનને તમારું શું સમર્પિત છે ? સંસારને

જો બરાબર ભીતરથી જોતાં-ઓળખતાં આવડે તો તમારી પાસે ભગવાનને અર્પિત કરવાનું ધણું હોય. આ તો તમારી દયા આવે એવું છે કે સંસારમાં તમે ખોટા તણાઈ મરી અંતે પાણી મૂર્ખા બનો છો ! બધું તમે મનમાનું કર્યા ઉપર જ્યારે કર્મ ઉંધું વાળે છે ત્યાં પછીથી જિંદગી સુધી તમે રોચા કરો છો ‘હાય ! હે ભગવાન ! શું થયું આ ?’ એની દયા આવે છે.

છોકરો મરે તો દાગીનાનું શું ? :- ચાલો પ્રસ્તુતમાં. છોકરીના પતિને કષ્ય લાગુ પડ્યો. એ એવો વધતો ચાલ્યો કે ડોક્ટરોએ લગભગ આશા મૂકી દીધી. ‘કુદરત બચાવે તો બચે.’ એમ કહી દીધું. એમને પૂછો કુદરત શું ચીજ છે ? કુદરત શું બચાવતી હતી ? એના પુણ્ય બચાવે તો બચે. પણ આજની કેળવાડીવાળાને પુણ્ય-પાપ ક્યાં માનવા છે ? જો માને તો પોતાના જીવનમાં દેવ-ગુરુ-ધર્મ ભૂલે ? સુકૃત ભૂલે ? આત્માના ગુણો ભૂલે ? એ હદ્દયના કઠોર, લોભી, ઈર્ઝાળું અને નાસ્તિક બને ? છોકરાના ક્ષયની આખરી સ્થિતિ જાણી માબાપ વિચારે છે કે ‘હવે પ્રાયઃ છોકરો મરી જવાનો; એની વહુ એના બાપના ઘરે જવાની; તે પચીસ હજારનો દાગીનો લઈને જવાની. હવે શું થાય ?’ દાગીનો કોણે આપેલો ? છોકરીના બાપે ને ? શા માટે આપેલો ? છોકરીનું ભલું કરવા ! હવે જુઓ ભલું થાય છે કે ભંડું ? સાસુ-સસરા વિચારે છે કે ‘છોકરો મરે તો દાગીનાનું શું ? માટે એવું કાંઈક કરવું જોઈએ કે દાગીનો આપણને પચી જાય.’

દાગીનો પચાવવા શું કરવું ? :- વિચારો કે છોકરો મરે એનું, અને નાની વહુ વિધવા બને, એનું હુંઅ ક્યાં છે ? દાગીનાનો લોભ લાગ્યો છે ! આ તમારો બુદ્ધિપૂર્વક પકડી રાખેલો સંસાર ને ? બુદ્ધિપૂર્વક નહિ પણ મૂર્ખતાથી પકડ્યો છે, એમ જો સાચેસાચ માનતા હો તો કમમાં કમ એવા સંસારી જીવનમાં દોષ અને દુર્ગુણોને તો જરૂર દૂર રાખો; કલહ અને કપટને નવગજના નમસ્કાર કરો. છોકરાના માબાપને પચીસ હજારની લક્ષી પચાવવી છે ! પણ તે એમને એમ પચે એવું લાગતું નથી. કદાચ ધૂપાવી દે, તોય બાપ છોકરીને આગળ કરીને ચાર જણાની સાક્ષીએ દાગીનો માગે ! તો શું જવાબ દેવો ? એટલે આ છોકરાના માબાપ વિચારે છે કે ‘છોકરાની વહુ જો મરી જાય તો પછી એનો બાપ શું માગવા આવવાનો હતો ? તે કાંઈ એમ મરે ? રોગી નથી એ. તો કાંઈ જાતે મરે એવી નથી. ત્યારે શું ઝેર અપાય ? તો તો પોલીસ જ ઘૂસે ને ? ગમે તેમ પણ વહુને મારી તો નાખવી જ.’ એવા ફૂર વિચાર સુધી એના સાસુ-સસરા પહોંચ્યા !

કેવી કમનસીબી ! બાપની ઉદારતા છોકરીના ભલા માટે ? કે, ઉલટું મોત માટે ? મોત પણ જેવું તેવું નહિ, કરપીણ ! કોના હાથે ? આર્યના હાથે ! પૈસા ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેશિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

ખાતર ને ? પૈસા શું કરાવે ? ધર્મ કે પાપ ? છોકરીને આપેલા પૈસાથી છોકરીએય પુણ્ય કર્યાનો લાભ લીધો ? ના, ક્યાંથી થાય ? એના પર તો જીવનની આશા બાંધી હોય. રખેને ધર્ષણી મરી જાય, કે દેવાળું કાઢે, કે અળખામણી કરે... તો પલ્લાના પૈસાથી જીવન નભે; -એવી આશા છે. પણ ખબર નથી કે એજ પલ્લું કરપીણ મોતનું પલ્લું પકડાવે છે ! સાસુ-સસરાએ છોકરો મરે એ પહેલાં વહુને પૂરી કરવાનો ઉપાય ઘડી કાઢ્યો ! શો ઉપાય ? વહુને ઘાસલેટ છાંટી બાળી નાખવાનો ! પણ તે એવી સિફતથી કે જાણો રસોઈમાં હતી ને આગ લાગી; અગર તો પતિના રોગથી ગભરાઈને ખાનગીમાં આત્મહત્ત્યા કરવા જતા બળી મરી. ઉપાય ઘડ્યો એટલું જ નહિ પણ અમલમાં મૂક્યો ! એમના વિશ્વાસમાં રહેલી એ વહુને એવી ફસાવી કે એ સહેલાઈથી અને બીજા ન જાણો એ ફબે આમના પ્રપંચનો ભૂગ બની ! આમણો એને ખાનગીમાં જીવતી સળગાવી મૂકી લોકોને ગંધ આવી હશે, પણ અહીં તો ક્યારનીય વહુ ભયંકર રીતે સળગી મરી. લક્ષીરૂપી નાગણે એના પ્રાણ ઓવરાચ્યા ! એના માબાપની જાણમાં આ આવી ગયું, પણ ‘હવે દૂર દેશમાં જઈ વેવાઈ ઉપર શા કોરટ કાગળિયાં કરવા ? છોકરી તો ગુમાવી. હવે વહુ કાંઈ કરવા જઈએ અને એમાં નથી ને વેવાઈનો ગુનો સાબિત થાય તો મારી નાખવાની સજા તરીકે એને શું ય મળે ?’ -એમ વિચારી વહું પાપ ન કરવાના રથી ને વહુ જગડામાં ન ઉત્તરવાના હિસાબે એ દિકરી ગુમાવ્યાનું દુઃખ મનમાં રાખીને બેસી રહ્યા. આ પણ એક મહાન ગુણ છે કે જૂનાં પાપ ઉપર નવાં પાપ ન કરીએ ! આપણો પ્રસંગ વિશ્વાસધાત ઉપર હતો. સાસુ-સસરાએ વિશ્વાસધાતમાં રહેલી વિનયી વહુને ફૂર રીતે બાળી નાખી. કેવી ભયંકર પિશાચી લીલા ! કેવો ધોર વિશ્વાસધાત !

● ૨. સમાધિની સુંદરતા ●

ત્રણ બાબતો જોવાની હતી. એમાં એક વિશ્વાસધાત અંગે વિચાર્યુ. બીજી બાબત છે ચિત્તમાં ધર્મસમાધિ રાખવાની અને એનાં કેવા સરસ ફળ, તે અંગેની.

સમતા અને સમાધિ :- સોમા ઉપર રુદ્રદેવે વિશ્વાસધાત કરી સર્પનો ઊંસ કરાયો. છતાં સોમાએ સારી સમાધિ રાખી ! એના બદલે જો એ અસમાધિમાં પણ હોત, હાય-વોય અને ગુસ્સામાં ચઢી હોત તો દેવલોકમાં જવાનું ન બનત. મહાસતી મદનરેખાએ પણ કમોતે મરતા પતિને સમાધિ આપી બચાવી લીધો. ત્યારે વિચારો કે એવા મરણાંત જેરના કષ્ટ વખતે પણ એણે સમાધિ કેવીક ટકાવી રાખી ! શું સમાધિ એટલે ? ચિત્તને આકુળ-વાકુળ ન થવા દેવું તે સમાધિ. આત્મા કષાયપરવશ

ન બને તે સમતા. ચિત્ત દુર્ધર્યાનપરવશ ન થાય તે સમાધિ. આત્મામાં રાગ કે દ્વેષનું વલણ ન થાય તે સમતા; અને મનમાં અમૈત્રી રીસ, વૈર, અકરુણા (કઠોરતા, નિર્દ્દયતા) ઈર્ધા, વગેરેની ભાવનાઓ ન ઉઠે તે સમાધિ. સોમાએ એ જાળવ્યું. પતિ દુદ્રેષ્વ પ્રત્યે વૈર, રીસ, કઠોરતા કે દુર્ધર્યાન ન ઉઠવા દીધું. શાના પ્રભાવે? ધર્મના. ધર્મનો કેવો મહાન ઉપકાર !

સમાધિનો ઉપાય :- ધર્મ અને સમજ આપી હતી કે,

(૧) આપણને જે દુઃખ આપત્તિ આવે તે આપણે જ કરેલા પાપે. ત્યાં બીજાનો વાંક કાઢીએ, તે ખોટો. હજુ પણ જો દુઃખ નથી જોઈતું તો પાપ કરવાનું બંધ કરો.

(૨) બીજું એ કે ભાવી મિથ્યા થઈ શકતું નથી. તો એમ સમજો કે અત્યારે દુઃખનું ભાવી છે.

(૩) ત્રીજી વાત એ કે ધર્મ એ એક મહાન અભ્યાસ છે, એમાં પરીક્ષા આપીએ ત્યારે પાસ થઈએ. તો દુઃખ આપત્તિ એ પરીક્ષા છે. એમાં સમાધિધર્મ, સમતાધર્મ ટકાવીએ તો પાસ થવાય. અર્થાત્ આત્મામાં એટલું બળ પ્રગટ થયું ગણાય કે દુઃખની સામે એ હવે ઊંચોનીયો નહિ થાય.

(૪) ચોથી વસ્તુ એ કે આ દુઃખ સમભાવે સહી લેવામાં આપણું જૂનું દેવું રદ થાય છે, નવું દેવું ચટટું નથી અને ઉપરથી સમતાના મીઠાં પુણ્યફળ કમાવાય છે.

(૫) પાંચમી વસ્તુ એ કે આપણા દેવાધિદેવ અને અન્ય મહાપુરુષોએ પોતે દુઃખ સથ્યાં જ છે, પણ સામે ફરિયાદ કે હાયવોય નથી કરી; તો આપણે એમના સાચા સંતાન હોઈએ તો એ રૂએ પણ સમતા-સમાધિથી સહી જ લેવું ઘટે.

(૬) આત્માનું મોકષનું સ્વરૂપ અનંત સમતા-સમાધિનું છે. એનો જેને ખ્ય છે, એ અવસર આવ્યે મામુલી સમતા-સમાધિ તો કેમ જ ગુમાવે?... વગેરે વગેરે સમજ પામેલી સોમાએ સર્પદંશની ઘોર પીડામાં પણ સમાધિ જાળવી. તો એનું ફળ પણ કેવું મહાન ! માત્ર દેવલોક નહિ પણ પછીના જન્મોમાં સમાધિની સુંદર ઝીલવટ, ઉચ્ચ ઉચ્ચ સ્વર્ગની પ્રાપ્તિ, અને હમણાં અવધિજ્ઞાન ! આ બીજી બાબત થઈ. ત્રીજી બાબત છે સદ્ગુરુની બલિહારીની.

● ઉ. સદ્ગુરુની બલિહારી ●

સોમા જે સમાધિ અને એનાં મીઠાં ફળ પામી એનું ખરું કારણ એને જે ગુરુણી સાધ્યીજ મહારાજ મળ્યા તે છે. ગુરુણીએ જન્મે આ જૈન નહિ, એવી ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈયુ કહા.” (ભાગ-૨૨)

૯

સોમાને સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવના ભાખેલાં સત્ય તત્ત્વોની પ્રેમી બનાવી દીધી. સંસાર અને વિષયોની રસિક એવી સોમાને એની અરસિક, વિરાગિણી તથા મોકષરસિક બનાવી દીધી. અનંત કાળથી એનું છૂપેલું આત્મહીર-આત્મનૂર પ્રગટ કરાવી આપ્યું અને એથી સોમાં હવે જગત પર દમન નહિ પણ પોતાની પાશવી વૃત્તિઓ ઉપર દમન કરવા સમર્થ બની; જગતને નહિ પણ જાતને જોનારી બની. આવો મહાન, અતિ મહાન ઉપકાર કરનાર સદ્ગુરુની બલિહારી ! ભલે જીવની યોગ્યતા અને પુરુષાર્થ પણ મહાન કારણ છે; કિન્તુ અહીં જન્મ્યો ત્યારથી જીવ તો એ હતો જ, ઉદ્ય નહોતો થયો, આત્મપરાવર્તન નહોતું થયું, તત્વદર્શન નહોતું થયું, કેમ વારું ? સદ્ગુરુ મળ્યા નહોતા. સદ્ગુરુ મળ્યાથી લાઈન બદલાણી, અવસ્થા ફરી; અને જડપી ઉદ્ય શરૂ થયો, એ ગુરુની જ બલિહારી કહેવાય. ગુરુતત્ત્વના આલંબને સોમામાં આગળ વધતાં વધતાં સર્પ-દંશની મરણાંત પીડામાં સમાધિ જાળવવાનું મહાન બળ આવ્યું.

ગુરુ કેવા જોઈએ ? :- ત્યારે આપણી પાસે આજે સદ્ગુરુઓ છે કે નહિ ? ધ્યાન રાખજો કે એને ગુરુ ગૌતમ સ્વામી નહોતા મળ્યા; પણ શુદ્ધ માત્ર મોકષમાર્ગ અને જિનોકંત તત્ત્વનો જ ઉપદેશ દેનાર આચાર સંપન્ન ગુરુણી જરૂર મળ્યા હતા. તો આજે શું એવા ગુરુ દુર્લભ છે ? આજે કેટલાકને જીવનમાં કરવું કંઈ નહિ, અથવા થોડું ધ્યાનું કદાચ કરનાર હોય, પણ જે વિદ્યમાન ગુરુઓની સાધુ-સાધ્યીઓની નિનદા કરવાની અને એમના દોષો જોવાની કુટેવ પડી છે તે બહુ ભ્યાનક છે; પોતાના જ આત્માને, છતે તરવાના સાધને, ડુબાડી રહી છે, ભવસાગરમાં રૂલવાની સગવડ આપી રહી છે ! ખરી રીતે તો સદ્ગુરુ એટલે કે શુદ્ધ આચાર-પાલક અને શુદ્ધ ધર્મ-પ્રરૂપક ગુરુ મળ્યા પછી જરાય વિલંબ કર્યા વિના એમનો ભેટો સફલ બનાવી દેવો જોઈએ. સોમાએ ગુરુણીની પહેલી મુલાકાત અને દેશનામાંથી જ આત્મા પલટ્યો, જીવન ફેરબ્યું, ધર્મ પુરુષાર્થ જગાબો, ધર્મશ્રદ્ધા અને ધર્મસમજ આત્મામાં ત્યાં જ વહી લીધી ! આ કર્યું એનું જ નામ ઉદ્યકાળ જાગ્યો. આજે તો દંભી માનવને આમાનું કાંઈ કરવું નથી અને કહેવું છે કે ઉદ્યકાળ જાગ્યો નથી તેથી ક્યાંથી આ બને ? અરે અજ્ઞાની ! સમજતો જા કે તું સન્માર્ગનો આત્મહિતની વસ્તુનો શ્રદ્ધાળું બન, સમજદાર બન, પુરુષાર્થ કરનારો બન તો ઉદ્યકાળ જાગશે. ઉદ્યકાળ કાંઈ આકાશમાંથી નથી પડતો. એ તો પાકી ગરજ અને પુરુષાર્થથી જાગે છે. ગુરુ મળ્યાથી આ બને છે. ગુરુનો અનંત ઉપકાર છે.

આપણા બળની સાર્થકતા શી ? :- સોમાને દેવપણું મળી ગયું. ત્યાં જઈને જોયું હશે કે પોતાનો પૂર્વ ભવ કેવો હતો ? અવધિજ્ઞાનથી જરૂર દેખાય હોય. ૧૦ ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“સદ્ગુરુની બલિહારી” (ભાગ-૨૨)

કે પતિએ વિશ્વાસધાત કરી સર્પ કરડાવ્યો. તો હવે એને શિક્ષા કરવી જોઈએ કે નહિ ? આપણી પાસે જો બળ છે, શક્તિ છે, તો એમ થાય છે કે ગુનેગારને શિક્ષા ન કરીએ તો પછી બળની સાર્થકતા શી ? બળ શા કામનું ? પણ અહીં એ જુઓ કે બળ બે પ્રકારનું હોય છે, એક માનવી બળ અને બીજું પાશવી બળ.

પાશવી બળનો ઉપયોગ બીજાના પર આકમણ કરી વિજય પ્રાપ્ત કરવા માટેનો;

માનવી બળનો ઉપયોગ પોતાના જ દુષ્ટ આત્મા પર શાસન ચલાવી વિજય મેળવવાનો.

બીજા પર શીરજોરી કરવી, બીજાને દબાવવા, બીજા પર હલ્લા કરવા, બીજાને પીટવા... એ પાશવી બળ છે. જ્યારે આત્માની ઈન્દ્રિયો, ને મન પ્રત્યેની શુલામી તથા કષાયાધીનતા અને સ્વચ્છંદતાને કાબુમાં લેવી એ માનવીબળ છે. એવા માનવી બળનો ઉપયોગ મહાવીર પ્રભુએ કર્યો, તે ભગવાન બન્યા ! તો કેવળજ્ઞાન અને મોક્ષ પાંચ્યા !

પાશવી બળ :- ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં બળનો પાશવી ઉપયોગ કર્યો હતો તો સાતમી નરકમાં જવું પડ્યું ! પછી પણ જ્યાં સુધી પાશવી બળનો ઉપયોગ કરતાં રહ્યાં ત્યાં સુધી સંસારમાં ભટકતા રહ્યા ! કર્મસત્તાને તીર્થકર દેવના જીવની પણ શરમ નથી નડતી. જો પુષ્યે દીઘેલા બળનો પાશવી ઉપયોગ કરો, તો ભવાટવીમાં ફરા ફરો. નરકમાંથી નિકળીને સિંહ થયા. ત્યાં પણ શું ? આજ પાશવી બળ પર ઉજાણી કરવાની ! તો ત્યાંથી ચાલો પાછા નરકમાં ! વીરના આત્માને કર્મ ચોથી નરકમાં તાણી જાય છે. પછી છૂટકો ખરો ? ના, પાછા રખડો સંસારમાં ! કેટલું રખડ્યા ? તેનો હિસાબ નથી મળતો. કવિ કહે છે,

“વીસમે ભવે થઈ સિંહ, ચોથી નરકે ગયા;
તિહંથી ચ્યાવી સંસારે ભવ બહુલા થયા...”

માનવી બળ :- જ્યારે એ જ પ્રભુ શ્રી વીરે માનવી બળનો ઉપયોગ જે ‘પોતાના આત્માને દબાવવાનો’ છે, તે પોતાના નંદનજ્ઞનિના ભવમાં કર્યો. શો ઉપયોગ ? એક લાખ વર્ષ ચારિત્ર ! એક લાખ વરસ સુધી લાગલાગટ માસખમણના પારણે માસખમણનો ઘોર તપ ! જરાય ઓછી વાત નહિ ! તો શું પરિણામ આવ્યું ? તીર્થકર નામ કર્મ નિકાયું. છેલ્લા ભવમાં તો માનવી બળનો સદૃપ્યોગ પરાકરણનો ! ખુદ આ જન્મ વિરાળી છતાં ત્રીસ વર્ષની વયમાં ચારિત્ર લઈ નીકળી પડ્યા ! પછી જે ઉપદ્રવો આવ્યા, -દેવ, તિર્યચ કે મનુષ્ય તરફથી, તેની સામે અદ્ભુત, આદર્શ, અતિ અનુકરણીય સહિષ્ણાતાનું માનવી બળ વાપર્યું ! તો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

હુર્જનનું સહી લેવામાં શું ગુમાવ્યું ? એ કરતાં કરતાં ધાતીકર્મનો નાશ કરી નાંખ્યો ! અને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બની ગયા !

ગુણો જ ગુણો ? કે ભૂલો જ ભૂલો ? :- હવે એ કહો કે આપણે શું શું કરી રહ્યા છીએ ? આપણામાં બળ છે, શક્તિ છે, તો શું જગતને દબાવીને એ બતાવી દેવું જોઈએ ? આખા જગતની ભૂલ હોય તો બધાને આપણે દંડ કરવા તૈયાર છીએ. પરંતુ આપણી પોતાની ભૂલ હોય તો ? ત્યારે શું એમ કહો છો કે ભૂલો નથી દેખાતી આપણા જીવનમાં ? જન્મથી માંડીને મૃત્યુ સુધી જુઓ કે શું ચાલે છે જીવનમાં ? ગુણો જ ગુણો ? ભૂલો જ ભૂલો ? માનવી બળનો ઉપયોગ આપણી ભૂલો સુધારવા આપણા આત્મા પર નિગ્રહ કરવાનો છે. અહીંયાં સૌર્ધમ દેવલોકમાં સોમાનો જીવ દેવ તરીકે થયો છે; જ્ઞાન થયું છે. પાસે દેવી શક્તિ છે. દિવ્ય બલ છે. પરંતુ એનો પાશવી ઉપયોગ કરી પતિને કયરવો નથી. સજજને દુર્જન સામે બદલા શા લેવાનાં ? એના પાપ જ એને દંડ કરશે. આપણે દંડ દેવાની જરૂર નહિ.

રુદ્રદેવ નરકે :- ત્યારે હવે રુદ્રદેવનું શું થયું ? તે પણ જોવું પડશે ને ? એને તો લાગે છે કે વચ્ચમાંથી સોમારૂપી એક કાંઠો ઉખડી ગયો ! ઠીક થઈ ગયું ! લોકોને કંઈ ખબર ન પડી કે કેવા પ્રપંચનો ભોગ બની. સોમા મરી ગઈ. એમણે તો ઉપરથી જાણ્યું કે સાપે એને કરીની, અને એ મરી. રુદ્રદેવે નાગશ્રી સાથે લગ્ન કર્યા. નવી પરણેલી પત્નીની સાથે એટલા રંગરાગ અને ભોગનાં પાપ કર્યા; તેમ પૂર્વનું વિશ્વાસધાતનું એવું ભયંકર પાપ કર્યું હતું કે એ મરીને પહોંચ્યો ૧ લી નરકમાં ! થોડાં કાળ માટે પ્રપંચ, વિશ્વાસધાત અને તૃષ્ણા તથા રંગરાગની મનમાની રમત જીવ કરી લે છે, તો એનું પરિણામ શું ? અને થોડા કાળ માટે ધર્મનો સ્વીકાર કરી લીધો. તેમાં કદાચ કોઈનો ઉપદ્રવ આવ્યો અને તેને સમ્યગ્ર રીતે સહન કરી લીધો, તો શું તકલીફ અને કેવું ઊંચું પરિણામ ? તકલીફ શાની ? હિનામ ! જાઓ દેવલોકના ભવમાં એક પદ્યોપમના દેવતાઈ સુખભોગ ભોગવો !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૦, તા. ૮-૪-૧૯૫૫

ત્રીજા ભવે હાથી-પોપટ :- રુદ્રદેવનું નરકનું આયુષ્ય અને સોમાનું દેવલોકનું આયુષ્ય પૂર્જ થઈ ગયું. પરંતુ સોમાદેવને ત્યાં કંઈક એવી ગફકલત થઈ ગઈ. આર્થિયાનમાં સોમાના જીવ તિર્યચનું આયુષ્ય બાંધી લીધું ! સમજજો કે આર્થિયાન પણ બૂરુ છે ! એના પરિણામે પૂર્વની ધર્મની સ્થિતિ છતાં દેવલોકમાંથી ચ્યાવીને

૧૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સદ્ગુરુની બલિહારી” (ભાગ-૨૨)

સોમાનો જવ એ જ વિજયમાં શુંશુમાર પર્વત પર શુંશુમાર જંગલમાં હાથીનો અવતાર પાખ્યો ! સાથે ભવિતવ્યતા જુઓ કે નરકમાંથી નીકળીને રુદ્રદેવનો-જવ પણ ત્યાંજ પોપટપણો થયો. કેમ જાણો સોમાનો જવ ધર્મ પાખ્યો છે માટે હવે સોનાની માફંક એની કસોટી કરી-કરીને એને વધુને વધુ તેજસ્વી બનાવવો; અને રુદ્રદેવે કેટલી દુષ્ટાની વધુને વધુ સજી કરવા દુષ્ટા તાજી રાખનારા સંયોગ આપવા.

પૂર્વના વૈરની પુનઃ જગ્રતિ :- ભલે, સોમાના જવને હાથીનો અવતાર મખ્યો પરંતુ આમ તો ધર્મનો પ્રભાવ ચાલી આવતો હોવાથી હાથીના અવતારમાં પણ એને પૌદ્રગલિક સુખ મળી ગયું ! સ્નેહાળ હાથણીઓ એની પાછળ મોહમૃદ્ધ થઈ ભટકવા લાગી ! જેથી હાથી પણ વિષયસુખમાં મળ્યા છે ! ત્યાં શું થયું ? આચાર્ય ભગવાન પોતાનું જ બ્યાન વર્ષાવતાં કહે છે કે “એટલામાં રુદ્રદેવનો જવ જે પોપટ છે, તેણે મને જોઈ લીધો. જોતાં જ એનામાં પૂર્વ જન્મના વૈરના સંસ્કાર જગત થયા. પૂર્વ જન્મમાં આ વિચાર્યુ હતું કે ‘ધર્મના ઠોંગ લઈને આ સોમા આવી ત્યારથી મારો આખો સંસાર બગાડી નાંખ્યો. જો હવે હું કહું છું તેમ ધર્મ છોડી વિલાસ નથી કરતી તો બીજી પત્ની કરવા આને હું સીફતથી મારી નાખ્યું.’ કયાં સુધીની સ્વાર્થી કૂરતા આવી ? યાવત્ત પ્રાણનું પણ અપહરણ કર્યું ! અહીં આનું જાતિસ્મરણ જ્ઞાન નથી થયું, પરંતુ સોમાના જવ પ્રત્યે એ સિફત, એ પ્રપંચબુદ્ધિ અહીંયાં ફરીથી જાગત થઈ !

પાપની ભાવના કરી તો સંયોગો ઝટ મળે છે :- રુદ્રદેવે સોમા ઉપર કરેલ દ્રેષ, કપટ અને મારી નાખવા સુધીની વૃત્તિના મલિન સંસ્કારે એને પોપટના ભવમાં હાથીના વગર ગુંઠે હાથી પ્રત્યે દ્રેષ, કપટ, અને કૂર રીતે મરણાન્ત કષ આપવાની બુદ્ધિ તરફ પ્રેર્યો. હાથીને ઠગવાનો ઉપાય શોધી રહ્યો છે એટલામાં એક વિદ્યાધર કોઈ એક વિદ્યાધરી કન્યાને ઉપાડીને ત્યાં આવ્યો. કેમ જાણો પોપટને એના ભયંકર અકાર્ય કરવામાં અનુકૂળતા કરવા ન આવ્યો હોય ! પાપકાર્યની ભાવનાની કેવી ખૂબી છે કે એને સગવડ વહેલી મળી જાય છે ! તમે ધર્મકાર્ય કરવા ઊઠો તો સગવડ તો નહિ, પણ ઊલટું અનેક આડખીલીઓ ઊભી થશે; અનેક વિઘ્નો ખડા થશે. એ જાણો કહેશે, ‘બેસો બેસો, હમણાં ધર્મકાર્યની ઉતાવળ નથી;’ અને જો પાપ કરવા તૈયાર થાઓ તો સગવડ સામગ્રી તૈયાર છે ! આવી સ્થિતિમાં વિચારો કે પાપની વાસના જગાડ્યા પછી અર્થાત્ પાપકાર્ય કરવાની વૃત્તિ ઊઠાડ્યા પછી પાપકાર્ય કરવામાંથી બચવું કેટલું દુષ્કર છે ! સામગ્રી ન મળે તો તો બચાય; પણ અહીં તો ઝટ સામગ્રી મળે છે. આજે માણસના દિલમાં જરાક જો અનાચારની

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેશ- સમરાચિય કહા.” (ભાગ-૨૨)

ભાવના ઊઠી, તો એને સફળ થવા માટે દુનિયામાં કેટકેટલી સુલભતા છે ! અનાચારની સામગ્રી જેવી કે બિભત્સ શુંગાર, બિભત્સ ચિત્રો, અશ્વીલ છાપાની વાતાંઓ, કામ ભૂખ્યા નરનારીઓ વગેરે સામે આવી અથડાય છે. રૂપના અનાચાર, સ્વર્ણના અનાચાર, શ્રવણના અનાચાર-એમ અનેક પ્રકારના અનાચાર છે. એનાથી બચાવ તો જ થઈ શકે કે જો જડમૂળમાં હદ્ય પવિત્ર રાખીને દુષ્ટ ભાવનાની છાયાથી પણ દૂર રહો. આની સાથે એ પણ ચોક્સ સમજી રાખવાનું છે કે હદ્ય પવિત્ર તો રાખ્યું, છીતાં ‘ચાલો, આપણું હદ્ય સાઝ છે ને ? સંયોગો શું કરનાર છે ? એમ કહી નરસા સંયોગોમાં ઉત્તરવાનું નથી. નરસા સંયોગો પવિત્ર પણ મનને મેલું બનાવી દે છે. આજે કેટલાય નીતિમાન દેશસેવકો હોદ્દો હાથમાં આવ્યા પછી અનીતિમાન બન્યા ને ? મુંબઈ જેવી નગરીમાં આવી તેવા તેવા કુમિત્રાદિના યોગે દુરાચારી થાય છે ને ?

પોપટને શાવતું જડચું :- વાત એ ચાલે છે કે વિદ્યાધર-વિદ્યાધરી જંગલમાં આવ્યાં. તેમાં વિદ્યાધરનું નામ હતું લીલારતિ, વિદ્યાધરીનું નામ હતું ચન્દ્રલેખા. એ હતી મૃગાંકસેન વિદ્યાધરની બહેન. તેને ઉઠાવીને અહીંયાં એ લીલારતિ આવ્યો હતો. એણે આ પોપટને જોયો; અને એને કહ્યું કે “જો પોપટ, મારું એક કામ કરવાનું છે. હું આ પર્વતની નીચે જે જાડી છે, ત્યાં ધુપાઈ જાઉં છું. પાછળથી અહીં કોઈ એક વિદ્યાધર આવશે. તો એને તારે મારું અહીં આવ્યાનું કહેવું નહિ. પરંતુ એની મેળે એમ જ એ વિદ્યાધર અહીંથી ચાલ્યો જાય કે તારે મને ખબર કરવી. પછી હું તારા ઉપર પણ એવો ઉપકાર કરીશા.” આમ કહીને એ વિદ્યાધર તો ગયો નીચે પર્વતની ખીણમાં. હવે મૃગાંકસેન ત્યાં આવીને ચાલ્યો ગયો; અને હાથી-હાથણી સાથે ફરતો ફરતો ત્યાં આવ્યો. અને સુખમસ્ત જોઈને અહીંયાં પોપટ વિચારે છે કે “શું કરું ? હાં, આ સરસ મોકો છે... હાથીને બરાબર બતાવી આપું...” એમ વિચારી એણે એક યુક્તિ ઘડી કાઢી. જે ઝાડ ઉપર પોતાનો માળો છે ત્યાં નીચે હાથી આવ્યો એટલે પોપટ મેનાને કાનમાં કંક સમજાવીને હાથીના સાંભળતા મેનાને પ્રગતપણે મોઢેથી કહેવા લાગ્યો કે,

‘જો સાંભળ, હું કાલે વશીષ ઋષિના આશ્રમમાં ગયો હતો. ત્યાં મેં સાંભળ્યું કું ‘એક સર્વક્રમિત નામનું પતન છે. તેના પરથી જે ઈચ્છા કરીને કોઈ પે તો તેની તે ઈચ્છા પૂર્ણ થાય છે. ઈચ્છિત સ્થિતિ એ મેળવી શકે છે.’

ત્યારે મેં ઋષિને પૂર્ણચું “ભગવન્ત તે પતન ક્યાં આવ્યું ?”

ત્યારે એમણે કહ્યું કે “આ સાલવૃક્ષની ડાબી બાજુએ.”

પોપટ કેવી ગોઠવીને વાત કરે છે ! જાણો સ્વાભાવિક લાગે. ઠગારા માણસો

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સદ્ગુરુની બલિહારી” (ભાગ-૨૨)

એમજ ઠગબાળ ચલાવે છે. પોપટ હાથીના સાંભળતાં આગળ વધીને મેનાને કહે છે,

“ત્યારે સુંદરી ! આપણે આ ભૂડાં તિર્યંચના અવતારનું શું કામ છે ? ચાલેને વિદ્યાધર થવાનું ધ્યાન કરીને ત્યાંથી પછી વિદ્યાધર-વિદ્યાધરી થઈ જઈએ ! તો પછી બસ ! મોજ, મોજ, ને મોજ !”

પત્ની પતિને પાપમાં સહાયક ? :- જુઓ આ પોપટને બાઈડી પણ કેવી મલ્લી ? રાગમાં તાલ પૂરે એવી ? સરબે સરખાની જોડી ! પોપટને પ્રપંચ કરવો છે, મેના એમાં ટેકો આપે છે, હવે પોપટ ક્યાંથી બચે ? જગતમાં આવી અંધ પ્રેમવાળી પત્નીઓનો પાર નથી. પતિને પાપમાં જ સહાયક ! કોક ભાગ્યવાનને પત્ની હિતનું કહેનારી મળે. ઉન્માર્ગથી પાછી વાળનારી મળે; પણ સન્માર્ગમાં જોડનારી ટકાવનારી મળે. સ્ત્રીજાતિને એવી પત્ની બનવા માટે કેવળ કામવાસનાના સંબંધ રાખ્યે નહિ ચાલે. ખરો સંબંધ તો એણે આત્માનો જોડવો જોઈશે. કદાચ અજ્ઞાનતા અને મોહવશ બની પતિ હુર્ગુણી થવા કે અકાર્ય કરવા તૈયાર થાય; ત્યાં આત્માની રાગી પત્નીએ પતિ ઉપર પોતાની લાગવગ, પોતાની શરમ કે પોતાનો કડપ વાપરીને પતિને હુર્ગુણી બનતાં કે અકાર્ય કરતાં રોકી રાખવો જોઈએ; કહીં જ દેવું જોઈએ કે ‘આ અહીં નહીં બની શકે...’ બાકી તો જેને આત્માના સંબંધ નથી એવી પત્નીઓ દાટ વાળે છે. પતિ માર્ગમાં રહેતો હોય, અકાર્ય તરફ ન જતો હોય તોય તેને અકાર્યમાં ધૂકેલનારી એ પત્નીઓ બને છે, ત્યાં પછી પતિ પોતેજ બગડતો હોય એમાં રાપસી પૂરે, ટેકો આપે, સહાયક થાય એમાં શી નવાઈ ? આવી પત્નીઓ શું નરકની દીવીનું કામ નથી કરી રહી ?

માતા-પિતા વગેરે કરતાં પત્ની કેમ વધુ અસરકારક :- ઘણો ઠેકાણો પિતા, માતા, ભાઈઓ, બેનો, પુત્રો વગેરે અકાર્યમાં જેટલા સામેલ નહિ હોય એટલી સામેલ પત્ની બને છે, એ એક જગતની હકીકત છે. હુષ્ટ્યોની ખાનગી મંત્રણા વધારે પત્ની સાથે થાય છે. પતિ પત્ની આગળ પોતાનું હૃદય ખોલી દે છે, અને પત્ની એ ખુલ્લા બનેલા હુર્ગુણી હૃદયને સંમતિનું વહાલું આલિંગન આપે છે, ટેકો આપે છે. ત્યારે પૂછો,

પ્ર.- માતાપિતા વગેરે હુર્ગુણો અને અકાર્યમાં એટલો ટેકો કરનારા નહિ અને પત્ની ટેકો કરનારી ખરી, એનું શું કારણ ?

ઉ.- આનો ઉત્તર સરળ છે; પત્નીને કામવાસનો સંબંધ છે, અને તે સંબંધની અસર આ જગત ઉપર અજબ-ગજબની છે; માટે જ જે આત્માને કામવાસનાના સંબંધની તેવી અસર નથી એને ધન્ય છે ! અને જેને મુદ્દામ કામવાસનાના સંબંધ જ નથી તેને મહાધન્ય છે ! યોનિના સંબંધની ભયંકરતા અવર્ણનીય છે. માણસ જે

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૧૫

એકલાપણાનું સ્વાતંત્ર્ય મૂકી પરતંત્ર બને છે, અને આખા સંસારનું પાપ વહોરવા તૈયાર થાય છે. તે એની જ પાછળ ને ? ચોવીસેય કલાક પરમાત્માને મૂકી પાપનાં જીવન ઉપાડ્યા છે તે એના જ પાયા ઉપર ને ? ઉચ્ચતાની પરકાષ્ઠાને પમારી શકનારા ભવ્ય માનવ ભવને બરબાદ કરાય છે તે એના જ બંધનમાં ને ? એની પાછળ દુનિયામાં શી શી સ્વાર્થ લીલાઓ અને શા શા અનર્થો નથી મયતા ? મંદોદરી જેવી સતી ગણાતી પત્નીએ પણ એ સંબંધથી જેની સાથે સંકળાયેલી છે એવા પોતાના પતિ રાવણને વશ થવા માટે મહાસતી સીતાને વિનવણી કરી ! વાસનાના સંબંધ કેવા દુષ્ટ !

આજના અનર્થનું મૂળ :- પાછા બાળપણથી માતાપિતાના પવિત્ર સંબંધના મહિમા ભણાવાતા નથી; ભાઈભાંનુંના નિઃસ્વાર્થ સંબંધના મહાગુણો શિખવાડવામાં આવતા નથી; તેથી માણસને કામપાત્રના સંબંધ મળતાં માણસાઈ મરી પરવારે છે ! આત્માનો એકદમ પલટો થઈ જાય છે, કેવો ? બાર મહિના બે વર્ષમાં નવી પત્નીને લઈને માતાપિતાથી ને ભાઈઓથી જૂદો થાય એવો ! ત્યારે, જ્યારે ઉચ્ચ આર્ય સંસ્કૃતિ એટલે કે કામવાસનાના સંબંધની છાતી ઉપર પગ મૂકીને ઊભેલી માતાપિતાના અને ભાઈભાંના સંબંધોની સંસ્કૃતિ, જીવંત હતી ત્યારે જુઓ કે સીતાના સામું જોયા વિના રામચંદ્રજીએ પિતાના વચન ખાતર રાજ્યાભિષેક મૂકી વનવાસ સ્વીકારી લીધો ! એથી જ સતીઓ સાસુ-સસરાની અદબ જાળવીને પતિની ઉદ્ધતાઈ કે પતિના ઉન્માર્ગને ટેકો નથી આપતી. પણ આજે આ બધું કેટલું જોવા મળે ? કેમ નહિ ? કહો આજની કેળવણીમાં માતાપિતાના અને ભાઈભાંના સંબંધોનો મહિમા અને વાસનાના સંબંધોની ભયંકરતા શિખવામાં જ નથી આવતા. પછી અનર્થોના ઢેર ધેર ધેર જોવા મળે એમાં શી નવાઈ ? પતિ ધોર અનીતિ અચ્યાય કરીને હજારો લાખો રૂપિયા કમાઈ લાવે; અને એમાંથી પત્નીને હીરાના હાર અને બ્રાન્ડ ન્યુ મોટર મળતી હોય, પછી એને બીજું શું જોઈએ છે ? શા માટે એ પતિનું કંનું પકડે કે “ઉભા રહો, આ પૈસા કેવી રીતે લાવ્યા ? અસત્ય-અનીતિથી ? મને એની રાતી પાઈ નહિ ખપે. શું કર્યું આ ઉત્તમ માનવના ખોળિયે ? પરલોકના પુણ્યને બદલે પૈસા વહાલા કર્યા ? પૈસા તો આજકાલમાં ઊડી જશે, પણ સત્ય અને નીતિ ગુમાવી, પરલોકનું પુણ્ય ન ઉપાજ્યું, અને જૂઠ અનીતિ એવા ભયંકર પાપ ઉપાજ્યા, તેથી નરકાદિની ભીષણ અજિ ભણીઓમાં તમારા દૂચા નીકળી જશે ! તે વખતે અમેય બચાવવા નહિ આવી શકીએ.” પરલોક મોટો છે, એની કાળજી રાખી ધર્મ પહેલો સાચવો, ઊંચા ખાનદાન કુળના ગૌરવ સમજી સ્નેહસલાહસંપ વિનય મર્યાદા વગેરે પહેલાં પાળો...’ આવું આવું

૧૬

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સદ્ગુરુની બલિહારી” (ભાગ-૨૨)

કહેનાર પત્નીઓ આજે કેટલી મળે ? આજ તો આગળ વધેલો યુગ ને ? શામાં આગળ વધેલો ? બોલવા જેવું નથી. પોપટને મેના એવી જ મળી !

હાથી લોભમાં દોડચો :- વિચારણા કરી બંને મેના-પોપટ ઉડ્યાં. આ બાજુ આ બંનેનો વાતર્લાપ સાંભળી હાથીને પણ લાલચ લાગી ! ‘જો આ પોપટ કહે છે તેમ વાત સાચી હોય તો આપણે પણ આ હાથીના અવતારમાં શા માટે પડવા રહેવું ? ચાલો આપણે પણ જઈએ !...’ પેલો લુંઘો પોપટ પણ હાથીને જેંચ્યે જવો છે, માટે ધીરેધીરે ઉડે છે. હાથી પોપટની પાછળ પાછળ દોડવા લાગ્યો. પોપટનું કેવું કારસ્તાન ! હાથીની કેવી લોભ દશા !

લોભ એ જીવની ભયંકર નબળી કરી છે :- લોભદશા મહા ભૂંડી છે. હાથીની સમૃદ્ધિ આગળ પોપટ રંક છે, પરંતુ હાથી લોભી બન્યો છે, તેથી રંકની પાછળ ધસડાય છે. કહેવત છે ને કે “લોભિયા હોય ત્યા ધૂતારા ભૂખે ન મરે.” ધૂતારા પોપટની જાળમાં લોભી હાથી ફસાય છે. કોણ બળવાન ને કોણ નિર્બળ ? પોપટ કે હાથી ? કહો, લોભ બળવાન અને જીવ રંકડો.

લોભ એ જીવની નબળી કરી છે. એનો લાભ ધૂતારા ઉઠાવે છે. એથી જ આજે પ્રજાના મહાવિશ્વાસના હોદે બેઠેલો કેટલાક અમલદારને લાંચ આપનારાઓ કર્તવ્યથી ભષ્ટ કરી શકે છે, અનીતિખોર બનાવે છે, એવું સાંભળીએ છીએ. જો એ અમલદારોમાં લોભની નબળી કરી ન હોય તો લાંચ દેખાડનારા શું લોભાવી શકવાના હતા ? માણસે ગુણસંપન્ન બનવું હોય, પ્રામાણિક રહેવું હોય, કર્તવ્યનિષ્ઠ રહેવું હોય તો આ નબળી કરીને દૂર કરવી જોઈએ. જીવન નિવર્હની ખાસ જરૂરીયાત પૂરતો લોભ રહે એ જુદી વસ્તુ છે. પરંતુ એથી વધારાનો લોભ થાય છે ત્યારે ફસામણી ઊભી થાય છે; તે ફસામણી કાં પાપની કે કાં દુઃખની. લોભિયો કોણિક પિતા શ્રેણિકને કેદમાં પૂરવાના પાપમાં ફસાયો. લોભિયો સુભૂત-ચ્યકવર્તી સાતમી નરકના ધોર ત્રાસમાં ફસાયો. લોભિયો અહીં હાથી પોપટની પાછળ મરવા જઈ રહ્યો છે. ઈચ્છા છે મરવાની ? ના, ઈચ્છા તો બીજી છે, પણ એ ખોટી લોભદશા છે, તેથી અનિચ્છાએ કમોતે મરવા પડવાનું છે. માટે જીવને અને કુટુંબને સમજાવો કે દુઃખ અને પાપથી બચવું હોય તો લોભ પર અંકુશ મૂકો. લોભને આવતાંવેનું ઓળખી લો કે એ દુઃખ અને પાપનો દૂત આવ્યો. નિર્લોભીને જુઓ કે એ કેવો સુખી અને ભાવી પુણ્યની મૂડીવાળો છે. અસ્તુ. પોપટ-મેના સર્વકમિત પતન પાસે આવે છે, હાથી પણ આવે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૨, તા. ૨૩-૪-૧૯૫૫

પોપટમેનાનું પતન:- પોપટ અને મેના યોજના મુજબ પર્વતની કિનાર તરફ ઉડ્યા. હાથી પણ લોભમાં ધસડાતો આવ્યો. પેલા બેઉએ કિનારે આવી સંકલ્પ જાહેર કર્યો કે ‘જો આ “સર્વકમિત” પતનનો પ્રભાવ હોય તો અમે અહીંથી પરીને સારા વિદ્યાધર-વિદ્યાધરી થઈએ.’ એમ બોલીને એ તો પડવા નીચે ખીણમાં ! પણ એમને પડવાનું શું ? પાંખો છે, તેથી નીચા ઉડ્યા. ઉડીને નીચેની ઝડીમાં ધૂસ્યા ક્યાં ? જ્યાં પેલો વિદ્યાધર બીજાની બેનને ઉપાડી લાવીને ધૂપાઈ રહ્યો છે. પોપટ સાથેના સંકેત મુજબ એ તો પોપટની રાહ જોઈને જ બેઠા છે. ત્યાં પોપટને જોઈને હરભિત થઈ ગયા ! થાય જ ને ! મનગમતી વાત કરી લાવનારને જોઈને હરખનું પૂછું જ શું ? એમાં પોપટ જ્યાં સમાચાર આચ્યા કે ‘બેનનો ભાઈ વિદ્યાધર તો આવીને ગયો.’ ત્યાં તો આ બે બેચ્યર-બેચ્યરીને ખુશી ખુશી. કેમ ? ‘હવે નિરાંતે રંગરાગની મોજ ઉડાવાશે માટે, તેમ પોપટ પણ રાજી છે !’

માનવતાની ઉજળામણા : ઔચિત્ય-ન્યાયનીતિ-નિઃસ્વાર્થ પરોપકારમાં :- જીવને રંગરાગનો, લક્ષ્મીનો, અને માનપાનનો જેટલો શોખ છે, એટલો ઔચિત્યનો, ન્યાયનીતિનો અને નિઃસ્વાર્થ પરોપકારનો રસ નથી, એ એક મહાન કમનસીબી ગણાય. જડ પદાર્થોની સગવડ અને શોભા વધારવાનું જે રૂચે છે તેવું આત્માની સલામતી અને આત્મગુણો વિકસાવવાનું નથી રુચતું એ હીનભાગી દશા છે. રસ-ઋદ્ધિ-શાતાની જે ભૂખ અને ભારે કાળજ રથા કરે છે તે આત્માની ઉજ્જવલતાની નહિ ! જીવની કેટકેટલી કમનસીબ દશા !! નહિતર એ શું સમજી શકે નહિ કે “રસ ઋદ્ધિ શાતાના શા બહુ મૂલ્ય આંકવા ? એના વસન તો સૌ જીવને છે. એનો રસ તો સૂક્ષ્મ કીડાનેય હોય છે. તું મોટો બુદ્ધિમાન માનવ થવા છિતાં પણ એમાં જ અટવાઈ રહે, એમાં શી તારી વડાઈ છે ? વડાઈ તો તારી ઔચિત્ય, ન્યાયનીતિ અને નિઃસ્વાર્થ પરોપકારમાં ગણાય. માનવતાની ઉજળામણા આમાં છે.” પણ વાસનાના હલકટ અને કંગાળ ગુલામી માનસમાં આ ક્યાંથી ઉત્તરે ?

(૧) **ઔચિત્ય :-** પણ મનને સમજાવી દો કે ‘બોલચાલ, વાતચ્યવહાર વગેરે બધે જ ઉચિત રીતે-યોગ રીતે વર્તવાનું શીખશો તો લોકમાંય ઉજળા દેખાશો, અને અંતરથીય ઉજળા બની શકશો. અનુચિત રીતે વર્તવામાં તો લોકોએ પાછળથી નિંદા કરે છે, વિરોધી બને છે, અને અંતરાત્મા નિર્વિવેકી બને છે.’

(૨) **ન્યાયનીતિ :-** ત્યારે ન્યાયનીતિને બદલે અન્યાય-અનીતિના હિસાબે લોકના વિશ્વાસ ઉઠી જાય છે, અને પોતાનું હથય કાળું મલીન થાય એ જુદું ! પૈસા તો કેટલીય

વાર જે અન્યાયના હોય છે તે જાણો બીજા માર્ગ પાંખ કરીને ઉડી જાય છે ! બાયરી માંદી પડી, છોકરો માંદો પડ્યો, ચોર મળ્યા, કયાંક આપણો જ ગુમાવી આવ્યા... આવું આવું બને એ શું છે ? બહુ વહાલા કરેલા નાણાંને ઉડી જવા માટેની પાંખો એટલે પૈસા તો આજ છે ને કાલે નથી. એ ઉડી જશે ચાલ્યા જશે, પણ અનીતિના ઘોર પાપના ગંજ આત્માને માથે રહી જશે ! અરે ! અનીતિનું તો ખાતાં પણ હદ્ય દ્વારા જોઈએ; શરમાવું જોઈએ. કહો તો ખરા કે ચોર ખાતર પાડી કે લૂંટ કરી માલ ઉપાડી જઈ પછી મોટા પાટલે ચઢી જમવા બેસે એ તમને કેવો લાગે ? બૂરો ને ? ત્યારે એ તો બૂરો લાગે છે, પણ અહીં જાત બૂરી નથી લાગતી ! પેલાએ લૂંટ તો સામે કહીને દેખાઈને ચલાવી, પણ અહીં તમે અનીતિ કરી તે તો સામાને વિશ્વાસમાં રાખીને કરી ! કેવી કમનસીબી વધારે શું ખરાબ ? એકલું પડાવવાનું ? કે વિશ્વાસધાત સાથે પડાવવાનું ? અહીં જો જો, પોપટ હાથીનો વિશ્વાસધાત કરી કેવા ગ્રાસ હરે છે ! પણ એટલું ધ્યાન રાખો કે તિર્યંચના અવતારમાં પાપ કરે, એ તો ભૂતકાળની ભૂલ નીચે દબાયો કરે છે. પરંતુ અહીં માનવના અવતારમાં કરાય એ તો નવેસરથી એક વિશેષ ભૂલ આદરવા જેવું છે. એના પ્રત્યાધાતો ભયંકર પડશે. જાણો એ ભૂલ પછીથી ફાલવા-ફૂલવા માટે કેઈ હલકા દુર્ગતિના ભવ આપશે.

(ઉ) પરોપકાર ! :- ખણજ અને ખણવું એટલે ? :- માટે જ અહીં તો જૂની ભૂલો સુધારો, નવી ન આદરો. જીવન એથી ઉમદા બનશે. નવી પ્રજાને પણ બોધપાઠ મળશે. જેવું ઔચિત્ય જેવી ન્યાયનીતિ, એવો જ નિઃસ્વાર્થ પરોપકાર જરૂરી છે. એ કરવાથી સામાના દિલને મહાન શાતા મળે છે, અને આપણા દિલને હોંશ રહે છે ‘હાશ ! ચાલો પાપ કરી લાવેલી લક્ષ્ણી કંઈક સારા કામમાં કામ લાગી !? શું’ પાપનો ભાર ઉત્તર્યની હાશ ! સ્વાર્થની રમતના અંધકારભર્યા જીવનમાં પરમાર્થનો કંઈક પ્રકાશ લાયો ! પોપટ બિચારો અજ્ઞાન તિર્યંચ જીવ ! શું આવડે એને ? એને તો ઉપકાર નહિ પણ અપકાર કરી ખુશી થયું છે ! એ અપકારથી શું પોતાનું પેટ ભરાશે ? પટારો ભરાશે ? ના, ગમે તેમ પણ એક ખણજ ઉપડી તે ખણવું જ જોઈએ. એથી ખણજ વધે કે ધેરે ? વારંવાર માયા કરવાથી માયાની ચણ વધે છે, ત્યારે હોંશથી પરોપકાર કરવાથી પરોપકારની ખણજ વધે છે. પણ તે તો સારી છે, ઈચ્છવાજોગ છે. જ્યારે, અપકારની કાર્યવાહી કર્યે જવાથી એની ખોટી ચણ વધે છે, તે મહાભયંકર નીવડે છે. સોમાના પતિ રૂદ્રદેવને અપકારની એ ચણ ઉપડી છે; તે કેટલાય ભવ ચાલશે ! એથી લાભમાં શું ? ઘોર નરકના ત્રાસ !! અને પછી પાછી વારેવારે વિશ્વાસધાતી અપકારની લીલા કરી કરી ભવચકમાં નિરાધાર, દુઃખી અને દુર્દ્શાભર્યા પરિભ્રમણ !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૩, તા. ૩૦-૪-૧૯૫૫

હાથી પડે છે : - અવધિજ્ઞાની અમરગુપ્ત આચાર્ય ભગવાન પોતાનો પૂર્વ ભવનો અધિકાર કહેતાં આગળ કહે છે કે “પોપટ-મેના તો ત્યાં ધૂપાઈ રહ્યા; અને વિદ્યાધર-વિદ્યાધરી બહાર ઉંચે નીકળી આવ્યા. એમને જોઈ હું હાથી તરીકે ઉપર કિનારે ઉભેલો ચકિત થઈ ગયો ! ‘અહો ! કેવો પ્રભાવ આ પતનનો ! કે આ પોપટ-મેના સંકલ્પ કરીને પડવા દ્વારા વિદ્યાધર-વિદ્યાધરી બની ગયા ! મને સજજદ વિશ્વાસ બેસી ગયો. મનને થયું કે લાવને ત્યારે, અમારે પણ આવા હલકા તિર્યંચના અવતાર રાખીને શું કામ છે ? ચાલો અમે પણ દેવદેવી બનવાના સંકલ્પ કરીને પડી ફક્કડ દેવદેવી બની જોઈએ.’” હાથી કેવો ભૂલો પડ્યો ! કેવો મૂર્ખ બન્યો ! એટલું એ વિચારતો નથી કે ‘આ તે સાચેસાચ એમજ બન્યું કે માંદી કોઈ લેદ છે ?’ વિચાર કરવા થોબે તો તો કદાચ પોપટ વાર થયા પછી બહાર ઉડી આવતાં ભરમ ખૂલી પણ જાય. તો પાપનો પરપોટો ફૂટી જાય; પણ અહીં તો લોભના ઘનમાં વિચાર કરવો જ કોને છે ? કેમ એમ ? કહોને કે પોતાનું માનેલું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું. જીવને સ્વાર્થની લાલચ લાગી કે પછી ફસાયો સમજો. ખોટું પણ સાચું માનશે.

આ પ્રમાણ છે કે ભ્રમણા ? :- આપણો તો આ પહેલેથી સાંભળતા આવ્યા એટલે જાણીએ છીએ કે ‘પોપટની આ ગેડ હતી. બાકી પોપટ જુદો છે અને વિદ્યાધર જુદો છે.’ પરંતુ અજ્ઞાન હાથીને પહેલેથી વિદ્યાધર ધૂપાચાની ખબર જ નથી; સમજે છે કે આ તો મેં મારી સગી આંખે પ્રત્યક્ષ જોયું કે પોપટ વિદ્યાધર બની ગયો. ક્યાં જોયું ભાઈ ? સામે પોપટ ઉભેલો જોયો હોત અને ત્યાં જ એ તરત પોપટ મટી વિદ્યાધરના રૂપમાં દેખાયો હોત તો તો જોયું કહેવાત. પણ ત્યાંય વહેમ પડે કે કોને ખબર વિદ્યાધરે વિદ્યાના બલે પોપટને અદશ્ય કર્યો હોય અને પોતે પ્રગટ થયો હોય તો ? ત્યારે અહીં તો એવું સાક્ષાત્ તો જોયું નથી ને ? છતાં એ સાચું માની લે છે.

આત્માનું પ્રમાણ :- નાસ્તિકો આમ જ ‘શરીરમાં જુદું આત્મદ્વય નથી,’ એવી ભ્રમણમાં પડે છે. એ કહે છે “અમે પ્રત્યક્ષ જોઈએ છીએ ને કે પ્રત્યક્ષમાં એકલું શરીર દેખાય છે. મરતાં ય શરીરમાંથી કોઈ બહાર નીકળતું હોય એવું દેખાતું નથી. પછી આત્મા જેવી ચીજ શી ?” પણ જ્ઞાનીની દસ્તિએ આ ભ્રમ છે. પ્રત્યક્ષ પ્રમાણ નથી. દેખીતું પ્રત્યક્ષ ખોટું છે. કેમકે જ્ઞાની પોતે જ્ઞાનચુણી સ્પષ્ટ જુએ છે કે પહેલો પરભવથી આવીને આત્માએ જ આહાર લઈ લઈને આ શરીર

બનાવ્યું હતું; પછી આજ શરીરમાં એ દૂધપાણીની જેમ એકરૂપ થઈને રહે છે. પણ એ જુદી વ્યક્તિ છે તો જ જડમાં ક્યાંય નહિ દેખાતા એવા ગુણો-જ્ઞાન, ઈચ્છા, રાગાદિ, લાગણીઓ, સુખદુઃખ વગેરે-આ શરીરમાં દેખાય છે. તો જેમ ભસ્મમાં જો બિનાશ અને ઠંડક દેખાય તો તે ભસ્મની નહિ પણ એમાં ભળેલા પાણીની સમજવાની; તેવી રીતે જીવંત શરીરમાં જ્ઞાના જ્ઞાન-ઈચ્છા-સુખ-દુઃખ વગેરે શરીરના પોતાના ધર્મ નથી પણ એમાં ભળેલા આત્મદ્વયના ગુણો છે. ભસ્મમાંથી પાણી સુકાઈ ગયા પછી ભીનાશ ઠંડક નથી દેખાતા તેમ મરેલા શરીરમાંથી જીવ ચાલી ગયા પછી જ્ઞાન વગેરે નથી દેખાતા. ત્યારે ભસ્મમાંથી પાણી જેમ અદ્દશ્યપણે વરાળ થઈ ચાલી જાય છે, એમ શરીરમાંથી જીવ પણ મરણ વખતે અદ્દશ્યપણે જ ચાલી જાય છે. તે કેવી રીતે દેખી શકાય ? માટે કહેવાતા પ્રત્યક્ષ ગ્રમાણ ખોટા હરે છે.

પોપટ કરતાં હાથીનો વધુ લોભ :- હાથી ખોટા પ્રત્યક્ષમાં ભૂલો પડ્યો. અજ્ઞાનતાથી ભૂલો પડ્યો તો પડ્યો, પણ પાછો વધુ લોભમાં ચઢ્યો. પોપટે તો સંકલ્પ વિદ્યાધર મનુષ્યનો જાહેર કર્યો હતો, પણ આને તો એવા મનુષ્યની ઉપરના દેવ થવાનો મનસૂભો થયો ! નથી એને સંતોષ ! નથી એને સમજ ! એને હવે તો એક જ વાત છે, જલદી દેવ બનીએ. કાંઈ વિચારવા થોભવું છે ? “ના, બસ ! હવે તો જલદીથી નીચે પડો, અને પછી ? પછી શું મોતને બોલાવો વહેલું કેમ ? જલદી દેવપણું મળે !!” મળી જશે ને ?

અજ્ઞાનતા અને લોભ માણસને પૂર્ણ વિચારવા દેતા નથી; અને ભયંકર સાહસમાં ઉતારે છે. આ, તમે પણ એટલા જ કારણે સાહસ કરીને ઘોર સંસારમાં ફસી રહ્યા હો ને ? એ વિચારવું જોઈએ કે અજ્ઞાન તિર્યંગ પશુના જીવનના સારાયે દિવસો પાપમાં ચાલ્યા જાય છે, તો અહીંયાં માનવ જીવનમાં એટલું તો જરૂર કરવું જોઈએ કે ‘ધેવટે એક સપ્તાહમાંથી માત્ર એકેક દિવસ પણ અમે અખંડ ધર્મસાધના કરશું.’ બાકી ધર્મસાધના વિના સંસારનો અંત એમ જ સંસાર ચલાવે જતાં આવી જાય એમ સમજશો મા. સારોય દિવસ, સારોય માસ, અને વર્ષ સંસારની જંજળમાં અખંડ પડ્યા રહેવાથી તમારો બચાવ કોઈ નહિ સાંભળે ! જીવનમાં કંઈક કમાઈ કરી લેવી હોય આત્મહિતની, તો પાપસમયમાંથી ધર્મનો સમય કાઢી લેવો જોઈએ. લોભ અને અજ્ઞાનતા ઓછા કરી સંતોષ અને સમજ લાવવી જોઈએ. તો જ જીવનમાં જે બિનજરૂરી જ છે, એ અન્યાય, અયોગ્યતા વર્તાવ, સ્વાર્થીધત્તા, ઈર્ઝા વગેરે પાપોથી બચી શકાશે. હાથીને મન હવે વિચારવા બેસવાનો કોઈ અવકાશ જ નહોતો. પાપી પોપટથી ભરમાયો એ બિચારો સંકલ્પ કરીને પર્વતના ઊંચા શિખર

પરથી પડતું મૂકી કાળી ઘોર ભયંકર ખીણમાં ગબડી પડ્યો ! વિચારો કે હાથી જેવું પ્રાણી પડે એટલે શું ? જાણો મોટી તુંગારી પડી ! પડતાંની સાથે પર્વતની શિલાઓમાં ભટકાઈને દંતશૂળના ચૂરેચૂરા થઈ ગયા, હાડકાં ભાંગીને જાણો ભૂકો થઈ ગયાં ! પગ ભાંગી ગયા ! સૂંધ છુંદાઈ ગઈ ! પોપટે જોયું કે હાથી પડ્યો-કે તુરત જ તે તો મેના સાથે બહાર નીકળી ગયો. પણ હાથીને એના તરફ જોવાની હવે નજર ક્યાં રહી છે ? અવિજ્ઞાની મહર્ષિ પોતાની જ સ્થિતિ બતાવી રહ્યા છે; કે હાથીના હવે મને ધર્મની કંઈ સમજ નહોતી. માત્ર પીડાની રીબામણથી અકામ નિર્જરા કરતો મર્યો. હદ્યની કોમલતાને લીધે એમાં પોપટ પર ગુસ્સો કે તેવું કાંઈ રૌદ્રધ્યાન ન થયું તે અહો ભાગ્ય ! નહિતર મરીને જાત નરકમાં ! ત્યારે એવું ખરાબ આર્તધ્યાન પણ ન કર્યું. તેથી તિર્યંગતિ પણ બંધ. હૈયાની કોમળતા એ પોતાને મહાન આશીર્વદ રૂપ છે. અહીં કહી શકાય કે હાથીની આ કોમળતા કે જેણે તીવ્ર આર્તરૌદ્ર ધ્યાનથી બચાવી લીધા, એ સોમાના ભવની ધર્મસાધનાને આભારી હોય.

હાથી સ્વર્ગ, પોપટ નરકે :- જીવનમાં બે પ્રકારની ધારાઓ કામ કરી રહી છે; એક પાપની ધારા, એક ધર્મની. હવે અહીં પ્રક્રિયા થાય કે

પ્ર.- ધર્મની ધારા શરૂ કરી પરંતુ કોઈ પાપથી પછીનું જીવન દુર્ગતિનું મલી ગયું. તો શું શરૂ કરેલી ધર્મની ધારા ફોગટ ગઈ ?

૩.- ના, એ પછીથી કામ લાગવાની છે. હાથી મરીને દેવ થાય છે; એમાં એ જ વાત આપણાને જાણવા મળે છે. સોમાના ભવનો ધર્મ કામ લાગ્યો. માટે જ ધર્મ ખૂબ કરો. કરેલો ધર્મ બધો જ લેખે લાગવાનો છે; એ ઉપદેશ છે. હાથી મર્યો ખરો, પણ પોપટ પર જરાયે રોષ ન કર્યો. જો એ કર્યો હોત તો ? જાત મરીને નરકમાં ! કેમ શું કરી નાખ્યું કે નરકમાં જવાનું ? એજ, કે સુખનો લાભ મળો કે નહિ, બીજાની હિંસા કરવાના એક ધારા એક વિચાર, મહાજૂઠના એકાગ્ર ચિંતન, મોટી ચોરીનાં ધ્યાન,... વગેરે રૌદ્રધ્યાન છે. એમાં જો આયુષ્ય બંધાઈ જાય તો નરકનું જ ! હાથી અકામનિર્જરા કરીને મર્યો અને કુસુમશેખર નામના વ્યંતર નગરમાં વ્યંતરદેવ થયો ! દેવપણમાં વિશાળ ભોગવિલાસમાં આનંદમસ્ત રહે છે. જ્યારે પોપટ ક્યાં ગયો ? એ મરીને ગયો પહેલી નરકમાં લોહિતામુખ નામના નરકસ્થાનમાં ! બંનેનું આયુષ્ય પલ્યોપમથી કંઈક ઓછું છે. વિચારો કે થોડીક ઠગાઈ કરી પોપટે, તો નરકનું પરિણામ ! અને હાથીએ મનને એવું બગડવા ન દીધું તો દેવલોકનું પરિણામ ! હાથે કરીને પોતાનું જ ગણાતું મન બગાડો તો માર ખાઓ ભારે ! ન બગાડો તો ઈનામ લો મોટું ! એમ જાણો કર્મ કહે છે.

પાંચમે ભવે ચકદેવ :- બંને મરીને આવ્યા મનુષ્ય લોકમાં. અવધિજ્ઞાની કહે છે કે “મહાવિદેહમાં બીજી વિજયમાં ચકવાલપુર નામના નગરે અપ્રતિહતચક સાર્થવાહની સુમંગલા નામની ભાર્યાની કુક્ષીએ હું હાથીનો જીવ ચકદેવ તરીકે જન્મ્યો. આ પાંચમો ભવ છે. ધર સંપત્તિવાળું છે. પરંતુ દ્રોહી પોપટનો જીવ એજ નગરમાં રાજ પુરોહિત સોમશર્મા બ્રાહ્મજ્ઞાની નંદીવર્ધના સ્ત્રીના પુત્ર યજ્ઞદેવ તરીકે જન્મ્યો. અમારા બંનેના જીવનનો વિકાસ થતો ચાલ્યો. કુમારભાવ પામ્યા. તેમાં કર્મસંયોગે મારી અને ચકદેવની વચ્ચે પ્રીતિ જોડાઈ. પરંતુ મારી પ્રીત સદ્ગ્રાવ-સરળભાવથી હતી; ત્યારે પૂર્વજીવનમાં અત્યાસ કરેલા કર્મદોષના પરિણામે યજ્ઞદેવની પ્રીતિ પોકળ હતી, કપ્તભરી હતી ! પોકળ તો શું પણ જોખમી પ્રીતિ હતી ! તેથી સરળ એવા મારા પ્રયે એ માયાવી બની મારી સંપત્તિ પર ઈર્ઝ્યા કરી ઠગવા માટે છિદ્ર શોધતો હતો.” એ પ્રીતિમાં જોતો હતો કે “ચકદેવમાં કંઈ ખામી દેખાય છે ? બસ, જો એકાદ ખામી હાથ આવી જાય તો દાવ ખેલી લઉં !” અત્યા ! પણ કેમ એટલું બધું ? તારું એણે કંઈ બગાડયું છે ? “ના, મારું કંઈ બગાડયું તો નથી. પરંતુ મને એ ગમતો જ નથી. બસ, તો એનું નુકશાન કરવું !” કેવું અધમ માનસ ! કેવી ખતરનાક માયા અને કેવી ભયાનક એની ચાલુ વિચારધારા ! કેમ આમ ?

ક્ષોટીવાળી ધર્મભાવનાનો દુકાળ : પાપના અને ધર્મના વિચાર :- હાથીને પોતે પૂર્વભવમાં મારવા પૂર્વે પોતાના મનમાં કેટલી બૂરી ભાવનાઓ ભાવી હતી ! “આમ કરું કે તેમ કરું...” તો એ બૂરી વિચારધારામાં નરકમાં અસંખ્ય વર્ષોની અશાતાનું પાપ બાંધ્યું ! એના પરિણામે નરકમાં પરમાધારીઓના હાથે કેટલીયે વાર ઘાત ! કાપ ! માર ! એથી મૃત્યુ થાય તો સારું. પણ અહીં ન થાય; અને મૃત્યુ જેવી કારમી પીડાઓ ખરી ! કેટલી વાર ? હિસાબ નહિ ! કુવિચારોનું આ ફળ ! વિચારો જો સારા, તો પુણ્યનો બંધ, વિચારો જો પાપના તો પાપોના બંધ. તો હવે માપ કાઢો તમે એક દિવસમાં કેટલીવાર ધર્મના વિચાર કરો છો ? અને કેટલીવાર પાપના વિચાર ? ‘હું બીજાને દબાવું’ એ વિચાર પાપના ઘરનો, હું મારી પાપવૃત્તિઓને દબાવું એ ધર્મનો વિચાર. ‘હું ખાઉં !’ એ પાપનો વિચાર. “હું તપ કરું.” એ ધર્મનો વિચાર. ‘હું બજારમાં જાઉં એ પાપનો વિચાર,’ ‘હું મંદિર-ઉપાશ્રયમાં જાઉં,’ એ ધર્મનો વિચાર. પરંતુ શું થાય ! જુલ્દ તે એટલો બધો કે ધર્મના સ્થાનમાંયે પાપના વિચાર કરવાની છૂટ છે ! અને પાપના સ્થાનોમાં ધર્મના વિચારની છાયા સરખી નહિ ! એમને એમેય નથી થતું કે ‘સામે લાખોની લાલચ હોય છતાં જૂઠ ન બોલું, અનીતિ ન કરું. અથવા પૈસા લડી લડી હૈયાં કાળાં ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

કરીને નથી જોઈતા. તુચ્છ લક્ષ્મી ખાતર સગા બાપ કે ભાઈ સાથે ન જગું...’ ક્ષોટીવાળી ધર્મભાવનાઓનો દુકાળ પડવા માંડયો ! યજ્ઞદેવની પ્રીતિ ઠગાઈભરી છે. જ્યારે ચકદેવ સરળ ભાવે પ્રેમ રાખે છે. હજુ બંને ઠગ હોય તો તો એક બીજાને પોત પોતાની ચાલાકી બતાવે. પરંતુ એક સરળ હોય એટલે બીજાને ઠગ વિદ્યા અજમાવવાનો સ્તો મળી જાય છે. ત્યારે પૂછો.

પ્ર.- શું સરળનો જ મરો ?

૩.- ના, માત્ર પોતાના પાપના ઉદ્ય હોય તાં સુધી સહવું પડે. પણ અંતે તો સરળતાનો જય છે.

“બસ બસ, હું એ ચકદેવની શ્રીમંતાઈ સહન નહિ કરી શકું...” યજ્ઞદેવ ધૂધવાઈ રહ્યો છે; પરંતુ ચકદેવના નિર્મળ જીવનમાં એને એકેય ખામી મલતી નથી ! છતાં રાત દિ’ વલોપાત એનો જ છે. કેવી કરુણ દશા ! પેલો જીવન એવું પવિત્ર જીવે છે કે એક ખામી ન મળે. કેવળ શાસ લેવા ને મૂકવા. પેટ ભરવું ને ભટકવું. અહીં તહીં આંટાફેરા લગાવી રોટલા ઊભા કરવા, ને પોટલા ભરવા, તેનું નામ જીવન નથી. જીવન એ ચીજ છે કે જ્યાં ગુણસંપન્તા હોય ! દુર્જન ગમે તેટલાં ફાંફાં મારે પણ એને એક દોષ પણ જોવા મળે નહિ ! તો જ મનુષ્ય બીજા જીવોથી શ્રેષ્ઠ ગણાય. ચકદેવ ગુણીયલ હતો, તેથી કંઈ દોષ જોવા ન મળ્યો. પણ સરળ અને સીધો હતો. તેનો લાભ ઉઠાવી યજ્ઞદેવે તેને ફસાવવા એક પાસો ફંકવાનું વિચાર્યું.

દ્રોહી યજ્ઞદેવનો પાસો :- એજ નગરમાં એક ચંદન નામનો મોટો શ્રેષ્ઠ હતો. યજ્ઞદેવે વિચારી લીધું કે “એના ઘેરથી માલ ઉઠાવું અને એ માલ જઈને ખાનગી તરીકે આપું ચકદેવને ! પછી હું ગમે તે પ્રકારે જાતે જ જઈને રાજાને બાતમી આપું. રાજા તપાસ કરાવે અને તેમાં ચકદેવ જડપાઈ જાય, રાજા ગુસ્સે થઈને તેની સંપત્તિ પડાવી લે. એને જેલમાં નાખે, બસ, તો આપણી ધારણાઓ સફળ થઈ જાય...” મનુષ્યને મન મલ્યું છે. ચિંતનની શક્તિવાળું, તો એનો ઉપયોગ આ જ ને ? મનની કેદી યોજનામાં એ યોજના નથી આવતી કે “અહો હું જન્મે જન્મે ભવયકમાં ભટકી રહ્યો છું. તો લાવ, કમમાં કમ પ્રેમીને તો ન ઠગું. વિના-સ્વાર્થના તો પાપ ન કરું. ઉલટું જેનાથી અનાદિકલીન કર્મ-શુંખલાઓ તૂટી જાય, કુસંસ્કારોનાં આકમણ થંભી જાય એવી શુભ વિચારણાઓ, સુંદર મનોરથો ઘડું.” ના, એ આવડત નથી ! મનનો ઉપયોગ શું ? “ચંદનને ત્યાં જાઉં, ઘન લૂંટી લાવું, અને આને આપી ફસાવી ભિખારી કરું. બસ, મને એ ચકદેવ પર દેખ થાય છે. માટે એને ખોટી રીતે ય પાયમાલ કરી દઉં...” આ કાળી લેશ્યામાં મનને

રમાડી રહ્યો છે ! શું જાણે ધાર્યું સફળ થશે !

માનવનું શરીર પામીને પિશાચી વિચાર યજ્ઞદેવ કરી રહ્યો છે ! જંગલી પશુ-સુલભ વિચારણામાં અટવાઈ રહ્યો છે ! શું સોનેરી માનવજીવનનો આ જ અર્થ છે ? જન્મ અને શરીર તો સર્વને મલે છે. પરંતુ એ વિચારવું જોઈએ કે “એના પર મારો કાબુ અજમાવું. કાબુ અજમાવી શકાય છે એજ આત્મા હોવાની સાબિતી છે. તો આત્માના ભલા માટે આ જન્મને ભૂરા કાર્યોથી ભૂરી વિચારણાથી, ને ભૂરા ભાષણોથી હવે તો બગાડું નહિ. ખાવા-પીવાદિ વાત નવીન નથી, પરંતુ આત્માનું સંશોધન કરું. સ્વભાવ નરમ ને નિર્મળ બનાવું. આજ સુધી બગડી ગયેલી પ્રકૃતિને-પાશવી વૃત્તિઓવાળી પ્રકૃતિને-પ્રશાંત ગુણસુવાસિત પ્રકૃતિવાળી બનાવી દઉં. અનંત કાળના ખબર ન લેવાયેલા આત્માની હવે ખબર રાખું...” જીવનનો આ અર્થ છે. ‘સોમા દુષ્ટાએ મારો સંસાર બગાડી નાખ્યો,’ - એ ભૂરી વિચારણાના મૂળ પાયા પર યજ્ઞદેવને, ધર્મ સોમાનો જીવ ચકદેવ મહાગુણીયિલ છતાં અને એવાની સાથે મિત્રપણાનો સંબંધ મળવા છતાં, અજ્ઞાત કુવાસનાના જોરે માનવના ખોળિયેય પાપ કરવાનું સૂઝે છે, તો એ પરથી આપણે આપણા જીવનમાં જે ભૂરો સ્વભાવ, ભૂરી કાર્યવાહી વગેરે ઘર કરી બેઠેલું છે, તેના પરથી પૂર્વ જીવનોની ભૂરાઈનો હિસાબ કાઢવો જોઈએ. એ હિસાબ કાઢીને એ નક્કી કરવું જોઈએ કે “અમે પૂર્વજીવનોમાંથી તો લખલૂટ પાપકર્મનોનો સ્ટોક, ગંજાવર સ્ટોક લઈને આવ્યા હીએ, હવે જો એને આગળ ન જ લઈ જવાં હોય તો અહીંના જીવનમાં ધરખમ ફેરફાર કરવો જોઈશે જ.”

કુપ્રકૃતિઓ અને કુપ્રવૃત્તિઓ : કુપ્રકૃતિઓ અને કુપ્રવૃત્તિઓ આકસ્મિક નથી; પરંતુ કેઈ જન્મોની છે. જીવ અનું સંગ્રહસ્થાન છે. સંયોગ પ્રમાણે કુપ્રકૃતિ અમલમાં આવે છે. દા.ત. વાધના ભવમાં ફૂરતા; કાગડાને લુચ્યાઈ...પણ આ ભવ પછી હવે એને આગળ ન લઈ જવી હોય તો હદ્ય કઠીણ કરીને એ ભૂરી વાસનાઓ અને પ્રકૃતિઓની સામે જીવું પડશે. ‘હવે જીવનને ધર્મમાંથી ભષ કરવાવાળો હું મૂર્ખ નથી, મેં વીતરાગનું શાસન મેળવ્યું છે, કે જે શાસનમાં ચકવર્તી જેવા, ષટ્ટખંડની મહા ઠંકરાઈને લાત મારીને નીકળી જનારા મહાપુરુષોના ભવ્ય દષ્ટાંતો પડેલાં છે ! તેમણે ન્યાય-નીતિથી પ્રાપ્ત કરેલું ય સર્વર્થા ત્યજ દીધું ! તો જો હું ત્યજું નહિ તો છેવટે તુચ્છ વસ્તુને માટે અસત્ય અનીતિ કરું ? નહિ જ કરું.’- કુવૃત્તિની સામે આ કરવું પડશે. “ઉત્તમ પુરુષોએ પોતાના ગુના વિના પણ પરાયા દુર્જનોનું ય ખૂબ ખમી ખાંધું ! તો હું મારા ગુનાની ય સજી ન ખમું ? ને ખોટા જગડા મચાવું ? ઓછામાં ઓછું પરાયાનું નહિ, તો પણ મારા સગાં-સ્નેહીનુંય ન

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્યુ કહા.” (ભાગ-૨૨)

૨૫

ખમી ખાઉં ? શા માટે ઘરમાં જ કલેશ જમાવું ? કલેશ જગડા હરગીજ નહિ કરું...” આવા નિર્ધાર અને અમલ જોઈશે.

ચોરીનો માલ ચકદેવને :- આ ભાજુ યજ્ઞદેવ મોકો જોઈને ચંદન શેઠના ઘરમાં ધૂસી ગયો; અને જવેરાતનો એક ડાબડો ઉઠાવ્યો. ત્યાંથી આવ્યો સીધો ચકદેવને ત્યાં.

મનની નીકમાંથી પ્રવૃત્તિનું વહેણ :- કેવો ગઠિયો છે ! માલ ઉપાડવામાંય હોશિયાર અને કોઈના ગળે બજાડવામાંય હોશિયાર ! અહીં એટલું ધ્યાન રાખજો કે પોતાનું મન બગડે એની કેટલી ખરાબ અસર જીવન પર પડે છે એની જ્યાં કોઈ ગમજ ન હોય ત્યાં, જીવન મજુસ્યાનું એટલે ઉચ્ચ પ્રાણીનું જીવન ગણાવા છતાં, ખરાબ મનમાંથી પ્રવૃત્તિનો પ્રવાહ મલિન-ખરાબખસ્ત વહે એમાં નવાઈ નથી. કુવાનું પાણી ચોકખું છતાં એમાંથી બહાર કઠાઈને જે નીકમાંથી વહી હવાડામાં આવે છે એ નીકજ કચરાવાળી ખરાબ હોય તો પાણી પણ હવાડાની અંદર મેલું વહી આવવાનું. એમ ખરાબ મનમાંથી વહી આવેલી પ્રવૃત્તિ પણ ખરાબ સમજવાની. પાણી એક ખરાબ પ્રવૃત્તિને સારાપણાનો વાધો પહેરાવવા માટે બીજી મલિન પ્રવૃત્તિ ફંડાવવી પડે છે. એમ કરવા માટે ખરાબ મન તો તૈયાર બેહું જ છે. યજ્ઞદેવનું મન બગડું છે તેથી એક તો ચંદનશેઠને ત્યાંથી ચોરીની પ્રવૃત્તિ કરી. હવે મેલા મનમાં એને ચકદેવને શાહુકારી બતાવવી છે અને વિશ્વાસમાં લઈ મહાન નુકસાનના સીસામાં ઊતારવો છે માટે જુઓ વાણીની પ્રવૃત્તિ કેવી મેલી આદરે છે.

ચકદેવને કહે છે, ‘દોસ્ત ! જરા આને કણજીથી સંતારી દે.’

દુર્જનકી દોસ્તી ઔર... :- અહીં અમરગુપ્ત આચાર્ય ભગવાન જે પોતે જ પૂર્વ ચકદેવ હતા એ કહે છે કે “મને પણ આ અકાલે લઈ આવ્યો હોવાથી શંકા પડી ગઈ. તેથી આમ તો એને રાખવાની ઈચ્છા નહિ. પણ એના તરફ દાક્ષિણ્ય વિશેષ; એટલે ના પાડી શકાય નહિ. વગર પૂછ્યે એ માલ મેં છૂપાવી દીધો.” જુઓ અંતર ચોકખું છે. તેથી આવા ગરબહર્ગોટામાં પડવાનું મન નહિ. ‘ચાલો અવસરે આપણને ય આમાંથી કંક ખાવા મળશે’ એવી કોઈ જ ઈચ્છા સ્વને ય નહિ, પરંતુ શરમમાં પડી મિત્રની સેવા કરવાના હિસાબે ગોટાળામાં પડે છે. એને ક્રાંતિના ખબર છે કે આનાથી કેવી મહાન આપત્તિ આવશે. દુર્જન કી દોસ્તી ઔર જનકાખતર મિત્ર-પરિવાર સજજન રાખવો જોઈએ. નહિતર અવસરે આપણું જીવન જોખમમાં મુકાય. એવાંઓની શરમ રાખવીય ખોટી. ત્યાં તો જો પહેલેથી જરા મન કાહું કરી શરમ રાખ્યા વિના કહી દીધું કે ‘ભાઈ ! આ કામની મારી હિંમત નહિ, કે મારા સંયોગ નહિ’ તો ટૂંકે પત્યું સમજો. પછી ભાવી અનર્થની પરંપરાજ

૨૬

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પાંચમે ભવે ચકદેવ” (ભાગ-૨૨)

બંધ ! ચકદેવ તો શરમમાં પડી માલ રાખ્યો, અને યજ્ઞદેવ ત્યાંથી ગયો.

ચોરીની ભૂમ :- પરંતુ પછી તો નગરમાં વાત ઉપડી કે ચંદન સાર્થવાહના ઘરમાં ચોરી થઈ. વાત શાની છાની રહે ? ચકદેવને પણ એ વાત સાંભળવામાં આવી, તેથી હૃદયમાં શંકા ઉઠી કે ‘આ મારે ત્યાં મૂકી ગયેલો માલ આ ચોરીનો તો નહિ હોય ?’ આ એક મહાન વિચાર હતો, તેથી હૈયું સળવયું. હવે કેમ જંપીને બેસાય ? સત્યુરુષ જીતે તો ચોરી ન કરે પણ કોઈની ચોરીમાં સંડોવાવાનું ય શાનું પસંદ કરે ? એ તો ઉપડ્યો યજ્ઞદેવ પાસે.

યજ્ઞદેવની તપાસ : અસત્ય ઉત્તર :- પૂછ્યું “કેમ ભાઈ ! શું બન્યું છે આ ? તું મારે ત્યાં શા માટે મૂકી ગયો ?”

લુચ્યો યજ્ઞદેવ ઠાવકે મોઢે કહે છે ‘દોસ્ત ! જરાય શંકા ન રાખ. કોઈ પણ બીજો વિચાર લાવીશ જ મા. એ તો પિતાજીના ભયથી મેં એ તને સોંઘ્યો છે. બીજું કોઈ કારણ નથી.’

રાજાને ચંદનશેઠની ફરિયાદ :- એવી સફાઈથી જવાબ આપ્યો કે સીધા સાદા ચકદેવને ચોરીની શંકા નીકળી ગઈ. યજ્ઞદેવ અને ચોકખો માણસ દેખાયો. તેથી નિશ્ચિંત બનીને બેઠો. પણ અહીં તો કિમતી માલ ચોરાયેલો છે. તેથી માલિક ચંદન શેઠ શાનો શાંત બેસી રહે ? રાજાને ખબર કહી કે

“મહારાજ ! મારો માલ ચોરાયો છે.”

“શું શું ચોરાયું છે ?” રાજાએ પૂછ્યું.

ચંદનશેઠ બધું જણાયું. રાજાએ તે લખાવી લીધું. હવે કેમ ? ‘તમને શંકા હોય તેને લાવો અગર તેનું નામ આપો,’ એવું નહિ. અથવા ‘ધરના જ માણસોને કે નોકર-ચાકરને ચોરી કબૂલ કરાવવા મારવા-ગૂડવાના; -એમ નહિ.’ એ આજનાં તોફાન છે કે કેટલાય નિર્દોષનો આટો નીકળે છે; અને ગુનેગારો સો મણ ઝુની તળાઈમાં સુખે સૂવે છે ! રાજાએ તો નગરમાં ઢંઢેરો પીટાયો કે

રાજાનો ઢંઢેરો :- “ચંદન સાર્થવાહના ઘરમાં ચોરી થઈ છે. એનું ધન કોઈ ઉપાડી ગયું છે. તો જેના ઘરમાં કોઈ ગમે તે વ્યવહારના હિસાબે એ પૂરું ધન કે એનો અંશ પણ આવ્યો હોય તે રાજાને ખબર આપો. રાજા ઉગ્ર શાસનવાળા છે, તેથી જો કોઈએ ખબર ન આપ્યા અને પછી એની પાસેથી માલ મળી આવ્યો તો રાજા એનું સ્વર્સ્વ હરીને એને ભયંકર શારીરિક સજા કરશે; પણ જરાય સહન કરી નહિ લે.”

પાંચ દિવસ એમને એમ :- રાજા ન્યાયી છે, પ્રજાનો રક્ષક છે. ઢંઢેરો પીટાવીને ચલાવી તપાસ. પરંતુ ક્યાં પતો લાગે ? આવ્યો માલ જ શાહુકરના ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨૭

ધરના કોઈ ગુપ્ત ભાગમાં પડ્યો હોય ત્યાં શું પકડાય ? યજ્ઞદેવે પણ પાકી હોશિયારી કરી હશે કે ચંદનશેઠને ત્યાંથી માલ ઉપાડતાં એને કોઈએ જોયો નહિ હોય. અહીં તો સમય પર સમય વીતવા માંડ્યો. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો...ચોથો...પાંચમો; પાંચ પાંચ દિવસ વીત્યા છતાં રાજાને કશી ભાળ મળી નહિ.

યજ્ઞદેવ રાજા પાસે :- પ્રજાનો હિતેથી રાજા તો ધૂંઆ-પૂંઆ થઈ ગયો છે. ત્યાં હવે યજ્ઞદેવ પહોંચ્યો રાજા પાસે ! શા માટે ? જાણો અજાણ્યા માણસ તરીકે મુદ્દમાલની ખબર પડી છે તે કહેવા માટે. જુઓ એ રાજાને કેવી સફાઈથી કહે છે ! પણ જો જો, આપણે એવું શીખવાનું નથી હોં. પરંતુ અવસરે આપણી આગળ કોઈ શાંકો થતો આવે તો સાવધાન બનવાનું છે. રાજાને એ કહે છે,

“મહારાજ ! શું કહું ? વાસ્તવિક રીતે મિત્રના દોષનું પ્રકાશન કરવું ઉચ્ચિત નથી, પરંતુ સાથે સાથે એ પણ વાત છે કે, જે કાર્ય આલોક-પરલોક વિદુદ્ધ છે, તેવી અહિતકર પ્રવૃત્તિ કરીને જો તે પોતે સ્વયં પોતાના આત્માનો શત્રુ બને છે, તો મારો ય શત્રુ જ બનેને ? મિત્ર કેવી રીતે બની શકે ? હું એવી મિત્રતા નથી ચાહતો. જે માણસ રાજાને અને પ્રજાને અહિતવાળી વાત જાણતો હોય તેણે એ વાત ધુપાવવી ન જોઈએ, એની ઉપેક્ષા ન કરવી જોઈએ. એ સિદ્ધાન્ત અનુસાર, વાત ભલે મારા મિત્રની જ છે, પણ તે છતાં લાચાર દું કે હજૂરને એ વાત નિવેદિત કરવાની મને ફરજ પડે છે.” કેવો કપટપટ નાટકિયો !

પશુ હૃદયની તુલના :- જે વાત કંઈ જ તાત્ત્વિક નથી, જરાય સત્ય નથી, યુક્તિપુરસ્સર નથી, તેવી વાત બીજાની સમક્ષ રજુ કરવા માટે મોટી ચાલાકી કરવી પડે છે ! એમાં પાછું સજ્જન ઉપર ખોટો આરોપ મૂકવો હોય ત્યારે તો મહાન ખેલાડીપણું અજમાવાય છે. એવા હૃદયની તુલના ક્યા પશુના હૃદયની સાથે થાય ? માણસને બધું ઊજળું અને સીધું ગમે છે; માત્ર પોતાનું હૃદય જ ઊજળું અને સરળ રાખવાની ગરજ નથી. કેવી મહા-મૂઢ્યા !

રાજા તો યજ્ઞદેવની વાત સાંભળી વિચારે છે કે ‘કોણ હશે એનો મિત્ર ! અને આ શું કહેવા માગે છે ?’ એટલે યજ્ઞદેવને એ કહે છે.

“કહી દે આર્ય ! તું શું કહેવા માગે છે ? તને હું છૂટ આપું દું કહેવા માટે.”

યજ્ઞદેવ જવાબ આપે છે, “મહારાજ ! સાંભળો. આપણા નગરમાં જે ચકદેવ નામનો સાર્થવાહ-પુત્ર રહે છે, તે મારો મિત્ર છે. એ મિત્રતાને લીધે મારે એની સાથે મળવા-કરવાનું સતત રહે છે, તેથી એનો પરિવાર પણ મને પરિચિત

૨૮ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પાંચમે ભવે ચકદેવ” (ભાગ-૨૨)

છે. અરસપરસનો પરિયય હોવાથી હું એક વખત ત્યાં ગયેલો, ત્યારે ત્યાં ખાનગીમાં વાતચિત થઈ રહી હતી કે ‘આપણા શેઠે કૃપણ ચંદન શેઠને ઠીક દબાવ્યો ! ઠીક પોક મૂકાવી ! એનો માલ ઠીક રાખ્યો છે !’ આ સાંભળી મને શંકા પડી ગઈ કે પરિવાર જૂંહ તો બોલે નહિ, અને રાજાને તો અહીંયાં બહુ કણ્ણી વાત થઈ ગઈ છે ! તેથી આપને આ કહેવા આવ્યો હું. મિત્રની છુપી વાત કહેતાં લજવાઉ હું. પણ વાત ગંભીર હોવાથી કહેવી પડે છે. હવે આપને ઠીક લાગે તે.”

કેવી સીઝિતથી રજૂ કરે છે. જાણો રાજાને લગાડે છે કે “આપ પ્રજાપતિ કહેવાઓ, પ્રજાના હિતની આપને ભારે ચિંતા હોય ત્યાં આવા લુચ્યા માણસ આ ધંધા કરે છે ? આપને લાગતું હશે કે પ્રજા જો કષ્ટમાં, તો હું રાજ શાનો ?” રાજ પણ પૂર્વકાળના કેવા ? રાજ પોતાની રાજપણાની સફળતા શેમાં માને છે ? વધુ માન મલે એમાં ? મોટી મિલકૃત મલી જાય એમાં ? ના રે ના; ત્યારે શામાં સફળતા ? પોતાના સંતાન સમી પ્રજાનું ભલું કરવામાં. આ રાજનું હદ્ય કેવું ઉમદા છે કે પોતાની પ્રજા પાલકપણાની જવાબદારી તે સમજે છે, તો પણ એક વસ્તુ છે કે કોઈને અન્યાય કરવાની વાત નહિ ! માટે જ યજ્ઞદેવની ચાલાકીભરી વાણી એકદમ માની લેવાની છે નહિ.

રાજાનો યોગ્ય ઉત્તર :- યજ્ઞદેવે તો કહી દીધું કે ‘માલ એણે ઘરમાં છુપાવી રાખ્યો છે !’ રાજાએ સાંભળી લીધું. હવે જુઓ કે રાજાને ખબર છે, કે માણું પ્રજાપાલકપણું સુરક્ષિત રહેવું જોઈએ. તેમાં પાંચ પાંચ દિનથી ચોરીનો પતો નથી. અહીં પતો મળે છે. તો હવે આ સમાચાર મળ્યા પછી શું કરવાનું ? ‘પક્કી લેવાનો ચોરને, તે પછી સાચો હોય કે જૂઠો; એમ ?’ ના, રાજ એવો અન્યાયી નથી. શાંતિથી યજ્ઞદેવનું સાંભળી લઈને એ કહે છે, “આર્ય ! તું આ શું બોલે છે ? ચક્કદેવ જેવો સદ્ગૃહસ્થ ચોરી કરે ? અસંભાવનીય વાત છે. એ તો ઉત્તમ કુળમાં જન્મેલો છે; તેથી આવું અત્યન્ત કુળવિરુદ્ધ કામ શાનો કરે ?”

કુળનું મહત્વ : કુલીનનો ખ્યાલ અને બચાવ :- પાંચ દિવસથી જે માલનો પતો મલતો નહોતો, તે આજે મલે છે. તો પણ એકદમ એ વાતને રાજ માનવા તૈયાર નથી. માટે એને અસંભવિત કહે છે ! કેમકે રાજ કુળનું મહત્વ સમજનારો છે, ચક્કદેવ જે ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છે, તે આવું ઉભય લોક વિરુદ્ધ કાર્ય કરે એ એને સંભવિત લાગતું નથી. વાત પણ સાચી છે. પૂર્વે કુળનું મહત્વ બહુ રહેતું. કુલીનમાં પ્રાય: અનુચિત ભયંકર કાર્યો સંભવતા નહિ. અકુલીનમાં માયાચાર, ખૂન કરવું, જૂંહ બોલવું, વગેરે ઉભયલોક વિરુદ્ધ થઈ જાય છે. ધર્મની યોગ્યતામાં કેઈ ગુણ બતાવ્યા છે, એમાં આ એક ગુણ છે કે એ કુલીન હોય. કેમ ? એને ભાન

છે કે “મેં કેવા સારા કુળમાં જન્મ લીધો છે ! મારાથી ખરાબ કાર્ય થાય નહિ, બૂરી વાત સરખી ન બોલાય. ન વિચારાય !” કુળનો ખ્યાલ અવસરે પાપથી બચાવી લે છે. રાજાને યજ્ઞદેવની વાતમાં વિશ્વાસ પડતો નથી. તેથી પોતાના સ્વાર્થને અવગણીને યજ્ઞદેવની વાત ઈન્કારે છે.

ત્યારે યજ્ઞદેવ કહે છે, “પરંતુ મહારાજ, આપ જાણતા નથી કે સારી ચીજમાં પણ ખરાબ ચીજ ઉત્પન્ન થાય છે ? એમાં કુલનો શો દોષ ? જે તળાવમાં કુમળ જેવું સુંદર સુગંધદાર પુષ્પ ઊગે છે, તેજ તળાવમાં શું કીડા ઉત્પન્ન નથી થતા ? એવી રીતે મહારાજ ! હું પણ માનતો હતો કે ચક્કદેવ એટલે કુલીન હોવાથી સજજન અને શાશ્વો ! પણ અજ્ઞાન અને લોભ શું નથી કરાવતા ? એને પરવશ પડી ગયા પછી કશું અસંભવિત નથી. લક્ષ્મીનો લોભ અને પરલોકમાં શું થશે એનું અજ્ઞાન; પછી ચોરીની કાંઈ નવાઈ નથી. જો આ ચક્કદેવમાં સાચે જ હોય તો મારી તો એના પરથી આસ્થા ઊઠી ગઈ છે. હજુ, આપણે એને ક્યાં ચોર છરાવી દીધો છે ? એના ત્યાંથી માલ મલે તો પ્રશ્ન છે ને ? નહિતર તો એ ખરેખરો શાહુકાર છે જ. માટે એક વાર ગમે તે પ્રકારે એની આપ તપાસ તો કરાવો.”

ચાર-પાંચ અગત્યના શિક્ષણ :- અહીં આપણા જીવનને ઉપયોગી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા લાયક મળે છે.

(૧) પહેલું તો રાજ પોતાના સ્વાર્થ કે આવેશને આગળ કરીને ગમે તેના મોંઢેથી ગમે તેવી વાત સાંભળ્યા બરાબર માની લેવા અને અયોગ્ય પગલું ભરવા તૈયાર નથી. આ શું શિખવે છે ? સાંભળેલા ઉપર પહેલાં હંડકથી ઊંડો વિચાર કરવો. ‘કહેનાર કોણ છે ? કોના માટે કહે છે ? કેવી ગંભીર ગુનાની વાત કરે છે ?... વગેરે વિચારવું જેથી એકદમ જ સાહસ કરવા જતાં, પસ્તાવું પડે એવા જે વચ્ચન વર્તાવ આદરાઈ જાય છે તે અટકી જાય.

(૨) બીજું એ છે કે ડેડ-બંગીના કુળને બદલે ઉત્તમ આર્ય અને જૈનના કુળમાં જન્મવાના ઈનામ મળવા ઉપર લાયકી તરીકે આપણે કુળનું મહત્વ સમજી લંપટ ઈન્ડ્રિયો અને લાલચુ મનને ખૂબ કાંબુમાં રાખવું; જેથી એ અયોગ્ય સ્થાને દોરાઈ-ઘસડાઈ ન જાય.

(૩) ત્રીજી વાત એ છે કે અજ્ઞાન અને લોભ અસંભવિત ગણાતી વસ્તુનેથી શક્ય બનાવે છે; જો કે ચાલુ પ્રસંગમાં યજ્ઞદેવનું તો તૂત જ છે પરંતુ વાત સાચી છે કે આ લોકના રાજદંડ, અપશ્યા વગેરેનો ખ્યાલ ન રાખે, તેમજ પરલોકમાં ઠેઠ નારકીની ઘોર પીડાના દંડની પરવા ન રાખે. તો એ આલોક-પરલોકના અહિતનું

અજ્ઞાન જીવને દુષ્કૃત્યમાં સહેજે ધકેલે છે. એમાં વળી લોભસંજ્ઞાનું જોર, એટલે કેમ ? તો કે ‘બસ ! યેનકેન પ્રકારેણ મારે વસ્તુ જોઈએ;’- એ ધોરણથી ગમે તેવા હલકટ ધંધા કરતાં આંચડો નહિ. માટે લોભ અને અજ્ઞાન પાપનાં મોટાં કારણ છે; પાપના ખાસ દોસ્ત છે; પાપને જરૂર નોંતરી લાવે. પાપનાં જાણે એ બાપ છે. કેમકે પછી ત્યાં કુલ, વિદ્ધતા કે આબરૂ બેકાર બની જાય છે. એમનું બિચારાનું એ લોભી બનેલા જીવ પર કાઈ ઉપજી શકતું નથી. માટે જ લોભ અને અજ્ઞાનથી દૂર રહે.

(૪) ત્યારે એ પણ એક વસ્તુ છે કે, અલભત જ્યાં ને ત્યાં વહેમાતા ન ફરવું; છતાં એકદમ વિશ્વાસમાંય ન રહેવું; એય જરૂરી છે. કુળ વિદ્ધતાએ હોવા છતાં લોભ અને અજ્ઞાન અવસરે પ્રગટ નહિ તો પ્રચ્છન્ન (ધૂપા) પાપ કરાવી દે છે. તેથી એકદમ વિશ્વાસ મૂકવા કરતાં કંઈક સાવધાની પણ જરૂરી છે. આના જ્યાલના અભાવે એવું એવું બને છે કે છોકરો જરા ઢીક બોલકણો અને બુદ્ધિમાન હોય, કંઈક વિનયી હોય એટલે એના પર વિશ્વાસ વધારે પડતો મૂકાય છે, અને તેની બીજી તપાસ નથી રાખવામાં આવતી. પરિણામે કેટલીકવાર પ્રારંભે ધૂપા દોષોનો એ ભોગ બને છે. પછી એ દોષો પ્રકાશમાં આવે ત્યારે બાપ ચોંકી ઉઠે છે !

(૫) ચાલુ પ્રસંગમાં યજ્ઞદેવ જે ધોર માયા આચરી રહ્યો છે, એ માયાથી ખૂબ ચેતવા જેવું છે. માયા એ ધૂપો દોષ છે. જગતને કોધાએ દોષ પ્રગટ દેખાય છે; પણ માયા એક એવો દુર્ગુણ છે કે તેની ખબર જ ન પડે ! કોધમાં તો આંખ લાલ થાય, હોઠ ફસ્ફી ઊઠે, અભિમાનમાં છાતી ટટાર રહે. પગ ઠમક-ઠમક કરતો પડે... આ બધી ખબર પડી જાય કે આ અભિમાની છે, આ કોધી છે ! વાત કરવા બેસે ત્યારે એના મોંઢે એવું કંઈક આવવાનું કે “અરે ! આમાં શું ? આ તો રમતમાં થઈ જાય... આપણે ખોટું જરાય ન સહીએ... આ લોકો મારી શક્તિ નથી સમજતા...” બધાને મોંઢે પોતાની હોશિયારી ગાયા કરવાનો ! લોભી પણ અજ્ઞાયો ન રહે ! બજારમાં બીજા લોકો છ કલાક જ રહે ત્યારે આ ભાઈ દસ કલાક સુધી જામ્યા રહે ! તેવી રીતે દીર્ઘાળું પણ ખુલ્લો પડી જાય છે; કેમકે એ બીજાનું જ્યાં ત્યાં કાપતો જ રહે ! આ બધા દોષોના લક્ષણોથી ખબર પડી જાય છે કે આ દોષ છે. પરંતુ માયા ચીજ અવી છે કે એનું બાધ્ય લક્ષણ જોવામાં આવતું નથી ! માયા નામ જ એનું છે કે જે હૃદયમાં હોય પણ બીજાને ઠગી પોતાનો મહિન સ્વાર્થ સાધવા બહાર દેખાવા ન દે અને દેખાય નહિ તેથી એને શિખામણ કોણ આપે ને કોણ એ દોષ મૂકાવે ? એ માટે શાસ્ત્રકારો માયા દોષને ભયંકર કહે છે. તેથી આ બધાનો સાર એ છે કે માયાથી જાતે જ બચો. અર્થાત્ માયા કદી ન સેવો.

શિખામણ નહિ તો શિક્ષાથીય દોષ નરમ પડે :- શિખામણ ન મળી કે ન

લાગી, તોય કોથ, માન, લોભ કે કામના જે દોષો છે તેની શિક્ષા થવાનો પણ સંભવ છે. કોધીને કે અભિમાનીને શેરના માથે સવાશેર મલી ગયો કે બાર વાગી જવાના ! લોભીને એક એવી બજાર-ફાઝરની ઠોકર લાગે કે ધરે જ બેસવું પડે ! તેવાં રીતે કામના વાતમાં પણ એવી ફરેલ માથાવાળી મળી જાય કે જે દિ’ને રાત હૈયું સેકી ખાય. આ દોષોને શિક્ષા મળી જાય એટલે ય દોષ નરમ પડવાને અવકાશ છે, પણ માયાની શિક્ષા ક્યાં ? અને જે દોષની પાછળ શિક્ષા નહિ, તે દોષ ફૂદકે વધતો જાય છે. માયા તો સુખ અને યશ બેઉ લુંટે છે. જીવન આવું માયાની જંજાળમાં ચાલી જવાનું; એમાં બીજી છતી સગવડના સુખ નહિ. ત્યારે શું માયા કરવાથી જશ મલે છે ? ના, લાંબે ગાળે અપજશના પોટલાં ! હા, સ્નેહ ન હોવા છતાં ઉપરથી સ્નેહ બતાવે, તો તત્કાલ જશ મલે ખરો; પરંતુ દિલમાં જુદું છે અને બતાવવાનું જુદું ! ત્યાં લોકમાં થોડા વખત માટે કદાચ ચાહુના રહે; પરંતુ માયા વધતી રહેવાથી અંતે મહાન અપકીર્તિ, લોકનો અવિશ્વાસ, વગેરે નુકશાન સિવાય કોઈ બીજું સારુ પરિણામ નથી આવતું. તેનાથી સંસાર દીર્ઘ થાય એ તો વળી મહાન નુકશાન !

માયા સંસારની માતા ! :- શાસ્ત્રો માયાને સંસારની માતા, જનેતા કહી છે. આ માતા એટલી પ્રેમાળ છે કે જીવને સંસારમાં એક નહિ પણ કેઈ જન્મ આપે છે, કેમકે માયાના સંસ્કારનો વારસો જન્મે-જન્મે સહેલાઈથી નવા દુર્ગતિના ભવની સગવડ કરી દે છે. આનાથી સંસારની વૃદ્ધિ થાય છે. વળી દેવગુરુની મોંઘેરી સાધના સામગ્રી બાજુમે રહી જાય છે. એટલું જ નહિ પણ દિલમાં જેણે માયા ભરી, ત્યાં દેવગુરુ અને ધર્મને સેવવવાનું તો નહિ પણ ઠગવાનાં એ કાર્ય કરશે. આરાધના તો દૂર રહી, પણ આશાતના અને વિશ્વાસધાત કરશે ! બીજાનોય દ્રોહ કરશે.

• પારધી અને પંખીનું દણ્ણાત •

એક જંગલમાં એક પારધી શિકારે ગયો. ત્યાં એક ઝાડ પર પક્ષી બેઠેલું હતું. પારધીએ બાણ ચંચાયું, અને નિશાન તાકયું. પક્ષીએ જોયું કે બાણ મારી તરફ તકાયું છે. એટલે એ ઊરિને પારધીની સામે આવ્યું ! પારધી તો આશ્રમ પામી ગયો. ‘આ શું ? મરવા અહીં વહેલું આવ્યું ?’ નિશાન ભૂલી ગયો. પક્ષી એને કહે છે, “જો ભાઈ, તું મને હમજુંનાં ન મારીશ મારા બચ્ચાં ધેર છે; હું એને ખાવાનું આપી આવું, એ ભૂખ્યા છે મારી રાહ જોતાં બેઠાં. પછી તારી પાસે આવી જઈશ. તે પછી તારે જે કરવું હોય તે કરજે...” પારધીને તો વધુ આશ્રમ

થયું ! કેમ વારું ? એક વાર છૂટીને ગયા પછી ફરી જાતે ફસાવવા આવવાનું કહે છે. આવા પક્ષી તો શું પણ માણસ કેટલા મળે ?

એ કહે છે, “પણ તું નહિ આવે તો ?”

‘તો જે પાપ વિશ્વાસધાતીને લાગે તે પાપ મને લાગશે.’

વિચારો કે તે કાળે વિશ્વાસધાતનું પાપ કેટલું ભયંકર મનાયું હશે કે આ પક્ષી આ ગ્રમાણો કહેતું હશે ! આજના શિક્ષણમાં આ આવે ને ? ના ? વિશ્વાસધાતની ભયંકરતા બાળપણથી શિખવવાની નહિ ? આ નથી શિખવાનું માટે જ વિશ્વાસે વર્ષો સુધી દુઃખ વેઠિને ઉછરેલા છોકરા તમારો દ્રોહ કરે છે ને ? માટે શિખવો, બચયપણથી જ ગુણો શિખવો. શાળામાં આજે કમભાગ્યે આત્મગુણોનું શિક્ષણ ન મળે ! તો પણ પાઠશાળામાં એના ખાસ પાઠો અને કથાઓ દ્વારા એ શિખવો કે દ્રોહ ન થાય, દીર્ઘા ન કરાય, જૂં ન બોલાય, જરા પણ ચોરી-અનીતિ ન આચરાય. ધૈર્ય, હિંમત, સહિષ્ણુતા, ત્યાગવૃત્તિ વગેરે ગુણો જોઈએ જ.

પક્ષીને પારધીએ જવા દીધું. એ જઈને પોતાના બચ્ચાને ખાવવાનું આપી પાતું પારધી પાસે આવી ગયું ! પારધીના મનમાં તો આધિક આશ્રમ થયું !

એટલે એને કહે છે, “હું તારા પર ખુશ થઈ ગયો છું; તો તું મારી પાસેથી કંઈક માગી લે; માત્ર બાણ ન મારવું, એટલું ન માગીશ !”

પક્ષીય ચતુર છે. બોલ્યું, “ઢીક જો હું કહું તે કરીશ ?”

“હા.”

“તો હું એક તારી સલાહ માગું છું. સાચી સલાહ આપીશ ને ?”

“જરૂર.”

“તો તું એ કહે કે હું કઈ દિશામાં ઉઠું તો તારું બાણ ન વાગે ? જો જે હોં, હવે તું ય વિશ્વાસધાત ન કરતો !”

કેવી યુક્તિ ! જો એ કહે ‘આ દિશામાં ઉડ, તને બાણ નહિ લાગે,’ અને પછી પાછો તેજ દિશામાં એના પર બાણ લગાવે તો તો ખલાસ ! વિશ્વાસધાત થયો !

અણઘડ-સુધડ યુગ :- હવે તો પારધી વિચારમાં પડી ગયો કે મારે શું કરવું ? કેમકે આ બાજુ પક્ષીએ પારધીને પાછા આવવાનો વિશ્વાસ આપ્યા પછી વિશ્વાસનો ધાત નહોતો કર્યો. એ તો અજ્ઞાન અવિવેકી તિર્યંચ કહેવાય. તોય વિશ્વાસધાતનું પાપ ન કર્યું ! તો પછી તેનાથી સેંકડો હજીરો ગુણો ઉચ્ચ ગણાતો માનવ ! વિશ્વાસધાતનું ધોર પાપ આચરે તો કેવા ગણાય ? તિર્યંચથીય નપાવટને ? જો જો આ પારધી છે પણ ગ્રામીન કાળનો પારધી ! આજના વિલાયતી ડારવીન

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવર્ણન મહોદેવિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૩૩

થીયરી, Darwin Theory- વાંદરામાંથી મનુષ્ય થયાના સિદ્ધાન્તના પૂજારી જે પ્રાચીન યુગને અણઘડ યુગ કહે છે, એ જ ખરેખરો સુધડ યુગ હતો. અણઘડ તો આજનો યુગ કહેવાય કે જ્યાં, પારધી જેવા હલકા ધંધાવાળા તો શું પણ, ઉંચા ધંધાવાળાને ધોર વિશ્વાસધાત કરતા સાંભળીએ છીએ ! ત્યારે, પ્રાચીન યુગમાં પારધીને વિચાર થઈ પડ્યો કે ‘મારાથી વિશ્વાસધાત કેમ કરાય ? ભલે આજ મને શિકાર નથી મજ્યો પણ આ પક્ષીને તો હવે મરાય જ નહિ.’ કેમ આ વિચાર ? પક્ષીની હિંમત અને નેકો જોઈને એ સ્તર્ય થઈ ગયો છે.

તિર્યંચની સમજ અને હિંમત :- વાત પણ સાચી છે. પક્ષી કલ્યાણ મુજબ ધાતકી પારધી પાસે આવીને હાજર થાય છે ! એ એની કમ હિંમત અને વિશ્વાસપાલકતા ન ગણાય ! મહાન શૌર્ય અને મહાન વચ્ચનભદ્રતા ગણાય. અહીં એક પ્રશ્ન થશે કે

પ્ર.- પક્ષી એવું બોલે જ કયાંથી, તો પછી એવો હિંમતનો બનાવ બનવાની વાતેય શી ?

૩.- પક્ષીની ભાષા જ્ઞાનનારા જગતમાં હોય છે, તો એવો જ કોઈ દાખલો સમજો કે જેમાં એ પારધી પક્ષીની ભાષા જોણે છે. બાકી પક્ષી એની ભાષામાં તો બોલીય શકે છે અને સમજુ શકે છે. તેમજ તિર્યંચોની સમજના અને પરાક્રમના દાખલા પણ જગતમાં બને છે. શ્રેણીકનો સેચનક હાથી હુકમ થવાથી પોતે અગ્નિમય ખાઈમાં કૂદી પડ્યો પણ તે પૂર્વે પોતાના માલિક હલ્લ-વિહલ્લને ખાઈની બહાર નીચે જમીન ઉપર ઉત્તારી દીધા-;અને વિવેકભરી સમજ અને હિંમત નહિ કહેવાય ? મેઘકુમારના જીવે પૂર્વ ભવમાં હાથી તરીકે સસલાના બચાવ અર્થે અદી દિવસ પગ ઊંચો રાખી મરણાન્ત કષ વેઠ્યું હતું. એ ઉદારતા, સહિષ્ણુતા અને દયાની સમજ કેવી ? પ્રસ્તુતમાં પણ પક્ષી હિંમતવાન અને બોલ્યું પાણનારું બન્યું છે, એ આજે માનવને એવા બનવાની શિખામણ અને પ્રેરણા આપી રહ્યું છે. ગમે તેવું કષ સહી લઈએ પણ બોલેલું પાણીએ-આ નિર્ધાર રાખવા ઘટે.

પારધીએ પણ સજજનતા વાપરી પંખીને જતું કર્યું. વિશ્વાસધાત ન કર્યો; અવળી સલાહ ન આપી.

મામુલી વાતમાં ય માયા ! :- યજ્ઞદેવે વિશ્વાસધાત કર્યો. માયા જળ પાથરી. શા માટે ? માત્ર ચક્કદેવને ઠગું એ ભાવના હતી. માયા એવો ભયંકર દોષ છે કે એ કોઈ મોટા લોભમાં જ આચરાય છે એવું નથી, પણ મામુલી બાબતમાંય કરાય છે. દા.ત. પતિને બતાવું છે કે અમે આખો દિવસ વૈતસુ કરીએ છીએ. તેમાં પતિની ગેરહાજરીમાં બે કલાક લાંબી ઊંઘ ઝેંચશે પણ દાદરો ખખડતાં ઝટ ઊઠી

૩૪ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પારધી અને પંખીનું દણાન્ત” (ભાગ-૨૨)

કામે વળગી જરો ! હવે આટલું સારું પતિને ન લગાડ્યું તો શું બગડી ગયું ? એમ જાણત કે આ ઉંઘે પણ છે; પરંતુ બીજી સેવાથી ખુશ પણ રહેત. તો માયાથી ઉચ્ચ માનવ હૃદયને કાળું કરવાની શી જરૂર ?

યજ્ઞદેવે માયા કરી. રાજાને પણ થયું કે “આ આટલું કહે છે તો તપાસ તો કરવી.” રાજાનું મંતવ્ય જાણતાં યજ્ઞદેવના દિલમાં ટાઢક વળી ! “હાશ ! હવે શિકાર સાણસામાં...” શું છે આ ? નરકગતિનાં નિર્મિષા, ભયંકર કપાવાની છુંદાવાની... પીડા અસંઘ્યકાળ સુધી ! પ્રતિસમય કારભી પીડાને કરોડો-અભજો વર્ષથી ય વધુ કાળ સહન કરવાનાં ભારે કર્મ ઉપાર્જન કરવાનું. આવાં માયાવી પાપ કાર્યથી થાય છે. પાપકાર્યની પૂર્વભૂમિકામાં દુષ્ટ વિકલ્પો અને પછીથી પાપ થવાની અનુમોદના, એ ફળને મોટું કરી દે છે. રાજાએ કારભારીને બોલાવ્યા; કહ્યું કે,

“નગરના મોટા માણસોની સાથે ચંદન શેઠના ભંડારીને લઈને ચક્કદેવને ત્યાં જાઓ અને ચોરી થયેલા માલની તપાસ કરો.”

રાજાની આ આજ્ઞા સાંભળીને કારભારીને પણ આશ્ર્ય થયું. “આ અસંભાવનીય શું ? મહાસજજન ચક્કદેવને ત્યાં ચોરીની તપાસ !... પરંતુ હા, અમે તો આજ્ઞાના તાબેદાર છીએ” એમ કહી આશ્ર્ય દબાવી, જવાનું નક્કી કર્યું. એને ક્યાં ખબર છે કે હું શું આશ્ર્યમાં પડું છું ? ખુદ રાજાને એના પર શંકા નથી; પણ એવા સમાચાર મલવાથી એને તપાસ કરાવવી પડે છે. રાજાની આજ્ઞા લઈ, કારભારીઓએ મોટા માણસોને ભેગા કર્યા. ચંદન શેઠના ભંડારીને પણ બોલાવ્યો; અને બધાને લઈને એક પહોર દિવસ ચંદ્રચો હશે એટલામાં ચક્કદેવને ત્યાં આવ્યા. કોણ છે ચક્કદેવ ? અમરગુપ્ત શાની મહર્ષિ. એ કહે છે કે મને પેલાઓ પૂછે છે;

“સાર્થવાહપુત્ર ! આજે અમે એ પૂછવા આવ્યા છીએ કે આપને ત્યાં મોટો વેપાર ચાલે છે, તો તેમાં કોઈ પ્રકારની લેવડદેવડના નિમિત્તમાં આપને કોઈ આવો માલ તો નથી આપી ગયું ને ?”

મને કાંઈ શંકા ન થઈ. એટલે તરત જ મેં જવાબ દીધો- “ના ના !”

ત્યારે વળી કારભારી હાથ જોડીને કહે છે, “મહાનુભાવ ! અમને મહારાજનો હુકમ છે કે તમારા ધરની તપાસ કરવી. તો કૂપા કરી અમારા પર ગુસ્સે ન થતા...”

“ભાઈ, એમાં કોપ કરવાનો અવસર જ નથી. મહારાજની પ્રવૃત્તિ તો પ્રજાનું રક્ષણ કરવાની હોય છે.”

પોતાનું નિર્દોષ જીવન બીજાના મોભાનો ખ્યાલ :- રાજાનું કર્તવ્ય શું છે, તે ચક્કદેવ બરોબર સમજે છે, તેથી કારભારીને પોતાનું ધર તપાસવાની ખુશીથી છૂટ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાચિય કહા.” (ભાગ-૨૨)

ત૪

આપે છે. આમાં બે વસ્તુ છે. એક તો નિર્દોષને કોઈ ભય નથી. ભય પાપીને રહે છે. માટે જ બને ત્યાં સુધી ગુનાના પાપના સક્રિયામાં ન આવવું. (૨)... બીજી વસ્તુ એ છે કે આપણા અપમાનની ગણના કર્યા વિના સામા માણસનો મોભો બરાબર ખ્યાલમાં રાખવો. આ મર્યાદા પળાય તો વહેવાર સ્વર્ગાય સર્જાય.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૪, તા. ૭-૫-૧૯૫૫

રાજપુરુષો નગરના વૃદ્ધ પુરુષો સાથે ધરની અંદર પેઢા; અને વિવિધ પ્રકારનો માલ જોયો. જોતાં જોતાં ત્યાં દશ્ટિ ગઈ કે જ્યાં ખાસ કાળજીથી યજ્ઞદેવે આપેલો ડાબડો મૂકેલ હતો ! હવે શું ? બહાર કાઢ્યો એ. તેના પર નામ લખ્યું હતું “ચંદન શેઠ.” તો શું પહેલાં ચક્કદેવ નામ નહિ જોયું હોય ? કદાચ જોયું હતે અને શંકા પણ પડી હતે, પરંતુ મિત્ર પરના વિશ્વાસના યોગે ખાલી બારદાનનું પરાવર્તન સમજ વધુ તપાસ કરવાની જરૂર માની નહીં હોય, અથવા નાના અક્ષરમાં કોતરેલા નામ ઉપર નજર ન પણ પડી હોય એ બને. ગમે તે કહો, પણ ડાબડો જોયો; બહાર કાઢ્યો, અને ચંદન શેઠના ખજાનચીને બતાવી પૂછે છે,

“કેમ તમારો છો ?”

ભંડારી પણ લાયક માણસ છે. ચક્કદેવ જેવા મહાશાહુકારના ધરમાં આ ડાબડો જોઈ ચોંકી ઊંઠે છે ! જવાબ શો દેવો. દુઃખી થઈને એ કહે છે.

“ભાઈ ! ડાબડો લાગે છે અમારાનો મળતો પણ નિશ્ચિત રૂપમાં કહી શકતો નથી.”

કારભારી કહે છે કે “હશે, તારી પાસે ચોરાયેલા માલનું લિસ્ટ (નોંધ) પત્ર છે ને ? તે વાંચ, અને આમાંની માલની સાથે મેળવ કે આવી-આવી નોંધ છે એમાં ? એટલે ખબર પડી જશે.”

પૂછોને શાહુકારના ધરમાં આ ? હા, તપાસ હતી આ તો ! નોંધ વાંચી ખજાનચી લિસ્ટ સાથે ડાબડાનો માલ મેળવતો ગયો. જરા પણ ફેર વિના નીકળ્યો બરાબર ! નગરવૃદ્ધો અને કારભારીઓ ચોંકી ઊંઠ્યા ! આના ધરમાં આ ? હવે શું થાય ? મોટો પ્રશ્ન થઈ પહ્યો. જુઓ, કામ બહુ સાવધાનીથી કરે છે. સજાનતાને જાળવીને, અને સામાની શાહુકારીનો પૂરો ખ્યાલ રાખીને. પરંતુ વસ્તુ જ્યાં એજ હતી કારભારીઓ ને નગરવૃદ્ધોની પણ નજરમાં ધડકા જેવું જ થાય ને ? છતાં ખૂબી એ છે કે હજુ કાંઈ એકદમ જ એવો કોલાહલ નથી મચાવી મૂકતા કે ‘હેતું ચોર; બદમાસ ! આવા ધંધા કરે છે ?’ ના, આવું કાંઈ જ નહિ. એ તો ખૂબ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પારાધી અને પંખીનું દણજાત” (ભાગ-૨૨)

શાંતિથી ચકદેવને પૂછે છે.

કુઓ તુહ ઇમં ?

“આ તમારી પાસે ક્યાંથી ?”

ચકદેવની ઉમદા વિચારણા :- અહીં શો પ્રસંગ છે ? સમરાદિત્યના બીજા ભવમાં સિંહકુમાર ધર્મધોષ આચાર્ય મહારાજ પાસે ચરિત્ર સાંભળી રહ્યા છે. કયું ? અવધિજ્ઞાની મહેરિ અમરગુપ્ત આચાર્ય ભગવંતે પોતે કહેલું પોતાનું ચરિત્ર. એ ચરિત્રમાં એ અવધિજ્ઞાની ભગવંત આગળ વધીને કહે છે કે હું ચકદેવ તે ‘આ વાસણ તમારી પાસે ક્યાંથી ?’ એવા કારભારીના પ્રેષન ઉપર વિચારમાં પડી ગયો કે ‘મિત્રે મારા પર વિશ્વાસથી રાખીને મૂકેલી થાપણને મારાથી પ્રગટ કેમ થાય ?’ જો એ પ્રગટ કરું તો ધાડ બધી મિત્રના ઉપર જાય અને એ બિચારો મારી ગફકલથી મુશ્કેલીમાં મૂકાય. કોને ખબર કે આ માલ એની બિચારાની પાસે પણ એમજ ક્યાંકથી કાં ન આવ્યો હોય ? તેથી મારા પ્રાણ બચાવવાના મોહમાં, મિત્રના પ્રાણ જાય એવું, મારાથી કેમ જ થાય ?’ એમ મનમાં વિચારીને મેં કારભારીને ઉત્તર કર્યો કે ‘એ મારો જ છે.’ બોલવામાં જરાય ગભરામણ નથી. અહીં ચકદેવની ઉત્તમતા જોવા જેવી છે. પહેલા વહેમ લાગતો હતો; પણ એક વાર મિત્રનો માલ રાખી લીધો એટલે માને છે કે ‘આ તો મિત્રે મારા પર વિશ્વાસ મૂકીને આ માલ મને સોંઘ્યો છે. તો હવે એ વિશ્વાસનો ભંગ કેમ થાય ?’ અહીં પ્રેષન થાય કે

પ્ર.- પણ એ આમ તો પ્રજારક્ષક રાજાની પ્રવૃત્તિને આવકારે છે; તો પછી શું ચોરને ટાંક-પિછોડો કરવો વ્યાજભી છે ?

૩.- આ પ્રેષને સ્થાન જ નથી. કેમકે અહીં તો પોતે મિત્રને ચોર સમજવાને બદલે મનમાં સમાધાન કરી લે છે કે ‘જેમ માલ મારી પાસે મિત્ર તરફથી, તેમ મિત્રની બિચારાની પાસે પણ ક્યાંકથી વિશ્વાસમાં આવ્યો હોય. મિત્ર કાઈ ચોરી કરે નહિં. એને વળી કોઈએ ભરોસાથી સોંઘ્યો હોય.’ આમ વિચારીને મિત્રને નુકશાન પહોંચે એવું પોતાના તરફથી કશું જ કરવા તૈયાર નથી.

‘આપ ભલા’... બનો.

આમાં ઘણું શિખવાનું છે. ચકદેવ સજજન એટલે મિત્રને પણ આવો માલ બજારી ગયેલા છીતાં સજજન તરીકે જુઝે છે. કહેવત તો એવી છે કે ‘આપ ભલા તો જગ ભલા.’ આપણે સજજન તરીકે રહીએ-વત્તિએ તો જગત પણ આપણા તરફ સજજન તરીકે વર્તે. જ્યારે અહીં, મિત્ર યજ્ઞદેવ પ્રત્યે ચકદેવની સજજન-વર્તણુંક છિતાં, એ દુર્જનતાથી વર્તી રહ્યો છે. તો પછી ‘આપ ભલા તો...’ ક્યાં રહ્યું ? ત્યારે કહો કે એનો અર્થ એમ પણ કરવો જોઈએ કે જો ‘આપ ભલા’ એટલે

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાદિત્ય કહા.” (ભાગ-૨૨)

૩૭

આપણે દિલના સજજન, સરળ અને સદ્ભાવવાળા બનીએ, તો આપણા દિલમાં ‘જગ ભલા’ એટલે કે જગત પણ ભલું સજજન અને સરળ દેખાય. હવે સામાના કુટિલ વર્તાવનો દિસ્તાબ ન રહ્યો. એનામાં કદાચ દુર્જનતા હશે, તોય આ સજજન-દિલમાં એનું સારું સમાધાન કરી લેવાશે. સમાધાનના અનેક રસ્તા છે. સામાના વર્તાવ પર નહિં, પણ પોતાના દિલ પર માપ નીકળે છે. પોતે હૈયામાં વાંકી-ચૂકી, આંટી-ધુંટીવાળી વિચારણા કરે તો સામાનાં વક્તા હોવાની કલ્યાન ઊઠે. દિલ સજજન અને સીધું બનાવી દીધા પછી તો એક વાર માનો કે કદાચ મિત્રસ્નેહી વગેરે સામા તરફથી આપત્તિ આવી દેખાઈ, તો પણ એમાં સામા પ્રત્યે વક્તાનો વિચાર નહિં આવે. એવા પ્રસંગમાંય સામાનું ગૌરવ ઊભું રાખીને કંઈક સમાધાન મન કરી લેશે. આ જો આવડે તો જીવન સુખ અને સદ્વિચારોથી મધમધતું. પત્નીએ પત્નીની કોઈ સગવડ બરાબર ન સાચવી, તો સજજન પત્તિ એનામાં બરાબી વિચારવાને બદલે એવું જ કંઈક માનશે કે ‘એ પત્તી ય બિચારી કોઈ ખટપટમાં પડી ગઈ હશે. તે કેટલે પહોંચે ?’ પાછું આમ માનશે એટલું જ નહિં પણ સગવડ ન સાચવી શકવા બદલ વિલખી થતી પત્નીને ઉપરથી પોતે આશાસન આપશે કે ‘હોય, એમાં શું થઈ ગયું ? તમારી કોઈ કસ્યુર નથી. બીજા કામનો ભાર હોય તો બધે તે માણસ ક્યાંથી પહોંચે શકે ?’ આ વર્તાવનું કેવું સુંદર પરિણામ આવે ! પત્નીનો પત્તિ ઉપર સદ્ભાવ કેઈ ગુણો વધી જાય. કુદરતી સદ્ભાવ, એથી સુખ અને સદ્વિચારણા વધારવાના આવા બધા રસ્તાઓ છે. સજજન દિલે સમાધાન કરી લેવું જોઈએ. પણ એનાથી વિપરીત વર્તવું હોય તો પછી સામા પાસેથી સદ્ભાવાની બહુમાનની શી આશા રાખી શકાય ? વાત એક જ છે કે પોતાનું દિલ સજજન બનાવો. જેવી પત્નીની સજજનતા, એવું જ પત્નીની સજજતાનું સમજવું. એનેય પત્તિ તરફની કોઈ અગવડ દેખાઈ, ત્યાંય મનમાં પત્તિનું ગૌરવ ઊભું રાખીને પત્તિને કહે કે ‘આપને અમારું કાર્ય ધ્યાનમાં તો છે જ. બીજા વધુ અગત્યાના કામકાજમાં એ કાર્યનો સમય ન મળ્યો હોય; કે પૈસા ન ય પહોંચતા હોય; તેથી કાર્ય ન થયું હોય. તેમાં આપ શું કરો ?’ આવું આવું આશાસન પોતે મનાવે તો સામાનો પોતાના ઉપર કેટલો બધો સદ્ભાવ વધી જાય ! પિતાપુત્રના, ભાઈભાઈના, માતાસંતાનના, મિત્રમિત્રના ઈત્યાદિ વ્યવહારો પર દિલની આ સજજનતાની ખૂબ છાયા હોય તો વ્યવહારો કેવા સ્વર્ગીય બની કેટલા બધા દીપી ઊઠે !

‘આપ ભલા’ બનવામાં મન બહુ શોરું રહે છે; મન પવિત્ર રહે છે. કદાચ કોઈના તરફથી આપત્તિમાં મૂકાયા, તોય ત્યાં સમજવું જોઈએ કે આપણા પોતાના

૩૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પારધી અને પંખીનું દણાન્ત” (ભાગ-૨૨)

પાપનો ઉદ્ય એમાં કારણ છે. ત્યારે ‘રહેને ફસાઈ જઈએ, ફસાઈ જઈએ’- એમ વિચારી વિચારી સ્વજન સ્નેહી પ્રત્યે હરહુંમેશ દિલ વહેમાતું અને વક્ત રાખવામાં શો લાભ છે ? પાપનો ઉદ્ય હોય તો ભોગવવું તો પડે જ છે. માનોને કદાચ સામો સાચેસાચ દુર્જન છે, અને કંઈક નુકસાન આપણને કરે છે ય ખરો. પરંતુ ત્યાં એવા કોક પ્રસંગથી ડરીને મનને સતત મલિન શા માટે રાખવું ? થોકબંધ પાપોનું એથી સતત ઉપાર્જન થયા કરે એનું શું ? અહીનું કોક નુકસાન તો અંતે અમજ ચાલ્યું જશે પણ (૧) હેયાના કૂટિલ વક્ત સંસ્કાર અને એનાં ફળરૂપ પાપ માથે પડી જશે. (૨) દિલને સ્વજન સ્નેહી તરફ વહેમાતા, વક્ત, દુભાતા અને ફરિયાદ કરતા રાખવાની અરસપરસનાં જીવન કલેશમય બની જાય છે. (૩) ન જોઈતી આપદાઓ ઊઠે છે. (૪) સ્નેહી જ પોતાના વિરોધમાં રહે છે. (૫) જરૂર પડ્યે જિંદગીભરના જુવારા થાય છે. (૬) એકબીજાનું કાપતા ફરાય છે. (૭) અરસપરસના સહકારથી નાતજાતમાં જે વટ આબરુ વધે એમ હોય, સંપત્તિ વધે એમ હોય, અન્યોન્યની સહાયથી સુખ-સગવડ સારી રહે એમ હોય,-એ બધું અરસપરસના સહકાર તોડી વિરોધ જગાવવાથી ઊડી જાય છે. (૮) પોતાનું મન જિંદગીભર નિરાશાભર્યું, અને (૯) આગળ વધીને નીચ-હલકટ વિચારોભર્યું બની જાય છે. કેવી દુર્દશા ! ! આ બધું શાથી ? ‘આપ ભલા’ ન બનવાથી; દિલ સજજનનું સીધું અને ઉદાર ન બનાવ્યાથી ! સજજન દિલમાં તો બીજાની સેંકડો ભૂલો ક્યાંક ઊંડાણમાં ઊતરી જાય છે; અને ઉપરથી એના પ્રત્યેનો નીતરતો પ્રેમ અને સદ્ભાવ વહેતો રહે છે. અર્થાત્ સામાની ભૂલો એ ક્ષાન્તબ્ય લાગે અથવા ભૂલ રૂપજ નથી લાગતી, પણ સંયોગની પરાધીનતા લાગે છે. એમ થાય છે કે “એમના સંયોગો જ એવા હતા કે એમને શું, મારેય આવું કરવું પડે.” ‘અરે ! હું તો આવું ન જ કરું; આ તો એ મૂખાઓ આવું કરે’ એમ પણ જો મનમાં આવે તોય વિચારવું ઘટે કે એમાંય એમની સમજણ નહિ માટે ને ? તો સમજણના અભાવે તો તું ય એવું કાં ન કરે ?

● ઉદારતા ●

ચક્કદેવનું સજજન-દિલ છે; તેથી મિત્ર માટે માની લે છે કે ‘એના ગળામાંય આ માલ ક્યાંકથી આવી ભરાડો કાં ન હોય ? એની સજજનતા મિત્રમાં દુર્જનતા હોવાનું માનવા ના પાડે છે.’ ત્યારે હવે એ જુઓ કે ચક્કદેવની પાછી ઉદારતા પણ કેટલી બધી ? મિત્ર ખાતર ભોગ આપવાની સાવધાની કેટલી ?

કોઈ કોઈનાથી બળતું હોય તો જ બીજાની ઠેકડી ઉડાડે.

ચક્કદેવના આંગણો રાજના અમલદારો આવ્યા છે; મહાજન આવ્યું છે; રાજીએ કરુક ઢંઢેરો પીટાયો છે; પોતે ય જાણો કે આમાં દેહાંત દેઢની સજા થાય. મિત્રના બચાવ તરફ જોવા જશે તો પોતાની આબરુ અને ગ્રાણ સુદ્ધાં ઊડી જશે. આ બધા સંયોગોની વચ્ચમાં વિચારો કે ઉદારતા રહેવી એ કેટલી મોંધી છે ! કેટલી બધી અસંભવિત જેવી છે ! ત્યાં મિત્ર ખાતર જાત પર બધું વહોરી લેવા તૈયાર છે, એ ઓની મહાન વિશેષતા ગણાય. આવી ઉદારતાની વિશેષતા કાંઈ અનાદિકાળથી નથી આવતી ? કોઈક ને કોઈક ભવમાં મન ન માને તોય અને દબાવીને આવી ઉદારતા કેળવવી જોઈએ છે. ઉદારતાનો કોઈ અમલ કરવો જરૂરી રહે છે. ચક્કદેવના જીવે સોમાના ભવમાં સારો ધર્મપુરુષાર્થ પ્રારંભ્યો છે ! પોતાના વિચારને અનુકૂળ નહિ એવા પતિ પ્રત્યેય પોતે ગુસ્સે ન થવાની અને સદ્ભાવ રાખવાની ઉદારતા કુણવી છે. તેથી તો પતિના વચ્ચન પર ઘડામાં એમજ હાથ ઘાલી ફૂલની માળા લેવા ગઈ; પણ સાપથી ડસ્ટિ, તોય પતિનું બૂરું ન ચિંતિયું. તેથી મરીને દેવ થઈ ! ત્યાંય પતિ ઉપર વૈર લેવા, પતિને હવે ખોખરો કરવા ન આવી ! ઉદારતા વિના આ બધું શું શક્ય છે ? એનું આ રૂંડું પારિણામ છે એ કે ઉદારતાનું વૃક્ષ હવે ફાલેકુલે છે. એટલે અહીં મિત્રને બચાવી રાખવાની અને જાતે બધું વેઠી લેવાની ઉદારતા દાખવે છે. આમ જો ઉદારતા કેળવતાં આવડે તો તો દિલ બહારથી સંસારી જીવનું દેખાવા છતાં અંદરથી સંતનું બની જાય છે. એમાં તો કોકવાર જીવનનો ભોગ આપવો પડે તોય કાયરતા કરશો મા. ભૂલતા નહિ કે જીવનની કુરબાની (ભોગ) તો તુચ્છ સ્વાર્થ અને અજ્ઞાતના પાછળ અનંતી વખત આપ્યા છે. પતંગિયા થઈ થઈને દીવાના ઝગમગાટમાં લોભાઈ, માછલા બની બનીને જાળ ઉપરના ખાવાના લોભમાં તણાઈ, હરણિયાના અવતારે શિકારીના માયાવી સંગીતમાં આકર્ષણી-વગેરે વગેરે સ્થિતિઓમાં જીવનના ભોગ ક્યાં ઓછા આપ્યા છે ? અને એમાં તો પછીથીય દુર્ગતિનાં ઈનામ ! ત્યારે નિઃસ્વાર્થ સજ્જાન ઉદારતામાં તો ઈનામ સુસંસ્કાર અને પુણ્યાનુબંધી પુણ્યના ખજાનાનું ! સમજવું જોઈએ કે એવા કોઈ પ્રસંગ આવે એ તો ઉદારતા વાપરવાનો ખરી રીતે મોકો ઊભો થયો. નહિતર ચાલુ સ્થિતિમાં તો શી મોટી ઉદારતા દાખવવાની હતી ? એવા કોઈ ગાઢ પ્રસંગમાં ખાસ ઉદારતા વાપરવાનો અવસર મળે છે. ત્યાં ચૂક્યા એટલે બજારમાં બરાબર મનગમતો ભાવ આવ્યે છતાં વેપાર કરવો ચૂક્યા બરાબર છે. ઉદારતાદ્વારા ગુણોથી જ દુર્ગતિને તાળાં લાગે છે, અને સદ્ગતિ રાહ જુએ છે.

ચક્કદેવે કહી દીધું કે ‘આ માલ મારો છે.’

કારભારી પૂછે છે કે “તો પછી કેમ આના ઉપર ચંદન શેઠનું નામ લખ્યું

છે ?”

“તે હું જાણતો નથી, ગમે તે રીતે ખાલી વાસણની ફેરબદ્ધિ થઈ હોવાનો સંભવ છે.” ચકદેવ ઉત્તર વાળ્યો.

એના ઉપર કારભારી જડતી લેવા કહે છે, “ભલે, તો એ કહો કે આ કેટલી રકમનું વાસણ છે ? અથવા આમાં કેટલું દ્રવ્ય ભર્યું છે ?”

ચકદેવ કહે છે “મને બરાબર યાદ નથી. તમે જ સ્વયં જોઈ લો.”

ચકદેવ મિત્રના માથે આપત્તિ ન જાય એ માટે બધો ભાર પોતાના માથે લીધો. શું એ જાણતો નથી કે ‘તપાસ ચાલશે એમાં જો આપણે જ ચોર તરીકે પકડાયા તો શું પરિણામ ? પણ પરિણામ ગમે તે આવો, કિન્તુ અહીં તો મિત્ર ઉપર ચોરીની ગંધ સરખીય જવા નથી દેવી, એ નિર્ધાર છે.

નોંધ સાથે વાસણને મેળવે છે :- પછી કારભારીએ ચંદન શેઠના ખજાનચીને પૂછ્યું “ચંદનશેઠનું વાસણ કયા નાણાંથી ભરેલું હતું અથવા કેટલી રકમનું હતું? વાંચો ! કાગળ વાંચો” ચોરાયેલા માલની વિગતનો કાગળ વંચાવ્યો. તો એમાં વાસણ સોનામહોરો સહિત અને દસ હજારની રકમનું લખેલું મળ્યું પછી વાસણ ખોલાવ્યું. અંદર જોવરાવતાં નોંધના કાગળની વિગત બરાબર મળતી આવી. નગરવૃદ્ધો અને કારભારીઓ તો આશ્રય પામી ગયા, એમને એમ થયું કે ‘અપ્રતિહતચક સાર્થવાહના પુત્ર આ ચકદેવમાં આવું કેમ બન્યું હશે?’ પાછા એ છે સમજું, હજ્યું ચકદેવને એકદમ ચોર માની લઈ પકડી જતા નથી. વળી કાંઈ બીજો ખુલાસો મળે છે ! એ હિસાબે ફરી પૂછે છે.

‘સાર્થવાહપુત્ર ! આ તો રાજાનો હુકમ છે, તેથી ચોકખું જે હોય તે કહે કે આ તારી પાસે ક્યાંથી આવ્યું ?’

અહીં અવધિજ્ઞાની મહર્ષિ એ ભવની પોતાની હકીકત કહેતાં કહે છે કે તે વખતે મને (ચકદેવને) પાછો મિત્ર અંગે પૂર્વની જેવો જ વિચાર આવ્યો. શો ? એ જ કે વિશ્વાસભંગ કેમ કરાય ?... ઈત્યાદિ, તેથી મેં એનો એજ જવાબ આવ્યો. How much boldness, desire & Sacrifice ? કેટલી બધી કૂરબાની આપવાની વૃત્તિ ! હિંમત તો હજ આવે, પણ ભોગ આપવાની તેથારી ? નાની પ્રજાને કૂરબાની આપવાના શિક્ષણ અપાય છે ?

અહીં વાત નક્કી થઈ ગઈ છે કે માલ જે ચંદનશેઠનો ચોરાયેલો, તેજ છે. તો પછી પ્રશ્ન થાય કે

પ્ર.- ત્યારે વાસણ જેની પાસેથી આવ્યું તેના માટે પહેલાં અભયદાન માગી ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૪૧

લઈને પછી ખુલાસો ન કરી દેવાય ?

૭.- ચકદેવ ન કરે. કેમકે એ સમજે છે કે આ તો રાજશાસન. એમાં મિત્રનું નામ બહાર આવતાં એ સંકટમાં મૂકાયા વિના રહે નહિં; પછી ભલેને એની પાસે વળી બીજા કનેથી આવ્યું હોય.

ચકદેવનો એકનો એક ઉત્તર સાંભળી નવો ખુલાસો ન મળવાથી નગરવૃદ્ધો અને અમલદારો લાયાર બની ગયા; ‘વિકાર હો દેવને’ એમ બોતી ઉઠ્યા; અને હવે તો એમ પણ પૂછે છે કે

“તમારા ધરમાં બીજાનું કંઈ બીજું પણ નથી ને ?”

ચકદેવ કહે છે કે ‘ના કાંઈ નથી.’

બીજો પણ ચોરીનો માલ નીકળ્યો ! : રાજા પાસે :- ત્યારબાદ તેઓએ ચોરાયેલા માલની નોંધ વંચાવીને વિશેષ ચોકસાઈથી ધર તપાસું; તો નોંધમાં લખેલો બાકીનો બધો જ માલ નીકળી આવ્યો, હવે નગરરક્ષકોની ક્યાં સુધી શાંતિ અને ધીરજ રહે ? ચકદેવ ઉપર ગુસ્સે થઈ ગયા, અને એને રાજા પાસે લઈ ગયા. કડક હુકમ કરનારા રાજાને બધી બનેલી વાત કરી.

સદ્યા વિના નૂર ન પ્રગટે :- ચકદેવ કાંઈપણ બોલે છે ? હજ્યું રાજાને ખુલાસો કરવા તૈયાર છે ? ના, કેમ ના ? સમજે છે કે આ કસોટીનો સમય છે. કસોટીના સમયમાં ઉથલપાથલ થાય. ત્યાં જ ધીરજ જોઈએ. નિશાળિયા બાર મહિના એમજ સીધા સાદા કાઢે છે;-રોજ શાળાએ જવું, ઘેર પાછા આવવું, ભાશવું, ન આવડે તો ય બહુ મોટા ફેરફારનું નુકસાન નહિં. પરંતુ વાર્ષિક પરીક્ષા વખતે ? મહાન ઉથલપાથલ ! જો પરીક્ષા પાસ ન કરે, સફલતાથી પસાર ન કરે, તો ‘ફરી બાર મહિના રહો એજ ધોરણમાં !’ માટે પરીક્ષા સારું કેટલું વેઠે છે ! કેટકેટલી મહેનત કરે છે ! બાર મહિનામાં ક્યારે ય ન કરી હોય તેવી અને તેટલી મહેનત ! સોનુંય સો ટચનું સાબિત થવા છેલ્લી પરીક્ષામાં ધીખતા અજિની જવાળાઓ સહે છે. સદ્યા વિના તો નૂર પ્રગટ ક્યાંથી થાય ? ચકદેવ આ સમજે છે; તેથી જ પોતાની હિંમત, ઉદારતા, મિત્ર-વિશ્વાસનું પાલન વગેરે ગુણોને ગમે તે ભોગે અખંડ રાખે છે.

રાજાની મોટાઈ :- કારભારીએ રાજાને બધી હકીકત કહી એટલે તો એમાં એ પણ કહું જ હોયને કે ‘ચંદન-શેઠનો બધો માલ ચકદેવની પાસેથી નીકળ્યો છતાં ચકદેવે ડેઠ સુધી ન તો ચોરીનો ગુનો કબૂલ્યો, કે ન તો એ માલ બીજા પાસેથી આવી જવાનું કહું. ઉપરથી પોતાનો જ માલ છે એમ બોલ્યા કર્યું !’ એ સમાચાર રાજાને કહ્યા છતાં જે છેલ્લી સ્થિતિ પર કારભારીઓ ગુસ્સે થઈ ગયા હતા, એને

૪૨ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ઉદારતા” (ભાગ-૨૨)

પણ સાંભળીને રાજી ગુસ્સે નથી થતા ! પણ શાંતિથી ચકદેવને પૂછે છે. મોટા માણસોની મોટાઈ જોવા જેવી હોય છે, એ એકદમ ઉછળી કે ઉકળી નહિ ઉઠે. કહે છે ને કે અધૂરો ઘડો છલકાય. ભરેલો નહિ ? કાંસાની થાળી ખખડી ઉઠે, સોનાની નહિ. મોટાઈ તો જ સચવાય કે જો ગંભીરતા, ઠરેલતા, પીઠપાણું, સહિષ્ણુતા વગેરે ગુણો કેળવતાં આવડે, કોઈ કોઈ બાળ-કુમાર-યુવાનોમાં આ ગુણો દેખાય છે, એ પૂર્વ જન્મના સુસંસ્કારનું ફળ હોય છે.

રાજાનો પ્રશ્ન :- રાજી ગુસ્સે થયા વિના ચકદેવને કહે છે, “જો સાર્થવાહ પુત્ર ! તું તો ઉભય લોકના હિતાહિત માર્ગનો જાણકાર છે. તેથી આ આવું અસાધુ જનને ઉચિત, હલકા જનને છાજતું કાર્ય તારામાં હું માની શકતો નથી. મને એ તારામાં અસંભાવનીય લાગે છે. તેથી એ કહી દે કે આની પાછળ રહસ્ય શું છે ?-અર્થાત્ તું તો હિતાહિત માર્ગનો જ્ઞાતા હોઈ આવું કાર્ય કરે જ નહિ, છતાં તારા ઘરમાંથી આ માલ નીકળ્યો, તો એની પાછળ કોઈ છૂંપું રહસ્ય હોવું જોઈએ; તો કહે, એ શું છે ?”

ચકદેવ દેશનિકાલ :- અવધિજ્ઞાની મહર્ષિ એ વખતે પોતાની ચકદેવના ભવમાં જે સ્થિતિ થઈ, તેને વર્ણવતાં કહે છે રાજાના આ પ્રશ્ન ઉપર વળી પાછા મને તો એજ વિચાર આવ્યા. ‘મિત્રના પ્રાણ જોખમમાં કેમ મૂકાય...’ વગેરે એજ વિચારીને પછી તો રાજાની આગળ કાંઈપણ ન બોલતાં, મારી આંખમાં ઝળજળિયાં ભરાઈ આવ્યાં, હું મનમાં સમજું કે ‘અહો ! મિત્રનું નામ બહાર કઠાવવા કેવી ઉપરાપર કસોટી થઈ રહી છે ! તેમજ મારા ઉપર કેવાં અપમાન-પરાભવ વરસી રહ્યા છે !’ તેથી મારી આંખમાં આંસુ છે, ત્યારે રાજી મનમાં એજ આંસુ જોઈને શંકા ખાય છે કે સંભવ છે ચકદેવથી આ ચોરીની ભૂલ થઈ ગઈ હોય, છતાં રાજાને મારા પિતા પર બહુમાન છે તેથી એક પણ અયોધ્ય બોલ મને ન સંભળાવ્યો, મારી કોઈ કદર્થના-વિટંબણા ન કરી. માત્ર પોતાને ન્યાય બજાવવો, તેથી મને દેશ છોડી ચાલી જવા કહ્યું. રાજાના માણસો મને નગરની બહાર લઈ ગયા અને નગરદેવતાના વનની પાસે છોડી દીધો. પછી રાજપુરુષો તો પાછા ફરી ગયા. પરંતુ મને આ બધી પરિસ્થિતિ અસ્વય થઈ પડી. મને હદ્યવેધી વિચાર આવ્યો કે, “આટલા બધા અપમાનના પાત્ર બનેલા જીવતરને હજી પણ ટકાવવાનું શું કરમ છે ? તેથી નગરદેવતાના ઉદ્ઘાનની નજીકના આ વડના ઝડ પરથી ગળે ફાંસો ખાઈ મારી જાતને લટકાવી દઉં.- અર્થાત્ આત્મહત્યા કરી દઉં.”

જીવનમાં દ્વિધાવૃત્તિ :- હવે અહીં જુઓ કે ચકદેવના પિતા ઉપર રાજાને બહુમાન હોવાથી ચકદેવને કોઈ ટોણો ઠપકો ન દીધો; એ એની કદરદાની ! છતાં ભુવનભાનું અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈયું કહા.” (ભાગ-૨૨)

૪૩

ન્યાય એ ન્યાય,- ચંદનશેઠનો ચોરાયેલો માલ બરાબર ચકદેવ પાસેથી મળ્યો; તેથી એને દેશનિકાલની સજા ફરમાવી ! બીજી કોઈ એની નાલેશી નહિ કરતાં માત્ર દેશ છોડી ચાલ્યા જવાનું કહ્યું. જીવનમાં આવી ઘણી દૈધી ભાવની વૃત્તિઓ રાખવી પડે છે. તો જ જીવન યોગ્ય રીતે જીવી શકાય છે. તો જ જુદા જુદા પ્રસંગને ઉચિત ન્યાય આપી શકાય છે. આશ્રિત ઉપર અવસરે પ્રેમ વાતસલ્ય દાખવવાનું હોય છે, અને અવસરે કડકાઈ બતાવવાની રહે છે, માલિકને જ્યાં પ્રેમ, એના જ ઉપર કડકાઈ,-આ દ્વિધાવૃત્તિ કહેવાય; જેને બીજા શબ્દમાં ‘ભીમ અને કાન્ત’ ગુણ કહેવાય છે. રાજી પણ અપમાન-વિટંબણા કાંઈ નથી કરતો; છતાં ચોરીનો માલ નીકળવા ઉપર સજા જરૂર કરે છે. આ દ્વિધાવૃત્તિ થઈ. સમકિતી આત્મા કુટુંબ ઉપર પણ વિરાગી હોય છે. છતાં એના પર દેખ નથી કરતો. પરંતુ ઉચિત રીતે વર્તે છે.

સમકિતી જીવની બેવડી જવાબદારી :-

જુદી જુદી જવાબદારીઓ અદા કરવા માટે તેને યોગ્ય તેવી તેવી વૃત્તિ-પ્રવૃત્તિ જોઈએ; વિચાર-વર્તાવ જોઈએ. રાજાના માથે પ્રજાના દરેક જણ ઉપર નિષ્પક્ષપાત વલણની અને યથાયોગ્ય રક્ષણ આપવાની જવાબદારી છે. એની રૂએ ચંદનશેઠની ચોરી થવાની સામે ચકદેવને સજા કરો. તેમ રાજાના મસ્તક પર સુયોગ્ય કુળ ઉપર બહુમાન ભર્યું વલણ વર્તાવ રાખવાની પણ જવાબદારી છે. તો એને અદા કરવા કોઈ જાતના ટોણાં, ઠપકાં ન દીધાં; કે કદર્થના ન કરી. સમકિતી જીવમાં પણ એવું જ છે. એના શિર પર મોક્ષાભિલાષી તરીકેની જવાબદારી છે. તેની રૂએ, એ શું બીજા, કે શુ કુટુંબ,-ક્યાંય મમત્વવાળો નથી થતો. ક્યાંય રસ અને આકર્ષણવાળો નથી બનતો; પણ વિરાગી બને છે. જો એ આવો ન હોય તો એણે મોક્ષેચ્છા શી બજાવી ? જો પોતે મોક્ષનો ચાહક છે, અને મોક્ષ એટલે ‘સર્વ સંયોગોથી મૂકાઈ જવું, છૂટી જવું, છે. તો એના ચાહક તરીકે સર્વ સંયોગો પ્રત્યે હવે એને આકર્ષણ ન જોઈએ; ચાચ્ય મનગમતી પ્રીતિ કે સેવા કરનાર કુટુંબપરિવાર હોય, તોય શું થઈ ગયું ? એ સંયોગની પણ આંતરિક ચાહના નજ રખાય, એમાં હિત નજ મનાય. એનું જ નામ વૈરાગ્ય. એવી રીતે બીજી જવાબદારી છે ધર્મા આત્મા તરીકેની કીર્તિ રક્ષવાની. એ માટે સંસારના વ્યવહાર સંબંધથી જોડાયેલા કુટુંબ પરિવારનું ઉચિત સાચવવાનું કર્તવ્ય આવી રહે છે. આમ જીવનમાં તે તે યોગ્ય જવાબદારીઓને શોભતી તેવી હાર્દિક વૃત્તિ અને કાયિક પ્રવૃત્તિ જોઈએ છે; ‘યોગ્ય જવાબદારીઓને શોભતી એમાં જવાબદારી યોગ્ય એટલા માટે કહેવી પડે છે કે ચોર બાપની પુત્ર પ્રત્યે ચોર બાપ તરીકેની જવાબદારી યોગ્ય નથી. એમાં તો ચોરી કરવાનું શિક્ષણ આપવાનું કુર્કટવ્ય બજાવવાની વાત આવે. તે

૪૪

ભુવનભાનું અન્સાઈકલોપીડિયા-“ઉદારતા” (ભાગ-૨૨)

યોગ્ય નથી.

કુલીનતા અને ગુણીયલતા :- વાત એ ચાલે છે કે રાજાએ પોતાનું બજાવ્યું. અહીં ચક્કદેવની હવે ધીરજ ખૂટી જાય છે. અપમાનભર્યું જીવવા કરતાં આપધાત કરવાનું એ ઈચ્છે છે. કુલીન આત્માને અપમાન અસર્વ થઈ પડે છે. નિર્દોષ ગુણીયલ જીવને સતત અપરાધી અને દુર્ગુણી તરફેની ઘ્યાતિમાં બેસી રહેવાનું પ્રાય: નથી રચતું. ચક્કદેવ કાયર નથી એટલે હવે વિચારો વધારવા થોભતો નથી. એ તો ફાંસો ખાઈ લટકી મરવા જાડ તરફ જવા માંડ્યો, પરંતુ ત્યારે અહીં રાજમહેલમાં વિચિત્ર ઘટના બની !

રાજમહેલમાં વિચિત્ર ઘટના : દેવવાણી :- તે એ હતી કે રાજાની માતા ધૂષાવા લાગી ધું...ધું...એમ ધુંકારા હુંકારા કરવા લાગી તેથી ત્યાં રાજાને બોલાવવામાં આવે છે. એ આશ્રય પામે છે કે આ શું થયું !

પૂછે છે, ‘માતાજી ! આ શું ?’

“હું...ધું...હવે પૂછવા નીકળ્યો ?”

“કેમ માડી ? શું ગુનો મારો ? ક્ષમા કરો.”

“હું...હું...ગુનો પૂછે છે ? ધું...પેલા બિચારા નિર્દોષ ચક્કદેવના પ્રાણ કઠાવી નાખશે ?...હું...પછી ક્ષમા માગવાની ?”

“શું કહો છો મા ! સાચે જ એ નિર્દોષ છે ?”

“નહિતર ? ગુનેગાર તો લુચ્યો યજ્ઞદેવ છે. સજ્જન અને ઉદાર એવા ચક્કદેવને ફસાવવા માટે તો પોતે ચોરી કરીને માલ ચક્કદેવને પકડાવી ચોરી એના માથે ઓઢાડવાનો એણો પેંતરો રચ્યો છે ! પણ તને ભાન છે કે ચક્કદેવ આ તારી તપાસ અને સજ્જનું અપમાન સહન નહિ કરી શકવાથી જંગલમાં આપધાત કરવાની તૈયારીમાં છે ?”

“અરે મા ! આ તમને કેમ ખબર પડી ?”

“હું નગરની રક્ષક દેવતા ધું. અવધિજ્ઞાનથી આવા મહાસજ્જન ઉત્તમ પુરુષ ચક્કદેવ પર, એને મરવું પડે ત્યાં સુધીની વિટંબણ થતી જોઈ એના પર મને લાગણી અને ભક્તિ ઊભરાઈ આવી. તેથી આમ તો હું બચાવી લઉં. પણ તને કહેવા આવી ધું. ચક્કદેવ વહના જાડ ઉપર શાખાએ ગળાફાંસો ખાઈ લટકી મરવા તૈયાર થયો છે. તો જલદી એને તેમ કરતો અટકાવ; અને સન્માનપૂર્વક નગરમાં એનો પ્રવેશ કરાવ.”

જીવનું ક્યાં ઉપજે- ન ઉપજે ? :- પુણ્ય શું કામ કરે છે ! તકલીફમાં જીવને ઠેઠ પહોંચવાનું થવા છતાં આત્માની અંદરથી કોક એવો પ્રબળ પુણ્ય વંટોળ

ઓઝો થાય છે કે એ બધી તકલીફ-આપત્તિનાં વાદળાંને વિખેરી નાખે છે ! પુણ્ય-પાપના ખેલમાં માણસનું શું ઉપજે છે ? કંઈ જ નહિ. પાપ પ્રબળ હોય તો લાખ પ્રયત્ન કર્યો ય કષ્ટ ન ટળો; અને પુણ્ય પ્રબળ બને તો નક્કી જેવી થયેલી ધોર આપત્તિઓ ય વિના પ્રયત્ને ટળી જાય. માણસનું ઉપજે છે ગુણદોષ ઉપર; ધર્મઅર્ધમ ઉપર. ધારે તો દોષ અને પાપ અટકાવી ગુણ અને ધર્મને સિદ્ધ કરવાનું કરી શકે છે. એ એના હાથની વાત છે, પુણ્ય પાપના ઉદ્યનો સામનો કરવાનું એના હાથમાં નથી. ત્યાં કંઈ એનું ઉપજે એવું નથી. તો ત્યાં મથવાની મૂર્ખાઈ શા સારુ કરવી ? જ્યાં ઉપજુ શકે છે એવા દોષત્યાગ અને ગુણ સંપાદનમાં બેપરવાઈ કરવાની શી જરૂર ? અસ્તુ.

સત્યવાળાએ ધીરજ ધરવી પડે :- ચક્કદેવનો પુણ્યોદય જાગ્રત થયો એટલે રાજાને ખરી બાતમી જાણવા મળી. રાજા દેવતાના શબ્દ સાંભળી ચોંકી ઉઠ્યો ! એનું હૈયું સળવળી ઉઠ્યું ! એક બાજુ લુચ્યા યજ્ઞદેવ પર મહાગુર્સો, અને બીજી બાજુ પશ્ચાતાપ સાથે ચક્કદેવ ઉપર અધિક સ્નેહ,-આવા મિશ્ર રસને અનુભવતો તરત જ ઉઠ્યો ત્યાંથી. કેમકે વિલંબ કરવાનો હવે અવસર નથી. ચક્કદેવ કંઈ રાહ જુએ એવો નથી કે ‘મને કોઈ બચાવે.’ એ તો મરવાની તૈયારીમાં છે. પણ ગુણપક્ષપાતી દેવતા એમ એને શાનો મરવા દે ? કારભારીઓ કારભારું કરીને, નગરના પંચાયતીઓ પંચાયત કરીને, જે સત્ય નહોતા તારવી શક્યા, તે સત્ય રાજાને દેવતાએ યથાસ્થિત જણાવી દીધું. કહે છે ને અંતે સત્યનો જય. ધર્મ-અર્ધમ બેમાં ધર્મનો જ વિજય છે. પાપનો ધરી ફૂટ્યા વિના રહે ? માત્ર સત્યવાળાએ, ને ધર્મના પક્ષકારે ધીરજ ધરવી જોઈએ. ‘ચડ ચૂલા ખાઉ’ એમ કંઈ ખીચી ચૂલે મૂક્યા બરાબર તૈયાર ન થાય. આપણો તો આપણી જાતને એટલું જ સમજાવી રાખવાનું કે ‘તમે તમારે ધર્મ-કર્તવ્ય બજાવ્યે જાઓ. એનાથી આત્માને તો એકાંતે સતત લાભ થઈ જ રહ્યો છે. પછી અધીરાઈ શા સારુ કે મારુ સત્ય બહાર ન આવું ? પુણ્યની ખામી હોય તો બહાર ન ય આવે. પણ તેથી કંઈ સત્ય એ સત્ય તરીકે મટી જતું નથી.’

રાજા ચક્કદેવને બચાવવા નગર બહાર :- રાજાને હવે તલપાપડ ઈંતેજારી થઈ છે. તેથી એકદમ ઊઠીને હુકમ કરે છે. ‘અરે ! પકડો પેલા હુરાચારી યજ્ઞદેવને પકડો !’ હુકમ કરીને પોતે એકદમ ગભરાટમાં છે. ‘હાય ! ચક્કદેવનું શું થયું હશે ! હું, ફાંસો ખાધો હશે ? શું મારાથી નહિ બચે...?’ વગેરે ગભરામણમાં યજ્ઞદેવ આવ્યાની રાહ ન જોતાં પોતાની મુખ્ય હાથણી ઉપર બેસીને ત્યાં નજીકમાં રહેલા પોતાના માણસોને લઈ પોતે જટપટ નગરની બહાર દોડી પોકે છે. તે ઉદ્ઘાનમાં

પહોંચ્યો ગયો. તો શું એ મરવાને ઉતાવળા થયેલા ચકદેવને બચાવી શકશે ? કહોને કે બચવા, ન બચવાની આપણને ખબર નથી પડતી. એકજ ક્ષણવાર પછી બચવાનું હોય કે મરવાનું હોય તો ય માત્ર એક ક્ષણ પૂર્વે પણ એની ખબર આપણને પડી શકતી નથી ! નહિતર માણસ શાનો મોટર આગ-વગેરેના અક્સમાતનો ભોગ બને ? ત્યારે ક્ષણ પછીનું ય ન જ્યાલમાં આવે એ મૂળસ્વરૂપે અનંતાનંત કાળનું બધું જ જોઈ શકવાના સામર્થ્યને ધરનારા આપણા આત્માની કેવી કંગાળ દશા ! કેવી ભયંકર પરાધીન દશા ! આનો બરાબર જ્યાલ રાખીને માણસે (૧) સદા જ્ઞાની ભગવંતનાં શરણ ધરવાં જોઈએ; પડખાં સેવવાં જોઈએ; એમની વાણીને અનુસરવાનું જ એક માત્ર કર્તવ્ય કરવું જોઈએ. તેમજ (૨) જાતના અહેતુક, દુરાગ્રહાદિ ન કરવા ધટે. (૩) આવી દુર્દ્શાની હાલત વખતે નિશ્ચિન્તપણે અમનયમનિયાં ઉતાવવાન ન ધાજે; મોજબોજ ઊરી જવી જોઈએ.

ચકદેવને બચાવી લે છે :- રાજા પહોંચે એટલામાં તો ચકદેવે શું કર્યું છે ? ઝાડ પર ચઢી પોતાના ઉતારાસંગ (ખેસ) વસ્ત્રનો એક છેડો ઝાડની ઝાળીએ બાંધ્યો છે, અને બીજા છેડાનો ફાંસો (ગાળો) કરીને એમાં પોતાની ડેક ઘાલી છે; અને હવે એ લટકી મરવાની તૈયારીમાં છે ! એ સ્થિતિમાં દૂરથી રાજાએ એને જોયો. જોતાં-વેંત જ એના દિલમાં એકદમ સંભ્રમ ઉઠ્યો; ભડક લાગી; હદ્ય વધુ ધબકારા લેવા માંડ્યું. રખેને આ એકદમ પડતું મૂકે...એટલે તરત જ બૂમ મારે છે “હે ચકદેવ ! સાહસ ન કરજે, સાહસ ન કરજે.” બૂમો મારતો અને હાથણીને જોરથી દોડાવતો ઝપાટામાં તે ઝાડની નીચે આવી લાગ્યો. રાજા પોતાના હાથે ફાંસો ગળામાંથી દૂર કરીને હાથણી ઉપર જ ચકદેવને પોતાના હાથમાં ધરી લે છે. હવે મનનો ગભરાટ દૂર થાય છે; આનંદનો પાર નથી. ઝાણો કોઈ અપૂર્વ લાભ થઈ ગયો ! વાત પણ ઠીક જ છે. આવા મહાસજ્જન નરરત્નનો નાશ થઈ જતો અટક્યો ! એ સહદ્યને મન મામુલી સિદ્ધિ નથી ! મહાન સિદ્ધિ છે ! સહદ્યનો ખરા આનંદ આવા આવા જ હોય છે... રાજા ગળગળો થઈને ચકદેવને બહુ જ બહુમાન સાથે કહે છે “અરે, સાર્થવાહપુત્ર ! તને મેં પૂછ્યું છતાં તારે મને ખરી વાત ન કહેવી શું યોગ્ય હતી ?”

ચકદેવનું પારમાર્થિક હુઃખ :- રાજાના આ બોલ પર ચકદેવ ચોકી ઉઠ્યો ! એને એમ થયું કે ‘અરે ! આ શું ? શું કોઈએ મિત્રનું રહસ્ય ખુલ્યુ કર્યુ હશે ?’ જો જો, પોતે મરવાની અણી પર હતો એમાં રાજાએ આવીને રોકી બહુમાન સાથે ઉતાર્યો એનો આનંદ નથી ! પણ રાજાના શબ્દો દ્વારા મિત્રનું રહસ્ય પ્રગટ થવાની સંભાવના જાણી એને પારમાર્થિક હુઃખ છે ! સ્વાર્થિક હુઃખ જૂદું, અને પારમાર્થિક

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૪૭

હુઃખ જૂદું ! એમાં પાછું રાજા એટલામાં જ જ્યાં ખુલાસો કરે છે ત્યાં તો એ જોવા જેવું છે, કે આ ઉત્તમ હદ્ય કેવી ઉદાત્ત સાત્ત્વિક વિચારણા પર ચેઢે છે !

રાજા કહે છે, “જો, સાર્થવાહપુત્ર ! તેં તો મને ન કહું, પણ ભગવતી નગરદેવતાએ માતાજ્ઞાના દેહમાં પ્રવેશ કરીને મને ‘ચકદેવ નિર્દોષ છે અને આમાં ગુનેગાર દુરાચારી યજાદેવ છે,’-એ બનાવ દેવતાએ કહ્યો. તો તું મને ક્ષમા કરજે, કેમકે મને અંદરના રહસ્યની ખબર નહિ હોવાથી મેં તને કદર્થના પહોંચાડી !”

સજ્જન દુર્જના ભેટ :- રાજાને પશ્ચાતાપનો પાર નથી ! ચકદેવ જેવા મહાન સજ્જન માણસને કનગડત અને અવહેલના કરી એ બદલ હૈયું સંતાપ અનુભવી રહ્યું છે. ક્યાં પોતાની દુર્જનને દંડવાની અને સજ્જને સમાનવાની રાજનીતિની મહાન જવાબદારી, એની સામે પ્રસ્તુતમાં ક્યાં દુર્જનનાજ શબ્દને આધારે ચાલી સજ્જનને દંડવાની, તેથી દેશનિકાલ સુધીની મહાકદર્થના પમાડવાની કરેલી પાપી પ્રવૃત્તિ ! -એમ પોતાના દિલમાં બળતરાનો અગ્નિ ભભૂકી રહ્યો છે. સજ્જનના હૈયામાં પોતાનાથી અજાણે પણ કોઈનું બગાડવાની થઈ ગયેલી ભૂલના મહાન પશ્ચાતાપ હોય છે તો જ એ સજ્જન છે. દુર્જનને તો પોતાને ભૂલ જ નથી લાગતી પછી પશ્ચાતાપ શા ? એને તો બીજાનું બગાડવું એ કર્તવ્ય લાગે છે ! ત્યારે સજ્જનના હૈયે ‘મારાથી કોઈનું જરાય ખરાબ ન થાવો’-એવી ભલી વૃત્તિ સજ્જન હૈયામાં ઊડે ઊડે બેઠી હોઈને ત્યાં બીજાનું ન બગાડવાની સતત જાગ્રત્ત અને અજાણે બગાડચાનો ભારે શોક હોય છે. સજ્જન દુર્જનના આવા ભેટ હોય છે. સજ્જન સતત બીજાનું ભલુ ચાહીને પોતાનાં અંતરને વધુ ને વધુ પવિત્ર અને પ્રકાશવાળું કરી રહ્યો હોય છે. ત્યારે દુર્જન પોતાનો તુચ્છ સ્વાર્થ સાધવા કે મેલી વૃત્તિ પોષવા, બીજાનું બૂરું ઈચ્છી ઈચ્છીને ઉત્તમ માનવભવે પણ પોતાના અંતરને વધારે ને વધારે મલિન અને અંધકારવાળું કરી રહે છે. હવે જુઓ ચકદેવની એ સાંભળીને દશા.

ચકદેવના ભવ્ય ઉદ્ગાર :- અવધિજ્ઞાની મહર્ષિ પોતાનું ચરિત્ર વર્ણવતાં કહે છે કે રાજાની આ વાણી સાંભળી મને (ચકદેવને) દિલમાં ભારે દુઃખ એ થયું કે ‘અરેરે ! હવે તો બિચારો યજાદેવ સંકટમાં આવી પડ્યો !’ પણ એને બચાવી લેવા મેં (ચકદેવે) રાજાને કહ્યું કે

“મહારાજા ! આપે મને ક્યાં કશી કદર્થના કરી છે ? પ્રજાનું રક્ષણ કરવામાં તત્પર એવા આપનો આ તો રાજધર્મ છે કે કોઈની માલ ચોરાયાની ફરિયાદ હોય તો તેની બરાબર તપાસ કરાવવી. એ હિસાબે જ આપે જે કાંઈ કર્યુ તે યોગ્ય જ છે, એમાં આપનો કોઈ જ દોષ નથી. માત્ર મારું નમ્રભાવે એટલું જ કહેવું છે કે

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ઉદારતા” (ભાગ-૨૨)

૪૮

યજ્ઞદેવની પાસે પણ આ માલ ક્યાંથી આવ્યો એનું મૂળ તપાસાવો. યજ્ઞદેવના વિષે ચોરીની શંકા ન કરશો, કેમકે એ મહાનુભાવમાં આવું અયોગ્ય આચરણ સંભવતું નથી.”

ચક્કદેવનો મહા વિવેક અને સજજનતા ! :- ચક્કદેવનું દિલ જુઓ. સજજનતા ઉપરાંત મિત્રભક્તિ કેટલી અસ્થિ-મજજા કરી હોય ત્યારે આવા સંયોગમાંય કે જ્યાં દેવતા પક્ષ કરે છે અને રાજા માઝી માગે છે, ત્યાંય વિવેક અને સજજનતાની રૂએ રાજાને ટોણો મારવાનું મન નથી થતું ! અરે, એમ પણ નથી થતું કે ‘બને ! તમેય માણસ છો. ભૂલ થઈ જાય !’ એવો પણ વિચાર કે ઉચ્ચાર નથી ! ઊલદું એમ મનાવે છે કે ‘હોય ? ક્ષમા શાની ? આપે તો આપનું કર્તવ્ય બજાવ્યું છે. અર્થાત્ હું હોઉં કે ગમે તે હોય, ગુનાની શંકા થાય તો રાજા તપાસ કરાવી શકે છે. એમાં વળી ધરમાંથી મુદ્દામાલ નીકળે તો ગુનેગાર ગણી યોગ્ય કરી શકે છે. એમાં રાજાની ભૂલ શાની ? રાજા કાંઈ એક વ્યક્તિનો નથી; એ તો સમસ્ત પ્રજાનો છે. તેથી આખીય જનતાનું હિત એણે સંભાળવું જોઈએ.’ કેવી સચોટ ગણત્રીઓ ! કેવા ચોક્સ ધોરણો ! આ બધું મહાવિવેકને આભારી છે; મહાન સજજનતાનો પ્રતાપ છે. સોનાના દાણીના ખાવા કામ નથી લાગતા; પણ એનું તેજ ચણકે છે; ને એનામાં મોટી કિંમત સમાયેલી છે, તેથી જ જગતમાં એ ઊંચું અને ચાહવા યોગ્ય ગણાય છે. એવી રીતે ચક્કદેવ જેવો ઊંચો વિવેક અને સજજનતા ભલે ખાવા કામ ન લાગે, પણ એનાથી આત્માનું તેજ દીપે છે; એમાં દુનિયાને મન મોટી કિંમત સમાયેલી દેખાય છે. તેથી એ ઉચ્ચ ગણાય છે અને પ્રેમપાત્ર બને છે.

ચક્કદેવની ભયંકર મિત્ર ઉપર ભક્તિ : દિવ્ય હદ્ય ! :- ત્યારે વિવેક ઉપરાંત એની મિત્રભક્તિય મહાન છે, મિત્રે કેવું ભયંકર કર્ય કર્યું છે ? પાછું એ મિત્રે એમેય નથી કહું કે ‘કદાચ સંકટમાં આવે તો મને બોલાવજે; જવાબ આપવાનું મારા પર છોડજે...’ વગેરે. ઊલદું એમ કહું છે કે ‘આ માલ મારો જ છે;’ અને એવી રીતે ધોખામાં રાખીને ચોરીનો માલ એના ગળે બજાડ્યો છે ! એ સ્થિતિમાં ચક્કદેવને કેટલું વેદવું પડ્યું ! કેવી વિટંબણ અનુભવી ! નગરમાં હલકાઈ અને દેશનિકાલની સજા ! આટલું છતાં મિત્રનું રહસ્ય બહાર પડી ગયું જાણી મનને ભારે દુઃખ થાય છે ! અને અહીં રાજા આગળ પોતાના સ્વચ્છ દિલની માન્યતાની રજૂઆત કરે છે !! કેવુંક દિવ્ય આ હદ્ય ! મિત્ર ધૂતારો અને મેંઢો છતાં, હજ્ય ચક્કદેવના શરદ ઋતુના નિર્મળ જળ જેવા પવિત્ર હદ્યમાં મિત્રની બુરાઈ નથી દેખાતી ! “મારો મિત્ર આવું શાનું કરે ? રાજાએ અધૂરું જાણ્યું લાગે છે, તેથી એમણે આને ગુનેગાર માન્યો છે.” ઈત્યાદિ કંઈક સમજી વિનવે છે રાજાને, કે યજ્ઞદેવ પાસેય બીજા પાસેથી આવ્યું હોય,

તો મૂળ કોણે ચોરી કરી, અથવા એણે બીજી રીતે ક્યાંથી મેળવ્યું તેની તપાસ કરાવો ! છે મિત્ર પરના વિશ્વાસની હદ “! તેય મિત્રે ખોદું ભરમાબ્યાથી આટલા ભયંકર નુકસાનમાં ઊતરવું પડ્યું હોય, છતાં મિત્રની શાહુકારીનો વિશ્વાસ ! ચક્કદેવના આ વિશ્વાસને તમે શું કહો ? લાયકી કે નાલાયકી ? કહેતા નહિ નાલાયકી, હો. ‘મિત્રતાનો સંબંધ જોડતાં પહેલાં માપી લેવું. અથવા બાંધ્યા પછી પણ તપાસી લેવું. પરંતુ એક વાર બાંધ્યા પછી પણ કોઈ અવસર ઉપસ્થિત થતાં એકાએક અવિશ્વાસું ન થવાય.’ ચક્કદેવના આ ધોરણ છે. તેથી મિત્ર ઉપર બરાબર વિશ્વાસ જાળવી રાખ્યો છે. પોતાને શું બન્યું એની પરવા નહિ, એનો વિચાર નહિ. સ્નેહીનું ગૌરવ બરાબર જણવાઈ રહેવું જોઈએ.

સંસારી કે સંત ? :- હજુ તો અહીં કોઈ છે કે મૂળ તપાસાવો. પણ આગળ જો જો કે આનાથી પણ કેટલી બધી વધારે ઉદારતા મિત્રને મૂળ ચોર જાણ્યા પછી પણ વરસાવે છે ! આ તો માનવ કે દેવ ! સંસારી કે સંત ! પોતાની ધોર કદર્થના થઈ એનો કોઈ વિચાર નહિ ! અને ‘મિત્રને ગુનેગાર ન માનો, પણ એનું મૂળ તપાસાવો’ એ ક્ષમા માગતા રાજા પાસે યાચના ? પણ કેવી ખૂબીથી કરી કે પહેલાં તો ક્ષમા માગતા એવા પણ રાજાને ‘કદર્થના નહિ પણ યોગ્ય જ કરનારા’ તરીકે ઓળખાબ્યા ! એય બનાવતી કથન નહોતું. જેવું પોતાનું દિલ કહેતું હતું તેવું કથન હતું. એના ઉપર મૂળની તપાસની વિનંતિ કરી જેથી પોતાના મનની અભિલાષા પૂર્ણ થાય. પણ અહીં જુઓ કે રાજા એની માગણીને અવગણતો નથી. તેય મૂળ શોધાવવાની વાતેય નથી કરતો, ત્યારે શું કરે છે ?

રાજા કહે છે કે, “મૂળની તપાસ થઈ ગઈ. ભગવતી દેવીએ જ કહ્યું છે કે આ બધું તે પાપીએ જ કર્યું છે.” એમ કહીને દેવીએ કહેલ હકીકત રાજાને કહી સંભળાવી.

યજ્ઞદેવને બાંધી લાવે છે :- એ વખતે ચક્કદેવના મનને એમ થયું કે ‘હે ભગવન્ ! આ અસંભાવનીય શું ?’ એટલામાં તો જમના દૂત જેવા સિપાઈઓ યજ્ઞદેવને મુશ્કેટાટ બાંધીને ત્યાં લઈ આવી હાજર કરે છે; અને રાજાને નિવેદન કરે છે. યજ્ઞદેવના તો હોશકોશ જ ઉડી ગયા છે. રાજાની આગળ પહેલાં શાશ્વતો થઈ આવ્યો હતો તે હવે કાંઈ એને પૂછવા માટે રાજા એમને એમ નથી બોલાવતા. કદાચ સિપાઈઓ ભૂલ્યા હોય પણ અહીં તો રાજાય એને માનભેર પૂછતા નથી. એટલે હવે તો બાપડો ‘શું થશે !’ એની ભયંકર માનસિક વ્યથામાં હુંજ રહ્યો છે. ત્યારે પૂછો ને કે

પ્ર.- શું એને પહેલેથી એ ભય નહિ હોય કે ચક્કદેવ રાજાને ખરી વાત કહી દેશે તો ?

અમણા કેવી સંભવે :-

૬.- પણ અહીં એ સમજવા જેવું છે કે માણસ કેટલીય વાર પોતાની બુદ્ધિને બડી માનીને ખોટા વિશ્વાસમાં રહે છે અને હાથે કરીને પોતે પોતાના જ ફૂલથી ફસાય છે. યજ્ઞદેવે મનમાં એમ ધાર્યું હોય કે “હું પહેલાં જઈને રાજાને ઉડો બેદ કહેવામાં શાંતો થઈ આવું; પછી ચોર તરીકે પકડાયા બાદ ભલેને કદાચ ચકદેવ રાજાને ખરી વાત કહેવા જાય તો ય રાજા માને નહિ. કેમકે રાજા તો એક જ વાત કહે કે ‘શું આ જગજાહેર મારા હંદેરાની ખબર નહોતી? પાંચ પાંચ દિવસ થાય. કેમ આવીને મને પહેલા કહું નહિ? માટે મનમાં હશે કે ઠીક માલ પચ્યો તો! એ તો પકડાઈ ગયા ત્યારે ભાઈ સાહેબ બચાવ કરવા નીકળ્યા છે કે આ તો મને યજ્ઞદેવે ફસાવ્યો. એટલે ખરો ચોર જ તું છે’- એમ રાજાને લાગી જવાનું. પછી ચકદેવની વાત પર વિશ્વાસ ન મુકે અને આપણે બંદા ખરા શાહુકાર અને રાજહિતેષી ગણાઈશું. તેમ કદાચ ચકદેવ તરત જ રાજાને કહેવા જાય કે ચંદનશેઠનો માલ આણે મને ગળે બજાડ્યો છે, તોય ચકદેવને પોતાનું સાચું મનાવવા માટે બહારનો કોઈ સાક્ષી તો મળવાનો જ નથી. પછી ક્યાંથી એનું સાચું મનાય?”... વગેરે વગેરે વિશ્વાસમાં યજ્ઞદેવ બેઠો હોય પછી ચકદેવ રાજાને કહી દે તોય એને શો ભય હોય?

પણ અહીં તો જો રાજા યજ્ઞદેવ પર વિશ્વાસે બેઠો હોત તો તો એને આવી રીતે પકડી મંગાવે નહિ. એટલે હવે યજ્ઞદેવ કળી ગયો કે ‘આ તો રાજાએ મને જ ખરેખર ચોર માન્યો છે’ તેથી કંપી રહ્યો છે કે ‘રાજા શી સજા કરશે.’

મહિરાકેફ : - માણસને, ઠેઠ પકડાય ત્યારે કંપ થાય છે ! કેવું કારમું અજ્ઞાન ! ગુનો કરતાં તો જાણે મગરમસ્તી ! ‘શું છે ? કોના બાપની પરવા છે ? કાલ કોણે દીકી છે ? આમાં આપણાને શો વાંધો આવવાનો છે ?’ વગેરે વગેરે અમણાઓના મહિરાકેફમાં અંધું બની ઘોર હુઝૂલ્યો આચરાય છે ! સંસારની નરક અને તિર્યંગ ગતિ એમજ કુલ (પૂર્ણ) ભરેલી રહે છે ! આ તો પરલોકની વાત. પણ અહીં ય જગતને એવા તરફથી મહાવિંબણા છે. ત્યારે પોતાને એનો કરુણ અંજામ આવતાં અહીં જ ઘોર ત્રાસ ! પાપનો ભયંકરનો બદલો ! વગેરેના ભોગ થવું પડે છે.

યજ્ઞદેવને ભયંકર સજાનું ફરમાન ! :- યજ્ઞદેવની એવી જ સ્થિતિ થઈ. જેવો એને બાંધી લાવી રાજા આગળ હાજર કરવામાં આવ્યો કે રાજાએ હુકમ કર્યો કે ‘એ ! આની જીબ કાપી નાખો, અને આંખો ફોડી નાખો.’ રાજાની દસ્તિમાં પહેલું તો યજ્ઞદેવે જીતથી જે જૂંહ હંકાર્યું એ એક મોટો ગુનો છે, તેથી જ જાણે એની જીબ કાપી નાખવા કહું. તેમજ આંખેથી યજ્ઞદેવે ચંદનશેઠનો માલ જોઈને

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૫૧

ચોર્યો, અને મિત્રને સજજન વિશ્વાસુ જોઈ ધોખામાં ઉતાર્યો એટલે જાણે ‘એની આખ ફોડી નાખો’ એમ કહું.

ચકદેવ મિત્ર માટે માફી યાચે છે :- આ ભયંકર સજા સાંભળીને ચકદેવનું કોમળ દિલ ઉછળી ઉઠ્યું ! એમ તો થયું જ હતું કે ‘આવા સુમિત્રમાં આવું ચોરીનું કાર્ય સંભવે નહિ. તે અસંભવિત સંભવિત કેમ બની ગયું?’ એ વિચારણા ય પોતાની સાંત્વિક અને મહા ઉદાર વિચારસરણી. હવે તો વળી એને રાજાએ ફરમાવેલી સજા સાંભળતાં કમ-કમી આવી ગઈ ! ગમે તે ભોગે મિત્ર ઉપરની દયાથી એને બચાવી લેવા માટે ચકદેવ રાજાના પગમાં પડી વિનવે છે કે ‘દેવ ! આ મારો ગુનો માફ કરો. યજ્ઞદેવને છોડી દો (એને સજા ન કરો).’

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૩,અંક-૩૫,તા. ૧૪-૫-૧૯૫૫

યજ્ઞદેવના અનેક ગુના :- ચકદેવ આ કોને કહી રહ્યો છે ? યજ્ઞદેવની અનેક પ્રકારની દુર્જનતા ઉપર ભયંકર ગુસ્સે થયેલા રાજાને ! પાછું યજ્ઞદેવનો ગુનો હોવામાં સજડ પ્રમાણ રાજાને મળેલું છે ! હવે મને રાજા ? નગરદેવતાની દરમિયાનગીરીથી રાજાને સત્ય હક્કિકતની ખબર પડી છે. તેથી કદાચ ચકદેવના સત્ય બ્યાનથી યજ્ઞદેવ જો પહેલાં પકડાયો હોત તો સંભવ છે કે રાજાને ઓછો ગુસ્સો થાત. તેનાથી ધણો જ ગુસ્સો રાજાને અત્યારે થયો છે. કારણ કે (૧) જે પ્રસંગમાં દેવતાને દરમિયાનગીરી કરવી પડી, એ પ્રસંગ કેટલો બધો ગંભીર ગણાય ! બીજું એ પણ છે કે (૨) યજ્ઞદેવે માત્ર ચોરી કરી તેટલો જ ગુનો નથી, પરંતુ (૩) સજજન અને ઊંચુંગના એવા પોતાના મિત્ર ચકદેવના ગળે મોટી ચોરીનો માલ બજાડી જે ચોરપણાનો આરોપ ચઢાવ્યો; (૪) પોતે જ પ્રપંચ રચીને રાજાને જે જૂંહ ભણાવ્યું. તથા રાજાને અજાણમાં રાખી જે એવી સ્થિતિ ઊભી કરી કે ચકદેવને રાજાને અજાણમાં રાખી જે એવી સ્થિતિ ઊભી કરી કે ચકદેવને દેશનિકાલની સજા થાય... આ પણ અનેક મોટા ગુના છે. રાજાને મન યજ્ઞદેવના અપરાધની સીમા દેખાતી નથી. મન ઊકળી ઉઠ્યું છે ! “અહો, આ દુષ્ટ મારી પાસે આવા એક સજજન પુરુષની આવી કદર્થના કરાવી ! પોતાના મિત્રને આ બદમાશ ભયંકર આપત્તિમાં ઉતારનારો થયો ! મિત્ર પર ભયંકર કલંક ચઢાવનારો થયો !...” આ સૂચ્યે છે કે ભૂતકાળમાં રાજાપણાની સ્થિતિએ પહોંચેલા ઉત્તમ પુરુષો સજજન પ્રત્યે કંઈ અજુગતું ન થઈ જાય તેની કાળજીવાળા હતા. હજુ ગુનેગાર છૂટી જાય એ નભાવી લેતા પણ બિનગુનેગારની હીલના ન થઈ જાય એ ચોક્સાઈ ખાસ લેતા.

૫૨

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ઉદારતા” (ભાગ-૨૨)

પાણું ચોક્સાઈ-ચીવટી બધું કરવા છતાં, યોગ્ય માનીને જે કોઈ કર્યું, એમાં પાછળથી જો દેખાયું કે ‘મારે હાથે અયોગ્ય થઈ ગયું !’ તો એના બેદનો પાર નહોટો રહેતો. અને એ પોતાની ભૂલ સુધારી લેવા નમ્ર બનીને યોગ્ય કરી લેવા ચૂકતા નહિ. આપણા દિલને ઉત્તમ હૃદય બનાવવા આ તૈયારી કરવી પડે.

ચંદનની વિશેષતા :- કોઈ પણ સજજન, ગુણીયલ અને કુળવાન આત્મા પ્રત્યે આપણાથી કંઈપણ અજુગતું ન થાય, ને એક પણ કટુ શબ્દ આપણાથી ન બોલાઈ જાય, એની સતત સાવધાની જોઈએ. એમાં ખબર પડી કે ‘આ તો અજુગતું થઈ ગયું...’ તો ત્યાં ઝટ અનુચ્ચિત કાર્યથી પાછા ફરી જવું જોઈએ. બચાવ ન જોઈએ. કે ‘આપણે તો ભાઈ ! બધી તકેદારી રાખીને જ કર્યું હતું. બાકી કોઈ અંદર થોડું જ પેસી નીકળ્યું છે ?’ આવો બચાવ કરવામાં પણ હૃદયની હલકાઈ છે. રાજ શું વિચારે છે ? “ઓહો, મારે હાથે અજુગતું થઈ ગયું !...” તો ચકદેવની પાસે ક્ષમા માગતાં વાર નહિ ! માત્ર ક્ષમાજ નહિ, મોટું સન્માન સ્વાગત કરશે ! આ બાજુ યજ્ઞદેવ પ્રત્યે ઉપર કદું તેમ અનેક ભયંકર ગુના પર મહાગુસ્સો છે. એટલે નોકરોને હુકમ કરી દીધો છે, “જાઓ, એ દુષ્ટની જીબ છેદી નાખો, એની આંખો છોડી નાખો.” એને વિનવતો ચકદેવ સામે ઊભો છે ! ચકદેવ એટલે ? કેમ જાણો શીતલ ચંદન ! ચંદનને તમે ગમે તેટલું લસોટો, પણ એ શીતલતા જ આપ્યા કરે, તમે એને ગમે તેટલું બાળો, પણ એ સુવાસ જ આપ્યા કરે ! એમ ચકદેવ ! લાખ કષ્ટની વચ્ચમાં દેવતાએ બધી ગુપ્ત વાત જાહેર કરવા છતાં એની ઉત્તમતા તો એની એજ ! કહે છે, “મહારાજ, આટલો મારો અપરાધ ક્ષમા કરી યજ્ઞદેવને છોડી દો.” મિત્રનો ગુનો એ જાણો પોતાનો ગુનો છે, મિત્રની કાયા એ જાણો પોતાની જ કાયા છે !! માટે મિત્ર વતી ક્ષમા પોતે માગી રહ્યો છે ! ચકદેવનાં વચ્ચન સાંભળી રાજા તો ચકિત જ થઈ જાય છે ! થાયજ ને ? વિચારો કે આ ચકદેવનું તે દિલ શાનું બનેલું ! જે મિત્રની કુટિલતાથી પોતાને કલંક અને વિટંબણા વેઠવા ઉપરાંત આપદ્યાત કરવાની દશા આવી, તેજ મિત્ર પર વાત્સલ્ય ઉભરાય છે ! જે મિત્ર ખરેખર ગુનેગાર છે, એવું હવે દેવતાના વચ્ચનથી સારી રીતે પુરવાર થયું છે, એને ક્ષમા અપાવવી છે, ત્યારે ચકદેવના હૃદયની અગાધ દયા, ઉદારતા. વગેરે ગુણો કેવા !

સાત્ત્વિક અને નિઃસત્ત્વ :- સાત્ત્વિક હૃદયના જ આ કામ છે. સત્ત્વહીનનું ગજું નહિ. સાત્ત્વિક હૈયું શત્રુનું દુઃખ જોવા સમર્થ નથી. નિઃસત્ત્વ હૈયું શત્રુનું ભલું જોઈ શકતો નથી. નિઃસત્ત્વ હૃદયને, જે પોતાનો કોઈ વિરોધી વિના સજીએ માફ કરાતો હોય, તો એ જોવાનું મુશ્કેલ પડે છે. એ જોવાનું એનાથી સહેવાય જ ભુવનભાનું અન્સાઈકલોપીયિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

નહિ. અધીરું થઈને એ તો બળી ઊઠે કે ‘હે ? આને માફી ? આને તો આવી આવી ભારે સજા થવી જોઈએ’-આવું જેમ સત્ત્વહીન હૃદય વિચારે છે; તેમ સાત્ત્વિક હૃદય એથી ઊલદું પોતાના ગુનેગાર દાંબિક મિત્રને પણ સજા થાય એ જોવાનું સહી શકે તેમ નથી. એને તો થાય કે “અરેર ! આને બિચારાને શા માટે સજા અને દુઃખ ? એને માફી કેમ નહિ ? લાવ, મારું ચાલે ત્યાં સુધી એને માફી આપાવું !”-એવું કોમળ અને સત્ત્વપૂર્ણ હૈયું ભાવના ભાવી રહ્યું હોય છે. કઠોર અને કોમળનો કેવો મહાન વિચારલેદ હોય છે ! અરે, કેટલીવાર તો તો જેને સજા થતી હોય એ માણસ પોતાનો દુશ્મન ન પણ હોય તોય એની સજા માટે કઠોર હૈયાં ખુશ થાય છે ! અને સજા વિના એમને એમ જો એને છોડી મૂકવામાં આવ્યો, તો આ કઠોર હૃદયો નારાજ અને આકુળવ્યાકુળ થાય છે ! કેવી જડતા ! સામાને દુઃખ ન આવ્યું એ જોવા માટે પણ જે દિલ સહિષ્ણુ નથી, એ પોતાની જાતે તો પોતાના ગુનેગાર માણસને માફી-દયા બક્ષવા ક્યાંથી જ તૈયાર હોય ? ચકદેવ સાત્ત્વિક અને કોમળ દિલનો છે.

સત્ત્વ અને કોમળાતા :- (૧) સત્ત્વને લીધે, પોતાને થયેલું આબરુનું નુકશાન અને વિટંબણા, એને મન કોઈ વિસતમાં નથી. તેમજ શત્રુનું ભલું જોવાની તાકાત છે; અને દુશ્મનને માફી થાય એ સહવાની શક્તિ છે. (૨) કોમળાતાને લીધે પોતાનાજ જીવલેણ વિશ્વાસધાતી કુમિત્રની ઉપર ભયંકર સજા વરસે, ને એ બદનામ થાય, એ જોવા સહિષ્ણુ નથી. એટલે રાજાને પગમાં પડી વિનવે છે. “નાથ ! ક્ષમા કરો મને, અને યજ્ઞદેવને છોડી મૂકો; માફ કરો !” એટલો ગળગળો થઈ વિનવે છે કે રાજ વિચારમાં પડી જાય છે. અને તેથી જ સિપાઈઓ હજુ રાજાએ ફરમાવેલ સજાનો અમલ નથી કરી શકતા ! ચકદેવનું કદું હૃદય ! શાનું બનેલું ? કદી જીવની મુખ્ય વિચારસરણી ! અને કેવાક આદર્શ ! જાણો કોઈ મહર્ષિ ! દુશ્મન ઉપર પણ જોરદાર દયા અને પ્રેમનો વરસાદ ! આવું કરવાથી શું પોતાનું જીવન મુફ્તલીસ બનતું હશે ? અને દુશ્મન પર દાટ વાળનારું, શત્રુ પર ભૂખ્યા વાઘ વરુની જેમ તૂટી પડનારાનું જીવન શું માલવાળું હોતું હશે ? ના, જરાય નહિ. માલવાળું જીવન તો દુશ્મન પર પણ ક્ષમા-શીલતાનું જીવન હોય. એના અંતરમાં દુશ્મનને ય બચાવી લેવાના કોડ, એ લોભિયાને લાખોનું ધન મેળવવાના કોડ જોવા, પ્રબળ હોય છે; અને પછી એ શત્રુ બચ્યાનો આનંદ પણ એટલો બધો ઊંચો હોય છે ! કેવું વન્ય જીવન ! કેવું દિવ્ય હૃદય ! આપણને આવું જીવન અને હૃદય ક્યારે મળશે ! કેવી જીવનોના આ માટેના સતત અભ્યાસ જોઈએ, ત્યારે આટલી ઉચ્ચ સ્થિતિ કહી રહી છે ને ? છતાં પ્રભુ પાસે રોજ ભુવનભાનું અન્સાઈકલોપીયિયા-“ચંદનની વિશેષતા” (ભાગ-૨૨)

પ્રાર્થિએ ‘પ્રભુ ! એવું સાત્ત્વિક અને કોમળ હૃદયવાળું જીવન મને જરૂર આપજે’ મુંજાશો નહિ, એવા જીવનથી લૂંટાઈ નહિ જઈએ; ઉલટાં સમૃદ્ધ થઈશું. આત્માનું નૂર એમાં ખીલશે; અવિકાર્ય-શક્તિ વધશે. અવિકાર્ય શક્તિ એટલે ‘પ્રતિકૂલ કે અનુકૂલ સંયોગો આવે છતાં એમાં આપણે લહેવાઈ જઈએ નહિ, રાગદ્વેષના ફંડામાં ન ફસીએ; મદ, ઈર્ઝિ, હિસા, વગેરે પાપોના મળમાં હાથ ન ઘાલીએ; આત્માને જબોળીએ નહિ.’ ચકદેવે આવું જીવન બનાવ્યું છે. પૂર્વે કહ્યું તેમ એની સહિષ્ણુતા-અસહિષ્ણુતા ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. પોતાને કષ આવ્યું એની સહિષ્ણુતા કેવી કે ઠેઠ સુધી પરદોષ અંગે મૌન ! ત્યારે પોતાની સામે ભયંકર શરૂવટ કરનારને પણ કષ આવતું જોઈ એની અસહિષ્ણુતા કેવી કે એને કષ પડવાની વાત સહિતી અશક્ય ! તેથી પોતેજ રાજને વિનવે છે ! જગત એમ રડે છે કે ‘હાય ! આ અમાનું દુઃખ અમારાથી સહાતું નથી.’ આ સાત્ત્વિક અને કોમળ નરરતન એ માને છે કે ‘આ બીજાનું દુઃખ અમારા માટે અસહ્ય છે !’ ધન્ય છે આવા નરરતે ! હવે જુઓ રાજ શું કરે છે.

રાજ સમજાવે છે :- રાજ સમજે છે કે ચકદેવનું દિલ અતિશય ઉત્તમ હોઈ દુષ્ટનેય માફી આપવા કહે છે, પરંતુ આ દુષ્ટ એટલો નીચ છે કે એ એને યોગ્ય નથી. તેથી કહે કહે છે “સાર્થવાહપુત્ર ! તારું કહેવું ઠીક નથી. આ યજ્ઞદેવ દુરાચારી છે. માટે એને માફી કરવા સિવાય બીજું કંઈ માગી લે.”

ચકદેવ જવાબ વાળે છે, “મહારાજ, બીજું માગવાનું કહો છો, તો બીજો મને કંઈ ખપ નથી. જો મારા પ્રત્યે આપને કંઈ પણ બહુમાન હોય તો આપ આજ કરો.” અર્થાત્ આ તો જો આપ મારા પ્રત્યે કંઈ માન ધરાવતા હો તો કહું છું, બાકી કંઈ મારો આપના પર અધિકાર નથી.

મોટા નગરના રાજાના કહેવાનો ભાવ એ હોય કે “તું આમાં ન પડ; એ મારો કેદી, અને અમે રાજા. એક રાજા તરીકેની અમારી નીતિ સમજ જા. અમારે તો મોટાં રાજ્ય ચલાવવાનાં છે...” તો શું આના પર મન મનાવવાનું ન થાય, કે “શું થાય ભાઈ ! રાજાને રાજ્ય ચલાવવું રહ્યું, ત્યાં એય શું કરે અને આપણેય શું કરીએ...?” પણ ના, ચકદેવને એવા સંતોષ આવડતા નથી. વિચારો કે યજ્ઞદેવ કંઈ ચકદેવનો સગો નથી કે નાતીલો નથી. આજે તો સગાભાઈ માટે પણ ધીરજ ધરવી મુશ્કેલ છે. જરાક સગો કોકનું આધું-પાછું કરે તો મનમાં શું ઊઠે ? “મરશે... એનાં ભાગ્ય ! આડાઅવળા ધંધા કરે ત્યાં આપણે શું કરીએ ?...” બચાવ શોધાય ને ? પણ ત્યાં ખબર નથી કે તું બચાવ કરે છે ખરો, પણ

ઉત્તમતાનો સોનેરી સમય :- હૃદયમાં જ્યારે ઉત્તમતા કેળવવાનો સોનેરી

અવસર આવ્યો છે, ત્યારે તું પહેલેથી એના પર તાળાં મારે છે ! ઉત્તમતા ત્યારે બતાવવાનો અવસર ખરો ઊભો થાય છે કે જ્યારે સામેથી અધમતાનું પ્રદર્શન થતું હોય. એમ નહિ કે સામો માનપૂર્વક લઈ જઈ; બાસુંદીના ભોજન કરાવે, તે પછી આપણે પણ બાસુંદીના ભોજન કરાવીએ એ ઉત્તમતા. એ તો સોછો છે. તેમાં શું મોટી નવાઈ ? ઉત્તમતા કેળવવાના અવસર વખતે આપણે ધીરજ ગુમાવી દઈએ છીએ. એનો અર્થ એ કે જે વખતે ગુણશ્રેણી પર ચઢવાનો અવસર મજ્યો હતો તે વખતે ટાંટિયા ઢીલા કરી બેસી ગયા ! અવસર વીત્યા પછી ઘણી ભાવના ભાવીએ તેથી શું ? આત્માના ગુણ કેવળ ભાવના પર સ્થિર નથી થતા. રોજ ભાવના ભાવીએ દાનની, પણ બે પૈસા દાન કરવાનો અવસર આવ્યો એટલે કેમ ? તો કે “આપણે ત્યાં ક્યાં આપીએ ? આપણું જ પૂરું નથી થતું ત્યાં...” આ હોય તો તમને લાગે છે કે દાનગુણ ખીલે ? એવી પોકળ ભાવના હૈયાની લખી રાખો. અવસરે દાનના અમલ વિનાની કલાકોના કલાકો સુધી ભાવેલી દાનની ભાવનાઓ હૃદયમાંથી કૃપણતાને કાઢી ન શકે અને ઉદારતાને કેળવી ન શકે. જેવી દાનની ભાવના તેવું ઉપદેશ શ્રવણ અંગે સમજવું.

ઉપદેશમાંથી ડહાપણ મેળવ્યું ખરું પણ તેને જીવનમાં ઉતારવાની તેયારી કેટલી છે ? ‘ઓહો, શું નવકારનો પ્રભાવ...’ આ સાંભળ્યું ખરું, પણ જ્યારે અમલમાં મૂકવાનું આવ્યું ત્યારે સવારથી સાંજ સુધીમાં નવકારનો એક અક્ષર પણ યાદ ન આવ્યો ! તો શું નવકાર સૂતી વખતે જ ગણવાનો છે ? એ તો ડગલે ને પગલે રટવો જોઈએ. ગુણને સિદ્ધ કરવા માટે તે ગુણને અમલમાં કેટલો ઉતારાય છે, તે જોવું પડે છે. સામેથી અધમતા વરસી રહી છે તેની સામે ઊંચી ઉત્તમતા બતાવવાની ! ચકદેવ એ કરે છે, “હું જીવતો રહ્યો છું, અને મિત્ર પર આપત્તિનો અવસર આવ્યો છે તે તે ઘણા દુઃખની વાત છે ! પણ એ આપત્તિ ટાળવા બનતું કરું.” આતલું ઊંચું હૃદય શાથી છે ? કહો કે મનુષ્ય જીવનના આદર્શ એવા ઉચ્ચ છે. આપણે આ સ્થિતિએ ક્યારે પહોંચવાના ? આદર્શ જીવન પછી ત્યાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષોનો પણ નિકાલ કરવો ઘટે. એમાં પહેલા નંબરમાં ક્ષુદ્રતા-સંકુચિતતાનો અભાવ અને ઉદારતાનો વિકાસ એવો જોઈએ કે હૃદય સારા વિશ્વ પર વાત્સલ્ય વેરનારું હોય. ચકદેવ આ આદર્શના માર્ગે પ્રગતિ કરનારો બની દુશ્મનનું કાર્ય કરનાર યજ્ઞદેવ ઉપર ગુસ્સે થયેલા રાજાની મહેર માર્ગે છે !!

ચકદેવના દિલનું દર્દ વધુ કિમતી : પ્રશસ્ત દર્દ ઉપર ઉન્તતિ :- અહીં રાજાને વિષમ સ્થિતિ થઈ પડી. એક બાજુ ચકદેવનો યજ્ઞદેવને છોડી દેવાનો આગ્રહ, બીજી બાજુ યજ્ઞદેવે કરેલ ભયંકર ચોરી, પાંચ પાંચ દિવસ ભારે તપાસ

ઇતાં પતો ન લાગે તેવી માયાજીળ, સજજન ચક્કદેવ ઉપર આરોપ, સજજનનો દ્રોહ વગેરે ગુનાહિત સ્થિતિ;-આમાં શું કરવું એ વિચારણીય થઈ પડે એવું બન્યું. રાજા દુષ્ટોનો દોસ્ત નથી પણ કાળ છે. એવાઓને ભારે નશીયત કરવી એ એને મન અગત્યની વસ્તુ છે. પરંતુ તેથીય વધુ અગત્યની વસ્તુ સજજનતાની પરાકાણાની કદર કરવા અંગેની છે. આવા દુષ્ટ ગુનેગારને હાથમાં આવ્યા પછી હવે કેમ છોંનું? એ રાજાને મન જેટલું કિંમતી છે એના કરતાં કેઈ ગુણું કિંમતી ચક્કદેવનું, જીવલેણ દુશ્મન ઉપર પ્રેમનો વરસાદ વરસાવનારું જે દિલ છે, તે રાજાના મનમાં લાગે છે. એટલે એ ચક્કદેવની વિનંતિને અવગણી શકતો નથી. વિચાર તો આવે ને કે આ ઉત્તમ આત્માનું દિલ તે કેવું કે જેમાં પોતાના પર વરસેલી આપદાઓનો હવે વિચાર સરખો નથી, અને દ્રોહી એવા પણ મિત્ર ઉપર આફિત ઉત્તરતી દેખો ભારે દઈ છે? દિલના દઈ તેય કેવાં! મન તો આપણાં જેવું જ ને? પુદ્ગળનું જ બનેલું ને? ઇતાં એમાં દઈ પણ પ્રશસ્ત કોટિનું ઉલ્લંઘન કરવું હોય તો કરી શકાય છે. એવા દઈ થવા ઉપર ઉન્તરિનો આધાર છે.

રાજી યજ્ઞદેવને છોડવા કબૂલે છે :- વિવશ બનેલો રાજી કહે છે કે “જો ચક્કદેવ ! તારું વચન મારા માટે અલંઘનીય છે. તું આ દુષ્ટને છોડી દેવાનું કહે છે. તો આમાં હવે તું જાણો.”

આ સાંભળીને ચકદેવને અપૂર્વ આનંદ થયો ! રાજાના પગમાં પડી કહે છે કે “મહારાજ ! આપે તો મારા પર મોટી મહેરબાની કરી.” એમ કહીને ઓણે યજદેવને છઠો કરાવ્યો.

શું કર્યું રાજીએ ! દિલાવર ચકટેવના વચનને ઉલ્લંઘ્યું નહિ. પણ દુષ્ટને માફ કરવા પાછળની જોખમદારી ચકટેવના માથે મૂકી. એટલે ? ભવિષ્યમાં પાછો એ દુષ્ટ નર ચકટેવનો ત્રોહ કરવા ઊભો થાય તો તેનો વિચાર ચકટેવને કરવો રહેશે. પણ તેથી ચકટેવ થોડો જ ગભરાય એમ છે ? ભવિષ્યમાં તો આપણાં કર્મના ઉદ્ય હશે એવું બનશે. પરંતુ વર્તમાનમાં સજજનતા બતાવવાનો, ને પર દુઃખના દર્દને અનુભવવાનો જે મોકો મળ્યો છે તેનો લાભ ઉઠાવી લેવા હો. તેથી જ એમાં સફલતા મળતાં આનંદનો પાર નથી ! જાણો પોતાના ઉપર કાંઈ બન્યું જ નથી. આવા ઉચ્ચ કોટિના દાખલા આંખ સામે રાખવાથી કર્મમાં કર્મ આપણું જરા જરા બગાડનારા પ્રત્યે પ્રેમ વરસાવી શકાય. આપણી પોતાની આફિત કરતાં બીજાની આફિત માટેનું દર્દ આપણા દિલમાં ઊભું કરી શકાય.

ચક્કટેવના સંભાન :- રાજી હવે જુએ છે કે ‘દેવતાના મુખેથી મેં તો સત્ય વાત જાણી; ચક્કટેવની નિર્દોષતા પિછાણી; પરંતુ જગતમાં એનો પ્રચાર કરવો જ ભુવનભાનુ અન્સાઈકલોપાડીઓ-“પ્રવયન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-રૂ)

જોઈએ. તેમ દેવતાની પણ એ સલાહ છે.' તેથી પહેલાં તો ચક્કદેવને પોતાના મહેલમાં મોકલાવે છે. કેમ વારું? લોકને એમ ન લાગવું જોઈએ કે એને દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને એ આપધાત કરવા તૈયાર થયો હતો. ઉદ્ઘાનમાંથી ચક્કદેવનું સ્વાગત કરવામાં આ ભય હતો. તેથી પહેલાં તો એને મહેલમાં મોકલાવી દીધો. પછી ત્યાંથી મોટા વૈભવપૂર્વક અર્થાત્ હાથીના હોદે કે પાલખી વગેરેમાં બેસાડી રાજ્યપુરુષોના પરિવાર વગેરે ઠાઈ સાથે એને એના મકાને પહોંચ્યતો કર્યો.

લોકવાણી :- પરંતુ આ રીતે વાજતે-ગાજતે રાજમાર્ગ ઉપર થઈને લઈ જાય તે કાંઈ છાનું રહે ? લોક તો ટોળે વળી જોવા મળ્યું. “ઓહો ! શું ચકદેવના રાજ તરફથી થતાં સંભાન !” લોકોને વસ્તુ સમજાઈ ગઈ. યજાદેવની દુષ્ટતા અને ચકદેવની સજજનતા જગજાહેર બની ગઈ. પછી જગતના મૌંઢા બંધ કોણ કરી શકે ? લોકો તો ચકદેવને રાજમાર્ગથી પસાર થતાં થતાં સંભળાતું જાય એવા મોટા અવાજથી બોલવા લાગ્યું કે “અહો યજાદેવ કેવો અધમ ! કેવો વિશ્વાસધાતી !...”

સુકૃત કરી લેવા છતાં અસંતોષ :- અહીં એ જોવા જેવું છે કે હવે તો યજણેવને માફી પણ અપાવી દીધી; એટલે કે સજજનતાનું મહાન કર્તવ્ય બજાવી દીધું. પછી રાજ મોટા ભપકા સાથે સન્માન-સ્વાગત કરાવે છે. તો એથી પોતાના દિલને સંતોષ થાય કે નહિ ? ખુશી ઊપજે કે નહિ ? અભિમાન તો નહિ, પણ “અહો ! મારાથી એક સુંદર સુકૃત થયું. ચાલો ઠેઠ રાજ સુધીય એની અનુમોદના પહોંચી. જીવનની એક સફળતા થઈ...” આવુંય મનમાં થાય કે નહિ ? પણ ના, અહીં તો આખી વસ્તુસ્થિતિ જ જુદી છે. યક્ષણેવના દિલમાં એ બધો આનંદ અને સંતોષ માણવાની વાત તો દૂર રહી, કિન્તુ લોક યજણેવની જે હવકાઈ ગાય છે, એ વસ્તુ એના સુકોમળ દિલમાં તીક્ષ્ણ બાણની જેમ ભૌકાઈ ઉદ્ઘેગ કરાવી રહી છે. તે એટલે સુધી કે હવે માત્ર એના પર જ ઉદ્ઘેગ નહિ, પરંતુ વિશાલ સંસાર કે જ્યાં કેઈ અનુચ્છિત ચાલી રહ્યા છે, અને કેઈ વિચિત્ર કર્મો પોતાનાં વિષમ પરિણામ દેખાડી રહ્યા છે, એવા સમસ્ત સંસાર ઉપર એને અભાવ થઈ જાય છે. જીવોના મન ઊરી ગુફા જેવા લાગે છે. ખબર જ ન પડે કે એમાં શું ચાલતું હશે !

ચક્કદેવની સંસાર પર અરુથિ :- આ વસ્તુ અવધિજ્ઞાની મહર્ષિના શબ્દમાં જુઓ, પોતાના ચિત્રને આગળ વર્ણવતાં એ કહે છે કે “હું ચક્કદેવ, મને આ લોકના વચન સાંભળી સંસાર પર તિરસ્કાર છૂટ્યો. મને થયું જુવો તો ખરા ! આવા પણ મિત્રને આવું પરિણામ આવે છે ! અહો ! અસારતા સંસારસ્ય ! ખરેખર ! આ સંસાર માલ વિનાનો છે; તુચ્છ છે; કોઈ સાર નથી સંસારમાં ! અને વિચિત્રતા કર્મપરિણાતે :। કર્મની સ્થિતિ તો મહા વિચિત્ર ! એ શું અકલ્યિત વાત

સર્જવી દે, તેનો પતો જ ન લાગે. વિચિત્ર છે કર્મપરિણાત્મિ ! અકલ્પિતની ઘટના કરાવે, અને કલ્પિતની શૂન્યતા બનાવે. વળી જનોનાં ચિત્ત દુર્લક્ષ છે ! તેમને કળી ન શકાય. તો આ બધામાં ખબર નથી પડતી કે યોગ્યાયોગ્ય શું ?”

ચકદેવને સદગુરુનો સમાગમ :- પ્ર.:- “આવી રીતે જ્યારે હું ચિત્તની વિદ્ધિ સ્થિતિમાં હતો, કર્તવ્યમૂઢ હતો, ત્યાં મારા સારા નસીબે શ્રી અજિનભૂતિ ગણધર મહારાજ પદ્ધાર્યા, અને ઉધાનમાં ઉત્તર્યા. બહાર ગયેલા એવા મેં એ મહાત્માને જોયા ! જોતાં જ મને તેમના પ્રત્યે બહુમાન થયું. મેં તેમને પ્રણામ કર્યા. તેમણે મને ધર્મલાભ આપ્યો. હું તેમના ચરણ આગળ બેઠો, અને મેં એમને પૂછ્યું,”

“ભગવન્ ! જોયો મેં આ સંસાર ! દુઃખથી અને અનુચ્છિતથી ભરેલો ! દુઃખ માત્ર એક પ્રકારનું નહિ પણ કર્મની વિચિત્રતાને લીધે અનેક પ્રકારનું ! તેમાં ખબર નથી પડતી કે શું કર્તવ્ય બજાવીએ કે જેથી સર્વ દુઃખો ટળી જાય. શું એવો ધર્મ કોઈ છે કે જે સર્વ દુઃખોનો નાશ કરી આપે ? હોય તો તે કૃપા કરી મને બતાવો.” આ બધું કોણ પૂછે છે ? ચકદેવ.

ચકદેવના તારણ :- પૂછ્યાં પહેલાં એઝે મિત્રના પ્રસંગ પરથી ત્રાણ જે તારણ કાઢ્યા તે વિચારણીય છે. તેમાં (૧) સંસારની ભ્યાનક અસારતા, તે દેવતાઈ વૈભવ-વિલાસવાળા સંસારને પણ તુચ્છ ગણવાનું સૂચવે છે; તેમાંય સાવધાન રહેવાનું શિખવે છે; અને શક્ય પ્રયત્ને એમાંથી સર્વથા ધૂટી જઈ સર્વદા સ્વસ્થ થવાનું કહે છે. (૨) બીજું તારણ :- ‘કર્મની વિચિત્રતા’ આત્મામાં પૂર્વના કેઈ કર્મ ધૂપાયેલા પડ્યા હોય છે તે અણધારી પળે જાગોને કેવા આશ્રયકારી પ્રસંગો સર્જ છે એનો પતો લાગતો નથી; એની કલ્પના આવી શકતી નથી. એ વસ્તુ (૩) આત્માને સદા નિરભિમાન રાખવા બસ છે. કર્મવશ માણસનાં અભિમાન શા કામનાં ? ક્યારે કર્મ શું કરે, ક્યાં પટકે, કેવી આપદાના સીસામાં ઉતારે, એનો શો ભરોસો ? બીજું, (૪) નવા અશુભ કર્મ કરવા સામે લાલબત્તી ધરે છે. (૫) ત્રીજું તારણ :- ‘જીવોનાં દુર્લક્ષ્ય ચિત્ત,’ તે સંસારી જીવોના સંબંધમાં આવતાં સાવચેતી રાખવાનું શિખવે છે. ઉપરાંત, જે સંસારી સગાં સ્નેહી વગેરેમાં પહોળાં પહોળાં થઈને ફરો છો, એમની ગૂઢ મનોવૃત્તિઓ અને એમાં ધૂપાયેલી સ્વાર્થાદિ ભલિનતા એવા પ્રત્યે વિરક્ત રહેવાનું સૂચવે છે.

હૈયામાં દાળ હોય તો ઉપદેશ અંદર ઉતારે :- ચકદેવે તારવેલા આ ત્રાણ તત્ત્વોએ હૈયામાં એવું સુંદર મંથન કર્યું કે હવે હૈયું મહાત્માના વચન રત્નોને ગ્રહણ કરવા યોગ્ય બન્યું. મહાત્માઓની દેશના હૃદય પર સારામાં સારી અસર કરારે કરે ? એની પૂર્વ ભૂમિકારૂપે હૈયામાં દાળ બન્યો હોય. જમીનનો દાળ હોય તો એ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

પર થઈને પાણી નીચે સરોવરમાં આવે. પણ જમીન દાળ વિનાની હોય તો પાણી સરોવરમાં ન ઉતારે. તેમ હૈયામાં દાળરૂપે જો તત્ત્વની જિજાસા થાય કે “હું તત્ત્વ સાંભળું, આત્માનું હિત સાંભળું,” વળી સાથે જો દુનિયામાં દેખે કે ‘અહીંયાં તો અસાર, વિચિત્ર અને ગૂઢ જ પડેલું છે. એમાં તો અહિતના જ મામલા છે !’-તો ઉપદેશ હૈયામાં ઉતારે. હૈયામાં આ દાળ છે. ચકદેવના હૃદયમાં તેવો દાળ થયેલો છે.

તે કહે છે, “પ્રભુ, મને સર્વ દુઃખ ટાળે તેવો ધર્મ બતાવો.”

ગુરુ ઉપકારી છે; કહે છે, “એવો ધર્મ તો ઊંચામાં ઊંચો જ હોય. સામાન્ય ધર્મ એવું દુઃખ ન ટાળી શકે.”

ગુરુ ઉચ્ચ ધર્મ બતાવે છે :- “એવો ધર્મ ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ છે.”

શું ક્ષમાદિમાં કઠિનધર્મ આવ્યો ? હા, એમાં કઠિનાઈ છે. એનો સ્વીકાર કર્યા પછી, કોઈ દુશ્મન આપણા શરીરના ચામડા ઉતારી લે, તો પણ ક્ષમા છોડવાની નથી. સારામાં સારા માનના હોદ્દા પર બેઠા હોઈએ, અને કોઈ હલકામાં હલકું કલંક ચઢાવે તો પણ માન-મદની વિદ્ધિના કરવાની નહિ. આ છે યતિધર્મ ! ગુરુમહારાજ ક્ષમા-મૃદુતા વગેરે દ્સેય પ્રકારના યતિધર્મનું બહુ સરસ વર્ણન કર્યું. ચકદેવના હૈયામાં દાળ તો થયો જ હતો. ત્યાં આ ઉપદેશો, જુઓ કે કેવી સરસ અસર કરી.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૬, તા. ૨૧-૫-૧૯૫૫

ચકદેવને અસર :- અમરગુપ્ત આચાર્ય મહારાજ કહે છે, “ગુરુનો તે ધર્મોપદેશ સાંભળીને મારા (ચકદેવના) દિલમાં પહેલાં તો દેશવિરતિ શ્રાવકધર્મનો પરિણામ જાગ્યો, પરંતુ સાથે સંવેગ ધર્મપ્રેમ વધતો ચાલ્યો અને વધતાં સમસ્ત સંસાર પર ઉત્કટ વૈરાગ્ય જાગી ગયો.” નવો ધર્મ પામીએ ત્યાં લક્ષ્મીની જેમ જો જવલંત રાગ હોય તો તેથી ય વિશેષ અધિક ધર્મના કોડ જાગે. પૈસા નવા કમાતા શું થાય છે ? હવે આમ વેપાર બેનું, ને આટલા ટકા બજાર ફરે તો આટલો નઝો કરી લઉં...’ એવું જ કંઈ ને ? ચકદેવને દેશવિરતિ ધર્મના ભાવ જાગ્યા પદ્ધી એવું જ થયું સંવેગ-વૈરાગ્ય વધી ગયા. એટલે હવે ચિત્ત વિચારવા લાગ્યું કે,

સંસાર એ કલેશ શાથી :-

“જે આવો કલેશ કે જે સંસારનું વર્ધન જ આપે છે. તેવા કલેશમાં પડી રહેવાથી શું ? એને છોડી ચારિત્ર જ લઈ લઉં.” શું સમજ્યા ! માત્ર કોઈ અમુક

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“ચંદ્રની વિશેષતા” (ભાગ-૨૨)

પ્રસંગ જ નહિ, પણ સંસારવાસને જ કલેશ કહે છે ! ઘેર શ્રીમંતાઈ છે; નોકર-ચાકર છે; દુનિયામાં મોટી આબરૂ છે; રાજાનું અત્યંત બહુમાન છે. ત્યાં કયાં કલેશ છે ? પણ દિલમાં જે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે કે ‘આ અનુકૂળતા જ કલેશ છે. કેમ વારુ ? જીવ એમાં લલચાય છે; એના પર આસ્થા મૂકે છે; એમાં ખેંચાઈને દિલમાં એની રમણતા પાછળ અનેક પાપસ્થાનક સેવે છે; ભવભ્રમણ વધારે છે; માટે જ એ કલેશ !’ માટીનું કોડિયું એટલું નહિ ખેંચે પણ ચાંદીના ગ્લાસની અનુકૂળતા હોય તો ? મોટો જ્વાસ નહિ, પણ મંદિરમાં પૂજા કરવાની નાની કટોરી ય તમે ચાંદીની રાખી હોય, ને હાથ ધોવા ગયા અને કટોરી ઉપડી ગઈ. તો શું થાય ? છાતીમાં કટારીની જેમ કટોરી પેસી જાય ને ? માટે જ એ કલેશ.’

જે સંયોગ, જે પરિસ્થિતિ આપણા હદ્યમાં દેવગુરુ અને ધર્મની આસ્થા પેસવા ન હે, જામવા ન હે, તત્ત્વ રમણતા થવા ન હે અને એના બદલે સંસારની વાતો એવી પેસીને રાગાદિનાં તોફાન જગાવે જાય કે પણ નીકળે જ નહિ !, તે કલેશ.

સંસાર પરના વૈરાગ્યથી, ને એની આવી ઓળખાણથી અનું દિલ આવું થઈ ગયું છે. સંસારમાં રહેલો પ્રતધારી જીવ આટલે સુધી પહોંચી શકે છે, એટલું જ નહિ પણ શ્રાવકનાં પ્રત ન લીધાં હોય તે પણ સમ્યક્તવના બણે આટલે સુધી પહોંચી શકે છે; કે અનું મન કહે છે “આ સુખરૂપ સંસાર પણ કલેશ છે.” અને મન તેથી ઉદ્દેગ અનુભવે છે. કલેશ કેમ ? શાન્તિ કેમ નહિ ? કહો, અહનિશ પાપની-રાગની, દ્વેષની, હર્ષની, શોકની, વગેરે વિચારણામાં રોકી રાખે તે કલેશ. અહનિશ દેવગુરુ અને ધર્મનું સ્મરણ રખાવે તે શાન્તિ.

અમરગુપ્ત આચાર્ય મહારાજ કહે છે, “મને ભવનો એવો વૈરાગ્ય વધી ગયો, કે આ બધું કલેશરૂપ લાગ્યું; તેમાં માત્ર આત્માની વિટંબણા અને ભવની પરંપરા વધવાનું લાગ્યું.” આ મારી ભાવનામાં કેટલાંય કર્મનો જથ્થો ગળી ગયો ! ને ગાઢકર્મબંધની સ્થિતિ તૂટી ગઈ ! આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ ગયું ! એમ લાગ્યું કે જાણે આ બધું કાઢી નાંખ્યું, ને સર્વવિરતિનો પરિણામ જગ્રત થઈ ગયો. મેં ગુરુ ભગવંતને વિનંતિ કરી કે,

ચક્કદેવની માગણી : ચારિત્ર ગ્રહણ :-

“પ્રભુ ! આપે મારા પર ઘણો ઉપકાર કર્યો ! આ સંસારના પ્રપંચ પરથી મારું ચિત્ત ઊઠી ગયું છે. તો હવે મારે શું કરવું તે ફરમાવો.”

ગુરુમહારાજશ્રીએ વિશિષ્ટ શાલ્કબોધના અનુસારે મારા મનના ભાવ સમજ જઈને કહ્યું “મહાભાગ ! તારે મહાપુરુષોએ આરાધેલ ચારિત્ર આદરવું યોગ્ય છે.”

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

મેં ચારિત્ર લીધું અને વિવિપૂર્વક પાળ્યું.

ચારિત્રમાં કષ : સંસારની ભયાનકતાને પીછાણી ગયેલા અને તેથી જ સર્વત્યાગી બની જગત ઉપર મહાદયાળું બનેલા સાધુ મહાત્મા સામા જીવને પાત્ર હેબે તો પછી શું કામ બાકી રાખે ? મહાદયા કરે તેજ ઠીક ને ? પણ પૂછોને.”

પ્ર.- મહાદયા કરવા જતાં સામો જીવ ચારિત્રના કષ એકદમ જ શી રીતે સહી શકે ?

૬.- પણ અહીં જ તમે ભૂલો છો. (૧) એક તો તમે એમ સમજ બેઠા છો કે સંસારમાં લાભ દેખાય ત્યાં કષ એકદમ જ ઉઠાવવામાં વાંધો તો નહિ; બલ્કે ઉઠાવવા જ જોઈએ. છોકરો ૫-૬ વર્ષનો થાય એટલે રમતગમતની સ્વતંત્ર મજામાંથી સીધી નિશાળની કેદમાં ગોંધાવાનું જ. ન જાય તો માર ખાઈને જવું પડે. ભણી ઉત્તરે કે તતર ધંધાનું ધુસરું ઉઠાવવું જ પડે. ધંધામાં કેદ ગુલામીઓ, ટોણાં, ત્રાસ, હાય-બળાપા વગેરેના કષ એકદમ જ ઉઠાવવા પડે. સંસારનું આ બધું બરાબર ! માત્ર ચારિત્રધર્મ કે બીજા ધર્મ જે આત્માને મહાતરણ-તારણ છે, ને પરલોકમાં પરમ આધાર છે, એના માટે કષ ઉઠાવવામાં અખાડા ! એમાં ‘એકદમ શે બને ?’ એવી માયકંગલી કે માયાવી વાતો ! કેવું સ્વાત્મધાતક અજ્ઞાન !!

(૨) બીજી વસ્તુ એ છે કે મનને કેળવી લીધાથી ચારિત્રમાં પણ કશું જ કષ કષ નથી લાગતું. ભવરોગ કાઢવા માટેની એક ચિકિત્સાનો એ આનંદધાયક પ્રકાર લાગે છે. સંસાર કલેશના ભાર ઉત્તરી જવાથી જીવને ત્યાં પરમ શાતા લાગે છે. માત્ર આંતર ચક્ષુ ખૂલવા જોઈએ.

ચક્કદેવ સર્વો :- ચક્કદેવે અભિનશર્મા ગણધર ભગવાન પાસે ચારિત્ર સ્વીકાર્યું. તેને સુંદર રીતે પાળી યોગ્ય કાળે કરી નવ સાગરોપમના આયુષ્યવાળા પાંચમા દેવલોકમાં દેવતા થયો. આ તો ઉત્તમ એવા ચક્કદેવની સરળહદ્યની આરાધનાનું પરિણામ ! પરંતુ યક્ષદેવ દુષ્ટ છે, પાપી છે. તેથી તે મરીને નરકનો જીવ થયો. ત્રાસ સાગરોપણનું આયુષ્ય પૂર્ણ કરી નરકમાંથી નીકળી તે શિકારી ઝૂતરો થયો. અહીં એક પ્રશ્ન થશે કે

પ્ર.- શિકારી ઝૂતરાના ભવનો અને યક્ષદેવના ભવનો શો મેળ ?

૩.- ઉત્તરમાં સમજવાનું છે કે યક્ષદેવના ભવમાં સામાને અંધારમાં ચાખી એના પર હલ્લો કરવાનું જે કર્યું, તે હલ્લા હવે સારા પ્રમાણમાં થાય તેવો ભવ મળ્યો ! ઝાડીમાં છુપાઈ જઈ કોક પર એકદમ તૂટી પડવાનું ! આ કર્મની જાણે ગોઠવણ છે ! એનો અર્થ એ છે કે જે દુર્ગુણો મનુષ્યભવમાં કેળવ્યા તે બીજા ભવમાં સારી રીતે કેળવી શકાય તેવા ભવ ઝટપટ મળે છે. જીવના લમણે

૬૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ચંદ્રનની વિશેષતા” (ભાગ-૨૨)

લખાય છે.

કૂતરો મરીને પાછો તે જ નરકમાં ગયો. ત્યાંથી નીકળી ગ્રાણ સાગરોપમ સુધી તિર્યચમાં ભયંકર ભવો કર્યો. ત્યાં સુખ શું મલવાનું ? એક એક ભવમાં દુઃખ કેટલું ? અસંખ્યકાળ સુધી અસંખ્ય ભવો થવાના ! એ કાળ એણો મહામુશીબતે પૂર્ણ કર્યો; અને ચકદેવ દેવલોકનો કાળ પૂર્ણ કર્યો. હવે પાછો બેઠો કેવો થાય છે તે જોવાનું છે.

● ચકદેવ-યજ્ઞદેવનો ભવ સમાપ્ત ●



બીજા ભવે સિંહકુમાર તરીકે એ અવધિજ્ઞાની અમરગુપ્ત મહર્ષિનું ચરિત્ર સાંભળે છે. એમના ભવો એમના વિરોધી રુદ્રદેવ સાથે ૧. સોમા-રુદ્રદેવ, ૨. હાથી-પોપટ, ૩. ચકદેવ-યજ્ઞદેવના થયા. હવે આગળ ૪. અમરગુપ્ત મહર્ષિનો છથો ભવ :-

● ચન્દ્રસાર-અનઘક ●

જન્મ :- અવધિજ્ઞાની મહર્ષિ કહે છે કે “હું ચકદેવના ભવમાંથી દેવ થઈ આયુષ્ય પૂર્ણ થયે આજ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં રત્નપુર નગરે રત્નસાગર સાર્થવાહ અને શ્રીમતી નામની એની ભાર્યાના પુત્રપણે જન્મ્યો. મારું નામ ચન્દ્રસાર રાખવામાં આવ્યું... યજ્ઞદેવનો જીવ અમારા જ ધરે નર્મદા નામની દાસીનો અનઘક નામે પુત્ર થયો.” શું અનઘક એટલે ? અધ એટલે પાપ. અનધ એટલે પાપ વિનાનો. પાપી જીવનું નામ અપાપી પડ્યું ! સંસારના ખેલ કેવા ! માબાપ નામ તો સારું પાડે છે, પણ એ પ્રમાણે નીવડવાનું પુત્ર ન કરે ત્યાં શું થાય ? ખુદ માબાપ ન કરાવે ત્યાં શું થાય ?

અનઘક કપટી :- ચન્દ્રસાગર અને અનઘક બંને ઉછરતા ઉછરતા બાળભાવમાંથી મોટા થયા. ચન્દ્રસારનું ચન્દ્રકાંતા સાથે લગ્ન કરવામાં આવ્યું. પેલો અનઘક પણ સાથે જ છે, પણ પૂર્વભવના સંસ્કારથી એ ચન્દ્રસારને ઠગવાની બુદ્ધિ છોડી શકતો નથી. ખાલી બુદ્ધિ નહિ, પણ જાગ્રત ઠગવાના પરિણામ ! પરંતુ ચન્દ્રસારને એની કંઈ ખબર નથી. કેમકે એના પરિણામ ભદ્રક છે. ‘સામો આપણી સાથે કેમ વર્તે છે’ તે ચન્દ્રસાર જોતો નથી; અને આ અનઘક તો લુચ્યો ! દંભી સ્નેહભર્યો બહારના વર્તાવમાં શા માટે ખામી રાખે ?

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્યુ કહા.” (ભાગ-૨૨)

૬૩

આચાર્યની દેશના :- એક વખતે કલ્ય અનુસાર વિચરતા વિજયવર્ધન આચાર્ય ભગવાન માસકલ્ય માટે ત્યાં પધાર્યા. ચન્દ્રસાર ગુરુમહારાજની દેશના સાંભળવા ગયો. દેશના સાંભળીને શ્રાવકધર્મ સ્વીકાર્યો. આ સ્વીકાર કેવો ? શાસ્ત્ર જે યોગ્યતાના એકવીસ ગુણપૂર્વકનો કહે છે તેવો. માટે જ આગળ જોઈશું કે એ ગુણોના લીધે કેવી સુંદર આત્મદશાને અનુભવે છે ! આપણે ધર્મ બની ગયા એમ સંતોષ માની લઈએ એ જુદ્દી વાત; બાકી ધર્મપ્રવૃત્તિઓ કર્યે જવા છતાં આત્મગુણો ખીલવ્યા વિના ઊંચી આત્મદશા અનુભવી મુશ્કેલ છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૭, તા. ૨૮-૫-૧૯૫૫

જીવનમાં બંને જરૂરી : ધર્મકિયા કેમ જરૂરી ? :- આ એક ખાસ જ્યાલમાં રાખવા જેવી વસ્તું છે; કે આપણા આત્માની દશાને ઉન્નતકોટિની બનાવવા માટે સંસારપ્રવૃત્તિઓ મૂકીને ધર્મપ્રવૃત્તિઓ આચરવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર આત્મગુણોને જીવનમાં કમાવાની અને સિદ્ધ કરવાની છે. બેમાંથી એકેય વિના ચાલે એવું નથી. અહીં એક પ્રશ્ન કરો.

પ્ર.- આજના નવા મગજવાળા કહે છે કે આત્માને ગુણવાન બનાવો, બાકી ધર્મની દોડાદોડ કરવાથી શું વળે ? બહુ ધર્મકિયાઓ તો માણસને અહીંની કેટલીય ફરજો ચૂકાવે છે. કૌટુંબિક ઉપરાંત ઘણીય સામાજિક ફરજો છે, નાગરિક તરીકેની ફરજો છે. ધર્મ-કિયાઓની ઘેલણા શું આ ફરજો તરફ બેદરકાર બનાવતી નથી ?

૬.- આનો ઉત્તર એ છે કે આવું કહેનારાને એ ખબર નથી કે જો માણસમાં આત્મગુણ ખીલવા છે તો એની સાથે ધર્મકિયાએ સંકળાવું જ જોઈએ. કેમકે જેને આત્મગુણ કહેવાય છે એ પામવાનું કારણ ધર્મકિયા છે, તેમ એ પાચ્યાનું પ્રતીક પણ ધર્મકિયા છે. એનું કારણ એ છે કે આત્મગુણો આત્માની અનંતકાળની અવળી ચેષ્ટાઓને પોપનારા દુર્ગુણો કરતાં તદ્દન ઊલટા છે. એથી એ સભ્યકુ પ્રવૃત્તિને પોષે છે. વળી કૌટુંબિક અને સામાજિક વગેરે ફરજો તો આજે બહેકાવી મુકાવેલા જીવનથી ઊભી થઈ છે. પૂર્વના જીવનો જે અલ્ય જરૂરિયાતવાળા અને તદ્દન સાદા હતા, એમાં આજની માનેલી ફરજોની ધાંધલનો સવાલ જ ઊભો નહોતો થતો. બીજું એ પણ હતું કે બાલપણથી માણસ જીવન જ એવું પરમાર્થી જીવતો કે કુટુંબ કે સમાજને બાધા જ ન પહોંચે. પછી સૌ કોઈને ધર્મપ્રવૃત્તિ કરવામાં ખૂબ અવકાશ અને ઉત્ત્વાસ રહેતો. અલ્ય જરૂરિયાતવાળું જીવન બહુધા સ્વાશ્રયી જીવન હોય છે. એમાં બીજાઓની બહુ સેવા લેવાની રહેતી નથી. આજના ખૂબ જરૂરિયાતવાળા

૬૪

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“ચન્દ્રસાર-અનઘક” (ભાગ-૨૨)

અને ફટાટોપ પ્રવૃત્તિઓ તથા (engagements) રોકાણોવાળા જીવન બહુધા પરાશ્રયી બની ગયા છે. હવે કહે છે એની ભૂખ સંતોષવા ધાર્મિક માણસે પોતાની ધર્મસાધના ચૂકીને આ કહેવાતી સામાજિક ફરજો બજાવવા નીકળી પડવું ! કેમ એમજ ને ? ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એવી ઊભી કરેલી મનમાની સાંસારિક ફરજોમાં ઉચ્ચ કોટિના આત્મગુણો નથી કમાઈ શકતા. આત્મગુણો એટલે આત્માના પોષક ગુણો. એ માટે અનાત્માના અર્થાત્ જડના પોષણ-સ્મરણથી બને એટલું દૂર રહેવું જોઈએ. ધર્મકિયાઓ, ધર્મપ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેવામાં આ તાકાત છે કે જડના પોષણ છોડાવી આત્માનાં પોષણ વધારી આપે. આજની માનેલી સામાજિક ફરજો માણસને જડમુખો અને જડમાં ઓતપ્રોત બનાવે છે. શુદ્ધ આત્મા અને એના વૈરાગ્ય, અનાસક્તિ તત્ત્વરમાણતા વગેરે ગુણોનું સ્મરણ પણ આવવા દેતા નથી. એ તો જડ પ્રવૃત્તિઓથી જડના વિકાસ બરાબર સધાયાનો સંતોષ આપે છે. અસ્તુ.

આત્મગુણોની શી જરૂર ? :- આપણી મુખ્ય વાત તો એ હતી કે ધર્મ પ્રવૃત્તિની સાથે સાથે આત્મગુણોને ભૂલવા જેવા નથી. આત્મગુણો વિનાની ધર્મપ્રવૃત્તિ થોડાં પુણ્ય આપશો, થોડાં હુન્યવી સુખ દેખાડશો, પણ એમાં આત્માની શી ઉચ્ચ દશા થઈ ? અમરગુપ્ત આચાર્ય ભગવાનનો જીવ એવી ઉચ્ચ આત્મદશનાને પામ્યો છે કે જીવનમાં યશસ્વી કારક્રિં આપે છે. એ દશાનું મૂળ શામાં છે ? આત્મગુણોની કમાઈ અને સિદ્ધિમાં. ઉદારતા, સરલતા, ગંભીરતા, અપકારી ઉપર પણ ઉપકાર વરસાવવાની મહાત્માગીરી, હત્યાદિ ગુણો એવા સિદ્ધ કર્યા છે કે એ સહજભાવે પ્રવર્તે છે. એથી જ એમના આત્માની દશા ભવે ભવે ઊંચી ઊંચી જણાય છે. આપણે પણ આ કરવાનું છે. ધર્મકિયાઓ અલબત્ત, ખૂબ કરીએ; કરવી જ જોઈએ. પણ સાથે સાથે આત્માના ગુણો કમાવાનું, કેળવવાનું, અને કેળવી-કેળવીને આત્મસિદ્ધ કરવાનું જરાય ભૂલવા જેવું નથી. એવી ચોંટ જોઈએ કે જ્યાં આત્મગુણ કેળવવાની તક મળે, પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યાં ત્યાં અને વધાવી લઈ આત્મગુણ કેળવવા દા.ત. આપણું કોઈએ બગાડ્યું, એ એક પ્રસંગ ઊભો થયો. એમાં હવે આપણે એક યા બીજી રીતે ઉપકાર કરવાનો આત્મગુણ કેળવી શકીએ; ક્ષમાનો આત્મગુણ અમલમાં ઉતારી શકીએ. ધારો કે પૈસા મળવાનું મ્રલોભન સામે આવી ઊભું છે; પણ તે અસત્ય અને અન્યાયથી. આ એક તક કહેવાય. શાની ? સત્ય અને ન્યાયસંપન્તા કેળવવાની. બસ ! બરાબર સાવધાન અને હદયના કડક બની ત્યાં સત્ય અને નીતિ-ન્યાય બરાબર સાચવવાના. એમાં પૈસા મળવાનું જાય તો જતું કરવાનું. આ વસ્તુ ન હોય તો શું લાગે છે કે આત્મગુણોને ભૂલી કરી ધર્મકિયાથી આત્માની ઊંચી દશા બનાવી શકાય ? શાસ્ત્રકારો તો આત્મગુણોની એટલી બધી

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેશ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૬૫

કિમત આંકે છે કે સમ્યક્ત્વ, શ્રાવકપણું, સાધુપણું વગેરેમાં પૂર્વે અમુક અમુક આત્મગુણોને જરૂરી ગણ્ય છે. ચન્દ્રસારે આવા ગુણો સિદ્ધ કર્યા છે. એના ઉપર ગુરુમહારાજ પાસેથી શ્રાવક ધર્મ લીધો.

ગામમાં ધાડ :- એક અરસામાં કોઈ દીર્ઘ કાલ માટે રાજી દંડયાત્રાએ નીકળી ગયો છે; અને ચન્દ્રસાર તથા અનંધક પણ કાર્યવશાતું બહારગામ ગયા છે. ત્યાં ગામમાં ધાડ પડી ! ધાડપાડુ ભીલ લોકોએ અને એના ઉપરી આગેવાન વિદ્યુન્કેતુએ હલ્લો કરીને લોકોને હત-પ્રહત કરી નાખ્યા; અને એમાંથી કેટલાક જીવતા માણસોને જ ઉઠાવી ગયા ! આ ઉઠાવી જીવામાં એની હોશિયારી છે ! પરંતુ પહેલું જોવાનું એ છે કે વિદ્યુન્કેતુ છે મનુષ્ય, પણ જીવન કેવું છે ? પશુને ટ્પી જાય તેવું ! જીવનમાં સુલભ શું છે ? આ જન્મ પામી, પછી પણ જલદી મળે એવું શું, અને મુશ્કેલીએ મળે તેવું શું ? મળે એટલે સમજાયા ? પોતાને ગમે છે અને આદરાય છે. તે એવું સરળ શું છે ? લૂંટવા વગેરેનું પશુજીવન ! આવા જીવનમાં માલ નથી; ખરાબી છે; પછી લૂંટ નાની હો કે મોટી; જંગલી હો કે સફાઈબંધ. બીજાનું પડાવી લેવાની વૃત્તિમાં માનવતા નહિ. ચન્દ્રસારને ખબર પડી ગઈ કે ગામમાં ધાડ પડી. દોડતો ધેર આવ્યો. ગામ આખું મસાણ જેવું થઈ ગયું હતું ! ધરમાં માણસોની તપાસ કરાવી. બધા છે; માત્ર પત્ની ચન્દ્રકાન્તા નથી ! બીજે ક્યાંય તો જાય નહિ, એથી લાગ્યું કે જરૂર લૂંટારા ઉપાડી ગયા, શું ? ધન નહિ, માણસ ! તેથી નોકર નહિ. પત્ની જ ઉઠાવી ! એથી ચન્દ્રસારના મનને ઉદ્ઘેગ થયો. પૈસા લઈ ગયા હોત લૂંટારા અને જે દુઃખ ન લાગત તેવું દુઃખ પોતાની સુશીલ પત્ની ઉપાડી ગયાનું લાગ્યું.

ચન્દ્રસારને પત્ની ચોરાવા પર મૂળજવણ :- એના મનને એમ થયું કે “અરે ! એ બિચારીએ આજસુધીમાં મારો વિયોગ જોયો નથી તો આ સ્થિતિમાં એ કેવી રીતે પ્રાણ ટકાવી શકો ?” શું લાગ્યું ? ‘ચન્દ્રકાન્તાને આ પહેલ-વહેલા વિયોગમાં જીવનું મુશ્કેલ બન્યું હશે.’ આમાં કેવળ મોહ કામ કરે છે એવું નથી મન પર અલબત સંસારનો સંબંધ જરૂર છે; પણ સાથોસાથ ધર્મનો પણ સંબંધ છે. આવી સુશીલ પત્નીને લૂંટારા ઉપાડી જાય તો કેવી સ્થિતિમાં એને મૂકાવું પડે એ સ્થિતિની કલ્પનાથી તે ધૂજી ઉક્ખો. અકળાઈ ગયો, અકળાઈ જ જાય ને ? એક તો જંગલી ભીલો, અને પાણ સ્રીઓને ઉપાડી ગયા ! એને જીવતી રાખે કે મારી નાખે એની કોને ખબર ? કૃત્ય કેટલું જંગલી ! ખોળિયું માનવનું અને આવી લૂંટનું કાર્ય ! માણસ જેવા માણસને આખા ને આખા ઉપાડી જાય એ શહેરીની દસ્તિએ એક ધણું જ અજુગતુ કાર્ય દેખાય છે. વાત સાચી છે, પણ જંગલી મનુષ્યોને એનો

૬૬ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“ચન્દ્રસાર-અનંધક” (ભાગ-૨૨)

કાઈ હિસાબ નથી. એને તો જાણો માણસ અને ઢોર, બેઉ સરખા ! આજેય પાકિસ્તાનમાં કેવી કારમી હોનારતો બની ગઈ ! મનને દહેશત રહે ને કે લુંટારાઓ પણ કદાચ મારે નહિ, તોય ઉપાડી જવાયેલા આદમીઓને શું લુંટારા બનાવતા હશે ? મોતનો ભય ટેખાડીને એવા બનાવતા હોય તો શી ખબર ? અને ઉપાડી જવાયેલી સ્ત્રીઓનો તો બિચારીનો મરો જ ! શહેરી ગણાતાને પણ જો પરસ્તીના એકાત્મ મળી ગયા, તો વિદ્વાળતા થઈ આવે; ત્યારે અહીં તો જંગલી લોકો ! એ શું સદાચાર સમજ્યા હોય ? પાછી સારા ધરની સ્ત્રીઓ એટલે રૂપ અને લાવણ્યથી ભરેલી હોય, એને મેળવ્યા પછી એ નાગડાઓ શું ન કરે ? એમાં નથી ને સુશીલ સ્ત્રી પર આકમણ આવતાં એ જીભ કયરીને મરે તો ? આવી બધી પરિસ્થિતિમાં ચંદ્રસારને અકળામણ થઈ જાય એ સહજ છે.

પુષ્ય વધારો :- પરંતુ કહે છે ને કે પુષ્ય બળવાન છે ? ધોર નિરાશામાં ઉદ્વિગ્ન બનેલાને એકાએક હર્ષિત કરનાર પુષ્યનો ઉદ્ય છે. માટે જ માણસ જીવનમાં પુષ્યની વૃદ્ધિ કરે એમાં ડહાપણ કે પાપ વધારે એમાં ? પાપ છોડી પુષ્યના માર્ગ ચાલવું હોય તો અનેક પ્રકારની સમજો અને અનેક રસ્તા છે. એક વાર આત્માને એમ હાડોહાડ લાગી જવું જોઈએ કે ‘હવે તો હું આ પાપભર્યા અપવિત્ર જીવનથી કંટાણ્યો !’ એવા ક્યાંથી મારા અહોભાગ્ય કે પુષ્યના માર્ગ મને જાણવાના મળે ! આચરવાના મળે ! વિષયલંપટતા અને કષાય ફુટેવોને પરવશ પડેલું મારું મન મને રાગ્દેષની, વેરઝેરની, અસત્ય અન્યાયની હોળીમાં બાળે છે ! માનવ થયા પછી પણ આ નહિ મિટાવું તો પછી ક્યાં મિટાવી શકીશ ?’ આવું કંઈક લાગી જાય તો પવિત્ર જીવનના રસ્તા ખુલ્લા થઈ જાય. એનાથી પછી પુષ્યના ભંડોળ વૃદ્ધિ પામે.

પત્નીની ભાણ :- ચંદ્રસાર પત્ની ચોરાવાથી અકાયાયો છે, પણ પુષ્યના ઉદ્ય એને ત્યાં તો દેવશર્મા નામના એક બ્રાહ્મણે આવીને કહ્યું, “સાર્થવાહ પુત્ર ! તું સંતાપ ન કર. પૂર્વે પણ આ દેશમાં એક વાર શ્રીસ્થલ નામની પલ્લીના ભીલોની ધાડ પાડી હતી તે વખતે પણ તે લોકો આમ જ માણસોને ઉઠાવી ગયા હતા. કિન્તુ પછી ધાણું દ્રવ્ય આપી તે માણસોને છોડાવવામાં આવ્યા હતા. એમાં જે બાઈઓને ઉપાડી ગયેલા, એમના શીલને જરાપણ વાંધો નહોતો આવ્યો.” ચંદ્રસારને આશા બંધાણી “તો તો પૈસા લઈને જાઉં; તો મારીય પત્ની મને પાછી મળે. કંઈ વાંધો ના આવે.”

વાસનાની સાંકળ :- કેવી એ વિચિત્ર ઘટના છે ! ધન તો લોકોએ ક્યાંય છુપું દાટી મૂક્યું હોય, તો કદાચ હાથમાં ન આવે. પણ આ તો લુંટારુઓ માણસોને જ ઉપાડી પોતાના નિવાસમાં લઈ ગયા ! કેમ ? ‘પૈસા જોઈએ છે. પરંતુ તે ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.’’ (ભાગ-૨૨)

૬૭

પડાવવા અહીં થોભવું નથી. તે માટે માણસોને ઉપાડો ! મનગમતાં પૈસા મળશે !’ કેટલી કુનેહ છે ! પણ આ પાપની હોશિયારી છે ! નરકમાં લઈ જનારી હોશિયારી એવી રચી કે બીજા કુંભીઓ નહિ, પણ સ્ત્રીઓને ઉપાડી. કેમ ? જાણો છે કે આ જગતમાં પતિપત્નીના સંબંધ જ કોઈ જુદા પ્રકારના છે. એ સંબંધની વચ્ચેમાં કામવાસનાની સાંકળ છે. તે કોઈ અજબ બળ ધરાવે છે ! હજુ પોતાના આત્મા પાછળ નહિ પણ સ્ત્રીની પાછળ, માણસ જરૂર પડ્યે સર્વસ્વનો ભોગ આપી દેશે ! એમ તો ધર્મત્વા ધર્મના સંબંધ પાછળ સર્વસ્વનો ભોગ આપવા તૈયાર થાય છે. પરંતુ અહીં તો ધર્મ-કર્તવ્યની સમજ વિનાય અંતરના કામનાં આકર્ષણમાત્રથી નાસ્તિક જેવા પણ ફૂંદી પડવા તૈયાર હોય છે. એટલે જ લુંટારુઓ સ્ત્રીઓને ઉપાડી જાય છે ! એમ સમજને કે એમના ધણીઓ ખૂબ ધન આપીને છોડાવી જશે.

વધારે શું ખરાબ ? શીલની લુંટ કે પૈસાની ? :- ‘પણ એક ખૂબી છે કે જાત લુંટારાની છતાં, દેવશર્મા બ્રાહ્મણ કહે છે કે, સ્ત્રીઓના શીલનો એ ભંગ નથી કરતા. શું સમજ્યા ? પૈસાની લુંટ ખરી, પણ શીલની લુંટ નહિ !’ વધારે શું ભયંકર ? પૈસાની લુંટ કે શીલની ? આ લુંટારાની જાત છતાં, વધુ ખરાબ એવી શીલની લુંટ નથી કરતા ! ત્યારે આજે શહેરી ગણાતામાં શીલની લુંટ ચલાવનારા સાંભળીએ છીઅ ! આજની કેળવણી એને અટકાવી શકતી નથી. એટલું જ નહિ પણ સહિશ્કાશ અને સિનેમાઓ જાણ્યે અજાણ્યે માનસવૃત્તિને એવી ઉશ્કેરે છે કે શીલની લુંટ તરફ માણસના મન અવસરે પ્રેરાય એટલું સારું છે કે હજુ કાયદો અને લોકવ્યવહાર લોકના મન પર સજા અને બેઅબરૂના ભય નાખે છે; તેથી હજુ એવો ભયંકર રાક્ષસી યુગ નથી આવ્યો. છતાં આંખેથી રૂપની લુંટ અર્થાત્ પરસ્તીના રૂપ ચોરવાનું આજે ખૂબ વધી ગયું. આય એક જાતની લુંટ જ ને ? ત્યારે પેલી તો જાત લુંટારાની; એટલે મહાહલકી, અને શિકાર હાથ વેંતમાં; છતાં શીલની લુંટ કરવાની વાત નહિ ! પૂર્વકાળના લુંટારાનીય અનેક અધમતાની વચ્ચેમાં આ કેવી ઉત્તમતા ! અફસોસી છે કે આજના સ્કૂલ-કોલેજના ભણતરમાં શીલ-સદાચારના જોરદાર શિક્ષણ નથી અપાતા ! ઐર ! તો પછી એ કાર્ય તમારે કરવાનું છે. તમારે છોકરા-છોકરીઓને અવરનવર શીલ-સદાચારનો બોધપાઠ ખૂબ ખૂબ ભાર મૂકીને આપવાનો છે. તેમ સાથે સાથે સિનેમા, નોવેલો, વગેરે બદીઓથી તમારી પ્રજાને ખૂબ બચાવી લેવા જેવી છે.

સંસ્કૃતિની લુંટ :- આપણી વાત ચાલતી હતી શીલની લૂંટની, પણ તમને ખબર છે ? શીલની લુંટ કરતાં પણ વધુ ભયંકર સંસ્કૃતિની લુંટ છે. સંસ્કૃતિ જીવતી હોય તો એ કોઈ દિવસ પણ શીલની લૂંટથી માણસને પાછો વાળે; શીલની લુંટ

૬૮

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ચંદ્રસાર-અનંદક” (ભાગ-૨૨)

કરતાં અટકાવે. પરંતુ જ્યાં જીવનમાં મૂળભૂત આર્થ સંસ્કૃતિ,-પરમાત્મા પર અનન્ય આસ્થાની અને પુણ્ય-પાપની શ્રદ્ધાની સંસ્કૃતિ-આત્મા-પરલોક વગેરે તત્ત્વોની જીવનમાં મુખ્ય દાખિ રાખવાની સંસ્કૃતિ-એ સંસ્કૃતિ જ જો લૂંટાય, તો પછી બાકી શું રહેવાનું ? આજનો ભૌતિકવાદ અને આજની રીતરસમો પવિત્ર આર્થ સંસ્કૃતિ અને ધર્મસંસ્કૃતિની લૂંટ ચલાવે છે.

પાઠ્ય પુસ્તકમાં ધર્મની વસ્તુ જ ન જોઈએ, એ શું છે ?

ઉપરથી માછલીમાં વિટામિન્સ અને ઈંડામાં પ્રોટીન વગેરેના શિક્ષણ, એ શું છે ?

‘પૂર્વકાળમાં ધર્મના કારણે જ જગા ચાલતા હતા’ એવું ઊંઘું શિક્ષણ વિદ્યાર્થીના મન પર કઈ અસર કરે ?

સિનેમા વિકાસનો સંસ્કૃતિ પર કેવો કારમો પ્રહાર છે ?

જે હરિજનોને જૈનધર્મ, જૈનમંદિર અને જૈનદેવ ઉપર કોઈ જ શ્રદ્ધા નથી, અને કાયદાના ડંડાથી જૈનમંદિરમાં ધૂમાડવા, એ સંસ્કૃતિની લૂંટ નથી તો બીજું શું છે ?

દેવના ભક્તોએ પોતાના જ પૈસા દેવભંડારમાં જમા થવા દીધા પણી હવે એનાથી દેવભક્તિ કરવા પર, બીજા મંદિર બંધાવવા કે બીજા મંદિરમાં ઉપયોગ કરવા ઉપર ટ્રસ્ટ એક્ટનો અંકુશ, એ શું સંસ્કૃતિનો દ્રોહ નથી કરતો ?

ધૂટાછેડાની લૂંટ; અસંયમ-નિયમનની નહિ, પણ સંતતિ-નિયમનની પ્રેરણા, એનાં સાધનો વેચવાની ધૂટ, ઈત્યાદિ બધું સંસ્કૃતિની ધોર લૂંટ સમાન છે.

આજ તમે આ બધાની આડે કેટલો હાથ દઈ શકશો ? પહેલું, એટલું તો અવશ્ય કરો કે આજનું આ બધું તોફાન જોતાં, આપણા પવિત્ર ધર્મ ઉપર, દેવાધિદેવ અરિહંત પ્રભુ ઉપર, ધર્મશાસ્ત્ર અને ધર્મગુરુ ઉપર ખૂબ શ્રદ્ધાળું બનો. ધર્મ એ જ જીવનમાં ખરી ચીજ છે; એ જ રક્ષક છે; એ શ્રદ્ધા અસ્થિમજજા કરી શક્ય પ્રમાણમાં સ્વ-પરમાં ધર્મ વધારો.

પૈસા લઈને ચંદ્રસાર જંગલ ભણી :- વાત શી હતી ? લૂંટારા પણ શીલની લૂંટ નહોતા કરતા. અને ચંદ્રસારે આ સાંભળ્યું. ત્યાં એના જીવનમાં જીવ આવ્યો. મનને થયું કે ‘એનું શીલ અખંડિત રહેશે ને ? પ્રાણ તો અખંડિત રહેશે ને ? બસ, તો પૈસા જ્યાં તોય વાંધો નહિ !’ નોકરને કહે છે, “અત્યા અનધક ! ઊઠ, ઊભો થા. ભાતું લઈ લે. અટવીનો માર્ગ છે, લાંબો છે, ખાવાનું સાથે જોઈએ. સાથે પૈસા પણ લઈને જઈએ.” લઈને બંને જણા નીકળ્યા. ભીલ લોકો દૂર રહે છે. ત્યાં સુધી પહોંચવાનું છે. પૈસા પણ સાથે વધુ લઈ લીધા કે જેથી પેલા ભીલ લોકો

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૬૮

આનાકાની કરે નહિ. અને સીધેસીધું કામ પતી જાય.

અવસરોચિત ન આવડે તો અપજશના પોટલા :- તાકે જે શુભકાર્ય આવી પણ્યું તે કાર્ય બગડે. ચંદ્રસાર વાણિક છે, સુશીલ પત્નીને બચાવવાનું મહાન કાર્ય સમજે છે. તેથી ઊંઘું લેખું માંડવાની વાત નહિ. ‘હાય ! બહુ ધન લૂંટારાને કેમ આપાય’ એ અત્યારે જોવાની વાત નહિ. માટે ધરમાં સારભૂત જે સોના ચાંદી-એવા પૈસાની થેલી લઈને ઊપજ્યા, જે આવી સમયસૂચકતા ન હોય અને બીજો-ત્રીજો છિસાબ માંડવા જાય કે “સમજાવી દઈશું... હમારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય ?...” તો ? જરૂર પડ્યે પત્ની ખોઈ બેસે ને ? અવસર ન સમજે તે પૈસા ખરચવા છતાં જશ પામી શકતો નથી. કહો છો ને કે જમજાવાર મોટી વસ્તુનો કરે, અને શાકભાજી કે એવી વસ્તુ ઓછી કરે, તો બૂમાબૂમ થાય. જમજાવાની બીજીવાર માગણી થાય તો કહે ‘વાપરો, વાપરો, આવે છે !’ ધી-દૂધની રેલમછેલ કરી પણ ખબર ન પડી કે લોકોને સંતોષ શી રીતે થાય. એટલે અવસરોચિત ન આવડવાથી અંતે અપજશના પોટલા ! અને પૈસા ખર્ચા જાણે પાણીમાં !

ધર્મવ્યવહારમાં વિશેષ રીતે ચારે બાજુથી ઔચિત્ય જાળવો :- જેવી રીતે દુન્યવી વ્યવહારોમાં જશ લેવા ચારે કોર નજર રાખવી પડે તેમ ધર્મવ્યવહારમાં પણ ચારે કોર નજર રાખવી પડે. વિશેષ રીતે ઔચિત્ય સમજવું જોઈએ. નયસારે ગોચરી વહોરાવી એટલું જ નહિ, પણ સાધુઓને વળાવવા સાથે ગયો. કેમ ? બરદાસ્ત પૂરેપુરી કરવી જોઈએ. અત્યારે લોકો કલકતા બાજુ જાય છે, અને ત્યાંના બાબુઓની ભક્તિ દેખીને ચકિત થઈ જાય છે ! “જમજા-ભક્તિ તો એજ !” એમ થાય છે. શાથી ? કારણ કે બધું વ્યવસ્થિત ! પાટલા-થાળી-નેપકીન બધું જ તૈયાર. ચક્કયક્તા લોટા પવાલા ઠંડગાર પાણીબર્યા તૈયાર. પીરસવા માટે ધરના મુખ્ય મુખ્ય માણસો ઊભા હોય ! ઉપરથી ભક્તિના શબ્દો મીઠા નીકળતા હોય ! પૈસા ખર્ચવાના એના એ, પણ અવસર ક્યો ? ભક્તિનો. તો તેના બધાં અંગો સચવાવાં જોઈએ. જમાડવામાં તો સારી ધી ભર્યા લાદું જમાડો. થાળી ભરી દો. પણ થાળી ધૂળવાળી કે ચીકળી હોય તો ? બેસવાનું ધૂળ પર હોય તો ? પાણીના પવાલા ન હોય તો ? પીરસનારો એક વખત પીરસી ગયો પછી ભલે એ વસ્તુ બીજીવાર કલાકે આવે કે ન આવે તો ? અથવા લાદુ હોય પણ શાક ન હોય ! દાળભાત ન હોય. દાળ હોય પણ મીઠું ન હોય !... તો ? આ બધું શું છે ? ખરચ કરવા છતાં ચૂ...ચૂ... થાય ! બસ, એવી જ રીતે, દેવ અને ગુરુની ભક્તિમાં બધું બરાબર સચવાવું જોઈએ. ભગવાનની પૂજાનું કામ છે. કેસર લઈને

૭૦

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ચંદ્રસાર-અનધક” (ભાગ-૨૨)

ગયા. પણ એવું પાતળું કે ભગવાનના અંગે રેલા ઉઠા ઉઠા છે. તો શું કહો ? ‘એ તો જરા પૂજારીએ ઢીલું ઘસ્યું છે; ’ એજ ને ? તો પૂજારીના ગુને સજી ભગવાનને ? આ બધું એ સૂચવે છે કે કોઈ પણ કાર્યનો અવસર ઓળખતાં ન આવડે, એટલે કરે-કારવે છતાં ભોટ ગણાય ! મૂરખમાં ખપે !

નાણાં કોથળી શેઠ પાસેથી નોકર પાસે :- ચન્દ્રસાર હોશિયાર છે. સારભૂત પૈસા લઈ લીધા, કે જે લૂંટારા ભીલને દેખાડતાં ભીલ બીજું બોલે જ નહિએ; જટ પત્તી સોંપી દે ! એ અને અનધક નીકળી પડ્યા. રસ્તામાં વચ્ચે વિસામો કરવા બેઠા. કોથળી બે હતી. એક પૈસાની અને એક ભાતાની ! અહીં સુધી તો ચન્દ્રસારના હાથમાં નાણાંની અને નોકરના હાથમાં ભાતું ભરેલી કોથળી હતી. પણ ભાવીભાવ જુઓ કેવા, એ અહીંથી ઉઠતાં ચન્દ્રસારના હાથમાં ભાતાની કોથળી આવી, અને નોકરના હાથમાં પૈસાની ! હવે ? અનધકના હાથમાં નાણાંની કોથળી આવતાં તેનું મન ચલાયમાન થવા માંડલું. આમેય પૂર્વજન્મમાંથી સંસ્કાર એવા જ લઈને આવ્યો છે, અને અહીંથી પણ એવા વિચાર ઘોળાયા જ કરતા હતા. ત્યાં આ પ્રસંગ મલી ગયો. માલ મળ્યો ! ત્યાં હવે શા માટે છોડવો ? પાપનાં ધાડાં ઉઠારી પડ્યા. “ખૂબ માલ છે ! જવેરાત દાંસીને ભરેલું છે. ઢીક હાથમાં લાગી ગયું છે ! હવે બંદાને લહેર થઈ ગઈ ! જંગલનો માર્ગ છે. રાડ પાડતાય કોઈ આવી લાગે એમ નથી. મોકો મળતાં શેઠને પૂરા કરી, આપણે આપણા રસ્તે પડી જઈએ !”

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૩૮, તા. ૪-૬-૧૯૫૫

કુસંયોગ ભયાનક છે, સારાનેય બગાડે :- જુઓ, વસ્તુનો સંયોગ કેવું કામ કરે છે ! અનધકના હાથમાં પૈસાની કોથળી નહોતી આવી ત્યાંસુધી બુદ્ધિ એટલી બગડી નહોતી. પરંતુ માલનો સંયોગ હાથમાં આવતાં ભયંકર વિચારો સ્ક્યાર્ય ! આમ તો પોતાની બુદ્ધિ પહેલેથી બગડેલી હતી જ. ઠેઠ કુદ્રદેવના ભવથી બુદ્ધિ બગડેલી છે. કિન્તુ અહીં એ દેખાય છે કે લક્ષ્મીનો સંયોગ થયા પણી એ દુષ્ટ બુદ્ધિની જગ્રતિ અને વિકાસ થાય છે. આનો અર્થ એ છે કે તમે ખરાબ વસ્તુના, બુદ્ધિ બગાડનારી વસ્તુના સંયોગમાં ન આવો, ત્યાં સુધી જ નિરાંત રહેશો, પણ પછી ઊંધી ઊથલપાથલ શરૂ થશો. દૂધને ખરાબ વસ્તુનો સંયોગ થતાં ફાટી જાય છે ને ? સારી કેરીઓની વચ્ચમાં બગડેલીનો સંયોગ થયેથી સારીમાંનીય બગડે છે ને ? જરૂમાં કુસંયોગ ખરાબ અસર કરી જાય તો ચેતનમાં ન કરે ? સદાચારી પણ પર સ્ત્રી પુરુષને એકાંત સેવવાની કે પરસ્પરના અંગોપાંગ જોવાની ના કેમ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૭૧

પારી ? જ્ઞાની ભગવંતો જાણો છે કે કુસંયોગ ભયાનક છે સારાનેય બગાડે.

● કામલતાની કરુણ કથની ●

પુરોહિત : રબારણ :- સાંભળી છે પુરોહિતની માતા કામલતાની કરુણ કથની ? સંયોગ માણસને કેવો પાડી દે છે એનો એ દારુણ ઈતિહાસ છે. એનો સાર જુઓ. એક પુરોહિત રાજમાર્ગ પર ચાલતાં જરા આંહુ જોવામાં પડ્યો, ત્યાં એક રબારણ સાથે સહેજ અથડાઈ પડ્યો, અને પેલીની દહીની મટકી નીચે પડી કૂટી ગઈ ! દહીં ધૂળ ભેગું થયું. કુદરતી આ બનવા પર પુરોહિત પ્રત્યે ભરવાડણ ગુસ્સે થઈ જગડો કરે, પણ એ તો ખડખડાટ હસ્તી પડી ! પુરોહિત પણ ભૂલને લીધે શરમાઈ જવાના બદલે આ જોઈ આશ્રય પામ્યો ! શું આ ? બંનેને તેવા સંયોગની અસર. પુરોહિત પૂછે છે.

“આ શું ? આટલા નુકસાનમાંય હસે છે ?”

પેલી જવાબ દે છે, “હા, બહુ દુઃખિયાને દુઃખ શું ?”

“એવાં તે તમારે કેવાંક દુઃખ છે ?”

રબારણ કહાણી કહે છે : બ્રાહ્મણી રાણી બની :- “બાજુએ ઊભા રહો, કહું. આજ ભવમાં હું હતી બ્રાહ્મણપત્તી, નગર પર રાજાની ધાડ પડી. વેર નાનું બાળક અને પતિને મૂકી ગામ બહાર કુવે પાણી ભરવા હું ગયેલી. ત્યાં તો શત્રુના ભયથી નગરના દરવાજા બંધ કરવામાં આવ્યા. હું ગભરાણી ! દોડી ! બૂમો મારી, પણ કોણ સાંભળે ને દરવાજે કોણ ખોલે ? એટલામાં દુશ્મનના સુભટોએ મને ઉપાડી પોતાના રાજા આગળ ધરી. કેમ ? ઈનામ શાબાશી લેવા. જગતમાં વસ્તુના સંયોગ થતાં જ તોફાનો શરૂ થાય છે. રાજાએ પણ મને જોતાં જ, હું રૂપાળી એટલે, રાણી બનાવવા ધારી, મને કહું પણ ખુસુ, કિન્તુ હું માનું શેની ? હું કાઈ હલકા કુળની નહોતી. ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મેલી અને સારા બ્રાહ્મણને વરેલી. પોતે સારી હોય છતાં પતિ હલકો હોય તો એ સારીનેય હલકી કરી દે. કેમકે સંયોગનો પ્રભાવ એવો ! પણ અહીં તો પતિ સારા, છતાં જુઓ કે કુસંયોગ કેવું ભયાનક કામ કરે છે. રાજાની બુદ્ધિ તે કેટલી બગડી ? કેમ જાણો હું જ એને એક રાજ્ય જેવી મળી ગઈ, તે લડવાય ન થોખ્યો, અને મને લઈને ગયો પોતાના રાજ્ય ભેગો ! મને ધમકાવી-લલચાવી, ગમે તેમ પણ મને મુખ્ય રાણી બનાવી. હું ય કેવી તરકી જેવી કે હજી હદ્યમાં બ્રાહ્મણ પતિને ચાહતી છતાં, શીલને સમજતી છતાં, રાજમહેલના એકાંતમાં વૈભવી રાજાની કામપ્રેરિત લટપટમાં લપસી, એની સાથે ભોગવિલાસમાં પડી.” સંયોગ શું ન કરે ? સારા સંયોગ તારે અને

૭૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કામલતાની કરુણ કથની” (ભાગ-૨૨)

નરસા સંયોગ મારે; જીવના દુયા કાઢી નાખે. આજની સંસ્કૃતિનાશની મોંકણ શાના ઉપર છે ? કુકેળવવણીના સંયોગ, સહશિક્ષણના સંયોગ, રેડિયો, સિનેમા, ધાપાં, ઉદ્ભબત્વેશ, ઉદ્ભબત રહેણી કરણી, બોલચાલ, કલબ વગેરેનાં સંયોગના ઉપર. નવી પ્રજાને જેટલી એ સંયોગોમાંથી બચાવશો એટલા એના સંસ્કાર નહિ બગડે.

પતિ મેળવવાનો ક્રીમિયો :- ભરવાડણ આગળ કહે છે, “મને પતિની ચિંતા તો હતી જ ‘બિચારા નિર્ધન, પાછો નાનો છોકરો પાળવાનો. શું કરતા હશે ? તેમ આ કુકર્મથી હું કંટાળી હતી. પણ પતિ અહીં કેમ આવે ? હું કેમ ધૂંદું ?’ એટલે મેં દાન દેવું શરૂ કર્યું. પતિ પણ આવ્યા. ધન આપ્યું; ઉપરાંત સંકેત કર્યો કે નગર બહાર અમુક મંદિરમાં સંધ્યાકાળ પછી અમુક દિવસે આવવું. અહીં મેંય રાજાને કહું કે મંદિરમાં આ સમયે માત્ર આપણે બંનેએ પૂજા કરવા જવાનું છે. રાજા તો મારામાં અંધ હતો. સારો પણ રાજાય ઈચ્છિત કામપાત્રના સંયોગમાં આંધળો ! કુસંયોગો સત્યાનાશ વાળે છે ! (એટલે જ અનઘક હાથમાં નાણાંપાણી આવતાં બગડ્યો ને ?) કિમતી જવેરાત નાણાં લઈ હું ઊપડી મંદિરે. રાજા સાથે છે. મંદિરમાં પેઠા પછી જુઓ મારી કૂરતા ! મેં વિચાર્યું કે ‘આ રાજા કાંઈ એમ હગાય નહિ, કે મને છોડે નહિ. તેથી આનો નિકાલ કરું તો જ અહીંથી એમકુશળ ભાગી શકાય.’

રાજા પતિ બેઉ મર્યા ! :- “એમ વિચારી રાજા ગફલતમાં રહેતાં તલવારથી મેં એનું ગળું કાપી નાખ્યું. પછી પતિ ત્યાં આવ્યા છે કે નહિ, તે જોઉં ત્યાં તો એક ખૂણામાં પતિ સુતેલા જોયા. પણ શરીર લીલું કલહાર પડી ગયેલું અને ઢંઢોળતા ઉઠ્યા તો નહિ, પણ તપાસ્યા તો મરી ગયેલા લાગ્યા. સમજુ કે સાપ કરડ્યો લાગે છે. મનને થયું. અહો કેવી હું મૂર્ખ ! ઉભયથા ભ્રષ્ટ થઈ ! કુસંયોગોએ કેવી બગાડી છે કે એમ ન થયું કે ખેર ! પતિ બિચારા મરી ગયા, પણ હું પાપમાંથી તો હવે છૂટીશ ? એમ પણ ન થયું કે અહો મેં વિશ્વાસુ રાજાને કેવો ભયંકર દ્રોહ કરીને મારી નાખવાનું ઘોર ફૂટ્ય કર્યું ?” આય કુઝ્યના સંયોગનો પ્રભાવ ! કવિ વચન છે. “વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ” વિવેકથી ભ્રષ્ટ થયેલાનું સો બાજુથી પતન થાય છે. અહીં નસીબની પણ કેવી બલિહારી છે ! બ્રાહ્મણીનું ધ્યાર્યું શું થયું ? કંઈ જ નહિ. ઉપરથી પાપ માથે ચઢ્યું ! ભરવાડણ કહે છે, “પછી તો હું હિંમત કરી માલ લઈ રાજાના ઘોડા ઉપર બેસી નાઠી. બીજા એક રાજ્યમાં પહોંચી ગઈ.”

રાણીપણામાંથી વેશ્યા :- કથા તો લાંબી છે. પણ ટૂંકમાં વસ્તુ એ થઈ કે કોઈ વેશ્યાને એની ખબર પડી ગઈ, તે લલચાવી પોતાને ત્યાં લઈ જઈ એને વેશ્યા

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈયુ કહા.” (ભાગ-૨૨)

બનાવી, રબારણ આગળ કહે છે કે “એમાં એક પરદેશી બ્રાહ્મણ ત્યાં આવેલો. એના પર મને સહેજ દિલ આકર્ષણું. તેથી પૈસાની બહુ દરકાર કર્યા વિના એના સાથે હું ભોગવિલાસમાં પડી. પ...ણ.”

પુત્ર સાથે ભોગ :- “શું પણ ? પાપ ક્યાં સુધી ધૂપું રહે ? અજ્ઞાન જીવને ભાન નથી કે ‘આ જગત પર મોહ તો કરું છું, પણ એની પાછળ કોણ જાણે કેટલાએ અકાર્યો સેવી નાખું છું !’ પછીથી ઓળખાણની પૃથ્વી થતાં ખુલાસો કર્યો તો અમે બંને જણો પરસ્પરને એવા ઓળખ્યા કે એ નવજીવાન બ્રાહ્મણ તે મારો પુત્ર જ.” શું થયું આ ? તેવા સંયોગોએ માતા પુત્રને જ દુરાચારમાં મૂક્યા ! બંનેયને ખૂબ શરમ લાગી. તે ત્યાંથી ભાગી જ ગયા, પુત્ર તો ક્યાંય ચાલ્યો ગયો; આવી વેશ્યાના કામ કરનારી માતા તરફ હવે શો પૂજ્ય ભાવ રહે ? કે શું સાથે રહેવાનું મન થાય ? પાછો પોતેય લપસેલો. એટલે એક વાર બગડ્યા પછી તો એવી માતા સાથે ફરી કુકર્મમાં ન પડાય એની ય શી ખાતરી ? દુરાચારનાં લપસણાં બહુ ભૂંડા.

આપધાતમાંથી રબારી બચાવે છે :- રબારણ કહે છે કે “ગમે તેમ પણ પુત્ર ક્યાંય નાઠો; અને હું હવે શું કરું ? મારી જાત પર મનેય ભયંકર ત્રાસ ધૂટ્યો ! અરે ! જગતમાં મારા જેવી દુષ્ટા કોણ હશે ? જીવનથી એવી કંટાળી કે ગઈ નદી તરફ, દૂબી મરવા ઊંચા કિનારેથી નદીના પાણીમાં ઝંપલાયું પણ ખરું. કિન્તુ દૂર રહેલા એક ભરવાડે જોયું. તે આવીને નદીમાં તણાતી મને પાણીમાંથી બહાર બેંચી લાગ્યો. મૂર્ખિત પામેલી મને પોતાના ઝૂંપડામાં લઈ ગયો. સારવાર કરી મને સ્વસ્થ કરી. પણ મારા રૂપમાં લોભાઈ મારા પગમાં પડીને મને સ્ત્રી થવા વિનવવા લાગ્યો. જીવનમાં મેં ધાણું જોયું. તેથી મારું હદ્ય ખોટું કૂણું બન્યું. કાળા કામ એક-બે વાર કર્યા પછી એની અફસોસી નથી રહેતી. તેથી જીવ નિષ્ઠુર થઈ જાય છે. ભોગની ઈચ્છાથી નહિ, પણ ભરવાડની દયાથી હું એની પત્ની બની. પણ સંયોગ કેવો ? પરપુરુષનો. શું બાકી રહે ? પાછો સંસાર શરૂ કર્યો તે હવે હું ભરવાડણ આ દહી ઢોળાઈ ગયું. પણ આ દુઃખ તે મારે શું વિસાતમાં છે ? જીવનમાં પતિને મૂકી રાજાને વળગી. રાજાને મારી પતિ સાથે જવા ધાર્યું. પણ પતિજ બિચારો સાપથી મર્યો. હું વેશ્યા થઈ. એમાં ઠેઠ પુત્ર સુધી પહોંચી ! એ બધું કર્યા પછી આપધાત કરવા જતાં ભરવાડે બચાવી અને વિનવી. તો હવે, દિલ નફટ થઈ ગયેલું, તે ફરી કુકર્મમાં પડી. પરલોકમાં તો દુઃખનો પાર નહિ રહે, પણ અહીં પણ પાપ અને દુઃખ જોવામાં શું બાકી રહ્યું ? આટલા બધા દુઃખમાં આ મરકી કૂટ્યાનું દુઃખ કંઈ વિસાતમાં નથી.”

૭૪ સુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કામલતાની કરુણા કથની” (ભાગ-૨૨)

પુરોહિત સાંભળીને સજજડ થઈ ગયો. એમ થયું કે આ હું શું સાંભળી રહ્યો છું ? એય હવે દિલ ખોલીને કહે છે કે ‘એજ હું તારો અભાગિયો દિકરો કે જે ત્યાંથી નાઢો હતો. ત્યારે તો હું દરિદ્ર જેવો હતો. બંનેને આકર્ષણ તો માતા-પુત્રના સંબંધને લીધે હતું. પણ અજ્ઞાનદશામાં હું જાણું કે આ તો કોઈ વેશ્યા છે, અને તું જાણે કે આ કોઈ પરદેશી છે. કેમકે ક્યાં એ મૂળ દેશ હતો ? તેથી પુત્રપણાની કલ્યાણ જ ક્યાંથી આવે ? પાછો નાનપણથી મૂકેલો તેમાં શરીરમાંય ફેરફાર થઈ ગયેલો; તેથી પડ્યો કુકર્મમાં.’ અહીં એક પ્રશ્ન ઉठે છે કે

પ્ર.- એ વખતે તો ન ઓળખે, પણ અહીં બંનેને ઓળખાજી કેમ જોતાં જ ન પડી ?

૩.- અહીં પુરોહિત દરિદ્ર નથી પણ રાજસેવાથી પાઘડી-દુપહ્ણા વગરેમાં સુસજજ ભપકાદાર પંડિતના લેબાશમાં છે. તેથી રબારાશને પુત્રપણાની કલ્યાણ ન ઉઠી, તેમ પુત્રે એને વેશ્યાના વેશમાં જોયેલી. તેય કદાચ એક જ વાર, ત્યારે અહીં તો તદ્દન જુદો ભરવાડણનો વેશ થઈ ગયો છે; નાક ને કાનમાં લાંબા લાંબા લટકણીયાં. કપડાં જાડા ખદ્દ. તેથી બનવા જોગ છે બંનેને એકદમ પૂર્વની ઓળખાજી તાજ ન થાય. પરંતુ હવે તો પુરોહિત જ પેલીનું બધું સાંભળીને પોતાની એના એજ પુત્ર તરીકે ઓળખ આપી. હવે તો સદ્ગુરુને શોધી બેય ધોર તપસ્યામાં ચઢી ગયા.

અહીં વસ્તુ એટલી જોવાની હતી કે સંયોગો કેવું ભ્યાનક કામ કરે છે !

કુસંયોગની અસરથી બચવા પવિત્ર વિચાર પ્રવાહ :- અનધકને સંયોગોએ બહેકાયો. હાથમાં કોથળી ધનની નહોતી આવી ત્યાં સુધી પાપ કરવા માટે સળવણ્યો નહોતો. હવે ધનનો હાથમાં સંયોગ થવાથી સળવળે છે. કુસંયોગ બહુ ભૂંડી ચીજ છે. સારા માણસને પાપના વિચાર માત્રથી બચવા માત્ર કુસંયોગ તો શું, પણ કુસંયોગની કલ્યાણથી ય દૂર રહેવું જોઈએ. કદાચ અજાણ્યે કુસંયોગ અથડાઈ પડ્યા, તો ત્યાં એકદમ સાવધાન બની દિલમાં પવિત્ર વિચારસરણીનો ધોખ વહેતો કરી દેવો જોઈએ; અને જલદીથી કુસંયોગમાંથી બહાર નીકળી જવું જોઈએ. કુસંયોગ એ તો ધર્મરાજાનું શરણું લેનારા ઉપર મોહરાજાની ઠગારી લાલચ છે. એમાં માણસ ફસ્યો કે ઊપર્યો ધર્મરાજાને ત્યાંથી મોહરાજાની સેવામાં ! આજના કાળે ઊભા થયેલા અનેક કુસંયોગોથી દૂર રહેવાની જરૂર છે.

આપણી વાત શી હતી ? કુસંયોગો માણસને ભાન ભૂલાવે છે. તેથી અનધકના હાથમાં માલ આવતાં બગડ્યો. તેય ક્યાં સુધી ? શેઠ ચન્દ્રસારને પૂરા કરી ભાગી જવાનું ધાર્યું.

● ચાર ચોર ●

સ્વાર્થની લાલસામાં માણસ લાંબો વિચાર કરવા રહેતો જ નથી. એને તો “મને લાભ કેમ થાય ?” બસ, તેજ જોવાનું આવડે. ભલે બીજાને ખીચડી મળે; પોતાને લાડુ મળે કે બસ ! જાપટી જવાના ! ચાર ચોરની વાત આવે છે ને ? ચાર ચોર ચોરી કરવા ગયા. ચોરી કરીને ચારે જણા તળાવની પાળે આવીને બેઠા. ચારે ભૂખ્યા થયા હતા, એટલે એમાંના બે ચોર ગામમાં ખાવાનું લેવા ગયા; અને બે જણા બેઠા ત્યાંના ત્યાં જ. અહીંથી બેઠેવાને વિચાર આવ્યો કે ‘પેલા બે આવશે તો ચોરીના માલનો ભાગ એમને આપવો પડશે ! માટે સંતલસ કરે છે કે તે આવે કે સીધા કૂવામાં જ એમને ધકેલી દઈએ !’ ત્યારે હવે ગામમાં ગયેલા પેલા બે શું ગોઠવે છે તે જુઓ ! “ચોરીનો માલ ખૂબ છે. પેલા બે મારા લ્હાલા બેઠા છે લહેરથી ત્યાં; ને આપણને ધકેલ્યા ગામમાં આથડવા ! પણ હવે બચ્યાઓને બતાવી દઈએ. આ લાડુ જેરવાણા કરીને આપી દઈએ કે બસ ! બધું ધન આપણને હજમ !” સ્વાર્થનો ટૂંકો વિચાર ! તેમાં જુઓ કે કેવા લેવાના દેવા થાય છે. આગળ તો જોવાનું જ ન હોય ! પછી પોતાના ટાંટિયા પોતાના ગળામાં પેસી જાય એમાં શી નવાઈ ? સ્વાર્થના ટૂંકા વિચારમાં પાપની ધોર બલા માથે !

પેલા બે ચોર લાડુ લઈને આવ્યા, આવીને કહે છે, “અમે તો ગામમાં થોડા લાડુ સાથે ભૂસું ફાકીને આવ્યા છીએ. તમે તો સાવ ભૂખ્યા છો. માટે જલદી લ્યો આ લાડવા; ને ખાઓ લહેરથી.”

“પણ પાણી...?” ઉસ્તાદ છે ને ? ત્યારે પેલાય અબૂજ છે; કહે છે,

“હા, એ પણ લાવી આપીએ...” એમ કહીને પેલા કૂવા પર પહોંચ્યા. ત્યાં પેલા બેએ માર્યો પાછળથી ધક્કો ! ગયા સીધા ઊંડા પાણીમાં અને આ બે આવીને લાડવા પર જામી પડ્યા ! પરંતુ જાઈને ક્યાં ઊભા રહી શકે ? લહેરથી લાંબા થઈને સૂતા; તે સૂતા !

સ્વાર્થધતાનો નશો :- જો સ્વાર્થ આ જીવનનો લાંબો વિચાર ન કરવા દે, તો પછી પરભવના વિચાર તો લાંબા હોય જ શાના ? જેને પરભવના લાંબા વિચારનો ખ્યાલ સરખો નહિ, તેના જીવન ઢોર જેવાં સમજવા. હાથમાં આવેલું ચિત્તામણિથીય અધિક કિંમતી મનુષ્ય જીવન એળે કેમ જાય છે ? પુણ્યયોગે એવી સામગ્રી પ્રાપ્ત થઈ જાય છે કે જેના પર સ્વાર્થધતાનો નશો ચઢે છે, ‘મારું સાચવી લઉં, મારું પગભર કરી લઉં. મારા જાગના તર કરી લઉં !’ બસ ! આની પાછળ ન આ જીવનની પવિત્રતાનો વિચાર કે ન પરભવના ધોર દુઃખનો વિચાર !

સ્વાર્થમાં જ અંધ બનતાં પહેલા વિચારી લેજો કે મૃત્યુની હક્કમત, શું સ્વાર્થી, કે શું નિઃસ્વાર્થી બેઉ પર સમાન છે ! ચોર હો કે શાહુકાર હો, રાજી હો, કે રંક હો; અંતે તો બંનેય અગ્નિમાં બળી જ મરવાનું ! અંતે માલનો સ્વામી પલટો અને કાયાની રાખજ થવાની ! પરભવે રવડી મરવાનું ! આવી રમત અનાદિકાળની, છતાં હજુ સ્વાર્થીધતા ન મરે એ આશ્રય છે.

સ્વાર્થીધતા કેમ મરે ? :- મન ઉચ્ચતર આદર્શો અને ધોરણો ધરતું થઈ જાય તો સ્વાર્થીધતા મટાડી પરમાર્થ વસન કેળવી શકાય છે; અને આત્માને ઉજ્જવલ કરી શકાય છે. જો આત્માને ઉજ્જવલ કરવાના રાહને સોમાએ પ્રથમ ભવમાં સ્વીકાર્યો, તો તેના બે ભવ પણી યક્ષદેવના અવતારમાં ત્યાં સુધીનું આત્મબળ વિકસ્યુ કે સ્વાર્થવશતા મૂકી વિશ્વાસધાતી એવા મિત્ર યજ્ઞદેવની ચોરીને પ્રગટ ન કરતાં, પરમાર્થવસનથી, પોતાના પર ચોરીનું કલંક આવ્યું તો, વહોરી લીધું ! દેશનિકાલની સજી પાખ્યો ! અને યાવદું આપથાત કરવાની સ્થિતિએ પહોંચ્યો ! છતાં મિત્રનું રહસ્ય બહાર ન પાડ્યું. આટલી સ્થિતિએ જ્યારે દેવતાએ ખરી વાત બહાર પાડીને સત્ય હકીકત રજૂ કરી કે ‘ચોર તો યજ્ઞદેવ છે; તમે કોણે દંડી રહ્યા છો ?...’ આ સાંભળી રાજાએ યજ્ઞદેવને જ્યારે કડક શિક્ષા કરવા ફરમાવ્યું ત્યારે પણ ચક્કદેવનું હદ્ય મિત્રપ્રેમથી કકળી ઉઠ્યું ! અને ખૂબ આગ્રહ કરી એને છોડાવ્યો. કહો જો હદ્ય ઉપર ક્યાં સુધીનો અંકુશ મેળવ્યો હશે, કે હુશ્મનનું કામ કરનારો જ્યારે પોતાના જ દુષ્કૃત્યથી સજી પામી રહ્યો છે, ત્યાં પણ પોતાનું ચાલે ત્યાં સુધી રક્ષણ કરવાની તૈયારી ! અને હુશ્મન પર વાત્સલ્યનો વરસાદ ! -આ ઉત્તમતા અને આ પરમાર્થવસન આદરી શકે છે ! આની મુખ્ય ચાવી અનાદિના દુષ્ટ બનેલા આપણા હદ્ય ઉપર કડક અંકુશમાં છે; કે જેથી સુંદર આદર્શો અને ધોરણો રાખી સ્વાર્થીધતા મિટાવી શકાય.

આત્મ-અંકુશનો પ્રભાવ :- આપણું હદ્ય ધારીએ તો આપણા કબજામાં જ છે. પરંતુ આપણને જો આપણા આત્માને ઊંચે ચઢાવવાની તૈયારી હોય તો ! નહિતર તો અનાદિની રીતરસમ મુજબ જે ગોટાળાવાનું હદ્ય આજ સુધી ચાલી આવ્યું છે, તે અહીંયાં પણ નહિ અટકે; અને આગળ ભવાંતરમાંય નહિ અટકે. સ્વાત્માની એવી ઓળખ જોઈએ કે કદાચ સારાયે જગતનો અમારા પર અધિકાર હોય તો બહારથી : બાકી અંદરથી અમારા હદ્ય પર અધિકાર તો અમારો જ છે. ગમે તેવા ઉપસર્ગ આવે પણ મલિન વિચારણામાં અમારે અમારા હદ્યને રમાડવું નથી, આ જો નક્કી કર્યું હોય તો તેવી મલિન વિચારણામાં આપણા હદ્યને ઘસડનાર જગતમાં કોઈ સત્તા નથી. મલીન લાગણીઓને આપણે જ પોષીએ

છીએ. તેથી વિચારણા શેતાન સરખી ચાલે છે, માત્ર આપણી મોહમૂઢ દશા ! પાપની નિરપેક્ષતા ! પરભવની બેદરકારી ! આ છે, તેથી મલીન લાગણીઓ સહેજે જન્મે છે, નિર્ભય બની શેતાની વિચારો કરીએ છીએ. પણી ભલે મન વાળીએ કે “કેટલું સહન કરી કરીને કરીએ...” જ્યારે ને ત્યારે આવા આપણા બચાવ તૈયાર હોય છે. પણ અજ્ઞાન કેવું પ્રવર્તે છે ! કે આત્મા વિચારવા નથી થોભતો. “આજાથી જે ભવિષ્યમાં મહા કદુ ફળ ઊભાં થશે તે વેઠવાનું તારું ગરૂં છે ? તે ભોગવવાની તારી તૈયારી છે ને ? આપણા હૈયાને સાફ પવિત્ર રાખવું હોય તો જગતનો કોઈ સંયોગ, કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે આપણને ચલિત કરી શકે. એ માટે સંતની વિચારસરણી જોઈએ. એ સારુ મહાત્માની ભલી લાગણીઓ જોઈએ. એ તો આવે કે મોહમૂઢતા કાઢી જ્ઞાની વિવેકી બનીએ, પાપથી ભયભીત રહીએ, પરભવની જગ્યાની સંતુષ્ટિ રાખીએ. મહાત્માઓ જે થઈ ગયા તેમને ઈન્ડ્રોએ પણ હાથ જોડ્યા હતા ! એમ માનીને કે “આપણું બધું બળ હોય પણ આ મહાત્માઓને ચલિત કરવા એ બળ સમર્થ નથી, ભલે આપણી દેવતાની આખી પર્દા આવે !” દેવતા શું જોઈને આવું વિચારતા હશે ? એટલા માટે કે એની સામે મહાત્માઓના આવા આદર્શ હતા કે “દેવતાનો ઉપદ્રવ આવે તોય શું થઈ ગયું ? જો પોતાની સજાન દશા છે, આત્માની ઓળખ છે. પરલોકની પડી છે. એકમાત્ર પાપનો ડર છે, તો પોતાના હૈયાને ચોક્કું રાખવા પોતે જ સરમુખત્યાર છે. એને મેલું કરવા દેવતા પણ સમર્થ નથી.” આત્મ-અંકુશનો પ્રભાવ ઓર છે !

કામદેવ મહાશ્રાવકની ધીરતા :- મહાશ્રાવક કામદેવને પૌષ્ઠ્રમાં રાત્રે દેવતા ઉપસર્ગ કરવા આવ્યો. ત્રણ મોટા ઉપસર્ગ કર્યા. ૧. ભયંકર અજગરનો ભરડો, એથી ભયંકર દશ્ય ઉપરાંત હાડકાના કડાકા ! ૨. મોટો ભયાનક પિશાચ ! અને ૩. મોટો વિકરાળ વાઘ ! આ ત્રણે ઉપસર્ગોમાં કામદેવ જરાય ચલાયમાન ન થયા, તો હવે એમના પિતા-માતાને લાવીને મૂક્યા ! અને અનુકૂળ ઉપસર્ગ શરૂ કર્યા ! પરંતુ જે સમજે છે કે ‘જગતમાં આપણી ચીજ જ કઈ છે કે એની ખાતર પ્રતિજ્ઞા ભાગીએ ? તો ભલે કાયા પડી જાય તોય શું ? કાયાની રાખ થતાં પહેલાં આત્માની સચોટ સાધના થઈ શકે, તો એવી ધન્ય ઘડી કર્યાંથી ?’ તેને ગમે તેવા ઉપસર્ગ આવો, હદ્યમાં જરાયે મલીન વિચારણા ધાલવાની વાત જ નહિ !

અનુકૂળ ઘોર ઉપસર્ગમાં કેમ અડગ ? :- માતા-પિતા કામદેવને વિનંતિ કરે છે, “અરે બેટા ! અરે ભાઈ ! આ અમને મારે છે અને તું જોતો કેમ નથી ? તને શું અમારી જરાયે દ્યા નથી ? તું સાવ નિષ્કર થઈ ગયો છે ? અરેરે ! અમે મરી ગયા રે...” કાળો કટ્યાંત અને ચોધાર આંસુ ! કહો, હવે હૈયું બગડે કે

નહિ ? ‘આ કોણ છે મારા માતા-પિતાને ગ્રાસ આપનાર ? હલકટ મનુષ્ય !’ એમ થાય કે નહિ ? છતાં કામદેવને કેમ છે ? બસ પોતે ભલો અને પોતાનું ધ્યાન ભલું ! પોતાનું ધ્યાન મૂકવાની વાત નહિ ! આપણી પાસે તો જ્યારે ને ત્યારે બહાનું આ છે, કે “અમારે ધ્યાન તો ગમે તેટલું રાખવું હોય પણ આવું ઊભું થાય ત્યાં શું થાય ?” પરંતુ આ મહાન આત્મા એ વિચારતાં કે ‘આ મનની જે પવિત્રતા અને નિશ્ચલતા ઊભી કરી છે, આત્માની જે અસંગ દશા જગાવી છે, તેને ધક્કો પહોંચાડવાનો નહિ !’

મન માને નહિ ત્યાં સુધી ધર્મ કરાય ? :- કામદેવ ગૃહસ્થપણે છે, અને આટલું સહન કરે છે, પણ પોતાના ધ્યાનમાં ભંગ નથી થવા દેતા ! ધોર ઉપસર્ગની વચમાં પ્રતિજ્ઞાને અખંડ જીવંત રાખે છે ! એ પ્રતાપ શાનો ? પોતાના અનંત અનંત કાળના ઉર્ધ્વાંભલ બનેલા આત્મા અને મન ઉપર કડક અંકુશ મૂક્યાનો. જેના એ સૂત્ર છે કે ‘ભાઈ ! મન માને નહિ ત્યાં સુધી સારું કામ શી રીતે થાય ?’ એ બિચારા પોતાની જાતને જ ઠણી રહ્યા છે. સંસારના સતત કાર્ય, મન ન માને તો પણ થાય છે. ત્યારે આત્માના હિતના કાર્યની વાત આવે ત્યાં, મન ન માને ત્યાં સુધી ન કરવા, એ કેટલી ભયંકર મૂર્ખાઈ ? સંસારનો તો અનંતાનંત કાળનો અનુભવ છે, કે એમાં પણ પહેલાં તો કેટલેય સ્થાને મનને બલાત્કારે દાબવું ફડે છે, પહેલ-પહેલું નથી માનતું; છતાં કાર્ય કર્યે જવાય છે; પછી મન માને છે. ત્યારે જે ધર્મનો એવો કાંઈ અભ્યાસ, પરિચય કે પ્રેમ નથી સેવ્યો, એ ધર્મ કરવા માટે શું મન એકદમ માની જ્શો ? ભૂલા ન પડો. આ પણ મનની જ એક ઠગાઈ છે, જે કહેવાનું તમને શીખવે છે કે ‘મન માને નહિ ત્યાંસુધી ધર્મ શી રીતે થાય ?’ સંસારમાં જુઓને, નિશાળે જવાનો અભ્યાસ અનંત કાળનો છતાં અહીં જન્મેલા બાળકને પહેલ-પહેલું નિશાળે જવાનું ય ક્યાં મન થાય છે ? છતાં તમે એને પરાણે નિશાળે તગડો છો. એમ પોતાના શરીરના રોગ મિટાવવા ઔષધ લેવાનો અનંતીવારનો અભ્યાસ છતાં અહીં રોગ આવ્યે કડવા ઔષધ અને કુપથ્યત્યાગ માટે ક્યાં એકદમ મન માને છે ? છતાં મન મારીને એનું સેવન થાય છે ને ? ઘરનાં માણસ તીખા સ્વભાવના હોય તો કેટલીય વાર રોક અને ધમપણાડા કરે છે એ સહવાનું દિલ ક્યાં માને છે ? છતાં મનને દબાવીને એ સહન કરો જ છો ને ? એવી તો કેટલીય પ્રવૃત્તિઓ સંસારની મન વિના પણ થાય, અને ધર્મની ન થાય, એ ક્યાંનો ન્યાય ? કહો મોહરાજાનો. કેમ કે એને ધર્મ નથી કરવા દેવો. તેથી તમારા હાથમાં આ સૂત્ર પકડાવી દીધું, કે મન વિના ધર્મ ન થાય. ‘સંસાર તો મન ન હોય તોય કરવો પડે, ન ચાલે. પણ જો મન ન હોય તો ધર્મ ન કરીએ તોય

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૭૮

ચાલે,’-આ શિખામણ મોહની છે; એ આત્માની જ ધાતક છે. શું મન કે શું આત્મા, એની પાસે દુર્ગુણો અને દુર્ઘૃત્યો છોડાવવા તથા સદ્ગુણ અને સુકૃત્યો આચરાવવા માટે એના પર કડક અંકુશથી કામ લેવું પડશે. એમ કાંઈ પહેલ-પહેલાં એ ઉત્સાહી નહિ થાય. કડક અંકુશ રાખી આત્મા અને મનને શુભ કાર્યમાં જોડ્યા, પછી તો ધીમે ધીમે એનો રસ લાગીને મન પોતે જ સમજદાર બની જશે અને ચાહીને સારાં કામ કરશે. કામદેવે પ્રભુ ઉપરના અથાગ વિશ્વાસે મનને અંકુશમાં લઈ વ્રત ધીરતા અને પવિત્રતા સિદ્ધ કરી છે.

મહાશ્રાવક કામદેવે પોતાના આત્મા અને મન ઉપર કડક અંકુશ મૂક્યો છે, તેથી ઉપસર્ગને ગણકાર્યા વિના ધ્યાનમાં મસ્ત છે. પ્રતિજ્ઞા પાળવામાં ચુસ્ત છે. એવી ધીરતાથી, ને એવી ધર્મશ્રદ્ધાથી ઉપસર્ગને સહે છે કે સવારે જ્યાં પ્રભુ મહાવીરદેવને વંદન કરવા જાય છે ત્યાં પ્રભુ પોતાના સાધુઓને બોલાવીને એમની સમક્ષ કામદેવને પૂછે છે ‘કેમ કામદેવ ! તેં આજ રાત્રે વાધ પિશાચ અને અજગરના ધોર ઉપસર્ગ સથા ?’ કામદેવને પોતાની પ્રશંસા ગમતી નથી તેથી મોં નીચું કરે છે અને પ્રભુને હાથ જોડી ઊભો રહે છે. પ્રભુ પછી સાધુઓને ઉદ્દેશીને કહે છે, ‘હે આર્યો ! જુઓ કે આ એક ગૃહસ્થ કામદેવ કે જોડો હજુ મહા પરાક્રમ કરી સંસાર નથી ત્યજ્યો, તે પણ જો આવા ધોર ઉપસર્ગ સહન કરે, તો સંસાર ત્યજ્યને આત્મકલ્યાણ માટે ત્યાગમાર્ગ ચઢેલા સાધુઓએ તો કેટલું સહન કરવું જોઈએ ?’ તીર્થકરદેવના શ્રીમુખે પ્રશંસાવું એ કેટલી આત્માની ઉચ્ચ સ્થિતિ ગણાય ! એના મૂળમાં શું છે ? સ્વાત્મા ઉપર કડક અંકુશ.

પેથડશાહનો પ્રસંગ પણ ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે. મન પર કડક અંકુશ રાખી એમણે રોજની પ્રભુભક્તિનો આખો કાર્યક્રમ બીજા કાર્યોની ઉખલથી તદ્દન અલિપા રાખ્યો હતો. તે એટલે સુધી કે ખુદ રાજા બોલાવે તોય પ્રભુભક્તિના સમયે જવાનું નહિ, અરે ! એ તો શું પણ ખુદ રાજા ગુપચુપ ધીમે પગલે મંદિરમાં આવી ગયો તોય એના તરફ દણ્ણ પણ ગઈ નહિ. દણ્ણ માત્ર પ્રભુ ઉપર ! એક જ દિલ, એક જ ચિત્ત, માત્ર પ્રભુની ભક્તિમાં. ચિત્તમાં બીજો વિચાર જ લાવવાનો નહિ. સંસારના કાર્યોમાં આજસુધી આ રીતે એક જ દિલ, એક જ ચિત્ત પરોવી-પરોવીને જ જો સંસારના ભાવો સાથે આત્મા એકમેક બન્યો છે, તો કહો, હવે પરમાત્મા સાથે એકમેક શી રીતે બનાય ? આજ ન્યાયે કે બીજી રીતે ? પરમાત્માની ભક્તિ, ગુણગાન અને આજ્ઞાપાલનના કાર્યોમાં જ ચિત્તને તરબોળ કરવાથી કે કાર્ય તો પ્રભુભક્તિ વગેરેનાં ચાલે પણ ચિત્ત રેઢિયાળ રહે એથી ? અનાદિનું મન એમ કાંઈ એકદમ કબૂલ કરવાનું નથી. એના પર દબાણ કરવું પડશે. એને પસંદ આવે

૮૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કામલતાની કરુણા કથની” (ભાગ-૨૨)

કે કંટાળો આવે, પણ આપણે તો એને ધર્મકાર્યમાં ઓતપ્રોત રાખવાનું. બીજો વિચાર એમાં આવવા જ નહિ દેવાનો. આવી જાય તો તરત એને હટાવી દેવાનો. નહિતર તો પછી સંસારિક ભાવોમાં જ આત્માની એકમેકતા રહેવાની.

પેથડશાહની ધીરતા :- રોજ જિનેન્દ્રપૂજા વખતે મહામંત્રી પેથડશાહે પણ સતત કામ પડતાં મૂકવાની ટેક રાખી છે. એમાં એક વાર રાજાએ પારખું કરવા માટે પોતાનો માણસ મોકલ્યો. ત્યાં દેરાસરના દરવાજે ઉભેલા પેથડશાહના માણસે કહ્યું, “નહિ, હમણાં અંદર નહિ જવાય.”

“પણ રાજાએ ખાસ મોકલ્યો છે.”

“તો ખાસ કહી દેંકે કે પેથડશાહ હમણાં ખાસ નહિ આવી શકે !” માણસ પાણો ગયો, કે રાજા ઉઠીને આવ્યો. તો તેને પણ ચોપદારે કહી દીધું, કે ‘નામદાર! ક્ષમા કરજો, મંત્રીજીની આ વ્યવર્થા છે. અંદર નહિ જવાય.’ પણ રાજા તો ધૂસ્યો અંદરમાં. ત્યાં જુઝે છે તો પેથડશાહ મશગૂલ છે ફૂલપૂજામાં ! માણસ પાછળથી ફૂલ આપતો જાય, જેવી રચના કરવી છે તેવું ફૂલ આચ્ચા કરે ! પેથડશાહ પાછળ હાથ કરીને તે લે; પણ દંદિ ભગવાન પરથી ખસતી નથી. કેમ કે મનને જેને સાબૂત રાખવું છે, તો કોણી તાકાત છે કે તેને ચણાવી શકે ! ફૂલ આપનાર માણસને ઉઠાડી મૂકી રાજા તેની જગાએ ગોઠવાઈ ગયો; અને ફૂલ આપવા શરૂ કરે છે. ત્યાં સુધી પેથડશાહને ખબર નથી પડતી. પરંતુ વચ્ચે ભળતું જ બીજું ફૂલ જ્યાં રાજાએ આપ્યું ત્યાં મંત્રી ચોક્ક્યો ! પાછળ જોયું. તો ? રાજા ખુદ છે ! બંને હસી પડ્યા. મન કેટલું બધું નિશ્ચિત અને નિશ્ચલ !

સંયોગોના ગુલામ :- મંદિરમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી બીજી વાત નહિ ! બહાનું ન નીકળે કે “અમારે લફરાં કેટલાં છે ? ઉપાધિઓ કેટલી છે ? રાજ જપવા ક્યાં દે છે ?...” પરંતુ આ બધાં બહાના છે. લફરાં મૂકી દે ને, કોણ કહે છે તે રાખ ? માનવ જીવન ઉપાધિ સંભાળવા માટે નથી, આત્મહિતની સાધના માટે છે ! પરંતુ તમને એ ઉપાધિ એટલી ગમે છે કે જીવનના પહેલા શાસથી તે છેલ્લા શાસ સુધી એ ઉપાધિ છોડવી તો નથી, ઉલટી વધારવી છે ! પછી છેલ્લી ઘરેઠે પણ તે મૂકવાની જગર નહિ ! પેથડશાહ જુદા છે. ઉપાધિના ગુલામ નહિ. ચક્કદેવ પણ સંયોગોના ગુલામ નથી. પોતાના વિશ્વાસુ મિત્રના આંખ-જલ કાપી નાખવાનું રાજા સુભટને કહે છે, તો ચક્કદેવ કહી દે છે, “જતો કરી દો, જો મારા પર માન હોય તો.” સંયોગોના ગુલામ નહિ એટલે પોતાના સંયોગો તો તે પછી ઘણાં સારા છે, પણ મિત્રના પ્રસંગ પરથી ચક્કદેવે સંસારને અસાર ઓળખી પોતે ચારિત્ર લીધું. “મિત્રની આવી સ્થિતિ ! એ બતાવે છે કે

ભુવનભાનુ અન્સારીકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-સમરાઈય કહા.” (ભાગ-૨૨)

આ સંસાર કે જ્યાં આપણો પૂર્ણ આસ્થા રાખીને બેઠાં છીએ તે કેવો છે ?” ગમે તેના જીવનમાં અનિષ્ટ પ્રસંગ બન્યો, પણ તેના ઉપરથી જગતનો ક્યાસ કાઢવો હોય અને સંસારસ્થિતિનું ભાન આપણો કરવું હોય તો કરી શકીએ છીએ. પરંતુ જો માને કે “આ તો તેને બન્યું ને ?...આપણો શું લેવા દેવા...” આવું માનવાની મૂખ્યાઈ કરી જે બિનસાવધ રહે છે તેને પરિણામે ઠગાઈને રોવાનું આવે એમાં નવાઈ નહિ. આમણો તો માપ કાઢી લીધું કે ‘આજે એના માટે તો કાલે મારા માટે.’ એટલે, આજના પોતાના સંયોગો રાજ-સન્માન, સંપત્તિ વગેરેના અનુકૂળ છે, છતાં ચારિત્રનું મહાન પરાકરમ અચાનક પળે ઊભું થઈ જાય છે ! ખૂબી કેવી કે યજ્ઞદેવ ઊંધું કરવા ગયો તો એ પટકાયો; છતાં એમાં ચક્કદેવ ચારિત્ર લે છે. શું ? કંઈ ખબર પડે છે ? આત્મા જાગે છે ? સંયોગના ગુલામ ન બનો. પાપ યજ્ઞદેવ કરે છે, પણ એથી વૈરાગ્ય પામી સંસાર ત્યાગ ચક્કદેવ કરે છે, એ વસ્તુ મહત્વની છે. ધર્મ કોણો કરવાનો ? પાપીએ કે ગુણીએ ? પણ કહો કે પાપીને પોતાનાં પાપ પાપરૂપ જ લાગતા ન હોય ત્યાં એને, ‘પાપ ધોવા ધર્મની જરૂર છે,’-એવું શાનું લાગે ? ત્યારે ગુણીયલ આત્મા તો એવી ઊંચી આત્મ-દશાએ પહોંચેલો છે કે એ તો એ જુઝે છે કે,

(૧) આજે પાપ બીજાને ઠગે છે, ફસાવે છે; તો કાલે મનેય કેમ ન ઠગે ? વળી,

(૨) લક્ષ્મી કમાવવી, ઘર ચલાવવા વગેરે જે દુન્યવી પ્રવૃત્તિ અવસરે આવાં પાપ પણ કરાવે એના વિશ્વાસ શા રાખી બેસવા ?

(૩) સારું થયું કે સામાની સાથે સંપર્કમાં આવ્યા છતાં આપણો એના દગાનો પૂર્ણ ભોગ ન બન્યા અને ધર્મ વિના ખપી ન ગયા ! તો હવે જીવતાં રહ્યાની સાર્થકતા કરી લેવી ધર્મથી !

(૪) જો પાપી જીવ બિચારો પોતાનો પાપસ્વભાવ અજમાવી શકે છે તો આપણો આપણો વિવેકસ્વભાવ અને ધર્મસ્વભાવ કાં ન અજમાવવો ? દુર્જન દુર્જનતા કરે છે, તો સજજન સજજનતા જ દાખવે.

(૫) એને એથીય આગળ, આપણેય ક્યાં એક નહિ તો બીજા પાપમાંથી મુક્ત જ છીએ ? તેથી ખરું જોતાં જો બીજાનાં પાપ પ્રત્યે આપણાને સુગ હોય કે ‘આ પાપી જીવ આવાં પાપ કરે છે !’ તો આપણી પહેલી ફરજ છે કે આપણે જાતે તો સર્વ પાપથી મુક્ત બનવું જ ; પાપ માત્ર છોડી જ દેવાં.

આવી આવી કોઈ ગણતરીનો પ્રભાવ છે કે પાપ કોઈ કરે, પછાડ કોઈ ખાય, અને એના પરથી બોધ લઈ સુખી થએલો માણસ ધર્મ કરવા લાગી જાય.

૮૨ ભુવનભાનુ અન્સારીકલોપીડિયા-“કામલતાની કરુણા કથની” (ભાગ-૨૨)

વાલી ને રાવણ :- હારે રાવણ, અને દીક્ષા વાલી લે ! આ કેમ બને ? વાલી જીતાં વિરાગી બન્યા ! ચન્દ્રહાસ ખડુગ લઈને રાવણ મારવા આવ્યો, તો વાલીએ સ્વસ્થતાથી તેને આપોને આખો ઊંચકી બગલમાં માર્યો ! ત્યાં શું ચાલે રાવણનું ? રાવણ પાસે સમૃદ્ધિની પુષ્યાઈ હતી. વાલી પાસે બળની પુષ્યાઈ હતી. તો રાવણને બગલમાં ઘાલીને જંબુદીપની આસપાસ ગજ રોન માર્યા, અને લાવીને ઉભો કરી દીધો યુદ્ધભૂમિ પર ! પરંતુ હવે ગૌરવથી ક્યાં ઉભો રહી શકે રાવણ ?

“કેમ, મહાનુભાવ ! ક્યાં ગયું ચન્દ્રહાસખડુગ ? તમારી પાસે તે છે, અને મારી પાસે એ નથી, એટલે ‘લાવ તેના હુરચા ઉડાવી દઉ.’ ‘એમ કરી દોડી આવ્યા’તા ને ? હવે ક્યાં ગઈ બહાદુરી ?” રાવણ વાલીની ક્ષમા માગે છે. “આપને ઓળખાં નહિ ! આપ નરોત્તમ છો. હું નરાધમ છું.” જે વાલીની પાસે આટલું બળ છે કે રાવણ જેવાની પહાડી કાયાને બગલમાં મારે તેને રાવણનું રાજ્ય પડાવી લેવું હોય તો કેટલીવાર ? અભિમાનથી આટલે સુધી ડાંડાઈ કરનાર રાવણને કેદમાં પૂરી રાખવાનું મન ન થાય ? પણ ના, ઉલટું વાલી કહે છે, “આ ચન્દ્રહાસ ખડુગ એટલે જગતની સામગ્રી.-તેના પર વિશ્વાસ રાખી તું દોડ્યો તો માર ખાધો. જગતના પદાર્થો પર વિશ્વાસ રાખી કષાયોના માર્ગ જે દોડ મૂકે છે, તે પાછળથી પસ્તાયા વગર રહે નહિ. ‘મારી પાસે મૂડી છે ! પૈસા છે ! બસ’,... એમ કરી તેના વિશ્વાસમાં ને વિશ્વાસમાં ચહે આગળ, તો એક દિ’ રોવાનો ! માટે ડાખા થઈ જાઓ, વિશ્વાસમાં દોજા ન જાઓ. બલા-બલનો વિચાર કરી લેવો જોઈએ.” આટલું કહીને વાલી ઉભા ન રહી ગયા. પરંતુ માપી લીધું કે “આ રાવણને જે જગત વિશ્વાસમાં લઈ જઈ નાલેશી અપાવનારું થયું, તો જેવું એનું જગત, તેવું મારું જગત ! મને ય એક દિ’ દગ્યો દઈ ઢે !” તો ત્યાં જ જગતને વોસિરાયું; અને રાવણને કહ્યું, “જાઓ, તમારે આ રાજ્ય પર આજ્ઞા ચલાવવી છે ને ? તો તેમ થશે.” નાના ભાઈ સુગ્રીવને મુગટ પહેરાવી કહી દીધું કે “તું રાવણની આજ્ઞામાં રહેજે, તારું એ પુષ્ય નથી કે તું સ્વતંત્ર રહી શકે ! માટે આજ્ઞામાં રહેવાનું.” એ પછી મહાત્મા વાલીએ ચારિત્ર લીધું. ચારિત્રની વાત તો પછી, પણ વાલીની ઉદારતા કેવી ? આત્માની કેટલી ઉન્નતિ સાધી હશે કે આ કક્ષાએ પહોંચી ગયા છે ! પોતાની જીત થયા પછી, સામાનું બથાવી પાડવાની ઈચ્છા થાય ? કે પોતાનું હોય તે પણ આપી દેવાની ઈચ્છા થાય ? તમારે હાઈકોર્ટ બાર વર્ષ કેસ ચાલે, ને જજમેન્ટ એવું તમારી ફેવરમાં આવે કે તેમાં સામાના છાપરાના નાણિયાં પણ ઉખડી જતાં હોય, ત્યાં તમને શું થાય ? એમજ ને કે “મારે એના નાણિયાં

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૮૩

ઉપાડવાં નથી...એના કોડ આપણે પૂરા કરો; આપો એને આપણી મિલકતમાંથી” અથવા “બાર વર્ષ ભારે કષાયના પાપ મેં બાંધ્યા, તો એને ધોવાં સામાને માફ કરું; અને ઉપરથી એને હવે કહું, તારો બધો ખર્ચ હું આપું છું.” કહોને કે આ વાત તો અમારા મનમાં પણ બેસતી નથી; તો આચરવાની તો વાત જ ક્યાં ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩,અંક-૪૦,તા.૧૮-૬-૧૯૫૫

સમ્યક્તવનો પ્રકાશ :- તો સમજ લ્યો કે સમ્યક્તવનો પ્રકાશ જ આ છે કે ભલે આદરી ન શકાયું, પણ આદર્શો હેયામાં ઉંચા રમ્યા કરતા હોય, હેયાનાં વલાણ ક્ષમા, મિત્રતા અને ભલાઈ વગેરેનાં હોય. રસ્તામાં ચાલતાં કોઈની સાથે અથડાઈ પડે તેથી કે બીજા કોઈ કારણે સહન ન થવાથી કદાચ બે અક્ષર સામાને સંભળાવી દીધા, પણ હેયામાં તો એમ થાય કે “આ અવસરે ખરી રીતે મારે એને આશ્વાસન આપવું જોઈતું હતું, તે ભાઈ ! કંઈ મનમાં ન લાવતા.” હેયામાં ભાવના ઉચ્ચ રમતી હોય. સારા કોઈ ધર્મક્રિયને પોખવાની સ્થિતિ જોઈ તે વખતે એવા પોતાના સંયોગ ન વર્તવા હોય કે પાસેના પચાસ રૂપિયા આપી શકે; તેથી કદાચ દસ જ આપે છે; તો પણ અંદરમાં જ્યાલ હોય કે “મારે એવો દિવસ ક્યારે આવે કે હું એકલો આ બધું ધર્મકાર્ય કરી દઉ !” અંદરમાંથી આ ઉછરંગ ઉઠે ! સમકિત ખરું કે નહિ આપણામાં ? એનું પ્રમાણ-પત્રક જ્ઞાની આપે તેના કરતાં જાતે જ કાઢી લ્યો ! શું ભગવાનના ઘરનું સમકિત એવું પાંગળું છે કે કેટલાયે વર્ષો સુધી તે હોવા છતાં આત્માના અંદરના દેદાર ન ફરે ? અશુભ ભાવનાઓને ફક્ટો ન લાગે ? શુભ ભાવનાના કોડ ન જાગે ? કદાચ ક્રત-પચ્યક્ખાણ નહિ, પણ થોડી આત્મગુણની પ્રવૃત્તિય ન થાય ? વર્ષોના સમકિત પછી પણ આત્માના દેદાર તેના તેજ દેખાતા હોય તો, પચીસ-પચાસ વર્ષ પહેલાં જેવા ગુસ્સા, રોઝ, લાલચ વગેરે ટેસથી થતાં હતા; તેવા જ આજે થતાં હોય, પાછળ ભય પશ્ચાતાપેય ન હોય તો શો દેદાર ફર્યો ? સાચું સમકિત પ્રકાશના જબૂકા તો જરૂર લાવે. ખાતી વખતે જો એક વિગઈનો પણ ત્યાગ ન કરી શકતો હોય, તોય હૈયામાં એમ જરૂર થાય, કે દિવસ એવો ધન્ય ક્યારે આવે કે આ પાપી વિગઈઓનું નામ પણ ન લેવું પડે ! સમકિત વૃત્તિના ઘરનું છે, ચારિત્ર પ્રવૃત્તિના ઘરનું છે. સમકિતીની વૃત્તિ ચોક્ખી, પણ પ્રવૃત્તિ મેલી. ચારિત્રીને વૃત્તિની સાથે પ્રવૃત્તિ પણ ચોક્ખી ! સમકિતની વૃત્તિથી અંદરમાં ઉમળકા ઉઠે. દાન ભલે બે પૈસાનું દે પણ ઉમળકા બારસોનું દાન આપવાના થઈ જાય ! સમકિતી એટલે જિનના અને જિનધર્મના ઘરનો બની ગયો;

૮૪

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સમ્યક્તવનો પ્રકાશ” (ભાગ-૨૨)

જગતનો કે દુનિયાનો નહિ. જગત એટલે કુંબ પરિવાર; દુનિયા એટલે વિષયો લક્ષ્મી વગેરે. જગતના અને દુનિયાના માણસોને પણ ઉમળકા ઉઠે કે નહિ ? ભલે બે હજારમાં લગ્ન પતાવતો હોય, પણ હૈયામાં થાય ને કે ‘શું કરું ? પહોંચતું નથી, નહિતર પચીસ હજારનો માંડવો ઘાલું !...’ દુનિયાનો છે તો તેના ઉમળકા જરૂર ઉઠે છે, તો જે જિનનો અને ધર્મનો છે તેને તેના ઉમળકા કેમ ન ઉઠે ? તે નથી ઉઠતા, તો પોતાના જીવને કહેવું જોઈએ કે ‘હજુ જગતનો તું મટ્યો નથી; અને જિનનો બન્યો નથી, તો પછી સમકિતના રંગની હજી વાર છે.’

વાદીદેવસૂરિજી મહારાજ : - રાજમંત્રીએ પોતાને રહેવા માટે એક બંગલો બંધાવ્યો; જે વખતે આચાર્ય ભગવાન શ્રી વાદીદેવસૂરિ મહારાજ વિચરતા હતા. જબરદસ્ત વિદ્ધાન અને વાદિ ! પાટાણમાં દિગંબરોની સામે વાદમાં એ ઊભા રહ્યા હતા. દિગંબરમાં વાદી કુમુદચન્દ્ર સામે હતો. તેણે જઈને સિદ્ધરાજની સભામાં ટેલ નાખી હતી કે “છે કોઈ શૈતાભરોમાં કે જે એમનું સાચું સાબિત કરે ? એ સાબિત કરે તો અમે તેમના; નહિતર તે અમારા; અથવા એ ગુજરાત છોડી જાય.” ત્યાં વાદીદેવસૂરિજી મહારાજ આગળ આવ્યા. વાદ મંડાયો. વાદમાં આપણે જત્તા. કુમુદચન્દ્ર તો ભાગી જ ગયો ! વાદી દેવસૂરીશ્વરજી મહારાજે મોટો સ્યાદ્વાદ રત્નાકર નામનો વાદોથી ભરેલો મહાગ્રંથ રચ્યો. આજે તો એ ઓછો મળે છે, પણ કહે છે ૮૪૦૦૦ શ્લોક પ્રમાણ લખ્યો; જેમાં સ્ત્રીને મુક્તિ હોય તેના પર જ બે હજાર શ્લોક પ્રમાણ લખ્યું. જો સ્ત્રીને મુક્તિ નહિ તો મરુદેવીમાતા, ચંદનબાળા વગેરે ક્યાં ગયાં ? સ્ત્રીને જો ચારિત્ર નહિ તો ચર્ચિત્વ સંધ્યા ક્યાં રહ્યો ? સ્ત્રીને ચારિત્ર અને મુક્તિ હોઈ શકે, તેના પર જબરદસ્ત દલીલો કરી કુમુદચન્દ્રને એવો નિરુત્તર કરી દીધો કે ત્યાંથી એ રાતોરાત પલાયન થઈ ગયો ! એ ખરી યુક્તિનો જમાનો હતો. સ્ત્રીને કેમ ચારિત્ર નથી ? હલકું સંધ્યાણ છે માટે ? સ્ત્રીવેદ છે માટે ? કપડાં છે માટે ? તો શું કપડાં કેવળજ્ઞાનને રોકે છે ? તો કાયા કેમ નથી રોકતી ? પરંતુ આવા વાદ કે શાસ્ત્રાર્થ આજે નથી. આજે તો છે પથરા ફેંકવાનું !

કહેશે “આત્મા નથી !”

“કેમ નથી ભાઈ ?”

“દેખાતો નથી.”

“તો તો તારા દાદા પણ દેખાતા નથી, એટલે એય નહોતા. તો પછી શું તું આકાશમાંથી ઊતરી આવ્યો ?”

મંત્રી ગુરુનો બોલ જીલી બંગલાને... -આપણી વાત હતી સમકિતીના દેદારની.

એના પર રાજમંત્રીનો પ્રસંગ છે, વાદી દેવસૂરિજી મહારાજ પોતાના શિષ્યો સાથે રસ્તા પર થઈને જતા હતા. ત્યાં મંત્રી સાથે હતો. વચ્ચે પોતાનો બંગલો આવ્યો. સૂરિમહારાજને તે બતાવતાં કહે છે, “આ હમણાં જ બંધાવ્યો...!” સામા ખૂશી થાઓ કે નહિ, પણ પોતે તો બતાવી ને ખુશી થઈ રહ્યો છે ! આચાર્ય મહારાજ તો કંઈ ન બોલ્યા, પણ સાથેનો એક શિષ્ય, એનાથી ન રહેવાયું ! તે કહે છે “કેમ મહેતા ! તમારે અમારી પ્રશંસા જોઈએ છે ને ? પણ ખબર નથી કે જૈન સાધુની પ્રશંસા બંગલા પર ન મળે ?” મંત્રી સમજ ગયો “એક તો પાપકાર્યનો બંગલો; અને ઉપરથી એમાં સાધુની સંમતિ લેવાની ?” યોગ્ય વિચારી, ત્યાં બીજી જ મિનિટે મંત્રી કહી દે છે, “જાઓ ભગવંત ! આ બંગલો આજથી ધર્મસ્થાન !” સમકિતનો પ્રકાશ કેવો ખીલ્યો છે ! હૃદયના ઊંડાણમાં એ જબૂકો હતો, કે આ બંગલો નહિ પણ ડેંબાનું છે, અને એ પણ એક જીવન માટેનું જેલખાનું નહિ, પણ ભવિષ્યની અનેક ભયંકર જેલો નક્કી કરાવનારું વિચિત્ર ડેંબાનું છે ! તમારે જગતમાં છે ને આવી જેલ ? ના ? અરે ! તમારી સારી-નાની રૂમ પણ જેલ છે ! અહીં તો હૃદયમાં સમકિતનો જબૂકો છે; તો મુનિનો એક ટોણાં પર સમજી ગયા અને કાચી સેકંડમાં ધર્મ ખાતે એ કરી દેતાં વાર લગાડી નહિ. પડિકાનું આ સમકિત નહિ, પણ હૃદયના પ્રકાશનું આ સમકિત છે. સમકિત એટલે આ જરૂરી છે, કે આજ મારા દેવ-ગુરુ અને ધર્મ. ભગવાને કહ્યાં તેજ તત્ત્વો સાચાં. સંસાર-લક્ષ્મી-વિષયો ભયંકર ! સાથે એ જોવું પડશે કે જે તત્ત્વ જેવા રૂપે કહ્યું તેવી પરિણાતિ અંદરમાં ઊભી થાય છે કે નહિ ? પાપ અને આશ્રવ હેય કચ્ચા તો હૃદયમાં પરિણાતિ તે મુજબ તેના પત્યે ભય-તિરસ્કારની થવી જોઈએ. મોક્ષ એજ સાર ! સંસાર એ અસાર જ એવું લાગ્યું તો મોક્ષ માટે ગલગલિયાં થાય; ને સંસારમાં રહ્યે પાંજરે પુરાયેલા પંખીની જેમ તરફદિયા મરાય.

આપણો મૂળ પ્રસંગ સમરાદિત્યના બીજા ભવમાં અમરગુપ્ત અવધિજ્ઞાની મહર્ષિના ચન્દ્રસારના ભવનો છે. એમાં સંયોગો શું કામ કરે છે ! ચન્દ્રસારની પત્નીને બહારવટિયા ઉપાડી ગયા, તો ચન્દ્રસાર અને નોકર ધનની પોટલી લઈને નીકળ્યા લેવા; સાથે ભાતાની પોટલી પણ લીધી એમાં જ્યાં વચ્ચે બેઠા, ત્યાંથી ઊઠતાં ધનની પોટલી નોકરે લીધી છે અને ભાતાની પોટલી ચન્દ્રસારે લીધી છે ! નોકર હતો પૂર્વનો વૈરી. એના દિલમાં એ હતું જ કે “ક્યારે આ શેઠને ફસાવું ?” ત્યાં આ ધનની પોટલી હાથમાં આવતાં ખીલ્યો ! તરંગ ઘડ્યો કે “મોક્ષ આવે કે ધન લઈને પલાયન થઈ જાઉં અને શેઠને બતાવી દઉં...” શું આ ? ધનના સંયોગની અસર, એમાં ક્યાં સુધી પહોંચ્યો ? - ‘ધનની પોટલી શેઠ માગે તે પહેલાં

જ શેઠને ઠેકાણે પાડી દઉં.’ એ વિચારમાં ચઢ્યો. ‘અરે પણ તારે ધન જોઈએ તો માગી લે ને ? શેઠને નુકસાન કરવાની શી જરૂર છે ? પાછું એ મર્યાદા પછી એની પત્તીનું બિચારીનું શું ?’ વગેરે કાંઈ વિચારવાનું ખરું ? ‘ના, એ તો જે થવું હોય તે થાઓ. આપણે તો ધન સફાઈથી મેળવવું જોઈએ, જેથી ઠેઠની નિરાંત. ને એમાં કાંઈ માગીને આટલું બધું ધન મળે ? મંગાયેય ખરું ?’ આવી બધી ગણતરીએ અનઘકને તક શોધવામાં ચઢાયો. માણસ પોતાના જ આત્માનો ભવિષ્યકાળ ભૂલ ત્યાં રાક્ષસી હદ્યની નવાઈ નહિ.

કુવો : અનઘકની પાપી યોજના :-

ત્યાં દૂરથી એક કુવો દેખ્યો, એટલામાં સૂર્ય આથમી ગયો; ને સંધ્યા પ્રસરી ગઈ. બરાબર કુવો જોતાં, ખીલી ઉઠ્યો. અવસર ઠીક મળી ગયો લાગ્યો; વિચારે છે કે “અવેરાત વગેરેની નાણાં કોથળી તો મારા હાથમાં જ છે; અને આ જંગલ નિર્જન છે. કોઈ આવતું કે જતું દેખતું નથી. પાતાલ જેવો ઊંડો કુવો નજીકમાં જ છે. તેમ અંધકાર પણ એવું પ્રસર્યું છે કે જે અપરાધરૂપી છિદ્રને ઢાંકી દે, લોકદાસ્તિએ ચઢવા ન હે. તો હવે શો વિલંબ ? શેઠને આમાં ઠેકાણે પાડી આ સ્થાનથી હું પાછો ફરી જાઉં.”

આત્મશક્તિનું ગૌરવ વિચારો :- જોયું ? કેટલી કૂર વિચારસરણી ? શાની પાછળ ? પૈસાના લોભની પાછળ ને ? શાસ્ત્રકારો જે માનવ ભવને મહાદુર્લભ કહે છે, એ પામ્યા પછી પણ એને એળે ગુમાવરાવનારા લક્ષ્મીના લોભને કેવો કહેવો ? કૂર, પિશાચ, યા ખૂનસવાળો દુષ્પ દુષ્મન કહેવો કે બીજું કાંઈ ? સમજવાની ખાસ જરૂર છે કે માનવદેહ એ નિર્મળ જ્ઞાનાદિસ્વભાવવાળા આત્માનું પવિત્ર મંદિર છે. એમાં જેટલી વૃત્તિ-પ્રવૃત્તિની ચોકખાઈ અને શોભા કરવા ધારીએ એ કરવી શક્ય છે. એ માટે વિશેષ કરીને મનને સમાલવાની જરૂર છે, એ સારું લક્ષ્મી વગેરેની લાલચ ઓછી કર્યે જ છૂટકો છે. ત્યારે પૂછો છો કે એ કરવું કાંઈ સહેલું છે ? પણ સમજો કે જો આપણાને આપણા આત્માની અચિંત્ય શક્તિનું ગૌરવ હુદ્યમાં વસી જાય તો એમ થાય કે “શું હું આવો શક્તિમાન તે જરૂરદર્થોના પ્રલોભનમાં એવો ફસી જાઉં કે જેથી ગુલામની જેમ મારે કૂડા કામમાં ઘસડાવું ? નહિ, નહિ, હું સમર્થ હું. જરાય ન લોભાઉં, જરૂરી ગુલામી જરાય ન વહોરું.”

ધનકમાઈ કે ધર્મકમાઈ ? :- અનઘકને તો આ વિચાર જ નથી, બસ એક વાત છે પૈસા મળે એટલે પત્યું. પછી ‘ભલે એ પૈસા કદાચ ધર સુધી પણ પહોંચશે કે કેમ ?’ એજ પૈસાને લીધે રસ્તામાં કોઈ લૂંટારા બદમાશનો માર ખાવો પડશે તો ?’-એની કોઈ જ વિચારણા કરવાની નહિ ! જીવન તો એજ મનુષ્ય તરીકેનું.

પણ એમાં જગત જ્યારે ધનકમાઈ માટે ધર્મનાશ, ગુણનાશ અને પુષ્યનાશના પંથે ચઢ્યું છે; ત્યારે વિરલ આત્માઓ કદાચ ધન જાય તો જવા દઈને પણ ધર્મકમાઈ, ગુણકમાઈ અને પુષ્યકમાઈ કરી લે છે. અનઘક ચઢવો છે ધનના તાનમાં.

શેઠને ઠગવા કહે છે “સાર્થવાહપુત્ર ! હું ખૂબ જ તૃપ્તાતુર થઈ ગયો હું. આ કુવામાં પાણી હશે ?”

શેઠને શી ખબર કે આને શાની તૃપ્તા લાગી છે ! એ તો પાણીની તૃપ્તા સમજ કહે છે કે “ઊભો રહે જોઉ માંદી પાણી છે કે કેમ ?” પેલાને ધન એ ચીજ છે, આને ઓચિત્યધર્મ ! દુર્જન સજજનના આવા ફરક પડવાના.

ચન્દ્રસાર કુવો જોવા :- ચન્દ્રસાર પાણી જોવા કુવાના કાંઠે ગયો, ને માંદી જરા નીચો વળ્યો પાણી જોવા. એને બિચારાને શી ખબર કે અનઘકનો આમાં શો ભેદ છે ! શું આપણા જીવનમાંય આવું નથી બનતું કે બીજાના વિશ્વાસે આંખ મીંચીને કોઈ પ્રવૃત્તિમાં આપણે જુકાવતા હોઈએ ? પછી એમાં દગ્ગો થાય તો ? તો વળી શું ? વેઠવાનો. પણ કેવી રીતે ? રોઈને નહિ, સામાને ગાળો દઈને નહિ, કિન્તુ એમ સમજીને કે સામાની પાસે દગ્ગો કરાવવાનું કામ આપણાં જ પાપકર્મ કરે છે. પણ પાપકર્મ છૂપાં તો ખબર જ ન પડવા હે કે અમે ક્યારે જાગીએ છીએ. ઠેઠ કુવામાં વાંકો વળી જુઓ છે ત્યાં સુધી ખબર નથી કે ઉદર પાછળ બિલાડી તાકી રહી છે. એટલે જ,

• ગુણ સાધવાની ચાવી •

અહીં, શાનીઓ કહે છે કે, ‘ચેતવા જેવું છે. કોથળામાંથી બિલાડું ક્યારે કેવું બહાર પડશે અર્થાત્ આત્માની કર્મસિલકમાંથી ભારે પાપકર્મના કેવા ઉદ્ય ક્યે કસમયે પ્રગટ થશે એનો પતો નહિ ! પછી એવા કપરા અવસરે ઊંચી તો શું પણ સામાન્ય શુણ સાધના અને સામાન્ય ધર્મસાધનાય કરવી મોંઘી થઈ જશે. માટે જ્યાં સુધી હજુ સમયની સારાસારી છે ત્યાં સુધી સામાન્ય તો શું પણ ઊંચી ધર્મસાધના કરી લેવી. અત્યારના સંયોગમાં કદાચ જૂઠ ન બોલો કે અનીતિ ન કરો, તો કાંઈ બહુ ન સહવું પડે. પણ નથી ને જો અન્ અને દાંતને વેરનો પ્રસંગ આવી ઊભો તો ટૂકડો રોટલો મેળવવા કેટલાં જૂઠ અને કૂડકપટ કરવાનું મન થશે ! વિચારણા મહાન જૂઠ કપટની ચાલશે ! એનો હિસાબ નહિ. જુઓ બિખારીઓની દશા. ત્રણ-ત્રણ દહાડાના રોટલાના જ વાખા પડ્યા હશે ત્યાં એવા દુઃખમાં એ ભાવના કયાં રહેવાની કે હજુ ભૂખે મરી જાઉં તે હા, પણ જૂઠ કપટ હરગીજ નહિ સેવું ?’ ત્યાં તો એ ઘણું મુશ્કેલ. તેથી કમમાં કમ એવો સંયોગ નથી ઊભો થશે !

ત्यां સુધી જો સત્ય અને સરલતા, તથા પ્રામાણિકતાની ટેવ પારી દઈએ; તો એથી કદાચ થોડું વેઠવું પડશે તો હરકત નહિ. આ વિચારણાથી માણસ ઘણા ઘણા દોષોને ટાળી આત્મગુણોને હોંશપૂર્વક કેળવવાનો રસિયો બની જાય. કોધને બદલે ક્ષમા, વૈરને બદલે વહાલ, અહંકારને બદલે લઘુતા, ઈર્ષાને બદલે પ્રમોદભાવ-બીજાનું સાંદું જોઈ રાજુ થનું, નિષ્ઠરતાને બદલે કોમળતા, કઠોરતાને બદલે દયા...ગણો-ગણો...આવા તો કેઈક ગુણો કેળવવાની જરૂર છે. સુદ્રતાને બદલે ઉદારતા, સંકુચિતતાને બદલે વિશાળતા, છીછરાપણાને બદલે મહાગંભીરતા, મિથ્યાત્વને બદલે સમ્યકત્વ-વગેરે અપરંપાર ગુણો કેળવવાના છે. તેને સારા સમયે તો જરૂર કેળવી લેવા જોઈએ. નહિતર ધોર પાપના ઉદ્યે આપત્તિની આગમાં જીકાયા પછી તો એ મુશ્કેલ બની જશો. ત્યારે સારા સમયમાં કેળવેલો ગુણો તો આપત્તિમાં સારા કામ લાગે છે.

ચન્દ્રસારે ગુણો કેળવ્યા છે એટલે હવે જોવા મળશે કે આપત્તિમાં એ કેવા ઝણકી ઊંઠે છે. કોણ છે ? ચન્દ્રસાર ? અવધિજ્ઞાની અમરગુપ્ત આર્ય ભગવાનનો જીવ.

વિશ્વાસની પૂંઠે જ મૃત્યુ :- અવધિજ્ઞાની મહર્ષિ પોતે જ પોતાનું ચરિત્ર કહી રહ્યા છે. એ કહે છે કે ‘હું’ (ચન્દ્રસાર) કૂવાના કાંઠે ગયો ત્યાં મને ખબર ન પડે એ રીતે ધીમે પગલે અનઘક મારી પાછળ પાછળ આવ્યો. તે એટલે સુધી કે જેમ વિશ્વાસમાં રહેલા જીવોની અત્યંત નિકટમાં મૃત્યુ અચાનક આવીને છૂંપું ઊભું રહે છે, તેમ અનઘક મારી પાછળ ઠેઠ નજીકમાં આવીને ઊભો. હું તો વિશ્વાસમાં રહ્યો. ભાતાની પોટલી હાથમાં ને હાથમાં જાલી રાખીને વાંકો વળી કૂવામાં પાણી જોઈ રહ્યો છું, ત્યાં હવે એ શું કામ વિલંબ કરે ?

અવધિજ્ઞાની ભગવંતે અહીં ઉપમા સુંદર બતાવી ! શી ? વિશ્વાસમાં રહેલા લોક અને સમીપ મૃત્યુની. લોક એટલે કે જીવો અતિ વિશ્વાસમાં એટલે કે ધીકમાં મૃત્યુ આવશે તો, એની લેશ ચિંતા-ફિકર રાખ્યા વિના, જીણે મૃત્યુ હમણાં કંઈ આવવા-કરવાનું નથી જ એવો પૂર્ણ વિશ્વાસમાં રહીને જીવનમાં કેઈ-કેઈ આશાઓ, તરંગો અને મનોરથો ઘડ્યે જ જાય છે ! યોજનાઓની હારમાળા રચ્યે જાય છે ! પણ ભાન નથી આવતું કે ‘આ મૃત્યુ ઠેઠ મારી પાછળ નજીકમાં આવીને ઊભું હશે તો, તે મને ગણચીમાંથી પકડી ઉઠાવશે,’ એથી એમ થતું નથી કે ‘મૃત્યુ સુધારી લઉં, પરભવ સુધારી લઉં, અને આવા ઉચ્ચ જીવન અને સંયોગો પાચ્યા થકી મારા આત્માને ખાસ સુધારી લઉં.’ માત્ર કિડા-કૂતરાના ભવમાં જે કરી જાણ્યું,

શું ? આહાર, વિષય, પરિગ્રહ, નિદ્રા-આરામીની વેઠ, એજ વેઠમાં રચ્યા-પચ્યા રહેવાનું સુંદર માનવદેહથી બને છે. એટલામાં તો નજીક આવેલો મોત રૂપી વાધ એ જીવરૂપી બકરાને ઉપાડીને આ ભવમાંથી દુર્ગતિમાં ધૂકેલાવા માટે ફેંકી હે છે. પછી જીવ સારું શું કરી શકવાનો ? ધર્મ ન કરવા સામે, સત્ય નીતિ ઉદારતાદિ ગુણો ન કેળવવા સામે, જેટલી અગવડાના બહાનાં કાઢ્યાં એના કરતાં અસંખ્યગુણી અગવડો ત્રાસ અને તકલીફ દુર્ગતિમાં ઊભા થાય છે. ડહાપણથી સમજી લેવાની જરૂર છે કે પરભવની ધોર અગવડો વેઠવાનું ઊભું કરવું, એના બદલે ધર્મસાધના અને ગુણસિદ્ધિ કરવા વર્તમાન થોડી અગવડ વેઠી લેવી, એ સસ્તું છે. એ માટે હુંમેશા એમ જ ખ્યાલ જોઈએ કે મૃત્યુ મારી પાછળ નિકટમાં જ ઊભું છે, માટે એક ક્ષાણ પણ ધર્મસાધના અને ગુણસિદ્ધિ વિના ન જવા દઉં. પણ આ કોણે સૂઝે ? સંસારકાળના ઠેઠ છેડે આવી ઊભેલાને; નિકટમાં મહાન ભાગ્યોદયવાળાને અ સૂઝે. બાકી તો જીવ વિશ્વાસમાં મૃત્યુથી આકમાય છે.

કૂવામાં ધૂકેલાયો :- એમજ ચન્દ્રસારને અનઘક ઠેઠ નજીકમાં આવ્યાની ખબર નથી. ત્યાં અનઘક ચન્દ્રસારને એકદમ જ પાછળથી જરા ઉપાડી કૂવામાં ધૂકેલી દીધો ! ચન્દ્રસારને તો આની કોઈ કલ્યના જ નહોતી. પછી કૂવાકાંઠે ઊભા રહેતાં શરીરે પણ સહેજે ફીરું રાખ્યું હોય ત્યાં અનઘકનો સહેજ પ્રયત્ન એને કૂવામાં પાડી દે એમાં નવાઈ નથી. ચન્દ્રસાર તો સીધો પડ્યો કૂવાના પાણીમાં. આવી સ્થિતિમાં મનમાં શું થાય ? નોકરે કૂવામાં નાખ્યો એ તો બરાબર સમજાયું. અને પોતાના હાથમાં ભાતાની પોટલી જુએ છે, એટલે પેલાના હાથમાં જવેરાતની પોટલી રહ્યાનો ખ્યાલ આવે છે. તેથી સહેજે સમજાય કે એના લોભમાં નોકરે આ સાહસ કર્યું. ગમે તેમ પણ પડ્યો એ ચોક્સ.

અક્સમાત બનતું નથી : પુષ્યપાપની અચિંત્ય ઘટનામાં પૂર્વકલ્યના ખોટી :- પહેલાં કહું છે, કુવો ખાસો ઊંડો છે. ચન્દ્રસાર એ કૂવામાં ધૂકેલાયો છે. હવે અહીં એની બચવાની કોઈ આશા ? ત્યારે લુંટારા જેને ઉપાડી ગયા છે એ ચન્દ્રકાન્તાને હવે બચવાનાર કોણ ? એની બચવાની ય કોઈ આશા ખરી ? પુષ્યપાપનાં લેખાં ન માનનારા આવા પ્રસંગે રીતસર ઉત્તર નહિ આપી શકે. એ તો બહુ તો કહેશે કે આમાં કદાચ બચી જાય તો એ ચાન્સ કહેવાય, અક્સમાત ઘટના ગણાય. ખરી રીતે ‘અક્સમાત’ એટલે ‘ક્સમાત નહિ,’ એટલે કે ‘કોઈ કારણથી નહિ.’ પણ એમને એમ કારણ વિના ! પરંતુ આ ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બનતું જ નથી, તો પછી અ-ક્સમાત કયાંથી બનનું ? ત્યારે એમને પૂછો ચાન્સ શું ચીજ છે ? તો કહેશે કે ‘જેમાં કોઈ હેતુ-સમાધાન ન મળે અને એકાએક અચિંત્ય ઘટના બને એ

ચાન્સ.' પરંતુ ખરી રીતે આવું કાંઈ બનતું જ નથી. જ્ઞાનીના ઘરમાં કાર્ય બનવા પાછળ સમાધાન જરૂર છે. અજ્ઞાનીને એની ખબર ન હોય તેથી કાંઈ સમાધાન છે જ નહિ, હેતુ છે જ નહિ,-એવું નથી. સમાધાન પુણ્ય-પાપનું છે. પુણ્ય અને પાપ એવી અદ્દશ્ય શક્તિઓ છે કે જે માણસની ધારણા વિના બારોબાર કાર્ય થવાને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો નીપણી હે છે. જગતમાં સારું-નરસું મળવાનો આધાર પુણ્ય-પાપ ઉપર છે. પુણ્ય જો આપણું પહોંચતું નથી તો લાભ પ્રયત્નયે સારું મનગમતું મળી શકે એમ નથી. પુણ્ય જો બળવાન છે, તો છેવટે પાતાળમાંથી સારું આવી મળવાનું છે. એમજ, પાપ જો ભમી રહ્યું છે તો લાભ ચોકસાઈ રાખવા છતાં આપતી નિર્વિવાદ આવે છે. આ પણ પાપ જો ઉદ્યમમાં નથી, તો દુષ્મનના પ્રયત્ન ભારી છતાં આપણો વાળ પણ વાંકો નથી કરી શકતો. અધારિત દેખાતી ઘટનાઓના સર્જનહાર પુણ્ય-પાપ છે. અહીં જો જો કે ચન્દ્રસારનું આ કૂવામાં ફેંકાવું કેવું પુણ્યોદય રૂપ બને છે. માટે તો કોઈ બનાવ ઉપર તત્કાલ ઉપલક્ષ્યનું ધોરણ બાંધવું એ અજ્ઞાનતાભર્યું છે. બનતા બનાવમાં કેટલીય વાર જાણે કર્મના ગૂઢ સંકેત હોય છે. જાણે પુણ્ય કહે છે 'ચન્દ્રસાર' તું અહીં પડે એજ ઠીક છે. મહાલાભ થશે તને.' પણ આ સમજ્યા વિના પહેલાં ખોટી કલ્યાના કરવી અને પછીથી લાભ દેખાતા કહેવું કે 'હા, હા, ભૂલ્યા ભૂલ્યા એમ, તે ચન્દ્રસારના બિચારાના પાપોદયની કલ્યાના કરી. આ તો જે થયું તે સારું થયું.' એ કેવીક ઉત્તાવળ ! શીખી લ્યો આ કે કર્મના ઉદ્યથી બનતા બનાવને 'કોઈ સારા માટે એ છે' એમ મનમાં ગોઠવો. એથી મહાકર્મબંધી બચી જવાશે. હદ્ય ખૂબ સ્વસ્થ રહેશે. બીજાની સાથે મનોભેદ, કલેશ વગેરે નહિ થાય.

"દિવ્ય-દર્શન"-“ગ્રવચન મહોદધિ”

વર્ષ-૩, અંક-૪૧, તા. ૨૫-૬-૧૯૫૫

કૂવામાં ચન્દ્રકાન્તા ! :- કૂવામાં ચન્દ્રસાર પડ્યો ખરો, પણ ત્યાં નીચે બાજુમાં એક ખચક જેવું હતું. એના પર એ ચઢી ગયો. અંધારું છે તેથી કાંઈ દેખાતું નથી. તેથી ભીતે હાથ ફેરવે છે. ત્યાં તો કોઈ થરથર ધ્રુજતી બાઈને હાથ અડ્યા, એટલામાં તો એ બાઈએ જ ઝર્ય કરતાંક મોટેથી 'નમો અરિહંતાણ' પદનું ઉચ્ચારણ કર્યુ !! ચન્દ્રસાર તો સાંભળી આભોજ બની ગયો ! કેમ ? 'નમો અરિહંતાણ' સાંભળવા મળ્યું માટે નહિ; પરંતુ આ અવાજ પોતાની પત્ની ચન્દ્રકાન્તાનો લાગ્યો તેથી. લાગ્યો શું ? સ્પષ્ટ ઓળખાઈ ગયો ! એમ થયું કે "અહો ! આ શું અહીં ? આ તો ચન્દ્રકાન્તા જ છે. અહીં ક્યાંથી ? પરંતુ એનો વિચાર પછી ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“ગ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૮૧

કરવાનો છે. પહેલાં તો એ ભયમાં 'નમો અરિહંતાણ' બોલી ગઈ, એને નિર્ભય કરનારો ઉત્તર દેવા હે."

કૂવામાં પતન એ પુણ્યોદય :- શું બન્યું અહીં ? કૂવામાં પડ્યો એ પાપોદય કે પુણ્યોદય ? કૂવામાં પડ્યો તો ચન્દ્રકાન્તા મળી એ પુણ્યોદય ખરો ને ? પહેલેથી ઉતાવળે ધોરણ બાંધી મૂકો એ ક્યાં કામ લાગે ? આવડત હોય તો કેઈ પાપોદયના પ્રસંગને પુણ્યોદય રૂપ ગણી શકો. ચન્દ્રકાન્તા પણ કેવી ? ભય જેવું લાગ્યું ત્યાં ઝટ 'નમો અરિહંતાણ' !'

‘શું નમો અરિહંતાણ ?’ :- એવું તે કેવુંક રટ્યું હશે કે 'ઓ બા !' 'ઓ બાપા' એવું કાંઈક નહિ અને નમો અરિહંતાણ ? આપતીમાં હાઈક સાચા જૈનપણાનું આ પ્રમાણપત્રક છે કે 'નમો અરિહંતાણ' સહજભાવે અને સપાટાબંધ યાદ આવે. કેમ, આવે છે ને યાદ ? ન આવતું હોય તો એની ખૂબ રટણા કરો. આખો દિવસ મનમાં એની ને એની રટણા, એ પદનો કે અરિહંતનો જાપ ચાલવા દો. ચન્દ્રકાન્તાએ એવું કાંઈક રટ્યું હશે તો જ અત્યારે 'ઓ બા !' મૂકીને ઝટ એ યાદ આવે ને ? આચાર્ય મહારાજ પાસેથી ધર્મ પામેલા છે તેનું આ ફળ છે કે જરા ભય જેવું લાગ્યું તો ત્યાં ઝટ અરિહંત ભગવાનને યાદ કર્યા. ત્યારે, આપણે ગાઈએ છીએ તો ખરા કે 'સૂતાં બેસતાં ઊઠતાં જે સમરે અરિહંત...' પણ અમલમાં કેટલું ? સૂતાં ને બેસતાં, ચાલતાં કે ઊભા રહેતાં, ખાતાં પહેલાં કે પીતાં, પહેલાં શું ? તો કે 'નમો અરિહંતાણ' ! આખો નવકાર તો નહિ પણ માત્ર પહેલું પદ, એને સમરતાં કેટલો સમય લાગે ? કંઈ જ નહિ. છતાં કેમ નથી સમરતા ? કહો છો યાદ નથી આવતું. પણ યાદ તે શી રીતે આવે ? યાદ આવે એવું કરવાની મહેનત ક્યાં છે ? પહેલાં જો એનો મહામહિમા સમજાય અને મનમાં એ નક્કી કરાય કે બધા વિના ચાલે, પણ મારે નવકાર વિના ન ચાલે, તેમજ એ પછી વારે ને વારે યાદ લાવી લાવીને એની રટણા લગાવી દેવાય, તો પછી ખરે પ્રસંગે એ પહેલું યાદ આવે. 'નમો અરિહંતાણ' પદનો શો મહામહિમા છે ? એજ કે (૧) ચૌદ્ધપૂર્વી જેવા મહાજ્ઞાનીઓને પણ અંત કાળે આની રટણા હોય છે; (૨) સર્પ જેવાને ધરણેન્દ્રપદ આપ્યા છે; (૩) સર્વ શ્રેષ્ઠ ઉપકાર કરનાર શ્રી અરિહંતને આમાં નમસ્કાર છે. (૪) એથી સર્વ પાપનો નાશ થાય છે; માટે જ સર્વમંગલમાં પહેલું મંગલ છે. એ આવી અનેક વિશેષતાઓથી એનો મહામહિમા છે. તો એ પદ તો શાસોશ્વાસે વણાઈ જવું જોઈએ.

નમો અરિહંતાણનો અર્થ :- શું નમો અરિહંતાણ એટલે ? અર્થ આવડે છે ? 'અરિહંત ભગવાનને નમસ્કાર હો' એમ નહિ. કેમકે 'નમસ્કાર હો,' એમ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“ગુણ સાધવાની ચાવી” (ભાગ-૨૨)

૮૨

કહેવામાં તો પ્રાર્થના કરી, માગણી કરી, કે હમણાં હું નમસ્કાર કરતો નથી, પણ ભવિષ્યમાં કરી શકું એવું માગું છું. જેમ કે, ‘નમુન્યુણ અરિહંતાણ ભગવંતાણ’ નો અર્થ લખતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજ મહારાજે લખિત વિસ્તારમાં પ્રશ્ન કર્યો કે,

૭.- આનો ઉત્તર આપતાં કહ્યું કે અહીં સામર્થ્યયોગનો નમસ્કાર કરવો છે, જે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગના નમસ્કાર કરતાં ય ઊંચો અને માત્ર સાત ગુણઠાળાની ઉપર અપૂર્વકરણ વખતે પ્રાપ્ત થાય છે. એ નમસ્કાર કરવાનું હાલ ગજું નથી. અત્યારે એવો દાવો કરી શકાય એમ નથી કે હું સામર્થ્યયોગનો નમસ્કાર કરું છું. તો તો મૃષાવાદ થાય. પરંતુ ઉત્કઠ ઘણી છે કે અરિહંત ભગવંતને આવો નમસ્કાર કરી શકું. માટે એની હું પ્રાર્થના કરું છું.

જે આ પ્રશ્ન-ઉત્તર લખ્યો તેમાં એ અર્થાત્ સૂચયું કે ‘નમોડસ્તુ’ ને બદલે એકલું ‘નમો’ કહેવામાં સીધો નમસ્કાર કરવાનો અર્થ થાય છે, તેથી નમો અરિહંતાણં એટલે હું અરિહંત ભગવાનને નમું હું એવો અર્થ કરવો જોઈએ. પણ નહિ કે ‘નમસ્કાર હો,’ એવો. અહીં એક પ્રશ્ન થઈ શકે

પ્ર.- ‘અસ્તુ’ પદ અધ્યાહરથી શું ન લઈ શકાય ? જો લઈ શકાય, તો તો પછી નમોજ્જ્ઞ એટાં નમસ્કાર હો એવો અર્થ કેમ ન કરાય ?

૩.- ઉત્તર એ છે કે અધ્યાહાર લઈ તો શકાય, પણ અહીં લેવાનો નથી. કેમકે આગળ ઉપર ‘એસો પંચ નમુક્કારો’ એવું સીધું નમસ્કારનું પદ આવે છે, પરંતુ ‘એસા પંચનમુક્કાર પત્થથા’ અર્થાત્ ‘આ પંચ પરમેષ્ઠિને નમસ્કારની પ્રાર્થના’ એવું પદ નથી આવતું. એથી સમજાય છે કે નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં વગેરેમાં હું નસું છું; સીધી નમસ્કાર કિયા છે. અહીં એટલો પ્રશ્ન ઉઠે કે

પ્ર.- તો પછી ‘નમુખુણ’ માં જે ‘અસ્તુ’ ન કહેતાં સીધો નમસ્કાર કરું છું. એમ કહેવામાં મૃષાવાદનો ભય બતાવ્યો, તો તે શું અહીં નહિ લાગે ?

૩.- ના, નહિ લાગે. અહીં જો સામર્થ્ય યોગનો ઉત્ત્ય નમસ્કાર કરવાનો દાવો રાખીએ તો મૃષાવાદ લાગે, પરંતુ ઈચ્છાયોગનો નમસ્કાર કરતાં એમ કહીએ કે હું નમું છું; તો મૃષાવાદ નથી. કેમકે અહીં નમું છું એટલે ઈચ્છા યોગથી નમું છું; ઈચ્છાયોગનો નમસ્કાર કરું છું. અસ્તુ.

ચન્દ્રસારનો પ્રત્યુત્તર :- હવે પ્રસ્તુતમાં આવો. ચન્દ્રકાળાએ ભય જેવું લાગતાં જટ નમો અરિહંતાણ એવું ઉચ્ચારણ કર્યું. એ સાંભળતાં જ ચન્દ્રસારે પત્નીનો શબ્દ ઓળખ્યો. જેના માટે એ બહુ ધન લઈ લુંટારાને આપી દેવા અને એને પાછી લઈ આવવા નીકળ્યો છે એ અહીંજ મળી ગઈ તેથી એને સંભમનો પાર નથી. હૈયું ભૂવનભાનુ એન્સાઈક્લોપીડિયા- “પ્રવચન મહોદષિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨) ૮૩

ઉદ્ઘાનવા લાગ્યું. અંગેઅંગ જાણે ઉચ્છવાસ લેવા માંચ્યા. પણ પહેલું તો સમજે છે કે સ્ત્રી જાતિ છે એટલે બીએ. પાછી અંધારામાં દેખી શકે નહિ. તેથી ઓળખાણ પડે નહિ. માટે પહેલાં તો એને આશ્વાસન અને ઓળખ આપી એનો લય દૂર કરવો જોઈએ. એ માટે તરત જ પોતે સામેથી કહ્યું કે ‘અભયં અભયં જિણશાસનશારયાણં’ અર્થાત્ શ્રી જિણશાસનમાં રક્ત આત્માઓને સદા અભય અભય જ છે. કોઈ ભય નહિ. કેવું સુંદર આશ્વાસન ! તે પણ જિણશાસન ઉપરની અટલ શ્રદ્ધાવાળું ! કેવી સરસ શાસનની ઓળખાણ ! શું કહ્યું ? એજ કે ભગવાન જિનેશ્વરદેવનું શાસન જ એવું છે કે એ આત્માને નિર્ભય કરી દે. પૂછોને,

જિન્શાસનમાં અભય શાથી ? :-
 પ્રશ્ન. -એ શી રીતે ? શું જિન્શાસન પામેલાને કોઈ તકલીફ વિટંબણા નથી જ ઉભી થતી ?

ઉત્તર એ છે કે થાય, ન જ થાય એમ નહિ. પરંતુ

(૧) જિનશાસન સમજાવે છે કે ગ્રાસ-તકલીફ પોતાના પૂર્વના પાપકર્મ વિના આવતી જ નથી. તેમ ગ્રાસ-તકલીફ આવ્યા વિના પેલાં પાપકર્મ આત્મા પરથી ખસી દૂર થતાં નથી. એટલે, એવા હઠીલા કર્મકચયરાને દૂર કરાવી આપનારી ગ્રાસ-તકલીફ તો સુઝને મન ઉત્સવરૂપ છે. એમાં પછી ભય શો ?

(૨) બીજું જિનશાસન પામ્યાથી એ પણ સમજ છે કે બહારના ત્રાસ-તકલીફ આત્માનું કશું લુંટી શકતા નથી. જો આત્મા સાવધાન હોય તો. માટે ભય શો. રાખવો? વળી.

(3) જિનશાસનના પ્રણોતા શ્રી અરિહેત પરમાત્મામાં અચિન્ત્ય શક્તિ છે કે એમનું સમ્યગું આદંબન કરનારના સર્વ ભય દૂર થઈ જાય છે. એટલે અહીં પરિણિત ચંદ્રસાર પોકારે દે કે જિનશાસનમાં રક્ત આત્માઓને સદ્ય અભય દે.

(૪) માત્ર અટલ શ્રદ્ધા જોઈએ કે ‘જિનશાસન જે આપણી પાસે નથી તો મહાભય છે. જિનશાસન છે, તો મહાકલ્યાણ છે. જગતમાં કલ્યાણનું સાધન હોય તો એક માત્ર જિનનું શાસન. સકલ કલ્યાણ એનાથી મળે.’ આવી શ્રદ્ધા હોય તો અવસરે એનો જ પ્રભાવ યાદ આવે. કૃતજ્ઞતાપૂર્વક એનું સ્મરણ થાય. ચન્દ્રસાર કહે છે જિનશાસને રક્તને અભય છે.

ચન્દ્રકાન્તા રડી ઉઠે છે :- હવે ચન્દ્રકાન્તાએ આ શબ્દો સાંભળી પતિના અવાજને ઓળખ્યો. એટલે એને તો હર્ષ અને આશ્રમનો પાર નથી ! હૈયામાં પ્રેમ એકદમ ઉભરાઈ આવ્યો. તે હુંખ સંભારી રોવા લાગી. મોઢું માણસ પણ હુંખની આગળ બાળકની જેમ દીન અને રોતડ બને છે. હુંખ ચીજ જ એવી છે કે

ભલભલાના હાંજા ગગડાવી નાખે; અને સંસારમાં કોને દુઃખ નથી આવતું ? માટે જ,

(૧) મહાત્માઓ કહે છે કે બીજાના ઉપર દુઃખ વરસી રહ્યા હોય ત્યારે એના દિલની વેદનાને સમજો; એના હાર્દિક રુદ્ધને નિજના અનુભવની આંખે નિહાળો. તો પછી એનો તિરસ્કાર કરવાની વાત તો શી ? પણ ઉપેક્ષા કરવાનું ય મન નહિ થાય; બલ્કે એના પ્રત્યે હમદર્દી દાખવી સહાય કરવાનો ઉમળકો રહેશે.

(૨) એવું જ, દુઃખની જોહુકમી ચલાવનારું કર્મ આપણને પોતાને આપણા સુખના સારા વખતમાં જાણો શિખામણ દે છે કે ‘સમાલીને ચાલજે, કુલાતો નહિ. ગાફેલ બનતો નહિ. બીજાના પર નવાબશાહી ચલાવતો નહિ. સુકૃત થાય એટલું વધારે વધારે અને વહેલું વહેલું કરી લેજે. નહિતર ધ્યાન રાખજે કે તારા ઉપર પણ એક હિ’ દુઃખનો હલ્લો આવવાનો છે. તે વખતે ભારે કરમાનું પડશો ! બીજાનો તારા પર દ્વિગુણ નવાબશાહી ચલાવશો, અને તે તને અસહ્ય થશો ! વળી સુકૃત કરવાનો અવસર દુઃખમાં નહિ રહે કેમકે એ અવસર તો ચાલ્યો ગયો.’

આશાસન :- અહીં ચન્દ્રકાન્તા પોતાના દુઃખનું નથી રડતી. છતાં પતિને અચાનક અહીં આવી પેલા જાણી રડી પડે છે. વિરહિત હૃદય સંયોગ મળતાં ભરાઈ આવે છે. રોતી ચન્દ્રકાન્તાને ચન્દ્રસાર આશાસન આપે છે. “હવે રડે શા સારું ?” બનવાનું બની ગયું. હવે તો આપણે ભેગા મળી ગયા. બાકી તો જુદા પડ્યા હતા તેથી શું ? કેમકે એ આપણાં જ કર્મના ફળ છે. અને ભોગવ્યા વિના થોડું જ ચાલે ? અને એ તો શાહુકારી છે કે કર્મનાં દેવાં હરખભેર ચૂકવવા, અસ્તુ. એ તો કહે, તું અહીં શી રીતે આવી પડી ?”

ચન્દ્રકાન્તા કેમ પડી ? :- “અરે, હું તો હાથે કરીને પડી ! અમને, લૂંટારાઓ ઉપાડીને ઘસડી જતા હતા. ત્યાં બધાને આ બાજુના નગરની પાસે રાતે પડાવ નાખ્યો. ત્યારે મને થયું કે અહીંયાં શીલના માથે જોખમ કેટલું ? સ્ત્રીજાત પાસેથી લાખોનું જીવેરાત ખોવાઈ જાય તેની જે ખોટ નથી તેનાથી કેઈ ગણું કિંમતી શીલ ખોવાવાની ખોટ છે ! તેને બચાવી લેવાની તાલાવેલી ઠેઠ પ્રસંગના પડછાયામાંથી એટલી બધી થવી જોઈએ કે સામાના પગલાં કેવા પડે છે, દુરાચારીના કે સદાચારીનાં ? બોલ જે બોલે છે તે કેવા બોલે છે ? બદમાશના કે ડાખાના ? એ કળી જવું જોઈએ. જો દેખાય કે ભય છે, પાપનો સંભવ છે, દગ્દો છે, ધોખો છે, તો ત્યાં જ ઉપાય કરી લેવાનો. આ તો લૂંટારાની જાત ! એ એના સ્થાને લઈ ગયા પછી શું ન કરે ? એનો કોઈ ભરોસો નહિ. આવીને સીધો હાથ માત્રેય લગાડે તેટલો પણ અવસર શા માટે જોવો ? ત્યાં મેં આ કૂવો જોયો. મનને થયું કે

ભુવનભાનુ અન્સાઈક્લોપ્ાઇડા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

૮૫

લૂંટારાના જોખમમાં પડવું એના કરતાં આ કૂવામાં પડવું સારું ! પરોઢમાં સૌ કોઈ પોતપોતાના બિસ્તર-પોટલા સંભાળતા હતા ત્યાં મેં આ કૂવો સંભાળી લીધો ! અંધારાનો લાભ લઈ ધીમે પગલે અહીં આવી આમાં પડતું મૂક્યું.”

“પણ તને બીક ન લાગી કે પડીશ ને મરી જઈશ તો ?”

“અરે, ત્યાં પેલું મારું શીલ મરી જાત એનું શું ? શરીર મરી જાત તો ભલે એની રાખ થઈ જાત ! પરંતુ એવું કંઈ બન્યું નથી. ચારિત્રને જરાયે વાંધો આવ્યો નથી, હજુ જીવતી છું.”

હિંમત અને ધગશ :- વિચારો, બાઈની હિંમત અને ધગશ કેટલી ? ભાવીમાં પણ શીલ જોખમાવાનો સંભવ ન જ આવવો જોઈએ. એની પૂરી ધગશ ! અને શીલ રક્ષવા ખાતર ભયાનક કૂવામાં ઝંપાપાત કરવાની હિંમત ? બંનેય અદ્ભુત છે ! ખૂલ્લી તો એ છે કે પહેલાં કહી ગયા છે કે આ લૂંટારાઓ તો માત્ર અપહરણ કરી જાય છે, પણ શીલ ઉપર આકમણ નથી કરતા. છતાં એના વિશ્વાસે કોણ બેસે ? તેમ ઠેઠ એની પલ્લીમાં ગયા પછી તો બચવાનો ઉપાય પણ શો ? ચન્દ્રકાન્તાને લાગે છે કે ‘આ કૂવાની સગવડ અને બધાઓની ગફલતની સગવડ સારી મળી છે. તો હવે બીજો-ત્રીજો વિચાર કર્યા વિના ભગવાનનું નામ લઈ જુકાવવા દે કૂવામાં.’ મહાન કાર્યો હિંમત ખેડ્યા વિના થતાં નથી. આ અભળા કહેવાય હોં. પણ એને મન શીલ એટલે પ્રાણ છે. તો એ રક્ષવામાં વીરાંગના છે. અને જાણો છો ને જાન પર વાત આવ્યા પછી હિંમત આવી જાય છે ? બાકી તો મરવાથી કે માર ખાવાથી બહુ ડરવું શું ? જગતમાં જન્મમરાણનો ક્યાં હિસાબ જ છે ? ધર્મની અને આત્મગુણની રક્ષા માટેનું મરણ એ જ દુર્લભ વસ્તુ છે. આમેય મરવાનું તો છે જ. વહેલું નહિ તો જરા મોહું. પણ ગુણ રક્ષવાની તમનામાં મરવું એટલે આત્માને મન ગુણની કિંમત કેઈ ગુણી ઊંચી જાગી જાય છે. મરીને પણ ગુણ રક્ષવાની કાર્યવાહી આત્માનું સાત્ત્વિક ઓજસ અપૂર્વ વધારી દે છે. માત્ર કિંમત ગુણની સમજાઈ જવી જોઈએ. જુઓને સુશીલ સ્ત્રીઓની ગણની ! જીવનમાં સારું ખાંધું શું, પીંધું શું, એની બહુ વાત નહિ. શીલ બરાબર રક્ષાયું ? તો એનો મોટી કિંમત.

શીલનું મહત્વ :- શીલ શું ચીજ છે ? સધળા ગુણને હૃદયથી સ્વીકારવા માટે જરૂરી છે જે હૃદયની પવિત્રતા, એની ચાવી છે શીલ. શીલ કહેતાં સદાચાર. બરાબર મન-વચન-કાયાથી-કાયાના સર્વ ગાત્ર અને સર્વ ઈન્દ્રિયોથી, વાણીથી અને વિચારણામાં સદાચાર પાણો; અને તમે પવિત્રતાની તિજોરી ખોલી લો. શીલના બળ ઉપર સ્થુલભરજાનું નામ ચોરાશી ચોવિસી સુધી અમર થઈ ગયું. સાંભળ્યું છે

૮૬ લુંટારાનુ અન્સાઈક્લોપ્ાઇડા-“જિનશાસનમાં અભય શાથી” (ભાગ-૨૨)

ન ? સુર્દર્શન શેડને શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન ! મહાસતીઓ સુભદ્રા, કલાવતી વગેરેના શીલના પ્રભાવ ઉપર દેવતા દાસ બન્યા હતા ! પણ અને માનવમાં શો ફરક છે ? પણ શીલ શું એ સમજ ય શકતું નથી, તો પાળવાની વાતે ય શી ? માનવ સમજને પાળી શકે છે. શીલ ગુમાવનાર ભલે આજે માત્ર આંખથી ગુમાવે, પણ ધીમે ધીમે એનું પતન એવું કે હદ્ય મહામલિન અને દુષ્ટ વિચારોવાનું બની જવાનું. શીલ એ તો માનવ દેહરૂપી પુષ્પની સુગંધી છે, અનો સુવાસથી બીજા અનેક ગુણો અને પુષ્પરૂપી ભ્રમરો બેંચાઈ આવે છે. શીલ એ માનવદેહનો સાચો અલંકાર છે, સાચું આરોગ્ય છે. એને ગુમાવનારાના દેહનો રાજ જે વીર્ય, તે તૂટી જાય છે. પછી ભાઈની દશા કેવી ? ઈન્દ્રિયો નિસ્તેજ, મોં ફિક્કં, મન નબળું અને તામસી; કાયા રોગનો ભોગ; કાર્યમાં નિષ્ફળતા. કહે છે ને,

“અભ્રલાયારીનું ચિંતબ્યું, કદીય સફલ ન થાય...પાપસ્થાનક ચોથું વરજાએ” ચન્દ્રકાન્તાનું પગલું શાબાશીભર્યું હતું. જીવનમાં સદાચાર રક્ષવાની પ્રવૃત્તિ સાહસવાળી હોય તોય તે જરૂરી છે. હવે ચન્દ્રકાન્તા પતિને પૂછે છે “પણ તમે આ ભયાનક કૂવામાં કેમ પડ્યા ?”

ચન્દ્રસારની કથની :- ઉત્તરમાં ચન્દ્રસાર ઠેઠ પરગામમાં ધાડનો બનાવ સાંભળી ઝટપટ ધરે આવ્યો ત્યાંથી માંડીને અહીં પડવા સુધીની હકીકત વર્ણવે છે. એમાં છેલ્લું શું કહ્યું ?... “અહીંયાં થઈને અમે જવાના હતા, તેમાં અહીંથી થોડા પાછળ રસ્તામાં વિસામો કરી ઉઠયા પછી અજાણતાં મારા હાથમાં ભાતાની પોટલી પકડાઈ. અનઘંક ધનની પોટલી ઊંચકી. એ પછી અહીં એ કહે ‘મને તરસ લાગી છે.’ કોને ખબર ‘એને શાની તરસ લાગી હશે ?’ પણ હું તો તે માટે જ્યાં આ કૂવામાં પાણી છે કે નહિ તે જોવા લાગ્યો કે એણે મને અંદર ધકેલ્યો.” જુઓ એક અહીં પ્રશ્ન ઉઠે છે,

ચન્દ્રસારે ગંભીરતા કેમ ન રાખી ? :-

પ્ર.- હવે પડ્યાનું ન પડવાનું થવાનું છે ? તો આવો ચન્દ્રસાર જેવો સારો માણસ કેમ એવી ગંભીરતા નથી રાખતો કે સ્ત્રી જાતિને નોકરની હલકાઈ ન કહેવી ?

૩.- ઉત્તર એ છે કે આમ તો એ પૂર્વભવે ચ્યકદેવ તરીકે મહાન ગંભીરતા કેળવીને આવેલ છે. તેથી અહીં તો એ ગુણ વૃદ્ધિ પાખ્યો હતો. એટલે અહીં ગંભીરતા નથી એમ ઉપર-ઉપરથી કલ્પી લેવું અજુગતું છે. ખરી રીતે પ્રસંગના ઊંડાણમાં જું જોઈએ જેથી નોકરનું બ્યાન સ્ત્રીને કહેવાની પાછળનો હેતુ સમજાય. ઊંડાણની સમજ ન પડે તો જરા ધીરજ હરવી જોઈએ કે આગળ ઉપર શું બને છે

ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદેશિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

તે લાવો, જોઈએ. પછી ધોરણ બાંધીએ. અહીં આગળ જણાશે કે નોકર પ્રત્યે ચન્દ્રસારના ટિલમાં કેટલો ઉચ્ચ કોટિનો સદ્ગ્રાવ છે ! એની કલ્પના તુચ્છ હૈયાવાળાના નીચ્યલા થરમાં રહેનારા તુચ્છ હૈયાવાળાને આવી શકે એવી નથી. બીજી વસ્તુ એ છે કે ચન્દ્રકાન્તાને હૂબહૂ બતાવવું છે કે લક્ષ્મી કેટલી બધી ભયંકર છે કે આવા બિચારા નોકરનું મગજ ફેરવી નાખ્યું. કયા કર્મના સંયોગમાં માણસનું મન ફરી બેસે છે એનો કોઈ ચોક્કસ હિસાબ નથી. જીવ એટલો બધો કર્મનો ગુલામ છે; કર્મથી કયાયેલો છે. પત્નીને કર્મની પરાધીનતા અને સંસારની બતાવવાનો આ મોકો છે તે શું કામ છોડે ?

પત્નીનો નોકર પ્રત્યે ખેદ :- ચન્દ્રસારે જ્યાં અંતે બતાવ્યું કે નોકરના ધકેલવાથી નીચે કૂવામાં આવ્યો ત્યાં પત્ની ભડકી ઉઠી એના મનમાં જર આવ્યું કે ‘હે ! નોકરે આવા ભયાનક કૂવામાં ફેંકી દેવાનું ધોર હૃત્ય કર્યું ?’ જર બોલી ઉઠે છે, ‘અરે ! અનઘક આવો દુષ્ટ ? હા ! હા ! બહુ દુષ્ટ કર્યું એણે !’

સંસારકૂવામાં ફેંકાવાનો ભય ? :- ચન્દ્રસાર આની સામે કેવા મહાત્માના ઉદ્ગાર કાઢે છે એ જોતાં પહેલાં જરા એ જુઓ કે આવા લૌકિક કૂવામાં ફેંકી દેવાની વાત જેવી ભયંકર લાગે છે, એવી શું પાપ જીવનરૂપી કે સંસારની ચાર ગતિરૂપી લોકોતાર કૂવામાં ફેંકી દેવાની વાત ભયંકર લાગે છે ? ત્યાં સાંભળતાં ય ભડકી જવાય, અને અહીં અનુભવ થાય તોય ભડક નથી એવું ખરું ? લોકોતાર કૂવા આગળ લૌકિક કૂવો તો કાંઈ વિસાતમાં નથી. જુઓને આ બંનેય કૂવામાં પડ્યા પણ જીવતા છે. ત્યારે પાપના કૂવામાં પડ્યા પછી તો મોત તે એક બે નહિ; જન્મ-મરણની પરંપરા !! માનવદેહની આંખે પાપનો કૂવો નહિ દેખાય તો શું પશુની આંખે દેખાશો ? ઉચ્ચ માનવભવના હદ્યથી જો પાપ એ ભયંકર કૂવો નહિ સમજાય, તો શું પશુજીવના હદ્યથી સમજાશો ? અહીં તો એવો સચોટ સમજાઈ ગયો હોય કે ઈચ્છા, વૈર, કલહ, આળ, જૂઠ, અનીતિ, દુરાચાર, ઉદ્ભબટેવેશવર્તાવ, કૃપણતા, રોષ, રોક, માયા વગેરે પાપોનો કૂવો તો પોતાના જીવનમાંનો પૂરી દેવાયો હોય; એ કૂવામાંથી જીવને બહાર કાઢી લીધો હોય. પણ સાથે સાથે છકાય જીવના સંહારખાના રૂપી જે ધરવાસ, તેના કૂવામાંથી બહાર નીકળી જવાની પેરવી ચાલુ હોય.

બાર વ્રત એ શું છે ? પ્રભુભક્તિ, દાન, શીલ વગેરે શું ? પાપના કૂવામાંથી સંદર્ભ બહાર નીકળી જવાના ક્રોવતની કેળવણી. એ ચાલુ હોય એટલું જ નહિ કિન્તુ પોતાનું ચાલે ત્યાં બીજાને પણ પાપના કૂવામાંથી બહાર કાઢવાનું કરે; પણ નહિ કે કૂવામાં ધકેલવાનું. કૃષ્ણવાસુદેવે છોકરીઓનું શું કર્યું ? કૂવામાંથી બહાર

૮૮ ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“જિનશાસનમાં અભય શાથી” (ભાગ-૨૨)

કાઢીને ? ચન્દ્રકાન્તા, નોકરે પતિને કૂવામાં ફેંક્યાનું જાણી કહે છે ‘હા હા હા ! દુષ્ટ કામ કર્યું એણે !’

ચન્દ્રસાર મોટા મનથી કહે છે,

“અને દુષ્ટ નહિ, પણ પરમ ઉપકારી કહે. કેમકે આપણા બંનેનો એણે સંયોગ કરાવી આયો. આ ન કર્યું હોત તો હું ક્યાંથી અહીં આવત ?” હદ્યમાં કેવી પવિત્રતા અને ફોરાંશ ! દણ્ણ કેવી શુક્લપાક્ષિક ! હદ્યને મલિન નહિ થવા દેવાનો પુરુષાર્થ કેટલો પાકો હશે કે આવા કપરા સંયોગોમાં બીજો વિચાર જ નહિ ! જે થયું તે સારું જ ! દણ્ણ માત્ર ઊજળું જોવાના સ્વભાવવાળી, તે દુષ્ટને ઉપકારી તરીકે દેખે છે. દુનિયામાં રહ્યે નચિંત અને શાંત કોણ રહી શકે ? જેમને દુન્યવી દરેક પ્રસંગમાં પવિત્ર હદ્ય ને શુક્લપક્ષીય દણ્ણ કેળવતાં આવડે તે. કોઈ આવીને કહે, “તમારા માટે પેલો ગાળ દેતો હતો;” તો કહેવાય, “એ ઉત્તમ જીવ છે તે ગાય. પણ અમે પ્રશંસા યોગ્ય નથી; તેથી ઉંધી જઈશું !” દુનિયાના ગમે તેવા વિકટ પ્રસંગમાંય ઊજળાપણાનું એટલે કે અનુકૂળતાનું દર્શન કરતાં આવડે તે નચિંત રહી શકે. અનુકૂળતાનું દર્શન કરવા માટે વાત-વાતમાં છંછેડાઈ જવાનું, ચીડાઈ જવાનું, વગેરે બંધ કરવું પડે. છંછેડાવું એ ભયંકર કુટેવ છે. તે મટે નહિ ત્યાં સુધી આવી ઊજળી દણ્ણ અને પવિત્ર હદ્ય ન બને. શું છે એ ? જે છે તે સારા માટે છે ! આપણે તો મૂર્ખાઈ કરીને નાહકની ચિંતામાં સુખ બાળી નાખીએ છીએ.

ચન્દ્રસાર પત્તીને કહે છે, “તને ખબર નથી, એ નોકરે તો આપણો સંયોગ કરાવી દીધો. વળી આ કૂવામાં પડવાનું ભાવી હોત તો કોઈ મિથ્યા ન કરી શકત !”

શાસનસ્પર્શના એટલે ? :- શાસન પામવાનો શું કંઈ અર્થ જ નથી ? શાસન પામેલો માણસ શાન્ત, નેકીવાળો, ને દયાળું હોય, જૂઠ પર નફરતવાળો હોય, ઉદાર અને ઉમદા દણ્ણવાળો હોય, આવો અર્થ ખરો કે નહિ ? કે પછી મંદિર-ઉપાશ્રેય જવાનું ખરું, બાકી ગમે તેમ વર્તી શકાય. એમ કરી પાપમાં રહેનારા તે જૈનશાસન પામેલા ? શું એ વ્યાખ્યા છે ? ના, એવી વ્યાખ્યા બીજે હશે. અહીંયાં નથી. અહીં તો તમે ઠેઠ ભલે ઓઘો લઈ લીધો પણ તેટલા માત્રથીય શાસન પામેલા નહિ. ઓઘા તો અનંતા લઈ-લઈને નવગૈવેયક સુધી પહોંચેલા, પણ શાસન પામેલા નહિ ! તેથી અનંત સંસાર રખડ્યા !

શાસન પામેલો તો ત્યારે કહી શકાય કે જ્યારે સંસાર પર તિરસ્કાર છૂટે, જિનવચનની શ્રદ્ધાનો રંગ રગેરગમાં વ્યાપી જય. જીવનમાં પુણ્ય-પાપનો નિશ્ચિત ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૮૮

વિવેક રહે. દિનપ્રતિદિન નેકી, દયા, વૈરાગ્ય વધતો જાય. કષાયો અને બીજા પાપ શાન્ત પડતા આવે. તો વિશ્વાસ રાખી શકાય કે આપણે શાસન પામ્યા.

ધર્મની ઊજળામણ કેમ નથી દેખાતી ? :-

આ દુનિયામાં કહીયે છીએ કે ‘આજે ધર્મની ઊજળામણ નથી દેખાતી.’ પણ એ ક્યાં જોવું છે કે તેનું મૂળ કારણ આપણે છીએ. ધર્મને શરીર નથી, ધર્મને શરીર છે. લોક ધર્મને જુવે છે. એના જીવનમાં દેખાય છે કે બાવીસ વર્ષે સંસાર શરૂ કર્યો તેમાં જે માયામતા, ઈર્ઝા-કપટ વગેરે પાપરમત હતી તે આજે બોતેર વર્ષે પણ છે, તો શું ધર્મ દેખવા મલે ? કષાયો-વિષયો, સંસારની ઉપાધિ અને માયામતા એની એજ દેખાય તો ધર્મ શો દેખવો ? ધર્મમાં જો આવું જ દેખાતું હોય તો શું થાય ? માટે ધર્મએ જવાબદારી સમજીને ગુણમય અને ધર્મપ્રધાન જીવન જીવવું જોઈએ. તે જોઈ લોક ધર્મના તો ગુણ ગાય, પણ ધર્મના પણ ગુણ ગાય. કેમકે ધર્મ એનામાં જોવા મળ્યો. બાકી ધર્મી કહેવાતો લોક આગળ ધર્મની વાતો મોટી કરે પણ સ્વયં આચરવામાં જો મીઠું હોય, તો લોકને અસર શી પડે ? કહેવત જરા બીજા રૂપે છે, પણ કહેવાય છે ને કે ‘સો શબ્દો અને એક અનુભવ.’ સો શબ્દથી જે અસર ન થઈ હોય તે એક અનુભવથી થાય. ધર્મ આવો સારો, આવો સારો, એ શબ્દ છે. પણ ધર્મી આત્મા ધર્મનો દાખલો છે. તે દાખલો એટલે ધર્મજીવન. શાસનની સ્પર્શનાવાળો ધર્મી હોય તો એ જીવન જોવા મલે. શું સ્પર્શના એટલે ? ... સ્પર્શના એટલે શાસનના અટલ સિદ્ધાન્તોનું વલશ. સિદ્ધાન્ત છે, ‘લક્ષ્મી અને વિષયો તથા કષાયો સ્વાત્મધાતક હોઈ ત્યાજ્ય છે.’ એનું વલશ એટલે લક્ષ્મી આદિ પ્રત્યે ભય હોય, કષાયો શાંત પડતા ગમે. ભલે ગૃહસ્થ હોય પરંતુ વિષય કષાયોની કાંઈ એજન્સી નથી લીધી. ધર્મી આત્મા એવો કોઈ દિન બચાવ ન કરે કે “અમે તો દુનિયામાં રહ્યા; તેથી બધું કરવું પડે.” ધર્મી તો કપાળે હાથ દે “કેવો અક્કમી હું ! અહીં પણ આ કરી રહ્યો હું ? પામર હું. બાકી કરવા જેવું હરગીઝ નહિ.” સ્પર્શના થવા માટે આ જરૂરી છે. જૈનશાસન સ્પર્શી જાય તેનું માપ આ કે ‘આત્માના દેદાર ફરી જાય. પ્રવૃત્તિ ખાવાની હોય તો પણ જબૂકો તપના કર્તવ્યનો જોઈએ. પ્રવૃત્તિમાં ગુર્સો કરતો હોય, તો પણ અંદરમાં પરમાત્માની સંગમ પરની ક્ષમાના કર્તવ્યભાનનો પ્રકાશ જોઈએ. કોઈ આપણું કુહારીથી માથું કેમ ન ચીરે, પણ રાખવી તો ક્ષમા જ જોઈએ, એવું સચોટ કર્તવ્યદર્શન જગ્રત રહે.

અનધકે ચન્દ્રસારને કૂવામાં ફેંકી દીધો ત્યાં એમ નથી થતું કે “કૂવામાં સ્ત્રી મલી, તે તો પુણ્યાઈથી; પણ પેલા હરામીએ તો જે ફેંકવાનું કર્યું તે તો ખરાબ

૧૦૦ લુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“જિનશાસનમાં અભય શાથી” (ભાગ-૨૨)

કર્યું...હુણ ! હરામખોર !” આવું મનને નથી લાગતું. આ તો પરિણામ જોઈને પત્તીને કહે છે કે “ઉપકાર માન એનો કે ઝટ તું મળે એવો મને એણો અહીંયાં ફેંક્યો ! એટલું જ નહિ પણ સાથે ધન એણો ઉંચક્યું, તો ભાતું મારા હાથમાં રહ્યું ! ભાતું ન હોત તો ખાત શું અહીંયાં ? જેવેરાત કાંઈ ખાવા કામ ન લાગત.” આમાં અનઘકનો ઉપકાર જ માનવાની ચન્દ્રસારની આત્મજાગ્રતિ સૂચ્યે છે કે એ શાસન પાણ્યો છે.

ધર્મના મૂળમાં :- શાસ્ત્રકારો જ્યારે શાસન પામવાની પૂર્વે પણ સામાન્ય ધર્મ પામવાના મૂળમાં મૈત્રી આદિ ભાવના આવશ્યક બતાવે છે તો શાસન પાણ્યા પછી તો આત્માની સ્થિતિ કેટલી બધી ઉચ્ચ હોવી ઘટે ? એ મૈત્રી ભાવનામાં દુષ્મનનું પણ ભલું ચિંતવવાની વસ્તુ આવવાની. અહીં તો ચન્દ્રકાન્તાને દુષ્મન અનઘકનું કાર્ય અનુદૂળ બની ગયું છે. પછી એમાં એનો ઉપકાર માનવો એ કઠીન વસ્તુ નથી. શાસન પાણ્યાની આ વિશેષતા છે કે દરેક પ્રસંગને કર્મબંધમાં નહિ પણ કર્મક્ષયમાં ઉતારી શકે. શાસનના અનુપમ તત્ત્વો, સિદ્ધાન્તો, અને ઉપકાર પ્રત્યે હૃદય એટલું બધું આકર્ષાઈ ગયું હોય કે એ હવે હલકી જીવનને ને હલકી વિચારસરણીને પસંદ જ ન કરે. હલકો વિચાર હૃદયમાં સ્હરવા સરખો ન હે. એવું કંઈ બને તો પ્રતની યોગ્યતા ગણાય; તો આત્માની વિશેષ ઉન્નતિ થાય.

દેહનાં લગ્ન કે આત્માનાં ? :- શ્રી સમરાદિત્ય કેવલી મહર્ષિનો જીવ બીજા ભવે સિંહકુમાર રાજપુત થઈ, શ્રી ધર્મધોષ આચાર્ય મહારાજ પાસે અવધિજ્ઞાની મહર્ષિ અમરગુપ્ત આચાર્યદિવનું ચારિત્ર સાંભળી રહ્યો છે. એમાં અમરગુપ્ત મહર્ષિનો જીવ ચન્દ્રસાર પત્તી ચન્દ્રકાન્તા સાથે કૂવામાં છે. કૂવામાં અંદર એક જીર્ણ કૂવો હતો, જેથી એની પાળે બેસાય એવું હતું. ત્યાં થોડી ઉંઘે રાત્રિ વિતાવી. ચન્દ્રકાન્તા અંદર પડી ત્યારથી ભૂખી હતી. પરંતુ રાત્રિ હોવાથી અત્યારે ભોજન નહિ કરવાનું, એ નિર્ધાર છે. જીવનમાં શાબાશી શામાં ? પોતે જે શુભ દરજામાં હોય તે મુજબના આચાર પાળવામાં. આ ચાર દિવસથી ભૂખી છે, અત્યારે સામે જ ભોજન છે. તો પછી અપવાદ જોવો કે નહિ ? ના. સવાર પડતાં સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ પચ્ચકુખાણ પાળવાની વાત. તે પણ સમય આવ્યે કહે છે પોતાના પત્તીને, કે “તમે જમો નહિ ત્યાં સુધી મારાથી કેમ જમાય ?” સ્થિતિ કપરી છે. પોતે કેટલાય દિવસની ભૂખી છે, છતાં મર્યાદાપાલનની ભૂખ આગળ ભોજનની ભૂખ ગૌણ છે. પહેલાં મર્યાદાનું પાલન, પછી ભોજન ! શું ? કાંઈ સમજાય છે ? આજના જેવા કેવળ દેહનાં લગ્ન કે કહેવાતા સ્નેહલગ્ન સમજતા નહિ. એમાં તો જરા ટાયલાંની પોલિસી રમીને પહેલું પોતે ખાઈ લેવાનું કરાય. “હા ! હા ! શું

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદિઃ- સમરાદિય્ય કહા.” (ભાગ-૨૨)

૧૦૧

કરત હું અહીં એકલી ?... ચાર ચાર દાઢો કોણો દેખ્યો છે ? ...પણ તમે કોઈ કેવા સરસ પુષ્યે મધ્યા છો કે અહીં કૂવામાં પણ મારા માટે ભાતું લઈ આવ્યા...તમારો ઉપકાર હું ક્યાં વાળી શકવાની છું ?...” વગેરે વગેરે સવાસલા કરીને પતિને એમને એમ બેઠા રાખી પેટ ભરતાં આંચકો ન આવત ! ખાતી જત અને ઉપરથી પતિ પાસેથી આશ્વાસન પોતે લેતી જત ! અહીં તો પોતે પતિને આશ્વાસન હે છે. ‘તમે ભોજન ન કરો ત્યાં સુધી મારાથી કેમ જમાય ?’ આ વિવેકની પાછળ હૃદયની વિશાળતા અને સહિષ્ણુતા સાથે વડિલ આગળની લધુતા તરવરી રહી છે. આવા ગુણો કેળવવાના સોનેરી અવસર આવા પ્રસંગે મળે છે.

મનુષ્ય જીવન શા માટે છે એ ખૂબ શોચો :-

અહીં પરિમિત ભાતું છે; ને કોણ જાણે કૂવામાં કેટલાય દિવસ થાય ? પરંતુ પત્તીના અત્યાગહથી જાણે છે કે ‘આ એકલી નહિ જમે’; તેથી ચન્દ્રસાર થોડુંક પોતે ખાઈને પત્તીને ઠીક ઠીક વપરાયું. પછી વિચારે છે કે “સંસાર સમુદ્ર જેવા આ ઊંડા કૂવામાંથી અમે કયા ઉપાયે ઊગરીશું ?” જુઓ, આવા મહાદુઃખ વખતે પણ સંસાર સમુદ્રની ઉપમા વિચારી સંસારના વળી અતિ મહાન દુઃખ ઘ્યાલ બહાર નથી કરતા ! ધર્માત્માની આ ભૂખી, કે પ્રસંગે પ્રસંગે તાત્ત્વિક દસ્તિ જાગતી રાખે સાંસારિક સુખ-દુઃખમાં ભવભ્રમણના દુઃખ ન વિસારે. અહીં તો દિવસો ઉપર દિવસો વીત્યા ભાતું ખૂટવા આવ્યું. ભાતું ય બચારું કેટલું પહોંચે ? કેમ કે એકલું ખાવાની વાત; ઉમેરવાની વાત જ નહિ. પુષ્યના ભાતાંની પણ એજ દશા છે. માટે જીવનમાં ધર્મ બહુ જ જરૂરી છે. ચન્દ્રસારને ભાતું ખૂટી જતાં જીવિતની આશા જતી રહી. કેમ કે રસ્તો જંગલી ! કોણ આવે કે જાય ? ત્યારે ખેદ થાય છે કે “શું આમને આમ જ મરી જવાનું ? જિનશાસન પામીને ચારિત્ર સાથ્યા વિના અફુતાર્થપણે મરું ?” ચારિત્ર વિના મરવાનું દેખાય છે. એનો એ મહાન પશ્ચાત્તાપ કરે છે. જાણે છે ધર્મથી જ જીવનમાં ધર્મ જો બરાબર સગો કરી લઈએ, તો પછી ધર્મ આપણી સાથે ભવેભવે સગાઈ માંડે ! “તું જ મારે ગણવા લાયક, સ્મરવા લાયક છે;”-એમ એક જ જીવનમાં ધર્મને હાડોહાડ પ્રવેશેલો કરી લઈએ પછી ધર્મ આપણો કેડો મૂકે નહિ. આ બંનેને શું વિચાર આવે છે ? “આમ જ ચારિત્ર વિના મરી જવાનું ?” એ વિચાર નથી આવતો કે “માલમિલકત, બંગલા-બગીચા, નોકર-ચાકર શું કરવાનાં ? પૂળો મૂકવાનો એમાં ? પડ્યા અહીં કૂવામાં ! નોકર બદમાશ !” એવી વિચારણા સરખી નહિ. મનુષ્યજીવન શા માટે છે એ ખૂબ શોચો. બીજા જીવનોમાં જે કદાપિ ન મળે અને જે મધ્યા વિના

૧૦૨ લુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“જિનશાસનમાં અભય શાથી” (ભાગ-૨૨)

નિસ્તાર થાય જ નહિ, તેવી વસ્તુ માટે મનુષ્યદેહ છે. વિચારો, જીવનમાં સમકિતનો જબૂકો કેવો જાગતો હશે ? કેવી ઉમેદો થતી હશે ? કે આવી ઉત્તમ ભાવનામાં એ રમી રહ્યા છે ! એક જ ભાવના-

આત્મજાગ્રતિ :-

“હું ? જિનમત પ્રાપ્ત કરવા છતાં પ્રબળ્યા પાળ્યા વિના અને તેનાથી ફૂતફૂત્ય બન્યા વિના મરવાનું ?” સમકિતનો પ્રકાશ શું ? એ જ કે, પાપનો ડર વધે, કષાયો શાંત થતા આવે, વિષયોની લગની કપાતી આવે, જીવન ધર્મમય બનતું જાય; ...ટુંકમાં આત્મા જાગ્રત થઈ જાય; મોહની નિદ્રાને અંકુશમાં લઈ લે. ત્યાં પછી રોદણાં નહિ કે ‘અરેરે ! આપણે શું ખાંધું-પીંધું ? શું ભોગવ્યું ?’ મુખ્ય એક જ વાત ‘આપણે આરાધું શું ?’ લક્ષ્મી હોય તોય કે ન હોય તોય એક જ દશા, આત્મજાગ્રતિ !

પરમાર્થ, સમતા અને સદ્બુદ્ધિનું ધન વધારવા ધખો અને મથો :-

નહિતર તો લક્ષ્મી હાથમાં આવ્યા પછી પરિણામ શું આવે છે ? ઉન્નતિ કે અધઃપતન ? પરમાર્થ કે સ્વાર્થ ? સુબુદ્ધિ કે કુબુદ્ધિ ? શાની સગવડ સધાય છે ? પણ એવા આત્માઓ છે કે જેમની પાસે લક્ષ્મી આવ્યા પછી શુભ ભાવવૃદ્ધિ પરમાર્થ, ધર્મસાધના વગેરે વિકસે છે. પણ એની જે ભાવવૃદ્ધિ પરમાર્થ અને ધર્મસાધના ઝીલે છે તે ખીલવાનું કારણ લક્ષ્મી નથી. પણ અંતરાત્માની જાગ્રતિ છે. જો અંતરાત્માની જાગ્રતિ છે, તો જગતમાં સારા ગણાતા સંયોગોનો જિનશાસનની દાખિએ સારામાં સારો ઉપયોગ કરશે. વર્તમાનમાં સત્તા, લક્ષ્મી, ને બુદ્ધિવાળા ઘણા; ઈજજત આબરૂવાળા પણ ઘણા; છતાં તેમાંના ઘણા મોહની નિદ્રામાં ઊંઘતા છે. એટલે કે એમને મળેલી ભૌતિક સંપત્તિથી જ આત્મા વધારે દુષ્કૃતમાં પડે છે. માણસને કોડ થઈ જાય છે કે “આટલી સંપત્તિ-ઈજજત આબરૂ મળી જાય તો મજા પડી જાય !” અરે મહાનુભાવ ! એ તરફ ન જો. એ મળી ગયા પછી સ્વાર્થ, મમતા, દુર્બુદ્ધિ વગેરે વધ્યે તેનું શું ? દુનિયામાં ચાર જણાએ સલામ ભરી, ને ‘શેર સાહેબ’ કહ્યા તેમાં કંઈ વિશેષતા નથી. વિશેષતા તો પરમાર્થ, સમતા, સદ્બુદ્ધિ વગેરે વધે એમાં છે. એ વધારવા ધખો અને મથો. ધ્યાન રાખો, આપણો આત્મા અથડાતો, ફૂટાતો જે કંઈ થોડીય શુદ્ધિને પામ્યો તેને ટકાવવા-વધારવાની ક્યારે ? મોટા પંચેન્દ્રિય નહિ, પણ નાની કીડી ય પગ નીચે મરે છે તો અંતરાત્મામાં જે કંકળાટ થાય છે તે શુદ્ધિ છે. કષાયમાં ધમધમાટ કરે છે, પણ એમાં લિમિટ છે, મર્યાદા છે. “મારી નાખું-કાપી નાખું” આવું જે નથી થતું એ શુદ્ધિ છે. કષાયો વિષયની સ્પૃહાઓ છે ખરી, પણ અમુક મર્યાદામાં જ કષાયની, વિષયની વિચારણા

છે. આ જે મર્યાદિત સ્થિતિ છે, તે સૂચવે છે કે કંઈક શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એ શુદ્ધ ટકાવવાના-વધારવાના ક્યારે ? અહીંયાં કંઈક અંશો પણ પુરુષાર્થ હશે તો ને ? ક્ષાયિક પ્રકાશ થાય નહિ ત્યાં સુધી ભરોસો ન કહેવાય કે આ મળેલો પ્રકાશ ક્યાં ઓલવાયો, ને ક્યાં પડ્યા ખાડામાં. શ્રેષ્ઠીકુંષાને ભય નહિ, કેમ કે તેમને ક્ષાયિક પ્રકાશ લાધી ગયો હતો ! માટે ક્ષાયોપશમિક પ્રકાશને ધારણ કરનારે સમકિતને નિર્મણ કરવા મહાપ્રયતનશીલ રહેવું પડશે. તો દેવપૂજા-શાસનપ્રભાવના વગેરે જે વિવિધ અનુષ્ઠાનો ફરમાવ્યા તેનું પ્રયોજન શું ? ક્ષાયોપશમિકનો પ્રકાશ ઢંકાતા વાર ન લાગે. તે આ ડિયાઓ દ્વારા ઊજળો થતો જાય. માટે જ વિચારવું ધેતે કે ‘અહીંયાંથી પૂર્વના ભવો પર દણ્ણ નાખું, તો દેખાય છે કે પૂર્વ કરતાં આજે સારી શુદ્ધિ છે. તેને ટકાવવા-વધારવા હવે ભગીરથ પુરુષાર્થ કરું’ એ માટે અધિક સમકિતની નિર્મણતા, કષાયનો ભય, પરલોકની ચિંતા વધવી જોઈએ. આ બધું કેમ આગળનું આગળ વધે તેનો પુરુષાર્થ જોઈએ.

નેત્ર ફરકવાનું શુભ ચિહ્ન :-

ચન્દ્રસાર પોતાને કૂવામાં પાડાનારને ગાળ દેતો નથી. કૂવામાં પડ્યા પછી ‘ધરનું શું થશે ? સારભૂત ધન તો નોકર લઈ ગયો ! હવે શું કરશું ?’ એ ચિંતા પણ નથી કરતો. પરંતુ “આવું જૈનશાસન પામ્યા પછી શું ચારિત્ર પાળ્યા વિના હાય ! એમજ મરી જવાનું ? એમ મરાય જ કેમ ?” એમ ચિંતવે છે. શું શ્રાવકપણાનો ધર્મ નથી કર્યો ? કર્યો છે. પણ ચારિત્ર જીવન વિના જીવન ફૂતફૂત્ય નથી થયું. ‘ફૂતફૂત્ય’ એટલે ? ફૂત્ય જેણે કરી લીધું છે, તે. ચારિત્ર એટલે અવશ્ય કરવા યોગ્ય કર્તવ્ય. તે કર્યું જ નથી. જીવનનું મહાત્વ શામાં સમજ્યા હશે ? શ્રાવક જીવન પણ કેવુંક ઊજળું હશે ! પોતે કાંઈ સાખુન નથી છતાં દુશ્મન પર પણ ગુસ્સો કરવાની વાત નહિ ! સંસારી છે છતાં સંસારી વાતનોનો લોભ નથી ! શ્રાવક-જીવન છતાં કષાયો પર કાબુ કેટલો ? પાપનો ભય કેટલો ? પાપની પરંપરા પર કાપ કેવો ? જીવનનું મહાત્વ જ આમાં છે. સંસારનો ભય છે, તેથી જ જંબે છે કે “અરેરે ! ચારિત્ર વિના જો મરું તો જીવન એળે ગયું !” એટલામાં પોતાની જમણી આંખ અને પત્નીની ડાબી આંખ ફરડી ! બંને એકબીજાને એની વાત કરે છે. પત્ની કહે છે “આર્યપુત્ર ! મારું ડાબુ નેત્ર ફરક્યું !” આ કહે છે “મારું જમણું નેત્ર ફરકે છે. તો ચિહ્ન સારું છે. માટે નિરાશાની જરૂર નથી.” એમ કહીને એ પત્નીને આશ્વાસન આપે છે કે ‘સુંદરી ! હવે આ વિશેષતાવાળા નિમિત્તોથી આપણે દીંઘડાળ આ કલેશમાં રહેવાનું નથી. માટે તારે હવે સંતાપ કરવો નહિ.’ કેવું આશ્વાસન ! પણ આના કરતા કેઈ ગુણું ઊંચું આશ્વાસન આત્મગુણો-

સમ્વક્તવાટિના લક્ષણોના શુભ ચિહ્નવાળાને ગુરુ આપે છે. લેવું છે ?

જંગલમાં સાર્થવાહ :-

એક અહોરાત્ર પસાર થયો એવામા ભીલ લોકોની જે રાજ્યાની હતી, ત્યાંથી રત્નપુર નિવાસી નંદીવર્ધન નામના સાર્થવાહનો રત્નપુર જતો સાર્થ નીકળ્યો; ને આ કૂવાની બાજુમાં જ એણે થાણું નાખ્યું. પાણી લેવા તેના માણસો દોરડા લઈ કૂવા પર આવ્યા. અહીંયાં તો બંનેની દિશિ ઉપર જ હતી ! એમાં પેલાએ પણ આમને જોયા ! આશર્ય પામી ગયા ! જઈને સાર્થવાહને વાત કરી, અહીં આ બેને આશા બંધાણી. દુન્યવી કૂવામાં જે જાગૃતિ બહાર નીકળવાની હોય છે, તેવી જાગૃતિ સમકિતીને સંસારના કૂવામાંથી નીકળવાની હોય. પાણીના કૂવામાંથી બહાર નીકળવાની, જે ધગશ અને તાલાવેલી હોય છે, એવી કે કોઈ દેખાય તો કહે “ભાઈ બહાર કાઢો.” તે ધગશ અને તાલાવેલી સમકિતીને હોય. લાગે કે સંસારમાંથી આ કાઢે એવા છે તો હૈયાની અંદરથી પોકાર ઉઠાડી કહે કે “ભાઈસાબ ! મરી ગયા સંસારમાં ! હવે કાઢો બહાર !” પેલા લોકોએ સાર્થવાહને ખબર આપી. સાંભળીને સાર્થવાહનું દિલ હલી ઉઠ્યું. નોકરોને કહ્યું “જાઓ જાઓ, જલદી કૂવામાં ખાટલો ઉતારી એમને બહાર કાઢો.” માણસો આવ્યા, ને ખાટલો કૂવામાં ઉતારી કહે છે “બેસી જાઓ આના ઉપર; તમને બહાર લઈ લઈએ.” બંને તૈયાર જ હતા. બેસીને ઉપર આવી ગયા. સાર્થવાહ પાસે એમને લઈ જવામાં આવ્યા. એણે આમને ઓળખ્યા.

યમકીને કહે છે, “અરે ! તમે અહીં કૃયાંથી ?”

ત્યાં ચન્દ્રસાર બનેલી હકીકત કહે છે.

સાર્થવાહ વિસમય પામી કહે છે “બહુ ખરાબ બન્યું. ખેર ! પણ હવે ચિંતા નહિ. ચાલો મારી સાથે.” ખાનપાન કરાવી ચાલ્યા રત્નપુર તરફ. રત્નપુર પહોંચતાં પહેલાં જ્યાં જંગલ પૂરું થાય તે અગાઉથી જ રસ્તાથી જરા દૂર એક બાજુમાં ભયંકર દશ્ય ચન્દ્રસારે ને ચન્દ્રકાન્તાએ જોયું.

ધનકોથળી સાથે નોકરનું હાડપિંજર : આપણાને શા-શા ભાવ થાય ? :-

શું જોયું ? એક ભયંકર ચવાયેલું હાડપિંજર પડ્યું છે. ‘અરે ! આ શું ?’ જોતાં લાગ્યું કે આ તો આપણા નોકરનું જ મહું કાં ન હોય ? કેમ ? બાજુમાં જ પેલી ધનની કોથળી અકંધ પડેલી જોઈ ! ‘નકી, કોઈ ભૂખ્યો વાધ કે સિંહ આવીને નોકરને ખાઈને ખતમ કરી ગયો લાગે છે. બિચારાની કોથળી કોથળીના ઠેકાણે રહી !’ કોથળી મળી અને ઓળખાણ પડી ખરી, પરંતુ આવા હુણ્ણે આપ મેળે શિક્ષા થવા ઉપર અને જવેરાતની કોથળી પાણી મળવા ઉપર આનંદ થવાને

બદલે આ દશ્ય જોઈ બંનેનો વૈરાગ્ય વધી ગયો. જીવનમાં કર્તવ્યદિશા અને આંતરદશા પલટાયા વિના, આ જે ભાવો ઉઠે છે, તે સંભવિત નથી. અહીં પાછા વળેલા મહાંકિંમતી જવેરાત પર રાગ વધે કે વૈરાગ્ય ? ધનના ચોર પર દ્રેષ વધે કે બીજું કાઈ ? “ઠીક થયું બદમાસને... એજ લાગનો હતો...” મારવાનું જગર કદાચ પોતાનું ન હોય પણ ‘હુશ્મન એના પાપે મર્યો તો ઠીક થયું,’ એમ થાય તો પેલા મારવાનો ભાઈ જ કે બીજું કંઈ ? પૈસા પાછા પાસે આવ્યા પછી શું શાબાશી ન લેવાય કે અમારા ન્યાયના પૈસા ? આમાંનું કશું થતું નથી ચન્દ્રસારને. ઉલટું નોકરની દયા આવે છે. જેનું આપણે પાલનપોષણ કરતા હોઈએ તેવા નોકરો દગ્ગો દે તેના પર શું ભાવ જાગે ? દગ્ગામાંય ઠેક કૂવામાં નાખવાનું કર્યા પછી શું ભાવ જાગે ? ખાવાનું ખૂટી જાય તે વખતે શું થાય ? બહાર નીકળ્યા, પછી નોકરની આ દશા દેખાય તે વખતે શું ભાવ જાગે ? વિચારો તો ખરા.

● લક્ષ્ય શુદ્ધિનું મહત્વ ●

આપણા જીવનનું મૂલ્ય અંકાય છે તે આવા આવા પ્રસંગે થતા આપણા શુદ્ધ-અશુદ્ધ ભાવો પર. એનો આધાર આપણા લક્ષ્ય પર છે. આપણું લક્ષ્ય શું છે ? દુનિયાના સંયોગો વચ્ચે તેવા મહિન ભાવો જગાવી ધમધમવાનું. આ ચન્દ્રસારનું લક્ષ્ય આત્મકલ્યાણનું છે, મનુષ્યના સારા કર્તવ્યનું છે. એટલે જે સંયોગોમાં બીજાને વૈર, કોધ-માયા-મમતા-શોક-બળાપો થાય, તે સંયોગોમાં આને કષાયો મંદ પડે છે. ક્ષમા દયાદિ ખીલે છે, કૂવામાં નાખનારનો ઉપકાર માનવાનું કરે છે. કૂવામાં પડ્યાનો જે બળાપો થાય છે, તે પણ અમુક ઉમદા વસ્તુ માટે ! તો જીવનનું લક્ષ્ય ઊંચું બનાવો. પછી ગમે તેવા સંયોગોમાં તમે મૂકાશો પણ ત્યાં દુખુદ્ધિના બદલે સુખુદ્ધિના વિચારો આગળ થશે. પરંતુ આપણે બચાવ કરીએ છીએ કે “ભાઈ-સાહેબ, પ્રકૃતિ જ એવી વિલક્ષણ પડી ગઈ છે...” આ ખોટું છે. ખરી રીતે આપણું ધ્યેય શુદ્ધ બન્યું નથી. લક્ષ્ય ઊંચું હૈયે ચોક્કસ બન્યું જ નથી. જો તે બન્યું હોય તો જેમ ધનના લક્ષ્ય પાછળ બજારમાં સીજાન દેખાતાં લાખો કમાવા માટે ટેવો ફેરવી દો છો- આઠના બદલે પાંચ કલાકની ઊંઘ; કોઈનું સહન ન કરનારા તમે હવે હાલી-મવાલીનું પણ સહન કરો... વગેરે ધણું ધણું ફેરવી નાખો છો; તેમ અહીં પણ કુસ્વભાવ વગેરે ફેરવી નખાય. પરંતુ અહીંયાં આપણાને લક્ષ્યની ચોટ નથી એટલે આપણી જે નરસી પ્રકૃતિ છે તે ચાલુ રહે છે અને જ્યાં ઉત્તમ ભાવનાઓ મહાત્માઓ ભાવી ગયા ત્યાં આપણું હૈયું નીચ ભાવનાઓમાં રમે છે. આનું કારણ પણ આપણા જીવનનું ઉચ્ચ લક્ષ્ય નથી તે. લક્ષ્ય એટલે સમજે છો ને ? જેને સિદ્ધ

કરવાની તમના રહે; જેમાં ફાવટનો નિર્ધાર રહે.

લક્ષ્યને યોગ્ય જીવન :-

ચારિત્રનું લક્ષ્ય એ માત્ર કપડાં કે નામનો બદલો કરવાથી સરતું નથી. એ તો આત્માના જેટલા દોષો છે, તેને નામશેષ કરવાનું લક્ષ્ય ધારી તે મુજબ વર્તાય તો સરે. મોક્ષના લક્ષ્ય માટે સર્વદોષ નાશ. એ માટે ચારિત્ર; અને ચારિત્રના લક્ષ્ય માટે શ્રાવકપણું. મોક્ષમાં કોઈ દોષ નાહિ; નિરાહારીપણું, સુખદુઃખની કે રાગદ્વેષની અથડામણ નાહિ; જશ-અપજશ નાહિ; માન કે અપમાન નાહિ. આવું લક્ષ્ય ચારિત્રમાં. એટલે? જ્યાં કોઈ દોષ નથી, કંઈ માન-અપમાન નથી, શાતા-અશાતા નથી ત્યાં જવું છે તો તે માટે જીવન તેવું જ જોઈએ. ચારિત્રજીવન શાતા-અશાતાની કિમત ગણનારું ન જોઈએ, માન અપમાનમાં ઝેંચાનારું ન હોય, રાગદ્વેષમાં ફસાનારું ન હોય, કોઈ પણ દોષને પોષનારું ન હોય. મોક્ષ માટે જેમ આવું ચારિત્ર, તેમ ચારિત્ર માટે તેવું શ્રાવક જીવન પણ જોઈએ ને? બિલકુલ વીતરાગ-એટલે કષાય વિનાની-સ્થિતિએ પહોંચવું છે તો આ જીવનમાં કષાયો પર કાપનું સતત કાર્ય જોઈએ. લક્ષ્ય બાંધ્યું કે ‘મારે મોક્ષમાં એટલે કે વિષયના કોઈ સંપર્ક વિનાની સ્થિતિમાં જવું છે’ તો વર્તમાન જીવનમાં પણ એ લક્ષ્યને અનુસારે વિષય વિમુખ રહેવાની સતત પ્રવૃત્તિ જોઈએ. પછી કોઈ પણ સંયોગમાં મુકાઓ, પરંતુ મન બગાડવાની વાત નાહિ રહે. ભૂખમરો વેઠવો પડે પણ મન નાહિ બગાડાય.

પૈસા પર વૈરાગ્ય :- એ તો નરસું હતું ફૂવામાં પડવાનું, પણ ફૂવામાંથી બહાર કાઢવા પછી ય ‘ચાલો હવે મનગમતું થયું.’ એમ કરીને મન બગાડવાની વાત નાહિ. આપણને તો બંનેમાં ય હાયને વોય! માંદગીમાંય અને સાજાપણામાંય! માનમાંય, ને અપમાનમાંય, ધનિકતામાંય ને દરિદ્રતામાંય. લક્ષ્યની શુદ્ધિ નાહિ એનો ડબલ મરો છે. આ ઉત્તમ આત્માઓને બહાર કાઢવા તો ખુશ થઈ ગયા. શા માટે? લહેર પડશે હવે સંસારમાં એ માટે નાહિ, પણ “હાશ, હવે ચારિત્ર લેવાશે!” આગળ વધ્યા ને પૈસા મલ્યા, તો રાગને બદલે વૈરાગ્ય વધ્યો! “અહો, આ પૈસાએ આ સ્થિતિ કરી! જરૂર બિચારાને કોઈ પશુએ ફાડી ખાધો હશે. પાપીને ઠીક સજી મળી!” એવો વિકલ્પ સરખો નથી. આવું હદ્ય શી રીતે બનતું હશે? માત્ર જ્યામાળા ગણવાથી નાહિ! દેવને તુચ્છ દર્શન ને તુચ્છ પૂજાથી સમજાવી દેવાથી નાહિ! પણ અભ્યાસ છે. એ અભ્યાસ પૂર્વ જીવનમાંથી શરૂ કર્યો છે, તેનું આ ફળ છે. “બિચારો નોકર કેટલી ઉમેદે પૈસા લઈને ચાલ્યો હશે, ને આ થયું બિચારાનું?” એ પૈસા પર તિરસ્કાર વધુ છૂટ્યો. નોકર પર દ્યા ઊભરાણી. “આ પૈસા એના ય નાહિ ને મારા ય નાહિ. એ પૈસા જેની પાસે જાય

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

૧૦૭

તેનું નિકંદન કાઢે એવા છે !”

ચારિત્રની પાયરીએ :- ચારિત્ર મોહનીયકર્મ ત્યાં તૂટવા માંડયું. “આ પૈસા? આ સંસાર? આ જીવન?” બધા પર નર્ફરત છૂટી. હૈયું એથી ઊભગ્યું. અલિપ્સ થવા માંડયું. અત્યાર સુધી “હાય ધર! હાય પતિ! હાય પત્ની! હાય પૈસા!” થતું હતું, હવે “આ ધર? આ પૈસા?” થવા માંડયું. ત્યાં ચારિત્રનો પરિણામ ઉત્પન્ન થઈ ગયો! પૈસાની કિમત ગણવાની નિશાળમાં બરાબર ડિગ્રી મેળવી નાહિ હોય !! કેમ? જરૂરથી વૈરાગ્ય છૂટે છે! ધ્યેય માનવજીવનનું લક્ષ્ય એટલું શુદ્ધ અને ઉચ્ચ બનાવી દીધું છે કે આ ચીજો એને ચલાયમાન કરવા સમર્થ નથી. સંવેગ અને વૈરાગ્ય વધવા માંડ્યો; ને નગરમાં આવી પહોંચ્યા.

દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

૧૦૮-૩, અંક-૪૨, તા. ૨-૭-૧૯૫૫

ચન્દ્રસાર જ મેં સ્વર્ગો; અનધક ત જ નરકે! :- ચંદ્ર સારે સંસારની બાજુ આટોપી લઈ શ્રી વિજયવર્ધન આચાર્ય મહારાજ પાસે ચારિત્ર લીધું. પોતાના જીવનમાં જ વિચિત્રતાઓ જોઈ લીધી, “પરગામથી ધન-માલ લાવશું ને ઘેર જઈ મજા કરશું.” પરંતુ મજા શું ધૂળ કરે? વચ્ચેથી પરગામજ સાંભળ્યું કે પત્ની જ ઊપરી ગઈ! વળી પત્નીને લેવા નીકળ્યો તો અધવચ્ચે નોકરે દ્રોહ કર્યો?—”આ વિચિત્ર ધનટાઓએ પોતાના હૈયા પર એવી ઘેરી અસર કરી કે આમાં આપણું કાંઈ ઊપરે નાહિ. મફતના શા સાચું ફૂટાવું? પળવાર સંસારમાં તે રહી ન શક્યો ને તુરત જ ચારિત્ર લીધું. સુંદર રીતે પાણ્યું; અંતિમ સંલેખના કરી અને કળધર્મ પામી સાતમા વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. સોળસાગરોપમનું સ્વર્ગાચી દીર્ઘ આયુષ્ય! પણ અનધક નોકર મરીને ગયો સાતસાગરોપમવાણી ગ્રીજા નરકમાં.

એક પૈસા પર પણ નરક સાધી શકાય :- અનધકને પૈસાએ શું આપ્યું? વર્તમાનમાં ભયંકર મૃત્યુ અને ભવાંતરમાં દુર્ગતિ. પણ એની પાસે ભરાબ પૈસા આવ્યા હતા એટલે આવું થાય, એમ કહેવું છે તમારે? ના, પૈસા જે તમારી પાસે છે તેવા જ તેની પાસે હતા. પૈસા તો એના એજ, પણ જેટલા પૈસા પરમાર્થમાં, દાનમાં ગયા તેટલા સારા; બાકીના જે તિજોરીમાં પૂરાઈ રહ્યા કે સંસારમાં વપરાયા તે તો નુકશાન જ કરનારા છે! એક તાંબિયા પૈસા પર પણ નરક સાધી શકાય! શું સમજ્યા? અખતરો ન કરતા કે ‘લાવોને જોઈએ એક પૈસા પર કેમ નરકમાં જવાય...!’ રાજગૃહીનો દ્રમક, ભિખારી ભીખના ઠીકરા પર સાતમીએ

૧૦૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ચન્દ્રસાર જ મેં સ્વર્ગો;” (ભાગ-૨૨)

પહોંચ્યો. એ ઠીકનું ભરાવવાની બહુ લાલસા ન કરી હોત તો નરકગામી લેશ્યા શું કામ કરત ?

નરકમાંથી સિંહ :- નરકમાંથી અનધક નોકરનો જીવ મારપીટમાં આયુષ્ય પૂર્ણ કરી વિન્દ્યગિરિ પર સિંહ તરીકે ઉત્પન્ન થયો. કેવા અવતાર મળે છે. કર્મ જાણે કહે છે “કૂવામાં શેઠને ધકેલી દેવા માટે જે કૂરતા કરી હતી. હવે તેને યોગ્ય ભવ લેતો પરવાર ! તેથી તને ત્યાં વધુ કૂરતા કરવા મળજો !” કુદરતનું સંચાલન કેવું છે ? હૈયાની જે સારી કે નરસી ઘરેડ તમે અહીંયાં શરૂ કરી તેવા પછીના ભવ મલે. હૈયું કેટલું બધું અને કેવું કઠોર કર્યું હશે કે ધર્મિષ, ઉદાર અને વિશ્વાસુ એવા શેઠને કૂવામાં ધકેલવાનું કામ કર્યું હશે ? એટલે અહીં જેટલી વધારે નઠોરતા, કૂરતા, પાપની આસક્તિ કરી તેટલા પ્રમાણમાં તેનું પરિણામ પરલોકમાં ભયંકર.

જડ પર પણ કોમળતા રાખો :-

એવું પણ બને કે જાણે છે કે કેરી સજીવ છે છતાં કેરીની છાલ ઉતારીને એના પર ખુશ થયા કે, “કેરી આમ હોલાય !” તો આ કઠોર હાર્દિક પરિણામનું પરિણામ કેવું ? બીજા ભવે જીવતા જીવે શરીરની ચામડી ઉત્તરાવવાનો પ્રસંગ આવે. માટે સમકિતીના સ્વરૂપમાં કહી દીધું કે નિર્ધર્ષસપણે તે કોઈ પાપ કરતો નથી. એક સોપારી ભાંગતા પણ હૈયું કોમળ રાખવાનું. ભવે જડ હોય, સચિત્તા નથી; છતાં હથ્યમાં કઠોરતાનો અભ્યાસ ન પડી જાય માટે કોમળતાનો ઉપયોગ રાખવો પડે. જ્યારે કોમળતા અહીંયાં સચવાય ત્યારે તે ભવાંતરમાં સગી થાય. પરંતુ જો કઠોરતાને સાચવી રાખી તો નોકર મરીને સિંહ થયો. હવે એ બિચારાના જીવનમાં અનેકાનેક પ્રાણીઓને સંહાર કરાવાનું કુદરતી સ્વભાવમાં જ કોરાઈ ગયું ! પરિણામ ? ત્યાંથી મરીને પાછો તેજ ગીજ નરકમાં રવાના થયો.

કુયું પાપ મોટું ? ધનમૂર્ખી કે જીવધાત ? :- અહીં એક પ્રશ્ન જે મનુષ્યપણે શેઠને કૂવામાં નાખી પૈસાના લોભમાં ગીજ નરક ઉપાર્જ, તેમ જે સિંહનો ભવ પામીને પણ ગીજ નરક ઉપાર્જ, તૂલના કરો કે બેમાંથી કોનું, કયા ભવનું પાપ વધે ? મનુષ્યપણામાં એક જ બ્યક્ટિને એક જ વાર કૂવામાં નાખ્યો, તે પણ મારી નાખ્યો નહિ, અને આ સિંહના જીવનમાં અનેકની હિંસા અનેકવાર ! કરપીણ રીતે હરણિયાં મારી ખાવાની વાત ! કૂર રીતે હાથી જેવાના ગંડસ્થલ ફાડી નરકવેદનાઓ આપવાની વાત ! આવાં પાપથી પણ ગીજ જ નરક ? અથવા આની સામે પણે શેઠને કૂવામાં ફેંકવાના પાપથી પણ ગીજ જ નરક ? ત્યારે સમજો કે મનુષ્યપણામાં શેઠનો વિશ્વાસધાત માનવબુદ્ધિએ કર્યો, એ ભયંકર પાપ છે. વળી પૈસાની ગાઢ મૂર્ખી કરી, તેથી જ જે વખતે સિંહે માર્યો તે વખતે રૈદ્રધ્યાનમાં ચઢી ગયો. આવું

કંઈ ભયંકર કર્યું હોય જેના યોગે ગીજ નરક સાથે તે સ્વભાવિક છે. પરંતુ એ તો કહો તમને પંચેન્દ્રિયને મારી નાખવો તે જેટલું ભયંકર લાગે છે તેવું પૈસા પર મૂર્ખી કરવામાં ભયંકરતા લાગે છે ? અહીંયાં પૈસા પર મૂર્ખી કરી શેઠનો વિશ્વાસધાત કર્યો તેનું જે પરિણામ, તેજ પરિણામ સિંહની કૂરતાનું ! એટલે ન સમજતા કે પૈસા પરની મૂર્ખાનું પાપ ઓછું ભયંકર છે. વિવેક અનું નામ કે વસ્તુને જે રીતે શાસ્ત્રે ઓળખાવી હોય તે રીતે દેખાય. હિંસાની લોલુપતા રાખવી તે જેટલું ભયંકર છે, તેવું પૈસાની લોલુપતા તે પણ ભયંકર છે. આવો હદ્યનો વિવેક જોઈએ. પછી પાપ દેખે ને ગભરાય. પાપની વિચારણા આવતાં કંપે ! જેમ ઉદરને બિલાડીની કલ્પના આવતાં કંપે તેમ. પાપની કલ્પના એ બિલાડી જેવા છે. જીવ ઉદર છે. એનાથી એ ગભરાતો રહે કેવો ? કે આ જે મનુષ્ય જીવનમાં પાપો છે, જેવાં કે પૈસાની મૂર્ખી, વિષયોની લાલસા, વિશ્વાસધાત, અનીતિ, ઈચ્છા, ધમંડ વગેરે; એમાં ભવોની પરંપરા દેખાય.

દુદ્રેવના જીવને પહેલેથી જ કૂરતા લાગી ગઈ છે પૂછે, સિંહમાંથી ગીજ નરકમાં ગયો. ત્યાં સુધીમાં બીજા ૧૪ સાગરોપમ પૂરા કર્યા. ત્યારબાદ નરકમાંથી નીકળીને બાકીનાં બે સાગરોપમ તિર્યંચના ભવોમાં ભટકીને પૂરાં કર્યા. ત્યાં પેલું ચંદ્રસાર દેવનું દેવલોકનું ૧૬ સાગરોપમનું આયુષ્ય પણ પૂર્ણ થયું.

● ચન્દ્રસાર અને અનધકનો ભવ પૂર્ણ ●

● અનંગદેવ અને ધનદેવ ●

શ્રી સમરાદિત્યનો જીવ બીજા ભવમાં સિંહકુમાર રાજપુત, આચાર્ય શ્રી ધર્મધોષસૂરિજી મહારાજ પાસે, અવધિજ્ઞાની શ્રી અમરગુપ્ત આચાર્ય ભગવાનજું ચરિત્ર સાંભળી રહ્યો છે. એ ચરિત્રમાં સોમા-દેવ-હાથી-દેવ-ચક્રદેવ-દેવ, ને ચન્દ્રસારના ભવ વર્ણયા. ચન્દ્રસાર મરીને દેવ થાય છે. એમના પર પ્રથમ ભવથી શત્રુવટ રાખનાર અહીં જે એમનો નોકર અનધક, તે મરીને ગયો ગીજ નરકમાં. ત્યાં સાત સાગરોપમ પૂરા કર્યા, અને કારમી કલ્પના વેઠી મરીને વિષયાચલમાં સિંહ થયો. સિંહ એટલે અનેક પંચેન્દ્રિય જીવોના કૂર ધાતનું જીવન ! તે મરીને ફરી તેજ નરકમાં પડ્યો. ત્યાં સાત, અને બીજા બે સાગરોપમ તિર્યંચના ભવોમાં ભટકે છે. ચન્દ્રસારનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને આજ જંબુદ્ધિપમાં ભરત ક્ષેત્રના રથવીરપુર નગરમાં ગૃહસ્થ નંદીવર્ધન અને સુરસુંદરીના પુત્ર તરીકે જન્મ્યો. નામ રાખ્યું અનંગદેવ. અનધકનો જીવ તેજ નગરમાં સોમ સાર્થવાહની નંદીમતિ

પત્નીનો ધનદેવ નામે પુત્ર થયો.

ધર્મપ્રાપ્તિ : આપકમાઈ :- અનંગદેવ અને ધનદેવની બાલ્યકાળથી મિત્રતા બંધાઈ, પણ ધનદેવની મિત્રતા ઠગાઈ ભરી. કેમકે જેવું વાયું તેવું લણવાનું ! જેવાં દીધાં તેવાં લેવાનાં ! નરસા સંસ્કારોનું વાવેતર કર્યું એટલે એનાં ફળમાં નીચે ભાવના મળે. બંનેની મિત્રતામાં આકાશ-પાતાળનો ફરક છે. એકની સરળતાની મિત્રતા છે, બીજાની માયાની ! તેવામાં અનંગદેવને દેવસેન ગુરુમહારાજ મળી ગયા. ગુરુમહારાજે સર્વજ્ઞભાષિત જૈનધર્મનો મર્મ સમજાય્યો. અનંગદેવને તે ખૂબ ગમી ગયો. ગમે જ ને ? પૂર્વ ભવોની ધર્મ સાધનાની મહેનત ચાલુ છે.

એક વાર એ વિચારે છે કે “પિતાજી પાસે ધનમાલ તો ઘણો છે, પણ એમાં આપણને શું ? બાપકમાઈ ખાવામાં તો અપમાનકારિતા છે. માટે આપકમાઈ કરવા પદરેશ જઈએ.” એ વિચાર પિતાજીને જણાયો. મા-બાપે ન જવા ઘણો સમજાય્યો; પણ આને તો જવું જ હતું પરદેશ; તેથી છેવટે રજા મળી. એ કાળે આપકમાઈની લાલસા પણ પછીથી મોટા પરોપકાર કરવા માટે રહેતી; નહિ કે માત્ર રંગરાગના સ્વાર્થ પૂરવા; -આ એક વિશેષતા યાદ રાખવા જેવી છે.

ધનદેવની ઠગબુદ્ધિ :- બંને મિત્રો રત્નદીપે જવા નીકળ્યા; અને પહોંચી પણ ગયા. ખૂબ રત્નો કમાયા અને સારી કમાઈ કરીને પાછા વળે છે. ત્યાં એક નગર આગળ મુકામ કર્યો. પરંતુ ધનદેવનું ચિત્ત કલુષિત છે, ત્યાં સારી વિચારણા લાવવી કર્યાંથી ? માત્ર નરસી જ વિચારણા, અને કષાય ભાવજ સૂર્જે છે. મનમાં સંકલ્પ જાગ્યો કે “કમાડી ઘણી થઈ છે. એમાંથી આમ તો આપણને બહુ તો અદ્ધો ભાગ મળે. પરંતુ બાકીનો અદ્ધો ભાગ પણ ક્યાં ઓછો છે ? શું એ મિત્ર લઈ જાય ? ના, ના, શાનો લઈ જાય ? એને તો હું મારી જ નાખું !” સીધી મારવાની જ વિચારણા ! આશ્રય કરશો નહિ. એ બિચારો તો જૈનશાસન સુધી આવેલો નથી, એટલે આ વિચારણા કરે છે. પણ આપણે તો જૈનશાસનમાં આવી ગયા છીએ ને ? તો જે નહિ કરવા જેવી વિચારણાઓ, તે મનમાં નથી જ ઉઠઠી ને ? બોલો ઉઠે છે કે નહિ ? સામો ભૂલ કરે છે ત્યારે તેની ભૂલ પર ઝટ નજર જાય છે, તો, આપણી જાત માટે તો જે પરમાત્મા, સદગુરુ અને ધર્મનો સંયોગ પામ્યા છીએ, તેને ધાજતું જ કરીએ છીએ ને ? પૂર્વના શ્રાવકો જેવું જીવન છે ને ? સામાની ભૂલો જોઈ જોઈને તો કાળના કાળ વીતી ગયા ! હવે ય જોવાનું બંધ નહિ ? આત્માને કંઈ લાભ તો ન થયો, પરંતુ મહાનુકસાન થયાં, તો હવે એનું દોષ-દર્શન બંધ કરો. આ જીવ તો અધમ બની ગયો છે. અજ્ઞાનતાના અંધાપામાં કંઈ દેખાતું નથી કે પૂર્વજીવનમાં કેવાં પાપ કરી કેવાં ભયંકર ફળ

ભોગવ્યાં છે ! “બસ, અનંગદેવને રત્નો લઈ જવા દઉં નહિ, અને આમેય એ મને ગમતો નથી, હૈયાને રુચયો નથી. પછી ભલેને એ મરતો.” મિત્ર મહાગુણીયલ છે; પણ આ મહાઅકર્મા છે. ગઘેડાને સાકર ન ભાવે, તેમ આને ગુણીયલ એવો પણ મિત્ર ગમતો નથી.

બધું ઊજળું ગમે, મન નહિ !! એ શું ? :- હવે આગળ પાપવિચારણામાં ચઢ્યો, “આમ તો કોઈ મારવાનો ઉપાય દેખાતો નથી, પણ કોઈને ખબર ન પડે તે રીતે મારવો જોઈએ... પરંતુ હા... આ રીત ઠીક છે...” એમ કરીને એક યોજના ઘડી કાઢી. યોજના સફળ થશે કે કેમ તે નિશ્ચિત નથી. પણ યોજનામાં મન બગડવાનું નિશ્ચિત છે. નવરા મનનો ઉપયોગ આવો જ ને કે દુનિયાદારીની જ વિચારણાઓ, કે જેમાં કંઈ માલ ન હોય ? સારામાં સારી ધર્મસાધનામાં જોડાયા હોઈએ ત્યાં પણ મનનો દોર કેવો છૂટો ? પરમાત્માના ચરણની સેવા કરવાના મહાન સંયોગ મળ્યા ત્યાં તો એ ઉત્તમ આલંબન પામીને મનને મહા ઉજ્જલ કરી શકીએ. પણ ક્યાં છે એ કરવાનું ? માણસને કાયા મેલી નથી ગમતી તરત સાફ કરવાનું મન થાય છે. કપડા મેલાં નથી ગમતાં; ઘોઇ સાફ બાસ્તા જેવું કરવાનું લક્ષ રહે છે. તો મન કેમ મેલું ગમે છે ? બીજું બધું ઊજળું ગમે, અને મન-આત્મા મેલા ચાલે, એ શું !! એ કંઈ સાવધાની ! પ્રભુની પૂજા વખતે મન ચોકખું કરવાની મહાન સગવડ છતાં મનના મેલની કેટલી બધી નાચિતતા, કે જો દણ્ણ બીજે ગઈ તો ખલાસ ! આંગળી નવ અંગે ફરી જાય તે માફ, બાકી મનની ગડમથલ જુદી જ ચાલતી હોય ! પછી મન ઠેકાણે રહે કર્યાંથી ? મનને ઠેકાણે લાવવાની જ્ઞાનીઓએ બતાવેલી યોજનાઓમાં પણ સ્થિર વિચાર ને પુરુષાર્થ નહિ ત્યાં શું થાય ? મનમાં સ્થિરતા લાવવા માટે અસ્થિરતા મૂકવી પડે. એ સમજવું જોઈએ કે “કિંમતીમાં કિંમતી મન મારી પાસે, તો શું એનાથી ઊંચામાં ઊંચી વિચારણાઓ ખૂટી ગઈ છે કે આવી ખોટી જળોજથા ચુંથું ?” ખોટી વિચારણાથી મન થાકે. એને નિદ્રા પણ વધુ જોઈએ. પછી એક નવકારની પણ સ્થિરતા ન રહે. એટલે કે મન બહુજ નિર્બણ, અસાર અને અસ્થિર બની જાય છે. માટે જ ધર્મ કિયા સિવાયમાં પણ મન મુફ્લીસ વિચારણામાં ન ભટકે તે જોવાનું.

કેટલા તરંગ નિષ્ફળ ? :- ધનદેવ અશુભ પૂર્વકર્મનો અભ્યાસ અને આ જીવનની હલકટ મનોવૃત્તિઓથી વિચારે છે, “એને ભોજનમાં જેર આપી દેવું, આપણે તો બે કામ થઈ જશે. આ દુશ્મનરૂપ લાગે છે તે ટળશે, અને પૈસા હાથમાં લાગી જશે.” શું છે આ ? ફરીથી ભવભમણની તૈયારીઓ ! નગર આગળ પડાવ નાખ્યો. એટલે ધનદેવ કહે છે, “હું ભોજનની તૈયારીઓ કરી આવું.” એમ કહીને

ગયો. ભોજન તેથાર કરાવ્યું. એક લાડુમાં જેર ભેળવી દીધ્યું. “બસ, જઈને લાહુ ખવરાવી દઉં, કે કામ પતી જાય.” તરંગની માણસને તરંગની લિમિટ (મર્યાદા) નથી હોતી, એ શેખચલ્લીના તરંગ ! લાહુ લઈને આવે છે, ત્યાં વિચારે છે કે “બસ, હું એવો અજાણ્યો બનીને હવે આ લાહુ ખવરાવી દઉં કે મિલકત આપણા હાથમાં. પરદેશમાં કોણ પૂછનાર છે કે આ કેમ મર્યાદ. અને આ પૈસા તો એટલા બધા છે કે આમાં તો ન્યાલ જ થઈ જવાનું છે...”આવા આવા તરંગમાં બે લાહુ લઈને આવ્યો ખરો પરંતુ એ ભાન ભૂલી ગયો કે ક્યો લાહુ જેરવાળો છે અને ક્યો લાહુ જેર વગરનો છે. પાપકર્મના ઉદ્ય જ્યારે આવી લાગે છે ત્યારે એકબાજુ તો કુમિથી એ ચમરબંધી ચકવર્તી જેવાને પણ એક રંક જેવો ગણે છે; પણ બીજી બાજુ એ પાપોદ્ય જાણે કહે છે, “કરે જા કરે જા તું તરંગ; બધા તરંગની નીચેની એક હેઠાં કુલ કે બધા તરંગ તારા કડકભૂસ કરી દઉં !” દિવસમાં તરંગ કેટલા ઉઠે, ને કેટલા ફેરીલ (નિષ્ફળ) જાય છે ? ઘણા ને ? કે એવો કોઈ તરંગ મનમાં આવતો જ નથી ?

ઉન્નતિ અને ઉજ્જવલતાની ચાવીઓ :- જીવનની જે ઉજ્જવલતા ગણાય અને જે ઉન્નતિ ગણાય તે ક્યારે બને ? કે જ્યારે

૧. જીવન તરંગી ન બનાવાય તો.

૨. હલકી ભાવનાઓને સ્થાન ન અપાય તો.

૩. અપ્રાપ્તની તૃષ્ણા ને પ્રાપ્તની મમતા ઓછી થતી જાય તો.

૪. ખોટા સંકલ્પ-વિકલ્પ જે મન કરે છે તેના પર કાબુ રહે તો.

૫. બધી વિચારણાઓ સાત્ત્વિક અને પદ્ધતિસરની કરવા માટે પૂરી જગ્રતિ હોય તો.

અનંગદેવ માટે જેર :- ધનદેવ અનેક વિકલ્પોમાં ચઢ્યો. એક ઊભી કરેલી ખોટી તૃષ્ણા કેટકેટલાં પાપ ઊભાં કરે છે ! જેને ચિત્ત નિર્મળ રાખવાની ઈચ્છા હોય, તેણે જગતના પદાર્થોની અન્યાયી-અજુગતી લાલસાથી દૂર રહેવું જોઈએ. જ્યારે આ હુષ ધનદેવ તો ક્યાં સુધીની પાપ વિચારણામાં ચઢ્યો ? “આ અનંગદેવને જેર આપી દઉં...” માત્ર વિચારણા કરીને અટક્યો નહિ પણ જેરવાળો લાડવો લઈને આવ્યો. મનમાં સંકલ્પ છે કે આ લાડવો એને આપી દઈશ; પણ તરંગમાં ને તરંગમાં એ ભૂલી ગયો કે બેમાંથી ક્યો લાડવો જેરવાળો છે. એ તો આવીને સીધો હોંશે-હોંશે અનંગદેવને જેર વગરનો લાડવો આપી જેરવાળો લાડવો પોતે લઈને હોંશે-હોંશે ખાવા બેઠો ! પછી હોંશે-હોંશે જ જેર મારે ને ? મનમાં શું હતું ? “બચ્ચા, ખાને લાડવો, હમણાં તેને ખબર પડી જાય છે. તું ધન શાનો લઈ

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્યુ કહા.” (ભાગ-૨૨)

૧૧૩

જાય ? આજે ઠીક ઘાટમાં આવ્યો છે. ખાઈ લે ! બસ, પછી મોટી રત્નોની કમાણીના બંદા માલીક થઈ જવાના !...” તરંગ પર તરંગ ચાલ્યા. ખબર નથી કે આ તરંગનો વિષય હું જ બનવાનો છું. દુર્જનતા સામે સજજનોના પુણ્ય જો કામ ન કરતા હોય તો તો દુર્જનોનું સામ્રાજ્ય ચાલે ને ? પુણ્ય એક એવી અટલ સત્તા છે કે સામેની ભલભલા ચમરબંધીની પોલિસીબંધ આકમક યોજનાઓ પણ રદ્દબાતલ થઈ જાય ! ત્યાં પેલાને નીપજતું કાઈ નથી, અને પોલિસી વગેરેનું પાપ માથે ચઢે છે. ધનદેવ તરંગમાં ચઠી ક્યાં સુધી પછિડાયો ? તો કે પોતાના લાહુનું જેર પોતાને જ અંદર પરિણામ પામી ગયું ત્યાં સુધી ! વિષની ઉગ્રતાથી અને ચક્કર આવવા લાગ્યા. દુનિયા ભમતી લાગી. ત્યાં થોડી જ વારમાં એ નીચે પટકાઈ પડ્યો. મૂર્ખ્યિત જેવો થઈ ગયો. ખબર પડી કે જેરનો લાડવો પોતે જ ખાવાનો આવ્યો ! પરંતુ હવે બાજી હાથમાં નહોતી. જેરની અસર આરપાર પહોંચ્યો ગઈ, પૂરો બેભાન થઈ ગયો. અહીં અવધિજ્ઞાની મહર્ષિ પોતાના અનંગદેવ તરીકેના ભવની હકીકત કહે છે કે ધનદેવની આ સ્થિતિ જોઈ હું (અનંગદેવ) તો હેબતાઈ જ ગયો ! “આ મરવા પડ્યો ? ભોજન તો અમે બનેએ હમણાં જ કર્યું. એટલામાં આજે આ શું થઈ ગયું ? હવે મારે શું કરવું ?” અને વિચાર કરું દું ત્યાં તો ધનદેવ તીક્ષ્ણ જેરની કારમી વેદનાથી મરી ગયો.

શલ્યનો ઉદ્ધાર એક મહાન કાર્ય ! :- જોવાની ખૂબી એટલી જ છે કે હવે પોતાને સમજાઈ જવું જોઈએ કે “ઝેર અનંગદેવને ખવરાવવાનું કર્યું, તે ઝેરે મારા જ પ્રાણ લીધા. અહો ! કેવી ખરાબ ભૂલ મેં કરી ? વળી એનું ફળ પણ મેં તત્કાળ ભોગવ્યું ! કેવો હું અધમાધમ ! લાવ. હવે ઠગાઈ છોડી દઉં... મારા દુષ્ટ્યનો પશ્ચાત્તાપ કરી લઉં...” આવો કોઈ વિચાર ધનદેવને નથી. એટલે જ શાસ્ત્ર કહે છે - “હુદયમાં પડેલા પાપશલ્યોનો ઉદ્ધાર કરવો ઘણો જ કઠીન છે.” શ્રી મહાનિશીથસૂત્રમાં શલ્યોદ્ધારનું એટલું બધું વિવેચન કર્યું છે કે એક જ જીવનમાંય શલ્ય કેટલાયે સેંકડો-હજારો વર્ષો સુધી નડ્યા કરે છે. પછી એ અનેક જીવનોમાં ભયંકર દુર્દ્શા સર્જે છે. તે ઉપરથી આત્માએ સમજવું જોઈએ કે આ જીવનમાં એ તત્વની સમજ મળી છે, તો શલ્યનો ઉદ્ધાર કરી લેવો ખાસ જરૂરી છે. અનાદિની અજ્ઞાન વિટંબણામાં જીવે કેવાં કેવાં પાપ સેવાં હશે તે કલ્યી લઈ આ જીવનને નિષ્પાપ બનાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. અહીંયાં મળેલી અનુપમ જિનવાણીમાં ખૂબજ સરળતાપૂર્વક તત્વની ઓળખ પ્રાપ્ત થાય છે. જો પાપને ઓળખવાનું મળે છે, તો જ પાપથી પાછા હઠબું સહેલું છે. ઓળખ નહિ ત્યાં શું થઈ શકે ? આની સ્થિતિ ઓળખની શક્યતા સામે પાપવૃદ્ધિની છે. પૂર્વના ભવમાં સિંહે ફાડી ખાધો

૧૧૪ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“અનંગદેવ અને ધનદેવ” (ભાગ-૨૨)

ઇતાં સદ્ગુરુદ્વિજી જાગી નહિ. પાપબુદ્ધિ મૂકવી મુશ્કેલ છે ! એજ જીવનમાં કરેલાં દુષ્કૃત્યોનો-વિશ્વાસધાતનો-ચોરીનો, અને અન્નાદાતા શેઠ જેવા પંચેન્દ્રિય મહાત્મા માનવને ફૂવામાં ઘડેલવાનો ભયંકર કીભિયો કર્યો. તેનું આ ફળ કેમ ન હોય કે હજી પણ પાપની ઓળખ નહિ. અહીંયાં પણ ઝેરથી મરે છે ઇતાં પણ દુબુદ્ધિ છોડવાની વાત નહિ. જીવનનું મૃત્યુ ખરું પણ દુબુદ્ધિનું મૃત્યુ નહિ ! આયુષ્યનો અંત ખરો પણ પ્રપંચનો નહિ ! કેવી કમનસીબી !

ભવેભવે મારવાની બુદ્ધિ સમાન, અને મારવાનું કાર્ય એક સરખું દેખાય છે તો સજામાં ફરક કેમ ? : ધનદેવ નરકે :-

ધનદેવ મરીને ચોથી નરક :- ‘પંકગ્રભા’ નામની પૃથ્વીમાં નવ સાગરોપમના આયુષ્યવાળો નારક-જીવ તરીકે ઉત્પત્તન થયો. વધુ ને વધુ નીચી નરક ક્યારે સંભવે ? દુબુદ્ધિની ઉગ્રતા વધુને વધુ વધતી જાય ત્યારે જ ને ? દેખાવમાં તો માત્ર દેખાય કે “આને માણું.” આટલી બુદ્ધિ કરી બધે. પરંતુ તેમાં એક વખતે પહેલી નરકમાં, બીજી વખત બીજુમાં, અને આ વખતે ચોથી નરકમાં ગયો ! મારવાનો વિચાર બધે સરખો છે પણ નરક તો વધતી જાય છે ! તો પ્રશ્ન થાય છે કે મારવાની જે બુદ્ધિ કરી એ બુદ્ધિમાં શું ફરક પડી ગયો કે સજામાં ફેરફાર થતાં, નીચી નીચી નરક સાધે છે ? હા, એ વાત નક્કી છે કે દુબુદ્ધિ સમાન હોય તો ફળ સમાન આવીને ઊભું રહે. દા.ત. ચાકુનો ધા એક સરખો થતો હોય તો એક પ્રહારે જે છેદ થયો, તેવો છેદ બીજા પ્રહારે પણ થાય. પરંતુ બીજો ધા જો ઊંડો પણ્યો છે, તો સમજવું પડે કે ભારે હોવો જોઈએ. તેમ અહીંયાં નરક મોટી મોટી થાય છે, તો દુબુદ્ધિ જરૂર વધુ ઉગ્ર હોવી જોઈએ.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૩, અંક-૪૩, તા. ૮-૭-૧૯૮૫

દુબુદ્ધિ ઉગ્ર શાથી ? :- દુબુદ્ધિને ઉગ્ર બનાવનાર છે પાપનો અભ્યાસ. જે પાપનો અભ્યાસ વધારે થવા માંડે, તેના માટેની દુબુદ્ધિ-માનસિક ખોટી લાગણી-વધુ ઉગ્ર બનતી જાય છે. રુદ્રદેવનો જીવ મારવાની કાર્યવાહી લેતો આવે છે ! તો એ અંગેની બુદ્ધિ બગડતી આવે છે ! પ્રપંચ ખેલવાનો અભ્યાસ કરતો આવે છે, તેથી પ્રપંચની દુબુદ્ધિ વધતી આવે છે. આ સમજ રાખો કે હિંસા, જૂઠ, માયા, અનીતિ, કામ, લોભ ઈત્યાદિનો જેમ જેમ અભ્યાસ વધે તદનુસાર દુબુદ્ધિ અંદરમાં વધારે વધારે વિકસવાની. માટે જ સમકિતી જીવ સંસારથી ગભરતો હોય; “જેમ જેમ હું આ સંસારનો વધારે અભ્યાસ કરીશ, તેમ તેમ મારી દુબુદ્ધિ વધારે પ્રબળ

ભુવનભાનુ અન્સાઈલ્કલોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાચિય કહા.” (ભાગ-૨૨)

૧૧૫

થતી જશે.” કહો ને સંસારમાં તમારે શાનો અભ્યાસ વધારે છે ? દુકાને જઈને સામાયિકની ભાવના જ ઝુકાવે રાખો છો ને ? અને બહેનો તો ઘરના કામકાજમાં જીવરકાની પૂજણીઓ જ લઈ-લઈને ફરતી હશે ને ? જીવનમાં જેમ જેમ દિવસો પસાર થાય છે, તેમ તેમ પાપનો અભ્યાસ વધે છે કે ઘટે છે ? એક પાપને અનેકવાર સેવવું તે તેનો અભ્યાસ ! આ અભ્યાસથી અંદરની દુબુદ્ધિ જોરદાર થવાની છે. કદાચ તેનો જોશ ખરેખરો અહીંયાં નહિ દેખાય, પણ ભવાંતરમાં એ જોરદાર દેખાશે. એટલા માટે સમકિતી અહરનિશ જંખે છે કે “હે પ્રભુ ! આ પાપના અભ્યાસથી ક્યારે છૂટો થાઉં ?” અરે પાપના અભ્યાસનો ભય તો ખરો જ, પણ એના સાધનભૂત પાપનાં અધિકરણ જે ઘરવખરી સુદ્ધાં, તેનો ય ભય હોય છે. આ જીવનમાં ચારિત્ર લેવાની ભાવના રાખી હોય, પણ જ્યાંસુધી અધિકરણોના ઉપયોગથી પાપનો અભ્યાસ ચાલુ છે, ત્યાંસુધી તે ચારિત્રની ભાવના માટે ઉપકારી નથી જ. કોડ રાખ્યા હોય કે, “મોટા થઈને ખૂબ ચારિત્ર પાણી લઈશું.” પણ ચાલુ જીવનમાં આરંભ-સમારંભ, પરિશ્રાહ, સ્વ કે પરના વિષય સુખની કાળજી, કોધાછિ લાગણીઓ વગેરેના અભ્યાસ પેલા કોડનું જ રાખે છે. “પર્યુષણાં ગયાં તો હવે ખૂબ ખાઈ પી લઈએ ! વળી નવાં પજુસણમાં તપનું જોઈશું.” આમ કરીને જેમ જેમ પાપના રૂચિપૂર્વકના અભ્યાસ વધે છે તેમ તેમ મલીન લાગણીઓ વધવાની. માટે ભાવનાઓ એવી જાગી જોઈએ કે જીવનમાંથી પાપ સંદતર નીકળી જાય.

વિકથામાં વિનાશ ! :- આ અવધિજ્ઞાની મહર્ષિના જીવન ચરિત્રમાં દુશ્મન દુર્દેવના પૂર્વ ભવોમાં આ વાત બરાબર જોવા મળે છે. દુબુદ્ધિ અને ખરાબ લાગણીઓ વધુ ને વધુ ઉગ્ર બનતી જાય છે એ નિશ્ચિત છે. કેમકે એને વધુ વધુ ધોર નરકોમાં ઘસડનારી થાય છે. તો એ પરથી આપણે આપણા જીવનમાં પહેલી તકે આ કરવા જેવું છે કે, ‘જ્યાં સુધી બધાં પાપ ન છોડી શકીએ ત્યાં સુધી ય બીનજરૂરી પાપો તો નીકળી જવાં જોઈએ જ.’ દા.ત. નવરા પડ્યા તો મનને થાય છે કે “લાવ ૧-૨ કલાક ગામગપાટા હંકી આવું.” પણ ખરી રીતે તો ત્યાં થવું જોઈએ કે-આ વિકથામાં પાપ એવાં રસવાળાં હોય છે કે એથી દુબુદ્ધિની ઉગ્રતા વધે છે; કુમતિનું જોર વધે છે. એમાંથી આત્મવિનાશ સર્જય છે. નિદા-કુથલી કરવામાં હૈયે સુમતિ નથી, કુમતિ છે. એ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં કુમતિનું જોર વધે છે. પછી ભલે આપણે કસાઈનું કામ હાથેથી ન કર્યું, પણ વાત-ચીતમાં એ પ્રસંગ લઈ આવ્યા કે ‘સાચ્યવાદીઓ આવા હતા, ને અમેરિકાએ એનો બરાબર ખોડો કાઢી નાખ્યો !’-આ પાપકથા છે. વાત શી કરી ? “સાચ્યવાદીઓ જોરમાં ઉઠ્યા હતા પણ અમેરિકાએ ઠીક ખોડો કાઢી નાખ્યો.” ઠીક ખોડો એટલે ? અમેરિકાએ જે

ભુવનભાનુ અન્સાઈલ્કલોપીડિયા-“અનંગદેવ અને ધનદેવ” (ભાગ-૨૨)

૧૧૬

કટલ કરી નાખી તે બરાબર થઈ ગયું ! શું નીકળ્યું આમાંથી ? જાતે કટલ ન કરી, પણ કટલને સારી માની ! એટલે ‘મનુષ્યની કટલ તે ભયંકર બૂરી ચીજ છે,’- એ જાતની દયાની લાગડીનું ખૂન થઈ ગયું ! ‘બિચારા જીવમાત્ર સુખને ચાહે છે. એને દુઃખ ન આવો.’- આ દયાની ભાવના મરી પરવારી ! અંતરમાં હિંસાની કુમતિ વધી. આજે એવા સુકુળમાં જન્મ્યો છે કે એ કાયાથી હિંસા નહિ કરે. પણ આ વિકથામાં જ એવું આયુષ્ય બાંધી લેશે કે એ આયુષ્ય જાણો નોટિસ આપી દેશે કે “જાઓ, અહીંયાં જે હિંસાની મતિ કેળવી છે તેને નરકાદિમાં વિકસાવો !”

ઘર તરફ :- નિદા-વિકથા બિનજરૂરી પાપ છે. તેને પહેલી તક દૂર કરવાની જરૂર છે, કેમકે એમાં કુમતિનું જોર વધે છે. એ ક્યાં સુધી લઈ જાય ? ભવાંતરમાં એવો ભવ આપી હે કે જ્યાં દયાનું નામ-નિશાન નહિ ! બિલાડીનું મોંહું એજ શરસ્ત્ર ! એનો અવતાર એટલે ફૂરતાનો જ અવતાર ! પૂર્વ વધારેલી કુમતિનું એ ફળ છે. પાપના અભ્યાસથી કુમતિનું જોર વધે છે. તે જાણી પાપનાં અભ્યાસ ઓછાં કરવા માટે બધાં બિનજરૂરી પાપોને દેશવટો દઈ દેવો જોઈએ. ધનદેવને પાપનો અભ્યાસ પૂર્વના ભવોથી વધતો ચાલે છે. એટલે આ ભવમાંથી ગયો ચોથી નરકના ભવમાં ! અનંગદેવ સજજન છે. તો એને મિત્રને મરેલો જોઈ ભારે દુઃખ થયું ! કારણની ખબર નથી. “અહાહાહા ! આ મિત્રને શું થઈ ગયું ? અરેરે, આવો સારો મિત્ર મરી ગયો ?” પાયખાનું પોતાની દુર્ગધ ગમે તેટલી ફેલાવે પણ પાસેનાં મોગરાનાં ફૂલ પોતાની સુવાસ નહિ મૂકે. એમ આ સજજન અનંગદેવ પોતાની સજજનતાની સુવાસ નથી મૂકી દેતો, ભલે ધનદેવ ગમે તેવો હતો. એનું મૃતકાર્ય કરી ઉદ્ધિગ્ન દિલે એ પોતાને નગર પાછો આવ્યો. આવીને ધનદેવના કુટુંબીઓને કહે છે, “મિત્ર તો મરી ગયો, પરંતુ એનો હિસ્સો તમે ત્યો. એય એના હિસ્સા કરતાં પણ અધિક લ્યો.” એમ કરી ઘણું ધન એના કુટુંબીઓને આપ્યું એને પોતાની પાસે વધેલા રત્નો સંન્માર્ગ ખર્ચી નાંયા.

ધનદેવના મૃત્યુ ઉપર અનંગદેવની વૈરાગ્ય ભાવના :- આપ કમાઈ શા માટે કરવાની ? આ દાનના પરાક્રમ કરવા માટે ! પૂર્વ એવી હોડ ચાલતી હતી કે “હું ફ્લાણા કરતાં વધુ દાન આપું.” ‘એની પાસે બંગલો છે, તેવો હું બાંધું,’- એમ નહિ, પણ ‘પરમાર્થ વધુ કરું’ એમ હોડ કરે. અનંગદેવ કમાઈ લાવેલાં રત્નો સંન્માર્ગ ખર્ચી નાખ્યાં એટલો જ પરમાર્થ નહિ. પણ ખરું તો મિત્રનો આવો કરુણ પ્રસંગ જોઈ વિચારે છે “મિત્રે મારી સાથે બધી ધાંધલ આપ કમાઈ માટે કરી, ને પેસા ક્યાં રહ્યા ? અને એ ક્યાં ગયો ? અને અંતે શું મળ્યું ? કેવળ પાપનાં સ્થાનક સેવીને પાપકમાઈ ! !” દુનિયાની બધી ધાંધલ કર્યાનું પરિણામ શું ? માલ

બીજા ખાય ! ને માર તમે ખાઓ ! એ જ કે બીજું કાઈ ?

કરે તેજ ભરે :- જાતે જેટલી અઠાર પાપસ્થાનકની ધાંધલ કરવામાં આવે છે, તેટલો પોતાના જ માથે ભાર વધે છે. ‘કરે તે ભરે’-આ દુનિયામાં દેખાય જ છે. મિત્રની જે પેસા પર આવી સ્થિતિ થઈ તેવા પેસાને શું કરવાના ? સન્માર્ગ જોડી ધો ! પાપસ્થાનક સેવીને, નવાં પાપ ઉપાર્જ, તથા વટાવાતાં પૂર્વ પુણ્ય ખૂટાડી પેસા લઈ આવ્યા; અને પાછા એ પેસાને પાપમય સંસારમાં જોડ્યા ! ! એટલે પાપની સીમા રહેવાની ? પુણ્ય ઉદ્યમમાં આવી સિલકમાંથી ખૂટવા તૈયાર હોય તો જ પેસા મલે. તેવા પેસા પાછા સંસારમાર્ગ ખર્ચાય એટલે નવાં પુણ્ય વધવાને બદલે પાપના સ્ટોક વધવાના.

અનંગદેવે પેસાની બાજુ જોઈ લીધી, સન્માર્ગ પેસા જોડી દીધા; અને મિત્રના મૃત્યુ પ્રસંગથી પોતે બાકીના સંસારના સુખ પ્રત્યે પણ દુર્ભાવવાળો બની ગયો. શું ? મિત્રના થયેલા અક્સમાત્ર મૃત્યુથી પોતાના ચિત્ત પર વિરાગની એટલી બધી ઊડી અસર થઈ ગઈ કે કમાઈ લાવેલાં રત્નો પર મૂર્ખા જાગી નહિ અને સમસ્ત સંસાર સુખો પર પ્રીતિ પણ રહી નહિ ! આ બેય વસ્તુ જીવનમાં થવી દુર્લભ છે. રત્નો પરથી મૂર્ખા ટાળીને પિતાના ઘરનાં બાકીનાં સુખોને પણ નકારવા માટે સાત્ત્વિકતા જોઈએ. અનંગદેવનો ત્યાં ભાગ્યનો સિતારો ચ્યામક્યો અને દેવસેન નામના આચાર્ય મહારાજ પધારતાં એ સંસાર ત્યજ અણગાર બની ગયા !

દારુની ઓળખમાં દારુથી દૂર રહેવું જોઈએ :- મોશ તરફની નિકટતા કેમ સધાય ? સંસારમાં બનતી ઘટનાઓ પરથી વસ્તુના પરમાર્થનો તાગ કઢાય. વસ્તુતાત્ત્વની ઓળખાણ થાય અને એને અનુરૂપ જીવન બનાવાય તો નિકટતા થાય. ધારો કે આપણો જોયું તો ખરું કે “આ માણસ દારુ ઢીંચીને પીઠામાંથી નીકળ્યો, અને બહાર આવી કપડાં દૂર ફગાવી દઈ નાગો થઈ નાયવા માંડ્યો ! ને પછી પડ્યો ગટરમાં !” આ નજરે જોયું ને પછી જો આપણે દારુના પીઠામાં પેસીએ અને દારુની બે બાટલીઓ મંગાવી લગાવીએ, તો દારુના સ્વરૂપને શું ઓળખ્યું ? તત્ત્વના સ્વરૂપને શું પિછાયું ? જોયું-પિછાયું તો એ કહેવાય કે “દારુ પીધા પછી આવા ભયંકર હાલ થાય છે, તો ન જોઈએ એ મારા જીવનમાં.” આ સ્વરૂપ સમજુને એવા સ્થળોથી ચાલતો થઈ જાય તો વસ્તુ સ્વરૂપ સમજ્યો ગણાય. બસ, અનંગદેવે તે જોઈ લીધું; ‘મોહના અને સંસાર પ્રપંચના નશાથી જીવની કેવી કફોડી સ્થિતિ થાય છે ! માટે મૂકી દઉં એને !’ ચારિત લઈ સારી રીતે પાણ્યું, અંતિમ આણશન કરી દસમાં દેવલોકમાં ઓગણીસ સાગરોપમવાળા દેવ થયા.

અનંગદેવ સ્વર્ગ :- અહીં પણ ખૂબી જોવાની છે. જેમ પેલા જીવને પાપનો

વધુને વધુ અભ્યાસ એ દુર્ભુદ્ધિ વધુ મળીન બનાવી એને નીચી-નીચી દુર્ગતિમાં મોકલે છે, તેમ આને ધર્મનો અભ્યાસ સદબુદ્ધિનું જોસ વધુને વધુ વધારી ઊંચા ઊંચા ટેવલોકમાં પહોંચાડે છે ! પછી આ વસ્તુ પણ સહજરૂપે બને છે, કે જગતમાં એકજ એવો પ્રસંગ જોઈ હિતનો માર્ગ પકડી લેવાય ! પૂર્વ જીવનના ચાલી આવતા સુંદર સંસ્કારથી ત્યાગ સહજપણે ગમે છે ! આજે આપણને જો આહાર છોડી તપ કરવા, અને ભોગ છોડી ત્યાગ કરવા માટે જો જોર કરવું પડતું હોય, મનને પરાણે મનાવવું પડતું હોય, તો તેનું મુખ્ય કારણ, પૂર્વજીવનોનો અભ્યાસ નથી, તે છે. પૂર્વ જીવનના આત્મગુણોનો અભ્યાસ સુંદર થઈ જાય તો પછીની જીવનમાં તે વસ્તુ સરળ બની જાય છે. ત્યાગ-બ્રહ્મચર્ય-દાન-શીલ-ને તપ બધું સહજ ! એવા પણ આ દુનિયામાં માણસો છે કે જે દાનશીલ, ત્યાગ-પ્રત વગેરે નિયમોને હૃદયના આંચળ વિના-મન પર કંટ્રોલ મૂક્યા વગર-સહજે કરી શકે છે. કદાચ આપણી પાસે એ અભ્યાસ નથી; તો હવે અહીંયાં પણ એ અભ્યાસ કરીએ તો ઉત્તર જીવનમાં સહજભાવે ધર્મની પ્રાપ્તિ થાય એમ છે; પરંતુ ખૂબ હૃદયના આનંદ સાથે એ ધર્મનો અભ્યાસ કરતા જઈએ તો. અનંગદેવને એ કોટિનો પૂર્વજીવનોનો અભ્યાસ છે એટલે સારોય સુખમય સંસાર છોડતાં જરાય જોર કરવું પડતું નથી ! સમજી લ્યો કે જીવન આપણે જે રીતે જીવવું હોય તે રીતે જીવી શકાય છે. અનંગદેવનું મન સહજરૂપે એ માર્ગ લાગી જાય છે. છેવટે આણશન કરી દેહનો ત્યાગ કરવામાં પણ વીર્યોલ્લાસ અપૂર્વ છે. તો મરીને દશમાં ટેવલોકે પહોંચી ગયા ! આયુષ્ય ૧૮ સાગરોપમ.

● અનંગદેવ-ધનદેવ ભવ સમાપ્ત ●

● વીરદેવ - દ્રોષક ●

જંબુદ્ધીપમાં ઐરાવતકૈત્રમાં ને હસ્તિનાપુર નગરમાં હરિનંદિ ગૃહસ્થની લક્ષ્મીમતી ભાર્યાની કુદ્ધીએ અનંગદેવનો જીવ દેવભવમાંથી અવી વીરદેવ તરીકે જન્મ્યો.

ત્યારે, ઠેઠ સોમાના ભવથી દુશ્મનાવટ કરનાર પતિ રુદ્રદેવનો જીવ અનંગદેવ સામે દુશ્મન ધનદેવ થઈ ચોથી નરકમાં ગયો છે. તે નવ સાગરોપમના આયુષ્યમાં કૂર રીતે કપાવા-છેદાવા પૂર્વકની ઘોર પીડાઓ વેઠી, ત્યાંથી નીકળી સર્પ થયો. અનેક જીવોને મારી-મારીને ઘોર પાપથી પોતાના પિંડને પોષ્યો, હવે કહો કે પરિણામ કયાંથી સારુ આવે ? વનમાં ફરતો કેઈ જીવોનો ધાત કરે છે; ત્યાં અચાનક એક વાર દાવાનળમાં ફસાઈ ગયો, તેમાં બળીને મર્યો. કુદરત જાણે કહે

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૧૧૮

છે કે ‘તું ગમે તે રીતે મર, એર ખાઈને મર, કે કપાઈને મર ! પણ રુદ્રદેવના ભવથી ક્રમાઈ લાવેલા દુર્ભુદ્ધિ તને છોડવાની નથી !’ તે એના પાપે મરીને પાછો એજ ચોથી નરકમાં પહોંચ્યો. કંઈક ન્યૂન એવા દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી નીકળી, એણે અનેક તિર્યચના ભવ કર્યા; અને પાછો વીરદેવ જ્યાં જન્મ પામ્યો છે, તેજ હસ્તિનાપુર નગરમાં મનુષ્યનો અવતાર પામ્યો. જુઓ ભવિતવ્યાતા ! વૃદ્ધ ઈન્દ્રશેઠની નંદિમતિ પત્નીનો દ્રોષક નામે પુત્ર થયો.

પ્રીતિ-કપટ :- એક બાજુ વીરદેવ અને બીજુ બાજુ દ્રોષક-બંને ઉછરવા માંચયા ! કળાઓ શીખ્યા. બંને વચ્ચે પ્રીતિ થઈ. પણ વીરદેવની પ્રીતિ સાચી અને દ્રોષકની પ્રીતિ કપટભાવની ! એવામાં એક વખત માનભંગ નામના ગુરુ મહારાજ હસ્તિનાપુરમાં પદ્ધાર્યો. જિનેશ્વરદેવનો માર્ગ પ્રરૂપ્યો. વીરદેવે અમની પાસે શ્રાવકર્થમ અંગિકાર કર્યો. આથી દ્રોષકને થયું કે “આ વીરદેવે ધર્મ સ્વીકાર્યો અને હું નહિ સ્વીકારું તો અને મારા તરફ એટલું આકર્ષણ નહિ રહે. તો હું પણ પ્રત લઉં જેથી અનો પ્રેમ વધે.” એમ વિચારી પોતે ઉભો થઈ ગયો અને આચાર્ય ભગવંત પાસેથી દ્રવ્યથી ધર્મ સ્વીકારી લીધો ! અર્થાત્ ભાવથી નહિ.

ધર્મની કદર :- પરિણામ એ આયું કે મિત્ર દ્રોષકે ધર્મ સ્વીકાર્યો એ જોઈ, અવધિજ્ઞાની મહર્ષિ કહે છે કે ‘મને (વીરદેવને) એના પર ધર્મપ્રેમને લઈને પ્રીતિ વધુ સ્થિર થઈ ગઈ !’ પરંતુ અનું પરિણામ શું ? કપટીની કપટલીલા આ ધર્મત્વાને વધુ ધોખામાં ઉતારનારી થશે. પાછો વીરદેવ પ્રીતિ વધારીને બેસી ન રહ્યો; ઉપરથી અને પોતાના ઘેર બોલાવી, “આ તો મારો સાધ્મિક ભાઈ !” એમ કરી ધયું દ્રવ્ય આપ્યું. પૈસાની ગઠી બાંધી આપી, કહ્યું ‘લઈ જા આ ધન, અનાથી અનિંદ્નીય-માર્ગ વ્યાપાર કરજે.’ દ્રોષક શ્રીમંત નહોતો. સામાન્ય સ્થિતિનો હતો. તેથી ધર્મના અનુરોગી વીરદેવને એ સ્વાભાવિક જ લાગે કે ‘મારો આ સાધ્મિક શા માટે એવી સામાન્ય સ્થિતિમાં રહેવો જોઈએ ?’ માટે ધર્મબંધુને ધન આપી ઉંચે લાવવા સગવડ કરી આપી. પોતે ધર્મત્વા છે એટલે પૈસા આપવા સાથે એ સાવધાની આપી કે “આનો અનિંદ્નીય-માર્ગ ઉપયોગ કરજે, પણ નિંદ્નીયમાર્ગ નહિ. હલકી કોટિના કે અનીતિના વ્યાપાર ન કરતો, કે લોકમાં અધમ ગણાતો ઉપયોગ ન કરતો.”

ધર્મરાગનું પ્રતીક શું ? :- અહીં વીરદેવનો ધર્મરાગ જોવા જેવો છે. દ્રોષક ધર્મ સ્વીકારે છે એટલા માત્રથી વીરદેવ અને અઢળક દ્રવ્ય આપે છે. આપણે આપણી જાત માટે વાત તો ખાસી મહેની કરીએ છીએ કે ‘અમનેય ધર્મપ્રેમ છે; અમે કંઈ અધર્મી નથી; અમેય ધર્મના રાગ વિનાના નથી.’-પરંતુ આ આપણો

૧૨૦ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“વીરદેવ-દ્રોષક” (ભાગ-૨૨)

દાવો કેટલે અંશે વ્યાજબી છે એ ખૂબ ખૂબ વિચારણા માગે છે. આપણા ધર્મરાગનું પ્રતીક શું છે ? જે વસ્તુ પર પ્રેમ છે એનો ગમે ત્યાં ય વિકાસ થાય; પણ તેથી આપણાને જો પ્રેમ ન ઊભરાય તો એ વસ્તુ પર પ્રેમ શાનો ?

આપણે કહીએ કે ‘પ્રભુભક્તિ ઉપર અમને પ્રેમ છે;’ પણ જો બીજાને ત્યાં પ્રભુભક્તિ વિકસતી દેખાઈ તે ખમાતી નથી, તો શુદ્ધ પ્રભુ-ભક્તિના પ્રેમી આપણે ક્યાં રહ્યા ? જો શુદ્ધ પ્રભુભક્તિનો પ્રેમ છે તો તે ગમે ત્યાં દેખાય,-આપણા દુશ્મનમાં પણ દેખાય,-તોય ‘એ મારા નાથની ભક્તિ છે’ એમ સમજુ એ પ્રભુભક્તિ ઉપર પ્રેમ જ થવો જોઈએ. અરે ! એટલું જ નહિ પણ એ પ્રભુભક્તિ ગમવાની રૂએ એને આચરનારા પ્રત્યે દુશ્મનાવટ ભૂલાઈ જવી જોઈએ. કાં તો પ્રભુભક્તિ ઉપર તેવો પ્રેમ નથી. એટલે અંતરમાં પ્રભુભક્ત ઉપર દુશ્મનાવટ તેટલી જ ખડી રહે છે. અથવા દુશ્મનાવટના અંધાપામાં આપણો એની મહાકિંમતી પ્રભુભક્તિ જેવી ચીજને બહુ માનવા તૈયાર નથી. તેથી કેટલીકવાર આપણા ઉદ્ગાર નીકળી પડે છે કે ‘હવે જોઈ-જોઈ એની પ્રભુભક્તિ ! જોયો-જોયો એનો તપ ! લુચ્યાએ અમારી સામે કેટલું કર્યું છે !’ શું છે આ ?

વેરનો અંધાપો :- વીરદેવને દ્રોષકમાં વ્રતસ્વીકાર જોઈ પ્રેમ વધી ગયો. તેમાં એને પહેરામણી કરી.

કેટલેક સ્થળે દેખાય છે કે એક પ્રભુભક્તિ કરનારી ભજન મંડળી બીજી તેવી ભજન મંડળી ઉપર ઈર્ઝા કરે છે, શાસ્ત્રો ભણેલો એક વિદ્વાન શાસ્ત્રો ભણેલા બીજા વિદ્વાન ઉપર ખાર રાખે છે. દ્યાદિ પરોપકારનાં કાર્ય કરનારી એક સંસ્થા બીજી સંસ્થાનું ઘસાતું બોલે છે. આમાં, “પ્રભુભક્તિ શાસ્ત્રજ્ઞાન એને પરોપકાર એ જીવોને આશીર્વાદભૂત વસ્તુઓ છે, તો ગમે ત્યાં વિકસો. એ જોઈને મને ખુશી થાય છે,”- એ વસ્તુ ક્યાં રહી ? આવા આત્મોપકારક પદાર્થોં પરનો શુદ્ધ પ્રેમનો એ મહિમા છે કે એ અવશ્ય તે પદાર્થોની અનુમોદના કરાવે. જો અનુમોદના નથી તો વિચારવું પડે કે શુદ્ધ પ્રેમ હશે કે કેમ ? અથવા આપણો વસ્તુ કરતાં પ્રભુએ ફરમાવેલી હિતકરણી વધુ ગમે છે કે કેમ ? જેની પાછળ આપણે છતી શક્તિએ ભોગ આપવા તૈયાર નથી એ આપણાને કેટલું ગમ્યું ગણાશે ? જેની ખાતર ઘસારો વેદાવા મન નથી ઉદ્ઘણતું એ આપણાને કેટલું ગમ્યું કહેવાશે ? દુનિયામાં જુઓ છોકરી પર પ્રેમ છે તો જમાઈ પર પ્રેમ થાય છે, એના છોકરા ઉપર પ્રેમ થાય છે. અને એ બધાની ખાતર ઘસારો વેદાય છે. એજ પ્રમાણે જો ધર્મ પર ખરેખર પ્રેમ છે તો ધર્મના સંબંધીઓ પાછળ ભોગ કેમ ન અપાય ? ઘસારો કેમ ન વેદાય ? ત્યાં પછી બહાના કાઢીએ તો એનો અર્થ એ છે કે ‘ધર્મ ઉપર અમને પ્રેમ

છે ખરો, પણ આટલી શરતે.’ શી શરત ? એજને કે “ધર્મ આચરનારો અમારો મિત્ર જોઈએ, અથવા અમારા ગુણગાન કરનારો જોઈએ.”... વગેરે. બસ અહીં જ પ્રેમને બદલે સોઢો દરે છે, બહાના શરત વિનાના ધર્મરાગમાં તો એની પાછળભાવ ભક્તિમાં તૂટી પડાય; ભારે ભોગ આપવા ઉમળકા હોય; અને કદાચ એ ન બન્યું તો કેટલોય ખેદ થાય કે ‘અરેરે ! હું કેવો અક્કમી કે ધર્મના રાગની પાછળ આપવા સાથે એ પણ કહ્યું કે આનો અનિધમાર્ગે ઉપયોગ કરજે. અર્થાત્ તેવા કઠોર ધંધા કે અનીતિ આદિના ધંધા કરતો નહિ. જીવનમાં પોતાને ધર્મ રુચ્યાનું અને સામા પર સાચી હિતબુદ્ધિ ધરવાનું આ પરિણામ જોઈએ કે અનીતિ, કઠોરતા વગેરે ત્યજ સદ્ગ્યવહાર નજર સામે રહે.

દ્રોષક કમાય છે, પણ બુદ્ધિ બગડે છે :- દ્રોષકે વેપાર શરૂ કર્યો. એમાં પુષ્યના યોગે નફો ખૂબ કર્યો. પણ એથી જ હવે એ પૂર્વકૃત કર્મની વાસનાનો ભોગ બન્યો. વીરદેવને ઠગવાનું મન વધ્ય. જોજો પૂર્વની વાસના કામ તો કરે છે, પણ પૈસા હાથમાં ન આવ્યા ત્યાંસુધી શાંતિ હતી, હવે જ્યારે પૈસાનું નિમિત્ત હાથમાં આવ્યું, તો દ્રોષકની બુદ્ધિ બગડી. દુર્બુદ્ધિ કરાવનારા નિમિતો ભયંકર હોય છે. એ મજબૂથી દુનિયામાં ભલે બીજી રીતે શાબાશી ગવાતી હોય કે સુખસગવડ મળતી હોય, પણ પશુતાના સિક્કા જેવી એને દુર્ગતિની દૂતીસમી દુર્બુદ્ધિ કરાવે ત્યાં પછી એની કોઈ કિમત રહેતી નથી. જીવનમાં શાબાશી કે સુખસગવડની જે કિમત નથી તે સદ્ગુદ્ધિની છે. સુખ ન હોવાથી જે નુકસાની નથી, તે દુર્બુદ્ધ હોવાની છે. મોદેરા માનવભવનું મૂલ્ય સમજતા હો તો આ બહુ ધ્યાનમાં રહે કે ‘શું હું અનંત-અનંત કાળથી દુર્બુદ્ધિથી આવોને આવો ખરડાયેલો જ રહું ? ના, ના એની અપવિત્રતા હવે મને ન આભડે.’ કુલીન સ્ત્રીને શું થાય છે ? ‘અશીલની અપવિત્રતા મને સહેજ પણ ન આભડે.’ એવું ધર્મ જીવને દુર્બુદ્ધિને દૂર રાખવાની સાવધાની હોય. પામર દ્રોષક બનાવટી ધર્મ છે. તેથી દુર્બુદ્ધિનો એને કોઈ ડર કે અફ્સોસ નથી. પૈસા તો વધ્યા પણ ખરી રીતે તિજોરીના વધ્યા. આત્મામાં તો દુર્બુદ્ધ વધી ! ત્યારે માણસ કેટલો મૂર્ખ છે કે દુર્બુદ્ધ દારા પોતાના આત્માને બગાડીને પણ તિજોરીનું સુધારી રાખવા ખરેપગે સાવધાન છે ! બસ હાથો, તે કે જે પારક જડનું સુધારવા ને જડ જેવા સ્નેહીનું સુધારવા પોતાના આત્માને, મનને અને હૈયાને ન બગાડે. અહીં વીરદેવે તો ધર્મરાગથી દ્રોષકને ધન આખ્યું હતું. પણ જુઓ કે આમાં એ હિસાબ ક્યાં રહ્યો કે માણસને આપણો અનુકૂળતા કરી આપીએ તો એની બુદ્ધિ સુધરી જાય ? કહો છો ને “કે માણસને આપત્તિ હોય ત્યાં

બિચારાને શી રીતે સારી બુદ્ધિ જાગે ? સગવડ-અનુકૂળતા હોય તો સદ્ગુદ્ધિ જાગે.” પણ એમ નથી. ખરી રીતે ખાસ જરૂરી ધર્મભાવના અને પવિત્ર દિલ છે. એનો થોડો પણ અંશ નહિ હોય તો બીજી સગવડ ઉલટું પાપ વધારશે, નહિતર તો આ દ્રોષકને સગવડ તો કરી આપી. તેથી હવે તો સદ્ગુદ્ધિ જાગે ને ? ના, આને તો ઠગાઈની બુદ્ધિ વધતી ચાલી !

વિચાર કરે છે કે “પૈસા તો હું કમાયો, પણ અમારા બને વર્ષેનો યથાસ્થિત વ્યવહાર શો થયો છે તે કોઈ જાણતું નથી. તેથી શું કરું ? મને મૂળ મૂરી વીરદેવે આપી છે. એટલે એ જરૂર ભાગ માગશે. કેમકે એ વખતે એણો ફોડ નહોતો પાડ્યો કે ‘જા તને આ પૈસા આપી દીધા. એનો જે નફો આવે તે તારો.’ એટલે હવે એ સામે આવીને ઉભો રહે ત્યાં લોકની વચ્ચમાં મારાથી જૂહું બોલાય નહિ; અને બોલું તો લોકનો એના પર વિશ્વાસ હોઈને મારું જૂહું નભે નહિ.”

પરંતુ વાસ્તવિક આવું કંઈ હતું જ નહિ ! વીરદેવે તો સાધર્મિક જાણીને પહેંચામણી કરી હતી. પણ આ દિલનો હલકટ ઊંધો જ વિચાર કરે છે ! કે “મહેનત મેં કરી અને પૈસા અને આપવાના ?” કુવિકલ્પની જાળ જ એવી છે કે એક કુવિકલ્પનું ગૂંચણું મનમાં ભરાયું કે બીજા પાંચ ગૂંચણાં તૈયાર જ હોય. એક ઊંધો રસ્તો લીધો એટલે કેમ ? તો કે બીજા અનેક ઊંધા રસ્તા પકડાઈ જાય, અને મૂળ રસ્તાથી આધો ને આધો થતો જાય. એક ખોટા મનોરથનો ચીલો લીધો કે બીજી અનેક ખોટી માન્યતાઓમાં ભૂલા પડી જવાય.

જુઓ એના વિકલ્પના મણકા જેવા કેવા વધતા જાય છે ! “ભાઈ ! મૂરી તો એની છે; એટલે ભાગ માગશે તો ?” આ મથાળું બાંધ્યું, હવે આગળ ચાલે છે ! “મહેનત આપણે કરીએ અને એ શાનો નફો માગે ? એની પાસે ક્યાં ઓછું છે ? અને એમ આપી દઈએ તો આપણે લુખ્ખા થયા પછી આપણી કિંમત શું ? આમેય આપણને એ નજરે જોયો ય ગમતો નથી; તો બસ ! એને હું ઠગી નાખું ! અરે ભલુ પૂછવું ભાઈ ! પૈસા એણો આપ્યા છે, ને હવે એ બહાર જઈને વાત કરે કે ‘ફલાણા ફલાણાને ઊંચે લાવનાર તો હું છું. પૈસા મેં ધીર્યાતા અને હવે એ નફો કે મૂરી કશું આપતો નથી.’ હાય ! તો લોકો મારા માટે કેવું માની લે ? વળી, એ રહ્યો પ્રતિષ્ઠિત...એનું કહું બધા સાચું માને. હું જૂહું કહું...તે કંઈ ચાલે નહિ. અરેરે ! તો મારે હવે શું કરવું ?...”ચઢ્યો વિચારમાં.

કુવિકલ્પનાં ગૂંચણાં :- મહાપુરુષો જે આ ચરિત્ર લખે છે. તે કેવું લખે છે ? જાણે આપણા મનના ફોટા લઈને ચરિત્ર ન લખ્યા હોય ! તે મન પછી કોઈને કદાચ પૈસા અંગે વલોપાતમાં ન હોય તો માન-પાન અંગે હોય; એ નહિ તો વળી

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૧૨૩

બીજી વસ્તુ અંગે. પણ કંઈને કંઈ ગૂંચણાં મનમાં ચાલતાં જ હોય છે. ત્યાં આ દ્રોષકની વાત વિચારતાં આશ્ર્ય લાગે છે; હાસ્યાસ્પદ જણાય છે, ખરું ને ? પણ તે વખતે આપણે આપણી જાતનો વિચાર કરવો ભૂલી જઈએ છીએ, કે આપણે ક્યાં ઓછા ગૂંચણાં વાળીએ છીએ ? આપણું મન એટલે જાણે સિનેમા-પિકચર્સ પ્રોડ્યુસર ! સિનેમાના ચિત્રોનું સર્જનકાર ! કુવિકલ્પનાં ગૂંચણા વાળવામાં પૈસા-માન-પાન-ઈજઝત-આબરુ-તેમાંનું કંઈજ વધતું નથી. બલ્કે વધે છે માત્ર હાય ને બળાપો ! શોક ને અરતિ ! દેખ ને ઈર્ઝા ! સત્તવ હણાય છે. અંતરનું ઓશિયાળાપણું ને દીનતા વધે છે. દ્રોષક આગળ વધે છે :- “બસ, બસ, એ જરૂર મને ફંજેત કરવાનો. વળી ત્યાં આપણો કોણ સાક્ષી ? માટે સીધો રસ્તો એક છે કે એને બીજું કંઈ કર્યા વિના ખતમ જ કરી નાખવો ! પછી તો લોકમાં હું જેમ કહીશ તેમ ઊપજશે.” શાથી આ વિચાર આવ્યો ? પૂર્વની પાપ-વાસનાથી. મૂરી એણો આપી છે એ નથી જોતો, પણ પોતાની મહેનત જુએ છે. તેથી ‘મહેનત મારી અને એ ભાગ શાનો માગે ?’ એમ વિચારે છે.

સ્વાર્થ રૂચિના મંડાણ ઉપર દોષવૃદ્ધિ :- જ્ઞાની ભગવંતોએ લાગણીઓ અને વિચારોનાં કરેલાં વર્ણન સાંભળતાં આપણાને જાણે એમ લાગે છે કે આપણાં જ ભાવો એ વર્ણવી રવ્યા છે. ખરી રીતે જેમ જગતમાં જો કડવી લિંબોળી વાવો, તો એમાંથી અમુક અમુક કમે કડવા લીમણાની વસ્તુઓનું સર્જન થવાનું. અને આંબો વાવો તો એની વસ્તુઓનું સર્જન થવાનું. બસ, એવું જ આપણા હૃદયમાં બીજરૂપે રહેલી સ્વાર્થ કે પરમાર્થની રુચિ ઉપર અશુભ કે શુભ લાગણીઓનાં તથા વિચારોનાં સર્જન થાય છે. અલબત એમાં માણસ-માણસ વચ્ચે એ લાગણીઓ-વિચારોના આકારમાં અમુક તફાવત હોય પણ મુખ્ય રૂપક સરખું રહે છે. એને આપણે સ્વયં બુદ્ધિથી વિચારવા બેસીએ તો એમ જ જણાય. એટલે,

પ્રગતિનો આ માર્ગ છે :-

(૧) આવા આવા શુભાશુભ પરિણામો આપણા દિલમાં થતા જોઈને એમાં કારણભૂત મૂળ રુચિને ઓળખી લેવી જોઈએ.

(૨) એમાં સ્વાર્થની રુચિ જે જે દેખાય તેને તેને જેમ બને તેમ મંદ કરી નાખવી ઘટે.

(૩) પરમાર્થની પ્રીતિને વધુને વધુ વિકસાવવી જોઈએ. એમ

(૪) આત્માના દોષોનો તિરસ્કાર, અરુચિ વધવા જોઈએ. કદીય એ હુગુંઝોની રુચિ આસ્થા, કે નિર્ભયતા થવા દેવા નહિ.

(૫) માત્ર આત્મગુણોની રુચિ દિન પ્રતિદિન વિકસ્વર બનવી જોઈએ.

૧૨૪ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“વીરદેવ-દ્રોષક” (ભાગ-૨૨)

ઉચ્ચ એવા માનવભવમાં મનને નક્કી થઈ જવું જોઈએ કે ‘જેમ જગતના પામર મનુષ્યો અને બીજા જીવોને ખાનપાનના, રંગરાગના, ને આરંભ-પરિચહણના જીવન હોય છે, એવી રીતે આપણે માટે દુર્ગુણ-નિકાલ અને ગુણોપાર્જનનું જીવન જોઈએ. શું સમજ્યા ? દોષનિયંત્રણ અને ગુણવિકાસનું જીવન જોઈએ. અયેતન જેવા જણાતા ચંદન, શેરડી, આંબા વગેરેનાય સ્વભાવ દેખાય છે કે એને જેમ વધુ પીડીએ, તેમ એ પોતે વધુ પરમાર્થ કરી બતાવે છે. તો પછી આપણે તો મહાયેતન જેવા; તે શું પાછા પડીએ ?’ આવું કોક પ્રશસ્ત ગુમાન જાગ્યા વિના સત્ત્વ ક્યાંથી ખીલે ?

જાતે જાગ્રત બની રહો :- વીરદેવનું સત્ત્વ ખીલેલું છે. દ્રોષક પ્રત લઈને સાધમી બને છે. એટલા નિમિત્ત માત્રથી લક્ષ્મીની મૂર્ચ્છા ઓછી કરી નાખીને સાધર્મિભક્તિનો ગુણ વિકસાવે છે. સત્ત્વ આકાશમાંથી નથી પડવાનું; આપણે જ ખીલવવાનું છે. એ ખીલવીને દોષભૂષણ, ગુણવૃદ્ધિના ઉદ્ઘમમાં આપણી જાતે જ જાગ્રત રહેવાનું છે. જાતે જો જાગ્રત નહિ રહ્યા તો તો આપણા પૂર્વના કુસંસ્કાર અને અહીંના પ્રલોભક સંયોગો, બેંં ભેગા થઈને કુમતિ અને કુપ્રવૃત્તિ તરફ આપણને ઘસરી જશે.

પૈસાની કરુણ કથની :- વીરદેવ ઉપકારી છે; દ્રોષકને પૈસા આપીને ઉંચો લાવનારો છે. છ્ટાં તેને પણ મારી નાખવા સુધીની બુદ્ધિ દ્રોષકને જાગી ! દ્રોષક જાગ્રત નથી. પૂર્વની વાસના પગભર થવામાં નિમિત્ત કોણ બન્યું ? પૈસા ! પૈસાની તો કરુણ કથની છે. સારામાં સારા ઉપકારના બેનેલા પ્રસંગને અપકારથી નવાજવાનું કરાવે આ પૈસા ! સારામાં સારી સેવા કરનારને લાતે મારવાનું કરાવે આ પૈસા ! મહાનમાં મહાન ગણાતા દેવાધિદેવને ભૂલવાનું અને આચાર્ય ભગવંત જેવાને પણ તુચ્છકારવાનું કરાવે આ પૈસા ! એવા એ પૈસાની આવી ઓળખાણ કરી લઈ તે ઓળખાણ હૈયામાં સ્થિર કરવા જેવી છે, જેથી એના નિમિત્તે જીવનમાં કાંઈજ અનુચિત ન બનવા પામે. દ્રોષક વિચાર કરીને અટક્યો નહિ, હવે એ એના માટે ઈલાજ ઘડવા માંડ્યો. પણ ઈલાજ સફળ શી રીતે થવાનો ? એઝો મનમાં નક્કી કરી લીધું કે “વીરદેવને હમણાં મારા પર પ્રીતિ એવી છે કે હું જે કહીશ તે એ કબૂલ કરશે. માટે દાવ ખેલી લેવાનો અવસર છે.” ઠણાઈની કોઈ હડ છે ? જાણે છે કે સામાનો મારા પર પૂરો પ્રેમ છે, માટે જંબે છે કે ધાર્યું કરી લઉં ! શું ધાર્યું એટલે ? પશુકરણી ! દ્રોષક પાસે પૈસા હતા. મોટી હવેલી બંધાવી, ઉપલા મજલા પર જરૂરો કાઢ્યો. પણ ફોલિંગ અર્થાત્ વાળેલો, કે સીધો રાખી શકાય એવો જરૂરો ! એટલે જરૂરાની નીચે ખીલો ભરાવ્યો હોય તો જરૂરો સ્થિર રહે. નહિતર

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૧૨૫

બંધ થઈ જાય. દ્રોષક વિચારે છે, “બસ, આ જરૂરાની નીચે ખીલો રાખવાનો નહિ, સહેજ અડકણ રાખીને એને ઊભો રાખવાનો; અને ઉપર વીરદેવને રમ્ય-દર્શનીયતાદિ ગમે તે નિમિત્તે ચઢાવી દેવાનો ! ચઢતાની સાથે જ નીચે ! ને... ખતમ ! વળી લોકમાં અપવાદ પડ્યા નહિ થાય. કોઈ કહેશે નહિ કે આણો લોભથી વીરદેવને માર્યો ! બસ, પછી બંધાને કોણ પૂછનાર છે ?”

દ્રોષક જાતે જ જરૂરે ચઢે છે :-

યોજનાનુસાર નૂતન મકાનમાં ગમે તે પ્રકારે મિત્રને જમવા નોતર્યો, વીરદેવ ભોળા ભાવે આવ્યો. જર્યો. હવે દ્રોષક કહે છે, “ચાલો ઉપર, મેડી દેખાયું,” એમ કરી પોતે આગળ અને પાછળ વીરદેવ. હવે કેમ ? બસ, પોતાની ધારણા બહુ જ નજીકમાં આમ સફળ થતી લાગે છે. “ચઢાવી દઉં છું, કે કામ પતી જાય !” તરંગમાં ચઢ્યો ! “પછી દુનિયામાં આપણો નામ જમાવી દઈશું ! અહીંયાં પણ આ પડતાં જ હાહાકાર કરી દઈશ... કોઈને ખબર નહિ પડે...” ઉપર લઈ ગયો. તરંગમાં છે. એટલે એટલું ભાન ભૂલી ગયો કે ‘જરૂરાની નીચે ખીલી ચઢાવી નથી; પોતે ત્યાં ન ચઢવું જોઈએ.’ સ્મૃતિબ્રંશ થઈ ગયો. આ શું સૂચવે છે ? વિનાશકાળ નજીક હોય અને માણસ તરંગી હોય, એને અવસરે જ મતિ બહેર મારી જાય છે. દ્રોષક મુખ્ય મુદ્દો જ ભૂલી ગયો. વીરદેવને મહેલની રમણીયતા દેખાડુા માટે “આવો, આવો, વીરદેવ,” એમ કહી જરૂરા ઉપર પોતે જ એકલો પહેલો ચઢ્યો ! ભૂલભૂલામણીમાં પડી ગયો ને ? પરંતુ આશ્ર્ય પામતા નહિ. આવું બનવામાં નવાઈ નથી. કોઈમાં ઘણી ધારણાઓ કરીને ગયા હો, ને “વકીલને આમ ઉત્તર આપીશ, ને તેમ ઉત્તર આપીશ...” વગેરે ધારી રાખ્યું હોય. પરંતુ મોકો આવતાં જ ઉત્તરમાં ઉંઘું મારી બેસો ! એવું બને છે ને ? દ્રોષકને એવું જ થયું. બધી ધારણા કરી રાખી હતી; પણ મોકો આવતાં મુખ્ય મુદ્દો જ ભૂલી ગયો.

વિકલ્પોની ધોંસનો આ પ્રભાવ છે કે માણસ ભૂલભૂલામણીમાં પડી જાય. વિકલ્પોને જગાવનાર કલ્પના છે. જો કલ્પના અસત્ત, તો વિકલ્પો પૂરજોશમાં અસત્ત કોટિના દોડે છે. એક અસત્ત કલ્પના મગજમાં ઘાલી કે સમજો કે બાર વાગ્યા. કેમકે એના પાયા પર હવે કુવિકલ્પોની હારમાળા ગોઈવાશે. તપાસજો જ્યારે-જ્યારે મન ધોધમાર ખોટા વિકલ્પોમાં જીલી રહ્યું હશે ત્યારે ત્યારે મૂળે કોઈ ખોટી કલ્પના થઈ હશે, તો પછી સમજો કે જો કલ્પનાને અસત્તને બદલે સત્ત કરી દઈએ તો ઉપરનું આખ્યું મંડાણ કેટલું સુંદર સારા વિકલ્પોથી શોલી ઊંઠું બને ! આજ ખૂલ્લી વાપરવાની છે કે કલ્પનાને ખોટામાંથી સારા રૂપમાં વાવી લેવી. દા.ત. શરીરે રોગ-બિમારી આવી. ત્યાં કલ્પના થાય છે. ‘અરે ! કેટલું ખરાબ થયું ?’ પછી એના પર

૧૨૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વીરદેવ-દ્રોષક” (ભાગ-૨૨)

પાપવિકલ્પોની હારમાળા ચાલે છે, એના બદલે જો કલ્પના એવી જ ખડી કરી કે ‘શું આ ? પૂર્વે દયા નહિ પાળેલી, કે અરિહંતદેવને નહિ ભજેલા, તેથી અશુભ કર્મના યોગે આ બિમારી આવી, હવે આ કલ્પના ઉપર શુભ વિચારોના થોક જન્મી શકે. દ્રોષકને કલ્પના જ ખોટી છે.’ “પેસા હું મહેનત કરી કમાયો અને વીરદેવને શાનો આપી દઉં ?” આના પર હવે ખરાબ વિકલ્પો કેમ ન જન્મે ?

નિષ્ફળ વિકલ્પો મનને નબળું કરે છે :- વિચારણા કેટલા વખતથી કરી રાખી છે ? ધંધાય વખતથી. પેસા મહ્યેથી વેપાર કરી નઝો કર્યો ત્યારથી. તે પછી તો ધર બંધાયું એમાં પાડનારા જરૂરાની યોજના કરી. બસ આ બધો વખત મને ગુંચણા વાયા કર્યા. પણ પરિણામે જો જો કે મીઠું ! ત્યારે જેમ શરીર પાસે કરાવેલી ફોગટની દોડધામ માથે પડે છે; તેમ આ મન પાસે કરાવેલી દોડધામ પણ માથે પડે છે. કોઈ સ્વાર્થ લાલસાથી ઠગાયેલું મન ચંચળ થઈ જાય છે. પછી અશુભ એવી બહુ વિચારણાઓ મનને એવું ચંચળ બનાવી દે છે કે સારી વિચારણા માટે મન સ્થિર કે સમર્થ રહેતું નથી; અને એ વસ્તુ માત્ર ધર્મમાંજ બને છે, એમ નથી; વ્યવહારમાં પણ એમજ છે. નહાવા બેસે ત્યાં ખાવાના વિચારમાં, ને ખાતાં ખાતાં પેસાના વિચારમાં ! નિષ્ફળ વિકલ્પોથી ભરેલી મનની સ્થિતિ મનને નબળું બનાવી દે છે; અને તે મન ક્યારે ને કેવા અનર્થ કરી બેસે, તેનું માપ નહિ ! દુનિયાના મોટા માણસોના મન સાબુત હોય છે. એમના માથે બીજાને તો મગજ બહેર મારી જાય કે ચિત્તભ્રમ જ થઈ જાય એટલાં લફરાં હોય; પણ પોતાના મન પર કાબુ એવો રાખે છે કે મફતિયા વિચારોમાં મનને દોડવા નહિ દે. જે સમયે જે કાર્યની જવાબદારી આપણે ઉપાડી, તે સમયે તેની જ ચિંતાને બદલે બીજી ચિંતાઓ કરવામાં ટેવાયેલું મન આત્મહિતના મુદ્દાના, મહત્વના કાર્યમાં તો કયાંથી ભલીવાર રાખશે ? ધાર્મિક-દિષ્ટિએ આત્મહિતના આપણી પાસે મહત્વનાં કાર્ય સામાયિક-પૂજા વગેરે છે. તે સાંગોપાંગ ત્યારે પાર ઉત્તરે કે જ્યારે મનને ફજુલ વિચારોથી બચાવી લઈએ તો. મન નવું પડે તો ફાજલ વિચારો આવે ને ? ખોટી વિચારણા કરવાનું છોડી મુદ્દાસરની વિચારણા રાખીએ તો મન સ્થિર થાય. એ ન હોય તો ‘નમો અરિહંતાણ’નો જાપ કયાં ઓછો છે ? જ્યાં ખોટી કે મફતિયા વિચારણા આવી કે નમો અરિહંતાણનો જાપ. આત્મા પર પાપનો ભાર એટલો અને એવો છે કે જીવનભર પરમાત્માનો જાપ કરીએ તો પણ ઓછો છે. એથી લાભ બે થાય; સારી વિચારણામાં ૧. એક તો પાપક્ષયનો અને બીજું ૨. મનને સાચ્ચિક બળવાન થવાનો મોકો મલે તે લાભ. જેટલા પ્રમાણમાં ખોટા વિચારોથી મનને બચાવીએ તેટલા પ્રમાણમાં મનનું બળ વધે છે. બળવાન મનથી જ્યારે ધર્મની સાધના હાથમાં

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાચિય કહા.” (ભાગ-૨૨)

આવે ત્યારે એ જોરદાર થાય છે. વિકલ્પોવાળા મનમાં દુર્બળતા આવવાથી અવસરે જ મન ભૂલું પડે છે.

દ્રોષક-પતન : વીરદેવ - વૈરાગ્ય :- દ્રોષક રંગમાં ચઢ્યો છે. પણ જરૂરે ચઢી દેખાડવા વીરદેવને બોલાવે છે. ત્યાં તો તે પોતે જ, જરૂરો ખીલાથી અટકાવેલ નહિ હોવાથી જરૂરો નીચો વળી જતાં, નીચે પટકાઈ પડ્યો ! માથું નીચે, ને પગ ઊંચા. ખોપરી ઝૂટી ગઈ.

અવિજ્ઞાની મહર્ષિ કહે છે “હું વીરદેવ, મારા હદ્યમાં એ જોતાં જ પ્રાસકો પડ્યો ! અરે ! આ જરૂરો બનાવનાર કારીગર કેવો ગફકતવાળો કે બિચારો શ્રાવક મિત્ર આમ પડી ગયો !” વિચારતાં એકદમ હું નીચે આવ્યો. જોઉં દું તો ખલાસ થઈ ગયો છે મિત્ર ! હાહાકાર થઈ ગયો ! “અરે ! આ મારા ધર્મ મિત્રને શું થયું ?” દ્રોષકનું આતું કુમૃત્યુ જોઈ કણની વિલક્ષણતા ઉપર મારું હદ્ય હચ્ચમણી ઊઠ્યું... મને સંસાર પર વધુ વૈરાગ્ય થયો. મહાન કંટાળો છૂટ્યો ! મને થયું કે અરે ! જીવનના ખેલને વિકાર છે કે જેમાં સંસારની રમતનું આવું કરુણ પરિણામ જોવાનો અવસર આવે છે... સાંસારિક જીવનનું અતિમ જો એવું જ હોય તો સર્યું એવા સંસારવાસથી. આવા જીવતરને વિકાર છે. એમ ઉત્કટ વૈરાગ્ય પામીને મિત્રનું મૃતકાર્ય કરી એ જ માનભંગ આચાર્ય મહારાજ પાસે મેં (વીરદેવે) ચારિત્ર લઈ લીધું.”

આત્મદ્રવ્યની કેળવણી : - દ્રોષક ઉપકારી ઉપર પણ કેવા નીચ વિચારોમાં ચઢ્યો હતો ! ત્યારે વીરદેવ અપકારીને પણ ધર્મમિત્ર માની એના કરુણ પ્રસંગમાંથી કેવી ઉચ્ચ સાચ્ચિક વિચારણામાં રમતો થઈ ગયો ! અલબત પોતે પેલાને અપકારી તરીકે ઓળખતો નથી. છતાં એમ ઓળખતો હોય તો શું ? કેટલાય જીવોનું ધર્મ-અભ્યાસી હદ્ય અપકારીનું પણ બૂનું ચિંતવવા તૈયાર નથી ! અપકારીને દુષ્ટ અને હલકો માનવા પણ તૈયાર નથી ! આત્માની એવી પ્રગતિ સાધી છે. આત્મદ્રવ્યને એટલું કેળવીને સુધાર્યું છે. આ ચાવી છે. અપકારીને ઊંડે ઊંડે સારો માનવા તૈયાર હોઈએ તો માનવું કે આપણે સારા ધર્મ અભ્યાસી છીએ. આપણે આપણા આત્મદ્રવ્યને તપાસીએ તો ? શું લાગે છે કે વર્ષોના આપણા દેવગુરુ ધર્મના પરિચય પછી આપણે આપણા પોતાના ગણતાના આત્મદ્રવ્યને આવું કેળવ્યું-સાધ્યું છે ? જો ના, તો પરિચય શું કર્યો ? દેવગુરુના પરિચય અને ધર્મના કરણ-કરાવણ-અનુમોદનની સીધી અસર આપણા પોતાના આત્મા ઉપર આ લાવવાની છે કે આત્મામાં સંગીન સુધારો થતો આવે. વાતવાતમાં ઊકળી-તપી જનાનું આત્મદ્રવ્ય હવે શાંત અને શીતલ રહે. ખરાબ વાતાવરણથી લહેવાય જાય નહિ. ગુસ્સો કરાવે,

૧૨૮

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“વીરદેવ-દ્રોષક” (ભાગ-૨૨)

ઈથ્યા કરાવે, રોફ કરાવે એવા એવા સંયોગોમાં પણ આત્મા લહેવાયા વિના ખૂબ શાંતિથી સમતા, પ્રમોદ, નન્ત્રતાને સ્વભાવથી જાળવી રાખે. એ અસર દેવગુરુના પરિચયથી ઊભી થવી જોઈએ. જગતની ચીજને કેળવવા-સુધારવાની રાત ને ડિ' ઝંખના અને જહેમત ચાલુ છે, પણ એ તો પારકા છે; જ્યારે આત્મા તો પોતાનો છે. એને માટે એવી કાળજી નહિ ? એ શું આશર્ય નથી ? શું એ આપણી સરાસર મૂર્ખતા નથી ? વીરદેવે તો ખૂબજ આત્મકેળવણી કરી છે. એટલે એ દ્રોષકના અક્ષમાત્ર પ્રસંગ પર ઠેઠ ચારિત્ર સુધીના વિચાર અને નિર્ણય કરી લે છે; ચારિત્ર લે છે પણ.

વીરદેવ ચારિત્રી ગ્રૈવેયક સ્વર્ગો :- અમરગુપ્ત આચાર્ય મહારાજના જીવનું પૂર્વ ધર્મના બળે જેમ જેમ નવું જીવન આવે છે, તેમ તેમ અભેનું એવું આત્મબળ વધે છે કે પૂર્વ કરતાં પ્રભળ આરાધના કર્યા વગર મરવાનું નહિ ! અને મરીને, તેથી ઊંચા ઊંચા દેવલોકે જવાનું ! અહીંયાં એવી ચારિત્ર ઉપરાંત અંતિમ આરાધના કરીને કાળ કર્યો કે સીધા ગ્રૈવેયકમાં દેવ તરીકે જન્મ્યા. ત્રીજ ગ્રૈવેયકમાં સહેજ ન્યૂન એવા પચીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા.

કુમસર અભ્યાસ છે ? :- અહીં ભવે-ભવે કુમસર ચઢતી થતી આવે છે. એ સૂચવે છે, ચારિત્રબળ વધે ખરું, પણ સામાન્ય નિયમે અભ્યાસથી વધે. એક જ જીવનમાં પહેલ વહેલું ચારિત્ર શરૂ કરીને ઈચ્છાએ કે ‘મારું ચારિત્ર જીવન એકદમ જ ધના અણગાર જેવું થઈ જાય !’ તો તે મુશ્કેલ છે. ત્યાં અભેજ કહેવાય કે “પહેલાં એકડિયાના ધોરણમાં ભણ; પછી પહેલામાં; પછી બીજમાં આવજે ! અર્થાત્ અહીંયાં તું અભ્યાસ વધારતો જા; તેમ તેમ ઉત્તરોત્તર ચારિત્રબળમાં વૃદ્ધિ થશે.” માત્ર ભણવાથી કંઈ વળે નહિ. એ તો એનો અભ્યાસ વધારવો જોઈએ. સારી ભાવનાનો પુનઃપુનઃ અમલ જોઈએ; તો ઉન્તિ થતી આવે. આ તો અભ્યાસના ઠેકાણાં નથી અને પરિણામ મહા ઊંચું અને એકદમ જોઈએ છે ! એ ક્યાંથી મળે ? સવાલ એ જ કરીએ છીએ ને કે,

પ્ર.- ‘સાહેબ ! નવકારવાળીમાં અમારું મન સ્થિર કેમ નથી રહેતું ?’

૩.- સ્થિર એટલે મહામહર્ષિઓનું મન જેવું સ્થિર, એવું ને ? કેવી માગણી છે ? માગણી કરતાં પહેલાં કહો તો ખરા કે કુમસર અભ્યાસ છે ? ૧. મન સ્થિર કરવા કાળજીપૂર્વકનો અભ્યાસ કેટલો કર્યો ? ૨. એ પુનઃપુનઃ અભ્યાસમાં સ્થળના થાય તો તે સુધારવા, અને એ ફરી ફરી ન બને એ માટે; અને અટકાવવા માટે દંડ કેટલો ભોગવ્યો ? સ્થળનાની કોઈ સજી રાખી છે ? ના, સજાય નહિ અને અભ્યાસ નહિ. જે મનને આપણે બહુ ચંચળ કહીએ છીએ, અનંતીવાર ચંચળ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૧૨૮

બનેલું સમજીએ છીએ એને અંકુશમાં લેવા માટે અભ્યાસના કેટકેટલા ભગીરથ પ્રયત્નો હજારો લાખો વાર કરવા જોઈએ ! એનો વિચાર સરખો નહિ એ કેમ કામ લાગે ? આત્માના ન્યાય, નીતિ, સત્ય, દયા, પરોપકાર, વગેરે ગુણોને પણ સિદ્ધ કરવા માટે કેટલાય અભ્યાસ કરવા જોઈશે. જીવન જ એવું બનાવી દેવું જોઈએ કે ‘એમાં કેટલું કમાયા ? શું ખાશું, શું પીશું ?’ વગેરેની વિચારણાનું જોર નહિ; પણ ‘દયા, પરોપકાર, નીતિ વગેરે ગુણોને કેળવવાનો અવસર ક્યાં ક્યાં મળે છે,-’ એની લગનીનું જોર હોય. આ લગનીનું જોર પૂર્વ નથી બનાવ્યું એટલે તો નિરાધારપણે સંસારના ભવો કરવાની દુર્દશા આજ સુધી ચાલુ છે. પણ આ જન્મ એટલો બધો સુંદર છે કે આમાં એ લગની જોરદાર કરી શકાય. કરશો ને ?

દ્રોષક નરકે :- દ્રોષક મરીને પાંચમી નારકીમાં બાર સાગરોપમના જંગી કાળ સુધી નરકના દુઃખ વેરવા ગયો. દ્રોષક જે જે શુના કરે છે, તેનાં કડવાં પરિણામ અહીંયાં તો ભોગવે જ છે; ઉપરાંત ભવાંતરમાં તો તેના અતિશય ભયાનક નતીજા ભોગવતો જાય છે ! પાંચમી નરકમાંથી નીકળી સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો માછલો થયો. મોટો મગરમણ્ય એટલે પાપ કરવાની મોટી સગવડ ! દરિયામાં પડ્યા-પડ્યા શું કરવાનું ? સામાયિક-પ્રત-પચ્યકખાણ વગેરે નહિ ! જો કાયા ત્યાં મોટી મલી છે, તો સામે જે જે નાના મગરો આવે તેને બિચારાને આખા ને આખા કે ચાવીને ગળી જવાનો જીવનભર ચાલુ ધંધો ! બસ ! એના પર મસ્ત બનવાનું ! પોતાનું સામાજય ! તેમાં ઓછા બળિયાનું ભક્ષણ !

રૌદ્રધ્યાનમાં :- આવા ભવમાં દ્રોષકને કોણ લઈ આવ્યું ? ઠગાઈની બુદ્ધિ, ઉપકારી પ્રત્યે કૃતધનતા, વિશાસુનો વિશાસધાત, મારી નાખવા સુધીના ઉત્ત્ર કખાય અને રૌદ્રધ્યાન ! હલકા ભવોમાં આ રીતે કયા-કયા હેતુઓ લઈ જાય છે તે ખાસ સમજી રાખવાનું છે. તો જ આપણે તેવા હેતુમાં ફસી ન જઈએ. તેમ એ પણ જોવાનું છે કે કેટલીયવાર આપણે રૌદ્રધ્યાન માત્ર હિસા અંગે જ નહિ, પણ ચોરી કે જૂઠના ચિંતનનું પણ રૌદ્રધ્યાન હોય છે. તેમ મળેલાને રક્ષી રાખવાના ચિંતનમાં પણ રૌદ્રધ્યાન આવે છે. દુન્યવી સ્વાર્થો સાધીતી વખતે કોઈ કોઈવાર મન એવા ઉત્ત ચિંતનમાં ચઢી જાય છે કે દા.ત. ‘બસ ! આ નવો ઈન્કમટેક્સ ઓફિસર બડો રોફવાળો અને ભારે દંડ કરનારો છે. પણ ભચ્યાને હું બતાવી દઈશ કે ટેક્ષ કેમ લેવાય છે ! એવા બનાવટી હિસાબ રજૂ કરી દઉં છું, અને પ્રશ્નોના ખુલાસા એવા ગોઠવીને-ગોઠવીને એટલે ? જૂઠા પણ આબાદ સાચા જેવા-કરી દઉં છું કે એનો બાપ પણ બીજું કાઈ બોલી શકે નહિ...’ આવા ઉત્ત ચિંતનમાં મન રૌદ્રધ્યાને ચઢી જાય છે. આવા તો જીવનમાં કેઈ પ્રસંગો છે. માટે જ સાવધાન રહી મનને તેવા

૧૩૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વીરદેવ-દ્રોષક” (ભાગ-૨૨)

ખરાબ ચિંતનમાં ચઢવા દેવું નહિ. હદ્ય બહુ કોમળ અને મન પાપથી ડરનારું રાખવું. મત્સ્યનું જીવન એટલે રૌદ્રધ્યાનભર્યું કોરું પાપમય જીવન ! ઘોર પાપ ! જ્યાં જ્યાં પાપ-પાપ ને પાપ ! મન સહિત પંચેન્દ્રિયપૂર્ણ છે. પણ દુર્લભ ધર્મસમજ લાવે ક્યાંથી ? અહીં તમને ધર્મસમજ મળી છે, પણ એનો ઉપયોગ કરી પાપ ઓછા ઓછા કર્યે જવાનું બનાવવું નથી. પેલો તો ધર્મસમજના અભાવે ઘોર રૌદ્રધ્યાનથી મહામત્સ્યના ભવમાંથી મરી પાછો એ જ પાંચમી નરકમાં બાર સાગરોપમના આયુષ્યવાળો નારક થયો. ચોવીસ સાગરોપમ પૂરા કર્યા. વધારાનો કાળ તિર્યંચમાં ભટક્યો. કેમકે વીરદેવનો જીવ ગ્રૈવેયકમાં લગભગ પચ્ચીસ સાગરોપમનું દેવ આયુષ્ય અનુભવી રહ્યો છે. તે પછી પાછા બંને ભેગા થવાના છે.

-: વીરદેવ-ડ્રોષક ભવ સમાપ્ત :-

● નંદયંતી-(પૂર્ણભદ્ર)અમરગુપ્ત ●

આજ જંબુદ્ધીપમાં મહાવિદેહ ક્ષેત્રની આજ વિજયમાં ચંપાવાસ નગર છે.

ડ્રોષકનો જીવ નંદાવર્ત શેઠને ત્યાં શ્રીનંદાપત્નીની કુદ્ધીએ નંદયંતી નામે પુરી તરીકે જન્મ્યો. જ્યારે આચાર્ય મહારાજનો જીવ ગ્રૈવેયક સ્વર્ગમાંથી ચ્યવી માણિભદ્ર શેઠને ત્યાં ધારિણી શેઠાણીનો પૂર્ણભદ્ર નામે પુત્ર થયો. હવે પૂર્ણભદ્ર જ્યારે બોલતો થયો ત્યારે તેણે પહેલો શબ્દ ‘અમર’ એવો કાઢ્યો, સહજરૂપે પહેલું ઉચ્ચારણ આ કર્યું; તેથી બધા આશ્ર્ય પામી ગયા. એટલે ‘અમર’ શબ્દ ઉપરથી બીજું નામ અમરગુપ્ત પ્રસિદ્ધ થયું.

‘અમર’ શબ્દનું ઉચ્ચારણ એટલે શું ? સમજાય છે ? એ જગતને અમરતાનો આશીર્વાદ છે. જગતના જીવો અમર બનો એ શુભેચ્છા છે. પણ પોતાની જાતની અમરતાની વાત નથી. ‘બીજા મરો પણ હું ન મરું’ ‘આપણે જો અમર બની ગયા તો દુનિયા જખ મારે છે, આપણે દુનિયા મરે એની બહુ ચિંતા કરવા જેવી નથી.’ આવી આવી પોતાના અમરપણાની ઘેલી ગણતરી આ ‘અમર’ ઉચ્ચારણમાં નથી. કેમ કે એ સ્વાર્થીધતાની ગણતરી છે. જગતમાં કેઈક માણસો એવી સ્વાર્થીધતાની ગણતરી ધરાવે છે, માણસ ભોગો નહિ હોય પણ ચાલાક હશે, તો કદાચ મોઢે આ ગણતરી બોલી નહિ બતાવે. પણ એનો વર્તાવ જોઈશું, એની રહેણી-કરણીને તપાસીશું, તો દેખાશે કે ભાઈને જાતની પડી છે, જગતની નહિ. ત્યારે કવિઓ ય કહે છે એવા કીડા જેવા જીવનથી શું ? કે જ્યાં પોતાનો સ્વાર્થ સરે એટલે પત્યું, પછી બીજાની ભલી વિચારણાની તો વાત નહિ પણ ઉપરથી બીજાનું બગડતું હોય

તો એ જોઈને દ્યાય નહિ પણ કલેજે ઠંડક ! એના કરતાં જરૂર જેવા દેખાતા નદીના, આપ્રના, ચંદનના, ઈત્યાદિના જીવન સારા કે જ્યાં જીતના સ્વાર્થની વાત નહિ, પણ તીલદું જીતને તકલીફમાં મૂકીને પણ જગતનું ભલું કરવાની વાત દેખાય છે. અમરગુપ્તે પૂર્વભવોમાં આ કર્યું છે. તો શું આપણે પણ આવા ચરિત્રો વાંચી-સાંભળી આ કરવાનું નથી ? મનને એમ થવું જોઈએ કે આવું મહામૂલું સમજદાર માનવભવ પાખ્યો તો શું આ કર્યા વિના મરું ? ના, હવે તો જીવનમાં આવું કાંઈક સાધુ કે જાતની સગવડો ભૂલી બીજાને સગવડ કેમ મળે એ જોતો જાઉં.

નદી જગતના મેલાં સંગ્રહીને પણ જગતને ચોકખાં પાણી આપે છે; કેઈ ખાડા-ટેકરા સહન કરીને માણસને, ઢોરને, ખેતરોને અખૂટ પાણી પાય છે.

આંબાના જાડ ઊગવાથી માંડી કેરીના ફળ આવે ત્યાંસુધી શિયાળા-ઉનાળા-ચોમાસાની ઋતુઓના ત્રાસ વેઠી, તેમ બીજુંય કેટલું સહન કરી, યાવત્ત કેરી લેવા પથરા મારનારના પથરા પણ સહન કરીને સામી મીઠી કેરીઓ આપે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૪૪, તા. ૧૬-૭-૧૯૫૫

ચંદનને જેમ બાળો તેમ જાતે બળી-બળીને સામે સુગંધની મધમઘતા આપે છે.

અમરગુપ્ત અવિજ્ઞાની મહર્ષિના જીવે પૂર્વ ભવોમાં આવો પરમાર્થ સાધ્યો છે. યાદ હોય તો, ચક્કદેવના ભવમાં પોતે ઠેઠ જાડ પર આપધાત કરવા સુધીનો પોતાનો પ્રસંગ બનાવ્યો, પણ મિત્રનું ભલું વાંદજ્યું. મિત્રને ત્યાં પકડી લાવ્યા તો પોતાને મિત્રની ચિંતા થઈ. રાજા મિત્રને ભયંકર સજા કરવા તૈયાર થયો તો રાજાને પગે પડીને પોતે મિત્રને છોડાવ્યો. પોતે બચ્યો એની નહિ પણ મિત્ર બચ્યો, એની બુશાલી માની ! શું આ ? ‘આપણે અમર ન રહી શકીએ એની ચિંતા નહિ. બીજા અમર રહો;’ -આ હાઈક ઉલ્લાસવાળી ભાવના એના અભ્યાસનો પ્રભાવ કેવો કે અહીં પહેલું ઉચ્ચારણ કરવાની શક્તિ આવી ત્યાં પૂર્ણભદ્રે પહેલ વહેલો શબ્દ ‘અમર’ એવો કાઢ્યો ! એના પર બીજું નામ ‘અમરગુપ્ત’ પડ્યું. ત્યારે જૈનધર્મ પણ એને અહીં જન્મથી મળ્યો છે. કેમકે જૈન-શ્રાવક કુળમાં જ જન્મ છે. પૂર્વના જીવનોમાં તો જ્યારે કોઈ આચાર્ય મહારાજ મળતાં ત્યારે જૈનધર્મ પામતા. અહીંયાં જન્મથી જ ધર્મ મળી ગયો.

ચન્દ્ર-રાહુનો યોગ :- અમરગુપ્ત ઉમરમાં આવ્યો. એજ નગરમાં નંદયંતી પણ ઉમર લાયક થઈ. ભવિતવ્યતાએ સંયોગ એવો જ લાવી મૂક્યો કે અમરગુપ્તનું નંદયંતીની સાથે લગ્ન થયું ભવિતવ્યતા કેટલી પ્રભળ ? આવું કેમ બનતું હશે ?

આવા સજજન સાથે એવા દુર્જનનો વારંવાર સંયોગ ? આપણે કેટલીવાર સાંભળતાંય કંટાળી જઈએ, ને અહીંયાં ભવિતવ્યતા એવો જ સંયોગ લાવિને મૂકે છે ! ગુલાબની આસપાસ કાંઠા ઊભા કરી દીધા ! ચન્દ્રની પાછળ રાહુ બજાડી દીધો !

‘આપ ભલા તો જગ ભલાનું રહેસ્ય’ :- સજજનને વારંવાર દુર્જન પૂંઠે લાગે છે એ પણ કુદરતની-ભવિતવ્યતાની અકલ કળા છે. સમજતા નહિ કે આપણે ભલા બનવા માંડ્યા એટલે હવે આપણા પર દુશ્મનાવટ કરનારો કોઈ દુશ્મન ન રહે. અલબત્ત, ‘આપ ભલા તો જગ ભલા’ની કહેવત છે. પણ એનો અર્થ એ નથી કે કોઈ આપણી વિરુદ્ધ નહિ વર્તે.

આપણાં પૂર્વોપાર્કિંત કર્મ વાંકા હશે, કે ભવિતવ્યતા વાંકી હશે, તો આપણે ભલા છતાં આપણને દુશ્મન દેખનારા જીવો જગતમાં હશે. પણ આપણો જો ખરેખર ભલા બન્યા હોઈશું તો એની દુશ્મનાવટ આપણી નજરે નહિ ચઢે. આપણે એને દુશ્મન નહિ દેખીએ. કાં તો આપણે એને દ્યાપાત્ર અથવા આપણા ઉપકારી તરીકે દેખીશું.

એટલે, આપણી દાણિમાં જો એ ભૂતો નહિ, પણ ભલો દેખાયો તો કહેવાય કે ‘આપ ભલા તો જગ ભલા.’ બાકી આપણને વિઘ્ન કરનાર, આપણી નિંદા કરનાર, આપણને ત્રાસ આપનાર તો જગતમાં હોય, રાહુ અનાદિકાળી ચંદ્રની પૂંઠે લાગ્યો છે. સુદ-વદમાં ચંદ્ર ઓછો વધતો કેમ દેખાય છે ? નિત્ય-રાહુના યોગે. જેમ પર્વ રાહુથી ગ્રહણ થાય છે, તેમ આ નિત્યરાહુથી ચંદ્રની કળામાં વધઘટ થાય છે. ચંદ્રને તો નિત્યરાહુનો આ જુલ્દમ રોજનો માથે પડ્યો પણ તેથી શું ? પોતાને પોતાનું સજજનતાનું કાર્ય બજાવ્યે જવાનું. લોકમાં પણ એથી જ વડાઈ છે. બાકી દુર્જનો હોવાની ચિંતા નહિ કરવાની. અમરગુપ્તના જીવની આ વિશેષતા છે. તો દુર્જન દુશ્મન ભલે જીવનમાં એમને અથડાઈ પડશે, પણ પોતે સત્ત્વશીલતાથી સજજનતાના માર્ગ ધપાવ્યે જશે. આચાર્ય મહારાજ સંસારી ગૃહસ્થપણે પણ, સામો માણસ દુર્જન છે છતાં, એની દુર્જનતાનો પોતે જ્યાલ પણ નથી કરતા ! પેલાની દુર્જનતા સહજરૂપે કાર્ય કરે છે ! નંદયની પરણીને સાસરે આવી. સ્નેહ પણ કરે છે. પણ પાછા પૂર્વના ખોટા કર્મ, તે ખોટી વાસના ! એના અધારે અમરગુપ્ત પર પાછી ઠગાઈની બુદ્ધિ ! ‘કેમ એમને બનાવું...’ એમ માયાથી વર્તે છે.

સંસ્કારના ઘડતર પર લક્ષનો આધાર :- અમરગુપ્તે તો પોતાની સારસાર વસ્તુઓ નંદયનીના હાથમાં સરળ ભાવથી આપી દીધી. ઉમદા દાળીના વગેરે જીવેત પણ એને સોંઘું. પરંતુ નંદયનીનો વ્યવહાર બધો જ માયાવી ! અમરગુપ્ત સમજતો નથી, પણ પરિવાર વર્ગ સમજી જાય છે કે શેઠાણી જરૂર માયા રેમે

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૧૩૩

છે ! એટલે આવીને અમરગુપ્તને કહે છે - “આપ તો મોટા દિલના છો. પણ એમનો (શેઠાણીનો) વ્યવહાર અમને ઠીક લાગતો નથી. જાનગી ગરબડગોટા ચલાવ્યા જ કરે છે.” પરિવારનું આવું આવું કથન સાંભળવા છતાં આ પૂર્ણભદ્ર એવો મોટા મનનો છે કે નોકરોની વાત પર લક્ષ નથી આપતો. કેવી વાત પર લક્ષ દેવું કે ન દેવું એ બધાનો આધાર પોતાના સંસ્કારના ઘડતર પર છે. ઉત્તમ સંગીન સંસ્કારનું ઘડતર ન હોવાથી મામુલી વાત પણ કોઈ કહી જાય તો આપણને અસર કરી જાય છે; ને ઘડતર એવું સંગીન હોય તો કોઈ મહત્વની વાત કહી જાય, તો પણ કાંઈ ન થાય. આપણા હંદ્યમાં કેટલી ઉત્તમતા કે અધમતા છે એનું માપ આના પર નીકળે છે કે જો સંગીન સંસ્કારના ઘડતરથી દિલ ઉત્તમ હોય તો આજુભાજુની કેટલીયે વાતો તો એમ જ દરગુજર થાય ! જીવનમાં એવો એક શિરસો જોઈએ કે ‘હું ક્યાં જે તે વાતો પર લક્ષ દેવા નવરો બેઠો હું ?’ એથી જીવનમાં પોતાના આત્માને ઉજજવલ નહિ બનાવતી, ઉન્નત નહિ બનાવતી કેટલીય વાતો પર ધ્યાન નહિ દેવાય. હુન્યવી જીવનમાંય એ લાભકારી છે. આજે કેટલાંક કુંઠબો સીધાં નભે છે-તે કોણા પર ? મોટાઓની ઘણું તો દરગુજર કરવાની ઉદારવૃત્તિ પર. અહીંયાં નોકરો શેઠાણીની વાત શેઠને કરે છે; છતાં અમરગુપ્ત એને દરગુજર કરે છે. એના પર વિશ્વાસ નથી મૂકતો. એ તો સમજે છે કે - “નોકરો તો કહે; નોકરોની દાણિ કેટલી પહોંચે !...”

કુંડલ ખોવાયા ! :- પણ એ અરસામાં એક વાર નંદયની રોતડ મુદ્રાએ કહે છે- “શું કરું...” પૂર્ણભદ્ર કહે છે- “પણ રોવાનું શું કામ છે ? કારણ તો કહે રોવાનું.”

“આપણા બધા ઘરેણામાં સારભૂત જે બહુ કિંમતી જીવેતાતના કુંડલ હતા તે ખોવાઈ ગયાં.” ગણ્યું જ છે ! ધરાર જૂંદું જ છે ! સારસાર દાળીના પૂર્ણભદ્રે નંદયનીને સોંઘું છે. તેમાંથી એ કુંડલને પોતે જ ઉદાવી લઈ આકુલવ્યાકુલતા બતાવી રહી છે. છતાં એ સંબંધમાં બીજું પૂછ્યા ગાંધ્યા વિના પૂર્ણભદ્ર આશ્વાસન આપે છે, “સુંદરી, એમાં શું મોટી વિસાત હતી ? આટલો ઘોંઘાટ શા સારું ? ગભરાઈશ નહિ; બીજી કુંડલ જોડી કરાવું હું.” હજારોની કિંમતના કુંડલ ખોવાવા છતાં ‘કેમ ખોવાયા ?’ વગેરે કાંઈ તપાસ કરવાની પણ દરકાર કરતા નથી. શાથી ? આત્માને એવો ઘડીને આવ્યા છે કે દરકાર બીજી કોઈ વસ્તુની છે.

ધરબારને ઠીક ઠીક કર્યાની શી કિંમત છે ? :- જીવનમાં આત્માનું ઘડતર કરવાની મોટી વિશેષતા છે. બુઢા બનીને જીવનના કાંઠે આવી ઊભેલા વૃદ્ધ બાપને એમ થાય છે કે ‘છોકરાઓ માટે વહુરો, દુકાન વગેરે તો બરાબર કરી આયા,

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“નંદયની-(પૂર્ણભદ્ર)અમરગુપ્ત” (ભાગ-૨૨)

૧૩૪

પણ હવે છેવટે આટલું ઘર ઠીક બંધાવી આપું,’ અથવા ‘ઘર ઠીક કર્યું તો વેપાર-ઘરાં વગેરે બરાબર કરી આપું.’ જેમ ડોસાને આવું આવું થાય છે, એમ મનુષ્ય જીવને ખરી રીતે બાળપણથી એમ થવું જોઈએ કે આજસુદીના અનંતાકાળમાં બીજું બધું તો ઘણું ઘણું ઠીકઠાક અને બરાબર કર્યું, પણ હવે મારા આત્માને બરાબર કરતો જાઉં. ઘરબાર, ધંધો કે દુકાન, માલ ને મિલકત, કાયા ને કુરુંબ-એ બધું બરાબર કર્યું, ઠીક-ઠાક બનાવ્યું, એની જે કિંમત નથી એથી અનંતગુણી કિંમત આત્માને ઠીકઠાક કરવાની છે. કેવી રીતે થશે એ? આત્માને ઘડવાથી. બચપણ અવસ્થાથી સંતાનને શિખવતા જાઓ કે ‘જુઓ, આપણે ખાવાપીવાનું, ને પહેરવા ઓફાવાનું ઠીક ઠીક કરીએ એની બહુ કિંમત નથી. કિંમત આપણા આત્માને ઘડીને ઠીક બનાવીએ એની છે. પૂર્વના લાંબા કાળથી આપણો જીવ ઊંઘો ઘડાયો છે, તેથી અત્યારે આપણા જીવના ભલીવાર નથી. સ્વાર્થ સરતો હોય ત્યાં જૂં બોલવું ગમે છે, અનીતિ કરવી ગમે છે, તેમ બીજાનું સાંદું દેખી ઈચ્છા થાય છે, વાતવાતમાં જાતને માટે અભિમાન, હું પદ આવે છે, એ આત્માનું ખરાબ ઘડતર સૂચ્યેવે છે. હવે એ મિટાવવાનું છે. એ માટે લાંબા કાળ સુધી સતતપણે આત્માને ઘડવો પડશે.

ઘડતરમાં શું શું કરવાનું? જાણો છો? :- પહેલાં એ સમજું રાખો કે ઘડતર કેવું કરવાનું છે. કેવું એટલે કેવા પરિણામવાનું? આગળ આપણે જોયું કે પૂર્ણભર એટલે કે અમરગુપ્ત મહાકિંમતી કુંડલ ખોવાયાને સામાન્ય ગણે છે. ત્યારે નંદયંતી માયાના ધોર પાપ કરીને ય એવા કુંડલની બીજી જોડ મળે એને મહાન લાભ ગણે છે. એનું ઘડતર જ એવું થયું કે તુચ્છ વસ્તુને અગર પાપચયરણની ભ્યાનકતાવાળી વસ્તુને પણ મહાન ગણે. અમરગુપ્તને ઘડતર એવું થયેલું છે કે એ કિંમતી કુંડલના ખોવાઈ જવાને નગણ્ય માને છે. બસ! ઘડતરનું આવું પરિણામ લાવવાનું છે; અર્થાત્ ઘડતર આવું કરવાનું છે કે જેમાં જગતની વિનશ્ચર સંપત્તિ-સગવડો આપણને સાફ ન-ગણ્ય લાગે એને આપણે આત્માની પવિત્રતાને એને ઉચ્ચગુણો દ્વારા ઉત્તમતાને બરાબર રક્ષી શકીએ. આ ઉપરથી સમજાશે કે ઘડતરમાં શું શું કરવું જોઈએ. કહો કે એવું એવું જ કરવાનું કે જેનાથી આત્મા પવિત્રતા એને ઉત્તમતા સિદ્ધ કરતો જાય.

પવિત્રતા માટે :- ત્યારે સમજો કે પવિત્રતાનું ઘડતર કરવા માટે ઘણી ઘણી મેલી પ્રવૃત્તિઓને અટકાવી દેવી જોઈએ. દા.ત. જાતનો સ્વાર્થ સાધવા જે માયા કપટ રમાય છે, તે હવે બંધ થઈ જવું જોઈએ. એટલું જ નહિ પણ કેટલીયવાર અજ્ઞાન માણસ, કશું ન વળવાનું હોય છતાં, મનમાં ને મનમાં અસત્યના, અનીતિના, દુરાચારના વગેરે વિચારો કર્યે જાય છે. એથી શું બને છે? આત્મા અપવિત્ર રહે

છે, મેલો ને ગંઢો રહે છે. જેના વિચાર મેલા એનું મન મેલું, એનો આત્મા મેલો. હવે તો એ સમજ કરી લેવી જોઈએ કે જ્યારે મને શરીર, કપડાં, અને બીજી વસ્તુઓ મેલી નથી ગમતી, તો પછી મારા વિચારો, મારું મન, અને મારો પોતાનો આત્મા મેલો કેમ ગમે? હવે એ મેલ કાઢી નાખું; કાઢી નાખીને જપું. એ માટે બાધ્ય રોષ, રોઝ, પોલિસી પ્રપંચ વગેરેની પ્રવૃત્તિ અને આંતરિક એવી એવી વિચારણા સર્દંતર અટકાવી નાખું. અને એના સ્થાને સત્ય, ન્યાયનીતિ, સરળતા સદાચારના ભરપૂર વિચારો પૂરજોશમાં વહેતા રાખું. પ્રવૃત્તિ પણ એને યોગ્ય બનાવી દઉં.

ઉત્તમતા માટે :- ત્યારે ઉત્તમતા માટે પણ અધમ પ્રવૃત્તિઓ અને વિચારણાઓ અટકાવવાની છે. એના સ્થાને ઉત્તમ આચરણ અને ઉત્તમ વિચારસરણી ગોઠવવાની છે, અમલમાં વહેતી રાખવાની છે. કુદ્ર માનસ, કુદ્ર વર્તાવ, અને કુદ્ર બોલ હવે બંધ થઈ જવા જોઈએ. ધ્યાનમાં રાખજો; અહીં માત્ર બાધ્ય કિયા નહિ પણ અંદરનું ઘડતર કરવાની વાત પણ સાથે છે. એટલે આ બધી પવિત્ર અને ઉત્તમ આચરણ અને વિચારસરણી આત્માને સહેજ જેવી થઈ જાય. એ પુરુષાર્થ કરવાનો છે. પછી તો સહેજે સહેજે પવિત્ર અને ઉત્તમ ભાવ હૃદયમાં વચ્ચા કરશે. જીવનું એવું ઘડતર થઈ ગયું કે જ્યાં મહિન ભાવો સહેજે ન જાગે; અધમ વિચારો સહેજે ન આવે. આ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે, આપણી જે વાત હતી કે દુનિયાના જીવોને મોટી કે કિંમતી લાગતી વસ્તુને પણ મહત્વ ન અપાય, એ વાત સહેજે બની આવવાની. ઉત્તમતા કેળવવા માટે સ્વાર્થ ભૂલવાની જરૂર છે. આપણે જાતના નહિ પણ જગતના બની જઈએ તો ઉત્તમ બનવાનો યોગ છે. એમાં પછી આપણી જાત પ્રતેની અનુકૂલતા પ્રતિકૂલતાની પડી નથી હોતી. જગતને અનુકૂલ કેમ કરી આપું, જગતનું પ્રતિકૂલ કેમ ટાણું એ તમના રહે છે.

જિનશાસન મણ્યું તે સારા ઘડતર માટે :- ત્યારે કહો, નજીવી બાબતોને તો શું, પણ મોટી બાબતો કે જે આપણી જાતને સ્પર્શે છે તેને ય દરગુજર કરવી એ શું કઠીન છે? હા, આત્માનું ખૂબ અભ્યાસથી ઘડતર જો નથી કર્યું, તો કઠીન ખરું. પણ ઘડતર કરાય તો પછી કઠીન નહિ. જંબૂકમારનો આત્મા પૂર્વ ભવોમાં ઘડતર કરીને આવેલો હતો, તો અહીં નવાણું કરોડની સંપત્તિ અને આઠ અસ્સરા જેવી નવોઢા પણીઓ મન પરથી ઉતારી મૂકી દેતાં વાર ન લાગી. આજે જુઓ કે એવા પણ શ્રીમંત માણસો કે શ્રીમંતના છોકરાઓ છે જેને પોતાની મોટરમાં પણ બંધુ ફરવાનો, મોંઘા ખાનપાનનો, કે કિંમતી કે ભપકાદાર પહેરવેશનો શોખ જ નથી. એને મન એનું મહત્વ નથી, ત્યારે એવા તો કેરી મધ્યમ લોકો કે ગરીબો

છે કે જેને મન એટલું તો શું પણ એનાથી નીચી કિમતના ખાનપાન, વસ્ત્ર અલંકાર અને સગવડના સાધનના ભારે શોખ છે; એનું એને મન મહત્વ છે. શું છે આ? ઘડતરની બિનન્તતા. ઘડતર પૂર્વ ભવેથી જો ઊંચું કરીને આવ્યા તો અહીં કિમતી ચીજાનું ય બહુ મહત્વ નહિ લાગે. જીવનમાં નજીવા બનાવ ઉપર ચર્ચા-મરચાં કરવાનું તો આજે ધેર ધેર દેખાશે. ત્યારે થોડા જ માણસો એ રીતરસમથી દૂર રહેનારા દેખાશે. ઘડતર પર બધો આધાર છે. જીવન ઉચ્ચ માનવ ભવનું, તેથી ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનવાળું પાસ્યા પછી તો ઘડતર ઊંચું કરી જ લેવું જોઈએ. એ જુઓને કે જો દુન્યવી વાત વસ્તુઓના સંયોગ વિનશ્ચર છે, અનિત્ય છે, તો એની પાછળ શું તૂટી પડવું? અમરગુપ્ત સર્વ ધરેણામાં સારભૂત એવા પણ કુંડલ ખોવાયા ઉપર મહત્વ નથી આંકતો; એના પર તૂટી નથી પડતો કે ‘ચાલો તપાસ કરો, કયાં ખોવાયા, કયારે ગયા, કેમ ગુમાયા...’ વગેરે. આવું કશું કરવાનું નહિ. મોટી કિમતનાં કુંડલ ખોવાઈ ગયાનું સાંભળે છે છતાં દિલ એવું વિવેકી અને ઉદાર છે કે એ સમજે છે- “આ જડ વસ્તુ છે આનો જે સંયોગ મળ્યો, તેમાંથી કંઈ આધું પાછું થાય એમાં મન શા માટે ડહોળાવા દેવું? પુષ્ય સાખુંત હશે તો બીજું મળશે. પણ બાકી આપણે શોક ને પોક જોઈએ નહિ.” એટલે જ પત્તીને આશાસન આપે છે કે ‘હું એવું બીજું કુંડલનું યુગલ કરાવી આપીશ.’ બસ! હવે કેમ? હવે શું પૂછવાનું? સાંભળીને નંદયંતી ખૂશ ખૂશ! પૂર્ણભદ્રે પણ કદ્યા મુજબ બીજી કુંડલજોડી કરાવી આપી. નંદયંતી શું વિચારે છે? - “ફિકર નહિ! સરસ થઈ ગયું. એક કુંડલજોડી આપણને પચી !”

અહીં જોવાની ખૂબી એ છે કે પતિ-પત્તી બંનેમાં કેટલો બધો ફરક છે? જગતમાં એ તો નક્કી છે કે આયુષ્ય પહોંચે ત્યાં સુધી જીવવાનું છે; અને આયુષ્ય ખૂલ્યે અવશ્ય મરવાનું છે. સજ્જન દુર્જનને આ બેય સમાન છતાં જીવન જીવવાની પદ્ધતિમાં આકાશ પાતાળના અંતર પડે છે. એના એજ કુંડલ પર જ્યારે નંદયંતી જૂઠ હંકે છે, ત્યારે અમરગુપ્ત ‘કાંઈ નહિ’ ઉદારતા દાખવે છે; કેમકે પોતે સજ્જન છે. મહાસજ્જન છે, નંદયંતી અનેક ભવોથી નિઃશંકપણે દુર્જનતા આચરતી આવી છે. એને અહીં કોણ ફેરવી શકે? હજુ ગુરુઓ કે કલ્યાણમિત્રો ફેરવી શકે. પણ પોતાને એ દુર્જનતા ફેરવલી જ કયાં છે? દુનિયામાં સદાને માટે અંગિ તે અંગિ; અને પાણી તે પાણી; પણ માણસ અંગિ જેવો મટીને પાણી જેવો શીતલ ઠરનારો બની શકે છે. એ સિદ્ધ હકીકત ઉપર જ આપણે આપણા ઘડતર સુધ્યારવાના છે. મરવાનું નક્કી છે એ સમજી રાખી મરવા પૂર્વ સજ્જનતાના ગુણો પ્રગટ કરવાના છે.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાચ્ચય કહા.” (ભાગ-૨૨)

૧૩૭

મન કુંડલથી ય વધુ કિમતી છે :- અમરગુપ્તે જીવને-જીવને એ કાર્ય કર્યું છે. તેથી જ અત્યારે એટલી બધી ઊંચી સ્થિતિએ પહોંચી ગયેલ છે કે કુંડલ ભલે બહુ કિમતી હતાં, પણ એની ખાતર એથી પણ વધુ કિમતી એવા મનને ડહોળાવવા દેવાનું એને પોખાતું નથી; ખપતું નથી. જાણો છો ખરા કે મન આપણું હીરા કરતાંય વધુ કિમતી છે? શાથી કિમતી? હીરાથી બજારમાં જેટલું ખરીદી શકાય એના કરતાં મનની શુભ ભાવનાથી કેઈ ગુણ ખરીદી શકાય છે. માટે મન મહા કિમતી છે. થોડી કણ પણ શ્રી અરિહંત પ્રભુના ધ્યાનમાં પરોવેલું મન પલ્યોપમોના સ્વર્ગાય સુખ સર્જ શકે છે, તેથી મન તો ધાણું ધાણું કિમતી છે.

વિનશ્ચર ખાતર મન ન ડહોળાવા દેવું :- એને જો જગતની વિનશ્ચર વસ્તુ ખાતર ડહોળાવા દીધું તો એનું એ મન કર્મ બંધ દ્વારા ભવાંતરના દુઃખો સર્જ આપશે. વિચાર તો એ કરવો જોઈએ કે શું મનની ડહોળામણથી વસ્તુ સુધ્યારી શકાય છે? જગતની વિનાશી વસ્તુ ખાતર મન ડહોળાવા દેવાને બદલે અવિનાશી એવા પોતાના જ શુદ્ધ આત્મા ખાતર મનને કાર્ય કરતું રાખવું જોઈએ. જે જગત ઉપર આપણો સાંગોપાંગ અધિકાર ચાલી શકતો નથી. જે આપણા કલ્યામાં નથી, જે આપણા ગુણાદોષની હાનિવૃદ્ધિ સાથે વસ્તુગત્યા સંબંધ ધરાવતું નથી એવા જગતના પદાર્થોથી આપણું મન શા માટે ડહોળાવું જોઈએ? આ મન ડોહળાય છે માટે જ પછી ખોટા વિકલ્પોની હારમાળા ચાલે છે; અને અનિચ્છનીય વાણી વર્તાવ પ્રવર્તે છે. નવી પ્રજાને નાની ઉમરથી જ જો એવા ઘડતર શિખવાડ્યા હોય કે આપણા આત્માથી પર એવી વસ્તુના ફેરફાર ઉપર મનને ડહોળાવા દેવું નહિ; તો પછી એના ચાલુ અભ્યાસથી મોટી ઉમરે એ કઠીન ન પડે. પણ આ તો મુશીબત એ છે કે નાની પ્રજાના સામે મોટા વડિલોજ વારંવાર ડગલે ને પગલે પોતાના મન ડહોળાઈ જતા દેખાડતા હોય, ત્યાં એ નાની પ્રજા પણ એવું જ શીખે ને? સાંસું ક્યાંથી શીખે? રામચંદ્રા, હરિશ્ચદ્ર અને નણ રાજ જેવા બહુ ગંભીર બાબત બની છતાં મન સ્વસ્થ રાખીને રહ્યા, એવી જ એમની સુશીલ પત્તીઓ હતી કે જેમણે જો કે મહેલવાસમાંથી વનવાસ સેવવા જેવો મહાગંભીર અને મહાદુઃખદ પ્રસંગ ઉપસ્થિત થયો અને વનવાસને સેવવો પક્યો તોય મન ડહોળાવા દીધું નહિ. માણસની માણસાઈ શું? પશુથી ઉચ્ચતા અને શાખાથી શી? એ જ ને કે આપણને સંપૂર્ણ આધીન નહિ એવી દુન્યવી ઘટનાઓ પર મનને ડહોળાવા દેવું નહિ!

અમરગુપ્તે તો મન સ્વસ્થ રાખ્યું છે, પણ નંદયંતીનું મન બિમાર છે. હજુ આગળ જુઓ કે એ ખોવાયેલા ગણાતા કુંડલ પકડાશે ત્યારે કેટલા કૂર વિચારમાં

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“નંદયંતી-(પૂર્ણભદ્ર)અમરગુપ્ત” (ભાગ-૨૨)

૧૩૮

ચહે છે. અત્યારે તો એણે જૂનાં કુંડલ પોતાના અંગત દાબડામાં ધૂપાવી રાખ્યા છે. પતિને એ દાબડો જોવાનો અવસર જ ક્યાં છે? તેથી પતિ એ સમજમાં રહે કે જૂના ખોવાયા તે ખોવાયા.

કોઈના સ્નેહી બન્યા પછીની સાવધાની :- નંદયંતી કોણ છે? અમરગુપ્તની અત્યંત નિકટની સગી. છતાં જીવન કપટવાણું પોતાના પતિની જ સામે. કેમ? જગતની વિનશ્વર સંપત્તિ ખાતર માયા-કપટ! તો આ પરથી આપણે સાવધાની એ રાખવાની કે કોઈના પણ સ્નેહી ગણાયા પછી તેના સાથે દાવપેચ ખેલનારા ન બનીએ. સ્નેહી બન્યા પછી દાવપેચ ખેલવામાં વિશ્વાસધાતનું પાપ લાગે છે. કેમકે ત્યાં સામાને આપણા પ્રત્યે શંકાશીલ બનાવીને પેંતરો રચાતો નથી! સગો દિકરો હશે, ને દાવપેચ કરતો હશે તો દેખાવ એવો કરશે કે જાણે હું તમારો જ છું! તેથી બાપ દિકરાને દુકાન સાંપે છે. પણ ભાઈ શું કરવાના? જુદી જમાવટ! કમાણીમાં બાપને ઓછું બતાવવાનું. કેમ? “હા, નથીને અવસરે બાપ સાથે ઝઘડો પડે અને જુદા થવું પડે, તે વખતે જો આપણે જુદું જમા કરીને સદ્ગ્ર થયા હોઈએ તો વાંધો ન આવે! અથવા “ખાનગી સહૃદામાં અવસર બારીક આવી લાગે તો પહોંચી વળવા કામ લાગે.” અથવા એમ થાય કે “આપણી સ્થિતિ સદ્ગ્ર હોય તો કમનું. જેથી બીજાનાં ઓશિયાળાં કરવા ન પડે... સામી છાતીએ ઊભા રહી શકીએ...” આ શું છે? વિશ્વાસધાતનું પાપ. હજ્ય કદાચ પરાયા સાથે આવો પ્રસંગ ઓછો બને; પણ સ્નેહી સાથે જલદી બને; માટે જ આ સાચવવાનું કે “સામો સ્નેહી છે તો આપણે એવા સ્વાર્થમાં ન પરીએ કે જેથી તેની સાથે દાવપેચની રમત કરવી પડે.”

નંદયંતી પકડાઈ :- લાગે જુદું અને બહાર બતાવે જુદું-એ ઘોર દ્રોહ છે. નંદયંતી તેવો જ દ્રોહ કરી રહી છે. પરંતુ કહેવત છે કે “પાપ પીપળે ચઢીને પોકારે!” બસ, અહીંયાં પણ એવું બને છે, જોગાનુજોગ નંદયંતીએ પોતાના દાબડામાં વીઠી મૂકી છે, ને પૂર્ણભદ્ર પોતાની વીઠી લેવા ભદ્રકભાવે તે પેટી ખોલી જુએ છે. તેમાં વીઠી ઉપરાંત પેલું કુંડલ દેખાયું! ત્યાં સામાન્યતયા એના મનને થાય છે, “શું કુંડલની જોડ જડી ગઈ લાગે છે?” પરંતુ એટલામાં નંદયંતી જાણે ભયભીત બનીને ત્યાં આવી પહોંચી. પતિના હાથમાં વીઠી જોઈ. એ પરથી કળી ગઈ કે દાબડામાં કુંડલ જોયા હશે એથી નંદયંતી વિલખી પડી ગઈ. અમરગુપ્ત આચાર્ય મહારાજ કહે છે- “મેં એના મોં પર સંકોચનો ભાવ જોઈ લીધો. એના મનને કોઈ વધુ સંકોચ ન થાય, એટલા માટે જલદીથી હું ધરની બહાર નીકળી ગયો. હું તો સારા હેતુથી ધરમાંથી બહાર નીકળ્યો,” પણ એને (નંદયંતી) લાગ્યું

કે “એમણે કુંડલ જોયા. તો હવે શું કરવું? કેમકે મારી હલકાઈ થવાની. કેમકે સગા-સંબંધીઓને જો કહેતા ફરે ‘શું કરું... ધરનું માણસ જ ચોર... ને આવી મોટી ચોરી...’ વગેરે વગેરે તો જરૂર મારી બદબોઈ થશે. પરંતુ ના, એમ થાય તે પહેલાં જ એમને મારી નાખું, ઉપાય સીધો છે. ઉચ્ચ કામણાનો પ્રયોગ કરી દઉં.” સીધી મારી નાખવાની જ વાત! શું કર્યું આણે? પૂર્વ જીવનોમાં જેનો બહુ અભ્યાસ કર્યો છે, તે જ તો. પતિને મારવાનું સૂઝયું! ઊઠિને શીધધાતી કામજા તૈયાર કર્યું. ધણીને ખવરાવે કે તાબડતોબ પહોંચી જાય સ્વર્ગલોકમાં. શીધતાથી મૃત્યુ થાય તેવી અનેક વસ્તુઓ એણે એકલીએ મેળવીને કામજા તૈયાર કર્યું. પતિના મનમાં કાંઈ નથી પણ જેના દિલમાં પાપ હોય તે ઊંધું જ કલ્પે એ સહજ છે. તેથી નંદયંતી ઊંધું કલ્પી હવે મારી નાખવાના વિચારે ચઢી.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૪૫, તા. ૨૩-૭-૧૯૫૫

મન પર ચોકી :- કેટલી કૂર લેશ્યા છે? આમાં જો આયુષ્ય બંધાય તો નરક વિના શાનું બંધાય? એ પણ મનમાં લેશ્યાની જેટલી કૂરતા, તેટલી જ નરકની ભયાનકતા! માટે જ આ મન પર મોટી ચોકી મૂકવાની જરૂર છે. સમજી રાખવાનું છે કે અવસરે કાયાથી પાપ, જો પુણ્ય કાચું હશે, તો નહિ પણ બને. કેમકે પુણ્યની કચાશથી પાપની સામગ્રી નહિ મળે તેવી કાયાથી પાપ નહિ થાય. પરંતુ મનમાં તે પાપ પેસાંજું કે ખાનાખરાબી શરૂ થઈ. શું સમજ્યા? બહાર પાપ કરવા માટે પણ સામગ્રી મળવાનું પુણ્ય જોઈએ! ચોરી કરવા છતાં ધન મલે એવો નિયમ નહિ. પણ પુણ્ય હોય તો મલે. નહિતર તો વગરભાડાની કોટી મલે! કઈ? જેલની! માટે જ માનસિક પાપ માત્ર ફોગટ જાય છે એટલું જ નહિ, પણ ઘોર કર્મબંધ અને કુસંસ્કાર થવાના નુકસાનમાં ઉતારે છે.

નંદયંતીએ પાપની માનસિક ઉચ્ચતા કેળવવા માંડી! એ જે વિચાર કેળવે છે તે કેવો ભયાનક છે, કે ઠેઠ છઢી નરકમાં પહોંચી જાય. જુઓ એનો વિચાર “બસ જરા હોઠે અડાડે આ કામજા, કે તરત જ લાંબાપાટ થઈ જાય! ઊઠવા જ ન પામે. મને બહાર ફોજેત કરે?... બતાવી આપું.” શું આ? મનની કેવળ ભ્રમજા! કોને ખબર ધાર્યું થયું કે નહિ, પણ મનનો ધંધો કે આવી કૂર વિચારણા કરે. કહો, હવે જીવ ઊંચે શી રીતે આવે? માટે જ મન પર ચોકી જોઈએ. શ્રી કુંથુનાથજી પ્રભુની સ્તુતિ કરતા આનંદધનજી મહારાજ કહે છે-

“મન સાધ્યું તેણે સધળું સાધ્યું-” સંસારથી તરવાની ચાવી આ-કે મનને

તમારે વશ સાધી લ્યો. પરંતુ “અમે મન સાધી લીધું છે.” એમ કહ્યા માત્રથી ન માનું. કેમકે મન સાધવાની વાત મોટી છે. મન લુચ્યું છે. તે ભાસ કરાવે છે કે “હું તમારે વશ છું, તમારે જે વિચાર કરવા હોય તે કરો !” પણ વર્તે છે તો પોતાની મુનસફી પર ! એ આપણી પાસે જ નાચ કરાવતું હોય છે. વાસ્તવિક તો જેણે મનને સાધું હશે, તેના આત્માના દેઢાર જુદા હશે.

“મેં મનને સાધું” એમ કહેવામાં પણ અહેંકારવૃત્તિ છે. “હવે હું બરાબર બળવાન થઈ ગયો.” આ બોલવામાં જે “મેં” અને “હું” આવ્યું, તે અહેંકારની વૃત્તિ છે. અને તે વૃત્તિ પણ મનનો નાચ છે. હવે જો આત્માનો મન પર કબજો હોય તો અહેંકાર ન રહે. નાનકડો અહેંકાર પણ ન રહે, કે- “હું જ્ઞાની ! હું તપસ્વી ! હું મનને કબજો કરનારો...” વળી કવિ કહે છે “ઈમ કહે સાધું તે નવિ માનું-” આવું મોઢે બોલ્યે શું કામ લાગે ? મોઢે બોલેલું હું ન માનું એટલે વસ્તુગત્યા જો મનનો કબજો કર્યો હોય તો તો કહ્યા ન કરે કે હું મનઃસંયમી. બાકી ખરેખર મન વશ કરવામાં આવે તો ઓઝો બધું જ વશ કરી લીધું. -મુક્તિ આખી વશ કરી લીધી. આ વાત પ્રતિપળ હૈયે ચોટેલી હોય તો એ ખ્યાલ રહે કે ‘કાયિક રીતે ભલે હું નબળો હોઉં - વિચિત્ર સંયોગોમાં હોઉં, છતાં મનને નહિ બગડવા દઉં.’ દુશ્મનને લાકી લગાવવાની છે. પણ અંતરમાં દુશ્મનનું બૂરું ચિંતવવાની વાત નહિ. મનમાં તો એ ચિંતવવાનું કે ‘અનું ભલું થાઓ. એને સદ્બુદ્ધિ સૂર્જે ! વળી ફટકો એને શું લગાવું ? મારી જાત જ ફટકાને લાયક છે. તો એને ન લગાવું ?...’ મન પર કાબુ હોય તો અસદ્ભાવનાઓ-કુવિકલ્પો અને દુર્ધ્યાનને સ્થાન ન મળે.

(૧) અસદ્ભાવનાઓ એટલે શુભ ભાવનાઓની જે પ્રતિપક્ષી (વિરુદ્ધ) ભાવનાઓ. દા.ત. પુદ્ધગલ પર મમત્વની વિચારણા, જગતમાં સંયોગોની કાયમીપણાની વિચારણા, જગતના સંબંધોને મહત્ત્વના માની લેવાની વિચારણા વગેરે અસદ્ભાવના છે.

(૨) કુવિકલ્પ એટલે ‘પૈસા લઈ આવું. માન મેળવું. આમ થાય તો પછી આમ કરું’ વગેરે માનસિક કુવિચારો.

(૩) દુર્ધ્યાન એટલે આર્ત અને રોદ્ધ્યાન, ‘અહાણ ! કરોડ મળે તો કેવી મજા !’ ‘અરેરે દુઃખ ક્યાં આવ્યું’ વગેરે ચિંતન.

જો મન પર ચોકી ન રાખી અને સુંદર ભાવનાઓ મનમાં રમતી ન રાખી, તો પેલી દુર્ભાવના-કુવિકલ્પો વગેરે મનમાં રમ્યા કરવાના.

પતિને મારવા જતાં ફસી : સર્પદંશ : - નંદયંતીએ એજ કર્યું. ઝેરનું ઔષ્ણ

બનાવ્યું. અને નક્કી કર્યું- ‘એક ઠેકાણે લાવ મૂકી દઉં, કોઈ જુઓ નહિ તે રીતે; અને પછી ગમે તે ઠગાઈ કરીને પીવરાવી દઉ !’ આ રીતે કાળીલેશ્યામાં ચેઢેલી નંદયંતી ઝેરનો વાટકો લઈને એકાંત ખૂણામાં મૂકવા ગઈ. ત્યાં બહારથી એક કાળાનાગે, ફણિધરે ઉફ લઈને એના પગે ડંસ માર્યો. ઝેરનો વાટકો ત્યાં જ પડી ગયો, ને રાડ પાડીને પડી નીચે, પડતાંની સાથે-

દ્યાળું અમરગુપ્તની વિરાગ ચિંતવના :- આચાર્ય ભગવંત કહે છે- “ત્યાં કુદ્રદેવ નામના પુરોહિતે મારી પાસે આવીને મને સર્પદંશનું કહું, એટલે હું દોડતો ઘેર આવ્યો. ઘરે આવીને જોઉં હું તો નંદયંતીને કાળા સાપનું ઝેર શરીરમાં વ્યાપી ગયું છે, અને આયુષ્યને જ્ઞાણ હવે સમાપ્ત કરતી પડી છે ! મને કંઈ કલ્પના ન આવી કે એ શું કરવા ગઈ હશે ને શું થયું. ગમે તેમ પણ હવે એને બચાવવી જોઈએ, એટલા માટે મેં ગારુડિકને બોલાવવા મોકલ્યા. અહીંયાં નંદયંતીને જોઉં હું તો એની ઘડી-બેઘડી ગણાઈ રહી છે. એની આ સ્થિતિ જોઈ મને વિચાર આવ્યો કે- ધિક્કાર છે આવા માયાવી ઈન્દ્રજાળ જેવા જીવતરને” અમરગુપ્ત શા માટે આમ વિચારે છે ? ઝેના પર વિશ્વાસ રાખીને આપણે બેઠાં હોઈએ એવા જીવતરનું એકાએક આવું પરિણામ આવીને ઊભું રહે છે માટે તો. “અરે ! આપણા જીવને આવા વિશ્વાસધાતી જીવતરો ક્યાં સુધી !” આવું મનને થાય છે ખરું ? આપણને જીવતર ભલે, કે ખુશી ખુશી થઈ જઈએ છીએ. પરંતુ ખબર નથી કે એ જીવતર ઉપર જ વિટંબણાઓના ધાડાં ! એના અવસરે એજ એવો દગ્ગો દેશે કે બધી ધારણાઓ ખતમ !

નંદયંતી મરે છે :- અમરગુપ્ત મહર્ષિ કહે છે કે “પત્તીની આ દશા પર આંખમાં આસું સાથે ગદ્ગદ કંઠે મેં પૂછ્યું- ‘સુંદરી, તને શું થાય છે ?...’ પણ નંદયંતી બોલી શકતી નથી. સર્પનું ઝેર ચ્યાદી ગયું છે, હવે તે જીવશે એવી આશા ન રહી. તો પણ ગારુડિકો કહે તે પ્રમાણ એ વિચારમાં ગારુડિકોને જે બોલાવેલા તે આવી ગયા. મંત્રશક્તિને ધરનારા હતા. મેં તેમને કહું.- ‘આ ઝેર ઉતારી આપો.’ પરંતુ નંદયંતીને જોતાં જ એ મારા જેવા જિન્ન થઈ ગયા. કહે છે ‘સાર્થવાહપુત્ર ! ગુસ્સે ન થતાં. આને કાળસર્પનો ડંસ છે. મૃત્યુનો જ ડંસ છે. એવી રીતનું ઝેર વ્યાપી ગયું છે કે જે મંત્રશક્તિનો વિષય નથી. મંત્ર માટે પણ અસાધ વસ્તુ છે. અમારે તમારું કામ અવશ્ય કરવું જોઈએ; પણ લાચાર છીએ.’ એમ કહીને ગારુડિકો ચાલી ગયા. આજુભાજુનો પરિવાર શોક-આકંદ કરવા લાગ્યો. ત્યાં નંદયંતીનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, ને મરીને છદ્દી નરકમાં ર૧ સાગરોપમના આયુષ્યવાળો નારકી જીવ થયો.

જીવનમાંથી શું સાર કાઢ્યો ? કલ્પનાની જાળ ને વિકલ્પોના કિટલા રચવામાં શું મલ્યું ? પ્રત્યક્ષમાં કંઈ નહિ, ને પરોક્ષમાં કલ્પનાતીત ઘોર હુઃખ !! તો આપણે સમજવું જોઈએ કે કલ્પનાઓ ધડી કર્યે જઈએ છીએ પણ હાથમાં તો કંઈ આવતું નથી. હાથમાં તો જે ભાગની ચિહ્ની મુજબ આવવાનું હશે તે જ આવશે. તો ખોટી ને ખરાબ કલ્પનાઓ કરી કરીને ખાલી મગજને થકવવું તથા આત્માને પાપથી ભારે કરવો શા માટે ?

સત્તાધીશ કર્મ :- ભાગની, કર્મની શિરજોરી જાણો છો ? જીવ અશક્ય નહિ પણ શક્ય જણાતી એવી ધારણાઓ કરે; તો પણ સત્તાધીશ કર્મ ઊંઘું વાળે છે. એક કરંદિયામાં કોઈએ સાપને પેક કરીને રાખ્યો હતો. ધણા દિવસથી સાપ ભૂખ્યો ડાંસ જેવો હતો. ત્યાં એક ઉંદરભાઈ ફરતા ફરતા આવ્યા. કરંદિયાને જોઈને વિચારે છે ‘દીક માલ ભર્યો લાગે છે. ચાલો સારું ખાવાનું મળી જશે ! ને એ મેળવવાનું કામ તો આપણું જ !’ એમ કરી કરંદિયાને કોચવા માંડ્યો. જ્યાં કોચે છે, ત્યાં જ અંદરમાં સાપ મોં ફાડીને બેઠો છે ! સાપને તો ડર લાગે છે કે શું આપત્તિ આવશે ! પરંતુ ઉંદરભાઈ તો હોંશમાં ને હોંશમાં - આખું શરીર પેસે તે રીતે સીધા જ સાપના મોંટામાં પેઠા ! શું પરિણામ ? ફળ-મેવા ખાવાના કરેલા વિકલ્પો શું કામ લાગ્યા ? આજના હાટફિલ્ઝના કેસો એ શું છે ? કર્મની શિરજોરી. ચાનો ખાલો હાથમાં રહી જાય, ને જીવ ગેપ થઈ જાય છે ! ત્યાં જ્યારે ચાનો ખાલો હાથમાં છે તે વખતે અંદરમાં શું ગડમથલો ચાલતી હશે ? કયા વિકલ્પો રમતા હશે ? છુતાં પરિણામે શું ? કર્મના દોરે દોરાવાનું. ઉંદરડાને જીવન અને ભોજનની સંભાવના છતાં કર્મની શિરજોરીમાં ભોજન તો ન મળ્યું પણ જીવનેય ગયું ! મૃત્યુ મળ્યું ! ત્યારે કર્મની મહેરભાનીમાં, સર્પને જીવન-ભોજન બેયની આશા નહિ છતાં, ઉંદરડો સીધો એના મોંમાં આવ્યો, અને એજ રસ્તે સાપને કરંદિયામાંથી છૂટકારો મણ્યો,

ખૂબી જુઓ કે પાછા મનોરથો પણ જીવને કેવા સૂર્જે છે ! તમે એવા મનોરથો ધડી રાખ્યા છે ને કે “અહીંથી ૧૧ વાગે જઈશ... આ કરવું છે - તે કરવું છે... ત્રીજી સાલે છોકરીનું લગ્ન કરવું છે... પાંચમે વર્ષે કનેયો મોટો થશે. એનું લગ્ન...” વગેરે ? પણ એવા એવા મનોરથો નહિ કે - “દિવાળી ઊતરે બ્રહ્મચર્ય લઈ લેવું છે... પછી બારવ્રત લઈ લેવાં છે... પછી સંધ કાઢવો છે... પછી ઊજમણું... ને પછી ચારિત્ર !” આવું ખરું કે નહિ ? “ના, એ તો મહારાજ તમને સોંઘું. તમે બધું છોડીને બેઠા તે બધું તમને પાલવે...” જો આમ કહેતા હો, તો સમજી રાખો કે પાપ વિકલ્પ ગમે તેટલા કર્યા; પરંતુ કરેલા પાપના

વિકલ્પોથી કાર્ય બનવાનું તે નક્કી નહિ, પણ એ વિકલ્પોથી પાપનો ધરખમ જથ્થો તો અચૂક વધવાનો. માટે જ જ્ઞાની કહે છે “અરે ! કરવાનું તો પછી, પણ ભાવના તો સારી રાખો ! ભાવના ભવનાશિની !” પરંતુ માનસિક કૃપણતા ભાવના નથી ભાવવા દેતી. કૃપણને હાથે જેમ પૈસા ન બર્ચાય તેમ આ સારી ભાવનાઓ માટેનું કૃપણ મન સારી ભાવનાઓ ન રમવા દે. ત્યારે આ એક એવો સુંદર અવતાર મણ્યો છે કે જ્યાં મનથી સારાં કે નરસાં-જેવાં નાટક રચવાં હોય તેવાં રચી શકાશે. માનવના આ મનથી સારામાં સારું ય નાટક રચી શકાય; અને ખરાબમાં ખરાબ પણ રચી શકાય. જુઓ આખાડાભૂતિએ ખાલી નાટક રૂપે દેખાડેલી ભરત ચક્વતની ભાવનાઓએ પણ પાંચસો રાજકુમારને સંસારથી ઊભા કરી દીધા, સાચા સાધુ બનાવ્યા.

● આખાડાભૂતિનું નાટક ●

કોલ ભંગ થવાથી :- આખાડાભૂતિ અણગાર મટી નાટકિયાની છોકરીઓમાં ફસાયેલા. પરંતુ પાછા જાગ્રત થઈ ગયા. ફસાતા પહેલાં છોકરીઓ પણે આખાડાભૂતિ ગયાતી તો નાટક કરવા, પણ કારણસર નાટક બંધ રહેલું હોવાથી તુરત પાછા આવ્યા, ઉપર ચઢ્યા. ત્યાં જુએ છે તો બંને સ્ત્રીઓ ભાન ભૂલી બની છે; પહેરેલા કફડાનાં ઠેકાણાં નથી ! મોં પર માખીઓ બણાબણે છે ! મદિરાની દુર્ગધ મારી રહી છે ! પાછી કંઈક ઊલટી થઈ હશે, એમાં માંસ પણ નીકળ્યું હશે. ત્યાં આખાડાભૂતિ વિચારે છે- “અરેરે ! જેના પર પ્રેમમાં આંધળો થઈ ભવોભવની પીડ મીટાવી દે તેવા મહામૂલા ચારિત્રને મેં કોરે મૂક્યું, તે અભાગણીઓ આ કોટિની ? કે મારું એક વચ્ચન પણ ન પાળી શકી ? અરે ! આ તે કેટલી વિશ્વાસધાતિની, અધમ હૃદયની ! કેવીક કજાત ! ક્યાં રહ્યો એનો મારા પર પ્રેમ ? તો હું જ પાગલ કે એના પર પ્રેમ કરું છું ? આ કજાતોના પનારે પડ્યો રહ્યો છું ? વિકાર છે મને !” માનશો નહિ કે એકલા આખાડાભૂતિને જ આવો પ્રસંગ આવે, દુનિયામાં ડગલે ને પગલે એવા પ્રસંગો છે, કે જે વિવેકથી વિચાર્ય હોય તો આત્માને વૈરાગ્ય ઉપજાવ્યા વિના ન રહે. પરંતુ એ વિચારવા હૈયું સતેજ જોઈએ.

આખાડાભૂતિનું હૈયું જાગૃત થઈ ગયું છે “આ ધંધા કર્યા તમે ? આ તમારી કબુલાત ? ફિટકાર છે તમને. જાઓ, હવે હું ચાલ્યો.”- એમ કહી ઊતરી પડ્યો નીચે. જ્યાં નીચે ઊતરવાનો ધડબદ-ધડબદ અવાજ થયો ત્યાં કોઈ દિવસ નહિ ને આજે આ રીતે આખાડાભૂતિને ઊતરતો જોઈ છોકરીઓનો બાપ વિશ્વકર્મા ગલરાઈ ગયો. પૂછે છે- “શું થયું ?”

“શું પૂછો છો ? કજાતની જત. મેં કહેલું માન્યું નહિ. જાઓ, ઉપર જઈને જુઓ એ તમારી લાડકીઓના રંગ !”

“પણ હું સમજાવું છું...” કહેતો વિશ્વકર્મા ઉપર ગયો છોકરીઓને લાત મારીને કહે છે, “ઉભી થાઓ, ઉભી થાઓ. અમાગળીઓ ! આ ચાલ્યો તમારો કંત ! આમ પડી રહેશો તો પતિ ગુમાવશો, અને ભૂખી મરશો તે જુદું.”

બસ, સ્વાર્થ ! દરેકને પોતાના સ્વાર્થની વાત. “ભવિષ્યમાં આ આપણાને સંભાળનાર છે, માટે રોકો એને.” આ સ્વાર્થનો સોઢો છે. એમ નહિ કે “ભાઈ, ભૂતકાળમાં એમણે અમારું ખૂબ કર્યું છે, માટે હવે એમને બેસવા દો. આપણે એમની હવે સેવા કરીએ.” ના, એ શાનું ? બીજાનો વિચાર શું કામ કરીએ ? અમારા વિચારમાંથી ઊંચા આવીએ ત્યારે ને ?

વિશ્વકર્મા છોકરીઓને તમાચ મારી ભાનમાં લાવે છે. “જાઓ, પતિને પગ પકડીને ઉભો રાખો.” છોકરીઓ આવી નીચે.

પગમાં પડીને કહે છે- “ક્ષમા કરો, નાથ ! અમારી ગંભીર ભૂલ થઈ ગઈ છે... હાય ! કેવી અમારી નાલાયકી...” એમ કહેતાં કહેતાં તો આંખમાંથી શ્રાવણ ને ભાદરવો. આંસુની ધાર વહેવા માંડી. બસ, કરુણ હાવભાવ ને કાલાવાલા શરૂ કરી દીધા ! “અરેરે ! રંકડી અમે, અમારે તમારો જ આધાર ! તમે જશો તો અમારું શું થશે ?”...

પરંતુ આખાડાભૂતિ કહે છે- “બસ ખલાસ; કરારનો ભંગ કર્યો, માટે હવે ન રહું.”

છોકરીઓએ જોઈ લીધું કે આ જવાના જ. તેથી છેલ્લો એક પાસો નાખ્યો, કહે છે “નક્કી જવાના ? તો છેવટે અમારી આજીવિકાનું તો કંઈક કરતા જાઓ !” બંને છોકરીઓ જાણે છે કે આ કલાબાજ છે. એક નાટકમાં નાણાંનો ઠગ થઈ જાય ! આખાડાભૂતિને છેવટના દાક્ષિણ્યથી એમ થયું “ઠીક, ત્યારે એક નાટક કરીને જાઉં. પણ એવું નાટક કરું કે જે પાછું મને અને બીજાને પ્રેરણા આપી જાય !”

નાટક મહાબલેશ્વરનું કે સિદ્ધિગિરિની ભાવનાનું :- આપણી વાત નાટક પર હતી. જેવું નાટક રચવું હોય તેવું નાટક માનવનું મન રચી શકે છે. “ઉનાણો છે... મહાબલેશ્વર જાઉં... બંગલો લઉં... હવા ખાઉં... બસ મજા !” આ હુન્યવી નાટક ! આ રીતે સિદ્ધિગિરિ અંગે ય માનસિક સર્જન કરી શકાય. “ચાલો સિદ્ધિગિરિ જઈએ. યાત્રાઓ કરીએ... દાદાને ભેટીએ... ખૂબ ભક્તિ-પૂજા કરીએ... જીવનનો અનુપમ લહાવો લઈ લઈએ...” શાનવિમલસૂરિજી મહારાજ કહે છે કે,

“ધેર બેઠાં પણ એ ગિરિ ગાવે રે,
શ્રી શાનવિમલ સુખ પાવે રે, નાગર સજજના રે કોઈ,”

“ધેર બેઠાં” કેવી રીતે ? “સાક્ષાત્ જાણે સવારે ઊઠાને પહોંચ્યો ગયા તળેટીમાં. આ જાણે સામે દેખાયો ગિરિરાજ... ચઢવા માંડ્યા ઉપર. મન કલ્પે છે કે અહીંયાં તો ગણધર ભગવંત શ્રી પુંડરિક સ્વામી સાથે પાંચકરોડ મુનિ કાઉસરગમાં ઊભા છે ! ને આ બીજી બાજુ તો દ્રાવિડ ને વાચિખિલ્લ દશ કરોડ મુનિ સાથે ઊભા છે ! અણસણ ઝુકાવી દીધા છે !... વાહરે વાહ ! કેવો સરસ પતિત પાવન ગિરિરાજ !... બસ હુંય બનું સાંદું ! અહીં ઝુકાવું અણસણ !” આમ ભાવનામાં તો જો સંઘયણ યારી આપે તો અવસરે ક્ષપકશ્રેણી લાગી જાય. પરંતુ આ આપણને નથી સૂઝતા પણ હું, ગોરાણી, ને ગગો !’ એ સૂર્જે છે. આખાડાભૂતિને થયું કે “એવું નાટક રચું કે જે નાટક મને હવે મહાન પુરુષાર્થી બનાવી જાય ! બસ, ભરતયકૃતિનું જ નાટક ભજવવાનું કે અરીસાભવનમાંથી જ કેવળ લઈને બહાર નીકળાય !” વિશ્વકર્માને કહે છે “એક નાટક ભજવી આપીને જઈશ. રાજાને કહી દો કે ‘ભરત ચકૃતીનું નાટક ભજવવું છે. પાંચસો રાજપુત મદદમાં જોઈએ.’”

નાટકની તૈયારી :- રાજાને જઈને કહું- “આવું આવું એક ચકૃતીનું અલૌકિક નાટક રચવું છે; કે જે આપે અને આપની પ્રજાએ આજ સુધીમાં જોયું ન હોય. પરંતુ તેમાં ચકૃતીના દિવિજય અને દબદ્ધા માટે પાંચસો રાજકુમારો જોઈએ.” રાજા આખાડાભૂતિને ઓળખે છે કે એ કેવો કલાબાજ કારીગર છે ! પાંચસો રાજકુમારો રાજાએ મેળવી આયા. બસ, હવે આખાડાભૂતિનું જ કામ ! રોજની તાલિમ આપવી શરૂ કરી દીધી. થોડા વખતમાં તો પાંચસોય રાજકુવરોને આબેહૂબ પ્રસંગ ભજવનાર અજબ જેલાડી બનાવી મૂક્યા. અંતિમ રિહર્સલ (પૂર્વ પ્રયોગ) પણ કરી લીધું. રાજાને નિવેદન કર્યું કે ‘નૂતન નાટ્યપ્રયોગ તૈયાર થઈ ચૂક્યો છે. હવે ભજવવાની આપવાની આજા જોઈએ.’ રાજા તરફથી દિવસ નક્કી કરાયો. પ્રજામાં જહેરાત થઈ ચૂકી કે ‘ગાજબ નાટ્યકાર આખાડાભૂતિ એક અપૂર્વ જ નાટક બતાવનાર છે, તેનું નામ છે ભરતયકૃતી.

જો જો આ કોનું નાટક છે ? ચકૃતીનું. એટલે સરંજામ બરાબર તૈયાર કર્યો છે. રંગમંડપ મોટો ઊભો કર્યો છે. વિશાળ મંચ પર અનેક પ્રકારે ભપકદાર ચિત્રોના પડદા ગોઠની દીધા છે. બીજા પણ કેટલાય રોનકદાર દેખાવોના પડદા તૈયાર રાખ્યા છે કે જે વચ્ચમાં વચ્ચમાં નાટકના પ્રસંગને અનુરૂપ રચના આબેહૂબ કરી શકે. વળી બધી જ જતના પ્રસંગો બરાબર ભજવી શકાય એ માટે રાજકુમારોને

નિષ્ણાત બનાવી દીધા છે. પ્રેક્ષકવર્ગમાં રાજા-રાણી, અમલદારો અને પ્રજાજન યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયા છે. ત્યાં હવે આખાડાભૂતિ નાટક ભજવવાનું શરૂ કરે છે.

નાટકના પ્રસંગો : ભરતનો દિગ્વિજય :- એક પછી એક પ્રસંગો રજુ થવા માંડ્યા. ચક્રવર્તી ભરતની કુમારાવસ્થાનો કાળ, બાહુબલની સાથે ગંગાની રેતીમાં જેલવું, બાહુબલ રમતાં દાની જેમ ભરતને ઉંચે ઉછાળે છે, પાછો જીલી છે... એક પછી એક પ્રસંગો ભજવાતા ચાલ્યા. લોકોને જોવામાં રસ ઘણો છે. પછી તો ભરત વગેરે સો ભાઈઓને જુદા જુદા રાજ્ય પર રાજ્યાભિપેક થયા. અમાં ભરતને પછીથી ચક્રતન ઉત્પન્ન થયું. તે ચાલ્યા હવે ભવ્ય તૈયારી સાથે દિગ્વિજય કરવા માટે, ચક્રતન આગળ છે; પાછળ મોટા લશ્કર સાથે ભરત છે. ગયદળ, હયદળ, રથદળ, પાયદળ એમ ચાર પ્રકારનું સૈન્યનું પ્રયાણ ધરતી ધુજાવી રહ્યું છે ! જ્યાં છાવણી પડે ત્યાં એક દેશ જેવો દેખાવ બને છે, છ ખંડ જીતવાના છે. વૈતાઢ્ય પર્વતની આજુભાજુના ત્રાણ ખંડ અને પેલી બાજુ ત્રાણ ખંડ, પહેલા આ બાજુના એકેક રાજ્યોને જીતતા ચાલ્યા. ક્યાંય તો સામેથી રાજા નમતા આવે છે, ક્યાંય લડાઈ આપે છે. એવા ભિન્ન ભિન્ન પ્રકારના દશ્યોમાં અંતે ભરતની હૃકૂમતી સ્થાપિત થાય છે. એમ કરતાં વૈતાઢ્ય પાસે આવીને દેવની આરાધના કરી ગુંજા ખોલાવે છે. અમાં થઈને બીજુ બાજુએ જઈ ત્રાણ ખંડ જીતે છે. આ બધા ભરતના વૈભવ પરાકમના દશ્યો શા માટે બતાવાય છે ? આગળ અંતે ખરું તો એ બતાવવું છે કે ‘આવા વૈભવી-પરાકમી આત્મા પણ જીવનની દિશા કેવી બદલે છે ! આવાઓ પણ જીવનની સફલતા શેમાં ઉતારે છે ! મહાવૈભવ અને મહાપરાકમના પુણ્યોદયવાળા પણ જો મહાવૈરાગ્યમાં ચઢે, ને મહાત્યાળી બને, તો સામાન્ય સ્થિતિવાળાએ તો જરૂર ત્યાગ વૈરાગ્ય લેવો જ જોઈએ. એવાને ત્યાગ-વૈરાગ્ય ખૂબજ શક્ય છે.’ આવું આવું કંઈક બતાવવું છે. તેથી પૂર્વ ભૂમિકામાં ભરતના મહાવૈભવ પરાકમ દેખાડે છે.

૮૮ ભાઈઓનો સંસારત્યાગ : રાજ્યાભિપેક : વૈરાગ્ય :- હવે ભરત છ ખંડ જીતીને અયોધ્યામાં પાછા આવે છે. પણ ત્યાં ચક્રતન શસ્ત્રશાળામાં પેસતું નથી; બહાર ઊભું રહે છે. મંત્રી કારણમાં કહે છે ‘આપના નવાણું ભાઈઓ આપની આજ્ઞા નીચે નથી, માટે આજ્ઞા મનાવો. એ વખતે ભરત ધરીને ના પડે છે. ‘ભાઈઓ સાથે મારે ઝગડવું નથી.’ ત્યાં મંત્રી યુક્તિશી ભરતને સમજાવી લે છે; ભાઈઓ પર દૂત મોકલે છે, ‘મોટા ભાઈના મહાન દિગ્વિજયના ઉત્સવમાં આપે હાજર રહેવું જોઈએ. નિકટના સગા કુંભુંભીઓની હાજરી ન હોય તો દુનિયામાં કુણું કેટલું ખરાબ દેખાય !...’ વળી પિતાજીની ગેરહાજરીમાં મોટાઓએ નાનાઓ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૧૪૭

ઉપર પિતા જેવો વાત્સલ્યભાવ દેખાડવો જોઈએ. તેમ નાનાઓએ મોટાની આજ્ઞામાં રહેવું જોઈએ...’ વગેરે વગેરે કહેતાં આજ્ઞા માનવાનો આદેશ આપી દીધો. ત્યાં અંદ્રાણું ભાઈઓ રાજ્યત્યાગ અને સંસારત્યાગ કરી જાય છે. ત્યારે નવાણુંમાભાઈ બાહુબલ સાથે ભરતનો મહાન સંગ્રહ મચે છે. અમાં પણ બાહુબલ જીતમાં છતાં ચુદ્ધ વર્ચ્યે સાધુ બને છે. ભરત પગમાં પડી ખમાવે છે, તે પછી ચક્રવર્તી તરીકે ભરતનો બાર વર્ષનો રાજ્યાભિપેક ચાલે છે. ત્યાં પછી રોજ રાજદરબારે સાધ્યમિકો ભરતયકીને સંભળાવે છે. ‘તમારો આત્મા (મોહથી) જિતાયેલો છે. ભય વધે છે. (પોતાના આત્માને) હણો નહિ, હણો નહિ !’ આના પર ચક્રવર્તી વૈભવવિલાસમાં છતાં મનમાં વૈરાગી રહે છે. એક પછી એક ચમત્કારિક અને કદી નહિ જોયેલા ભવ્યતાભર્યા પ્રસંગો જોઈને રાજી ને પ્રજા ખુશ ખુશ થઈ ગયા.

ભરત અરીસાભવનમાં : - ત્યાં તો હવે ભરત ચક્રવર્તીનો વેશ ભજવનાર આખાડાભૂતિ ચક્રવર્તીના પૂર્ણ ઠાઠમાઠ સાથે ૫૦૦ મુકુટબદ્ધ રાજાઓની પંક્તિની સલામી જીલતાં અરીસાભવનમાં જઈ રહ્યા છે. ૫૦૦ રાજકુમારોને પણ એમજ લાગી રહ્યું છે કે ‘અમે ખુદ ચક્રવર્તીની જ તહેનાતમાં છીએ !’ અરીસાભવનની રચના થઈ ગઈ છે. ચક્રવર્તી ભરત ત્યાં પહોંચી અરીસામાં પોતાની શોભાને નિરખી રહ્યા છે. ત્યાં એક આંગળી પરથી વીંઠી સરકી પડી ! વીંઠી વિનાની આંગળીને ચક્રવર્તીએ અરીસામાં જોઈ. એથી ચોક્કા ! “અરે ! આ શું ? આ આંગળી કેમ સાવ બેઠોળ દેખાય છે ? “ઓહો ! આ એક વીંઠી નીકળી ગઈ, તેમાં આંગળી આવી ફિક્કી લાગે છે ! ! તો શું આ શરીરની પોતાની કોઈ શોભા નહિ ?” આ બધી શું ભાહુની શોભા ? લાવ જોઉ એકલું શરીર કેવુંક લાગે છે !” એમ કરી શરીર પરથી એક એક આભૂષણ ઉતારતાં જાય છે, અને એના વિના અંગોની થતી નિસ્તેજતા જોતાં જાય છે, સાથે વૈરાગ્ય ભાવનાના અંતરના ઊંડા સંવેદનો પ્રગટ કર્યે જાય છે.

“ઓહો ! આ તો બધું નકલી જ દેખાય છે ! બધું અનિત્ય અને અને વિશ્વાસધાતી !...” મારી તો કોઈ શોભા જ નથી દેખાતી ! જેની શોભા દેખાય છે તેય વિનશ્ચર ! તો, અરે મૂર્ખ જીવ ! અવિનાશીને મૂકી તું આ વિનાશીમાં ફસાઈ ગયો ? પુદ્ગલના અનિત્ય રંગમાં તું નિત્ય એવો આત્મા ક્યાં ફસાઈ પડ્યો !!!” પાંચસો રાજકુમારોને એવી સ્થિતિમાં લાવી મૂક્યા કે એમને તો સાચે જ એમ લાગે છે કે ‘ઓહો ! આ ચક્રવર્તી શું ખોટું વિચારે છે ? વાત ખરી છે ગમે તેવા મોટો વૈભવ, પણ એક હિ’ એણે કે આપણે ઉડી જવાનું !’ ભરતની ભાવના સાથે એકીટસે રાજકુમારોના મન એવા ભાવમાં ચઢી ગયા, કે સાચા સાધુ

૧૪૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“આખાડાભૂતિનું નાટક” (ભાગ-૨૨)

બની બેઠા. તેમ આખાડાભૂતિ માટે પણ કોઈક એમ કહે છે કે નાટક ભજવતાં એવી સાચી ભાવનામાં ચઢી ગયા કે કેવળજ્ઞાન પામ્યા. સાંભળી રહ્યા છે. “અરે મૂર્ખ જીવડા ! તને એમ લાગતું હોય કે હું બધા પર હક્કુમત ચલાવી દઉં ! તું શું હક્કુમત ચલાવતો તો ? તારા પર ઘણા દુશ્મનો હક્કુમત બજાવી રહ્યા છે. મહાન કર્મસત્તા, મોહની સેના, શરીર, ઈન્દ્રિયો વગેરેની હક્કુમત છે. આ બધા જડ સંયોગો પુણ્યને જાડો કહી રહ્યા છે કે ‘પુણ્ય ! તું ચક્રવર્તીને શું ઉંચે ચઢાવતો હતો, અમે તેને જોત-જોતામાં નીચે પટકી દઈએ તેટલી વાર છે !’ ક્ષણ ભર પણ પરલોકને સુધારવાની યાવતું આત્માના સામ્રાજ્ય સર કરવાની કોઈ વિચારણા કરતો નથી ! ને આ સ્નેહીથી બીજો સ્નેહી. આ ખાનપાનથી બીજુ ખાનપાન-આ દેહથી બીજો દેહ... કુતરાની જેમ હીઓ કાઢે છે ! આરંભ-પરિશ્રેષ્ઠના પાપમાં જીવન બરબાદ કરે છે ! એકી કલમે જ્યાં બધું સારુ, ત્યાં નિરાંત શી ?...”

એકેકી ભાવના એવી લલકારવા માંડી કે ત્યાં રાજકુમારો તો સજજડ થઈ ગયા. કેમ જાણે ભરતને મહાવૈરાગ્ય થઈ ગયો; અને ઉપરથી દેવો ઊતરી આવ્યા. વેષ આચ્છો... ભરતે તે પહેર્યો, અને એ તો નીકળ્યા બહાર ! ત્યાં પાંચસો રાજકુમારોય સાધું બની ચાલ્યા આખાડાભૂતિની પાછળ. ત્યાં રાજ ઊભો થઈ ગયો. રાજકુમારોને કહે છે. “એ તો નાટકિયો એટલે જાય, પણ તમે ?...” પાંચસો કહે છે ? “હોય નહિ, એ નાટકિયા નથી. એ તો ખરેખરા સાધુ છે ! અમે એમની પાછળ જ સાધુ છીએ. જેવું ભજ્યું તેવા બન્યા છીએ.” આપણી વાત હતી કે મન નાટક બંને પ્રકારનાં રચી શકે છે. આખાડાભૂતિના સંસર્ગમાં એવી ભાવના રાજકુમારના મને ખેલી કે સાચા સાધુ બની ગયા.

નંદયંતી નરકે : અમર અમર :- સર્પદંશથી નંદયંતી માયાના પાપમાં મરીને છઢી નરકમાં ગઈ. પતિ પૂર્ણભદ્ર (અમરગુપ્ત) શુભવિકલ્પોને કરનારા છે. તો એમને જીવન પર તિરસ્કાર છૂટ્યો; અને મોક્ષની એવી અભિલાષા વધવા માંડી કે સંસાર ધોર અસાર લાગવા માંડ્યો. જેના પરિણામે સ્નેહીઓને કહી દીધું કે “જુઓ, જેવી આ નંદયંતીની દશા, એવી આપણી પણ કેમ ન થાય ? માટે હું તો જાઉ છું...” એમ કહીને અમરગુપ્તે બહાર નીકળી જઈ ચારિત્ર લીધું. ધોર તપ-સંયમ-સ્વાધ્યાયની સાધના કરી, ગુરુસેવાની સાધના કરી, અને આચાર્ય બન્યા. આગળ વધીને એ અવધિજ્ઞાની મહર્ષિ અમરગુપ્ત આચાર્ય મહારાજે પર્ષદામાં પોતાના ભવ કર્યા. રાજ અને લોકોના મનમાં પણ આ સાંભળી વૈરાગ્ય પ્રગટ થઈ ગયો. રાજાનું હૈયું ગદગદ થઈ ગયું. એટલે પૂછે છે, “ભગવંત ! આગળ પર શું થશે ?” અવધિજ્ઞાનીએ કહ્યું, “નંદયંતીનો જીવ છઢીમાંથી નીકળી અનંતકાળ

સંસારમાં ભટકશે; ધોર વિંબણા પામશે-અનંતકાળ પણી સંયમ પામી-પાળીને કેવળજ્ઞાન પામશે; મારે આજ જીવનમાં મોક્ષ થશે,” શું ? અમરગુપ્ત અમર બની જશે. આ સાંભળીને એજ પર્ષદામાં રહેલા ધર્મધોષને વૈરાગ્ય વધવાથી અનેક નગરજનો સાથે ચારિત્ર લીધું. આગળ વધીને આચાર્ય પદ પામ્યા. એજ ધર્મધોષ આચાર્ય મહારાજ સિંહકુમારને કહે છે- “આ મારું વૈરાગ્ય પામવાનું કારણ છે.”

સમરાદિત્ય કેવળી મહર્ષિ બીજા ભવે સિંહકુમાર રાજપુત તરીકે આ રીતે અવધિજ્ઞાની અમરગુપ્ત મહર્ષિનું ચારિત્ર સાંભળી લે છે. એથી એમને શી અસર થાય છે તે આગળ જુઓ.

અમરગુપ્ત આચાર્ય મહારાજનું જીવન સંપૂર્ણ.



સિંહકુમારને વૈરાગ્ય :- ધર્મધોષ આચાર્ય મહારાજને વૈરાગ્યમાં જે નિમિત્ત હતું, તે અમરગુપ્ત આચાર્ય ભગવંતનું ચારિત્ર શ્રવણ કરી સિંહકુમાર કહે છે- “ભગવન્ ! આપના નિર્વેદનું કારણ ધાણ સુંદર !” પહેલાં સિંહકુમારને જે લાગતું હતું કે આવી નાની ઉમરમાં અને પુણ્યશાળી સ્થિતિમાં સંસાર કેમ ધૂટે ? તે હવે સોમાના ભવથી માંડી ચક્કદેવ, અનંગદેવ વગેરે... યાવતું અમરગુપ્તના ભવ સુધીની રોમાંચક કથની સાંભળી લાગે છે કે, “બરાબર છે, સંસાર વૈરાગ્ય આવે તેવો જ છે.” પોતાના દિલમાં વૈરાગ્યની આ વસ્તુ બરાબર છસી ગઈ. જેને સાચા સમજદાર જીવ કહીએ તે જીવો અભાણ હોય ત્યાં સુધી જિજ્ઞાસા રાખે. પણ જિજ્ઞાસાને તૃપ્ત કરતાં તેવો ખુલાસો-વિચારણા જો મળે, તો પછીથી એનો સ્વીકાર એવો કરી લે કે પૂર્વગ્રહ કોઈ કુતર્ક કરવાની વાત નહિ. જે સાચા સમજુ હોય તેની આ રીતિ હોય છે. પણ જે અજનુસ્ખની વચ્ચેની દશામાં છે, તેને તમે સમાધાન આપો એટલે એના પર એને પથરો ફેંકવા જોઈએ ! કેવી રીતે કુતર્ક લગાવે ખબર છે ? એમ કહેશે ‘શું આ ચારિત્ર સાંભળીને એકદમ દીક્ષા લઈ લેવી ? હા, એય બને, કોઈકની જીવનમાં તેવું બને. પરંતુ એવું ક્યાં ચારિત્રમાં આવ્યું કે, ધર્મ જાણ્યો કે તેજ વખતે દીક્ષા લઈ લેવી ? એ તો પહેલા ગુરુ મળ્યા... ધર્મ મળ્યો... શ્રાવક બન્યા... સંસારમાં રહ્યા ને પણી દીક્ષા લીધું... અને તમે તો કહો છો ચારિત્ર સાંભળીને તુરત જ... વૈરાગ્ય થઈ ગયો ! પણ એ કેમ બને ?’ આવા આવા કુતર્કો ઉઠાવવાના ઘણા મળે, પણ સિંહકુમારે એ ચારિત્ર સાંભળ્યું ને વૈરાગ્ય થયો.

સિંહકુમારના પ્રશ્ન :-

સિંહકુમાર આગળ પ્રશ્ન કરે છે-

“ભગવંત ! જે ચારગતિ રૂપ સંસાર છે તે ગતિઓ કઈ કઈ છે ?”

“તેમાં કેવાં શારીરિક ને માનસિક સુખદુઃખ છે ?”

“અને એવા સંસાર કારાગારમાંથી છોડાવવા માટે કયો ધર્મ સમર્થ છે ?”
ત્રણ પ્રશ્નો છે. એમાં પહેલો ગતિઓ અંગેનો; બીજો એની સ્થિતિનો અને ત્રીજો સમર્થ ધર્મનો. શું ? ધર્મ, સંસારથી છોડાવવા સમર્થ જોઈએ. નહિતર જગતમાં ધર્મો તો ધણા છે ! બીજા બજારોની જેમ ધર્મનો પણ બજાર છે. શું એમ કહેવાય કે જેનું નામ ધર્મ તે સંસારથી છોડાવે જ ? ના, જેનું નામ લાદુ તેનાથી ભૂખ મટે, એવો નિયમ ખરો ? ના, ધૂળનો જ લાદુ બનાવ્યો હોય તો ? જેનું નામ રૂપિયો તેના ૧૯ આના આવે ? ના, નકલી સીસાનો રૂપિયો હોય તો ? એવી રીતે જેનું નામ ધર્મ-તે સંસારથી છોડાવી મોક્ષ અપાવે જ એવો નિયમ નહિ. ઊલંઘું એવો કોઈ નકલી ધર્મ હોય તો અવસરે સંસારને લાંબો લયક કરી આપે ! સાચો ધર્મ જ મોક્ષ અપાવવા સમર્થ હોય છે. આજના સમાનતાવાદને બધા ધર્મો સરખા કરવા છે ! બની શકે જ નહિ સરખા. કાચ અને હીરા સરખા થાય ? સાચી વસ્તુની નકલો હોય, તેમાં ખરી કિંમત અસલની જ હોય, નકલની નહિ. માટે સમર્થ ધર્મ કયો હોય તે માટે સિંહકુમાર પ્રશ્ન પૂછે છે.

ત્રણોના ઉત્તરમાં ધર્મધોષ આચાર્ય મહારાજ કહે છે- “સાંભળ, વત્સ ! પહેલા પ્રશ્ના ઉત્તરમાં તો મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક એ ચાર ગતિઓ છે.”

સંસારમાં સુખ થોડું ય છે ? :- “પણ બીજા પ્રશ્નમાં આ જગતમાં પ્રાણીઓ કેવા પ્રકારના સુખદુઃખ ભોગવે છે, તે પ્રશ્ન અણસમજનો છે. કેમકે વચ્ચે ‘સુખ’ જે ધાર્યું, તે શું તું સંસારમાં સુખ જુઓ છે ? જે સંસારમાં જન્મ, જરા, ને મૃત્યુની કાયમી પીડાઓ છે, ચમરબંધીને પણ આ પીડા જે અનુભવવી પડે છે;- ‘હમજાં ક્ષાળ પૂર્વે હું ઈન્દ્ર હતો ! કરોડો દેવતા મારી હકૂમતમાં હતા ! એમા મારે પણ મરવાનું નક્કી ? અને બીજે જન્મવાનું નક્કી ?’ જન્મીને ઘરડા થવાનું નક્કી ?’ આ સત્તા જ્યાં માથે બેઠેલી જ છે, રાગાદિ દોષોથી જ્યાં જ્વ જકડાયેલો છે, કોઈને કોઈ દોષ પ્રતિપળે જીવમાં જાગ્રત હોય છે; રાગ નહિ તો દેખ, લોભ નહિ તો રતિ, રતિ નહિ તો શોક ! આ બધા દોષો જ્યાં જીવને મજબૂત રીતે કોટે વળગેલા છે; આવી સ્થિતિમાં તું સુખ માને છે ? અને જગતના વિષયોરૂપી ઝેરથી જેની ચેતના ઊઠી ગઈ છે, નાશ પામી ગઈ છે એવા જગતના જીવોને તું સુખી હોવાની વાત કરે છે ? ન કિંચિ સુહં, સુખનું તો નામનિશાન નથી, ને દુઃખના

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૧૫૧

પોટલા પડેલાં છે ! જન્મ જરા અને મૃત્યુની કારમી પીડાઓ વચ્ચે સુખ શું ?”

પ્ર.- જન્મ પછી મૃત્યુ આવે તેના વચ્ચા ગાળામાં તો સુખ ખરું ને ?

૬.- “ના, જેમ કોઈ માણસને નવેંબરની પહેલી તારિખે ફાંસીની સજા ફરમાવાઈ હોય કે ‘દિસેમ્બરની પહેલી તારિખે ફાંસી થશે;’ પછી તે નવેમ્બરના વચ્ચા ગાળામાં પદ્ધવાન્ન વગેરે લહેરથી ખાઈ શકે ખરો ? ભલે મોટા શ્રીમંતુ હોય, બંગલા-બગીચા બધું હોય પણ જો રાજદ્વારી ગુનામાં સપદાઈ ગયો ને ફાંસીની સજા થઈ; તો હવે શ્રીમંતાઈ ભોગવવા પર આનંદ હોય ? ના, ભય છે આગામી ! બસ, તેવો ભય અહીંયાં લાગી જાય. જન્મ થયો કે મૃત્યુની ફાંસી નક્કી થઈ ગઈ ! અરે, એમ માનો કે આ શહેર પર પાકિસ્તાની સર્જાઈ, ગુંડાઓ કાપવા માંડ્યા છે, તો શું આપણે નિરાંતે બેસી શકીએ ? કતલ ચાલુ છે, રોજ ૫૦-૧૦૦ ની કતલ થઈ રહી છે. તો ? હોશકોશ બધા ઊરી જાય ને ? તો આજે દુનિયામાંય રોજ કેટલાયના ઉપર મૃત્યુ તૂટી પડે છે. એના મોતના ભયમાં આપણાને સુખ શું ?”

વાસના છે વિકાર છે ત્યાં સુખ નથી :- પરંતુ, એવાંય જોણે હદ્ય કઠોર કરી દીધાં છે કે ‘આવશે ત્યારે જોયું જાશે !’ તે પૂછે છે કે તે વચ્ચેના ગાળામાં તો સુખ ખરું ને ? ના, રાગાદિ દોષોએ જેને જક્કી લીધો છે તેને શાનું સુખ ? રાગાદિ દોષોમાં તો હૈયાહોળી છે. જ્યાં રાગ કર્યો ત્યાં વાંધો વચ્કો આવી દુઃખ કરે છે. સુખ તો તેને છે કે જેને વાસના કે વિકારો નથી; રાગ કે દેખ નથી, ભોગ કે રોગ નથી; લોભ કે કોધ નથી. જેને વાસના છે તેને લોલુપતા છે. “સારું સંઘરી લઉં ! સારું-મીહું ખાઈ લઉં ! સારું ભોગવી લઉં !” આવી જેને તૃષ્ણા છે તેને સુખ નહિ પણ વિકલ્પોની વિટંબણા અને ભારોભાર હાયવોય હોય છે !

પ્રકૃતિ : વિકૃતિ :- મહાત્માઓને ઉપસર્ગ આવ્યા. એમને કહે છે કે અમારા રાજાની આજ્ઞા છે માટે તમારી જીવતાં ચામડી ઉતારી લેવી છે; તો એ સારું માને છે. કહે છે “તારે ચામડી જોઈએ ? લઈ જ ભાઈ ! તારો રાજ તો ભાઈ કરતાં ભલેરો ! કેમકે અમને પૂર્વના પાપથી છોડાવનારો બન્યો.” આજે મુંબઈમાં કરોડોપતિ ઘણા છે ને ? પણ એમાંથી નિવૃત્ત કેટલા ? કોક. મોટો ભાગ હજી દોડધામવાળા. કેમ ? કહો વાસનાના પાપે ! જગતો કાળ બધો હાયવોયનો ! સૂતા પછી ભાગ્ય હોય તો શાંતિ, નહિતર ઉંઘમાંય લવે ! “હાય, ઈન્કમટેક્ષવાળાની ધાડ છે... પેલું આમ બગડી ગયું...” વાસના છે ત્યાં હાયવોય છે; ને વિકાર છે ત્યાં લોલુપતા છે, ભારે ચિંતાઓ છે. વિકાર એટલે ? આત્માની અસ્વસ્થતા. આત્માની સ્વસ્થતા તેને ‘પ્રકૃતિ’ કહેવાય ને અસ્વસ્થતાને ‘વિકૃતિ’ કહેવાય.

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“સિંહકુમારને વૈરાગ્ય” (ભાગ-૨૨)

૧૫૨

સ્વસ્થતામાં શાંતિ, તત્ત્વચિંતન અને આત્મરમણતા આવે. અસ્વસ્થતામાં અતિત્વની ગડમથલ આવે. હર્ષ ને શોકના વિકાર આવે. મદિરા પીધેલાના ચાળા તે વિકાર. હેં હેં હેં હુહુહુ... કરે ! ભલે જેન્ટલમેન હોય. પણ દારુ પિને કરે છે શું ? એ જ ! નાચવાનું ને ફૂદવાનું. એ ચાળા એટલે વિકાર. તેમ અહીંયાં મોહના દારુ પીધેલાના પ્રેમના, દ્રેખના, હર્ષના, ઉદ્ઘેગના, ખડખડ હસવાના-પોક મૂકીને રોવાના, વિકાર-ચાળા હોય. આમાં સુખ ક્યાં ? પછી મૂઢતાને લઈને દુઃખને સુખ માને એ કંઈ પ્રમાણ નથી. બાકી વાસના અને વિકારમાં સુખ નથી.

મહેમાનને વળાવવા :- શ્રાવક આ સમજતા હોય છે. તેથી ગંભીર પ્રસંગમાં પણ ચિત્ત સ્વરથ રાખે છે. એક પ્રસંગ છે. બનેલો છે. મહારાજે વ્યાખ્યાનમાં મોડા આવેલા એક ભાઈને વ્યાખ્યાન પછી પૂછું “કેમ મહાનુભાવ ! આજે કંઈ મોડા ?”

શ્રાવક કહે, “સાહેબજી ! મહેમાનને જરા વળાવા ગયો તો !” પચીસ વર્ષનો જુવાન જોધ છોકરો મરી ગયેલો. તેને સમશાનમાં અભિનિસંસ્કાર કરી પછી નાહીં-ધોઈને વ્યાખ્યાનમાં આવેલા; તેથી સહેજ મોંઠું થયેલું. પરંતુ આંખમાં એક આંસુનું બિંદુ પણ નહિં; અને વ્યાખ્યાનમાં આવી બેઠેલા. કેમ ? જિનવાળી સાંભળવા. વિકારી હૈયાને, કખાયથી સળગી ઉઠેલા હદ્યને આજે વીતરાગની વાણીના અમીથિંટણાં નહિં જડે ! પરંતુ ઉપરથી બેસવા આવેલા બીજા વિકારીઓથી પીરસાતી થોકની થોક લાખ્યો જડે છે. બળતા પર જ્યાસ્તેલ ! આવેલાં શું કહે ? “છોકરો મરી ગયો ? આહા ! છોકરો તો રતન જેવો હતો... આંધળાની લાકડી...” એમ કરીને ઓછું રોતાને પોકેપોક મૂકાવે. પાછું આ એક ઊઠીને જાય કે બીજા ચાર ભેગા થાય ! કેમ આવ્યા છો ? “બેસવા !” બેસવા કે રોવડાવવા ? એથી સામાના હદ્યમાં સળગેલી કખાયની અભિનમાં જ્યાસ્તેલ નાંખવાનું થાય ! એટલે પછી શું થાય ? ભડકા ! આ વિકાર છે. હસો તે પણ વિકાર. રાણ થાઓ તેથી વિકાર, ને નારાજ થાઓ તે પણ વિકાર. કૂલો તેથી વિકાર, અને કરમાઓ તે પણ વિકાર ! આ વિકારની જાળમાં સપડાયેલો જીવ માને કે ‘હું સુખી’ તો શું એ ખરેખર સુખી છે ? વિષયના વિષથી જેનું ચૈતન્ય હણાઈ ગયું છે, તે શું સુખી ? આપણામાં ચૈતના છે તે તો જ ખીલે કે જો વિષયનું ઝેર ન લઈએ તો. વિષય એટલે દુનિયામાં ઈન્દ્રિયને પસંદ કોઈ પણ કિંમતી કે મામુલી પદાર્થ તે લીધું કે ચૈતન્ય ખલાસ ! એક ભમરીનો ડંસ લાગતાં પણ “ઓહ” થાય છે. તે ‘ઓહ’ થતાં જ બધું ભુલાય છે ! દશ લાખની કેશ ગણી રહ્યો હોય; ગણવામાં મસ્ત હોય, પણ પાછળથી ડંસનો ચટકો લાગતાં ક્ષણવાર બધું જ ડૂલ ! તેમ અહીંયાં જીવ ચૈતન્ય ગુમાવી દે કે પોતાના સાચા સુખની જાંખી ય દૂર. પછી અહીં દુઃખને

માને કે “હું સુખી.” તો શી રીતે સુખી ? “મન હી મેં વૈરાગી ભરતજી.” કોણ ભરત ? જેની પાસે લાખો ઘોડાઓ છે, લાખો હાથીઓ છે, કરોડો ગામ, ને કરોડોનું પાયદળ લશ્કર છે ! એવા તે ભરતજી વિરાગી હતા ! કેવી રીતે ? તે સમજતા હતા કે “આ જગતના પદાર્થો અમારા આત્મામાં સોંસરું ઝેર નાખી નાખીને શુદ્ધ ચેતનાનો નાશ કરી દે છે.” જેમ કોઈ અબજપતિને ઝેરી જીવ કરડતાં ઝેર ચઢે છે, તો તે વખતે તે સુખી ખરો ? ન કહેવાય સુખી. તેમ ખાતાં ટેસ આવે છે, રેણ્યો સાંભળવાની મજા આવે છે તે વખતે તે અંતરનું ચૈતન્ય હણાય છે-તો સુખી ગણાઈએ ?

સુનંદામાં લુબ્ધ :- રૂપસેનનો જીવ સાપ થઈને સુનંદા રાણીની સામે આવ્યો. સુનંદાને દૂરથી જોઈ કે ખુશી ખુશી થઈ ગયો. અલબત અને એ ખબર નથી કે “આ દેખાય છે તે પેલી જ સુનંદા, કે જેણે મને નોંઠરું આપેલું- ‘તું આવજે, આપણે મજા કરશું’ તો પોતે મળવા નીકળ્યો હતો. પણ વચ્ચે ભીત તૂટી પડી ને પોતે મર્યો હતો.” આ વાત કંઈ યાદ નથી. પણ મરતાં પહેલાં એક વાત યાદ રહી ગઈ હતી કે ‘કેવું સરસ અનું માખણ જેવું મુલાયમ અને ગુલાબ જેવું ગુલાબી મુખ ! બસ, દેવાંગના જેવું રૂપ ! અને હું એને સ્પર્શી શક્યો નહિં !’ આ દુર્ધાની મરતાં થયું, તો મરીને સીધો ગયો એજ સુનંદાના ગર્ભમાં ! ત્યાંથી મરીને થયો સર્પ ! અને આવ્યો સુનંદા સામે ભેટવા. તો હવે કહો કે સુનંદાનું સુંદર રૂપ જોઈને રૂપસેનના જીવ સર્પની આનંદ થયો કે નહિં ? તો એટલું તો સુખ ખરું કે નહિં ? શું રાખનું સુખ ? મોં સારું લાગ્યું કે થયું ‘હવે આના ખોળામાં ભરાઈ જાઉ !’ એમ કરીને દોડ્યો સામે. સામેથી સાપ દોડતો આવતો જોઈ રાજકુમારી ગભરાઈ ગઈ. ને બૂમ પાડી ઉઠી. પહેરગીરો ઉઘાડી તલવાર લઈને દોડી આવ્યા. પરંતુ સાપને તેનું ભાન જ નથી ! એને તો ભાન છે માત્ર ‘કેવું સરસ રૂપ !’ એના ખોળામાં ભરાઈ જાઉ ; અને એ મને વહાલથી પંપાળે.’ આ શું છે ? એક રૂપની ઘેલાયામાં પોતાના ચૈતન્યને હણી રહ્યો છે. ભાન ગયું કે ઉઘાડી તલવારને જોવાનું ગયું ! તેથી આંખ મૌચીને દોડવાનું ! ત્યાં તરત જ ખટ કરતો પહેરેગીરે ઝટકો લગાવી દીધો ! સાપના બિચારાના એક ઝટકો ને બે ટૂકડા ! કહો વચ્ચા ગાળાનું સુખ ખરું ?

જગતના પદાર્થો આત્મામાં એવી મોહિનીના ઝેર નાખે છે કે એમાં ચૈતન્ય હણાઈ જાય છે. તેથી માનવ જીવનાં કર્તવ્ય વિસ્તૃત થઈ જાય છે, અને જંગલી પશુની જેમ જગતના પદાર્થો પાછળ દોટ મૂકાય છે. કર્તવ્યકર્તવ્યનું ભાન નથી રહેતું.

“સંસારના સુખો મધુલિંદુ જેવાં છે. મૂઠ જીવ એ તુરણ સુખના લોભમાં આજુભાજુની પીડાઓય ભૂલી છેવટે ભયંકર પીડામાં પડે છે.”

આજના કાળે પરમાત્માના અજોડ શાસનની અને ધર્મ ખુરંધર સદ્ગુરુઓની પ્રજાને પિછાન ન રહી તેથી એક જ વાત પ્રજાના માનસમાં ભ્રમી રહી છે. ‘જગતના પદાર્થો કેમ ખૂબ લઈ આવવા ખૂબ ભોગવવા... તે લાવતાં ભોગવતાં જે કરવું પડે તે કરવાનું !’ આ શું છે ? ચૈતન્યલુપ્ત નિશ્ચેતનગ્રાય. તેના આ ચાળા સૂઝે છે. એટલે આચાર્ય મહારાજ સિંહકુમારને કહે છે ‘જે સંસારમાં જન્મ જરા મૃત્યુની અનંતી પીડાઓ છે, રાગદેષની પીડાઓના ભયંકર તોફાન છે, જડ પદાર્થોના ઝેરના સંસર્ગથી ચૈતન્યનો નાશ છે, તે સંસારમાં તું સુખની વાત કરે છે ?’ એમાં સુખ કંઈ નથી ને દુઃખના પોટલાં ભરેલાં છે ! ત્યારે પૂછો ને કે,

પ્ર.- ‘આમ લાગે છે તો બરાબર; પણ પાછું દુનિયામાં અનુભવ જોવા જઈએ છીએ ત્યાં ધારો કે એક માઈલ ચાલ્યા... થાક લાગ્યો, ત્યાં કોઈની મોટર મલી ગઈ ! એણે આપણને એમાં બેસાડ્યા ને જ્યાં જવું હતું ત્યાં પહોંચાડ્યા ! તે પણ ‘શેઠ સાહેબ’ કહીને માનપૂર્વક પહોંચાડ્યા. ત્યાં હૈયે હાશ ! થાય છે. અથવા ધારો કે ભૂખ લાગી હતી... બબર હતી કે ઝીચડી-દૂધ મળશે. પરંતુ તેના બદલે બાસુંદી-પૂરી મલી ગયા તો મહાઆનંદ સાથે ગળે લપલપ ઉતરી પડે છે ભાઈસાહેબ ! બજારમાં પાંચ રૂપિયા મળવાની માડ આશા હતી, પણ લાખની લોટરી લાગી ગઈ. તો ત્યાં અવર્જનીય આનંદ ઉત્સરાય છે !’ આ બધું જોતાં સંસારમાં સુખ નથી એમ કેમ બેસે ?

૩.- આ પ્રશ્નો ઉત્તર આચાર્ય મહારાજે સિંહકુમારને આપેલા એક દણાન્તથી સમજશે.

સંસારમાં સુખની ઘેલધાનું એક દણાન્ત :- એક માણસ ખૂબ દરિદ્ર દશામાં આવી ગયો. પૈસા ખોવાઈ ગયા. આમાં નવાઈ નથી. પૈસાને લાવવા માટે બહુ પરિમિત ધંધો મળે છે; પરંતુ જવા માટે ઘણા રસ્તા છે ! વ્યાપારમાં લોહી ઉકાળી ઉકાળીને પૈસા ભેગા કર્યા હોય ત્યાં એક તરફ કનૈયાને ટાઈફોઇટ લાગુ પડ્યો, બીજી બાજુ નોકર ઘરમાંથી ધાપ મારીને રવાના થયો, ગ્રીજ તરફ દેશમાંથી મનીઓર્ડ મંગાવે છે ! ચોથી તરફ ઘરમાં જ આગ ફાટી !... પૈસા જતાં શી વાર ?

પેલો માણસ દરિદ્રતાથી કંટાળી ગયો. તેને થયું કે, ‘ચાલ આ દેશને જ મૂકવા દે. અહીંયાં ભીખ પણ કેમ મંગાય ?’ એમ વિચારી, સારામાં સારો દેશ નક્કી કરીને નીકલ્યો. પરંતુ નસીબ બે ડગલાં આગળ; તે વચ્ચે માર્ગ ભૂલ્યો. એવો ભૂલ્યો કે ગીય જંગલમાં જઈ ચઢ્યો. મોટમોટાં જંગી જાડ ! ભયાનક અટવી ! એટલું જ નહિ પણ ત્યાં પાછા વિચિત્ર વિચિત્ર પાડતાં શિકારી પશુઓ ! વાધવું ને ચિત્તા !... આમેય આ દરિદ્ર તો હતો જ. ભૂખ-તરસથી પીડાયેલો છે. ફાંઝાં મારતો આગળ જઈ રહ્યો છે. ચાલેલો ઘણું, થાક ઘણો લાગ્યો છે. પરેસવાથી રેબઝેબ થઈ ગયો છે. અધૂરામાં પૂરું ચારેકોર નજર નાંખે છે ત્યાં કોઈ દિશા સૂઝતી નથી. સૂરજ પણ વાદળમાં છુપાઈ ગયો છે. આશામાંને આશામાં આગળ ચાલે છે. પરંતુ ત્યાં અચાનક પાછળ જુએ છે તો ભયંકર મોટો હાથી, રંગો કાળો વાદળ જેવો, ગજરાવ જોરદાર કરતો આવી રહ્યો છે. જંગલના પશુ-પંખીઓને ગ્રાસ પમાડી દે એવી ગર્જના ! એ સૂંધ ચારેકોર ઉછાળતો આ માણસની પાછળ ધસી રહ્યો છે. દરિદ્ર ગભરાઈને મુઢીઓ વાળીને દોડ્યો. એમ કરીને આગળ દોડે ત્યાં તો એક ભયંકર રાક્ષસી જોઈ. હાથમાં તલવાર-વિકરાળ મોં, જીભડી મોટી બહાર કઠેલી, કૂર અહૃદાસ્ય કરે છે ! આ માણસને આ જોઈને મૃત્યુનો ભયંકર ભય લાગી ગયો ! પૂર્વ તરફ દોડ્યો. દોડતો દોડતો જાય છે ત્યાં દૂર એક વડનું જાડ જોયું. ઓહો, પાછળ પેલો હાથી છે, એક બાજુ રાક્ષસી છે... બચવું શી રીતે ? મૂઢીવાળી જેટલું જોર હતું તે કાઢીને દોડ્યો. વડના જાડ નજક આવી પહોંચ્યો. વડનું જાડ ઊંચું છે. ઉપર ચઢી શકાય એમ નથી. સપાટ જાડ છે. આ ચિંતામાં તેણે એક વસ્તુ જોઈ કે આ વડના જાડ પાસે એક કૂવો છે. કૂવામાં વડની ડાળીઓ નમેલી છે. બસ, તે પકડી લઉં ઠેકડો મારીને ! તો બચી જવાશે. એમ વિચાર કરતાં જ એ તો કૂદ્યો કૂવામાં. કૂવાની વચ્ચે લટકતી ડાળીઓને વળગી પડ્યો. ડાળી હાથમાં આવી તો ખરી, પણ હવે કૂવામાં નીચે જુએ છે તો એના હોશકોશ ઊડી ગયા ! કૂવામાં ચાર સાપ લીતોમાંથી ફણાને ધુણાવતા ભયંકર કૂત્કાર કરી રહ્યા છે; જેર ઉડાડે છે; જીભના લપકારા કરે છે. જેરની અસર ઉપર પહોંચે છે. તેમાં વળી બીજો એક મોટો અજગર પડ્યો છે. એ તો એનું જંગી મૌંઢુ ફાડીને પડ્યો છે કે ‘ક્યારે આ પડે ને એને ગળી જાઉં !’ એની રાહ જ જોઈ રહ્યો છે ! ઉપર જોયું તો જે ડાળીએ પોતે લટક્યો છે તે ડાળીને બે ઉંદર કાતરી રહ્યા છે. એક ધોળો ઉંદર છે ને બીજો કાળો ઉંદર છે. અધૂરામાં પૂરું જ્યારે ડાળીને પોતે વળગ્યો ત્યારે ડાળી પરનો મધ્યપૂર્ણ હાલી ઉઠ્યો અને માખીઓ ગુર્સે થઈને આને ચટકા મારવા માંડી !

હાથી કંડે આવીને ઉભો છે. ને વિચારે છે કે ‘શિકાર હાથમાંથી ગયો.’ એટલે એણે થડને સુંધરમાં ઘાલીને જાડ હચમચાવવા માંડ્યું ! ત્યાં તો પેલી રાક્ષસી પણ આવી પહોંચી ! આ બધા દુઃખો વચ્ચે પણ એક સુખ થયું ! પેલા મધ્યપૂડામાંથી મધ ટપકતું આ માણસના હોકે આવ્યું, આણે જીભ કાઢીને લપકારો લીધો, ‘બહુ મીઠું હો !’ એમ મનમાં થયું !

અહીંયાં ધર્મધોષ આચાર્ય મહારાજ સિંહકુમારને પૂછે છે, “બોલ સિંહકુમાર, આ માણસને સુખ ખરું કે નહિ ?” સિંહકુમાર કહે છે “પ્રભુ, અમને તો એની કલ્પના આવતાં જ કંપારી છૂટે છે ! ત્યાં કોઈ મધનું ટીપું તો શું, પણ મધના કુંડેકુંડ પીવરાવવા આવે તો પણ અમે કહી દઈએ કે આના કરતાં તો ભાઈ ! તારાથી બને તો અમને આ દુઃખથી બહાર કાઢ ! તો જિંદગીનો ઉપકાર માનશું !” પરંતુ આ માણસ તો જીભીનો લપકારો લે છે !

અહીં તો ગ્રંથકાર વૃક્ષને જ મોકણી ઉપમા આપે છે. પણ બીજે વિદ્યાધરનું વિમાન બતાવ્યું છે. એ ડિસાબે,

ત્યાં એક વિદ્યાધર-વિદ્યાધરીનું જોડલું આવ્યું. વિદ્યાધરીને દ્યા આવતાં વિદ્યાધરને કહે છે કે “આ માણસને બચાવો.” વિદ્યાધર કહે છે- “આ અયોગ્ય છે.”

“ના ના, તમારે બચાવવો નથી માટે અયોગ્ય કહો છો.”

“સારું, તારે જોવું હોય તો જો.”

એમ કરીને પેલાને કહે છે, “મહાનુભાવ ! આ વિમાનમાં તારા પગ મૂકી દે. તને અમે સારા સ્થાનમાં લઈ જઈએ.”

ત્યાં પેલો માણસ કહે છે- “ભાઈ સાબ, તમારી વાત તો ખરી છે. પણ આ જે મધનો સુંદર સ્વાદ આવે છે, તે હમણાં ચાખી લેવા દો. હમણાં આ છોડવાની મારે ભાવના નથી.” ધોર દુઃખની વચ્ચે એક બિંદુનું સુખ એવું એને ગમી જાય છે કે બીજી લાખ સારી વાતો આવે, પણ તેને વિટેબણાના પોટલા છોડવા પાલવતા નથી !

બસ ! આવો ગમાર જીવ તે જ સંસારી જીવ. દરિદ્ર પુરુષ એજ આપણો જીવ ! સંસારઅટીમાં ભૂલો પડ્યો છે. તે ભૂલો પડ્યા પછી, મૃત્યુરૂપી હાથી તેની પાછળ પડ્યો છે; અને જરાવસ્થારૂપી રાક્ષસી પણ આકમણ કરી રહી છે. વડના જાડ ઉપર દુઃખમાંથી મોકષ છે. પણ તે મોકણા વૃક્ષ પર ચઢવા વિધાયસકત માણસો સમર્પણ નથી. મનુષ્યપણું એ કૂવો છે; અને ચાર કષાયરૂપી ચાર સર્પો તેમાં રહેલા છે. એ સર્પોનું જેર જેને ચેઢે તેની શુદ્ધિબુદ્ધિ ન રહે ! કાર્યકાર્યનો વિવેક

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈયું કહા.” (ભાગ-૨૨)

૧૫૭

ન રહે. નીચે અજગર તે હુર્ગતિ છે. વિષયમન જીવ મરે કે ગળવા તૈયાર. કેમકે વિષયના વિષમાં મોહી ગયેલાને તે વિના બીજી સારી ગતિ જ નથી ! પેલી વડવાઈ તે આયુષ્ય છે. તેના પર બેઢેલા કાળા ધોળા ઉંદર તે શુકલ-કૃષ્ણપક્ષો છે. એ ઉંદરો સતત આયુષ્યને કાપી રહ્યા છે. શરીરે ચટકા ભરતી ભમરીઓ તે આવિન્યાધિનો છે અને પેલું મધનું ટીપું, એ ઈન્જિન્યોના વિષયના તુચ્છ સુખો છે. એ ભોગવવા દરિદ્ર જીવ મસ્તાન બન્યો છે ! આવી સ્થિતિમાં સપાઈ ગયેલો ઝાંખો તો, એ મધના ટીપાનું સુખ લેવા ઉભો રહે ? કે જાડ પર ચઢી જાય ? કે વિમાનમાં બેસી જાય ?

ઉપદેશ :- માટે આચાર્ય મહારાજ સારાંશ કહેતાં કહે છે- “હે સિંહકુમાર ! વિષયના સુખોને ચપળ એવા સમજને, ભયંકર સમજને અને મનુષ્ય જીવનને વિજળીના જ્ઞાનકા જેવું સમજી, સ્વજનોના સુખ અતિ ચંગળ જાણીને, યુવાનીને અસાર જાણીને,- સુખના નિધાનભૂત એક ધર્મ વિષે જ દઠ મતિ રાખ. નહિતર જો ફસાઈ જઈશ તો તીંચો નહિ આવી શકે. સંસારનાં સુખો મધુબિંદુ જેવાં છે, મૂઢ જીવ એ તુચ્છ સુખના લોભમાં આજુબાજુની પીડાઓય ભૂલી છેવટે ભયંકર પીડામાં પડે છે. માટે એક ધર્મને જ આરાધી લેવા જેવો છે.”

પ્રેણ બીજો, ધર્મ કયો સમર્પણ છે ? :- આવા સંસારમાંથી - તેના ત્રાસ-દુઃખમાંથી છોડવવા આ સાધુ ધર્મ જ સમર્પણ છે. એ પછી સાધુનો ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ બતાવ્યો. એમાં તપના બાધ-આભ્યંતર ભેદ બતાવ્યા. સંયમના સતર ભેદ બતાવ્યા. ડિસાદિ પાપોનો ત્યાગ, ક્ષમાદિ દ્વારા ચાર કષાયોનો વિજય, મન, વચ્ચન ને કાયાના અશુભ વ્યાપારોનો ત્યાગ... વગેરે વિસ્તૃત રીતે કહી બતાવ્યું. એ સાંભળીને સિંહકુમાર ઉભો થઈ ગયો ! પૂછે છે,

“પ્રભુ, અદ્ભુત વાણી ! આપે અપૂર્વ તત્ત્વોનો સુંદર પ્રકાશ આપ્યો ! પરંતુ, ભગવંત ! આટલા ઉચ્ચ યત્નિર્ધર્મ સુધી પહોંચવાની શક્તિ ન હોય તો બીજો કોઈ રસ્તો છે ? બીજી કોઈ રીત છે ?”

આચાર્ય ભગવાન કહે છે, “હા, છે. સમ્યક્તવમૂલક બારવ્રતનો ધર્મ છે.” એમ કહીને સમ્યક્તવ અને બારવ્રતોને સમજાવ્યા ?

ત્યાં હાથ જોગીને સિંહકુમાર કહે છે “કૂપા કર્યીને ભગવંત ! મને એ સમજિતપૂર્વક બારવ્રતો આપો.” શું છે આ ? પહેલો જ પ્રસંગ. ને એક જ દેશના છતાં બારવ્રતો લઈ લીધાં ! ધ્યાન રાખજો જો મનમાં સંયમ લેવું જ જોઈએ એ બેસતું નથી તો સમજિત પણ નહિ. મોકણો અંતિમ માર્ગ માત્ર ચારિત્ર, એ જો મનમાં બેસતું નથી ને વૈરાગ્ય વધતો નથી તો સમજિતનાં ફાંફાં છે ! સમજિત

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“સિંહકુમારને વૈરાગ્ય” (ભાગ-૨૨)

૧૫૮

એટલે વિષયો પ્રત્યે હાર્દિક વૈરાગ્ય ! જળહળતો વૈરાગ્ય ! સિંહકુમારમાં એ છે; તો તુરત પ્રતો અંગીકાર કરી લીધાં. લઈને, ગુરુ મહારાજની સેવા ભક્તિ કરીને સિંહકુમાર ઘેર ગયો.

રાજમહેલમાં જઈને પત્ની કુસુમાવલીને બધો બનેલો અધિકાર કહી સંભળાવ્યો. એટલે ? સંબંધ સંસારના ચૌદ રાજલોકના કૂવામાં ફેંકવા માટે બાંધેલો નથી લાગતો. પણ ચૌદ રાજલોકના શિખરે ચઢાવવાનો સંબંધ બાંધ્યો લાગે છે. તોજ આવી વાત કહી શકાય. સાંભળીને કુસુમાવલીએ પણ પતિની સમક્ષ પ્રતો ઉચ્ચરી લીધાં.

બંને પતિ-પત્ની રોજ ગુરુ મહારાજ પાસે જાય છે; ને દેશના સાંભળે છે. એક માસમાં તો હૈયાને જિનધર્મથી સારું ભાવિત કરી દીધું !

ધર્મથી ભાવિત એટલે ? :- કસ્તૂરીના ડાબડામાં મૂકેલો કપડાનો ટૂકડો-તેના કેટલા તાંત્રણ હોય ? પછી દરેક તાંત્રો રૂંવાટી કેટલી ? પરંતુ તેમાંની એક પણ રૂંવાટી એવી શોધવી મુશ્કેલ પડે કે જેમાં કસ્તૂરીની વાસ ન હોય ! રૂંવેરૂંવે કસ્તૂરીની વાસ લાગી ગઈ. તેમ આ પતિ-પત્નીના આત્માના પ્રદેશે પ્રદેશે જૈનધર્મની ભાવના લાગી ગઈ. આંગળીનો અગ્રભાગ પણ પોકાર કરતો હોય કે “મારો જૈનધર્મ !”

દુનિયાના હિસાબ પડતા મૂકાય અને શાસનના તત્ત્વો હૈયે વસાવાય તો આ વાત બની આવે કે પ્રદેશે પ્રદેશે ધર્મનો રંગ ચઢી જાય ! નહિતર જો સંસાર તમારો સલામત, તો ધર્મની સુવાસ પ્રદેશે પ્રદેશે તો નહિ, પણ એક ભાગના એક ખૂશામાં ય ધર્મનો રંગ ન ચઢે, સિંહકુમારને કેટલામાં બન્યું આ ? એક જ દેશનામાં !

માનવજીવનનું એસેન્સ :- પરમોપકારી શાસ્ત્રકાર મહર્ષિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સમરાદિત્ય કેવલી ભગવાનના બીજા ભવમાં ‘સિંહ’ રાજકુમાર તરીકેનો અધિકાર બતાવતાં એ વાત ફરમાવી ગયા કે સિંહકુમાર અને એની પત્ની કુસુમાવલી શ્રાવકધર્મ પામ્યા. હવે આગળ ફરમાવતાં કહે છે કે સિંહકુમારના પિતા પુરુષદાટ રાજાએ અમિતતેજ નામના ગુરુમહારાજ પાસે ધર્મ સાંભળીને સંવેગી બની સિંહકુમારને રાજ્યગાદીએ સ્થાપી મહારાણી શ્રીકાન્તા સાથે મોક્ષમાર્ગ અંગીકાર કર્યો. માનવજીવનું એસેન્સ (અક્) આ કાઢયું કહેવાય કે ચારિત્ર સિદ્ધ કરાય. એ વિના તો સારામાં સારો ગુલાબી માલ પણ એળે ગયો ગણાય. બજારમાંથી ધારો કે પાંચ પચીસ હજાર તાજાં ગુલાબ ખરીદી લાવ્યા; પણ લાવીને ધરમાં મૂકી તમે કંઈક બહાર ગયા. ત્યાં છોકરાઓએ અને આખા મકાનમાં પાથરી ખુશબો લીધી પણ એમાંથી અર્ક-અત્તર કાઢ્યું નહિ. તમે બહારથી આવીને જુઝો

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાચ્ચય કહા.” (ભાગ-૨૨)

૧૫૮

છો તો ગુલાબ ચીમળાઈ ગયા છે; ઊકરે ફેંકી દેવા લાયક બની ગયા છે. તમને શું થાય ? ‘અરેરે ! રૂપિયા સો પાણીમાં ગયા ! આમાંથી એસેન્સ કાઢ્યો નહિ !’ એવું થાય ને ? એમ ગુલાબ જેવા આ મનુષ્યભવમાંથી ચારિત્રરૂપી એસેન્સ ન કાઢી લો, એ કેટલું દુઃખદાયી લાગવું જોઈએ ? લાગે છે ?

રાજાજ્ઞિ :- સિંહકુમાર રાજા બન્યા પછી ધર્મ-અધર્મની બરાબર વ્યવસ્થા પાળવામાં રક્ત છે; પ્રજાના મનને આનંદકારી છે; સામન્ત રાજાઓને પ્રિય છે; અને દીનદુઃખી વગેરેના ઉપર ઉપકાર કરનારો છે. આવા યથોચિત ગુણોથી રાજાજ્ઞિ બની ગયો. રાજ્ય ભોગવતાં કેટલોક કાળ નીકળી ગયો.

અજિનશર્મા ગર્ભ :- એટલામાં અજિનશર્મા તાપસ જે વિદ્યુત્કુમાર દેવ થયેલો તે ત્યાંથી ચ્યાવી સંસારમાં ભટક્યો; અને કોઈક ભવે કંઈ અજ્ઞાન તપનું કષ સહીને પૂર્વકર્મની વાસનાના વિપાકના દોષથી રાણી કુસુમાવલીના ગર્ભે ઉત્પન્ન થયો. વાસના એટલે સંસ્કાર. શા સંસ્કાર છે ? વેરના, દેખના, અનો પરિપાક થવાથી અહીં આવી ચઢે છે. આમાં સિંહરાજાનો પણ પાપોદય કામ કરે છે. પોતાના પાપોદય વિના તો કષની સાથે અથડામણી થાય નહિ. ગર્ભમાં આવતાં રાણી સ્વભન જુઝે છે. એમાં ‘પોતાના પેટમાં એક સર્પ પેઠો અને બહાર નીકળીને તે જઈને રાજને એવો ડસ્યો કે રાજા સિંહાસન પરથી પડ્યો નીચે.’ આવું સ્વભન જોઈને જાગી; ગભરાણી; અને અપમંગલ જાણી પતિને કષ્યું નહિ.

ગર્ભની અસર :- પરંતુ ગર્ભની અસર એ થઈ કે રાણીને પોતાને ગર્ભના દોષે રાજના ઉપર બહુમાન ઘટી ગયું. એટલે હવે રાજાનો આદરસ્તકાર કરતી નથી. બહુમાનથી રાજા સાથે વાતચીત કરતી નથી. ગર્ભજીવ રાજનો વેરી છે. એ સજજન એવી રાણીને પણ રાજા પ્રત્યે અરુચિવાળા બનાવે છે. નિમિત્ત કેવું કામ કરે છે ! આમ રાણી સુશીલ, પતિભક્તા, અને પતિ પર બહુ પ્રેમાળ છે છતાં ગર્ભમાં આવેલ જીવ દુષ્ટ હોવાથી એના નિમિત્તે રાણીનું મન બગડે છે.

સારાના પગલે સારું... :- તેમ એ પણ બને છે કે ધરમાં એક પુણ્યશાળી તો આખું કુટુંબ પુણ્યશાળી ! ધનાજી ધરમાં હતા તો કુટુંબનું પુણ્ય ફાલ્યું, પણ ધનાજી ગયા પછી ? પુણ્ય પણ ભૂગર્ભમાં પેસી ગયું ! કેટલાક કુટુંબોમાં એવું બને છે કે સારાના પગલે સારું. ચાર છોકરાની વહુઓ હોય પણ એકાદ વહુ એવા પગલાંની હોય કે એના પગલાં થયાં એટલે જાણો ખુદ લક્ષીનાં જ પગલાં થયાં ! આખા કુટુંબનાં ભાગ્ય ખોલી નાખે ! એક જીવ બીજા જીવના પુણ્યોદય-પાપોદયમાં નિમિત્ત બને છે. કુસુમાવલી પોતે પતિત્રતા છે; શ્રાવકધર્મને સમજજનારી છે; પણ ગર્ભમાં આવેલો જીવ દુષ્ટ છે. એટલે કુસુમાવલીના મનમાં ખોટી વિચારણા કરાવે

૧૬૦ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“સિંહકુમારને વૈરાગ્ય” (ભાગ-૨૨)

છે. શું છે આ ? નિમિત્તકારણની બળવત્તા. એ સમજુને જ બહુ કાળજી રાખો છો ને ? સીરી કેવી રીતે ઉત્તરો છો ? ધ્યાનથી. અંધારામાં કેમ ચાલો છો ? સાવચેતીથી, એમ સગાંસ્નેહી ને મિત્રના સંપર્ક સાધવામાં સાવધાની ખરી ? હરવા-ફરવામાં અનુચ્ચિત સ્થાન; અનુચ્ચિત વાતાવરણના નિમિત્તમાં ન અથડાઈ જવાય એની કાળજી કેટલી ?

ગર્ભપ્રતાપે રાણી રાજા પર નાખુશ : - ગર્ભમાં આવેલો જીવ એવો છે કે એના નિમિત્તે કુસુમાવલી રાજા પર અનાદરવાળી બની ગઈ. રાજાને તો સ્નેહ ઘણો છે. રાણીનો પરિવાર રાણીને સલાહ આપે છે “રાજા સાહેબ આપના પર કેટલો પ્રેમ રાખે છે; ને તમે ગણકારતાં નથી ?”

ત્યાં રાણી કહે છે- “શું કરું, આ મારો દોષ નથી, પણ મારા ગર્ભનો આ દોષ લાગે છે. નહિતર આવા ગુણવાન પતિ પર મને અપીઠિ કેમ થાય ?”

રાણીને ભયંકર દોહદ : - રાણી ખોટા વિચારમાં આગળ વધે છે. ગર્ભના પ્રતાપે દોહદ થાય છે. તેને થયું કે “આજ પતિ-રાજાના આંતરડાનું હું ભક્ષણ કરું !” આ જ્યાં વિચાર સ્ફૂર્યો ત્યાં જ રાણીનો આત્મા ચોંકી ઉઠ્યો. “આવો વિચાર મને ? અરે ! તો આ પેટમાં આવેલો જીવ કેવોક પાપી હશે ? તો મારે તેવા જીવની જરાય જરૂર નથી.” કીડી પણ મરે એવું ઈચ્છનારી નહિ. તે રાણીને આ વિચાર આવે છે ! પરંતુ પોતાના સ્ત્રીસ્વભાવ મુજબ રાજાને દુઃખ લાગશે તેથી તે વિચાર તેણે અંદરમાં જ રાખી મૂક્યો.

ગર્ભપાતનો પ્રયત્ન :- બીજી બાજુ આવા વિચારના મૂળભૂત ગર્ભ પ્રત્યે એનું હૃદય એટલું બધું ઊકળી ઉઠણું કે એ એવા નિર્ધિર પર આવી કે “મારે આ ગર્ભને પાડી નાંખવો.” એમ નિર્ધિર કરી, મુખ્ય પરિવારની સાથે વિચારણા કરી લીધી અને આ જન્મે તો મહારાજાને મહા અનર્થ કરે એ હિસાબે પરિવારે પણ પરિણામની ભયંકરતા સમજ ગર્ભ પાડવામાં સંમતિ આપી. બસ ! પછી તો પરિવારે લાવી લાવીને ઔષધ આપ્યા, અને રાણીએ તેનો ઉપયોગ કર્યો, એકદમ સડાવીને ગાળી નાખે તેવા ખારો કડવા ઔષધ હતાં, છતાં ગર્ભના જીવના નિકાચિત કર્મના દોષથી એના પર કોઈ અસર ન થઈ. ઓગળવાની વાત નહિ ! ઓસડ એટલાં ઉગ્ર હતાં કે પોતાનું શરીર દુર્બળ બનતું ચાલ્યું. પણ ગર્ભને કંઈ થયું નહિ. ધ્યાન રાખજો આ સાંભળતાં લેશ્યા ન બગડે. આવા પણ ગર્ભને મરાય નહિ. ગર્ભ મરે તો સારું એમેય ઈચ્છાય નહિ. રાણીને એક બાજુ પોતાનો દોહદ પૂર્ણ થતો નથી અને બીજી બાજુ આ ગર્ભ સલામત છે. તેથી રાણીનું શરીર ક્ષીણ થતું જાય છે. પરંતુ રાજાને હથયની વાત કહી શકતી નથી. એ એની સુશીલતા, પતિત્રતાપણું

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૧૬૧

અને ખાનદાની સૂચવે છે.

તુચ્છ વાતોમાં પાપ ? :- માણસનું ધાર્યું શું થાય છે ? પોતાની ધારણાઓ ધાર્યી નકામી જાય છે, અહીં ગર્ભને કંઈ હાનિ પહોંચતી નથી. કર્મની બલવત્તા સિવાય આમાં બીજો ખુલાસો શો મળે ? એ સૂચવે છે કે એવા કર્મજોડ્યાને આત્મધરમાં પેસવા ન દો. એ માટે, એને ધુસાડનારા પાપસ્થાનકોમાંથી જીવને બચાવી લો. તુચ્છ વાતોમાં રાગ ને દ્વેષ, ઈર્ષા ને પક્ષપાત, અસત્ય ને અનીતિ વગેરે સેવવામાં કોઈ શોભા નથી.

પાપના કરતાં મૃત્યુ સારું :- રાણીને અતિકૃષ થતી જોઈને રાજા પૂછે છે, “શું છે આ બધું ? સુકાવાનું કારણ શું ? શું કાંઈ ધાર્યું થયું નહિ ? શું કોઈએ તમારી આજ્ઞા લોપી ? અથવા મેં તમારી વિરુદ્ધમાં કાંઈ કર્યું ? કે જેના ખેદથી જેમ થોડા થોડા પાણીમાં પોયણું કરમાતું જાય તેમ કરમાતા જાઓ છો ? કારણ શું ?” રાજાના પ્રશ્નનો ઉત્તર કરતાં કંટાળીને રાણી કહે છે, “શું કરું, મારા મનનો ખેદ જ એવો છે ! શું થાય ? મને એમ થાય છે કે હું મારી જાતે આત્મધાત જ કરું.” જુઓ હજુ રાણી પાપી વિચાર પતિને કહેતી નથી. કદાચ રાજા એમાં કબૂલ થાય તો ? વળી ધર્મી જીવને પાપી વિચાર આવે એનો ખેદ કેટલો બધો હોય છે કે એને થાય છે કે “આના કરતા મૃત્યુ કેમ ન સ્વીકારી લઉં ?” પાપના વિચારમાં રમવું પડે, પાપી વિચારમાં રમતાં રમતાં જીવતાં રહીએ એના કરતાં પાપવિચારથી છૂટવા મરવાનું ખોટું શું ?” જીવનમાં જીવને જે પાપની વિચારણા આવે છે એ એક જીવનનો ખેલ નથી; એના પર અનેક જીવનનાં નાટક રચાયા છે; તે પણ દુઃખનાં નાટક ! પાછી અહીં જો પાપની વિચારણા ચાલુ રહે તો એના પર ભવિષ્યમાં આવાં અનેક દુઃખનાં જીવન આવે, તેથી ધર્મી આત્મા કંપી ઉઠે છે ! માટે પાપની કરણી તો નહિ, વાણી તો નહિ, પણ પાપની વિચારણા સરખી ન જોઈએ; એવું ધર્મી મન ઝંખે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૪૭, તા. ૧૩-૮-૧૯૫૫

ચારિત્રધર્મને એકમાત્ર મોકષસાધક સમર્થ ધર્મ કેમ કહ્યો ? કહો કે વીતરાગતાએ જવાનો રસ્તો એક માત્ર ચારિત્રનો જ છે. ચારિત્ર વડે સર્વથા વિરક્તતા અને વિરતિ કરો પછી જ વીતરાગતા આવે. પછી તમારી તાકાત ન હોય તો ધીમી ધીમી પગલી માંડવા શ્રાવકધર્મનો દેશવિરતિ માર્ગ છે- પરંતુ છેવટે સર્વવિરતિના રાજમાર્ગ પર તો આવવું પડે જ ! એકલું જ્ઞાન નકામું. એકલું સમ્યગ્રૂદ્ધર્ણ પાંગળું;

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“સિંહકુમારને વૈરાગ્ય” (ભાગ-૨૨)

૧૬૨

એકલાં શ્રાવકનાં પ્રતોથી કંઈ નહિ; એકલી તપશ્ચયર્થી કંઈ નહિ; હા, ચારિત્રથી મોક્ષ ખરો. માટે તેને શિખરે યદાયું. જુઓ સૂત્રમાં મોક્ષસાધનમાં છેલ્લું ચારિત્ર મૂક્યું. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિમોક્ષમાર્ગ : । ચારિત્રમાં રહીને તાપ કરો-જ્ઞાન-ધ્યાન કરો... બધું કરો. પણ વિના ચારિત્રે કંઈ વળે નહિ. ચારિત્રની આટલી બધી તાકાત કેમ ? કેમકે જગતમાં એકજ આ સર્વવિરતિ જીવન છે કે જે જીવનમાં પાપની કરણી-વાણી, વર્તાવ કે વિચારણા પણ નથી. ત્યારે કહો જો વારુ, મોક્ષ જીજામાં જીજી પાપની કરણી-વાણી કે વિચારણા બેઠી હોય ત્યાં સુધી મલે ? ચારિત્ર ન હોય ત્યાંસુધી માણસથી પાપની કરણી ન થતી હોય તેવું બને ? ઘરમાં અર્થાત્ ગૃહસ્થવાસમાં રહીને કોઈ ધારે કે મારે તેવું જીવન બનાવવું છે, તો બનાવી શકે ? ક્યાંથી બનાવી શકે ? કેમકે આરંભ-પરિગ્રહ વગેરે કેટલાંય પાપ ત્યાં રહેવાના. જૈનશાસનમાં પાપ એટલે રાતીપાઈનો સંગ્રહ તે પણ પાપ ! કોઈ પાસે સંગ્રહ કરાવ્યો તે પણ પાપ ! સંગ્રહકરણને અનુમોદે તોય પાપ ! એમ પાપ એટલે એક પાણીનું ટીપું ય કચર્યું તો અસંખ્ય જીવો કચર્યાનું પાપ ! એમ બીજા પાસે કચરાયું, કે કોઈથી કચરાતું સારું માન્યું તેય પાપ ! તેવાં બેજ પાપ નથી; કુલ અધાર પાપ છે. ભલે જીજામાં ઊંચો શ્રાવક હોય, પણ એટલો બેદ તો રહી જવાનો કે આ મારો દિકરો, ને આ પડોશીનો દિકરો ! એટલે પોતાના દિકરા માટે મોહનો વિચાર હોય, પોતાનો દિકરો ભૂખ્યો હોય ત્યાં થાય- ‘એને ચૂલો સળગાવી ચા પાઈ દઉં !’ પણ પડોશી માટે ન થાય. આ બધું ક્યાં ન હોય ? ચારિત્રમાં.

રાણીના અંગે દાસીનો ખુલાસો :- ત્યારે એ ઉત્તર કરે છે “આર્થપુત્ર ! મારા નસીબને પૂછો.” પણ રાજને કંઈ સ્પષ્ટ કહેતી નથી; અને આંખમાં આંસુ ભરાઈ આવે છે. ગદ્દગદ કંડ બને છે. રાજ જુઓ છે કે આને વધુ પૂછવામાં હુંખ વધે છે, માટે વાત ફેરવીને પ્રસંગ ટાળી દીધો.

પદ્ધીથી રાજા મહનલેખા વગેરે એના પરિવારને બહુમાન સાથે બોલાવીને પૂછે છે “તમે તો કારણ સાંભળ્યું હોય તો કૃષ્ણપક્ષની ચંપ્રરેખાની જેમ દેવી ક્ષય પામતી જાય એની ઉપેક્ષા કરવી શું યોગ્ય છે? દેવીનો શોક કોઈ અસાધ્ય વસ્તુ અંગે નહિ હોય. દેવી તો મારું જીવન છે. તો મારે જીવને શું અસાધ્ય છે?” રાજા જાણે છે કે રાણી એટલી ધર્મની પરિણતિવાળી છે કે એનો ખેદ કોઈ સમર્થ નિમિત્ત વિના હોઈ શકે નહિ. તત્ત્વની સમજ, ધર્મની શ્રદ્ધા અને વ્યવહારિક વિવેક હોય તો કાંઈ ફોગટિયા વાતમાં ખેદ થાય નહિ. મહાત્વની વાતમાં જ ખેદ થાય.

મદનલેખા તેનો જવાબ આપે છે- “જુઓ મહારાજ, આપ કહો છો તે બરાબર છે. વળી બેદનું કોઈ પણ નિમિત્ત હોય તો તેને દૂર કરવા આપ આપનું ભૂવનભાનું અન્સાઈકલોપાડિયા-“પ્રવચન મહોદધિ-સમરાઈયે કહા.” (ભાગ-૨૨) ૧૬૩

સર્વ ખર્ચી નાંખવા સમર્થ છો. પણ આમાં જે નડતર નહે છે તે માત્ર સ્ત્રી-જતિને વરેલો અવિવેકજ નહે છે. આજ સુધી આપને કહ્યું નથી, હજ્ય કહેવા જેવું પણ નથી. છતાં બીજો કોઈ ઉપાય જરૂતો નથી ત્યારે હું કહું છું.”

રાજ આતુર થઈ ગયો, સંભવમાં આવીને કહે છે- “કહે, જલ્દી કહે, ઉપાય સાધ્ય તો તમે કર્યું જ હોય; પણ બાકીનું નિવેદન કરવું ઘટે.” એટલે એણે દોહરા ઉત્પન્ન થયાશી માંગીને આજ સુધીની બધી ઘટના કહી સંભળાવી. ‘ગર્ભમાં એવો જીવ આવ્યો છે કે જેની પાછળ ઠેઠ ગર્ભપાતના ઈલાજ કરવા સુધીની આટલી ધ્યાંધલ થઈ રહે.’

ગુણ પર આકર્ષણ :- આ સાંભળીને રાજીને કુસુમાવલી પર જે આદર હતો તે કંઈ ગુણો બધી ગયો. “અહો ! આ પત્નીનો મારા પર કેવો રાગ ! એને પહેલું બાળક જન્મવાનું છે, તેનીય તેને પરવા નથી ! ઉલટું પતિને જરાયે કંઈ ન થવું જોઈએ તેની આટલી બધી એ તકેદારી રાખે છે ! એણે એની યોગ્યતા મુજબ સાચવ્યું છે. પણ વિચાર હવે મારે કરવો જોઈએ. જો દોહદની પૂર્તિ નહિ કરવામાં આવે તો આ રાણી આમ ઘસાઈ-ઘસાઈને કોણ જાણો કેવીય થઈ જશે. તેમ ગર્ભ પણ કદાચ જોખમાય. માટે દોહદની પૂર્તિ થવી જોઈએ.” એમ વિચારી ‘હું અવસરોચિત કરું’ એમ કહીને પરિવારને રજા આપી. શ્રાવકધર્મનો પામેલો આ રાજી છે. એટલે એ વિવેકથી વિચારે છે.

રાજાના આંતરડા ખાવાના દોહદની પૂર્તિ :- રાજાને મન ન રાણીનું કે ન તો ગર્ભનું બગડવું જોઈએ. તેથી પોતાના મંત્રીને બોલાવ્યો. રાજાએ બધી વાત મંત્રીને કરી. મંત્રી હોશિયાર હતો. એણે જોયું કે રાણીએ તો ઘોગય જ કર્યું છે. પણ આમ કાંઈ દોહદ પૂરાય નહિ. રાજા-રાણી બંનેને નુકસાન થાય. એથી બીજો ઉપાય બતાવ્યો; અને રાજાને કહી દીધું કે ‘બધું સાંદું થશે.’ મંત્રી રાણી પાસે આવ્યો; ને રાણીને સમજાવી દીધી કે એના દોહદની પૂર્તિ કરવામાં આવશે.

પરંતુ રાણી કહે છે “ના, મારે દોહદની પૂર્તિ કરવી નથી. એક તો પેટમાં આવેલો જીવ ધાત જેવું તો કામ કરી રહ્યો છે, ને હું ઉપરથી પતિ પર અંબું કર્દું? એર આપો તો ફાકી જઈશ, પણ આવો દોહદ મારે પૂરવો નથી.”

પરંતુ મતિસાગર મંત્રીએ સમજૃતી કરી કે “મારી પાસે એવી કલા છે કે એ કલાથી રાજીના આંતરડાં કાઢીશું ને રાજીને જરાયે ઈજા નહિ થાય ! માટે આપ જરાય ચિંતા કરશો નહિ.”

ગાર્ભના કૂર સ્વભાવથી રાણીએ તે કબૂલ કર્યું. તે પછી યોજનાનુસાર રાજીને બે-ત્રાણ ટંક ભૂખ્યો રાખ્યો, ખાડો પરી ગયેલા પેટ ઉપર કુદરતી લાગે એ રીતે

કૃત્રિમ અંતરડાં બંધાવ્યાં. ઉપર એને પાટાથી મજબૂત કર્યો. હવે એને પલંગ પર સુવાડી રાણીની આગળ એના દેખતાં જ મતિસાગર મંત્રી કપડા નીચે હાથ ધાલી કાપી-કાપીને રાણીને કૃત્રિમ અંતરડાં આપે છે. બધી ઉપરની જ રમત હતી ! પરંતુ એમ કરીને રાણીનો દોહદ પૂર્ણ કર્યો ! એ વખતે તો ગર્ભના લીધે રાણીને બીજો વિચાર આવ્યો નહિએ, કે આ હું શું ભયંકર કરી રહી છું. કેમકે કૂર ગર્ભની એના મન પર અસર છે. પણ પછીથી ભયંકર શોકનો વિચાર આવ્યો કે “અરે, મે પાપિણીએ આ શું કર્યું ? મેં શું રાજનાં અંતરડાં ખાધાં ?...” એમ કરીને ખૂબ જ દુઃખ અને પશ્ચાત્તાપ કરવા માંડી. પરંતુ ત્યાં જ મંત્રીએ રાજાને પલંગમાંથી સાજો ઉભો કરી દીધો ! તેથી રાણીને શાંતિ થઈ.

પછીથી મંત્રી રાણીને કહે છે કે “પુત્રનો જન્મ થાય ત્યારે પહેલા સમાચાર મહારાજને નહિ પણ મને આપવા. પછી હું યથાયોગ્ય કરી લઈશ,” એણે પણ કબૂલ કર્યું. કાળકમે પ્રસૂતિનો સમય આવી ગયો, અને પુત્રનો જન્મ થયો.

રાણી અને મંત્રીની સંતલસ : બાળકને બહાર :- દુશ્મન અનિશ્ચર્મનો જીવ ગર્ભમાં આવતાંની સાથે જ ભયંકર સ્વખ રાણી કુસુમાવલીએ જોયું છે. દોહદ પણ ભયંકર થયો હતો. પોતાનું મન પણ પતિ પર બગડી ગયું હતું. આ રીતે આ જીવના આગમને જ થતા ચિક્કો પરથી રાણીને એના પર જરાયે સદ્ગ્રાવ રહ્યો નથી. તેમ મંત્રી પણ સમજે છે કે “આ પુત્રથી રાજા અને રાજ્ય પર કેવું ભયાનક પરિણામ આવે ?” એટલે રાણીને કહે છે કે “સ્વામિની ! મહારાજને માટે આ જીવ અશુભ જેવો દેખાય છે. માટે આને અહીં રાખીને શું કામ છે ? અને તદ્દન જુદા જ સ્થળે ઉછેરાવા દો; જેથી રાજકુળ સાથે એનો કોઈ સંબંધ ન રહે અને રાજાને કોઈ અનર્થ ન કરી શકે. વળી રાજાને સમાચાર અપાવીશું કે પુત્ર મરેલો જન્મયો છે.” રાણીને વાત ગમી ગઈ ! કહે છે “એ બરાબર છે. મંત્રીજીએ તો મારા હૃદયે ધારી મૂકેલું જ વિચાર્યું. ઠીક છે એ.” મંત્રીએ માધવિકા દાસીને બોલાવીને બાળકને આપી દીધું. સાથે છૂપી રીતે એને અમુક જગાએ જવાની સૂચના આપીને રવાના કરી.

બાળક સાથે દાસી પકડાય છે :- દાસી બહાર નીકળી જરા થોડે ગઈ ત્યાં તો... વિષિ બળવાન છે. જીવનું ધાર્યું શું થઈ શકે, કે જ્યાં પૂર્વોપાર્જિત કર્માનું પ્રબળ સામ્રાજ્ય વર્તી રહ્યું છે ? રાજાએ દાસીને જોઈને પૂછ્યું, ‘શું છે આ ?’ દાસી ગભરાઈ ગઈ. જેને દાળમાં કાળું છે, હૈયામાં મેલ છે, મનની ચોરી છે, એવા માણસો અકસ્માતું પકડાઈ જતાં ગભરાઈ ઉઠે તેમાં નવાઈ નથી. આ તો કંપવા પણ માંડી. થોથરાતી કહે છે, “કંઈ...નથી...મહારાજ...”

ત્યાં તો બચ્યુ રોવા માંઝ્યુ ! લે હવે છુપાવ ! ક્યાં છુપાવે ? રાજા રૂપાણું બાળક જોઈ સમજી ગયો, “જરૂર, આ બાળક રાણીનું જ અને આ દાસી એને ગમે ત્યાં મૂકવા લઈ જાય છે.” એટલે કહે છે- “અરે પાપિણી, આ શું કરવા ધાર્યું છે ? આટલું સાહસ ? બોલ, આ શું ભયંકર કૃત્ય કરવા તૈયાર થઈ ?”

વિકસિત માનવતા :- જુઓ રાજાએ પુત્રના જીવની ભયંકરતાના પરચા જોયા છે. છતાં એની વિકસિત માનવતા શું કામ કરે છે ! ચંદન પાસે અર્જિ એટલે ચંદનની દશા શી ? છતાં ચંદન કામ તો સુગંધિ દેવાનું જ કરે છે. રાજા પુત્રરક્ષા માટે સજજ છે. એના ભારે ધમકીના શબ્દ સાંભળી સ્ત્રીસ્વભાવ મુજબ કાયરતાથી દાસીએ સધણું કહી દીધું કે “આ પ્રમાણો રાણી અને મંત્રી સાહેબની મંત્રાણા હતી, કે બચ્યાને ક્યાંય મૂકાવી ઉછેરાવવું...” વગેરે. છૂપી વાત પ્રગટ થઈ ગઈ. કેમકે તુચ્છ માણસના હાથમાં હતી. દાસી એટલે તુચ્છ પ્રાણી. ઊંચા નીચા કુળમાં આ ભેદ પડે છે. એ સૂચવે પણ છે કે એવી રહસ્યવાળી વાતમાં તુચ્છ માણસને સામેલ ન કરવા જોઈએ. નહિતર રહસ્ય પ્રગટ થતાં વાર ન લાગે. રાજાએ મનમાં વિચાર કર્યો કે ‘આ બાળકને આ લોકોના હાથમાં સૌંપવું જોખમકારક છે. આગળ પર સુરક્ષિત રહે તેવો વિશ્વાસ પડતો નથી.’ તેથી બાળકને રાજાએ લઈ લીધું. બીજી ધાવમાતાઓને બોલાવી, અને બાળકને સૌંપ્યું. સાથે સોગન લેવરાવી કર્યું કે “જો આ બાળકને લેશ માત્ર ઈજા થઈ તો ધ્યાન રાખજો કે તમે જીવતાં નહિ રહ્યો.” બરાબર ઠપકો આપ્યો; અને એ બંનેના મન સાચવવા પુરતું પુત્રજન્મનું જાહેર વધામણું ન કરાવ્યું; પણ કંઈક ગુપ્ત વધામણું-પુત્રજન્મોત્સવ કરાવ્યો.

આમાં સિંહરાજની ઉત્તમતા દેખાય છે. કેટલી ઉત્તમતા છે ! કે પોતાને ખબર છે રાણીના દોહલાની કે આ બાળક ગર્ભમાં હતું તારે શું દોહદ રાણીને થયો હતો. ગર્ભવતી માતાને જે દોહદ થાય છે તે ગર્ભના જીવને અનુરૂપ થાય છે. અધમ જીવ હોય તો દોહદ અધમ થાય છે. ચેલણા રાણીના ગર્ભમાં કોણિક આવ્યો તો તેને પણ આવો જ દોહદ થયો હતો. કેમકે એ જીવ જ બાપનો દ્રોહી હતો. અહીંયાં રાજા જાણે છે કે “આય જીવ સારો નથી. પોતાના ઉપર પત્નીની અગાધ પ્રીતિ-ભક્તિ હોવા છતાં ગર્ભના જીવના લીધે જ એના તરફથી અનાદર વગેરે પણ જોયું છે. સાથે દોહદમાં સુકાઈને રાણી કેવો ભોગ આપવા તૈયાર હતી તે પણ જોયું છે. તો હવે આ એવો જીવ બહાર ક્યાંક મુકાઈ જવા લઈ જાય છે, તો જવા દો કાસળ !” ના, કેમ આમ નથી થતું ? એટલા માટે કે રાજ પોતે સમજે છે “મારું જે થવું હોય તે થાઓ; પણ અમારા ખાનદાન કુળમાં જન્મેલા જીવનું ખરાબ થાય તેવું અમારાથી કેમ આચરાય ? અમારા સ્વાર્થ ખાતર, ‘આ જીવ અમને

માફક નથી, માટે એને નખાવો ઉકરે' આવું સ્વાર્થી અને કૂર કામ અમારાથી બની શકે જ નહિ." તો પછી.

પ્ર.- ખાનદાન કુળવાળા રાણી અને મંત્રીએ બાળકને બહાર કાઢવાનું કેમ ચિંતયું ? એ પ્રેરણ થાય.

૩.- પરંતુ અહીંયાં એટલું સમજવાનું છે કે બાળકને બહાર કાઢવામાં રાણી કે મંત્રીને પોતાનો અંગત સ્વાર્થ નહોતો. એમણે તો રાજ અંગે અર્થત્ પરમાર્થની વિચારણા કરી હતી.

રાજ ખુદના પર આપત્તિ છે, છતાં પોતે જે ઉત્તમતા દાખવે છે એના મૂળમાં આ ઉત્તમ વિચારસરણી છે કે "અમારે અમારા પુણ્યના ભરોસે રહેવાનું. અમારાં પુણ્ય નબળાં હશે અને અમે સારું કરવા લાખ પ્રયત્ન કર્યા હશે તોય તે અમારા લાખ પ્રયત્ન રદ-બાતલ થવાના, તો જે વસ્તુ પુણ્ય-પાપને આધીન છે તેને રદ-બાતલ કરવાના ફોગટ પ્રયત્નો સુજ્ઞન શા માટે કરે ? હા, અજ અભૂત માણસની દશા એ હોય છે કે દુનિયામાં કોઈ પુણ્યશાળી યશ ખાટતો હોય છે, તો એને સહન નહિ થાય. ઉલટું એમ થશે "આને કેમ જશ મળે ? હું એને બરાબર હલકો પાંચું..." અહીં જુઓ, આ આમ ભલે વિચારે, પણ તેમ કરી શકશે એ ચોક્કસ છે ? ના, બહાર એનું ઊંઘું બોલવામાં તે ખરાબ બોલવાનો, એ બોલવામાં એનું હૃદય નિંદાખોર છે, તેજોદેખી છે, તેમ બીજાને લાગવાનું ! તેથી બીજાનું બૂરું બોલવામાં પહેલો પોતે જ હલકો પડવાનો, બીજો નહિ ! એ વિચાર એને નથી કે 'સામાનું પુણ્ય તપે છે, ત્યાં તું શું કરી શકીશ ?' જોવું જ જોઈએ કે જે વાત સામાના પુણ્યને આધીન છે, તેને ઈર્ઝાથી રદ-બાતલ કરવા આડાવળા ધંધા કરવા તે સુશ્નાં કામ નથી. કામ આવડે તો એ છે કે આત્માની લેશ્યા ન બગડે એની સાવધાની કરવી. ધ્યાન રાખ, "તારું પુણ્ય ન હોય, તો તેને ખાસડાનોય માર મલે ! માટે તું તારે તારા કર્તવ્યના માર્ગે હાલ્યો જા !" શું છે આ ? આપણે આપણા સત્કર્તવ્યના માર્ગે ચાલ્યા જવાનું, પછીનું કામ પુણ્ય-પાપનું છે. એ પુણ્ય-પાપને જશ આપવો હશે તો જશ આપણે ને અપયશ આપવો હશે તો અપયશ આપણે. આપણે તો આપણું સત્કર્તવ્ય જોવાનું. આનું નામ જ માનવજીવન કહેવાય. નહિતર માનવજીવન છતાં આત્માના ઉપર કાળો-કૂચડો ફરી જાય !

પુત્રનું નામ આનંદ : પિતા પ્રત્યે દુર્ભાવવાળો :- કેટલોક કાળ વીત્યો, પુત્રનું નામ 'આનંદ' રાખ્યું. પુત્ર ધીરે ધીરે ઉછિરતો ગયો. પરંતુ આટ-આટલું કરનાર પિતા પ્રત્યે પણ આનંદકુમાર પૂર્વના કર્મને લીધે વિષમચિત્તવાળો, દુર્ભાવવાળો બનતો ગયો. પરિણામ ? રાજાની પ્રવૃત્તિમાં ખામી જોનારો થઈ ગયો. રાજ ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

૧૬૭

એનું સારા માટે કરે, આ ઊંઘું પકડે ! રાજાએ તો તેને યુવરાજપદે પણ સ્થાપી દીધો !

દુર્મતિ રાજાનું જોર :- એક વારનો પ્રસંગ એવો બને છે કે પોતાના રાજ્યના સીમાડામાં જંગલ સંબંધી એક દુર્મતિ નામનો રાજ રાજ્ય જમાવીને રહે છે. આમ તો તે સિંહરાજાનો સામંત રાજ છે. પણ એની પાસે કિલ્લાનું બળ છે. તેનાથી ગર્વિષ બની સિંહરાજાની સામે માથું ઊંચક્કું. અહીંથી રાજાએ પોતાનું સૈન્ય મોકલ્યું. દુર્મતિ પોતાની ભૂમિમાં રહીને લડે છે; એટલે સિંહરાજાના સૈન્યને હારી જવું પડ્યું. આ હારના સમાચાર સિંહરાજાને મળ્યા. રાજ ઉકળી ઉઠ્યો. પરાજ્યની વાત સહન થઈ શકી નહિ. તેથી સ્વયં તેની સામે ઉપદ્યો. ત્રણ દિવસના પ્રયાણમાં તે યુદ્ધભૂમિ પર પહોંચી ગયો. જાય છે લડાઈ લડવા માટે પણ જ્યાં વચ્ચે સિન્ધુ નદીની રેતમાં સવારી જઈ રહી છે; પોતે મોટા હાથીના હોદે બેઠેલો છે. ત્યાંથી પાણીની નજીક એક મનુષ્યના ટોળાને જોયું. એ ટોળું 'અરે ! અફસોસ ના પોકાર કરી રહ્યું છે. રાજાએ અવાજ સાંભળ્યો, અને આતુરતાથી પોતાનો હાથી તે તરફ લીધો. ત્યાં તેણે એક વિચિત્ર ઘટના જોઈ.'

મત્સ્યગલાગલ :- મહાન કાયાવાળા તથા ભયંકર શ્યામ રંગને ધારણ કરનારા અને ચક્ષુમાંથી નીકળતા વિષની જવાણાથી દેઢીયમાન એક ઘરડા સાપે મોંમાં એક દેડકને પકડ્યો છે. દેડકો ચીસો પાડે છે. ભયાનક પહેળા મોંવાળો તે સાપ તેને છોડતો નથી. પરંતુ સાપ પોતે પાછો એક મોટા ટિટોડાથી ગળાઈ રહ્યો છે ! એની પાછળ દિગ્ગજની સુંઠના જેવો જાડો અને વિશાળ કાય એક અજગર વળી આ ટિટોડાને ગળી રહ્યો છે ! જેમ જેમ લાલ આંખથી બીભત્સ દેખાતો એ અજગર પેલાને ગળતો જાય છે; તેમ તેમ એ વળી પ્રાણી સર્પને ગળતો જાય છે ! ને સાપ દેડકને ગળતો જાય છે ! પ્રાણ કંઠે આવવા છતાં શિકારને છોડતા નથી. એકબીજા પર આકમણ ચાલી રહ્યું છે ! સમુદ્ર માટે જેમ 'મત્સ્યગલાગલ' ન્યાય કહેવાય છે; મોટમોટા માછલાઓ પોતપોતાથી નાનાઓને ગળે છે, તેમ આ પૃથ્વી પર જોવામાં આવ્યું. કહો, આ પ્રસંગ કેવો છે ? જીવની ચંચળતા, પરાધીનતા છતાં પાપમજનતાને બતાવતો આ પ્રસંગ છે. ક્યારે જીવનો અંત આવી જાય તેનો પત્તો નહિ ! દેડકો કોઈ ભોજન કે મોજની આશામાં ક્યાંક જતાં પકડાયો છે. સર્પને એમ છે કે હું એને ગળી જાઉં ! ટિટોડાને વળી એમ છે કે હું સર્પને ગળી જાઉં... જીવનની ક્યાં સ્થિરતા છે ? ક્યાં નિષ્પાપતા છે ? જે એકબીજાની કિયા છે કે 'ગળી જાઉં !' આ મૂઢ હૃદયને આનંદ આપનારી છે. પરલોકનો વિચાર નથી. માત્ર આ ભવ મીઠાં તો પરલોક કેણે દીઠાં ! અહીંયાં ઘરબાર, ને બેરી-છોકરાં મલી ગયાં, પછી

૧૬૮ ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પુત્રનું નામ આનંદ...” (ભાગ-૨૨)

એની લહેરની સાધનામાં લીનતા ! બીજું શા માટે જોવાનું ? જીવનની છેલ્લી શાસધરડ સુધી એજ ઘરબાર ને બૈરી-છોકરાંની પલેવણ કરતો મરે ! એ સુજ્જજનને તો બેદ કરાવનાર છે.

રાજી વિચારે છે :- “અહો, આવું જગતમાં ચાલી રહ્યું છે ? આમને બચાવવાનો ઉપાય શું ? કરવું શું ? કોઈ કોઈને મૂકતા નથી. પોતાનીય ભયાનક જીવલેણ સ્થિતિ થઈ છે; તો પણ આવું ભયંકર અકાર્ય કરવામાંથી પાછા હટતા નથી. આમાં કોને છોડાવવા જઈએ ? જેને છોડાવવા જઈએ તેના ઉપરના ગ્રાફીનો નાશ કરવો પડે. તેમ એનો નાશ કરવા છતાંય છોડાવેલા જીવનો બચાવ તો થવાનો નથી ! તો આવી પ્રતિકાર રહિત વસ્તુને જોવાનીય શી જરૂર ?” તરત રાજીએ ત્યાંથી પોતાનો હાથી મારી મૂક્યો. વાત સાચી. જ્યાં પોતાનું કંઈ વળવાનું નથી, ત્યાં શા માટે ઊભા રહેવું ? ઊલટું કોઈની સંહારલીલા જોઈ રહેતાં આપણા દિલ નિષ્ઠુર બની જાય. કેવું આશ્રય કે ગ્રાફી વિનાશના પંજામાં સંપડાયો હોવા છતાં પોતાને સારું કરવું સૂઝતું નથી ! ‘પાપથી પાછો હટું’ તે વાત કદાચ વૈખયિક સુખની બોલબાલામાં તો ન થાય, પણ પીડિત થવા છતાંય ન થાય ? મનમાં ઉમળકો આવ્યો, ને સામાને કઠોર શબ્દ કહી નાંખ્યો, જૂઠ બોલી નાખ્યું, આટલું કરવા છતાં કાર્ય તો સિદ્ધું નહિ; તો હવે બેદ થાય ખરો ? કે “આવા બોલ મેં ક્યાં કાઢ્યા ?... કામ તો બગડી ગયું...” ના, બસ ત્યારે આનું નામ જ જીવના સ્વભાવમાં પાપનીજ મહા ઓતપ્રોતતા છે. આ પાપના પંજામાંથી બહાર નીકળી જવું મુશ્કેલ છે. આપણે હારીશું, પાછા પડીશું, છતાં પાપ મૂકવાનું મન નહિ થાય ! એટલી બધી જીવની અધમ દશા થઈ છે. થઈ છે શું આપણી જાતે જ કરી છે.

કહો, આ દુનિયામાં પાછા પડ્યા છો કે નહિ ? દુકાન માંડ્યા પછી, પરણ્યા પછી, બચ્ચાના બાપ બચ્ચા પછી... ક્યાંક ક્યાંક પાછા પડવાનું બન્યું છે કે નહિ ? પાછા પડ્યા હશો. છતાં પાપથી પાછા વળવાનું ખરું ? “ભલે છોકરો લાત મારી જાય પણ અંતે તેજ આપણને પાળશે... ભલે દુકાને ખોટ આપી, પણ તેજ કમાઈ આપશે...” આવાં સમાધાન કરો છો, તે પાપની નીડરતાને લીધે કરો છો. પણ તે પોકળ સમાધાન છે ! પોકળ વિશ્વાસ છે ! જેમાં અંતે રોવું જ પડે ! એ દુકાન વગેરે પાછળ જે ગુમાન, ઉગ્રતા, ઈચ્છા, કુદ્રતા વગેરે પાપો, હિંસા, જૂઠ, અનીતિ વગેરે પાપો કર્યો તે માથે પડ્યાં; એનો બેદ, અને હવે એ ન કરું એવો નિર્ધાર ક્યાં છે ?

માણસ વસ્તુના પરમાર્થને નથી સમજતો, તેથી જીવન પણ બેફામ રીતે જવે છે. ધારો કે દુનિયામાં કોઈ એવો માણસ હોય કે એની સાથે પ્રસંગ પાડવા ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“ગ્રવચન મહોદેશિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

જેવો નહિ છતાં પ્રસંગ પાડવો પડે ખરો, પણ એ વખતે આપણે જો સમજદાર હોઈએ છીએ તો જે પ્રસંગ પડે તે કેવી રીતે પડે ? વધારે પડતો અનર્થ ન નીપજે તે રીતે ને ? તેમ આ સંસારની ઘટના જોઈને જીવનો વ્યવહાર તેવો સાવધાનીવાળો જોઈએ. ત્યારે શું તમને સંસારની વિચિત્ર ઘટનાઓનો અનુભવ જ નથી ? છે, તો પછી તમારો વ્યવહાર એવો જોઈએ કે એમાંથી તમને અનર્થ નીપજી ન શકે. આ સાવધાની રાખનારો ખરો સમજુ છે, ખરો જ્ઞાની છે. પૂર્વે આવા સમજુ વધારે હતા તેથી એ જ્ઞાનયુગ કહેવાય.

રાજી હાથી દ્વારા લશ્કર ભેગો થઈ ગયો. લશ્કરને જે સૂચના-સલાહ આપવી હતી, તે મુજબ કરી; રાત્રે પોતે સૂઈ ગયો. સૂટેલો રાજી અર્ધરાત્રિએ જાગ્યો. પરંતુ જાગતાં ‘હુશ્મને આપણો પરાજય કર્યો છે’ તે વાત યાદ નથી કરતો, પરંતુ રસ્તામાં જોચેલો પેલો અજગરનો પ્રસંગ તેની સમક્ષ હાજર થયો ! હવે જુઓ કે ગ્રન્થકારે કેવી સુંદર વિચારણા અહીંયાં રજૂ કરી છે !

જગતના વિષયો આપાતમાત્ર મધુર છે :- એટલે કે વિષયોનો ઈન્ડિયો સાથે સંપર્ક થાય, તે ક્ષણ પૂરતા જ વિષયો મધુર લાગે છે. પણ પછીની ક્ષણો જ તેનો વિપાક, તેનું પરિણામ વિરસ આવે છે; કટુ આવે છે; અને ભાવીમાં તો એના પાપના ભયંકર માઠાં ફળ હોય છે. આમ વિપાક બે જાતના :- (૧) વર્તમાન વિપાક; (૨) ભાવી વિપાક.

વર્તમાનવિપાક બે જાતના હોય છે :- એક તો વિષયનો સંપર્ક થયા પછી ક્ષણવાર જે મધુરતા-શાતાનો અનુભવ થાય છે, તે વિપાક. બીજો તેનાથી જીવની થતી જે નિઃસત્ત્વ અવસ્થા-આસક્ષિતી અવસ્થા-વિષયો તરફની ગુલામીની અવસ્થા-તે વિપાક. આ વિપાક અતિ કટુ હોય છે. એટલું સમજુ રાખો કે જીવને દુનિયાની સારી વસ્તુ ન મલે ત્યાં સુધી જ તે સાખણો; પણ મલ્યા પછી મોટી મૌંકાણ મૂકાય છે ! નિઃસત્ત્વતા, આસક્ષિત, ગુલામી વગેરેનો વર્તમાન વિપાક ઊભો થઈ આસાના ધોર દુશ્મનભૂત મોહનીય કર્મ, જ્ઞાનાવરણ કર્મ અને બીજા અશાતાદિ કર્મના દારુણ ભાવી વિપાક ઊભા કરે છે.

● ફીરનું દષ્ટાન્ત ●

એક ફીર જૂંપડીમાં ધ્યાન ધરતો હતો. રોજ ગામમાંથી લોટ માગી લાવીને પેટપૂર્તિ કરતો. પણ એક દિવસ બન્યું એવું કે ઊંદરભાઈએ ફીરની એકની એક કફનીમાં કાણું પાડી દીધું ! ફીરે કફની જોઈ, ‘અરે, કફનીમેં કાણા પડ ગયા ? હાં, ઊંદરને પાડા, અબ કયા કરે ?...’ ફીરને એ ચિંતા થઈ પડી કે ‘ઈસ ચૂછા

યદિ ગુંપડીમેં રહે જાયગા તબ સબકો ખત્મ કર દેગા ! ઈસ લીધે ચૂહાકો હટાના ચાહિએ.’

જ્યાં આ એક મધુરતા ફકીરના મનમાં પેઢી કે “ઉંદર ન રહે તો સારું,” ત્યાં મન થઈ ગયું મુદ્દાલ ! અત્યાર સુધી અલ્લાહનું ધ્યાન હતું, હવે ઉંદરને દૂર કરવાનું ધ્યાન ચઢ્યું ! “બસ, એક બિલ્લી રખની ચાહીએ ! એક બિલ્લી રફ્ખખી હોવે, તો ફીર ચૂહા નહિ આયેગા. કિન્તુ બિલ્લી કેસે રહેગી ?...” બિલાડી થોડી પરમાર્થી છે કે ફકીર એને ખવરાવે નહિ તો પણ એની સેવા કરે ! ના, બિલાડી પણ સંસારનું પ્રાણી છે; માટે ફકીર વિચારે છે “બિલ્લી કો દૂધ પીલાના હોગા. ઓર, વો દૂધ પીવેગી, તબી યહાં સે જાયેગી નહિ ! તો ફીર ઉંદર આયેગા નહિ !” જોવાને માટે હૈયે જો આંખો હોય તો ફકીરની આ વિચારણામાં કટુવિપાક દેખાય. નહિતર કેવળ કથા સાંભળી જવાય ! જુઓ કે જીવની નભળી કરી કરી ? નભળી કરી એટલે ? એવી કોઈ ખાસિયત કે જેથી જ બીજાને જલદીથી વશ થઈ જાય. બીજાની ગુલામી ઉઠાવે, પરાધીન પડી જાય. તેવી કરી કરી ? ફકીરે બિલાડીની નભળી કરી પકડી લીધી ! બસ, દૂધની લાલચ આપો કે એ તમારે પરવશ બની રહે ! મનગમતાની લાલસા એ નભળી કરી. માટે જેણે જીવનમાં કોઈ જરૂરિયાતો રાખી નથી તેવા જ જીવો જગતમાં બેપરવાહ થઈને ફરી શકે છે. નહિતર ચમરબંધીને પણ ગુલામી ઉઠાવવી પડે. પોતાના સ્વાર્થની લાલચ તે નભળી કરી છે. એ કરીને સલામત રાખી તો સમજ રાખો કે તમારે કોઈને પરાધીન થવું પડશે ! ફકીરે બિલાડીને દૂધ આપીને રાખવાનો વિચાર કર્યો. હવે આગળ શું વિચારે છે તે જુવો, “બિલ્લી તો રખુંગા, કિન્તુ દૂધ લાઉંગા કહાંસે ? હાં, દો ચાર ઘંટે ઔર ભટકેંગે તો દૂધ મીલ જાયેગા. લેક્નિન ઉસમેં ખુદાકી બંદગીકા સમય જાયેગા. ઔર જહાં લોટ ભી પૂરા મીલતા નહિ. વહાં દૂધકા કટોરા ભી કહાંસે મીલેગા ? ક્યા કરના ? ઔર, એક દિન હોવે તો ઠીક હૈ, લેક્નિ યે તો રોજ કી બાતે હેં... તબ તો ઈસલીધે એક ગૌઝાં રફ્ખે તો અચ્છા હે !” ફકીરે ઉંદરને કાઢવા બિલાડીનો વિચાર કર્યો, બિલાડીને રાખવા દૂધનો વિચાર કર્યો ને દૂધને લાવવા હવે ગાયનો વિચાર કરે છે ! પણ પાછી મુશ્કેલી તો ઊભી જ રહી ! “ધાર, ગૌ લાના તો ઠીક હૈ, કિન્તુ કહાં સે લાયેંગે ? ઠીક હૈ, રોજ તો હમ છોટે છોટે ઘરમેં બિક્ષા લેનેકે લીધે જાતે હે, લેક્નિ અબ ખુદ બાદશાહ કે વહાં હી જાઉંગા...”

ફકીર સંસારને છોડીને બેઠેલો, પરમાત્માનું જ સ્મરણ કરવાનો ભેખ લઈને બેઠેલો. તે ક્યાં પહોંચ્યો ? ‘કફનીમાં કાણું ન પડવું જોઈએ’- તેટલા વિચારે આ ફકીરને કેટલો લપેટમાં લીધો ? શાસ્ત્રકાર વારંવાર કહે છે કે “સંસાર અસાર છે,” તે સમજો છો ને ? અસાર એટલે માટે કે એનું જરાક સુધારવા આપણું ઢગલો

બગાડવું પડે. કફનીને પડેલું કાણું-બેય સંસાર છે. તે સંસારે ફકીરને ક્યાં ફેંક્યો ? ઊંચા પરમાત્મ ધ્યાનમાં વિચરવાનું મૂકાવી બાદશાહ પાસે ભીજ માંગવામાં ! એ વિચારે છે કે “રાજી તો ખુદ અલ્લાહકા અવતાર હૈ ! ઉસકી પાસ જાઉં, આજજી કરુંગા... હરરોજ જાઉંગા... બાદશાહ ખુશ હો જાયેગા... ગૌ માંગ લુંગા !... દૂધ નિકાલુંગા... બિલ્લી કો ખીલાઉંગા ! બિલ્લી ફિરતી રહેગી. બસ, પીછે ચૂહા આયેગા નહિ... ફીર કફનીમાં કાણાં કહાંસે પડેગા...?” પણ ગાય એમનેમ દૂધ આપે ? ગાયની રખેવાળી કરવી પડે; અને ધાસચારો નાંખવો પડે; એના છાણ-મૂત્ર સાફ કરવા પડે; ચરવા જાય તો ત્યાં ભાળ રાખવી પડે; વગેરે કેટલુંય કરવું પડે. હવે ફકીરને આ વિચાર આવ્યો ત્યાં એ ચોંક્યો ! “અરે મેંને એ ક્યા કીયા ? કફનીમાં એક કાણાં તો કાય, સારી કફની ચૂહા ખા ગયા હોતા તો ભી મુજે કાય ? માંગ લેતા દૂસરી. કદાચ ન મીલતી તો મેં લંગોટ પહેનકે રહેતા. કિન્તુ યહ મેંને કહાં તક અધમ ચિંતા કી ? કાય યહ ફકીરી ઈસલીધે લીધા હૈ, કી ખુદાક ભજન કે લીધે ?”

મમ્મણ શેઠ શા કસાઈનાં કામ કર્યા હતા ?... :- જગતના સારા દેખાતા પદાર્થો લાલચમાં ક્ષણવાર સુખ દેખાડે; પણ વિપાક ધણો ભયંકર. માણસને રૂપિયા લાખ આવ્યા પછી કેમ ? આંખું હૈયું એના માટે સર્મર્પણ ! આખી ગડમથલ એ લાખની જ ચાલતી હોય ! કલ્પનામાં જ હજાર ચિંતાઓ-ભયો વગેરે ઊભાં કરે ! આ તો વર્તમાન વિપાક. પણ ભવિષ્યનો વિપાક ? જગતના પદાર્થો ચિરકાળ સુધી એવી કટુતા બતાવે છે અને એમાંથી એવા ધોર પાપ ઉપાજીવે છે કે ભવાંતરમાં જીવને દુર્ગતિના દુઃખોની ભડીમાં જ શેકાવાનું ! મમ્મણ શેઠ શા કસાઈનાં કામ કર્યા હતાં ? કઈ ચોરીઓ ને કઈ બદમાશીઓ કરી હતી ? તો એ મરીને સાતમીએ કેમ ગયો ? કહો કે વિષયો ક્ષણવાર સુખ આપે છે પણ વર્તમાનમાં પરિણામે ધોર પાપની વૃત્તિઓ ખડી કરે છે; અને ભવિષ્યના પરિણામે નરકના ધોર દુઃખની ભડીમાં શેકે છે. હવે જીવનમાંથી માપ કાઢો કે જીવન કેવું જીવી રહ્યા છીએ ? ક્ષણિક સુખ પાછળ કેટલું ભમીએ છીએ, ને મન કેટલું બગાડીએ છીએ ?

અહીંયાં આપણાને સર્વજ્ઞાનો રૂડો ધર્મ મળ્યો અને નિર્ગ્રન્થ ગુરુ મળ્યા ! કેવી સુંદર અખંડ ઉપાસના કરવાનો લાભ મળ્યો ! ત્યારે એની સામે દુનિયા કેવી મળી ? મહાકિમતી ઉપાસના જ ભૂલાવી દે ! અહીંથી (ઉપાશ્રેથી) ઉઠાચ બરાબર શું ચાલવાનું ? સંસાર લૂધો લાગશે ? સંસારથી ભાગી જવાનું મન થશે ? “અરે થાક્યા આ સંસારથી...!”ના, આંખું થવું ક્યાં રસ્તામાં છે !

● સિંહરાજની મનનીય વિચારણા ●

સિંહરાજ અર્ધ રાત્રિએ ઊરીને વિષયોના વિપાકની કટુતા વિચારી રહ્યો છે. “આ જગતના આવા તુચ્છકટુ વિપાકવાળા જેર સમા વિષયો પર મૂર્ખાઓને પ્રેમ થાય-સદ્ગ્રાવ થાય. સમજુને આવા જેરી વિષયોના સંગમાં બેસી રહેવાનું પાલવે નહિ, કેમકે એ સમજે છે કે આ વિષયો એટલે અહીના અમૃત્ય અવસરની બરબાઈ ! અને ભવાંતરમાં આત્માની કારભી કંતલ !” વિચારો, રાજ ત્યાગની ભૂમિ પર નથી બેઠો, ભોગની ભૂમિ પર બેઠો છે. એવો એ રાજ પોતાની જતને મૂર્ખ ગણે છે ! “અરે, હું કેવો મૂર્ખ ! કે આવા જેરી વિષયો પર સદ્ગ્રાવ રાખીને હું હજુ બેસી રહ્યો છું...” આગળ વિચારે છે કે “વળી આ જગતમાં આશ્રય જુઓ કે જેમ કોઈ જીવનના અર્થે જેરને સેવે તેમ આવા જેર જેવા વિષયો ખાતર આ સુખના પ્રેમી લોકો પાપને સેવે છે. જાતે માની રહ્યા છે કે આ કરીને અમે સુખ મેળવી લઈએ. !” પણ શું જેર ખાવાથી જીવાનનું મલે ? ના, એ તો સમજ જ રાખો. કે અહીં જે પાપ કર્યું જેરની જેમ તેનું પરિણામ ખતરનાક જ છે. વિજળીના જબૂકા જેવું સુખ જોઈ તો લીધું, પરંતુ એ જેરી સુખના ખાતર શાશ્વત એવા ધર્મને છોડી દેવાય છે, એ ખૂબજ દુઃખદ છે ! “ભાઈ ! ધર્મ તો થશે, પછી ય થશે, પણ હમથાં તો દુનિયા સંભાળી લેવા એ...કેમકે દુનિયાનું સંભાળ્યા વિના ચાલવાનું નથી...ધર્મને સાચવનાર તો છે ને સંધ અને આચાર્ય મહારાજ ?” આવું કહેનાર અબૂજને આપણે કહી શકીએ કે “મૂરખ ! ધર્મનું સાચવવાનું તો રહ્યું, પણ તું તારા આત્માનું સાચવીશ ?” ખરી રીતે કહીએ તો તને તારા આત્માની પડી નથી-કે જેથી માનવજીવનની સોનેરી ઘડીઓ આ કથીર જેવા વિષયોમાં પસાર કરી રહ્યો છે.”

માણસે સમજ રાખવું જોઈએ કે “દુઃખ એ પાપનું ફળ છે.

- (૧) વર્તમાનમાં દુઃખી છે તો ભૂતકાળનાં પાપ ઓછાં થાય છે.
- (૨) વર્તમાનમાં પાપ કરી રહ્યો છે તો ભવાંતરમાં દુઃખી થવાનો !”

આ બેય વાત નજર સામે તરખરે તો (૧) વર્તમાનના દુઃખમાં ગભરામણ કે શોક તો ન થાય; પણ ઉપરથી પાપનાં જેર આત્મામાંથી ખસે છે તે બદલ કલેજે શાંતિ રહે. વળી (૨) જીવનમાં વર્તમાનમાં ખોટો શોક, ખોટી તૃષ્ણા, દુર્ધ્રાન, કે દુનિયાને વળી બીજાં પાપો અને દોષો સેવવાનું જે થાય છે તે અટકે. બે વાત છે; જૂનાં પાપને ખસવા દો; નવાંને આવતા અટકવો.

દુઃખ ભોગવનારો પોતાના પાપનો નાશ કરી રહ્યો છે. ત્યારે એમાં તો

આત્મા પાપના ભારથી હલકો થવાનો. પછી એણે શોક શા માટે કરવો ? ઉલદું ધર્મસેવામાં લાગી જવું. જેથી ભવિષ્ય માટે પાપ અને દુઃખ ઊભાં થાય નહિ. આ તો દુઃખોની વાત. તેમ સુખી અહીં પોતાના સુખ ભોગ વખતે પોતાના પુણ્યને જ ઓછાં કરી રહ્યો છે ! તેથી હવે ભવાંતરમાં સ્થિતિ સદ્ગ્રાવ રાખવા એણે ધર્મભય જીવન કરી દેવું ઘટે. સુખી કે દુઃખી જો ધર્મનાં ફળ ઉપર શ્રદ્ધાવાળા હશે, તો જ આ કરશે. ધર્મથી દુઃખ જાય; ધર્મથી જ સુખ મળે, આ સમજનારે ધર્મનું ઔષ્ણ લેવું જોઈએ; અને ભવાંતરમાં દુઃખી ન થાઉં-માટે નવાં પાપ બંધ કરવા જોઈએ. શ્રાવકપણાને યોગ્ય જીવનમાં કેટલાંય પાપ ઓછાં કરવા જોઈએ. પાપો રોજ પ્રતિકમણમાં બોલો છો ને ?

કાળ ગમે તેવો બગડી જાય, ભલે-ચિંતા નહિ, પણ શાસ્ત્રે જે કંધું કે-પાપનું ફળ દુઃખ. માટે પાપનો નાશ કરવા માટે ચાહે સુખી હોય કે દુઃખી-એણે હંમેશા ધર્મ કરવો જોઈએ. જીવનમાંથી પાપનો નિકાલ કરવા માટે એક જ ઉપાય છે-ધર્મનો. ધર્મનું આલંબન ન રાખે તો સુખી પણ દુઃખમાં પડે છે; અને દુઃખી વધુ દુઃખી બને છે.

આ કોણ સમજ શકે ? ધર્મનાં સુંદર ફળ હૃદયથી સમજે તે. બાકી તો ‘મારે તેની તલવાર’માં લોક પડ્યું છે. સાપ દેડકાને ગળે, તેમ બળિયો નબળાનું પડાવે છે. “નબળાને આપું એમ નહિ, પણ એનું જેંચી લઉં ! મૂડી છે, તો બજારમાં ‘ખેલો’ કરી લઉં...રેંગડા-પેંગડા વેપારીઓને હેઠા બેસાડી માલ ઘર ભેગાં કરી લઉં.” વધુ બળ-તાકાતનો ઉપયોગ શું ? પિશાચી દુનિયામાં અલ્ય-બળવાન પર હક્કમત બજાવવાનો અને એની પાસેથી આપણે સ્વાર્થ ચૂસી લેવાનો ! કેમ એજ ને ? અરે, મોટાની વાત એકબાજુએ રાખો; નાના બાળકોમાં પણ શું છે ? ભલે લાંબી પહોંચ નથી; પણ જેનામાં બળ વધારે, તે બીજાને ઠાંસો લગાવીને ઊભો રહે છે ! એક જ બાપના બે બાળકો હોય, એક ત્રણ વર્ષનો ને બીજો દોઢ વર્ષનો. બે સગા ભાઈ છે ને ? તોય પેલા ત્રણ વર્ષનો સમજશે કે “હું મોટો !” શા માટે ? નાનાને દબાવવા ! આને સંતની દુનિયા કહેવાય કે શેતાનની ? આવીય દુનિયા, જ્યાં સુધી આપણે શિરજોરી કરી શકતા હોઈએ, ત્યાં સુધી આપણને એ માલવાળી લાગે છે. પણ સમજાનું જોઈએ કે ‘કાળ અને ભાગ્યનું ચક ફરતું છે.’ આજે આપણે ભલે બળિયા અને ભાગ્યશાળી; પણ કાલે આપણે જ નિર્બળ અને બીજાની દાઢીમાં હાથ ઘાલવો પડે એવા હીનભાગી થઈએ ત્યારે ભારે દેખાશે. સો દાઢાડ સાસુના તો એક દિવસ વહુનો ખરો ને ? વહુ નવી-નવી આવી હોય. એટલે સાસુ શિરજોરી કરી લે, પણ વહુએ પગદંડો જમાવ્યા પછી

સાસુને તોબા પોકરાવે છે ને ? કેમ આટલું બધું ? વારા પછી વારો, મારા પછી તારો ! નાના અને નિર્ભળ પાસેથી જેટલો સ્વાર્થ ચૂસાય તેટલો ચૂસી લેવો, એ તો કોલુ જેવી કૂરતા છે. કોલુ શેરરી કરતાં બળવાન છે, તો શું કરવાનું ? બિચારીને જોરદાર કચરી ઘાલશે ! સ્વાર્થની મહાન લૂંટ અને ઉપરથી મહાન શિરજોરી ! એ આ શેતાની જગતમાં મળેલા બળનું પરિણામ દેખાય છે.

જીવો જીવસ્ય જીવનમ્ :- રાજી હુનિયામાં વાપક રીતે દેખાતો સિદ્ધાંત તારવે છે- “દેડકા જેવો નિર્ભળ અને તુચ્છ જીવ, સાપ જેવા બળવાન પ્રાણીથી ગળાઈ રહ્યો છે, કોળિયો કરાઈ રહ્યો છે !” માટે ‘**જીવો જીવસ્ય જીવનમ્**’-નું સૂત્ર ઊંધું લગાવ્યું છે. એક જીવ બીજા જીવનું જીવન છે, માટે એને ખાઈ જાઓ-ગળી જાઓ ! જો આજે આપણે બિલાડી છીએ, તો ઉંદરને ખાઓ ! પણ આપણને કૂતરો ખાય એ પાછું નહિ ગમે. બીજા જીવો આપણા શિકાર; આપણને કોઈના નહિ. જીવો જીવસ્ય જીવનમ્ એનો અર્થ એ છે કે જીવ=એક સજ્ઞાન જીવ, બીજા જીવનું=બીજા અજ્ઞાન જીવનું જીવન છે; અજ્ઞાનને જીવાડવામાં આધાર છે. સજ્ઞાનના આધારે અજ્ઞાન બચે. માતા સજ્ઞાન છે, તો બચ્યું અજ્ઞાન છીતાં ઊછરીને મોટું થાય છે. પણ માતા જ બાળક જેવી અજ્ઞાન હોય તો ? બચ્યું મરે ! શિક્ષક સજ્ઞાન છે, તો બાળક ભણીને શિક્ષિત બને છે. પણ શિક્ષક જ નિશાળિયા જેવો હોય તો ? તેમ ગુરુ જો સજ્ઞાન છે, તો જગતના જીવો માટે જીવનરૂપ બને છે. પણ ગુરુ જ અજ્ઞાની હોય તો ? જગતના જીવો વહેલા મરે ! ગુરુ જો અજ્ઞાન તો જગતનું મોત, ગુરુ જો સજ્ઞાન તો જગતનું જીવન.

સજ્ઞાન એટલે ? :- તો હવે એ જુઓ કે સજ્ઞાન એટલે શું, ને અજ્ઞાન એટલે શું ? જ્ઞાનવાળા એટલે શાના જ્ઞાનવાળા ? ચાર પૈસાનું શેર તો આઠ પૈસાનું બશેર મળે એ ? પૈસાનું પાશેર મળે એ જ્ઞાનવાળા ? ચક્કવર્તી વ્યાજ ગણનારો એ સજ્ઞાન ? શું સજ્ઞાન એટલે ? માની બહેનને મારી કહેવાય, તે જ્ઞાનનારા ? ક્યા જ્ઞાનવાળા જોઈએ ? પુષ્ય-પાપના જ્ઞાનવાળા, આત્માના હિતાહિતના જ્ઞાનવાળા, કર્તવ્યાકર્તવ્યના જ્ઞાનવાળા, એ સજ્ઞાન.

ગુરુ જો અજ્ઞાની હોય તો સામો ધર્મ માગતો હોય, છીતાં એને અધર્મમાં પ્રેરે. જગતના ભદ્રક જીવો ધર્મ માગી રહ્યા હોય છે, પણ ગુરુઓ કેટલાક એવા હોય છે કે જે એને અધર્મના કૂવામાં ઉત્તરે ! તેમ એવા હિતશત્રુઓ પણ મળે છે જે પાપસલાહ દઈ સામાનું નિર્કંદન કાઢે. પાપસલાહથી જ હુનિયા આજે ખોટા પાપાચરણમાં રોળાઈ રહી છે; જીવનને ભારે કરી રહી છે ! જ્યારે જિનેશ્વર ભગવાનનું શાસન મોજુદ છે, ઉત્તમ વિચારધારા, સુંદર સમાવિની ચાવીઓ આજે ભુવનભાનું અન્સાઈકલોપીયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

પણ મળી શકે એમ છે, ત્યારે એ બધું મૂકીને જગતને ખોટા પાપાચરણના ઉપદેશ કરવા તે શું ચાલ્યું છે ? જીવો જીવસ્ય જીવનં નહિ, મરણમ- નેતા જીવ બીજા જીવને જમરૂપ બને છે. “મધ્યમ માણસો ભૂમે મરે છે... અને શ્રીમંતોને લહેરથી બંગલાઓમાં રહેવું છે અને મોટરોમાં ફરવું છે...” આમ બોલીને પ્લેટફોર્મ ગજાવવાનાં ને ટેબલ પછાડવાનાં ! “આજે લક્ષ્મીવાળાઓને કંઈ પડી નથી... લોકેનાં લોહી ચૂસે છે...” આવું બોલનારને આપણે પૂછીએ છીએ કે “અરે મહાન વક્તા ! આ તું કોને સંભળાવે છે ? પૈસાવાળાઓને સંભળાવે છે ? તે તો તારી સભામાં હાજર નથી. સુધારવા તો તેને છે ને ? તો તેના બંગલાઓમાં જા તો ખરો સંભળાવવા, કહી દેશે, ઉતરો ઉતરો નીચે, રવાના થાઓ !” પણ ના તવંગરોને સંભળાવવાની વાત નહિ, એ તો ગરીબોને સંભળાવવાનું ! એટલે શું પરિણામ ? ગરીબો પાસે શ્રીમંતોને ગાળો દેવરાવવી, ગરીબોના મનમાં ઈર્ઝા જગાવવી, દુધાન જગાવવાં... આ ધર્મ આપ્યો કે કષાયો ? આ બધું મોત આપ્યું કે જીવન ? માટે કોઈને સલાહ આપતાં જોવું જોઈએ કે ‘હું સજ્ઞાન હું કે અજ્ઞાન ?’ સલાહ આપવા નીકળી પડનારને એ જ્ઞાન ન હોય કે “સામા આત્માનું હિતાહિત શામાં ? મારી વાણીથી એ હિત મેળવશે ?...” અને એમને એમજ ગોળા ગબડાવે તો અજ્ઞાની ગણાય. સજ્ઞાન એ જે બીજાને જીવનરૂપ બને; કેમકે એ હિતનું બોલશે. તેવી રીતે, દેવ જો મહાજ્ઞાની હતા તો જગત માટે જીવનરૂપ બન્યા. આ ખરો અર્થ છે. પણ લુચ્યાઓએ સૂત્ર બનાવી દીધું. ‘એક જીવ એ બીજા જીવનું જીવન-શિકાર !’ હુનિયામાં બળિયાના બે ભાગ ચાલે છે. જરૂર બીજા પર શિરજોરી કરવાનું મન થાય; સ્વાર્થ લૂંટવાનું મન થાય ! “આપણે શેઠ છીએ, સામો નોકર છે ને ?” બસ ! આપણી બાયડી માંદી હોય તો આપણે એની પાસે રહીએ. પણ નોકરની બાયડી માંદી હોય તોય એણે એને પડતી મૂકી દુકાને આવવું જોઈએ. હુનિયામાં આવા નાટક દેખાય છે, ‘મારે તેની તલવાર !’ અમારે તો આ જોઈએ છે કે બળ છે છીતાં પોતાના સ્વાર્થ લૂંટવાવાની વાત ! પણ બીજાનાં સ્વાર્થ લૂંટવાની વાત નહિ; આ શાસનનો માર્ગ છે. લોકનો માર્ગ પેલો છે.

રાજી વિચારે છે, “શું દેખાય છે આ હુનિયામાં ? એક બીજાને ગળી રહ્યા છે ! મિલનો સાત રૂપિયાનો કારકૂન ઘેર બાયડી પર છસ્સો રાખે છે ! ને બાયડી છોકરા પર છસ્સો રાખે છે ! છોકરો નાના ભાઈ પર છસ્સો રાખે છે !

કારકૂન પર એનો અમલદાર રોઝ ચલાવે છે, ને અમલદાર પર મિલનો માલિક રોઝ ચલાવે છે ! સિંહરાજી વિચારે છે -આવી હુનિયાના પદાર્થ પાછળ લંપટ બનવું, જુભ બહાર કાઢી લાળ પાડતાં ચાલવું, તે તો મહામોહનું કારણ છે.

પેલો મોટો અજગર એમ માનતો હતો કે ‘મને કોઈ ગળનાર નથી.’ પણ એનેય ગળનાર જમરાજ બેઠો છે ‘કાણવારમાં તે આવીને ગમે તેવી તારી ભીષણ કાયામાંથી પણ તને બહાર ફેંકી દેશે.’ દુનિયાના પદાર્થ પાછળ ઘેલા થવું, એની પાછળ દોટ મૂકવી-તે તો મહામોહનો કિસ્સો છે. રાજા શું તારવણી કાઢે છે? “નબળા પર સબળાની શિરજોરી છે, માટે ઈન્દ્રિયોના વિષય સુખોમાં રાચવું નહિ.” તો પ્રશ્ન થાય કે,

પ્ર.- સબળાની શિરજોરી અને ઈન્દ્રિયોના વિષયો વચ્ચે શું સાંકળ છે, કે શિરજોરી છે માટે વિષયો ત્યજવા?

ઉ.- રાજાની તારવણી બરાબર છે. જુઓ-આ જીવને જે ઈન્દ્રિયના વિષયોની લંપટતા ગમે છે, તે વિષયો શું એમને એમ મળી જવાના? શું આંગણામાં કલ્યવૃક્ષ ઉંઘું છે, કે એને કહી દો ‘આપી દેઝે મખમલની શૈય્યા, ગાંધર્વના સંગીત, અને ઘેબરનાં ભોજન’ એટલે ટપ એ બધું હાજર થાય? ના, તો તે લેવા માટે દુનિયામાં જવું પડશે. જ્યારે દુનિયામાં તો પેલું નાટક ચાલી રહ્યું છે-સબળાની નબળા પર શિરજોરી! જેનું બળ તેની લૂંટણગીરી! ત્યાં આપણે આપણું મનગમતું લેવા જવાનું કે એના શિકાર બનવા જવાનું? ધરાકને વિશ્વાસમાં રાખી વેપારી એકના દોઢ લઈને ય બેળસેળ આપવાની શિરજોરી કરે છે. વસ્તુ લઈને ઘરે આવ્યા, છોકરાની નજર પડી ગઈ, માગે છે. હવે તમે શિરજોરી કરવાના! શિરજોરી શા માટે થઈ રહી છે? જગતના પદાર્થો માટે. જે જગતમાં પદાર્થો માટે એકબીજાને ગળવાનો ધંધો કરી રહ્યા છે, તેવા પદાર્થો આપણે જગત પાસે લેવા જવાનું, એટલે? એના શિકાર જ બનવાનું ને? અને આપણે જો બુણિયા છીએ તો બીજાને શિકાર બનાવવાના ને? આ બે સિવાય ત્રીજુ કાર્ય નથી. બીજાનો શિકાર કરો એટલે જંગલી પણ જેવા, અને બીજાના શિકાર થાઓ એટલે મોટી શોક-પોક મૂકતા ઉંદર જેવા! ઈન્દ્રિયોને ગમતા જગતના પદાર્થો પાછળ આ બેમાંથી જ ગમે તે સ્થિતિ ને?

પાપની દુનિયામાંથી જિની દુનિયામાં :- દુનિયા પરથી આસ્થા ઉઠાડી લેવાનો આ એક જબરદસ્ત કિભિયો છે, રાજાની આસ્થા ઉઠી ગઈ. “મારે સર્યુ આ રાજ્યથી, જોઈએ નહિ રાજ.” આવ્યો છે શરૂને દબાવવા. સામગ્રી અને સત્તાવાળો છે. એવી અનુકૂળતામાંય એણે પૂર્વ વિચારણાથી સાર એ કાઢ્યો કે “જે મોટું રાજ્ય પણ અનેક દુઃખરૂપી ફળોને આપનારા ઝડનું બીજ છે; અને જે અધમ પુરુષાર્થના વિકાર જેવું છે, એવા રાજ્યનો મારે ખપ નથી.” યોગ્ય સાર બેંચ્યો છે. રાજ્ય એટલે બળ, સત્તા અને એના પર શિરજોરી. આ સંબંધમાં માર્ગ પર જોયેલા

એક દશ્ય પરથી આ સાર કાઢ્યો! જો દુનિયામાં બહુધા જ આ ન્યાયનું ચલાણ છે-બળ પર શિરજોરી-ચૂસણી; તો વિષયોની ઘેલણાથી દુનિયાની ચક્કામાં ફસાનું તે મહામોહનું કારણ છે. કેમ? સામે બીજું દેવાધિદેવનું જગત ઊસું છે. જેમાં દુનિયા કરતાં જુદ્યો જ ન્યાય છે! બળ પર શિરજોરી નહિ પણ લધુતા ને નમ્રભાવ! મહાવીરભગવાને એ જ કર્યું હતું. ગોવાળિયો પગ વચ્ચે અનિન્દ્ય સણગાવી ખીર રાંધવા આવ્યો; તો? ભલે! “બાળ પગ” શું ભગવાન પાસે બળ નથી? બળ તો અંગુઠો અડાઈને મેરુને નચાવવાનું હતું. પણ બળ પર શિરજોરીનો રાહ તો પાપી દુનિયા પકડે, જિની દુનિયા નહિ. સંસાર પ્રવાસી પકડે, મોકણો મુસાફર નહિ. જેને દુગ્ધિતિની મુસાફરી ખપે, તેને પોતાના બળ પર શિરજોરી સૂઝે. પણ જેને મોકણો રાહ ખપે છે તેને તો સ્વકીય બળ પર વધુ નમતા-લધુતા ખપે છે. એ ભગવાને સ્વયં સાધ્યું, ને જગત પાસે સધાયું! “બળ છે તો વધુ કોધી ન થાઓ, વધુ ક્ષમાશીલ બનો. પૈસા છે તો વધુ લોભિયા ન થાઓ, વધુ દાનેશ્વરી, વધુ ત્યાગી બનો.” તાકાત પર નમ્રભાવ અને પરમાર્થવૃત્તિ-દાખવવાનું જૈનશાસનનું જગત સૂચવે છે. તમે જો સારી શારીરિક શક્તિવાળા છો, સારી માનસિક શક્તિવાળા એટલે કે બુદ્ધિમાન છો, તો નાનામાં નાના એકન્દ્રિયાદિ જીવ પર પણ શિરજોરી કરનારા નહિ, કિન્તુ અભ્યદાન દેનારા થાઓ, તેથી જ સમજો કે જૈનશાસને ચારિત્રનો માર્ગ કેમ સૂચવ્યો? આ જગતના શિરજોરીના મારક રાહથી ઊલટો સ્વાત્મ-નિયંત્રણનો તારક રાહ લેવા માટે. તમારે બીજાને અભ્ય આપવાનું; પણ એના પ્રાણ નહિ લૂંટવાના.

રાજ્ય એટલે :- રાજા અંતિમ નિર્ધાર પોતાના હદ્યમાં કરે છે,

(૧) “હવે મારે રાજ્ય ખપે નહિ. કેમ? અનેક દુઃખના બીજભૂત અને અધમ પુરુષાર્થી જન્મેલું અને અધમપુરુષાર્થ કરાવનારું એ છે.”

(૨) “રાજ્ય? રાજ્ય એટલે જેને દુઃખે કરીને પૂરી શક્ય તેવું જાણે પાતાળ ! પાતાળને કોઈ પૂરવા જાય તો પૂરાય? તેમ રાજ્યની લાલસા પૂરાય એમ નથી. આ તો મિયા મસાલા વિના અટક્યા છે! કોઈ મૂડી આપીને કહે, ‘લગાવ સોદો!’ તો જીવ જાત્યો રહે? લક્ષ્મી શું કે વિષયો શું, તેની લાલસા પાતાળ જેવી છે. અથવા રાજ્ય એ બીજી કેટલીય વસ્તુ માગે છે, જેની પૂર્તિ કરવી કઠીન. એ હિસાબે પણ રાજ્ય પાતાળ જેવું કહેવાય. માટે નચિત બેસવા જેવું નથી.”

(૩) “રાજ્ય પાછું ખંડિયેર મકાન જેવું છે.” એમાં બીલ, બાકોરા, અને બખોલા વગેરેને ભારે અવકાશ છે. એમાં દુર્જનોને પેસી જવા માટે બહુ સંભવ;

વિકારોને દાખલ થવાની તક ઘણી; સાપ ને ઉંદર જેવા કેઈ દોષોને ઘૂસીને સ્થિરવાસ કરવા માટે પણ ઘણા પ્રસંગ મળે. કેવી સરસ ઉપમા ! રાજ્ય અને લક્ષ્મી એ સહ્યું- પરંચું ધર ! વિચારજો કે મમતા-ઈર્ષા-કોધ-અભિમાન વગેરે દોષો શાના પર છે ? જે લાંબી કે ટૂંકી લક્ષ્મીટેવી પાસે બેઠી છે, તેના પર. સાધુ મહારાજ પાસે આ નથી; તો તેને આ દોષો સેવવાના નથી ! વળી,

(૪) “રાજ્ય એ દુષ્ટની સંગત જેવું છે. દુષ્ટની સંગતમાં પરિણામે ગાંઠનું ખોવાનું, ને રોવાનું ! જેની સમાપ્તિ વિરસ હોય. રાજ્ય પાછળ પુષ્ય ખોવાનું, દુર્ગતિમાં રોવાનું.”

(૫) “વળી, આ રાજ્ય વેશ્યાના હૃદય જેવું છે, વેશ્યાનું હૃદય કેવું હોય ? ‘પૈસા લાવ !’ ઇ ઊગે ને ‘પૈસા લાવ ! જો ન હોય તો ઊતરો નીચે.’ બસ, રાજ્ય પણ તેવું જ કહે છે. “ભંડારો ભર !” પણ ક્યાંથી લાવું ? ‘ગમે તે કૂડકપટ અને જુલમ કરીને પણ ભર ! પુષ્ય ખૂટે ઊતર નીચે.’ વેશ્યાના હૃદય જેવું એટલે ? ખોટી મોહિનીમાં ઘસડનાનું. રાજ્ય એવું છે. અરે એક ધર-કુંદેભનું રાજ્ય પણ એવું. સદા માગવાનું ચાલુ. વિચારો, તમારો સંસાર કંઈ માગે ખરો ? હા, તાંબાની તોલકી તેર વાના માગો ! એક તાંબડી માટે તાવેથો ને કડણી, ચૂલો ને હોલો. એવું તો કેટલુંય !

(૬) “રાજ્ય એ તો મોટો રાફડો છે. કેમકે એમાં ઘણા ભુજંગો રહે છે. દાવપેચ ખેલનારા ભુજંગો સમાન છે. ને રાજ્યખટપટમાં દાવપેચની ખાણ હોય છે.”

(૭) “અરે ! રાજ્ય એટલે કદ્દિય કાર્યો પૂરા જ ન થાય એવી જિંદગી જોઈ લ્યો ! અરે ! ચાલુ જિંદગીમાં ય કાર્ય પૂર્ણ થતા નથી; તો રાજ્ય જીવનની વાતેય શી ? દુન્યવી જીવનમાં કાર્યોની ક્યાંય સમાપ્તિ થઈ હોય તેવું દેખ્યું ? ઘણા માણસોના તમે જીવન જુઓ છો. શું તેમાં એ જોયું ખરું કે આને ખાવાનું, આને ઊંઘવાનું, આને પૈસા કમાવાનું, કુંટબ સંભાળવાનું કાર્ય પૂરું થઈ ગયું ? ના, સંસાર એટલે હંમેશાં કાર્યની અપૂર્ણતા ! સદા કાર્ય જ્યાં અપૂર્ણ જ ઊભાં રહે તે સંસાર ! ને સર્વ કાર્યો જ્યાં પતી ગયાં હોય તે મોક્ષ ! જેને મજૂર રહેવું ગમતું હોય તેને માટે બધાં કાર્ય ઊભા રહે તે સારું; જેથી મજૂરી કર્યા જ કરે. જીવ એટલે સંસારનો મજૂર ! કંઈ ને કંઈ કર્યા જ કરે. કહે છે ને સર્દિનો દિકરો, જીવે ત્યાં સુધી સીવે.”

(૮) “અરે, રાજ્ય તો સાપનો કરંદિયો છે ! તે કરંદિયો રાખવો હોય તો સાવચેતી જોઈએ. સાપના કરંદિયાનું ઢાંકણ જરાક ગફલતથી ખુલ્લું થઈ ગયું તો ખલાસ ! એવું રાજ્ય ! ક્યાંક જો છિદ્ર પડે તો એમાંથી અનર્થો મહાન જન્મે !

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદેશ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૧૭૮

ક્યાંય એના પર વિશ્વાસ કરાય નહિ. નચિતતાનું નામ નહિ ! રાજ્ય હોય ને નચિતપણે સૂર્ય શકીએ, તેવું બની શકે નહિ. રાગીને-ભોગીને, સંગ્રહીને નચિતતા ન હોય. એ તો ત્યાગ-વૈરાગ્યની વાતો ભણાવનાર જૈનશાસનમાં જ નચિતતાના પાઠ મળી શકે. નિશ્ચિન્તા વિરાગીને ત્યાગીને, નિસ્પૂહીને.”

(૯) “વળી રાજ્ય વેશ્યાના યૌવન જેવું છે. યૌવનવાળી વેશ્યાને રસ્તા પર જતી જોઈ કેટલાકો તેના પર નજર નાખી, તેની ઈચ્છા કરે છે ! તેમ કેટલાય લોકો રાજ્યને જોઈને ઈચ્છા કરે છે કે ‘અમને રાજ્ય મલે !’ પરંતુ જેમ વેશ્યાના યૌવનમાં ફસાયેલો સર્વસ્વ ગુમાવી દે છે, તેમ રાજ્યસત્તામાં ફસાયેલો સર્વથા નાશ પામે છે. ઉપરાંત”

(૧૦) “રાજ્ય એ, જેને શુદ્ધપરલોક સાધવો છે તેને માટે બિનજરૂરી, ને ઊલટ શુંખલા સમાન છે. રાજ્ય એ પરલોકના કલ્યાણનું સાધન નથી. શુદ્ધપરલોકનો માર્ગ નથી. માટે એને છોડી, આલોક-પરલોકને સુખકારી અને ધીર જનોએ અપનાવેલા ચારિત્રમાર્ગને જ અપનાવી લઉં !”

ચઢાઈ કે ચારિત્ર ? :- રાજીની ધર્મજાગરિકા કેવી છે ? માણસ સમજુ ત્યારે કહેવાય કે જે પ્રસંગ સામે આવ્યો હોય, તેને મનમાં તત્વદિષ્ટી પલોટાવે. તમેય જગતમાં કોક પ્રસંગ જોયા તો હશે જ, તો તમને કોઈ ઇ’ વિચાર આવે છે કે ‘આ સંસાર એટલે સાપનો રાફડો ! વેશ્યાનું યૌવન ! વેશ્યાનું હૃદય ! કાર્યની સમાપ્તિ કદીય ન થાય તેવા જીવનોની ધારા ! દુષ્ટની સંગત !’ હજારો દિવસ વીતી ગયા જીવનના, ઇતાં આવો વિચાર નથી ! જ્યારે શાસ્ત્રે તો શ્રાવકને માટે નિરંતર ધર્મજાગરિકાનું વિધાન કરેલું છે ! કેમકે આ કર્યે રાખે તો કોઈ ઇ’ જીવ ઊંચો આવી શકે. રાજીએ નક્કી કર્યું કે “ચારિત્ર લઈ લઉં.” “માટે હવે-અહીંથી ચાલ્યા જવું-પરંતુ જે કાર્ય માટે આવ્યો છું, તે કર્યા વિના જાઉં તો લઘુતા ન થાય ?...” આ વિચાર આવતાં જ, સામે પ્રતિપક્ષી વિચાર તત્વમાં ઝીલતા મનમાં તૈયાર જ હતો... “લઘુતા થશે. આ વાત જ તુચ્છ છે. કેમકે એ માત્ર એક જીવની નાની વાત છે. બાકી પરલોકનું એ આપણું શું બગાડી દે છે ? અને વિજય મેળવી લઈએ તો આત્માનું શું સુધારી નાખે છે ? ત્યારે ચારિત્રની વાત અનેક જન્મો સાથે સંગત છે; ભાવી દીંદ્રકાળને સુધારી દે છે.” આ પ્રમાણે વિચારણા કરતાં રાત્રિ પસાર થઈ ગઈ. સવાર પડ્યું અને આવશ્યકૃત્ય કરી લીધું. ત્યાં મન્ત્રીઓનું મંડળ આવી પહોંચ્યું. સંસારમાં ‘મત્ત્યગલાગલ’ ન્યાય જોઈને સિંહરાજાનો વૈરાગ્ય એટલો બધો વધી ગયો કે જે દુશ્મન પર ચઢાઈ કરીને તે ગયા હતા. તે દુશ્મનને પરાજ્ય પમાડવાની વસ્તુ હવે મનમાંથી કાઢી નાખી. ત્યારે ઉત્કૃષ્ટ વૈરાગ્ય વિના, દુન્યવી

૧૮૦ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“સિંહરાજાની મનનીય વિચારણા” (ભાગ-૨૨)

રાગ એવી ચીજ છે કે ઈણી આશામાં તો શું, નિરાશામાંય ભારે ધાંધલ કરાવે ! અહીંયાં રાજ બલવાન છે-શત્રુને જીતી શકે એમ છે. હવે ન લડે તો લોકમાં આબરૂ જ્યા એમ લાગે છે. છતાં એક વૈરાગ્યે દિલ ફેરવી નાખ્યું.

દુર્મતિ વશ આવે છે :- રાજ પાસે મંત્રીમંડળ આવ્યું-તેની આગળ લડાઈ પડતી મુકવા વગેરેની પોતાની વાત મૂકે તે પૂર્વે જ સદ્ગ્રાહ્યની બલિહારી જુઓ કે એ કેવોક વિજણી જબૂકો કરી જ્યા છે ! દ્વારપાલિકા આવીને ખરબ આપે છે “મહારાજ ! પેલો દુશ્મન દુર્મતિરાજ આપશ્રીને સ્વયં યુદ્ધ માટે નીકળેલા જાણીને અને આપશ્રીની શિક્ષા કેવી ભયંકર કોટિની હોય છે તે વાતને બરાબર સમજ્ઞને, આપશ્રીના શાસનનું ઉલ્લંઘન કરવા બદલ ધણો પસ્તાવો કરતો, પોતાનો બધો મદ ત્યજી દઈને હવે કોઈ પણ રીતે આપની પાસે રક્ષણ મેળવવા પોતાના ગળે ફરસી (કુહાડો) બાંધીને કેટલાક પુરુષોના પરિવાર સાથે આવી ગયો છે, અને મહારાજના દર્શન કરવાનો અભિલાષી તે પહેરગીરની જગાએ ઉભો છે. હવે આપ જે આજ્ઞા કરો તે પ્રમાણા.” કહો જો આમાં માણસનું ધાર્યું શું થાય છે ? અધીરો માણસ ધમાધમ કરવા જ્યા કે “અરે, ભાઈ ચારિત્ર તો લેવું છે, પણ આ જે માટે આવ્યા છીએ તે તો પતાવી લ્યો...” આમ કરી ધમાલ કરે, પણ ઉલટું એવુંય બને કે સામેથી પ્રત્યાઘાત પડતાં “અરેરે મેં ક્યાં આ ધમાલ કરી !” એમ પસ્તાવો કરવાનો વખત આવે ત્યાં અણધાર્યું ઉંઘું થયું કહેવાય. અહીં પ્રયત્ન નહિ છતાં અણધાર્યું સારું-સવળું બની આવે છે.

ખુદ દુર્મતિ રાજ સામે ચાલીને આવે છે. સિંહરાજએ મતિસાગર મંત્રીની સામે જોયું. કુશળમંત્રીએ રાજનો અભિપ્રાય જાણી લીધો; ને કહ્યું- “એને પ્રવેશ કરાવો. ભલે આવે, શું વાંધો છે ? કેમકે રાજાઓ તો શરણાગતવત્તસ્લ જ હોય છે.” રોફ કે અભિમાન કરતો હોય તો જરા ચિમકી બતાવી દે એ જુદી વાત; પરંતુ જ્યાં પગે પડતો આવે ત્યાં તો પ્રેમ જ વરસાવનાર હોય છે. રાજાએ અનુઝા આપી. દ્વારપાલે દુર્મતિને પ્રવેશ કરાવ્યો. દુર્મતિએ આવીને સિંહરાજને “દેવ આ કુહાડો અને આ મારુ ગળું;” એમ કહીને ચરણમાં પડ્યો.

● સાચી મોટાઈના ઉપાય ●

પૂર્વના રાજાએ એટલે માત્ર જમીનના ટૂકડાના બાદશાહ નહિ; મનના પણ બાદશાહ; અર્થાત્ બાદશાહી મનવાળા ! ભયંકર દુશ્મન પણ સુધ્યર્યા પછી મોટા મનથી એને ગુનાની ક્ષમા આપી દે ! તેવી ક્ષમા આપવાની તૈયારી ન હોય તો મોટાઈ ન ટકે ! પણ એ સાચી મોટાઈનું ભાન હોય ત્યારે. જ્યારે નકલી મોટાઈમાં

તો નાના પર જોહુકમી કરવાનું આવડે. ગુનેગાર પસ્તાવો કરે તોય ખૂનસથી એને કચડી નાખવાનું આવડે. બસ, કેમ મારી સામે બળવો ? ઉદ્ધત... નકલી મોટા બળ-શક્તિનો શું ઉપયોગ ? શિરજોરી કરવાનો ! દંડાબાજ કરવી હોય તો તૈયાર ! મોટો કોળિયો પોતાને ભરવો હોય તો તૈયાર ! સાચી મોટાઈવાળાને તો પોતાનો કોળિયો નાનો હોય, અને નાનાને મોટો કોળિયો ભરવે ! નાનાને સુખસગવડ આપે, પોતે કષ્ટ અગવડ ભોગવે. નાનો ચડભાડે તેમ મોટાથી ચડભડાટ ન કરાયતો મોટાઈ આવે. જાણો છો ને ? કે એના બદલે મોટા છો માટે આંખની ક્રીકી ભમરે ચઢી જ્યા છે ?... ભારે શબ્દો મોંમાથી નીકળે છે ?... રોફ ને રૂવાબ ચાલે છે ? શું શું ? આ ન ચાલે મોટાઈમાં. મોટાઈની પાછળ ઘણી ૧ ઉદારતા, ૨ વિશાળતા, તુ ગંભીરતા અને ૪ મધુરતા જોઈએ. આ ગુણો ખુબ જરૂરી છે.

૧. ઉદારતા :- મોટાઈ ગુણની જોઈતી હોય તો પહેલા નંબરમાં ઉદારતા કેળવો. શું ઉદારતા એટલે ? મારું જે બધું દેખાય છે, તે મારું નહિ પણ મારા સંઘનું, મારા આશ્રિતોનું, મારા જ્ઞાતિબંધુઓનું...શું સમજ્યા ? ઉદારતા માટે પરની વસ્તુમાં પોતાનું સ્વત્વ નહિ લઈ જવાય, પણ પોતાની ગણાતી વસ્તુઓમાંથી ય સ્વત્વની ભાવના ઉઠાવી લઈ એમાં પરક્યેત્વની ભાવના જમાવવી જોઈશે, જો પોતે વડેરો છે. તો એનો અર્થ એ છે કે એ સગવડો નાનાદિયાઓ ભોગવે અને પોતે તો ખૂબ સાદાઈમાં રહે; અવસરે અગવડ પોતે વેઠી લે. એમ જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં પોતે બીજાની સેવામાં પોતાના ધનની, મનની, બુદ્ધિની, કાચિક શ્રમની, સમયની વગેરેની ઉદારતા કર્યે જવાની. એવું જ એ કે કોઈએ પોતાનું બગાડ્યું છે, પણ એ આજે પશ્ચાત્તાપ કરે છે તો એનો પૂર્વનો ગુનો જાણે બન્યો જ નથી એ રીતે પોતાના મનમાંથી એ કાઢી નાખવાનો. મન એટલું બધું સહિષ્ણુ અને ક્ષમાશીલ, તેમજ દાનવીર કે એજ ગુનેગારને ગુનાની માફી ઉપરાંત હીનામ આપે, દિલ ઉંખીલું ન હોય તો જ આ બની શકે. અહીં સિંહરાજ એવી ઉદારતા બતાવે છે. તો એમનામાં મોટાઈ છે. હજુ આગળ પર પુત્ર આનંદ પ્રત્યે મોટી ઉદારતા બતાવશે. એવી કે પુત્ર દુર્જનતા દાખવતો છતાં એને રાજ્ય પ્રદાન ! ઉદારતામાં એમ માને છે કે પોતે તો માત્ર કષ્ટનો અધિકાર ! એ ઉદારતા આપણા માટે મહાન આદર્શરૂપ છે.

૨. વિશાળતા :- હૃદયની વિશાળતા એટલે એવું મોટું મન કે એમાં બધાની ભૂલો સમાઈ જ્યા. વિશાળ સાગરમાં બધું સમાઈ જ્યા, તેમ તેના વિશાળ હૈયામાં બીજાની બધી ત્રુટિઓ સમાઈ જ્યા ! સમાય એટલે ? બીજાની ભૂલો શોધી-શોધીને દિલમાં ધારી રાખે એમ નહિ પણ ભૂલનું સહજ પિંજણ ન કરે, પણ એ ભૂલોને

વિસ્મૃતિના, ઉપેક્ષાના ભૂગર્ભમાં સમાવી છે. દિલ જો વિશાળ નથી તો એ યાદ લાવ્યા કરે છે, વિશાળ દિલ ઉપેક્ષા કરે છે- “હોય ! બાળક છે. ભૂલ થઈ જાય. મેંય કેટલીય ભૂલો કરી છે.” સામો જુવાન કે વૃદ્ધ હોય તો વિચારે, “હોય ! જુવાનીનું જોર છે... અજ્ઞાન છે.” આનો અર્થ એ નથી કે અવસરે ભૂલ પર ડિતશિક્ષા ન આપે. આપે, પણ પહેલાં વિશાળતા ધરીને પછી કહે. હેઠું એટલું બધું પહોંચું હોય કે એમાં સામાની અનેકાનેક ઉજજવલ બાજુઓ અને પ્રેમપાત્રતા રમ્યા કરે. આવા વિશાળતા ગુણવાળા નાની ઊરના પણ મોટા છે ! આવા ગુણ વિનાના મોટા પણ નાના છે ! ત્યારે એ પણ જો જો કે આવી વિશાળતાનો આનંદ ઓર છે ! પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેય સ્થિતિમાં આનંદ જ છે ! પરોક્ષમાં એટલે પરલોક માટે અહીં કર્મના લેપ નહિ લાગવાના. તેનો અપૂર્વ લાભ ! અને પ્રત્યક્ષમાં અના મનમાં એવી ચિંતાઓ જ નહિ રહેવાની ! “આડો આવું કર્યું...તેવું કર્યું...” એવું કાંઈ નહિ. એ તો છીછકું હૃદય વિચારે છે કે “ઘરના કેવા માણસો છે બધા... આપણું કોઈ સાંભળે જ નહિ...આવા સાથે ક્યાં ફસાઈ મર્યા...” છીછરા વિચારમાં રમતા રહેવાથી નુકશાની કેવી, કે સોનાનું ખાય પણ કથીરનું પરિણમાવે ! એટલે કે ખાવા-પીવાનું રુંકુરુપાળું, પણ એમાં આનંદ કે અનાથી પુષ્ટિ નહિ. વિશાળતાવાળો તો સૂકા રોટલા પર અલમસ્ત રહેશે ! શું કામ બળે ? ત્યાં છીછરો પૂછે છે “ત્યારે શું બધી ભૂલો સહી લેવાની ?”

વિશાળ દિલવાળો કહે છે, “હા, દુનિયામાં એક જીવ તો શું, એક ચીજ પણ એવી નથી કે જેમાં ભૂલ ન હોય ! અને બધું કાંઈ ને કાંઈ વાંધાભર્યુ છે પછી હાથ જોડીને બેસી રહેજે. કેમકે તું ખાવા બેસે છે... તે ભોજન શામાંથી બન્યા ? ઘઉં વનસ્પતિમાંથી. તે ઘઉં વગેરેમાં કયા પુદ્ગલ ભજ્યા ? ખાતરનાય ખરાને ? તે ખાતર કેવું ?...” આ ઉપર એક રમૂજ દાંત છે.

• શૌચવાદી બ્રાહ્મણનું દ્રષ્ટાન્ત •

શુચિવોદ નામે એક શૌચવાદી બ્રાહ્મણ હતો. ચંડાળ પાસે એના પૈસા લેણા હતા; તે એક દિવસ ચંડાળ પૈસા લઈને આવ્યો. બ્રાહ્મણને જે એ પૈસા ધોવરાવવા કરવાની વિધિ કરવી હતી તે કર્યા પહેલાં જ ચંડાળે પૈસા બ્રાહ્મણના ઘરમાં ફેંક્યા. ત્યાં જ બ્રાહ્મણભાઈ બરાડી ઉઠ્યા !

“અરે નાલાયાક ! તેં આ શું કર્યું ? માણું આખું ઘર અભડાવી નાંખ્યું ? જુલમ જુલમ !...”

“અરે શેઠજી, પણ મેં શું કર્યું ?” ચંડાળ બિચારો ઠરી ગયો !

“શું, શું કર્યું ? પૈસા પાણીમાં ધોઈને લેવાના હતા, તે એમજ તારાથી અભડાયેલા ફેંક્યા ?”

“શેઠજી, માફ કરજો, એમ તો એ પાણી પણ ક્યાં ચોક્કું ? એને પણ અમારા જેવા દૂર નદીમાં અડેલા તો ખરા જ ને ?”

“બેસ, બેસ, ઉલ્લુ ! પાછો ઉપરથી દોઢ ડહાપણ કરે છે. હટ, ચાલ્યો જા આહાંથી.”

ચંડાળ તો ગયો. પરંતુ ચંડાળના શબ્દોએ વિપ્રના દિલમાં ચોંટ લગાડી. “હા, એની વાત તો બરાબર છે ! આ હિસાબે તો બધું જ મેલું ! તો તો ચંડાળથી વસેલી આ પૃથ્વી પર પણ ન રહેવાય ! બધું અભડાયેલું ! બસ, તો આપણો એવી ભૂમિ પર ચાલો કે જ્યાં આવા માનવ પશુઓ ન હોય. અહીં તો ધરતી પણ ક્યાં ચોકણી ? એના પર પણ ભંગી ચાલે, ને હુંય ચાલું !... છી... છી... છી... બસ હવે હરામ આ ધરતી.”

બ્રાહ્મણ ત્યાંથી નીકળી ગયો. દરિયા કિનારે પહોંચ્યો. ભૂખ્યો ને ભૂખ્યો હો. વહાણમાં બેસી ગયો. સમુદ્રની વચ્ચે એક નિર્જન બેટ આવ્યો. વહાણવાળાને કહે “મને ઉતાર અહીં,” એય વિસ્મય પાય્યો. પણ વહાણ થોભાવ્યુ. ત્યાં બ્રાહ્મણ ઊતરી ગયો. ઊતર્યા બરાબર કપડાં બદલી લીધાં, ને જૂનાં કપડાં દરિયામાં ફેંકી દીધાં. પછી ખુશ થાય છે “હાશ ! હવે બરાબર શૌચ પળાશો. શાસ્ત્રે સાફ સાફ લખ્યું છે કે જરાયે અપવિત્રતા ન રખાય ! અને બહારનું મેલું તો અંદર મેલું કેમ ન બને ?” શું થયું છે આને ? પવિત્રતાની લગની લાગી ગઈ છે ! ચાલ્યો દીપ પર આગળ. સમય ઘણો થઈ ગયો છે. કક્કિને ભૂખ લાગી છે. શું ખાવું ? ત્યાં ફળનું ઝાડ જોયું ‘ઓહો !’ આ ઝાડ પર ફળ છે ખરાં. અરે, પણ એના પર તો પંખી અડ્યાં હોય... અશોચ્યવાળી ચાંચો અડાડી હોય... આ તો કામ ન લાગે !’ એમ કરી ચાલ્યો આગળ. ‘ભૂખ તો ભૂખ; પણ મેલું કેમ ખવાય ?’ એ લગનીમાં ભૂખ્યો મરવા તૈયાર. રાત્રે ન ખવાય; માટે ભૂખ્યા રહો ? પેલાએ દૂર જમીનના ભાગ પર કંઈક પડેલું જોયું... “હા, આ બરાબર ! સુંદર ઝાડ મૂકીને પંખી જમીન પર આવે નહિ. પણ જમીન પર ચાલે ખરા, પણ અહીં પણ દેખાતા નથી. માટે આ પહેલાં તદ્દન ચોક્કા ફળ ખાઈને પેટ ભરશું ! અને ઊંડી વાવડીનાં પણી પીશું ! બસ, પછી પવિત્રતાને આંચ નહિ આવે !” એમ કરી એ જમીન પર પેલે ગોળવા ખાવા માંડ્યાં. દિવસ પર દિવસ આનંદમાં જવા માંડ્યા. ત્યાં તો દીપની અંદરમાંથી એક વાર એક બીજો માણસ ભેટી ગયો. એટલે આ બ્રાહ્મણ પૂછે છે, “કેમ ભાઈ, કોણ છો ?”

“હું પરદેશી છું. મારું વહાણ ભાંગી ગયું છે, તેથી ફરું છું; પણ તમે કોણ છો ?”

“હું ? હું બ્રાહ્મણ છું, શૌચધર્મને પાળવા અહીં આવ્યો છું !...”

“તે તમારા દેશમાં શૌચધર્મ નહોતો પણાતો ?”

“ના, ભાઈ ! આ જુઓને, જ્યાં જોઈએ ત્યાં અપવિત્રતા છે ! નદી-તળાવનાં પાણી ચંડાળથી અભાયેલ. જે ધરતી પર વળી, ભંગિયા ચાલે તે ધરતી પર આપણે ચાલવું પડે ! ખેતરોમાં અનાજ મેલા ખાતરથી પાકે ! પૈસાય ચંડાળના અદેલા આપણી પાસે આવે.”

પેલાને થયું આ કોઈ પાગલનો નમુનો જ લાગે છે ! એટલે પૂછે છે-
“તો શું, તમને અહીંયાં ફાવી ગયું ?”

“હા.”

“તો અહીંયાં ખાઓ છો શું ?”

“તમે શું સમજો છો ? હું કાચો નથી, હોશિયાર છું હા ! જાડ પરનાં ફળ ખાઉં તો વળી એ પંખીના બોટેલા હોય ને ? એટલે તે હું ખાતો નથી. નીચે પેલાં જ ખાઉં છું. જુઓ આ રહ્યા !” એમ કરીને પોતાની પાસેના ગોળવા બતાવે છે.

“અરરર !... તમારું જાય ! આ ખાઓ છો ?” એમ કહેતો પેલો ખડખડાટ હસે છે !

“કેમ ભાઈ ! કેમ હસો છો ?”

“શું કહું તમને ? તમે જે ખાઓ છો, તે છે તો ગળ્યાં મીઠાંને ? વાહ ! ખબર છે ? એ તો આ દીપના ઊંડાણમાં જે ઉંટ રહે છે, તે ત્યાંની શેરરી ચાવે છે, તેના આ લીડા છે, લીડા !”

જુઓ શૌચવાદીની છીછરી વિચારણામાં થયેલી બનાવટ ! જેની દણિ ટૂંકી, અને વાતવાતમાં કચ્ચકચ-તે પ્રત્યક્ષમાં પણ સુખી નથી ! હદ્યની જ્યાં વિશાળતા નથી ત્યાં આમ બને છે. તો ત્યાં સાચી મોટાઈ નથી. વિશાળતા માટે દણિને ખૂબ વિસ્તારો; અને હદ્ય એવું પહોંચું કરો કે વાતવાતમાં કચ્ચકચ નહિ, આનંદ હોય, સંતોષ હોય.

(૩) ગંભીરતા :- ત્રીજી વસ્તુ મોટાઈ માટે હદ્યમાં ગંભીરતા જોઈએ. શું કામ કરે ગંભીરતા ? જે કંઈ બીજાનું જાણતો-કરતો હોય તે પેટની અંદરમાં પછું રહે. એનો આફરો ન ચેદે; બહાર ઊંઘળી ન આવે, જ્ઞાને બહાર ન નીકળે.

● કુમારપાલનું લશ્કર ફૂટયું ●

કુમારપાલ મહારાજને એક વાર યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો; પણ સામો એવો ચબરાક હતો કે એણે જોયું- ‘આ કુમારપાલ ગુસ્સે થઈ ગયા છે, ને લગઠિમાં એમની સામે હું ટકી શકીશ નહિ.’ તેથી એણે નીતિ અજમાવી. કુમારપાલના મોટા મંત્રી સેનાપતિ વગેરેને ફોડી નાખ્યા ! આખું લશ્કર ફોડી નાંખ્યું. એ ફૂટેલું લશ્કર લઈ કુમારપાલ યુદ્ધભૂમિ પર આવ્યા; શું દાળદર ફીટે ? સંસારના સગાંઓ પણ એવા જ મોહના પક્ષમાં ફૂટેલા છે. તેથી આપણા આત્મહિતના પક્ષમાં ઊભા રહે એવા નથી. કુમારપાલને ય સૈન્ય સ્વપક્તે નથી. સામાને એમ છે કે “હું હમણાં જતી લઉં છું !” દિવસ પ્રગટ્યો કે કુમારપાલે ઓર્ડર છોડ્યો- “ચલાવો...” પણ કોણ ચલાવે ? કોઈ શસ્ત્ર જ ઊંચું કરતું નથી ! તરત સમજી ગયા કે જરૂર દાળમાં કાણું ! આજે સૈન્ય આમ શાંત કેમ ? ખુદ સેનાપતિ પણ એમ જ બેઠો છે... મહાવતને પૂછે છે-મહાવત ફૂટેલો નહોતો- કહે છે.

“મહારાજ, બધું ફૂટેલું લાગે છે !”

“તો, નહિ ફૂટેલું કોણ ?”

“આ હાથી ને હું ! આ બેથી જેટલું કરવું હોય તો કરો. આજે બીજાની આશા રાખવા જેવી નથી લાગતી.”

કુમારપાલ ગંભીર છે. લશ્કરને કે શત્રુને બીજો કોઈ ભાવ દેખાડતા નથી. અહીં ગંભીરતા ન રાખે તો મરે. મહાવતને કહે છે,

“એમ ? તો ચલાવ હાથીને.”

એકલા હાથે લડવાનું છે, પણ બહુ વિચાર કરવા ના રહ્યા, કેમકે પ્રભાવ પારી દેવો છે. હાથી કૂદ્યો. એની સામે દુશ્મને સિંહનાદ કર્યો. હાથી પાઇને પડવા માંડ્યો. કુમારપાલે સમયસૂચકતા વાપરી, મહાવતને કહું- “નાખી દે એના કાનમાં કુચા; કે એ અવાજ ન સાંભેદી.” હાથીના કાનમાં બેસ ભરાવી દીધો. હાથી એવો કૂદ્યો કે ઠેઠ દુશ્મનના જ હાથી પાસે જઈને ઊભો. કુમારપાલે એના હોદા પર કૂદીને દુશ્મનને ગળચીમાંથી જ પકડ્યો ! “બોલ, શું કહે છે ?” પેલો તો એના તરંગમાં જ હતો કે “મેં આખું લશ્કર ફોડી નાંખ્યું છે... હવે જીત થઈ સમજે...” આ તરંગમાં જ એકદમ જ કુમારપાલે આવીને પટકયો નીચે ! “બોલ, શું કહેવા માગે છે ?” પેલો કહે છે, “જીવિતદાન !” કુમારપાલે દુશ્મનને જતી લીધો, વશ કરી લીધો; અને છોડી મૂક્યો. પણ ત્યાં લશ્કરને એક અક્ષર પણ કંધો નહિ ! જિંદગી સુધી એ માટે ઠપકાનો અક્ષર ન બોલ્યા ! આપણે તે સ્થળે હોઈએ તો

મનને શું થાય ? “એવો ટોણો ઠોકી દઉં કે ખબર પડી જાય...” પરંતુ કુમારપાલની કેવી ગંભીરતા ? ક્યારેય નહિ કહેવાનું કે “સેનાપતિજી, તે દિવસ યાદ છે ને ?” યાદ જ નહિ કરવાનું ને. એ સમજે છે કે આ માણસો છે, એમના દિલમાં આપણા એકલા હાથના પરાકમથી જબ્બર છાપ તો પડી જ ગઈ છે. તેમ ભારે પશ્ચાત્તાપ મનમાં કરતા હશે. એના પર આપણો આગ વરસાવવાની જરૂર શી ? બધા જાણે છે કે કુમારપાલનું બળ જબરદસ્ત ! પુષ્ય મહાન ! કુમારપાલની આ ગંભીરતાનું પરિણામ શું થયું, ખબર છે ? સારાયે લશ્કરનું કુમારપાલ પરસ્તું બહુમાન ફૂદકે ને ભૂસકે વધી ગયું !

જો આપણા ગંભીરતા ગુણ પર આપણે સામાના હૃદયમાં આરપાર ઉત્તરી જઈએ છીએ, તો શા માટે નાહક તીક્ષ્ણ કે માર્મિક ટોણાં મારવા ? કાણવારનો આનંદ કે બીજું કંઈ ? પણ એ ખબર નથી કે એ ટોણાંઓથી સામા માણસને આપણે આપણાથી ગભરાતો-ચંપાતો કર્યો ! ને આપણા પર એનું આકર્ષણ, પ્રેમ બહુમાન ઓછું કર્યું ! સાચી મોટાઈ જોઈએ તો દિલની ગંભીરતા જોઈએ. ગંભીરતાથી બધું પચાવતાં આવડે છે. ગંભીરતાના પ્રભાવે આત્માના ઉચ્ચ ગુણો પર લક્ષ્ય ટકાવી શકાય છે. ગંભીરના અભિપ્રાયો જાણવા મુશ્કેલ હોય છે.

(૪) મધુરતા :- ઉપરોક્ત ત્રણે વાતો પર જો ચોથી વાત ન હોય તો નહિ ચાલે ! સામાની ભૂલ પચાવી ખાનાર હોય પણ સ્વભાવ કડવો હોય તો ? ના, સ્વભાવ મધુર જોઈએ. “આવો ભાઈ, તમારું જ બધું છે ! તમે નહિ વાપરો તો કોણ વાપરશો ?” આ શું છે ? મધુરતા ! પોતાની વાણી અને મુદ્રાની મધુરતા ખાસ જરૂરી છે; જો મોટાઈ જોઈતી હોય તો. મુખની મુદ્રા મીઠી દેખાડો; શબ્દો મુલાયમ વાપરો; મધુર વ્યવહાર રાખો. તે પણ જ્યારે પોતે સત્તાધીશ છે, ઉંચી પાયરી પર છે, બીજાને સંભળાવવા બેઠો છે, તે વખતે તો ખાસ મધુરતા જોઈએ. પણ તે ક્યારે બને ? હૃદયમાં સ્નેહ ભર્યો હોય તો.

સિંહરાજા પાસે દુશ્મન કહી રહ્યો છે “હું તો ગુનેગાર છું, તો આપની આગળ આ કુહાડો ને આ મારું માથું. આપ મોટા છો, આપને જે યોગ્ય લાગે તે કરો.” દુશ્મનના આ ઈકરાર પર સિંહરાજાએ ચરણમાં પડેલા તેને ઊભો કર્યો, ને કહું- “લઈ જ તારો કુહાડો-જ તને અભયદાન છે.” આતલું કહીને ઉપરથી તેનો સત્કાર કર્યો;- સેવકોને કહું- “જાઓ એમને હાથીની અંબાડી પર બેસાડી પાછા મૂકી આવો. એમની પ્રજાને લાગવું જોઈએ કે આ મોટા રાજાનો સન્માનિત છે.” રાજાની આજ્ઞા મુજબ દુર્મિતરાજાને સન્માનપૂર્વક એની રાજ્યાનીમાં મૂકવામાં આવ્યો. સિંહરાજ જ્યાપુર પાછા આવ્યા.

સિંહરાજાના વિવેકી મંત્રીઓ :- મંત્રી મંડળને ભેગું કરી, પોતાનો આંતરિક અભિપ્રાય તેને કહ્યો.

“જુઓ, આ જગતમાં એકબીજાને ગળવાનો ન્યાય ચાલી રહ્યો છે. વિષયભૂષ્યો જીવ જગત પાસે જાય, તો એ કોઈને ગળવાનો કે સ્વયં ગળવાનો. માટે એવા જગતને વિષે વિષયના પ્રસંગમાં આવવું મહામોહનનું કારણ છે, તો હું એવા જગતથી ફારગ થવા ઈચ્છું છું.”

તે સાંભળી મંત્રી વર્ગ કહે છે- “ઓહો ! આ વંશમાં જન્મેલા બીજા રાજાઓ માટે પણ જો આ કર્તવ્ય છે. તો આપના જેવા જિનવચનથી ભાવિત મતિવાળા માટે તો કર્તવ્યનું પૂછવાનું જ શું ?”

શું કહે છે ? સંસારત્યાગ એ ઉત્તમ વંશે જન્મેલા બીજાઓ માટે પણ કર્તવ્ય છે, તો જે જિનવચનથી રંગાયેલા છે, તેના માટે તો એ અવશ્ય કર્તવ્ય હોય જ. આ કહેનારા કોણ છે એય ધ્યાનમાં રાખવા જેવું છે. સુયોગ્ય માલિકનો પરિવાર પણ યોગ્ય અને શાશ્વો બની જાય છે. મંત્રીઓ કહે છે કે “આપનું જીવન સફળતાને પામેલું છે ! તે માત્ર આ લોકની દસ્તિએ નહિ, પણ ઉભય લોકની દસ્તિએ.” શું સમજીને આ કહે છે ? ગૃહવાસ દરમિયાન ઉચ્ચ સદ્યાચાર અને ધાર્મિકતાનું જીવન જીવ્યા ઉપર હવે સંસારત્યાગનું ભવ્ય જીવવાની તેયારી કરે છે એના ઉપર. ત્યાં મંત્રીઓ પોતાની જાતને વિષયના કીચડમાં ખદબદ્દી જોતાં શી રીતે સિંહરાજાને સંસારમાં રોકી શકે ? એ “રોકવામાં અમે આપને કંઈ સારું આપનાર નથી;” એમ માનનારા છે.

મહેમાનને ઘરવાળો રોકી રાખે આગ્રહથી; ને મહેમાન ન રોકાય, તો શા માટે ? રોટલો ને ભડકું ખાવા રોકાય ? તેમ મંત્રીઓ કહે છે કે “આપને રોકીને અમે આપને શું સારું આપી શકીએ ? આપ સુખમાં મહાલો એવી અમે સેવા બજાવીએ; પણ અમારી સેવામાં ય શું સાર છે ? કેમકે આ સંસારના જે વિષયો અને ભોગો છે, જે સુંદર રૂપ-રસ વગેરે અને સારી રીતે તેને ભોગવવું, ખાવું, પીવું વગેરે, તે બધા સણગતા બળતણ જેવા છે. જીવને પ્રતિસમય બાળનારા છે. કિંપાક-ફળના કડવા પરિણામે જે દુઃખ મૂત્ય, તે કરતાં પણ આ ભોગોનું ભયંકર પરિણામ આવે છે ! માટે આપનો અભિપ્રાય અમને માન્ય છે.”

હવે કહો કે- આ મંત્રીઓએ વિવેક કર્યો કે અવિવેક ? વિવેક ખાતર તો કહેવું જોઈએ ને કે “તમારે દીક્ષા લેવી છે ? ભલે લેજો, પણ થોડો સમય રોકાઈ જાઓ...” તમને કંઈ મંત્રીઓનાં દિલ ઓળખાય છે ? બધા સ્વર્ગમાંથી ઉત્તરી આવેલા નથી, આ ભૂમિ પર જ જન્મેલા છે ! રાત-દિવસ ઉપાશ્રયમાં બેસનારા

નથી, રાજકાજમાં રમનારા છે, રંગરાગ ને ભોગમાં ખેલનારા છે. છતાં અવસરે કેવા અમૃત-બોલ કાઢે છે ! તેનું કારણ જો કંઈ કહેતા હોઈએ તો, તેમને જિનવચનનું રસાયણ મળેલું છે-તે છે. સિંહરાજના મહાપવિત્ર જીવને આમના જીવનો પર છાપ પાડેલી છે. તેથી જીવન ભલે મોટા પ્રધાનનું છે; એમાં ઉપાધિઓ ય છે અને વૈભવોય છે. છતાં જિનવચનથી ભાવિત બનેલા સમજે છે, “મનુષ્યભવ જેવો ઉત્તમ ભવ, એની ઉત્તમતા શામાં ? પશુજીવનમાં આળોટવા નહિ. કોધાઈ કખાયોમાં સળગી મરવા નહિ...” આ મુદ્રાલેખો હૈયે લખાઈ ગયેલા, ત્યાં રાજ ઉઠીને માગણી કરે “હું આ સંસારથી ફારગ થવા માગું છું” તેને વધાવી કેમ ન લે ? એ તો તે અટકાવે કે જેને કખાયોની ધાંધલ અને પશુકિયા સિવાય બીજી દસ્તિ જ નથી ! આપણે હુનિયાના ડાઢા અને સમજદાર એટલે શું કરવાનું ? ચાર બચકાં, બચુકલાં અને ચાર દિવાલની કોટી સાચવવાની ! અને ચારે કખાયોની આગો સળગાવી એમાં જાતે જ બળ્યા કરવાનું ! આ મંત્રીઓ સાચા તત્ત્વના સમજદાર છે. ઊંચામાં ઊંચો સર્વવિરતિ માર્ગ અને પરમપદ મોક્ષ પમાદનાર આ માનવ જીવન ! અને જગતના જડ પદાર્થોમાં અટવાવી દેવું એ મહામૂર્ખતા છે. આ વાતને બરાબર સમજનાર મંત્રીઓ રાજાની વાત વધાવી લે છે. આપણને સ્નેહી એવા મલ્યા હોય, કે આપણી સેવા દેવની જેમ કરતા હોય, પણ તેમાં આપણું શું લીલું વળ્યું ? અરે, પાણી માગીએ છીએ ને દૂધ હાજર કરે છે ! પણ પછી...? તેથી તો જીવને કહેવું જોઈએ “મૂરખ ! વધારે ચેતતો જા ! તારું મોત થઈ રહ્યું છે. તને તે સેવાએજ સાવ ભાનભૂલો કરી દીધો છે. તારા મનમાં જમાવી દીધું કે ‘મારે બધું સરસ છે.’ કોઈ ચિંતા નથી. મારામાં કોઈ ખામી નથી !”

મંત્રીઓ કહે છે કે “દેવદાનવોને પણ જીતનારું મૃત્યુ જીવોના મનોરથોને એકાએક જ, કોઈ જાતની નોટિસ વિના ભાંગી નાખે છે. એવા મૃત્યુના વિશ્વબ્યાપી સામ્રાજ્ય નીચે રહી કોઈની ધર્મભાવનાની આડે આવવું એ કેટલું ભયંકર સાહસ છે !!”

મંત્રીઓએ રાજાની સદ્ગ્રાવનાને બહુમાની. તરત જોખીઓને તેડ્યા, કાલ કોણે દીઠી છે ?

રાજા કહે છે “આનંદ કુમારના રાજ્યાભિષેકનો દિવસ જુઓ, કે જેથી એનો રાજ્યાભિષેક કરીને હું તરત છૂટો થઈ શકું.”

જ્યોતિષીઓ કહે છે, “આજથી પાંચમો દિવસ સરસ છે.” દિવસ નક્કી થયો. અભિષેકના મંગલ દ્વર્યો તથા બીજી સામગ્રી મંગાવી રાજ્યાભિષેકની તૈયારી કરી.

રાજ વિચારે છે કે “કુમારને રાજ્યગાદી સૌંપી, હું ધર્મઘોષ ગુરુમહારાજ પાસે ચાલ્યો જઈશ.” પાંચમા દિવસની રાહ જોઈને રાજ બેઠો છે. સંસારત્યાગ વગેરે મનમાં વિચારી રહ્યો છે; ત્યાં...

પુત્રનો પિતા પર દ્રોહ :- બીજી બાજુ એજ પિતાનો પુત્ર આનંદકુમાર કે જે દુશ્મન અજિનશર્માનો જીવ છે, તેણે રાજાના અભિપ્રાયને જાણ્યો નહિ. એટલે એણે નવી રમત ચલાવવા માંડી. કોના સહારે ? પેલા દુર્મિતને સાગારિક તરીકે શોધ્યો. તેને કહ્યું કે “જુઓ, આપણને આ કંઈ પસંદ નથી. બાપુજીની બુદ્ધિ બગડી ગઈ છે; ગમે તે માયાજળ રચીને પિતાજીને પૂરા કરી દઈએ !” હજુ સુધી તો એમ સમજે છે કે ‘આ પિતા ક્યાં સુધી રાજ્ય પર ચીટકી રહેશે.’ પરંતુ આ ઘટમાળમાં તો એણે સાંભળ્યું કે “મારો રાજ્યાભિષેક થવાનો છે” તો કહો જો, હવે તો એની બુદ્ધિમાં ફેરફાર થઈ જશે ને ? ના, ઉલટો વિચાર આવે છે ! ‘ખરેખર, આવું એક ધર્તિંગ રચીને એના બહાના હેઠળ મારો બાપ મને મારી નાખવા માગે છે...’

કેમ આવા વિચારમાં ચઢ્યો ? કારણ છે, ખોટો અભિનિવેશ-દુરાગ્રહ જાણ્યો છે. પોતાના મનમાં જ પાપ પેહું છે ! વિચારે છે, “મને મારવા ધાર્યો છે... પણ હું ઠગાનાર નથી ! અને કદાચ રાજ્યાભિષેકના સમાચાર સાચાય હોય; ને મને રાજ્ય આપી દે; પણ એવા રાજ્યથી શું કે જે એ આપે ને મને મલે ? હું કાયર નથી કે એવું લઉં. હું તો ભુજાબળથી રાજ્ય લઈશ. પ્રશંસનીય તો એ કહેવાય કે હું એને મારીને બળાત્કારે રાજ લઉં !” મિથ્યા દુરાગ્રહથી અને પોતાનું ચિત્ત દુષ્ટ થવાથી આનંદકુમાર ઊંધા વિકલ્પમાં ચઢ્યો છે. રાજાને તો આના આ પાપાચરણની ગંધ સરખી નથી !

હુઃખું નિદાન :- માણસ જે હેરાન થાય છે, તે ખોટા દુરાગ્રહથી અને ખોટી કલ્પનાઓથી. નહિતર વધુ હેરાન થવાનું નથી. અહીંયાં કંઈ નરકના હુઃખો નથી કે એના પર એવી હાયવોય કરવી પડે. છતાં પોતાની જાતને શું લાગે છે ? “હેરાન થઈ ગયા... ! આ તે કેવા માણસ આપણા લમણે લાગ્યા !...” ત્યારે સમજો કે જો આપણા જીવનમાંથી ખોટા દુરાગ્રહ અને ખોટી કલ્પનાઓ કાઢી નાખીએ તો જરાયે હુઃખ કે હેરાનગતિ નથી. હુઃખનું નિદાન દુરાગ્રહ અને કુવિકલ્પો છે. મનુષ ગમે તેવો સજજન હોય પણ તેનો પૂર્વકમ્ભની સ્થિતિ પર શું અધિકાર છે ? પોતાના અને સામાના પૂર્વોપાર્જિત કર્મ જ એવાં છે, તેમ સામામાં કુસંસ્કારોનું જ જોર છે, તો પોતાની સારી ભાવના પણ સામા જીવ માટે કારગત નથી નીવડતી. તેમ પોતાની સજજનતા છતાં પોતાને વેઠવું પડે એવી ય આ જગતમાં બની આવતી હકીકત છે. પછી શા માટે હઠવાં તાણવા ? શા સારું ખોટા

વિકલ્પોથી પોતાના જ મનને બગાડવું ?

“જાઓ, કુમારને બોલાવી લાવો.” રાજાએ કુમારને બોલાવવા માણસ મોકલ્યો. પણ કુમાર આવવાની ના પાડે છે. રાજા તો સજજન છે; ઉદાર છે. એટલે કુમારના મનમાં કોઈ ઉદ્ઘેગ રહે તે ઠીક નહિ, તે ટાળવા માટે અને રાજ્યાભિષેક નક્કી કરવા સામા આવે છે. રાજાને બીજી કોઈ કલ્યના નથી કે આ કુમાર મને મારી નાંખવા સુધીના ભયંકર વિશ્વાસમાં પડ્યો છે ! એ તો વિશ્વાસમાં ને વિશ્વાસમાં એક પહેરેગીરને લઈને કુમારના મહેલમાં આવ્યા. રાજાને આવતો જોઈ કુમાર વિચારે છે કે “આનાથી વધુ સારો અવસર નહિ મલે, આ ઠીક છે !”

માણસ ગમે તેવી ધારણા રાખે, સજજનતા રાખે, પણ પોતાના ગુઝકર્મ એવી આણધારી તક એવો દારુણ વિપાક દેખાડે છે કે સજજનતા સાથે એનો મેળ મેળવવો મુશ્કેલ પડે ! “આવા કુમાર એટલે મારો પુત્ર” રાજા આમ સમજે છે. કેમ વારું ? જેના પર તેની માતા અને મંત્રી અરુચિવાળા હતાં, છતાં રાજાએ તેને બચાવીને ઉછેરેલો છે. માટે “કુંવર મારો;” કેમ ન થાય ? રાજાના મનમાં એમ નથી કે- “ચાલો, આપણે કર્મ ખપાવી દેવાં છે, માટે ઉપસર્ગ સહન કરવા જઈએ !” કારણ કે એમ ઉપસર્ગ ઊભા કરવામાં કાંઈ વધુ આરાધના સહેલી નથી. હા, ઉપસર્ગ આવી પડે તો સહન કરવાનું. પણ ‘મારે કર્મ ખપાવવાં છે માટે લાવ સિંહના મુખમાં પેસી જાઉ !’ આ નહિ. રાજા વિશ્વાસમાં છે કે “કુંવર મારો !” પણ કર્મ એવાં છે એનાં, કે કુમાર એનો થાય એમ નથી ! જ્યાં વિશ્વાસ છે ત્યાંથી જ ધોખો આવે; એનું જ નામ સંસારની અસારતા. શું છે સંસારમાં ? અસારતા. અસાર એટલે માલ વિનાનો, તુચ્છ, ફેંકી દેવા લાયક, તુચ્છકારવા લાયક, વિશ્વાસ કરવા લાયક નહિ. ગમે તેવા પદ્ધવાનના સુખ પણ એમાં ઝેરનો કણિયો પડ્યો હોય તો તમે શું કહો ? પદ્ધવાન્ન પણ અસાર ને ? તેમ આ રંગરાગ અને વિષય સુખોનો સંસાર જીવને મીઠો લાગે છે, તે અસાર છે ! સંસારમાં એવું બતાવો કે જ્યાં તમે વિશ્વાસ મૂકવા જાઓ ત્યાં ગરદને ન મરાઓ ! તમારો બંગલો, હુકાન, લક્ષ્મી, સગીપત્ની કે દિકરા તરફથી તમને વિશ્વાસ છે કે એનાથી છૂટું નહિ પડવું પડે ? એના યોગે જ લાગેલા પાપથી પરલોકે પીડા નહિ આવે ? તેમ વિશ્વાસમાં રહો અને એક દિ’ તમારા ડાબા ચુલ ! કોઈ એવું નથી કે જે તમને ઉન્નત સ્થિતિ અપાવે, એ તો જ્યાં તમે વિશ્વાસ મૂકો ત્યાં ધોખો !

માતાએ જન્મ દેતા વાર જ તરછોલા કુમારને રાજાએ ખાસ ઉછેરેલો છે, પણ તે જ આજે કહૃર દ્રોહી થઈને બેઠો છે ! એટલે રાજાને આવતો જોઈ કુમાર તલવાર કાઢીને તૈયાર થઈ જાય છે. પોતાના સહાયક તરીકે સાથે પેલા દુર્મતિને ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાચ્ચય કહા.” (ભાગ-૨૨)

ઊભો રાખ્યો છે.

અજૈન કરમનો વાંક કાઢે, જેન પાપની રમતનો વાંક કાઢે :- રાજા મહેલ ઉપર ચઢે છે. કોનો દોષ આમાં ? ડહાપણ રાખીને બોલજો, આ ઘટનામાં દોષ કોનો ? કરમનો દોષ તો મિથ્યાદર્શનમાં પડેલા પણ માને છે. જેને આત્મવાદ મળેલો છે, આત્મા-પુણ્ય-પાપ વગેરેને જે માનનારો છે, તેવા અજૈન પણ તકદીરનો વાંક કાઢી આશાસન મેળવે છે. પરંતુ એમ કરમનો વાંક માનવામાં તો આત્મામાં એક પ્રકારની દીનતા આવે છે. કર્મનો દોષ માનનારને તે કર્મને ટાળી પુણ્યને જગાડી સુખ દેખાડનાર વહાલો હેમ જેવો લાગે છે. એટલે પછી પાછું ગફ્ફલતમાં પડતાં વાર નહિ. જ્યારે જૈનદર્શન બતાવે છે કે કર્મના દોષને શું ગણવો તો ? વાંક તો આપણી પાપની રમતનો છે. અદાર પાપ-સ્થાનકની રમતમાં પડ્યા, માટે આ જોવાનો અવસર આવ્યો ને ?

સીતાજીએ દિવ્ય કરી જશ મેળવ્યા પછી; રામ-લક્ષ્માણ વિનવવા આવ્યા ‘પધારો અયોધ્યામાં’ લોક પણ પગે પડે છે. ત્યારે પ્રતિષ્ઠાના શિખરે બેસી જગતના સન્માન લેવાનો પ્રસંગ હતો. છતાં અયોધ્યામાં આવવાની ના પાડે છે ! કેમ ? રામલક્ષ્માણ અને પરિવાર જૂરે છે; સમસ્ત લોક ‘જગદંબા’ કહે છે ! અજિની ખાઈ પાણી છલકાતી વાવડી થઈ ગઈ છે ! તેમાં પાછું વચ્ચે પોતે સુવર્ણ કમળ પર બિરાજમાન થયા છે ! પાણીનાં વહેણ ઊદ્ધળી, લોકને દૂબાડી તાણી જવા જેવું કરશે એવા દેખાયા; તેને ત્યાં સીતાજીએ પાણી પર હાથ મૂક્યો કે શાંત બધું જ ! આવી રીતે જ્યાં દુન્યવી દ્રષ્ટિએ પ્રતિષ્ઠાનાં, સન્માનનાં ફૂલ વેરાઈ રહ્યાં છે, ત્યાં સીતાજી કહે છે “મારે નથી આવવું અયોધ્યામાં.” જો કર્મનો દોષ માનતા હોત તો આમ ના ન પાડત. ઠીક છે, રામને ગાળ દેવાનું ન થાય, કર્મને ગાળ દે. પણ કર્મ સીધાં થઈ જાય એટલે કેમ ? તો કે “હાશ ! દુઃખના દહાડા ગયા; હવે દ્રી ધામ બેસવા અવસર મળ્યો. તો મહાલો.” પણ સીતાજીએ હિસાબ જુદો કાઢ્યો હતો. “જેટલી આ ઈન્દ્રિયોના મનગમતા વિષયોની આશામાં હું તણાઉં છું-તેટલી કર્મથી ઠગાઈ હેરાન થાઉં છું. માટે મારે આ વિષયોની તૃષ્ણા જ જોઈતી નથી.” આ દિવ્યદાસ્તિ છે, અમૃતનું અંજન છે. મહાન કટોકટીની સ્થિતિમાં આત્માને એટલું ઉચ્ચ જોમ આપે કે તક જ શોધતો હોય કે ‘કૂદકો મારું !’ પણ તે ત્યારે બને કે જ્યારે દુઃખના કારણ તરીકે વર્તમાનની પાપરમત દેખાય તો; કિન્તુ નહિ કે પૂર્વ કર્મના દોષ જોઈ બેસી રહેવાનું.

દીકરો મરી ગયા પછી રડાઈ પડાતું હોય, ત્યાં કોઈ અમારા જેવા પૂછે કે “કેમ રડો છો ?” ત્યાં “શું કરીએ ? પાપનો ઉદ્ય આવ્યો, છોકરો મરી ગયો?”- ૧૮૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કુમારપાલનું લશકર કૂટ્યું” (ભાગ-૨૨)

એમ નહિ. પણ “આ મેં એના પર રાગની રમત કરી, માટે રોવાનો પ્રસંગ આવ્યો. રાગની રમતનું પરિણામ આ હુઃખ છે. જો રાગ એ કર્યો હોત કે ‘સારામાં સારો તો ધર્મ !’ તો પુત્રનેય જીવતે એવું શીખવાડીને મોકલત ! પણ હું રાગાંધ. એને ધર્મ શી રીતે શીખવું ? આવ્યો હશે કોઇથી કે-હું શ્રાવકને ઘેર જાઉં. તો ધર્મ મળશે. એટલે પૂર્વભવે ધર્મ કરીને ભવાન્તર માટે ધર્મ માણ્યો હશે; પરંતુ મેં એ બધું વિસરાવી પાપમાં રોખ્યો.”

ધર્મનો વ્યાપાર ચાલતો હોય ત્યાં મૃત્યુની ધાડ આવતાં ધર્મનું બંડલ બગલમાં મારીને બેફિકર ઈચ્છયું કે અહીંથી ચાલ શ્રાવકને ત્યાં ! ત્યાં પછી તે બંડલ ખોલીને નવો ધર્મ-વ્યાપાર કરવાનો ! આ રીતે આવેલા પુત્રને મોહાંધ મા-બાપ શું કરે છે ? બંડલ લઈ લે છે. કેવી રીતે ? હઠકો દઈને લ્યો, ઉઠ્યા ત્યારથી “મારે એકાહણું કરવું છે, ને બેહણું કરવું છે ! સામાયિક ને પૂજા કરવી છે !” રાગની રમતનો અંધાપો શું આપે ? રાગની લહાણી કે પુષ્યકાર્યની ?

સીતાજી એમ વિચારે છે કે “સંસાર માંડવાના રાગમાને રાગમાં તણાઈ તો વનમાં ભટકતી થઈને ? ત્યાંથી રાવણને ત્યાં હરાઈ, ને ત્યાંથી છૂટી તો સંસાર સુખની ભૂખી થઈને આવી અયોધ્યામાં ! તો પાછી તગોડાઈ વનમાં ! બસ ! બહુ થયું; હવે મારે જોઈએ નહિ એ વિષયોની તૃષ્ણા.” ઊભી થઈ ગઈ સીતા ! બાજુમાં જ કેવળજ્ઞાની મહર્ષિ હતા, કેશના લોચ લોકોની વચ્ચે જ ઉતારીને પહોંચી ગઈ ત્યાં. વહાલા, અતિ વહાલા રામ તો મૂર્ચિંદું જ થઈ ગયા ! “ભલે થાઓ, તે તમારી મોહદ્દશાને લીધે છે.” કેટલું આત્મસમર્થ ! તે ક્યા વખતે ? અનેક વિટબણાઓ વેઠ્યા પછી ઠરીધામ બેસવાનો અવસર આવ્યો ત્યારે ! તૃષ્ણા એટલે પાપની રમત ! આવું જૈનશાસનની દિવ્યદેણિ પ્રાપ્ત થઈ હોય તે સમજી શકે. સિંહરાજા તે સમજે છે; તેથી જોજો એમની ધીરતા !

પુત્રનો પિતા પર ધા : પિતાની ઉદારતા :- સિંહરાજા જેવો ઉપર ચેદે છે તેવો પેલો તૈયાર જ ઊભો છે. ઉદર પર જેમ તલખી રહેલી બિલાડી ટ્રાટ્કે, તેમ પ્રતિહારીને મારી નાખી સીધો સિંહરાજાની નજીકમાં આવતાં જ એમના પર તલવારનો જોરથી ધા કરી દે છે ! કોના પર ? સગા બાપ પર ! શું બોલતો ? “લે માર... માર...” એટલે જાણે રાજા પોતાના પર મારવા ધર્સી આવ્યો છે, અને પોતે બચાવ કરવા તલવાર વાપરે છે ! રાજા તો રક્ષણના કોઈ ઉપાયમાં નથી. અત્યંત વિશ્વાસુ ચિત્ત ધરીને આવ્યા છે. તેથી ધા ખાઈ પડે છે. બીજી જ મિનિટે બહાર ખબર પડી ગઈ. કોલાહલ ઉઠ્યો. નગરમાં અને સૈન્યમાં ખળખળાટ મચી ગયો ! સૈન્ય વડે ચારે બાજુથી કુમારના મહેલને ઘેરી લેવામાં આવ્યો. લડાઈ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેશ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૧૮૩

માટેની તૈયારી-શરૂઆત થઈ ગઈ. કેમકે કુમારે થોડા ઘણાને ફોડ્યા હશે એટલે લડવા ઊભો થઈ ગયો. પણ રાજાનો પક્ષ મોટો છે. ત્યાં તેનું ચાલી શકે એમ નથી. છતાં એ વખતે સિંહરાજ શું કહે છે ? આખા સૈન્યને રોડી ટે છે. “ઊભા રહી જાઓ.” પોતાના શરીરના સોગન આખ્યા. કહે છે “લડવાનું શું કામ છે ? આનંદને કોઈ મારશો નહિ, જો કંઈ કરશો તો મારો દેહ ખતમ થઈ જશે. હું જાતે જ મર્યો સમજજો. જો મને જીવતો રાખવો હોય તો ઊભા રહી જાઓ...” અમલદારોની આકુળતા-વ્યાકુળતાનો પાર નથી, છતાં આગળ વધી રાજા કહે છે કે “જાઓ, મુહૂર્ત નજીકમાં છે. એનો રાજ્યાભિષેક કરો. એ તમારો રાજા છે.”

હૃદયમાં કેટલા ગુણો :- શું સમજ્યા ? રાજા સંસાર ત્યાગી નથી. સંસારી છે. પૈસાટકા વિનાના હાલીમવાલી રખડતારામ નથી, રાજાધિરાજ છે. બેઠાં બેઠાં નવકારવાળી નથી ગણી; પણ દુનિયાના ઘણાં કારબાર કર્યા છે ! છતાં તત્ત્વનો જાણ છે. માત્ર કર્મને દોષ દેનારો હોત તો તો કદાચ સૈન્યને ન ય રોકત. પરંતુ આત્માની પાપરમતનો વાંક જોનારો છે. તેમ ગંભીર છે. એવો રાજા વિચારે છે કે કોણ એવો બીજો રાજકારભારમાં કેળવાયેલો છે કે જે આનંદ વિના રાજ્યનું રક્ષણ કરે ? માટે, મારું ગમે તે થાઓ પણ પ્રજાનું કંઈ ન બગડો.” આ હૃદયમાં કેટલા ગુણો ભરેલા હશે ? હૃદય કેવું ધરી રાખ્યું હશે ! હડતર પણ સામાયિક પૂજામાં જ નહિ પણ દુન્યવી જીવનમાં ! તોજ રાજા આ ઉત્તમતા બતાવી શકે છે. પરંતુ પેલો પાપી તો આનો લાભ ઉઠાવે છે. દુર્મિતિને કહે છે, “શું ઊભો રહ્યો છે ? બાંધ રાજાને, અને નાખી દે કેદમાં.” સામે સમર્થ સૈન્ય ઊભું છે, ને રાજા આમ કહે છે કે “એને કંઈ કરશો નહિ.” કુમારનું વચન સાંભળવા છતાં રાજાને કંઈ નથી કે “હું સાપને આગમાંથી બહાર કાહું, ને સાપ મને ઉંસે છે ?” એ તો ધીર છે. બધું સહવા તૈયાર છે, માણસ ધારે તો પોતાના દિલની ધીરતાને ક્યાં સુધી ચઢાવી શકે ? સહિષ્ણુતામાં કેટલો આગળ વધી શકે ? એટલો બધો કે જેની આગળ ગગન પણ હરીકાઈ કરી શકે નહિ. ગૃહસ્થ છતાં આત્માની આતાકાત ! તત્ત્વ પરિશ્યાનું આ ફળ છે.

આત્માનો અધિકાર ક્યાં ? :- દુનિયાના પદાર્થો કે સુખદુઃખ ભલે કર્મના હાથમાં હોય, પણ આત્મા આપણા હાથમાં છે. બહારની પ્રતિકુળતા-અનુકુળતા પર આપણો હક નથી; આપણું ધાર્યું થાય કે ન થાય; પણ આત્મા પર આપણો એવો અધિકાર છે, કે ક્ષમા-મૃહૃત્બા-ગંભીરતા-નિરૂપૃહત્તા; આવી આવી ઉચ્ચકોટિની બનાવવાની છે, તો બનાવી શકીએ. સાથે એ ભૂલશો નહિ કે તે બનાવવાનો ઊંચામાં ઊંચો અવસર અહીંયાં માનવજીવનમાં છે. જડનો વિકસ આપણા હાથમાં

૧૮૪ સુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“કુમારપાલનું લશકર ફૂટયું” (ભાગ-૨૨)

નહિ; તે તો કર્મની વાત. પુષ્ય ધારે તેટલી તિજોરી ભરી શકે; અને પાપ ધારે તેટલી ખાલી કરી શકે ! તમે તો માત્ર વચ્ચે મજૂરિયા ! “જાઓ વલણમાં પચાસ લાખ કમાયા, તો મને માત્ર ગાંઠડા (ગાંસડા) બાંધી લાવો !” જીવ જાણે લક્ષ્મીનો વફાદાર ગુરખો ! લક્ષ્મીના ગમના-ગમનમાં જીવનું કંઈ ઉપજે નહિ. આત્માનો વિકાસ આપણા હાથમાં છે. તો આપણો ધંધો શું છે ? જ્યાં આપણું ચાલે એમ નથી ત્યાં ફરવું છે અને ચાલે એમ છે ત્યાં કંઈ નહિ કરતાં હાથ જોડિને બેસી રહેવું છે ! આપણો મનથી શું ચિંતવવું તે આપણા અધિકારની વાત છે; ત્યાં સારું ચિંતવવું નથી. ને જે કુટુંબ-કબીલો હાથની વાત નહિ, તેને સુધારી દેવા કૂદવું છે ! એની ખાલી વિચારણામાં પાંચ કલાકેય પાર ન આવે ! એનું પ્રભુનું નામસરણ કેટલું ? જરાયે નહિ ! રાજી સમજે છે કે,

‘આપણા જીવની સંસાર ખેલવાની ભૂલજ એવી છે કે એમાં આપત્તિ વરસેજ. આપણા કર્મના ઉદ્ય વિના કંઈ બનતું નથી. એમાંય વિશેષ કરીને આપણી જાતને જો સમજદાર સજજન સમજતા હોઈએ તો જેમ એ એની યોગ્યતા મુજબ કરે છે, તેમ આપણે આપણી સમજદાર સજજનતાની યોગ્યતા મુજબ કરવાનું.’ એની યોગ્યતા એવી છે-જેલમાં નાખવાની,-તો તેમ એ કરે; અને આપણી યોગ્યતા એને રાજગાદી પર બેસાડવાની છે, તો તેમ કરવાનું, શું છે આ ? માત્ર મન વાળવાની વાત છે. દુનિયાને જે વાત મહાકષ્ટમય દેખાય તે વાત તત્ત્વદિષ્ટવાળાને મને કંઈ નથી ! “કર્મ અહીં તૂટશે ! જે થયું તે સારું થયું !” એમ એ વિચારી શકે છે.

શું આવ્યું ? મન વાળવાની ત્રાણ વિચારણા :-

- (૧) આપત્તિ આવે છે તે આપણી સંસાર-ભૂલને કારણે.
- (૨) આપણા કર્મના ઉદ્યે જ અહીં સારું-નરસું મળે છે.
- (૩) આપણી સજજનતાને યોગ્ય જ વર્તવું.

રાજી કેદમાં : કુમાર ગાઢી પર :- હવે આનંદકુમારની આજ્ઞાથી દુર્મિતિ સામંતરાજી સિંહરાજને બાંધવા આગળ આવ્યો. ત્યાં વચ્ચે પડતાં કુલપુત્રોને એણે હેઠા પાડ્યા; ને નગરજનનોને ધૂટકારી કાઢ્યા. પોતાના માણસો પાસે રાજીને બંધાવ્યો.

પ્ર.- સિંહરાજની આ ઘેલી ઉદારતા કહેવાય કે નહિ ?

૩.- હા, પૂર્વકર્મનો હિસાબ જેની પાસે ન હોય, ત્યાં ઘેલી ઉદારતા દેખાય, પણ જેને પૂર્વકર્મનો હિસાબ સમજાય છે કે ‘જન્મ જન્મના કર્મ ઊભાં છે તે એમ ખસે એવાં નથી. એ તો આપત્તિ વેઠવાથી જ ખસશે.’ એવો કર્મનો હિસાબ જો સમજ્યા છીએ, તો વર્તમાન કપરી સ્થિતિને હર્ષથી વધાવી લેવાય ! આવા સમજુને ઘેલી ઉદારતા ન લાગે. ઘેલધા એ નથી. એને ઘેલધા તો કર્મના ભાર

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૧૮૫

ઉતારવાની લાગી છે. કુમારે પિતાને મુશ્કેટાટ બંધાવીને વિશ્વાસુ માણસના પહેરા નીચે સુરક્ષિત કરી દીધા. પછી શું ? પોતાની મેળે બેસી ગયો રાજગાદી પર ! રાજાની આણ હતી એટલે કોઈ તેનો સામનો કરી શક્યું નહિ. એણે વ્યવસ્થા સ્થાપી દીધી. સાંમતરાજાઓને પણ વશ કરી લીધા. બીજી બાજુ વૈરના લીધે રાજાને નરકાગાર જેવા કારાગારમાં નાંખ્યા. કેવી એ જેલ હતી ? અત્યંત ચુંથાતી વિલાથી ગંધાતી ગારની દુર્ગધી ભરેલી. વળી, એ અંધકારમય હોવાથી એમાં ડાંસ, મચ્છર અને માખીઓનો ગણગણાટ-ભણભણાટ ચાલુ હતો. તેવી આ જેલ હતી. વળી દિવાલો જીર્ણ-શીર્ણ અને વચ્ચે વચ્ચે તૂટેલી એવી, કે જેમાં સર્પ જેવા પણ સૂતા હોય. તેમ, દર અને બાકોરાના મોં આગળ ઉંદરની લીડીઓના ફગલા પડેલા. કોણ સાફ કરે ત્યાં ? ઠેર ઠેર કરોળિયાના જાળા ! ઉપરથી સાપની ઊતરેલી કાંચળીઓ લટકતી રહેલી ! ભયંકર-દુષ્પમ કાળિકાળનું જાણે નિવાસસ્થાન ! સાતમી નરકના સીમન્તક પાથડાનું જાણે ભાઈ ! કીડાભૂમિ કેમ ન હોય ! સર્વયાતનાનું કુલધર જોઈ ત્યો ! મૃત્યુને વિશ્વસનીય ભૂમિ સમાન; અને યમરાજનું જાણે સિદ્ધિક્ષેત્ર ન હોય ! એવું લયાનક આ જેલખાનું હતું.

મહારાજાને મોટા કેદખાનામાં લઈ જવામાં આવ્યા એવી અંત:પુરમાં ખબર પડી ગઈ. મુખ્યરાજી કુસુમાવલી સહિત અંત:પુરને એવો ભયંકર આધાત લાગ્યો કે કરુણ આકન્દ અને ચીસો પાડી ઉઠે છે. મહેલમાંથી નીકળી જેલ તરફ એ રોતું કકળતું જઈ રહ્યું છે. સતત ધારાબદ્ધ કાજળ વિનાના ચોક્કા આંસુ એટલા બધા વહી રહ્યા છે કે મોટા મોતીઓ જેવા બનીને એ હાર જેવા લાગે છે. રાજી માથેના દુઃખથી રાજી કરમાય પણ એના બદલે અહીં તો રાણીઓની કાયા મહારાજને માથે પડેલા દુઃખના શોકથી કરમાઈ ગઈ છે. શોક કલ્પાંતનો પાર નથી.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૩, અંક-૪૮, તા. ૨૪-૯-૧૯૫૫

ખોટા ગુમાન તૃણા :

વિચારજો સંસારનું સ્વરૂપ. એક વખતની સિંહકુમાર અને કુસુમાવલિના પ્રેમભર્યા સુખની સ્થિતિ ક્યાં ! અને અત્યારની આ વિષમ પરિસ્થિતિ ક્યાં ! જ્યાં એક વાર બંને જણ રાજશાહી સુખના સરોવરમાં જીલ્યા છે, એજ જીવનમાં હવે હદ્યનાથ રાજી તલવારનો ધા ખાઈ ભયાનક જેલમાં નખાયા છે ! અને પ્રાણખારી પ્રિયતમા ધોર આકંદ કરી બોર-બોર જેવાં આંસુ વહાવી રહી છે ! સુગંધિના મધમઘાટ વચ્ચે, મનોરમ ચિત્રભર્યા રાજ-મંદિરની સુંવાળી શથ્યામાં, વીંગાતા પંખાના

૧૮૬

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ખોટા ગુમાન તૃણા” (ભાગ-૨૨)

પવનની લહેરી સાથે, આરામ કરતા રાજા અત્યારે દુર્ગધની બદબો વર્ણે, બિભત્તસ ને ભ્યાનક જેલખાનાની ખાડા-ટેકરાવાળી કઠોર ભૂમિ પર, અંધારામાં ઘામ સાથે પડ્યા છે. તો રાણીનું કાંઈ ઉપજતું નથી, ને કલ્યાંતનો પાર નથી ! માણસ કદાચ ઠકરાઈ પર ઘમંડ કરે, પણ આવા વિકટ પરિણામ આગળ એ ઘમંડને ઓગળી જતા શી વાર ? ત્યારે જેને ઠકરાઈના કોડ થાય છે, એ જો નજર સામે આ પરિણામ લાવે તો કોડ ક્યાંય સુકાઈ જાય કે નહિ ? સંસારમાં રહ્યે-રહ્યે પણ આવા પ્રસંગો આંખ સામે રાખી ખોટા ગુમાન, તૃષ્ણા, હર્ષ વગેરે દોષોને તો સંદર્ભ નાખૂં જ કરી દેવો જોઈએ.

રાણીઓ કલ્યાંત કરતી જેલ તરફ આવી રહી છે. જ્યાં જેલની પાસે દરવાજે પહોંચી ત્યાં દરવાજા પર પહેરગીરો રોકે છે. પણ પોતાના હાથથી એમને બળાત્કારે હટાવીને રાણીઓ અંદર પેસે છે. હવે તો ઠેઠ નજીકમાં આવી એટલે દુઃખનો ઉછાળો ભયંકર વધ્યો, તેથી છાતી અને પેટ ફૂટવા મંડી. એમાં વળી આ દુર્ગધમય અયોગ્ય મુકામની ધરતી પર ચાલવાથી શાસ ભરાઈ આવે છે. કુટિલભાવ છોડી દીધો છે. છતાં આંખ જાણે મહારાજાની અવસ્થા જોવા યોગ્ય નથી એટલે લટકતા અલતાથી જોતી બંધ થઈ જાય છે. રાજાને એક પશુની જેમ મોટી લોઢાની કાળી બેડીથી જકીને બાંધ્યો છે. આટલું છતાં રાજા બહુ સ્વસ્થ છે, દીન નથી. પરંતુ રાણીઓ રાજાની આ ભયંકર હાલત જોઈ આસોપાલવના પાન સરખા હાથ વડે છાતીને હારના વહન કરવાથી જાણે થાકી ગઈ હોવાથી ફૂટે છે. જાણે એ દરશિવે છે કે આ સંસાર અનુચ્છિત આચરણની બહુલતવાળો છે. પછી કારમું રુદુન આંકંદ વધી પડે છે. ત્યાં રાજા પહેરગીરો પાસે ખૂબ સમજાવીને આંકંદને અટકાવે છે. પછી રાજા શિખામણ આપે છે ! કેવી અનુપમ તે વાળી છે, તે જુઓ કેમકે જગતની જે ઘટનામાં અજ્ઞાનપ્રાણીઓ શોક અને આંકંદ કરે છે, ભારે દેખ અને મત્તસર કરે છે, તેજ જગતની ઘટનામાં વિવેકી એવા જિનશાસનના જીવો વધુ વૈરાગ્ય વિકસાવી સંસારની અસારતાને ખૂબ દૃઢપણે સમજે છે. શોક અને પોકને બદલે સમતા-સમાધિમાં ચઢી તટસ્થભાવે જગતનું નાટક નિહાળે છે. આ ટૂંકો હિસાબ છે. ચાલુ ઘટનાને જગત શી રીતે જુએ છે ? તેજ રીતે જો આપણે જોઈએ તો આપણે અજ્ઞાની; ને જૈનદર્શનની રીતે જોઈએ તો આપણે સજ્જાન. જોઈને ઉદાસીન ભાવે રાગદ્વેષથી દૂર રહીને સમતાસાગરમાં બરાબર જીલતા રહીએ, જરાય એની બહાર ન નીકળીએ, તો આપણે વિવેકી અને સજ્જાન.

રાજાની અમૃતવાણી : રાજા કહે છે, “અરે, તમે આ શું કરો છો ? કેવળ તકલીફ આપે અને મહાન પાપ કરાવે, પાપનો અનુબંધ-પરંપરા ચલાવે, જેમાંથી ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

સારું ફળ કશું જ નહિ તેવો શોક તમે કેમ કરો છો ? ખબર નથી તમને કે આ સંસાર અતિ અતિ વિચિત્ર સ્વરૂપવાળો છે ? આ સંસારને સર્વ જીવો એ રમવાના રમકડાં જેવા છે ? જેમાં જીવે પૂર્વે કરેલાં કર્મનો ઉદ્ય પ્રસરવાનું હુર્નિવાર છે. આપણા કર્મનો ઉદ્ય ચાલુ થયા પછી વર્ણે રોકવાની દિવાલ ઊભી કરી શકાય નહિ. લક્ષ્મી વાદળાંની વચ્ચમાંથી નીકળી આવતી વિજળીના જેવી ચંચળ છે. સ્નેહી અને સંબંધીનો સંગમ સ્વર્જ સમાન છે. રાગની જે રમત કરીએ તેનું આ પરિણામ છે ! એ શું તમે નથી જાણતા ?” રાજાની આ શિખામણમાં ક્યાંય “કુમાર દુષ્ટ છે...” એવો વિચાર ગ્રગટ થતો નથી ! કેમ વારું ? કહો, પૂર્વ-સાધના અને અહીં જિનવચનની ઓતપ્રોતના બીજાનું ખરાબપણું મનમાંય પેસવા દેતું નથી ! કહે છે, “કર્મના તોફાનાં અને રાગની ચેષ્ટાનાં આવાં ફળ આવે એમાં નવાઈ નથી. તો પછી અવિવેકી માણસને છાજે એવું આ રુદુન કરવાથી શું વળવાનું હતું ? અને તમે રુઓ ? તમને તો જિનવચનનું અમૃત મળેલું છે, કે જે જીવનના મહાન સાર રૂપ છે ! માટે જિનાશાને જ અમલમાં ઉતારો. જીવનનો સાર હાથમાં આવતો હોય તો એ છોડી વર્ષ અવિવેકી ચેષ્ટા કોણ કરે ? કરવા યોગ્ય હોય તો તે છે જે જિનવચને ભાખ્યું છે. કેમકે જિનવચન સિવાય દુઃખ માત્રનો અંત આશવાનો બીજો કોઈ ઉપાય નથી !”

તલવારથી ઘવાયેલ અને બેડીથી જકડાયેલ નરકાગાર જેવી જેલમાં પડ્યો પડ્યો રાજા કેવી સોનેરી શિખામણ, કેવો મધમધતો ઉપદેશ આપી દે છે ! એમને અંતરમાં દ્વેષ નથી; ઈતરાજુ, અરુચિ નથી. પોતાની અવસ્થા પર કલ્યાંત, દીનતા કે દુઃખ, કંઈ જ નથી ! કેમકે, જિનવચનના રસાયણે આત્મા નવું ચૈતન્ય, નવી સ્કૂર્તિ પામ્યો છે. પ્રલુબાણીએ આત્મામાં માત્ર તત્વચિંતનને વિષે ઊજમાળતા કરી દીધી છે; કર્મતત્વના ભયંકર તોફાન દેખાડ્યા છે ! તેમાં નાદાન છોકરાની સામાન્ય કસુર શી લક્ષમાં લેવી ? જ્યાં મોહ અને કર્મથી જન્ય બીજી વસ્તુના જગતમાં મહાન તોફાન છે, ત્યાં એનો વિચાર છોડી મામુલી વસ્તુ લક્ષમાં લેવી તે મૂર્ખાઈ છે ભારોભાર. જ્યારે તલવાર ને ભાલા જેવા રાગ-દ્વેષ, મહાગુંડાઓ જેવા પૂર્વકર્મ, અને આ જીવની પિશાચી પાપરમતો આપણો કચ્ચરઘાણ કાઢતી હોય, ત્યાં કહીએ કે “ધોકરાએ આમ કર્યું..ફ્લાણે અમારું આ બગાડયું..આ આવું આવું બગડી ગયું...” એ મહામૂર્ખાઈ છે. રોવાનું ઘણું પડ્યું છે. આમાં શું રોવાનું ? રાગદ્વેષરૂપી લુચ્યાઓએ, આ મહાન માનવજીવનમાં જ જે ઉત્તમ ચારિત્રરતન લઈ શકાય, તે ન લેવા દીધું અને જીવને માયકંગલો બનાવ્યો; નિઃસત્ત્વ બનાવ્યો. પણ હવે તેમાંથી પાછા હટવાનું કરવું, કે પાછું એજ રાગ-દ્વેષની લોથ ઉપાડવી ? કયું

૧૮૮ ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“ખોટા ગુમાન તૃષ્ણા” (ભાગ-૨૨)

ધ્યાનમાં લેવા જેવું છે ? કુમારે રાજ્ય પડાવી લીધું તોયે શું ? ને ન પડાવ્યું હોત તોય શું ? રાજ્ય હોત તોય મરવું પડત, ને ન હોય તો પણ મરવું પડે ! દુનિયાની સંપત્તિ ટકી તો પણ શું વિશેષતા, ને ગઈ તો યે શું ખોટ ? જીવ્યાની વિશેષતા એ છે કે આ અસાર સંસારની વેઠ ત્યણું, જિનેશ્વરદેવના ચરણે બેસી જવાય ! એ ન કર્યું અને રાગ દ્વેષને પંપોળ્યો, તો એક જન્મ જ નહિ પણ અનેક જન્મતા મોત છે.

વિચારો-ન્તમારા માથે કયું જોખમ મોટું છે ? ક્યો ભય ભારે છે ? :

રાજના હદ્યમાં આવું બધું રખ્યા કરે છે, તો આવો દિવ્ય ઉપદેશ આપે છે ! કે જેની એ અમૃતવાણીથી ભીજી ગયેલી રાણીઓ કહે છે કે “આપ કહો છો તેમજ છે. કાંઈ ફરક નથી.” રાજના દિલના ઉદ્ગાર છે ! એ પાછા નિકટના સ્નેહીના છે; વળી જીત પર વેઠીને કહેલા શબ્દો છે ! એની અસર ભારે પડી. પરંતુ આ કયારે બને ? એક માત્ર સારભૂત જિનેશ્વરદેવની વાણી જ ઘારી લાગે ત્યારે; એ લાગ્યા પછી જીવનનું કર્તવ્ય એ વાણીએ ફરમાવેલું હોય તેજ હાડોહાડ ભાસી જાય ત્યારે ! તે પાલન ન થાય ત્યાંસુધી હૈયામાં તેવો જ બેદ હોય. “અહો ! મારું કેવું ધોર સાહસ ! અધમ એવો હું કર્તવ્ય કરવાના વખતે ચૂકી રહ્યો છું. જિનશાસનનો વિવેક ચૂકીને ચાલી રહ્યો છું,” જિનશાસનનો કયો વિવેક છે ? એ કે તમારા માથે મોટું જોખમ કયું છે ? મોટી નુકસાની કઈ છે ? તેનું માપ કાઢો. કોની સાથે તમારા આત્માનો દીર્ઘતિદીર્ઘ કાળનો સંબંધ છે, તે બરાબર ઘ્યાલમાં રાખો. આ લક્ષમાં રહે તો ‘ફાલતું-ફાલતું ઝગડા કે ઊંચા-નીચીમાં જાતે ન બગડે. અરે ! પરમાત્માનું શાસન પામ્યા છો, વિચાર તો તે કરો કે “જો હું સો ટચ્યના સોના જેવો છું અને બીજો મને દોષિત કરે છે, તેટલા માત્રથી મારા માથે કોઈ મોટો ભય કે જોખમ આવતું નથી. જોખમ તો તો છે કે જો હું ગુસ્સો, ઘમંડ વગેરેથી, તૃણા મમતા વગેરેથી મન બગાડી રહ્યો છું. ભય તો આવશે કે જો હું પાપની રમત રમી રહ્યો છું તો પૂર્વ કર્મનાં મોટાં પાપોનું જોખમ મોટું છે. મને એની ખબર નથી તેથી કંઈ હું અકર્મી નથી, છૂપાં કર્મો પડેલાં જ છે. તે મને કચી સ્થિતિમાં મૂકી દે તેનો પતો નથી. આની કોઈ ચિંતા નહિ, ને વર્તમાન અસાર વસ્તુ પાછળ ખરાબ લાગણીઓમાં અટવાઈ જવું એ શું !!



“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૩, તા. ૨૪-૮-૧૯૫૫

ખોટા ગુમાન તૃણા :- વિચારજો સંસારનું સ્વરૂપ. એક વખતની સિંહકુમાર અને કુસુમાવલિના પ્રેમભર્યા સુખની સ્થિતિ ક્યાં ! અને અત્યારની આ વિષમ પરિસ્થિતિ ક્યાં ! જ્યાં એકવાર બંને જણ રાજશાહી સુખના સરોવરમાં જીત્યા છે, એજ જીવનમાં હવે રાજ હદ્યાંત તલવારનો ઘા ખાઈ ભયાનક જેલમાં નખાયા છે ! અને પ્રાણાય્યારી પ્રિયતમા ઘોર આંકંદ કરી બોર બોર જેવડાં આંસુ વહાવી રહી છે ! સુગંધિના મધ્યમધાટ વચ્ચે, મનોરમ ચિત્રભર્યા રાજ-મંદિરની સુંવાળી શાયામાં, વીંઝાતા પંખાના પવનની લહેરી સાથે, આરામ કરતા રાજ અત્યારે દુર્ગધિની બદબો વચ્ચે, બિભત્તસ ને ભયાનક જેલખાનાની ખાડા-ટેકરાવાળી કઠોર ભૂમિ પર, અંધારામાં ઘામ સાથે પડ્યા છે. તો રાણીનું કાંઈ ઉપજતું નથી, ને કલ્યાંતનો પાર નથી ! માણસ કદાચ ઠકુરાઈ પર ઘમંડ કરે, પણ આવા વિકટ પરિણામ આગળ એ ઘમંડને ઓગળી જતા શી વાર ? ત્યારે જેને ઠકુરાઈના કોડ થાય છે, એ જો નજર સામે આ પરિણામ લાવે તો કોડ ક્યાંય સુકાઈ જાય કે નહિ ? સંસારમાં રહ્યે રહ્યે પણ આવા પ્રસંગો આંખ સામે રાખી ખોટા ગુમાન, તૃણા, ઈર્ઝા વગેરે દોષોને તો સંદર્ભ નાબૂદ જ કરી દેવા જોઈએ.

રાણીઓ કલ્યાંત કરતી જેલ તરફ આવી રહી છે. જ્યાં જેલની પાસે દરવાજે પહોંચી ત્યાં દરવાજા પર પહેરણીરો રોકે છે. પણ પોતાના હાથથી એમને બળાતકરે હાયાવીને રાણીઓ અંદર પેસે છે. હવે તો કેઠ નજીકમાં આવી એટલે દુઃખનો ઉછાળો ભયંકર વધ્યો, તેથી છાતી અને પેટ ફૂટવા મંડી. એમાં વળી આ દુર્ગધમય અયોધ્ય મુકામની ધરતી પર ચાલવાથી શાસ ભરાઈ આવે છે. કુટિલભાવ છોડી દીધો છે. છતાં આંખ જાણે મહારાજની અવસ્થા જોવા યોગ્ય નથી એટલે લટકતા અલતાથી જોતી બંધ થઈ જાય છે. રાજને એક પશુની જેમ મોટી લોડાની કાળી બેડીથી જકડીને બાંધ્યો છે. આટલું છતાં રાજ બહુ સ્વરથ છે, દીન નથી. પરંતુ રાણીઓ રાજની આ ભયંકર હાલત જોઈ આસોપાલવના પાન સરખા હાથ વડે છાતીને હારના વહન કરવાથી જાણે થાકી ગઈ હોવાથી ફૂટે છે. જાણે એ દર્શાવે છે કે આ સંસાર અનુચ્છિત આચરણની બહુલતવાળો છે. પછી કારમું રુદ્ધન આંકંદ વધી પડે છે. ત્યાં રાજ પહેરણીરો પાસે ખૂબ સમજાવીને આંકંદને અટકાવે છે. પછી રાજ શિખામણ આપે છે ! કેવી અનુપમ તે વાણી છે, તે જુઓ. કેમકે જગતની જે ઘટનામાં અણાનપ્રાણીઓ શોક અને આંકંદ કરે છે, ભારે દ્વેષ અને મત્સર કરે છે, તેજ જગતની ઘટનામાં વિવેકી એવા જિનશાસનના જીવો વધુ

વैराग्य विकसानी संसारनी असारताने खૂબ દટ્પણે સમજે છે. શોક અને પોકને બદલે સમતા-સમાધિમાં ચઢી તટસ્થભાવે જગતનું નાટક નિહાળે છે. આ ટૂંકો હિસાબ છે. ચાલુ ઘટનાને જગત શી રીતે જુએ છે? તેજ રીતે જો આપણે જોઈએ તો આપણે અજ્ઞાની; ને જેન દર્શનની રીતે જોઈએ તો આપણે સજ્જાન. જોઈને ઉદાસીન ભાવે રાગદ્રેષથી દૂર રહીને સમતાસાગરમાં બરાબર જીલતા રહીને, જરાય એની બહાર ન નીકળીયે, તો આપણે વિવેકી અને સજ્જાન.

રાજાની અમૃતવાણી :- રાજ કહે છે, “અરે, તમે આ શું કરો? કેવળ તકલીફ આપે અને મહાન પાપ કરાવે, પાપનો અનુબંધ-પરંપરા ચલાવે, જેમાંથી સારું ફળ કશું જ નહિ તેવો શોક તમે કેમ કરો છો? ખબર નથી તમને કે આ સંસાર અતિ અતિ વિચિત્ર સ્વરૂપવાળો છે? આ સંસારને સર્વ જીવો એ રમવાના રમકડા જેવા છે! જેમાં જીવે પૂર્વે કરેલાં કર્મનો ઉદ્ય પ્રસરવાનું દુર્નિવાર છે. આપણા કર્મનો ઉદ્ય ચાલુ થયા પછી વર્ષ્યે રોકવાની દિવાલ ઊભી કરી શકાય નહિ. લક્ષ્મી વાદળાની વચ્ચમાંથી નીકળી આવતી વિજળીના જેવી ચંચળ છે. સ્નેહી અને સંબંધીનો સંગમ સ્વર્ણ સમાન છે. રાગની જે રમત કરીએ તેનું આ પરિણામ છે! એ શું તમે નથી જાણતા?” રાજાની આ શિખામણમાં કયાંય “કુમાર દુષ્ટ છે...” એવો વિચાર પ્રગટ થતો નથી! કેમ વારુ? કહો, પૂર્વ-સાધના અને અહીં જિનવચનની ઓતપ્રોતતા બીજાનું ખરાબપણું મનમાંય પેસવા દેતું નથી! કહે છે, “કર્મના તોફાનાં અને રાગની ચેષ્ટાનાં આવાં ફળ આવે એમાં નવાઈ નથી. તો પછી અવિવેકી માણસને છાજે એવું આ રુદ્ધ કરવાથી શું વળવાનું હતું? અને તમે રુઓ? તમને તો જિનવચનનું અમૃત મળેલું છે, કે જે જીવનના મહાન સાર રૂપ છે! માટે જિનાશાને જ અમલમાં ઉતારો. જીવનનો સાર હાથમાં આવતો એ છોડી વ્યર્થ અવિવેકી ચેષ્ટા કોણ કરે? કરવા યોગ્ય હોય તો તે છે જે જિનવચને ભાખ્યું છે. કેમકે જિનવચન સિવાય દુઃખ માત્રનો અંત આણવાનો બીજો કોઈ ઉપાય નથી!”

તલવારથી ઘવાયેલ અને બેડીથી જકડાયેલ નરકાગાર જેવી જેલમાં પડ્યો પડ્યો રાજ કેવી સોનેરી શિખામણ, કેવો મધમધતો ઉપદેશ આપી દે છે! એમને અંતરમાં દ્વેષ નથી; ઈતરાજી, અરુણિ નથી. પોતાની અવસ્થા પર કલ્પાંત, દીનતા કે દુઃખ,-કંઈજ નથી! કેમકે, જિનવચનના રસાયણે આત્મા નવું ચૈતન્ય, નવી સ્કુર્તિ પામ્યો છે. પ્રભુવાણીએ આત્મામાં માત્ર તત્ત્વચિંતનને વિષે ઉજમાળતા કરી દીધી છે; કર્મતત્વના ભયંકર તોફાન દેખાડ્યા છે! તેમાં નાદાન છોકરાની સામાન્ય કસુર શી લક્ષમાં લેવી? જ્યાં મોહ અને કર્મથી જન્ય બીજી વસ્તુના જગતમાં

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેશ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨૦૧

મહાન તોફાન છે, ત્યાં એનો વિચાર છોડી મામુલી વસ્તુ લક્ષમાં લેવી તે મૂર્ખાઈ છે ભારોભાર. જ્યારે તલવાર ને ભાલા જેવા રાગ-દ્રેષ, મહાગુંડાઓ જેવા પૂર્વકર્મ, અને આ જીવની પિશાચી પાપરમતો આપણો કર્યરઘાણ કાઢતી હોય, ત્યાં કહીએ કે “છોકરાએ આમ કર્યું... ફલાણે અમારું આ બગાડયું... આ આવું આવું બગડી ગયું...” -એ મહામૂર્ખાઈ છે. રોવાનું ઘણું પડ્યું છે. આમાં શું રોવાનું? રાગદ્રેષરૂપી લુચ્યાઓએ, આ મહાન માનવજીવનમાં જ જે ઉત્તમ ચારિત્ર રત્ન લઈ શકાય, તે ન લેવા દીધું અને જીવને માયકાંગલો બનાવ્યો; નિઃસત્ત્વ બનાવ્યો. પણ હવે તેમાંથી પાછા હટવાનું કરવું, કે પાછું એ જ રાગ-દ્રેષની લોથ ઉપાડવી? કયું ધ્યાનમાં લેવા જેવું છે? કુમારે રાજ્ય પડાવી લીધું તોયે શું? ને ન પડાવ્યું હોત તોય શું? રાજ્ય હોત તોયે મરવું પડત, ને ન હોય તો પણ મરવું પડે! દુનિયાની સંપત્તિ ટકી તો પણ શું વિશેષતા, ને ગઈ તો યે શું ખોટ? જીવ્યાની વિશેષતા એ છે કે આ અસાર સંસારની વેઠ ત્યજી, જિનેશ્વરદેવના ચરણે બેસી જવાય! એ ન કર્યું અને રાગ-દ્રેષને પંપોળ્યા, તો એક જન્મ જ નહિ-પણ અનેક જન્મના મોત છે.

વિચારો- તમારા માથે કયું જોખમ મોટું છે? ક્યો ભય ભારે છે? :-

રાજના હદ્યમાં આવું બધું રમ્યા કરે છે, તો આવો દિવ્ય ઉપદેશ આપે છે! કે જેની એ અમૃતવાણીથી ભીજી ગયેલી રાણીઓ કહે છે કે “આપ કહો છો તેમજ છે. કાંઈ ફરક નથી.” રાજના દિલના ઉદ્ગાર છે! એ પાછા નિકટના સેહીના છે; વળી જાત પર વેઠીને કહેલા શબ્દો છે! એની અસર ભારે પડી. પરંતુ આ ક્યારે બને? એક માત્ર સારભૂત જિનેશ્વરદેવની વાણી જ ખારી લાગે ત્યારે; એ લાગ્યા પછી જીવનનું કર્તવ્ય એ વાણીએ ફરમાવેલું હોય તેજ હાડોહાડ ભાસી જાય ત્યારે! તે પાલન ન થાય ત્યાંસુધી હૈયામાં તેવો જ બેદ હોય. “અહો! મારું કેવું ધોર સાહસ! અધમ કેવો હું કર્તવ્ય કરવાના વખતે ચૂકી રહ્યો છું. જિનશાસનનો વિવેક ચૂકીને ચાલી રહ્યો છું.” જિનશાસનનો ક્યો વિવેક છે? એ કે તમારા માથે મોટું જોખમ કયું છે? મોટી નુકશાની કર્ય છે? તેનું માપ કાડો. કોની સાથે તમારા આત્માનો દીઘાતિદીર્ઘકાળનો સંબંધ છે, તે બરાબર ખ્યાલમાં રાખો. આ લક્ષમાં રહે તો ‘હાલતુ-ફાલતુ’ જગડા કે ઊંચ-નીચમાં જાતે ન બગડે. અરે! પરમાત્માનું શાસન પામ્યા છો, વિચાર તો તે કરો કે “જો હું સો ટચના સોના જેવો છું અને બીજો મને દોષિત કરે છે, તેટલા માત્રથી મારા માથે કોઈ મોટો ભય કે જોખમ આવતું નથી. જોખમ તો છે કે જો હું ગુસ્સો, ઘમંડ વગેરેથી તૃષ્ણા મમતા વગેરેથી મન બગાડી રહ્યો છું. ભય તો આવશે કે જો હું પાપની રમત રમી રહ્યો છું તો પૂર્વ કર્મનાં મોટાં પાપોનું જોખમ મોટું છે. મને એની ખબર

૨૦૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ખોટ ચુમાન તૃષ્ણા” (ભાગ-૨૨)

નથી તેથી કંઈ હું અકમ્ભી નથી, છૂપાં કર્મો પહેલાં જ છે. તે મને કઈ સ્થિતિમાં મૂકી દે તેનો પતો નથી. આની કોઈ ચિંતા નહિ, ને વર્તમાન અસાર વસ્તુ પાછળ ખરાબ લાગણીઓમાં અટવાઈ જવું એ શું !!”

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૫, તા. ૮-૧૦-૧૯૫૫

પ્રભુ કરતાં ઉદર વહેલો મોક્ષે :

ધર્મનાથ ભગવાનના સમોવસરણમાં એક ઉદરડો આવ્યો. ઊંચો થઈ થઈને પરમાત્માની વાણી સાંભળે છે.

આ જોઈને ઈન્દ્ર ભગવાનને પૂછે છે “પ્રભુ ! શું આ જીવની બહુ યોગ્યતા છે ? કે આમ નાચે છે !”

પ્રભુ કહે છે, “ઈન્દ્ર ! આ જીવ યોગ્ય તે કેવો, કે મારા ને તારા પહેલાં મોક્ષે જવાનો છે !”

શું આ ? પ્રભુના અને ઈન્દ્રના કર્મ હજુ લાંબા ચાલે તેવા ! ને ઉદરના જટ પતે તેવા !!

કોના છૂપાં કર્મ વધુ છે, તેની કોને ખબર ? “એવાં છૂપા કર્મ મારે ઉદયમાં આવે અને તે વખતે સમાધિનું જોમ ન હોય, સમતા ન હોય, તો મોટું જોખમ છે. માટે લાવ અત્યારથી જ સમતા-સમાધિને ખૂબ અભ્યાસથી સિદ્ધ કરી લઉં.” આ થવું જોઈએ. કેમકે એક બાજુએ છૂપા પૂર્વકર્મ અને બીજી બાજુ વર્તમાનમાં સતત વહેતા રાગદ્રેષ, એના જંગી જોખમો મોટા મેરુ જેવા જોખમ છે. તેને બાજુએ મૂકી તુચ્છ અને નાની બાબતમાં મનુષ્ય ઊંચો-નીચો થઈ જાય છે. ત્યારે તે કેવો પાગલ દેખાય છે ! એને ઘ્યાલ નથી કે ‘જ્યારે કુસંસ્કારોની સીરિએલ (ધારા) ઉત્તરશે ત્યારે તને ભારે લપેટામાં લેશે.’ રાજનો ટૂંકો પણ ઉપદેશ વિસ્તારથી વિચારીએ તો કલાકોના કલાકો જાય.

રાણીઓનો હદ્યપલટો :

સારરૂપે રાજાએ એ વાત બતાવી કે “તમને પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના અમોઘવચનો સાંભળવા મળેલાં છે. એથી તમે પૂર્વોપાર્કિત કર્મસ્થિતિને જાણો છો; અને નવા રાગદ્રેષ તથા હર્ષ કે શોક કરવાનાં કેવાં કટુફળ આવે છે તે પણ જાણો છો. તો પછી શોકની આ નિષ્ફળ રમત શી કરવી’તી ? જીવનમાં જો નક્કર કાર્ય બજાવવું હોય તો પ્રભુના વચન કહે છે, તે કરો.” ઉપદેશ સાંભળતાં રાણીઓનું શોકતુર હદ્ય પલટી ગયું. એ કબૂલ કરી લે છે કે “તમે જે કહો છો તે જ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાચિય કહા.” (ભાગ-૨૨)

૨૦૩

બરાબર છે. સંસારની માયાજળ ખોટી છે; બંધનો કારમા છે; વિષયોના વિપાક ભયંકર છે. માટે સંસારની માયા છોડી હવે ચારિત્ર જ લેવું છે. તો એ માર્ગ જવાની રજી માગીએ છીએ.”

આત્મા મૂઢ, દુર્ગુણી અને ઉચ્છ્રંખલ કેમ રહે છે ? :

રાજને વધુ ઉપદેશ આપવો ન પડ્યો. માત્ર પોતાના દિલમાં ધર્મનો, તત્ત્વનો અને સંસારના સ્વરૂપનો જે પ્રકાશ પ્રગટ્યો હતો, તેને અલ્ય શબ્દો દ્વારા રાણીઓ પર ફેંક્યો. બસ, તેટલામાં જ રાણીઓ તૈયાર થઈ ગઈ; અને સંયમમાર્ગ જવા રાજાની અનુજ્ઞા મેળવી લીધી. રાણીઓના તત્ત્વજ્ઞ હદ્યની કોમળતા વિચારવા જેવી છે. અત્યારે સંયોગ કેવો ઉપસ્થિત થયો છે !! આવા કપરા સમયે સંસારત્યાગ ! શું ? અંતરમાં અધ્યાત્મનાં અજવાળાં પ્રગટે તો જ સમયને ઓળખી કર્તવ્યના કપરા પણ માર્ગ ચઢી જવાય. રાણીઓએ કુમારની રજી લઈ ગંધર્વદત્તા નામના વિદ્યાધર સાધીજી પાસે ચારિત્ર અંગીકાર કર્યું. કુમારની રજી કેમ મળી ? કારણ એ હતું કે એમને હવે જીવતરની પણ પરવા નહોટી. તેથી કુમાર પાસેથી બળાત્કારે રજી મેળવી શક્યા. હૈયું વિચારક હોય તો એવી વિષમ પરિસ્થિતિ બનેલી જોયા પછી સંસારની માયા, મમતા અને એવા સંસારમાં જીવવાની પણ મમતા ન રહે એ સહજ છે. આત્મા મૂઢ, દુર્ગુણી અને ઉચ્છ્રંખલ કેમ રહ્યા કરે છે ? કારણ એ છે કે અસાર સંસારની માયા, ને સંસારી જીવન જીવવાની મમતા હૈયામાં આરપાર વસી ગઈ છે. તેથી સહેજે મૂઢતા, દુષ્ટતા, અને ઉચ્છ્રંખલતા કોટે લાગી છે. પછી વિષમ સ્થિતિ ઉપર સદ્વિચાર કરવો નથી. રાણીઓ તો ચારિત્ર માર્ગ સુધી ચઢી. જીવનમાં ગમે તે પ્રસંગ પામીને પણ આત્મા ધર્મમાર્ગ પર ચઢી જાય, તેજ તેની વિશેષતા છે. પછી ચાહે દુઃખના પ્રસંગને પામીને કે ચાહે સુખના. ડહાપણ એમાં છે કે કોઈ પણ પ્રસંગને આપણા ધર્મનો પ્રેરક બનાવી દેવો.

રાણીઓ માટે પ્રસંગ કેવો છે ? ગુણીયલ પતિની પુત્રના જ હાથે થતી મહા વિઠંબણા જોવાનો !

ત્યારે, રાજને પોતાના માટે પ્રસંગ કેવો બન્યો ? પોતે ગાઢી આપવા જેને જાય છે તે છોકરાએ જ તલવારનો ધા કર્યો ! આ કષાય કરવાનો, કલેશ વધારવાનો, ને મનને બગાડવાનો જે પ્રસંગ કહેવાય, તે જ પ્રસંગને રાજાએ ધર્મનો પ્રેરક બનાવી દીધો. કેવી રીતે ?

કેદમાં અનશન :

રાજને કેદખાનામાં પણ રોજ ને રોજ કદર્થના ચાલુ જ છે. છતાં ખૂબી એ છે કે જીવાયે કોધવશ ન થતાં વિચાર કરી લે છે કે “હવે મારું જીવિત આટલું

૨૦૪ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ખોટા ચુમાન તૃષ્ણા” (ભાગ-૨૨)

જ લાગે છે. તો પછી આરાધના શા માટે ગુમાવવી ? માટે મારે અનશન કરી લેવું તેજ ઉચિત છે.” એમ વિચારી રાજાએ શેષ જીવન માટે અનશન સ્વીકારી લીધું. કહો એવું થાય છે ને કે કોને ખબર ક્યારે દેહ પરી જાય ? ને આરાધના વિના જો પરી જાય તો અહીંયાં માનવ તરીકે શું આવ્યો ? મળેલા મહાદિવ્ય કાળમાં જ દિવ્ય સાધના કરી શકાય, તે ન કરી તો શું જીવ્યો ? જિનવચને રંગાયેલા રાજના ચિત્તમાં પુત્ર પર કોઈ રોષ નથી. ‘ધોકરો ખરાબ પાકયો.’ તેવું લેશ પણ નથી. તેમ એ પણ નથી ‘હાય ! રોજને રોજ માર ? ત્રાસ ?’ એટલું જ છે કે “હું ધર્મની આરાધનામાં રહું, એક સેકડ પણ મારી ધર્મ વિના ન જાઓ.” ધર્મની હૈયે સ્પર્શના થવાનાં ચિહ્ન વિચારજો. ‘હું ? શું એમ આ અન્યાય ચલાવી લઈએ ?’ આવા બહાના તો ઘણાં કર્યા. ધર્મ એ કરાવે છે કે ‘હા, આ અમારી પૂર્વ ભૂલોના વિપાક છે. આમાં ભૂલોનું પરિમાર્જન થઈ રહ્યું છે.’

આનંદકુમારનો ગુસ્સો :

પહેરગીરોએ જઈને આનંદકુમારને આ અનશનના ખબર આપ્યા. સાંભળતાં જ કુમાર ગુસ્સે થઈ ગયો. દેવશર્મા નામના માણસને બોલાવીને કહ્યું “જો, રાજાને ભોજન કરાવ. કહી દેજે કે ભોજન નહિ જમો તો હું નક્કી મારી નાખીશ.”

એનો એજ પ્રસંગ ધર્મપ્રેરક કે પાપપ્રેરક ? :

સિંહરાજા અને આનંદકુમાર બંને માણસ છે, પણ કેટલાં અંતર છે બેમાં ? યુગયુગનાં અંતર દેખાય છે. જે કંપુ પ્રસંગને સિંહરાજા ધર્મનો પ્રેરક બનાવે છે, તેની જગાએ કુમાર મનમાન્યો પ્રસંગ કરી પાપનો પ્રેરક બનાવે છે ! વિવેકની જ જરૂર છે. સાવધાનીની જરૂર છે. દુનિયા તો એની એજ રહેવાની. જે દુનિયા લાખો કરોડો વર્ષો પહેલાની, તેજ દુનિયા આજની દરેક જીવને એજ જગત મળવાનું, પણ વિવેકનો દીવો હોય તો પ્રસંગ ધર્મનો પ્રેરક બનાવાય; ને વિવેક વિનાનાં અંધાપાએ એ જ પ્રસંગ પાપનો પ્રેરક કરાય. પછી ભલે મોટો ચક્કવર્તી હોય, તો વિવેકના અભાવે પણ પાપની જ લીલા ! પાપમાં જ ઉંચે ચઢે ! એમ વિવેક નહિ હોય અને રંક થઈ જાય તોયે પાપ ! ત્યારે વિવેક હોય, જાગ્રત્ત હોય, તો ધર્મની મહાપ્રેરણ લેશે. ભિખારી તો રાજગૃહીનોય હતો, ને ભિખારી સંપ્રતિનોય જીવ હતો. બંને ભીખ માગવા નીકળ્યા હતા. બંનેને કોઈ ખાવાનું નહોતું આપતું. પરંતુ સંપ્રતિના જીવે દિશા ફેરવી, પ્રસંગને ધર્મનો પ્રેરક બનાવ્યો; તો ઉંચે ચઢી ગયો. ને પેલાએ પ્રસંગને પાપનો પ્રેરક બનાવ્યો તો ગયો સાતમી પાતાળે. પાસે બધું છે કે નથી પણ જો ડહાપણ ખોવાઈ ગયું, તો પાપનો જ વિકાસ થાય.

દેવશર્માની વિનંતિ :

કુમાર ગુર્સાથી કહેવરાવે છે. દેવશર્મા ગયો. રાજાને જુએ છે તો કદર્થનાથી શરીર કૃશ થઈ ગયું છે. એમને એ હાથ જોડીને કહે છે “દેવ ! જગતમાં એક દેવ એવું છે કે એને પરવશ પડેલા પ્રાણીઓની વિષમ સ્થિતિ થાય છે. પછી તો એમની સહેજે વિષમ કાર્યપદ્ધતિ બને છે. મહારાજ ! દેવની શી વાત કરીએ ? એ કાંઈ વિનયથી આરાધી શકાય નહે; અર્થાત્ દેવને ગમે તેવા કાલાવાલા કરો, છતાં એ પીગળે નહિ. ગુશવાનના ગુણો પણ દેવને વિસાતમાં નહિ ! એવાને પણ એ કનદે છે ! દેવ ચીજ એવી છે કે એ જીવને મનવાંછિતનો અવસર ન જુએ. ઈચ્છિત ફળવાનો અવસર આવે તે પહેલાં જ એને તોડી નાંખે. ખરું કહીએ તો લોકોને માટે એ અનર્થકારી છે. ઉન્મત હાથીની જેમ સ્વચ્છંદાચારી છે. તેથી ગંગાપ્રવાહની જેમ ક્યાંક સરણ, ને ક્યાંક તો કુટિલ છે. વળી કેમ જાણો, માણસની સામે આવી પડેલું મહાયુદ્ધ, તેને પાડવાને તૈયાર હોય તેમ આ ભાગ્ય એ ઉંચે ચઠેલા જીવને નીચે પાડવા-પદ્ધાડવા તૈયાર છે ! ઝેરની ગાંઢ જેમ રસોને અનુકૂળ નથી, તેમ આ દેવ પણ જીવના રસને માફિક નથી. તેમ જીવની ઝંખનાને પ્રતિકૂળ છે અને જીવના અણગમતાને એ અનુકૂળ છે. આમ છતાં ક્ષણવાર પણ મહારાજ ! આપણે પુરુષાર્થ મૂકી દેવો ઉચિત નથી. કેમકે પૂર્વોપાર્કિત કર્મને દેવ કહેવાય છે. એટલે એ જ્યારે પૂર્વના પુરુષાર્થી જ ઉપાર્જય છે, તો પછી એ જરૂર પુરુષાર્થી જિતાવા રહે છે. માટે જો પુરુષાર્થ રાખીએ તો બચી શકાય. નહિતર દબાઈ જવાય. માટે મારી આપને ખાસ વિનંતી છે કે આપ ઉદ્યમ જરૂર રાખો અને આહાર લ્યો. ‘જીવતો નર ભદ્રા પામે.’ માણસ જીવતો હોય તો અવસરે આપત્તિને ઓળંગી સંપત્તિને અવશ્ય પામે છે.” રાજાનો પરિવાર મહાલાયક છે ! સિંહરાજ કેવા છે, તે પરિવાર જાણે છે. એટલે રાજા આગળ જેમ તેમ બોલતા નથી. વિવેકથી બોલે છે ! ત્યારે સિંહરાજ પણ વંગ કરીને દેવશર્માના શબ્દોનો ઊંઘો અર્થ નથી લેતા; એક માત્ર ધર્મની પ્રેરક પ્રેરણ લે છે ! પેલાએ જ્યારે આટલું કહી દીધું કે, “તમે પુરુષાર્થ ન ગુમાવો અને આહાર લ્યો. માણસ જો જીવતો છે તો ક્યારેય આપત્તિ ઓળંગી સંપત્તિ જરૂર પામશે. માટે નિરાશ ન થતા પુરુષાર્થ બન્યા રહો.”

યોગ્ય પુરુષાર્થ :

સિંહરાજ ઉત્તર કરે છે, “જો દેવશર્મા, કાળને ઉચિત પુરુષાર્થ મેં છોડી દીધો જ નથી !” દેવશર્મા કયા પુરુષાર્થની વાત કરે છે, અને રાજા ક્યો પુરુષાર્થ બતાવે છે ? એ કહે છે, “તારી વાત બરાબર છે. જીવિત છે ત્યાં સુધી યોગ્ય

પુરુષાર્થ ન છોડવો. મેં તે જ કર્યું છે. હવે મારે યોગ્ય પુરુષાર્થ દીક્ષાનો છે. તેથી ભાવથી મેં પ્રવજ્યા સ્વીકારી લીધી છે; પરિગ્રહ હિંસાદી પાપોનો ત્યાગ કર્યો છે. તેથી હવે સંપત્તિ વગેરે પર મને કોઈ હિંસા નથી. વળી એમાં પણ ઉચ્ચિત કાળને સમજુ મેં અણસણ અંગીકાર કર્યું છે. તેથી જ હું આહાર ગ્રહણ કરતો નથી, કરવાનો નથી.” વર્ષોના વર્ષો સુધી આત્માને શ્રી જિનવચનનો કેટલો આરપાર રંગ લગાડ લગાડ કર્યો હોય; તેમજ જીવનમાં સમતાનો કેટકેટલો સચોટ અત્યાસ હોય, ત્યારે આવા મહાવિકટ પ્રસંગે ચિત્તમાં એક નાનો પણ કુવિકલ્પ ઉઠે નહિ ! કોઈ હાયવોય નહિ ! ને કોઈ બળાપો-વલોપાત નહિ !

દેવશર્મા મુંજાયો ‘રાજાની પ્રતિજ્ઞા એટલે ખલાસ !’ ત્યારે બીજી બાજુ પેલા કુમારે કહ્યું છે, ‘આહાર નહિ લે તો મારી નાખીશ !’ માટે આ કહે છે “આપ આહાર નહિ લ્યો તો કુમારને ગુસ્સો થશે !”

રાજા કહે છે “એને ગુસ્સો કરવાનું શું કારણ છે ? મેં પ્રતિજ્ઞા કરી છે, અને હું પાળી રહ્યો છું. કુમાર પણ જાણો છે કે તપસ્વીજનો પોતાની પ્રતિજ્ઞાને યથાર્થ પાળનારા હોય છે, માટે ગુસ્સે થવાનું કોઈ નિમિત્ત નથી.”

“પણ મહારાજ, આપ એના ચરિત્રને ક્યાં નથી જાણતા ? રખેને તે આપનો ઘાત ન કરો.”

કૂર કુમારનું આગમન :

દેવશર્મા જ્યાં આ કહી રહ્યો છે ત્યાં તો પેલો આનંદ ધૂંધવાઈ રહ્યો છે; “દેવશર્મને કેમ વાર લાગી ? હા, મારો બાપ માનતો નહિ હોય...હુરાગ્રહી છે...હવે બતાવી આપું...” એમ વિચારતો હાથમાં તલવાર લઈ એકદમ તે કેદખાનામાં આવ્યો. આવીને કહે છે,

“આહાર લેવો છે કે નહિ ? જો નહિ લેવો હોય તો જમરાજની જ્બ જેવી આ તલવારથી તમારું માથું વાઢી નાખીશ.”

સાંભળ્યા દીકરાના શબ્દો ? કહો, કોણ કોનું જગતમાં ? કોના વિશ્વાસે ચાલવાનું ? વર્તમાનમાં કદાચ આપણે ત્યાં ન દેખાય પણ જગતમાં આવા અનેક પ્રસંગો બનતા દેખાય તો અનુમાન તો થાય ને કે અંતિમ પરિણામ શું ? સંબંધ તૂટ્યા કે પછી સાંધા કરવા નકામા ! કેમકે સંસાર છે ! એવી સ્થિતિમાં જ્ઞાનીઓ કહે છે કે પરમાત્માનું શાસન પામી જગતની ઓળખ કરી, હદયને પ્રકાશમાં રાખવું જોઈએ, અંધકારમાં નહિ. પોતાનું સાચું હિતેધી કોણ છે એ વગેરે પોતાની સ્થિતિનો ઘ્યાલ કરીને નકલી હિતેધીના ખોટા મોહમાં તણાઈ સ્વાત્મહિત સાધન ગુમાવાય નહિ. પરભવની અત્યારથી તૈયારી કરી લેવી જોઈએ. નકલી હિતેધીઓ અવસરે

ફરી બેસે, દુશ્મન થઈને ઊભા રહે ત્યાં આપણાને ખેદ કે આશ્ર્ય ન થવું જોઈએ. કેમકે એ નકલી જ હતા.

રાજાનો ગંભીર ઉત્તર :

આવો નકલી સ્નેહી આનંદકુમાર જોરદાર ગુસ્સો બતાવી, હાથમાં તલવાર લઈ મારી નાંખવાની ધમકી બતાવે છે. સિંહરાજ જવાબ આપે છે : “હે નરવર ! હે શ્રેષ્ઠ પુરુષ ! જીવે દેહમાં કરેલા નિવાસને મરણના કાળ સુધીનો જ જે જાણો છે, એટલે કે મરણ થવા સાથે જ જીવને દેહવાસનો અંત આવી જવાનું જે જાણો છે, તે એવા અશાશ્વત અને અસાર દેહવાસને જ્યારે ક્યારેય પૂરું થવાનો અવસર આવે ત્યારે શોક શાનો કરે ? હા, જે એમ સમજતો હોય કે આ શરીરમાં મારે ટકી જ રહેવાનું છે, ને એમાંથી મને સુખ જ મલે છે, એને વહેલું કે મોહું, ગમે ત્યારે મરવાનું આવે તો હુંઘ થાય. એમાં વહેલું મોત આવ્યું તો તો હુઃખનો પાર નહિ. પણ જે જાણો છે કે આ દેહમાં હુઃખ જ ખીચોખીય ભરેલું છે, તો તેમાંથી જતા કોણ હુઃખ કરે ? આ દેહમાં જે આત્મા વસે છે, તેને જમરાજ જાણે કહે છે. ‘અદ્ધી પળે ખાલી કરાવીશ !’ એમાં પાછું થોડું વસવાનુંય સુખવાનું હોય તો ઠીક, પણ ના, આ તો સાવ પોકળ ! સુખના નામે હુઃખના પોટલાં !”

“રાજા કહે છે, “હે કુમાર, તું મને તલવારના થાથી મારવા માગે છે, તો મને જરાયે મરણથી ભય નથી. આ જીવે જન્મા ત્યારથી મરવાનું જ કામ કર્યું છે ! મરવું એટલે આયુષ્યનો ક્ષય થવો. તે તો જન્મથી માંદીને આયુષ્યનો ક્ષય ચાલુ જ છે. એવું આવીચિ મરણ પ્રત્યેક પળે ચાલુ છે. ત્યાં કોઈ માણસ અભિમાન કરે કે ‘હું મર્યાદ નથી, જીવતો છું !’ તો આને શું કહેવાય ?

અંજલિમાં પાણી લીધી પછી ટપક ટપક નીચે પડે છે. ત્યાં માણસ જો માને કે ‘મારી પાસેનું પાણી નાશ નથી પામતું,’ તો તે અજ્ઞાન છે. જન્મ થતાં સમજુ જ રાખવું જોઈએ કે ‘આ મોત થઈ રહ્યું છે.’ બધા જન્મ લેનારાઓ શું કરી રહ્યા છે ? અંતિમ મૃત્યુ અને પરલોક તરફ દોટ મૂકી રહ્યા છે ! કોઈ ટોળું પહેલું, તો કોઈ ટોળું પછી પહોંચે છે ! તેમાં ભયભીત થવાની શી જરૂર ? આપણા મનમાં નિર્ધારિત જોઈએ કે મરણ અવશ્ય નિશ્ચિત છે અને જીવન અનિશ્ચિત છે; કેમકે આપણે જીવનકાળ જાણતા નથી ! એનો અર્થ એ કે એક કંતલખાના આગળ પશુને બાંધી રાખ્યું; તેની જેવી દશા, તેવી જીવમાત્રની દશા. કંતલખાના આગળના બકરાને શી ખબર કે ક્યારે છરી ગળા પર ફરી વળશે ? એમ જીવને શી ખબર કે ક્યારે મૃત્યુની છરી જીવ પર ફરી વળશે ? પણ મરવાનું એ નક્કી; જીવવાની આશા નહિ. આ પરિસ્થિતિમાં એવા મૃત્યુથી ડરીને પોતાની સાધના ગુમાવવાનું

કોણ કરે ? માટે જ મેં મૃત્યુનો ભય ત્યજ અનશનની સાધના સ્વીકારી છે, તો મહાનુભાવ ! તું સમજ જા, કે આ મૃત્યુ તો શિકારી છે, એણે જરારૂપી ઘનુષ્ય રાખ્યું છે; અને એમાંથી વ્યાધિરૂપી બાણો ફેંકે છે. જીવોરૂપી મૃગલાં પર એનો શિકાર ચાલુ છે. આનો કોઈ પ્રતિકાર નથી. એટલે અને રોકી શકાય એમ નથી. સ્વચ્છંદ રીતે આ મૃત્યુ જગત પર ભમે છે, અને મોટા ઈંડ જેવાનોય શિકાર કરે છે. આ સમજને શાણા મનુષ્યો વારંવારના જન્મ-મૃત્યુથી કંટાળેલા હોય છે. તો એવા ભાગ્યશાળી જીવો જન્મ-જરા-મૃત્યુથી બેદ પામી શું કરે છે ? એના કારણભૂત સંસારરૂપી રોગને દૂર કરવા માટે અમૃત જેવા જિનવચનના રસાયણને અનુસરે છે.”

ખરેખર ! જગતમાં સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માનો ઉપદેશ એવો ચમત્કારિક છે કે એના અમલથી જન્મ-રોગ અને મૃત્યુના ઝેર હંમેશ માટે દૂર થઈ જાય છે. એ વિશિષ્ટ અમૃત રસાયણ છે. એનું કારણ એ છે કે જિનોપદેશ જન્મના મૂળ નિમિત્તને પકડી એને દૂર કરવાના ઉપાય બતાવે છે. જન્મ મટ્યા પછી રોગ અને મૃત્યુ તો આપોઆપ દૂર થઈ જાય છે. બાકી સંસારમાં જન્મનાં સાચાં નિમિત્ત શા છે તે જ્ઞાના વિના મોકશના ભજતા ઉપાય સાથે શું વળે ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ જન્મનાં નિમિત્ત છે. સિંહરાજા એને નિવારવાના પુરુષાર્થમાં છે; એટલે એમને અહીંના તાત્કાલિક મૃત્યુનો કોઈ જ ભય નથી. માટે જ,

રાજા આનંદકુમારને કહે છે, “જન્મ-મૃત્યુને મૂળથી નિવારનારું, તેથી જ પરિણામે મહાકલ્યાણને કરનારું એવું જિનવચન મને મળ્યું છે, તેથી ક્ષણિક મૃત્યુનો મને કોઈ ભય નથી. જે જનોએ ભવિષ્યના અનંત મૃત્યુ સામે પ્રતિકાર કરી લીધો છે; પાપમળને જેમણે ધોઈ નાખ્યો છે; કર્મબંધનની લોખંડી શુંખલાઓ જેમણે તોડી નાખી છે; તેવા મનુષ્યોને કાળમૃત્યુ શું કરી શકે ? માત્ર આ જીવનના સમયને મય્યાદિત કરતું આ મૃત્યુ એટલે કાઈ આત્માનો સર્વનાશ નથી; કે આત્માના ગુણોનો સર્વનાશ નથી. આ તો માત્ર આ જીવનની કાળમર્યાદાનો અંત લાવી બીજા જીવનની શરૂઆત કરી આપે છે. આત્માને એવા અનેક જીવનમાંથી પસાર થવાનું હોય છે.

‘બાકી જેણે તપરૂપી ધન ખૂબ ભેગું કરેલું છે, તેમ આ શરીર પર જેને બિલકુલ સ્પૃહા કે રાગ નથી, સંલેખનાથી જેણે શરીરને કસી લીધું છે; તેવા સર્યાચિની આત્મા માટે મરણ પણ શ્રેષ્ઠ છે.’

ગૃહસ્થપણે મહાત્મા બની શકાય ? :

હજુ સિંહરાજાએ સંસાર ત્યજ સાહુજીવન અને ગુરુકુલવાસનો અભ્યાસ કર્યો નથી. છતાં વૈરાગ્યદર્શા અને તત્ત્વદર્શિ કેટલી બધી ઊંચી કેળવી છે કે પોતાની છતી શક્તિ-સામગ્રીએ સગા દીકરાના હાથે તલવારના ધા ખાવાની કદર્થના સહન ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

કરે છે, અને તે વખતે દેહ-આત્માનું સાચું બેદજ્ઞાન તથા વિવેક ધરી અપૂર્વ સમાધિમાં વિહરે છે ! ત્યારે શું ગૃહસ્થ વેશમાં મહાત્માગીરી શક્ય નથી ? ધારીએ તો કેળવવી શું સંભવિત નથી ? બસ, મહાત્મા બનવા માટે સંસારના ભાવોનું સાચું દર્શન, અને અસાર એવા પર-પદાર્થો પર નફરત, વૈરાગ્ય સાથે આત્મવિવેક આ થવાની જરૂર છે. પછી તો મહાસહિષ્ણુતા, મહાસમાધિ, મહાનવીરતા વગેરે પ્રગટવાને કાઈ વાર નથી. ત્યારે મનુષ્ય જન્મ જેવી ઊંચી ડિગ્રી, ઉચ્ચ કક્ષા પામ્યા પછી એ દર્શન, વૈરાગ્ય અને વિવેક ન જગાડી શકીએ, ન જગાડીએ તો આ ડિગ્રીની કિંમત શી ? સિંહરાજાએ જિનવચનરૂપી રસાયણને પોતાના આત્મામાં એવું ઓતપ્રોત કરી દીધું છે કે માનવજન્મની ઉચ્ચ કક્ષાને યોગ્ય ઊંચી આત્મદશા અને તાત્ત્વિક ધોરણ પ્રગટાવી શક્યા છે. માટે જ ધાતકી પુત્રને કહે છે,

દેહવાસ અસાર-અસ્થિર શાથી ? :

જીવ આ દેહમાં આવાસ કર્યો તે અસાર અને અસ્થિર જાણી મરણ પર બેદ કોણ કરે ? અસાર એટલા માટે, કે જીવ દેહમાં વસીને તો પોતાના અનંત સુખથી વંચિત રહ્યો છે; પોતાની સ્વતંત્રતા અને અનંત સમૃદ્ધિના દર્શન નથી પામ્યો. કોઈ કેદ પૂરાયેલા રાજાની જેલ કોટી ગમે તેવી રંગેલી શાશગારેલી અને ગમે તેવા ખાનપાનની સગવડવાળી હોય, છતાં કેદી રાજ એમાં માલ માને ? ના ! કેમ ? કહો કે એ કેદ કોટીમાં પુરાવાના યોગે તો પોતાના રાજમહેલના સુખ, પોતાની સ્વતંત્રતા, અને મહાસમૃદ્ધિ એ બધાથી વંચિત બન્યો છે. બસ તેવી જ રીતે કાયામાં જીવનો વાસ માલ વિનાનો છે, અસાર છે. પાછો એ દેહવાસ અસ્થિર એટલા માટે છે કે એ મૃત્યુ સુધી જ છે અને મોત અવશ્યંભાવી છે.

પાછું આ મોત આયુષ્યના ક્ષયરૂપે તો ગર્ભથી માંડીને પ્રતિપળ ચાલુ છે.

પ્ર.- પણ કોઈ વહેલું ભરે તો હુંબ નહિ ?

૩.- ના નહિ, એક જ સાર્થમાં ચાલનારા પૈકીના કોઈ જરા આગળ જાય એમાં ભયનું શું કારણ ? બાકી કાયામાં જન્મરૂપી કસાઈવાડે બંધાયા પછી મરણ ન આવવાની આશા શી ? મરણ પારધી મોટા ઈંડનેય છોડે છે ? ત્યારે મરણને પાપનો, અપયશ થવાનો કે સામાના પ્રતિકારનોય કોઈ વિચાર છે ? ના, રાનમાં ફરતા સિંહને ભરગલાં ભરખતાં જેમ પાપ, કલંક વગેરેની કાઈ ગણત્રી નથી એવું મરણને જીવનો કોળિયો કરતાં કોઈ વિચાર નથી. પછી તાં જીવ મૃગલો મરણ સામે ફાંઝા મારે એ શું કામનું ?

પ્ર.- શું મરણ સામે ફાંઝા મારવા નકામા છે ?

૩.- હા, નવા જન્મ ન લેવા પડે એ પ્રયત્ન કારગત ખરો, બાકી જન્મા

એટલે મરણ નક્કી. જન્મ અટક્યા એટલે મરણ સહેજે અટકી જાય. ત્યારે એ પણ જેવા જેવું છે કે એકાદા મરણનું શું બહુ દુઃખ માણણું ? કે જ્યાં અનંતી અનંતી વાર જન્મવા મરવાનું થાય છે, એવા ભવરોગનું જ મોટું દુઃખ છે. તેથી એ ભવરોગ અને જન્મ-મરણની પીડાને મટાડી દેનાર જિનવચનરૂપી ઔષધ સેવી લેવું જોઈએ.

સિંહરાજ કહે છે ‘એ ઔષધ મેં પીધું છે. હવે મોતનો મને કોઈ ભય નથી.’
પ્ર.- છતાં ભાવીની ચિંતામાં શું મરણનો શોક ન થાય ?

ઉ.- થાય; પરંતુ જેણે જીવનમાંથી પ્રાણાતિપાતાદિ, કોધાદિ, અને રાગદ્વાદિના પાપનો મેલ ધોઈ નાખી અને અને નવાં કર્મબંધનને અટકાવી દીધાં છે, સાથે કેઈ પૂર્વ કર્મના બંધન તોડી નાખ્યા છે, એણે તો ભાવી ઉજ્જવળ બનાવી દીધું. પછી અને મોતનો ડર શો ?

પ્ર.- ત્યારે એ બધું છતાં, શું મરણ વખતનો શારીરિક ત્રાસ માણસને ન ગભરાવે ?

ઉ.- ના, મહાત્માઓએ આ જીવનમાં એકબાજુ તપના વ્યાયામથી શરીરને ઉગ્ર કષ્ટમાંય ખડતલ રહે, સહિષ્ણુ રહે એવું કેળવી લીધું છે; ને બીજી બાજુ શરીર ઉપર પણ નિસ્પૂહભાવ કેળવી લીધો છે. એટલે હવે તો જ્ઞાણ શરીર કેમ વહેલું ટળે ! એવી તૈયારી છે. કાયા જેવા કાટમાલમાંથી કમાણી કરી લીધી, અને પાછો કાટમાલનો મોહ રાખ્યો નથી; પછી એ નાશ પામીને, બીજી કોઈ નવી સારી જોગવાઈ થતી હોય તો ખોટું શું ? સારી જોગવાઈ એટલા માટે થઈ છે કે તપરૂપી ભાતું, સાધકે સાથે બાંધી લીધું છે. પાછો વળી આત્માને તો, આ કાયામાંથી છૂટકારો મળવા યોગ્ય કરી દીધો છે. તેથી જ ધીરપુરુષો ધૈર્યની સહાય વડે બિન્ન બિન્ન પ્રકારના મનોરથોથી એ છૂટકારાને, અર્થાત્ મૃત્યુને ઝંખી રહ્યા હોય છે. દા.ત. એ ભાવના ભાવે છે કે ‘ક્યારે હું ભક્તપચ્યક્ખાણ એટલે કે જીવનભરનું અનશન કરી દઉં !’ ‘ક્યારે હું ઈંગિની મરણ એટલે કે અનશન સાથે અમુક થોડી જ જગામાં અને કાયિક થોડી જ ચેષ્ટામાં જીવન સમાપ્ત કરું !’ ‘ક્યારે હું પાદપોપગમન અનશન કરું !’ અર્થાત્ વૃક્ષની જેમ જીવનભર નિશ્ચેષ પડી રહું !’ આવા આવા મનોરથ સેવે છે. શરીરના લીધે જ આત્માના અનંતશુદ્ધ સ્વરૂપમાં બિગાડો હોવાનું જોઈને શરીર ઉપર રાગ કયાંથી રહે ? એટલે જ મહાત્માને એવા એવા કોડ થાય છે કે ‘દેઠ દેહવાસના અંતને કરવાવાળા સુધીના મહાન ઉપસર્ગને હું ક્યારે સહું !’ ત્યાં એવા ઉપસર્ગથી પણ આવતું મરણ શોકરૂપ નહિ કિંતુ ઉત્સવરૂપ બને છે. ‘માણ્યું મધ્યાં’ ત્યાં હર્ષ જ હોયને ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૬, તા. ૧૫-૧૦-૧૯૫૫

મરણ એ ઉત્સવ શાથી ? :

ાંખ સામે અનંતકાળનો પટ, એમાં આત્માનું નવ નવા જન્મોમાં ભટકવું, અને એના કારણ તરીકે સાચા તપરૂપી ધન વિનાની જીવની દરિદ્ર ચીંથરેહાલ કંગાલ દશા, આ બધું રખ્યા કરે, તો પછી એવા ચક્કરો મિટાવી દેવા, તપ લક્ષ્મી ક્રમાવવામાં પાકો પુરુષાર્થ લગાવી દેવાય; ને ચિત્ત પણ વધુને વધુ પવિત્ર તથા ઉચ્ચ તત્ત્વ વિચારણામાં રમતું કરી રખાય. પછી તો આ બેથી અવશ્ય પાપમળ ધોવાઈ જવાનો, અને પરલોક માટે પુષ્યાઈ પણ અવશ્ય ઊભી થઈ જવાની. આવા આત્માને એ ભાવના રહેવાની કે માણું મરણ પંડિતમરણથી હો. કેમકે મરણ જો બગડે તો એક વાર તો દુર્ગતિમાં પટકાઈ જવું પડે છે. એટલે પોતાને લાગે છે કે જ્યાં સુધી પોતાની ચિત્તની સ્વસ્થતા છે, ત્યાં સુધીમાં ઈષ એવું પંડિતમરણ મળી જાય. આવું હોય પછી મરણ એ ઉત્સવરૂપ કેમ ન લાગે ?

પ્ર.- મરણ આવે એ કરતાં વધારે જીવવામાં ધર્મસાધના વધારે થાય ને ? પછી જીવન જ ઈથ્યે ?

ઉ.- પહેલાં એ વિચારો કે જીવન એ આપણી ઈચ્છાનુસાર વર્તે એમ છે ? બીજું એ જુઓ કે ત્યાં જીવનનો મોહ છે કે આરાધનાનો પ્રેમ ? કે મૃત્યુનો ડર છે ? યાદ રહે કે ઉચ્ચ ધર્મારાધકને જીવનનો લેશ માત્ર મોહ નથી, તેમ મૃત્યુનો લેશ પણ ભય નથી. ધર્મસાધનાનો રંગ છે. તે સાધના તો પંડિતમરણમાં કાંઈ ઓછી નથી દેખાતી. સાધનાનો આધાર એકલા વર્ષો ઉપર નથી. કેટલીકવાર સંયોગ-પરિસ્થિતિ અમુક પ્રકારના ઊભા થઈ ગયા, તો એમાં ઉચ્ચ સમભાવ સાથે ચિત્તની સમાધિથી અલ્પકાળમાયે ગજબ સાધના બની જાય છે. પછી એ ઉપસર્ગના અને યાવત્ મૃત્યુના પ્રસંગે હોય, તોય સાધકને બેદ શાનો ? સંતોષ, મહાસંતોષ હોય.

જિનવચનનું મહત્વ :

આ બધું જિનવચનરૂપી રસાયન મળ્યાના પ્રતાપે છે એ ખૂબ યાદ રાખવા જેવું છે. જગતમાં જિનવચનની બલિદારી છે કે,

(૧) જ્યાં ધર્મના નામે અર્ધમ નથી, પાપ નથી, ભોગવિલાસના ચેક વટાવવાના નથી, અજ્ઞાન દશા નથી. અસર્વજ્ઞ અને અવીતરાગના વચનમાં આ પંચાતીઓ છે. ત્યારે એમ થાય છે કે,

(૨) ‘અહો ! જગત ઉપર જિનવચન ન હોત તો જગતનું શું થાત !’

(૩) સંસારની દુર્ગતિઓ અને યાવત્ સંસાર પણ હવે ઉપાડવો ન પડે એવું કરી આપનાર જિનવચન છે.

(૪) આ જીવ ચૌદ રાજલોકમાં બધે ભટકી આવ્યો, બહુ અનુભવી આવ્યો, છતાં કશું નહિ જાણતા એવાને બધું જણાવનાર જિનવચન છે. એટલું જ નહિ પણ,

(૫) એ ભ્રમણ કેમ છે, જીવ-અજીવાદિનું સ્વરૂપ શું છે, ભ્રમણતા અને મોક્ષના કારણો તથા પ્રક્રિયા શી છે, ઈત્યાદિનો પ્રકાશ કરનાર જિનવચનરૂપી દીવો છે, સૂર્ય છે.

જિનવચનની દુર્લભતા :

જિનવચન પામવું બહુ દુર્લભ છે. આજે જગતમાં જોઈએ છીએ ને કે જિનવચન કેટલાને મળ્યું છે? જૈનકૃદ્ધમાં જન્મથી જિનવચન મળેલાને જિનવચનની દુર્લભતા કે મહત્તમ ન સમજાય એ એની ભારે કમનસીભી છે. એમાં એ પછી કેટલાય દીર્ઘકાળ માટે જિનવચન હારી જાય છે. બધું મળવું સહેલું છે, દેવલોકના દ્વિત્ય ઠાઈ પણ મળવા સહેલા ! થોડુંક અજ્ઞાન કષ્ટ કરો, ને દેવલોક મળો. પણ જિનવચન મળવું અતિ અતિ દોહિલું. એ મળવું સહેલું હોત તો જગતમાંથી ઘણાનો ઉદ્ધાર થઈ ગયો હોત. માત્ર વર્તમાન કાળ નહિ, પણ અનંતાનાંત કાળનો હિસાબ જોવામાં આવે તોય બીજા જીવો કરતાં જિનવચન પામેલા જીવો ઓછા મળવાના. એની સંખ્યા બહુ નાની. એવી બહુ નાની સંખ્યાવાળા ભાગ્યશાળીમાં આપણો નંબર લાગી ગયો છે. હજુ તો જગતમાં અનંતાનાંત જીવો એવા પણ્યા છે કે જેને આજ સુધીના કુલ જંગી અનંતા ભૂતકાળમાં જિનવચન મળ્યું નથી. અને હજુ અનંતા ભવિષ્યકાળમાં મળવાનું નથી. ત્યારે આપણાને અહીં તે મળી ગયું છે. કેવુંક મહદૂ ભાગ્ય !

જિનવચનની શું ? :

હવે એવા દુર્લભ જિનવચનનો ઉપયોગ શો? એ વિચારી યોગ્ય કરવાનું છે. જિનવચનનો મોટો ઉપયોગ ભવરોગ, સંસારરોગ કાઢવામાં છે કે જેથી મૂળ ભવરોગ ઉપર જીવને નીપજતી અનેકાનેક નાની મોટી વિટંબણા, પરાધીનતા, નાલેશી, વગરેનો અંત આવે. સંસાર છે ત્યાં સુધી આ બધું રહેવાનું. માણસ ફરિયાદ કરે કે ‘એમ તો છોકરાને સારી રીતે ઉછેર્યો હતો; પણ એ હવે હરામી પાક્યો, ને અમને વિટંબણા દે છે,’ પણ આ ફરિયાદ કરવા પૂર્વે ખરી રીતે એણે સમજવું જોઈએ કે વિટંબણા મૂળ સંસારને લીધે છે. સંસાર જ એવો છે કે એમાં સ્નેહી વૈરી થાય, સેવા કર્યાના બદલામાં ખાસડા મળે, આશાના ભુક્કા થાય. માટે હવે તો ભુવનભાનુ અન્સાઈકલોપીલિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

ઉહાપણ એ જોઈએ કે આવા મૂળભૂત સંસારરોગને કાઢનારું મહાસમર્થ જિનવચન મળ્યા પછી એજ કામ કરું. જિનવચન સંસારરોગને એ હિસાબે દૂર કરી આપે છે કે એ સંસારના કારણભૂત મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાણને હટાવવાના કીમિયા બતાવે છે; ઉપાય દર્શાવે છે; એ ઉપાય સાધવાનું બળ આપે છે, સાધેલાના દાખાનો દર્શાવે છે. જીવનની પ્રત્યેક પળ વીતે, ને એને જિનવચનની કોઈને કોઈ આરાધનાથી અંકિત કેમ કરતો જાઉં,’ એ તમના જોઈએ, એ પ્રયત્ન જોઈએ; પછી જીવન પણ ઉચ્ચ બને; અને મરણ મનગમતું મળે. માટે જ મહાત્માને મરણ પણ ઉત્સવરૂપ છે.

મૃત્યુ નાગ :

સિંહરાજા પુત્રને કહે છે “ત્યારે મૃત્યુની બીક રાખ્યે થોડું જ એનાથી બચાય છે ? મૃત્યુ તો કાળા નાગ બચ્યા જેવું છે. સતત સરી આવતા રોગો એના ચળકાટનાં કિરણો છે; અને અનેકાનેક આપદાઓ અને સંકટો એ એની લાંબી દાઢાનાં ઝેર છે. એવો એ નાગ પાછો વિશ્વવિહારી છે. પછી જીવ ક્યાં ભાગીને એનાથી બચી શકવાનો હતો ? મૃત્યુ આવીને જીવને પકડવા પૂર્વે જ જાણે કોઈ રોગોરૂપી કિરણો ફેરં છે; અને અનેક આપત્તિઓરૂપી ઝેર ફૂકે છે. આ રોગ-કિરણોનો વિસ્તાર અને સંકટ વિષના વિકાર જીવ પર આગળથી જ સાગ્રાજ્ય જમાવી દે પછી મૃત્યુને એકી કલમે જીવને ખતમ કરી દેવામાં શી વાર ? શી મહેનત ? દુનિયાના કોઈ પણ ખૂઝામાં જીવ સંતારી જાય, મરણ ત્યાં પહોંચી શકે છે. આવા જીવની સટોસટ લાગી ગયેલા મૃત્યુના આગમન વખતે શોક શો ?”

મૃત્યુ હાથી :

સિંહરાજા કુમારને કહે છે ‘મહાનુભાવ !’ જો કે મરણ એક જબરા હાથી જેવું છે. એની આગળ સંસારી જીવ એક તુચ્છ પ્રાણી છે. તેથી જ એણે મૃત્યુ સામે લડવું, અથવા મૃત્યુથી છૂટવા દૂર ભાગી જવું, કે મૃત્યુથી ગભરાયા ફંડવું, એ જરાય સફલ થાય એવું નથી; શોભાદાયી નથી. ખૂબી તો એ છે કે એ મૃત્યુરૂપી હાથીની જીવને પકડવાની સૂંધ દેખાતી નથી કે જેથી એ સૂંધથી આપણે દૂર રહીએ. છતાં અદ્યથપણે જીવને એ એવી દફતાથી, મજબૂતાઈથી પકડે છે કે જીવ કંગાલ એમાંથી શું છૂટી શકે ? જેની સામે યુદ્ધ, પલાયન, કે ગભરામણ, કાંઈ જ ન ચાલી શકે, કાંઈ જ કારગત થઈ ન શકે, એવા મૃત્યુને ઓળખી લીધા પછી, એની પરાધીનતાનો વિચાર કરવાને બદલે એ મૃત્યુ પછીની સારી સ્થિતિનોજ વિચાર કરવો ઉહાપણભર્યો અને સુખદાયી છે. જીવને સુકૃતોથી અજવાળી દેનાર ભવ્ય જીવ ભાવી સારી સ્થિતિને રજિસ્ટર્ડ કરી દે છે, નક્કી કરી દે છે. મૃત્યુ એ સારી

સ્થિતિમાં દાખલ થવા માટેનો ખુલ્લો દરવાજો છે. એ દરવાજો ખુલ્યે શોક શું કામ થાય ભાઈ ?”

મરણ એને ખેડૂત :

મહાત્મા સિંહરાજ પુત્રને કહે છે “બાકી ભાગ્યવાન ! જગતમાં જરા નજર નાખ કે ખેતરમાં યોગ્ય સમયે પાક તૈયાર થતાં પાકી ઉકેલા હજારો છોડવાઓની કેવી કુણા દશા ! ખેડૂત અને અનું કુટુંબ તીક્ષ્ણ દાતરડાં લઈને નીકળી પડે છે અને છોડવાઓને ખચોખચ લખી નાખે છે ! હવે ત્યાં કોઈ બહુ સારો પણ છોડવો હાયવોય કરવા લાગે, કે બચવા ફાંઝા મારે, એ કેટલું બધું કુજૂલ ? એણે તો નિરાતે સમજ્જજ રાખવાનું કે ‘જે બધાનું એ આપણું.’ એવી રીતે જમરાજ પણ ખેડૂત જેવો છે. ‘જે જન્મ્યા તેમને લખી લ્યો.’ આ એનો અનંતકાળથી ચાલ્યો આવતો ધંધો છે. માટે જ ઈન્દ્ર સરખાને પણ એની આગળ હાથ જોડવા પડે. જન્મવું છે અને મરવું નથી એ વાત અનંતકાળમાં નથી બની, નથી બનવાની. પછી શાશ્વત નિયમ મુજબ મૃત્યુ આવે એમાં ડર શો ? આનાકાની શી ? કે એનાથી બચવાના ફાંઝા શા ? મૃત્યુની સામે તો ભારે નિહિતતા જોઈએ; કે જેથી એનો ભય ન હોવાથી કોઈ પણ શક્ય ધર્મસાધના કરવામાં સંકોચ ન રહે, કમી ન રખાય. તેમ એના અચાનક આગમન વખતે પણ આત્મા પરમાત્માના અને આત્મસ્વરૂપના ચિંતનમાં સ્થિરપણે મસ્ત રહી શકે.”

મૃત્યુ પણ :

જે દેવતાઓને વિષે ઘડપણ, ઘસારો કે રોગવ્યાધિનું બિલકુલ નામ-નિશાન નથી, એવા દેવો ઉપર પણ જો મોતના ફાંસા સ્વચ્છન્દપણે વિચરે છે તો પછી વ્યાધિઓ, વૃદ્ધાવસ્થા, રોગ, શોક, વગેરે ઉપદ્રવોથી નિરંતર પીડાતા માનવીઓને વિષે તો એ મૃત્યુપાશના પ્રચારનું પૂછવું જ શું ? વ્યાધિઓ વગેરેથી દ્વારાયેલો તો અદ્યો મર્યાદ જેવો થઈ ગયો; ત્યાં જમરાજને પોતાની લીલા અજમાવતાં શી વાર ? એ તો એક પલકવાર પણ જીવ જે જીવી શકે છે, એમાં કાંઈ માણસની શાબાશી નથી; કાંઈ માણસનો મૃત્યુ પર થોડોય પ્રભાવ નથી; એમાં તો મૃત્યુનો જ પ્રમાદ છે; કે એ આવવામાં જરા વિલંબ કરે છે. નહિતર ખખડધજ મજબૂત કાયાવાળા દેવતાઓને પણ ફાંસવા સમર્થ એવા બળવાન મૃત્યુને રોગ-શોકાદિશી જર્જરિત માયકંગલા માનવને ફાંસતા શી વાર ?

કૃષ્ણ બધા ભય ટાળવા સમર્થ ? :

થાવચ્યાકુમારની એકેક પત્નીને આપેલું એકેક કોડનું ધન; એવી બત્તીસ એની પત્નીઓ. ત્યારે થાવચ્યાકુમારની પોતાની પાસે વળી બીજું ધન કેટલું ?

એવા થાવચ્યાકુમારને પણ જ્યાં ભગવાન નેમિનાથસ્વામીએ મૃત્યુનો ધર્મ સમજાવી દીધો અને સ્વાત્મરક્ષણ કરવાની ભવ્ય પ્રેરણા આપી દીધી કે ઉઠચા એ સંસારમાંથી; ને ચારિત્રની તૈયારીવાળા બની ગયા. કૃષ્ણ વાસુદેવ એમના પર ઓવારી જાય છે, એમના ઘેર પોતે આવે છે; અને એમને કહે છે,

“તું શા માટે સંસાર ત્યજે છે ? તારી પાસે વૈભવ-વિલાસની સામગ્રીનો પાર નથી. હા, તને જો કોઈના પરાભવનો ભય હોય તો હું, લાવ, ઢંઢેરો પીઠાવી દઉં કે ‘એકમાત્ર પવનને છોડીને જો કોઈએ પણ થાવચ્યાકુમાર પર આંગળીય ચિંધી છે તો વાસુદેવ એની ખબર લઈ નાખશે’ તારા માથે વહેતા પવન ઉપર મારું ચાલે એવું નથી. બાકી તને કોઈનો ય ભય રહેવા ન દઉં.” થાવચ્યાકુમારે જવાબ શો દીધો, જાણો છો ? આ-

“હા, હા, મહારાજ ! તો તો મારે દીક્ષા લેવાની જરૂર ન રહે, જો આપ એમ બધા ભય નહિ, માત્ર એક મૃત્યુનો ભય, મૃત્યુનો હલ્લો મારા માથેથી ટાળી દેતા હો.”

વૈદના દેણાંતે મૃત્યુ પર દેખ ન કરો :- કૃષ્ણે હાથ જોડ્યા; કહ્યું “જ ભાઈ ! જા, મારા મૃત્યુને જ અટકાવવા હું સમર્થ નથી, ત્યાં તારા મૃત્યુનો ભય ટાળી શકવાની શી વાત ?”

જન્મ્યાની બીજી મિનિટે મૃત્યુને આવવું હોય તો આવી શકે છે. એટલે તો થાવચ્યાપુત્રને તરત જ ચારિત્ર જીવનમાં પેસી જવાની તાલાવેલી જાગી છે. ધીર પુરુષો આંખ સામે એવા મૃત્યુને જોતાં જટ આત્મહિતની સાધનામાં લીન બની જાય છે. સાવધાની એ જોઈએ, કે જે ધર્મ હાથમાં આવે એને સાધી લ્યો; કારણ કે મૃત્યુના પ્રમાણે જીવી શકીએ છીએ. સારું છે, મૃત્યુ વિષયસુખોની અને વૈભવ-સમૃદ્ધિની અંતે અસારતા સૂચવે છે, પોકળતા પૂરવાર કરે છે ! તેથી જ માણસ ધર્મને શરણે જાય છે. એવા મૃત્યુ પર દેખ શા માટે ? જે વૈદ્યની કડવી દવાઓ અને લાંબી કષમય ચિકિત્સાવિધિ એમ સૂચવે છે કે ‘સીધા ચાલજો, કુપથ્ય સેવતા નહિ; નહિતર મારા પરવશ પડવું પડશે;’ અને એમ કહીને કુપથ્યથી દૂર રાખી આરોગ્યના નિયમો બરાબર પળાવે છે, એવા વૈદ્ય, અને એના ઔષધચિકિત્સા ઉપર શું દેખ કરાય છે ? તો પછી મૃત્યુ પર દેખ શા માટે ? મૃત્યુ જાણે કહે છે ‘પાપકુપથ્ય સેવતા નહિ. ધર્મનો મુજબ ચાલજો. નહિતર હું એકી કલમે તમારા બધા ચાળા ભૂલાવી દેવાનો છું.’ ત્યારે પૂછોને,

પ્ર.- પણ દવા કરતાં મૃત્યુમાં ફેર છે. ત્યાં તો આરોગ્યના નિયમ સાચવીએ તો કડવી દવાને પરવશ નથી પડવું પડતું. ત્યારે અહીં તો ગમે તેટલો ધર્મ કરો

પાપકુપથ ન સેવો તોય મૃત્યુ તો પાછું આવે જ છે. એ થોહું અટકે છે ?

ઉ.- ખરી વાત. પરંતુ એટલું સમજ લેજો કે એ મૃત્યુ જુહું. મૃત્યુ મૃત્યુમાં ફરક છે. ધર્મજીવન પછીનું મૃત્યુ તો નીચી પાયરીમાંથી ઊંચી પાયરીમાં મૂકનારો ટ્રાન્સફર-ઓર્ડર છે. જેમ સારી નોકરી બજાવ્યાથી સરકારી હુકમ આવે કે તમારી સ્મોલકોઝ કોર્ટના જજમાંથી હાઇકોર્ટના જજ તરરીકે બદલી કરવામાં આવે છે, તો શું એ બદલી હુકમ ઉપર દેખ થાય ? ના. તો બસ એજ રીતે મૃત્યુ ઊંચી રિથ્યિતિએ બદલી કરી આપે છે. એ તો ઊલંઘું સારું કહેવાય. એના પર દેખ શો ? એથી ડરવાનું શું ?

મહાત્મા સિંહરાજ બહુ પ્રેમથી કહે છે,

કુળને કલંક ન લગાડ :- “જો ભાઈ ! અવશ્યંભાવી મૃત્યુને સુકૃતોથીજ સુધારી શકાય એમ છે. તો પછી તું અધીરા માણસોથી અવલંબાતા અપયશને અવકાશ ન આપ. મારી નાખવાની અપયશકારી કરણી એ સુકૃત નથી. એથી આત્માને મૃત્યુ નથી તો એકદમ અટકતું કે નથી તો સુધરતું. ત્યારે બીજી એ પણ વસ્તુ છે કે માણસ કોઈને મારી નાખવાનો અપયશ ન લે, તોય સામો કાંઈ અમર બની શકતો નથી. મૃત્યુની દાઢથી ચટાયેલાને ઈન્દ્ર પણ બચાવી શકતો નથી; મૃત્યુદાઠ તરફ આકર્ષયેલાને પાછો વાળવા માટે મોટો સુરેન્દ્ર પણ સમર્થ નથી. એટલે આપણને એમ લાગતું હોય કે સામો માણસ જીવતો ન રહેવો જોઈએ, તો સમજું રાખ કે આમેય એ કાયમ જીવતો નથી જ રહી શકવાનો. પછી આપણે મારવાની ઉત્તરવણ શા માટે કરવી ? મારવાનું કલંકિત કાર્ય શા સારું કરવું ?”

સિંહરાજર્ઝ કહે છે ‘જો, મેં તો યાવજજીવનું અનશન એટલે આહારત્યાગ કરીને મૃત્યુ સ્વીકારી લીધું છે. હું હવે મર્યા જેવો થઈ ગયો છું. પણ તું મને મરેલાને મારવા માત્રથી હે વત્સ ! નિજકુળને કલંકિત શા માટે કરે ? મૃત્યુની મારે નવાઈ નથી; લાંબો વિલંબ નથી; પણ તું કુળને કલંક લગાડશે. તું જ કહે પ્રતિજ્ઞાપૂર્વક ત્યજેલા આહારને હું કેવી રીતે લઉં ?’

રાજાની અમરવાણીમાં શું શું ? :

ગૃહસ્થવેશમાં રહેલા સિંહરાજાની આ અમર વાણી છે. એ ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે, વારંવાર વિચારવા જેવી છે. એમાં (૧) મૃત્યુતત્ત્વનું મહાજ્ઞાન ભરેલું છે. (૨) અવસરે વનવગડે ચકવર્તી છ ખંડ ગુમાવવાનું પણ દુઃખ સહશે, પણ જે મૃત્યુના દુઃખને બનશે તો દૂર રાખશે; એવા મહાન દુઃખદ મૃત્યુ પ્રત્યે પણ અન્યાન્ય નીડર કેમ બનાય, એની ભવ્ય પ્રેરણા આ મહાત્માની વાણીમાં છે ! (૩) માણસ, ધારે તો ગૃહસ્થપણે પણ કેટલી બધી ઊંચી તાત્ત્વિક વિચારસરણી, અને

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨૧૭

સાત્ત્વિક વલણ સુધી પહોંચી શકે છે ! એનો આમાં ઘ્યાલ આવે છે. વળી રાજાના ઉપદેશમાં માત્ર મૃત્યુ સામે નીડરતાની જ પ્રેરણા નથી, પરંતુ (૪) એ પૂર્વે સુકૃતો આચયરી લેવાનો એ મહાન કર્તવ્યનાંદ છે. જિનવચનની લગની, પાપમળનો નાશ, બાધ્ય-આત્મનાર તપની સાધના, વગેરેથી જીવનને ધન્ય બનાવવાની પણ મહાન પ્રેરણા એમાં છે. રાજાએ ગુણસેન પછીના માત્ર આ બીજા જ ભવમાં માનસ કેવું મહાન વિચારક બનાવી દીધું ! મન પરજ આધાર છે ને ? મન વિચાર કરે કે ‘હાય ! છોકરો ઊંધો પાક્યો ? બતાવી દઉં એ હરામીને ! હાય મારે મરવાનું !’...આમ કાયર વિચારમાં ચઢે તો બધું ઊંધું ! પણ ના, આ તો પહેલેથી વિચારણ જ સીધી પછી શું અવળું થાય ? સાવધાની જોઈએ; ઉચ્ચ માનવક્ષણાના મૂલ્યાંકન જોઈએ. ઘઉંને કેળવીને ઘેખર બનાવાય છે, એમ પોતાના આત્માને કેળવીને મહાત્મા બનાવી શકાય છે. કેળવણીમાં પહેલા નંબરે મનને તત્ત્વવિચાર અને સત્ત્વ વલણ વળગાડી દેવા જોઈએ.

આનંદ તલવાર મારે છે :

મહાત્મા સિંહરાજાના બોલ તો તત્ત્વ નીતરતા છે, સાથેજ મહા વીરતાભર્યા, અને પુત્ર પરના વાત્સલ્યથી છલકાતા છે. છતાં પૂર્વના નિદાનને લઈ આવેલા આનંદુમારને એની જાણો ઊલટી ઊંધી અસર થાય છે. તે કોધાજિનથી લાલચોળ આંખોવાળો બની કહે છે, ‘હજ્ય કેમ બોલો છો ?’ એમ કહેતોક કઠોર તલવારનો ધા પિતાના મસ્તક પર લગાવી દે છે ! એજ વખતે તત્ત્વના જ્ઞાતા સિંહરાજ ‘નમો જિણાણ’ જિનને નમું છું’ ચિંતવે છે ! સાથે જ પોતાને એ ધા લાગવામાં પણ પોતાનાજ પૂર્વકૃત કર્મનો દોષ છે એમ વિશુદ્ધ ભાવથી વિચારે છે ! કેવી અદ્ભુત સમાધિ ! ધન્ય જીવન !

સમાધિના બે મહાસાધન :

એક જિન નમન; બીજું સ્વકર્મસ્મરણ. એમાં જિનનમન માટે ‘નમો જિણાણ’ પદ આ પદના પાંચ અક્ષરમાં તો મિથ્યાત્વાદિ પાંચ બંધનોથી છૂટી પંચમ જ્ઞાન અને પંચમી ગતિ સાધવાની ચાવી છે. જગતમાં શ્રી જિનેશ્વરદેવનું નામ-સ્વરૂપ, જીવન, ચારિત્ર વગેરે બધું પરમ પવિત્ર છે. એનું આલંબન શ્રેષ્ઠ આલંબન છે. એમાં ‘નમો જિણાણ’ એમ ખાલી નમસ્કાર કે જિનનામનું ઉચ્ચારણ પણ જીવને જિન બનાવવા સમર્થ નીવડે છે. દિનભર ‘નમો જિણાણ’ની રટણ થઈ જવી જોઈએ. કરો છો ને ? અરે ! માત્ર મંદિરમાં પણ, શું પાપાણના કે શું ધાતુના, દરેક દરેક જિનબિનબના મુખારવિંદ જુદા જુદા જોતાં ‘નમો જિણાણ,’ ‘નમો જિણાણ’ બોલતા જાઓ છો ને ? ના ? ત્યારે દેરાસરે બહુ ભગવાન શા સારુ રાખ્યા છે ? તમારે

૨૧૮ સુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સમાધિના બે મહાસાધન” (ભાગ-૨૨)

એ બધા સાથે શો સંબંધ ? તમારે એમની સાથે કાંઈ લાગેવળગે છે ખરું કે નહિ ? ધન્ય તમારો અવતાર ! ધન્ય તમારી આંખો ! આપણે તો હાલતાં ચાલતાં ‘નમો જિષાણાં’ની રટણા ઊભી કરવી છે. ‘જિનવર નામે મંગળિ કોડ’ શ્રદ્ધા છે ? શી ? કરોડો મંગળ એક માત્ર જિન નામથી નીપજે. ગભરાતા નહિ કે ‘ત્યારે તો બીજું બધું નકામું, માટે મૂકી દેવું પડે !’ આ મૂકવાની વાત નથી, પણ બધા ઝેરને વારંવારના જિનનામ રૂપી અમૃતથી-‘નમો જિષાણાં’ના અમૃતથી-સીચી દેવાની વાત છે. કન્યાના સારા મુરતિયા સાથે વિવાહ થયાથી માંડીને કન્યાને પતિના સ્મરણની રઢ લાગે છે ! વારંવાર પતિનું શરણ અદ્ભુત મીઠાશથી યાદ કરે છે ! જિનના સ્મરણની, ને જિનને નમસ્કારની એવી રઢ લગાડી દેવી જોઈએ. માનવદેહે કંઈક પણ તત્ત્વ જાણ્યા સમજ્યાની પહેલી નિશાની, પહેલું કર્તવ્ય આ, કે જિનને નમો, જિનને સ્મરો.

સ્વકર્મસમરણ :

સિંહરાજર્ષિના માથે પુત્ર તલવારનો ઘા જીકતા રાજર્ષિ પૂર્ણ શાંતિથી ‘નમો જિષાણાં’ સ્મરે છે; જિનને નમે છે. સાથે વિચારે છે કે “આ પીડા આવવામાં મારા જ પૂર્વ કર્મનો દોષ છે. કેમકે આ જીવને જગતમાં અનુકૂળ-પ્રતિકૂળ મળવામાં બીજાઓ તો નિમિત્ત માત્ર છે; ખરું કારણ તો પોતાના પૂર્વકૃત કર્મો છે. પોતે પૂર્વે જેવાં કર્મ ઉપાજ્યા હોય તે પ્રમાણે અહીં એનો ફળ-વિપાક આવે છે. બધાં જ સારાં-નરસાં ફળના ઉદ્ય મળવામાં પોતાનાં જ પૂર્વોપાર્કિત કર્મ કારણ છે. તો ખરો દોષ એ કર્મનો અને કર્મ કરનાર પોતાના આત્માનો છે. એમાં બીજાને શો દોષ દેવો ? પોતાના કર્મનો દોષ જોવાથી ૧. સાવધાની રહે છે, ૨. શાંતિ રહે છે, ૩. સારી ભાવના રહે છે. ૪. બીજા પરના ખોટા દ્વેષ-દુર્ધ્વાન, દીનતા વગેરે કરવા પડતા નથી. કર્મની વિચારણા એટલે તત્ત્વની વિચારણા અને ‘નમો જિષાણાં’ એટલે અરિહંત શરણ-આ બે સુંદર આલંબન છે.


રાજાનું મૃત્યુ :

રાજાએ ‘નમો જિષાણાં’નું ધ્યાન ધરી લીધું; અને જૈનશાસનનો અટલ સિદ્ધાંત, “જીવે પોતાના જ કરેલાં કર્મનાં ફળનો વિપાક પામવો રહે છે; ચાહે જીવને સારું થાય કે નરસું થાય, પણ મુખ્ય તો કર્મ જ કારણ છે. બાકી તો બધાં નિમિત્ત છે.” આ ભાવનામાં રાજા દૃઢ થાય છે. ત્યાં પેલો કૂર પાપાત્મા કુમાર ફરીથી ખડુગનો ઘા કરીને રાજાને મૃત્યુ પમાડી દે છે ! કલુષિત ચિત્તવાળા અધમપુત્રે નિષ્યાપ ચિત્તવાળા મહાત્મા પિતાનો નાશ કરી દીધો ! બસ, અનંતસંસારના આંધણ આમ જ મૂકાય છે; અનંતા દુઃખનાં રાંધણા આમ જ તૈયાર થાય છે.

કુમારે રાજાને મારી નાખ્યો પણ એમાં રાજાનું શું બગડ્યું ? રાજાએ તો માનવશરીરનો ત્યાગ કરી દિવ્ય શરીર ધારણ કર્યું. ગીજા દેવલોકમાં રાજા ચાલી ગયા. આનંદ મરીને ગયો હલી નરકમાં.

જીવન તો જીવવાનું જ છે, પણ એક જીવન ચિત્તના ભયંકર સંકલેશમાં, કોઈ દુષ્ટ વિચારણામાં, અને કોઈ અધમ કરણીમાં વીતે છે; ત્યારે બીજું, સુંદર પવિત્ર ચિત્તવૃત્તિમાં, અને ઉત્તમ કાર્યસરણીમાં વીતે છે. મરવાનું પણ એવું જ. એક જીવ મહાસમાધિ અને સ્વાત્મવિચારમાં મરે છે. તો બીજો ધોર કલેશ અને કૂર વિચારમાં મરે છે. આનંદકુમાર એવી રીતે મર્યો તેથી માત્ર નરકમાં ગયો એટલું જ નહિ, પણ દીર્ઘસંસાર ઉપાર્જન કરનાર બન્યો.

-: સમરાદિત્ય-બીજો ભવ સમાપ્ત :-



સમરાદિત્ય શ્રીજી ભવ શિખી અને જાલિની

સમરાદિત્યકેવળી મહર્ષિના મનુષ્યના નવ ભવમાં ઘણા ઘણા પ્રકારની ઉત્તમ ઉત્તમ સાધનાઓ આપણાને જોવા મળે છે. તેમાં મુખ્ય સાધના ક્ષમા-સમતાની. એની સાથેની સાધનામાં સુયોગ્ય માનવતાના અનેક ગુણ, તથા પ્રથમના બે ભવમાં બાધાથી જો કે ચારિત્ર ન લઈ શક્યા, ભાવના હોવા છતાં, તૈયારી પૂરી હોવા છતાં, અને નિકટમાં ચારિત્ર લેવાનું હોવા છતાં ચારિત્ર વેશ ન લઈ શક્યા, પણ ચારિત્રની સાધનામય અવસ્થા તો બનાવી દીધી. હવે અહીં શ્રીજી ભવમાં આરાધના કેવી આગળ વધે છે, તે બતાવે છે.

કૌશામ્ભનગર :

જંબુદ્ધીપમાં પશ્ચિમ મહાવિદેહકેત્રમાં કૌશામ્ભ નામનું નગર છે; વિશાળ નગર છે; વસ્તી પણ ઘણી છે. સ્થાન તરીકે એવું સરસ સ્થાન છે કે જ્યાં વ્યાધિ-રોગની પીડાઓ નથી; પરશત્રુના આકમણનો ભય નથી; ઋષિ-સમૃદ્ધિય ભરપૂર હોવાથી સુંદર નગરોમાં નાયક તુલ્ય આ નગર છે. તેવા તે નગરને વિષે સ્ત્રીઓ કેવી હતી ? સરળ સ્વભાવી ! સામાન્ય રીતે સ્વીજાતિ કપટના સ્વભાવવાળી ગણાય. પણ અહીંના કેત્રની વિશેષતામાં સ્વીવર્ગ સરળ હતો. વળી કુલીનતા મુજબ જે સ્થાને સ્નેહ થયો, તેને સ્થિર રાખનારો અને તેમાં સંતોષ માનનારો હતો. પુષ્યવાન હોવાથી સ્ત્રીઓ કામદેવની રાજ્યાની સમી રૂપવાન હતી. પૂર્વ આચરેલા ધર્મનું જ ફળ સમાન હતી ! અર્થાત્ જેણે પૂર્વમાં ધર્મની સાધના કરી છે, તેને સ્ત્રી સુયોગ્ય જ મળવી જોઈએ, એવો પુષ્યનો નિયમ. બસ, તેવી સ્ત્રીઓ હતી અહીંની.

ત્યારે એ નગરમાં પુરુષ વર્ગ પણ પ્રિયભાષી, સત્યવક્તા, પ્રથમભાષી અને ધર્મરક્ત હતો. એમનું હૃદય કોમળ માટે પ્રિય બોલે, આત્મા ઊંચા માટે સાચું બોલે, મન નમ તેથી સામે મળેલાને પહેલાં પોતે બોલાવે; અને જીવન આખુંય પાપભીરુ તેથી ધર્મરક્ત બહુ. કેવો સરસ લોક !

ત્યાં અજિતસેન રાજી હતો; પરાક્રમી હતો. અનેક યુદ્ધોમાં અનેક ધમંડી રાજાઓને એણે પરાસ્ત કરેલા; જે હવે ચરણે નમતા હતા. એ રાજાને ઈન્દ્રશર્મ નામે એક મંત્રી હતો. બીજો પણ એને એક બુદ્ધિસાગર નામનો મંત્રી હતો.

ઈન્દ્રશર્મ બ્રાહ્મણ છે; આખા રાજ્યની ચિંતા કરનારો છે; અને રાજ્યને તે બહુ જ અનન્ય જેવો થઈ ગયો છે.

પુત્ર માતા :-

હવે એ જુઓ કે આપણા ચરિત્રના મુખ્ય પાત્રોનું શું થાય છે. અન્નિશર્મનો જીવ બીજા મનુષ્ય ભવમાં થયેલો આનંદુકુમાર, તેણે નરકમાં એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી કંઈક ન્યૂન એવા ચાર સાગરોપમનો કાળ સંસાર ભમવામાં કાઢ્યો. આંટા વીંટવાની મહેનત થોડી; ઉકેલવાની કેટલી મોટી મહેનત ! આનંદના ભવમાં પોતાના આત્મા પર પાપના આંટા વીંટચા, તે ઉકેલવા કેટલો દીર્ઘ સંસાર ભમ્યો ? ત્યાંથી છેલ્લે કંઈક અકામ નિર્જરા કરીને ઈન્દ્રશર્મ મંત્રીની શુભંકરા પત્નીના પેટે પુત્રી તરીકે જન્મ્યો ! નામ જાલિની. અહીં બુદ્ધિસાગર મંત્રીનો પુત્ર હતો બ્રહ્મદંત. તેની સાથે આ જાલિનીના લગ્ન કરવામાં આવ્યાં. એમાં ભવિતવ્યતા કેવી વિલક્ષણ કે સિંહરાજાનો જીવ દેવલોકમાંથી આવીને આ જાલિનીની કુક્ષિમાં આવ્યો. આ ગોઠવણ કોણે કરી આપી ?

ભવિતવ્યતાની બળવતા :-

ભવિતવ્યતા બળવાન કહેવી પડે. ન ઈચ્છાએ એવું પણ જગતમાં અણધાર્યું બની આવે છે ને ? એમાં શું આત્માની સ્વતંત્રતા કહેવાય કે પરતંત્રતા ? એ દૂર હઠાવી શક્ય કે વેઠચે જ છૂટકો ? તો પછી ઝોગટ સંતાપો જે છગલાબંધ કરીએ છીએ તે વ્યાજભી છે ? આ એક મંત્ર શીખી રાખો, ‘બળવાન ભાવી (ભવિતવ્યતા) જે સર્જ લાવે એમાં સંતાપ ન કરતાં, વીરતાથી એને નભાવી લેવું.’ કારણ એકજ કે એ ભવિતવ્યતા આપણા કરતાં એવી બળવાન છે કે આપણો કશો સામનો ઉપજવા નહિ દે. પછી શા માટે આનંદપૂર્વક સહી લેવાની, અનુકૂલ તરીકે નભાવી લેવાની શક્તિ ન કેળવવી ? ત્યારે એ વસ્તુ સમજવા જેવી છે કે માણસનાં કેટલાંય દુઃખ પૈસાની ન્યૂનતાના નથી, કે કુટુંબની મનમાની અનુકૂળતા ન હોવાના નથી; પરંતુ દુઃખ ભવિતવ્યતાને ન વધાવી લેવાના છે. ‘મારે તો ભવિતવ્યતા ઘણી સારી છે કે મને આ જગતમાં બીજા અગાધિત જીવો કરતાં આટલી બધી અનુકૂળતા તો મળી છે !’ આ વિચાર જોઈએ. ‘ભવિતવ્યતાથી કુદરતમાં અનેક સર્જનની જેમ માટું, મારા સંયોગનું પણ એક સર્જન છે. એથી મારા આત્માએ મુંજાવાનું નથી; ઉદાસીન રહેવાનું છે.’ આ વિચારણ રખાય.

સંસારની વિચિત્રતા :-

અહીં ખૂબી કેવી થઈ કે પૂર્વે બીજા ભવમાં સમરાદિત્યનો જીવ સિંહરાજ હતો અને દુષ્મનાવટ કરનાર અન્નિશર્મ એ પુત્ર આનંદ હતો. હવે અહીં એજ

પુત્ર માતા બને છે, એ પિતા એનો પુત્ર બને છે ! કર્મના અચિંત્ય પ્રભાવે સંસારમાં કેવીક વિચિત્રતાઓના નિર્માણ થાય છે ! માટેજ બહુ રાગ કે ઈતરાજી કરવા જેવી નથી. એવા પોકળ સ્નેહ માથે ઊંચડી-ઉંચડીને પરમાત્માને ભૂલવા જેવા નથી.

માતા જાલિનીને સ્વખ :-

જાલિની માતા હુષ હૃદયવાળી છે, છતાં હવે ગર્ભ રહેવાથી માંડીને જેવો પુત્ર, તેવાં ચિંઠનો ! પુત્ર સમરાદિત્યનો જીવ છે, તેથી હુષ એવી પણ જાલિનીને સુંદર સ્વખન આવ્યું ! શું ? સુવર્ણમય એક ઘડો પોતાના પેટમાં પેઠો; પણ એને આનંદ ન થયો. તેથી એ ઘડો બહાર નીકળી ગયો; અને ગમે તેમ કરીને ભાંગી ગયો. સ્વખન નવા જીવની પ્રાપ્તિની દસ્તિએ સાંદું; પણ એ નીકળી જવાની દસ્તિએ ખરાબ ! સ્વખન જોઈને જાલિની જાગી. સ્વખન ઠીક લાગ્યું અને ન લાગ્યું; તેથી હર્ષ-ઉદ્ઘેગના મિશ્ર રસને અનુભવે છે. જીવ સંસારમાં હાલતાં-ચાલતાં આનંદ અને શોકના ડિલોળે ચઢે છે. એણે પતિને આ સ્વખન ન કહ્યું. જેમ જેમ એ ગર્ભ વધવા માંડ્યો, તેમ તેમ એના શરીરને હુંબ થવા લાગ્યું, એના મનને પીડા થવા માંડી.

સારાનાં પગલે સારું જ થાય ? :-

જુઓ ! સારાના પગલાંથી બધાને સુખશાન્તિ થવી જોઈએ ને ? ના, એવો નિયમ નથી. ચંડકૌશિકના આંગણે ભગવાન મહાવીર પદ્ધાર્યા, કહો છે કાંઈ કમીના ? પણ તેથી ચંડકૌશિકને શું ? પગલાં તો સારાનાં થયાં પણ પછી ય પરિણામ સારું આવવું તેમાં સામા જીવના સારાપણાની જરૂર છે. ત્યારે પૂરોને કે

પ્ર.- તો પછી સારાના પગલે શું વિશેષતા ? સારાને જ લાભ, તો ખરાબનો બિચારાનો તો ઉદ્ધાર જ નહિ ?

૩.- સારાના પગલાંની વિશેષતા એ કે સામાના અલ્ય પણ સારાપણારૂપી બીજ ઉપર મહાન સારાપણાનો પાક પાકે છે. થોડા પણ સારાપણાની યોગ્યતા જોઈએ. અત્યંત અયોગ્યને અસર નહિ થાય. ખરાબમાં પણ થોડું સારાપણું હોય તો એનો ઉદ્ધાર થઈ શકે છે. દા.ત. એજ ચંડકૌશિક નાગે ભગવાનના ‘બુજજ બુજજ, ચંડકૌશિઆ’ એવા શબ્દ ઉપર કાન ધરવા પૂરતું સારાપણું રાખ્યું, તો એમાં જાતિસરણ, સમભાવ વગેરે લાભ મળ્યા, ને ઉદ્ધાર થયો. જગતમાં લાભકારી સારા માણસો છે, સંતો છે, આપણે આપણી જાતે થોડા પણ સારાપણાને રાખ્યી લાયકાત કેળવશું, તો એમના થકી મહાન લાભ મેળવી શકીશું. પોતાની લાયકાતનો મોટો પ્રભાવ છે. સંત્થી લાભની વાત તો દૂર, પણ સામો દુર્જન હોય ને દુર્જન; તોય આપણે થોડીય લાયકાતના બળ ઉપર એના નિમિત્તેય લાભ પામી જઈએ.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાદિત્ય કહા.” (ભાગ-૨૨)

૨૨૩

મહર્ષિઓએ ઉપસર્ગ કરનારાના નિમિત્તને પામી કેવળજ્ઞાન અને મોક્ષ લીધો.

ગર્ભને મારવાનો વિચાર ! :

અહીંયાં તો સારો પણ ગર્ભ જેમ વધે છે, તેમ માતા અયોગ્ય હોવાથી એને પોતાને અસ્વસ્થતા લાગે છે ! વિચારે છે કે “કેમ આમ થઈ રહ્યું છે ? જરૂર આ ગર્ભ જ ખરાબ લાગે છે. અત્યારથી જ માટું મન સંતાપમાં જ રહે છે. તો એ જન્મયા પછીય શું ય કરશે ? માટે અત્યારથી જ એનાથી છૂટાછેડા લેવા છે.”

રક્ષક એ ભક્ષક :

માતા છે હોં ! માતાની વત્સલતા ઠેઠ ગર્ભ ઉપર પણ ઉભરાય છે. માટે તો ગર્ભ રહ્યો ત્યારથી કેટલીય અગવડો આનંદથી વેઠે છે; યાવત્ ગર્ભ ખાતર એટલો સમય સંસારસુખ જતાં કરે છે. આજે, અલબત્ત, આ કેટલું સચ્ચવાય છે એ વિચારણીય છે. માટે જ એવી ભોગભૂષી માતાના ગર્ભમાંથી જન્મેલા બાળક નિઃસત્ત્વ પાકે છે, નિર્માલ્ય જેવા બને છે. ભોગની ભૂખ ભયંકર છે. નવી પ્રજાની દ્યાય ચિંતવવા દેતી નથી. આ માતા તો વળી પૂર્વનાં વેર લઈને આવેલી તે ગર્ભને સીધો અહીંથી જ રવાના કરવા હશે છે ! જે માતાથી રક્ષણની અપેક્ષા, એજ માતા ભક્ષક બને છે ! રક્ષક ભક્ષક બને એ હુંબ કોણે કહેવું ? તમેય કોઈને કોઈના રક્ષક છો ને ? તો રક્ષકણીરી બરાબર પાળો છો ને ? હુંગતિમાંથી બચાવી રાખો છો ને ?

મંત્રીની પુત્રરક્ષણની સાવધાની :

જાલિની તો સીધું મારી નાખવાનું ધારે છે ! કેવીક ઝૂરતા ! માતા છતાં આમ ? હા, માટે જ સમજો કે ત્યાં કર્મ સિદ્ધાન્ત આગળ આવે છે, માનવદેહ પશુતાનો પાર્ટ ભજવાય છે. જાલિનીએ એમ વિચારી ગર્ભ પાડવાના ધંધા કરવા માંડ્યા. ગર્ભના જીવનો પણ એમાં પાપોદય કામ કરે છે. તેથી ગર્ભપાતકારી ઓસરની પીડા સહીવી પડે છે. પણ અહીંયાં જે પાપવૃત્તિ છે માતાની, તે મોટો ભાગ ભજવી રહી છે. ગર્ભને પાડવાના ઈલાજ થવા માંડ્યા, પણ ગર્ભના જીવનું પુણ્ય મોટું છે; તેથી ગર્ભ પડી ગયો નહિ. આ બધું અહીંયાં અંત:પુરમાં ચાલી રહ્યું હતું, તેની ખબર બ્રહ્મદત્તને પડી ગઈ. હવે આ મંત્રી સાવધાન બને છે, કે આ બચ્ચાનો જન્મ થાય ત્યારે એને જોખમ મોટું છે. ગર્ભમાંથી જ જે માતા એને પાડવાની પેરવીઓ કરવા માંડે છે, તે જન્મતાં શું નહિ કરે ? માટે મંત્રીએ દાસદાસીઓને કહી દીધું, “જો જો, ધ્યાન રાખજો, જ્યારે પુત્રનો જન્મ થાય, ત્યારે એને જરાય નુકશાન થવું ન જોઈએ; તેવી રીતે ખાસ પ્રયત્નશીલ રહેજો. ઊલંટું તમારી સ્વામિનીને ખુશ કરી દેવા એનું ચિત્ત ગમે તે રીતે બીજે વાળી દઈ, મને

૨૨૪

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સમરાદિત્ય-ત્રીજો ભવ” (ભાગ-૨૨)

ખબર આપજો. હું બચ્યાને સંભાળી લઈશ.” એમ પત્નીની સેવામાં રહેનાર પરિજ્ઞનોને કહી દીધું.

દોહદ :

અહીં જાલિનીને સારા ગર્ભ મુજબ હવે સારા દોહદ થવા માંગ્યા. દોહદ થાય માતાને; કિન્તુ માતાના સ્વભાવ મુજબ ન થાય, પણ ગર્ભના જીવને અનુસારે થાય છે. એવી અહીં માતાને થયું કે “હું દેવમાંદિરોમાં મોટી પૂજાઓ રચાવું, દાન વગેરેથી બધા જીવોને આનંદિત કરી દઉં ! ધર્મમાં રક્ત એવા મહા તપસ્વીજનોની સેવા-પૂજન કરું. કંઈક પરલોક હિતના માર્ગને સાંભળું.” રહસ્ય શું છે આ મનોરથોમાં ? જે જીવ ગર્ભમાં આવ્યો છે, તે જીવ જન્મયા પછી આવી આવી શુભ ઈચ્છાઓ કરશે. એ સૂચવે છે કે જીવ પૂર્વજન્મમાંથી સાધના લઈને આવેલો છે. દોહદ પુરાય નહિં, તો શરીર કીશ થતું જાય. પતિને વાત કરી. પતિ તો ખુશ થઈ ગયો. ‘આવા સુંદર દોહદ !’ દોહદ પૂરા કરાયા. બધા જીવોને આનંદિત કરાયા. આનંદિત કેમ કરાય ? દાન, ભેટણાં, જમણ વગેરે આપે તો ને ? અને એ લેવાની વાતમાં કોણ નાખુશ થાય ? માટે જ વસ્તુપાળે ને તેજપાળે સંઘયાત્રા, મંદિર વગેરે જે ધર્માર્થના કામ કર્યા, તેની સાથે દાનનાં પડ્યા મોટાં કામ કર્યા. જરાક કોઈ સમાચાર લઈને આવે કે ગુરુમહારાજ અમુક ગામે છે કે સુખશાત્તમાં છે, અથવા તો જૈનશાસનની પ્રશંસા કરતો કોઈ આવે તો એને હજારોના ધનથી નવરાવી દેતા ! દાનનો મહિમા શું હતો ? એકને દાન દીધું એટલે એ આખા જગતમાં ગેઝેટિંગ કરવાનો. જૈન ધર્મના ઉદાર ચાહકો આ સમજતા હતા. તેથી વાતવાતમાં દાન ખરું. ધર્મની વાહવાહ લોક ક્યારે બોલે ? એને સારી પ્રભાવના કે જોવાનું આપું હોય તો. નહિતર એને શી પડી છે ? એને જોવા-ચાખવાનું કંઈક આપો એટલે તમારા સામે જોશે. આપણો તો જૈનેતરને જૈનધર્મ પ્રત્યે આકર્ષવા છે. એ ઉદારતાથી થશે. અહીં બધા જીવોને આનંદ આપવાનું થયું એટલે, તેમજ ગર્ભ ઉત્તમ છે તેથી મંત્રીપત્ની લોકપ્રિય થઈ ગઈ !

પુત્રજન્મ : રક્ષા :

પ્રસૂતિ સમય આવી ગયો. સુંદર ગ્રહોમાં જાલિનીએ પુત્રને જન્મ આપ્યો. પણ વાસના કેવી છે ? મારવાની ! વિચારે છે કે ‘આટલા પરિવાર સમક્ષ આ બચ્યાને કેમ મરાય ?’ પણ અહીં પરિવાર સાવધાન છે. મંત્રીએ પહેલેથી જ જેઓને ખાસ ભલામણ કરી રાખી હતી તેમણે તક સાધી જોઈ લીધું કે “જરૂર આ સ્વામિની ફાંઝા મારે છે તો તેનો અભિપ્રાય બચ્યાને મારી નાખવાનો જ લાગે છે. એમાં બંધુજ્ઞવા નામની જાલિનીની બાલસખી કે જેને મંત્રીએ ખાસ સૂચન કરી

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાદિય્ય કહા.” (ભાગ-૨૨)

૨૨૫

રાખેલું; તે જાલિનીને કહે છે “ભહિની ! જુઓને આ ગર્ભપાપી છે. અને તમે પાસે રાખીને શું કરશો ? તમને તો તે કલેશ અને મજૂરી આપશે. માટે મને તો લાગે છે કે એ બચ્યાને દૂર ત્યજ દેવું એજ ઠીક છે.” સખીએ વસ્તુ ચાલાકીથી કહી છે. બાકી એને બાળક પ્રત્યે દ્રેષ નથી. કેમકે બાળક પુણ્યવાન છે. સખીના શબ્દથી જાલિનીનું દિલ ખુશ થઈ ગયું ! વિચાર તો બાળકથી છૃતવાનો હતો જ, છતાં જોયું કે ‘જે કામ મારે કરવું છે તે જ આ સખી કહે છે ! એટલે જેવું દિલમાં હતું તેવું જ બરાબર સાંભળતાં પસંદ પડી ગયું. પોતે કષાયને પરવશ હતી જ. હવે તો અસંખ્ય વર્ષ પૂર્વનું વેર લઈને આવી છે. બાળક પ્રત્યે દ્રેષ છે. એમાં સખીનું વચ્ચન ફાવતું લાગે છે. આમ તો સખીઓની લાજે બાળકને, ત્યાંજ તદ્દન મારી શકે એમ નથી. એટલે અરધું-ગમતું વચ્ચન જીલી લીધું. એણે કહું ‘તું જાણો’ અર્થાત્ “જેમ ઠીક લાગે તેમ કર.” સખીને તો આજ જોઈતું હતું ! બચ્યાને કપડામાં વીટી લઈ ત્યાંથી ખસેડવામાં આવ્યું. બ્રહ્મદત્તને જણાવવામાં આવ્યું. મંત્રીએ જુદી વ્યવસ્થા તૈયાર જ રાખેલી. તે મુજબ તે જુદા સ્થાનમાં બાળકને મોકલી આપ્યો. કેવી ખૂબી છે ! પુત્રનો જીવ બદ્ધ ઊંચો છે, તેની સાથેના સંબંધ થવા તે પણ પુણ્યની નિશાની છે. છતાં પૂર્વજન્મની વાસના ભયંકર છે, તેથી આવા ઉત્તમ જીવને પામી ઉત્તમતા પોતાના જીવનમાં ઉતારવાને બદલે એના જ નિમિત્તે અધમતા કેળવે છે ! પુત્ર છે, નિકટનો સંબંધ ગણાય. છતાં સારી નિકટની વસ્તુ પાછળ પણ જો મન બગડે તો પછી દુનિયાની બીજી વસ્તુ પાછળ મન બગડે તેમાં શું મોટી વાત ! એજ સંસારની અસારતા સૂચવે છે. જાલિનીની તેવી અવસ્થા થઈ. પુત્ર ઢેકાડો પડી ગયો એવું જાણી ખુશ થઈ.

સમરાદિત્ય અહીં ત્રીજો ભવમાં શિખીકુમાર :

અહીં ખાનગીમાં પુત્રનું નામ શિખીકુમાર રાખ્યું. લોકોમાં જાહેર થયું કે મંત્રીપત્નીને મરેલું બાળક જન્મયું ! એમ કરતાં કેટલોક કાળ ગયો; એટલે કણ અને દેહથી વધ્યો. બ્રહ્મદત્તે તેનું સમયોચિત બધું સાચાયું. પછી પોતાના પુત્ર તરીકે તેને દાતક લીધો. શિખી ધરમાં આવ્યો. ધીમે ધીમે એને એ વાત જાણવામાં આવી ગઈ કે આ મારાં સાચા માતા-પિતા છે. એ પણ ખબર પડી ગઈ કે મારી આ માતાને સ્વન્ન કેવું આવેલું, દોહદ કેવા થયેલા ! એ પણ જાણ્યું કે આ ગર્ભથી જ મારી વેરણ હતી. છૂપી વાત ક્યાં સુધી છૂપી રહે ? એક નહિ તો બીજાના મોંઢેથી સાંભળવા મળે. વાત કરવા સાંભળવાનો શોખ ઘણાને. માણસની ઈતેજારી એક એવી ચીજ છે કે પોતાના સંબંધીની વાત કરવા આવે તો તરત જ કાન ઊંચા કરી ટેસ્થી સાંભળે. પણ જો કંઈક નરસું પોતાના માટે કહે કે તરત જ ઊંચો-નીચો

૨૨૬ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સમરાદિત્ય-ત્રીજો ભવ” (ભાગ-૨૨)

થાય ! અહીં શિખીકુમાર જુદી વ્યક્તિ છે. એણે સાંભળ્યું ખરું; પછી શું થયું ? એવો દેખ ન થયો કે “આ મારી મા ? ગર્ભમાં હતો ત્યારે મારી નાખવા ઓષ્ઠધિઓના પ્રયોગ ? જન્મ્યો ત્યારે પણ મારવાની બુદ્ધિ ?” આવો દેખ ન થયો. પણ વૈરાગ્ય પ્રગટ્યો. એના ચિત્તમાં થયું કે “અહો ! જગતમાં કષાય એ કેવા પાપી છે !” દેખની ભાવના અને વૈરાગ્યની ભાવનામાં ફરક શું ? દેખમાં સામી વ્યક્તિ ખરાબ લાગે છે. વૈરાગ્યની ભાવનામાં દોષો ભ્યંકર પાપી લાગે છે. અહીં કષાય એ દોષો છે. એ દોષો પર ઈતરાજી થશે તો તો વૈરાગ્ય થશે અને દોષિત વ્યક્તિ પર દ્યા આવશે. દિકરાના હાથે ભૂલ થઈ, કે નોકરે ભૂલ કરી નાખી; ત્યાં પછી દોષિત પ્રત્યે દ્યા આવે ને કે “આ કેવી ભૂલ કરી બેઠો ? હા, પણ એ બિચારો શું કરે ? એની જગ્યાએ હું હોઉં તો મારે હાથેય ભૂલ થઈ જાય.” જો વ્યક્તિ પર દ્યેખ હોય તો ? “શું સમજે છે એ ? શું આંધળો હતો કે દેખતો ? ખબર નથી પડતી...” શિખીકુમાર તો યોગ્ય હતો. તે તો વૈરાગ્ય પામી ગયો !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૮, તા. ૨૮-૧૦-૧૯૫૫

શિખીકુમારની ભવ્ય વિચારણા :-

અહીં માતાને ખબર પડી ગઈ કે ‘આ તો તેજ પુત્ર !’ એથી એ કષાયમાં પડી. હવે ખૂબી જુઓ કે બંનેય આકારે માનવ છતાં, જુદી જુદી સંસ્કાર મૂડીએ જુદાં જુદાં સ્વરૂપ પ્રગટાવે છે. માતા દુશ્મન છે, તેથી દેખ અને ઉદેગનો ધંધો લઈ બેઠી. ખાવા-પીવાનું જીવન સરખું; પણ લાગણીઓનું જીવન જુદું. શિખીકુમાર તો માતાનો કષાય દેખી વધુ વૈરાગ્યમાં ચેઢે છે. વિચારે છે કે,

“આ કષાયો પાપી છે. એ સંસારરૂપી વૃક્ષના મૂળમાં પાણી સીચવાનું કામ કરે છે. તેથી સંસારવૃક્ષને પુષ્ટ કરે છે. કષાય એટલે રાગ અને દેખ; મોહ અને મિથ્યાત્વ, તૃષ્ણા અને પ્રપંચ; એ બધા પર જીવ દુષ્કૃત્યો કરે છે; અને તેના પરિણામે સંસાર અખંડ રહે છે !” આ શાણો શિખીકુમાર વિચારે છે- “માતાએ આવું શાથી કર્યું ? કષાયથી. કષાયો એવા જ છે કે એ જેને વળગે તે બધાની પાસે આવું જ કરાવે. તો તો મોક્ષાથીએ ખૂબી સાવધાનીથી અને ચીવટથી કષાયોને દૂર કરી દેવા જોઈએ. સંસારની વૃદ્ધિ કરનારા પાપોની જડ કષાય છે. કષાયમાં પડીએ, કે પાપ કરવાનું મન થાય.” પૈસાનો લોભ લાગ્યો કે બજારમાં જવાનું મન થશે. પછી જૂઠ, અનીતિ વગેરે પાપો આચરવાનું મન થશે. પાપ કોણે કરાયું ? લોભ કષાયે. રાવણ અને દુર્યોધનને મનમાં અભિમાન આવી ગયું તો ખૂનખાર લડાઈનાં

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાચિય કહા.” (ભાગ-૨૨)

૨૨૭

પાપ થયા. પાપ કોણે કરાયું ? અભિમાન કષાયે. સંસારને પુષ્ટ કરનારા પાપોનો જેને ખપ નથી, તેણે કષાયથી દૂર રહેવું જોઈએ. કષાય આવે કે સમજવું કે પાપનો પહેરગીર આવ્યો ! માટે જે મોક્ષાથી છે તેણે સંસારનો અંત લાવવો જોઈએ, અને તે માટે પાપોનો પણ અંત લાવવો જોઈએ. કષાયથી પાપ; પાપથી કર્મ, અને કર્મથી સંસાર ઊભો થાય છે. સંસાર ઊભો થયા પછી પૂછવાનું જ શું ? સંસારમાં દુઃખોના મોટા સમુદ્દરય ખડકાયેલા છે; દુઃખોનાં ટોળાં ફરે છે. દુઃખથી જે કંટાયા છે તેણે કષાયોને છોડી દેવા જોઈએ. કહું છે કે જે વીતરાગ છે, જેના રાગદ્વેષ નાશ પામી ગયા છે એને તો ફળ સ્વરૂપ કષાય કરવાનાં ન હોય, એમાં શું આશર્ય છે ? પરંતુ જે આત્મા હજુ વીતરાગ નથી બન્યો, પણ સત્તામાં રહેલા કષાયોનો નિગ્રહ કરે છે, બહાર પ્રગટવા જ દેતો નથી, એ આત્મા પણ વીતરાગ તુલ્ય છે. આ એક મહાયની વાત કહી. શું ખૂબી બતાવી ? મહાવીર પરમાત્મા વીતરાગ થઈ સર્વજ્ઞ બની ગયા, તેમને હવે કષાય નથી કરવાના; પણ તે પૂર્વેય ચારિત્રમાં કષાયના નિગ્રહથી વીતરાગ જેવા હતા. વીતરાગની વાણીને અનુસરનારે સાંભળી લીધું કે “આજે તમે વીતરાગ નથી પણ કોધાદિ કષાયો પર કાબુ તો રાખી શકો. અંદરથી કદાચ એ ઊઠે, પણ ઊઠતાને જ દાબી નાખો, તો તમે સુખી. અમુક વસ્તુ માટે મનને કષાય જાગ્યો, તેમ ખબર પડતાં જ એની ભયાનક કામગીરી સમજી એના પર અંકુશ મૂકવામાં આવે તો તેનું કંઈ લાંબુ ચાલે નહિ. તો પછી દુઃખ પણ જોવાનો અવસર ન આવે. વીતરાગની જેમ કષાયનો નિગ્રહ કરનારને પણ ભવિષ્યમાં દુઃખ નહિ !” કેવું અદ્ભુત આશ્વાસન આપી દીધું ! આ શિખીકુમારની વિચારણા છે. માતાની કુપ્રવૃત્તિ પર આવી સરસ વિચારણા કરે છે ! વિવેક આનું નામ છે કે બીજાના દોષનો વિચાર કરતાં પોતે દોષમાં ન સપદાઈ જાય ! અવિવેક એટલે બીજાના દોષ પર તો સોનેરી શિખામણ આપી દે, પણ એમ કરતાં પોતે પાછો દોષમાં પડતો હોય ! દા.ત. દોષિત પર દેખમાં પડે, જાતના અભિમાનમાં પડે. આ કુમાર શું વિચારે છે ? “કષાયો કેવા પાપી ! વીતરાગ જેમ સુખી, તેમ રાગદ્વેષને કચરનારો પણ સુખી.” રાગદ્વેષ ઊઠે તે દરગુજર; પણ તેને દાબવા કે મહાલાવવા, તેનો વિનાશ કરવો કે વિકાસ કરવો તે આપણા હાથમાં છે. જીવને ગુસ્સો ક્યાં સુધી ચેઢે ? બંધકસ્યુરિને એણે ક્યાં સુધી ચઢાવ્યા ? પાંચસોને તો મોક્ષમાં રવાના કર્યા, પણ પોતે પાલક પરના ગુસ્સામાં નિયાણું કરી દેવલોકમાં ગયા, તો શું કર્યું ? પાલકને જ સજી નહિ, પણ આખા નગરને ! આખા નગરનો નાશ કર્યો ! કોધના જે સંસ્કાર લઈને આવ્યા છીએ, તેમાં હવે વધારો કરવો કે ઘટાડો કરવો તે આપણું કામ છે. પૂર્વના સંસ્કારની લોભવૃત્તિ જાગવાથી મનમાં થાય કે

૨૨૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સમરાદિત્ય-ત્રીજો ભવ” (ભાગ-૨૨)

“આટલા રૂપિયા લઈ આવું !” આ સારું તો લાગે; પણ સાવધાન છે, માટે વિચારે છે કે “જવા દે ને જીવ, ઓછું મધ્યું ઓછું ખાશું. કંઈ નથી જવું !” આ લોભ પર દાબ-કંદ્રોલ મૂક્યો. કોઈ સારી ચીજ આંખ આગળ આવી, મન બેંચાયું ત્યાં વિચારવાનું કે “હુનિયામાં આ જ ચીજ સારી છે ? અરે, આવા જડ પર મોહ્યો ! જવા દે આમાં કંઈ માલ નથી” આ રાગને કચર્યો ! આવી રીતે જે કષાયો પર અંકુશ મૂકે તે પાપકર્મથી બચી જાય છે. વિચારણા કરી શિખીકુમારે દિલમાં શાન્તિ રાખી. બીજુ બાજુ માતાને હવે જંપ નથી. એને ‘અમ થાય છે કે આ તો એના બાપે ઘાટ ઘડ્યો હતો !’ એમ કરી બ્રહ્મદાત્ત ઉપર પણ એ ગુસ્સે થઈ. ઘરના કામકાજ છોડી દઈ આંખો ચઢી ગયેલી રહેવા લાગી. આ તો મોટો મંત્રીનું ઘર છે, મોટો કારભાર હોય; પણ જાલિનીએ એ બધું મૂકી દીધું. એને પુત્ર શિલારૂપ લાગે છે ! હુશ્મનરૂપ લાગે છે. એને એમ થયું કે આ વાતની ચોખવટ કર્યા વિના નહિ ચાલે. એટલે પતિને કહી દે છે; “જુઓ તમે તે આ શું ધાર્યું છે ? હું કેટલા દિવસથી દુઃખી છું, તેની તમને કંઈ ખબર છે ?” શું ? પતિને ભાન નથી ! પતિને ભાન વિનાના કોણ બનાવે ? એજ તો, પત્ની ! કેમકે એનો પતિ પર હોલ એન્ડ સોલ રાઈટ ! (Whole and sole right) કેમ ખરું ને ? આજની દુનિયા સ્ત્રીઓની દ્યા ખાય છે; પણ પુરુષની બિચારાની દ્યા કોણ ખાય ? એ બિચારો દુકાને જાય તો શેઠ તત્ત્વાવે; સરકારી ઓફિસે જાય તો ઓફિસર ખખડાવે. પાછું બધાને બાકી રહ્યું તે ઘરનાં રાણી સાહેબ ઊધડા લે !

જાલિની કહે છે “જુઓ, એક ખ્યાનમાં બે તલવાર નહિ રહી શકે, તેમ એક ઘરમાં અમે બંને (મા-દિકરો) નહિ રહી શકીએ.”

ખ્યાન રાખજો હોં ! પત્ની હોશિયાર છે; કાઢવો છે દિકરાને, અને પોતાને તો ચોંટી રહેવું છે; પણ સમજુને બોલે છે. કદાચ આમાં મંત્રી કહી દે કે, “જાઓ મારે છોકરાને નથી કાઢવો, તમારે જે કરવું હોય તે કરી લ્યો;” માટે પાછી એ પહેલેથી કહી દે છે-

“હું તમને સાફ કહી દઉં છું કે હવે તમે એને રાખશો તો હું પાણીનું ટીપું પણ લેનાર નથી.”

વાત કેવી રીતે ઉપાડી ? “એને રાખો કે મને.” પણ પછી કહી દીધું, “છોકરાને દૂર ન કરો તો ભૂખી-તરસી હું મરી જાઉં...” દેખનાં નાટક જબરાં છે. દ્વેષીલા જીવને વિકલ્પના પર કોઈ અંકુશ નથી. સુમાર્ગ છોડી ઉન્માર્ગ ચઢનારને કોઈ અટકાવનાર નથી. આવી પરિસ્થિતિમાં ઉન્માર્ગ, કષાયના માર્ગ કે પાપના માર્ગ ચઢતાં પહેલાં જ વિચાર કરવા જેવો છે કે “સામે સંયોગ ગમે તેવો હોય,

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨૨૮

પણ મારે આગળ વધવું તે કેટલું વ્યાજબી છે ? ભલે સામો જ ગુનેગાર હોય, મારો ગુનો ન હોય, પણ મારે ઉન્માર્ગ, કષાય, કે પાપનો રસ્તો લેતાં વિચાર કરવા જેવો છે. એમાં ફસાઈ ગયો તો કોઈ રોકનાર નથી.”

મનુષ્યના જીવનમાં ધર્મના અંકુશવાળું જીવન એટલે આ, કે પાપની કાર્યવાહી કરતાં પહેલાં થોભી જાય. મગજની ભર્ણી ગરમ થઈ ગયા પછી એને ઠંડી કરવી મુશ્કેલ પડશે. માટે પહેલેથી જ અજિન ન સળગવા દેવી.

જાલિનીએ વૈરની ગાંઠ બાંધી છે, એટલે સામો જીવ ઉત્તમ છતાં એની સામે ધોર અધમતા કરે છે ! જગતમાં આ ચાલતું આવ્યું છે. સામાનું પુષ્ય તપતું હોય એટલે વળે કંઈ નહિ ! પણ આ વૈરનું કરેલું નિયાણું ભયંકર અધમતા સર્જે છે ! જાલિની પતિને કહી રહી છે, “જો તમારે એને કાઢવો ન હોય તો મારે એક પાણીનું ટીપું લેવું પણ હરામ છે.” ત્યારે હવે બાપે શું કરવું ? પણ જો જો છોકરો ઉત્તમ અને મહાન લાયકાતને ઘરનાર છે. એટલે બાપને મુંજવણ ન થાય એવું પહેલેથી જ કરી લેશે. પણ એને ખબર શી રીતે પડી ? આ રીતે માતાની વાત શિખીકુમારે સહેજ સાંભળી. ત્યારે જ તેને લાગ્યું કે “ગુણની કદર કરનારા પિતાજીને કેટલી મુંજવણ ! અને મારો કેવો પાપનો વિપાક કે મારી માતા પણ આ રીતે વર્તે છે ! અને એથી મારા પિતા દુઃખી થાય છે !” જ્યારે નજર શુદ્ધ થાય ત્યારે પોતાની નુટિ દેખાય. નજર મેલી હોય એટલે બીજાની નુટિ જોવાનું મન થાય. પોતાની નુટિ જ્યાં જોવાય ત્યાં કલેશ અને ટંટા શમી જાય; માટે એ નજર શુદ્ધ. બીજાની નુટિ જોવાય ત્યાં કલેશ અને ટંટા ન હોય તો પણ ઊભા થાય; માટે એ દિન્દિ મેલી. આપણો આપણી ભૂલ જોઈએ તો એમાં કંઈ જગત આપણા પર તૂટી પડતું નથી. એક બે વારના પ્રસંગમાં એ જોશે એટલે બસ. બાકી બીજાની જ ભૂલ જોવી એ હૃદયની મલિનતા છે; એજ કલહ-ટંટાનું મૂળ છે. આ ઉત્તમ શિખીકુમાર પોતાની નુટિ જુએ છે, “મારા પાપનો વિપાક !” આ મહાન જરીબુઝી છે, મહાન મંત્ર છે, દુનિયાના બીજા ત્રીજા ઈલાજો જે દુઃખ દર્દ અને સંતાપ ન મિટાવી શકે એ “આ મારા પાપનો વિપાક” મિટાવી શકે; જે આશ્વાસન ન આપી શકે, એ આ આપી શકે. બીજાને બદલે પોતાની ભૂલ જોવામાં ઘણા સંતાપ મટે છે.

મહારાણી પદે બિરાજમાન અને ગર્ભવતી અવસ્થામાં, કોઈ પણ સહાય વિના, એકલી અટૂલી સીતાને રામે જંગલમાં મૂકાવી દીધી. શા માટે ? કોઈ અપરાધ હતો ? ના, વિના અપરાધે ! અરે ! અપરાધ કદાચ હોય, તો પણ ગર્ભવતી છે તો રસ્તે જનારને પણ દ્યા આવી જાય. છતાં અહીં સીતાજીને વિના દોષે જંગલમાં ધકેલ્યા ! સાથે ન તો કોઈ સખી, કે ન તો કોઈ દાસી કે

૨૩૦ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સમરાઈય-ત્રીજો ભવ” (ભાગ-૨૨)

રખેવાળ ! ખાનપાનની સામગ્રી કે વાહન પણ નથી હોં ! એવી ભયાનક સ્થિતિમાં સીતા શું વિચારે છે ? “આમાં રામનો દોષ નહિ, મારા પૂર્વકર્મનો દોષ છે.” કહો, આમાં ક્યાં રગડો-જગડો થાય ? ક્યાં ધાંધલને અવકાશ જ હોય ? સીધો જ હિસાબ સીતાજીએ મૂકી દીધો. “મારા પૂર્વકર્મનો દોષ.”

કેમ પૂર્વકર્મનો દોષ આવ્યો ? પૂર્વ ધર્મ ન કર્યો માટે. તો જગતમાં જૈન ધર્મ એજ સાચું શરણ છે. માણસ બીજી આળપંપાળ કરે તે ખોટી. ધર્મ સિવાયનું બધું કંચન, કુટુંબ બધું જ - કેન્સલ છે ! રદ બાતલ છે ! રંક માણસ મરણ સમયે હિસાબ બતાવે કે ‘હું પાંચ પૈસા એક સાથે કમાયો નથી; ને એક સાથે ભોગવ્યા નથી.’ શ્રીમંત માણસ હિસાબ બતાવે કે “હું પાંચ અબજ એક સાથે કમાયો અને ભોગવ્યા...” આ બંનેને જાણે જમરાજ કહે છે કે “લાવો તમારા ચોપડા.” એમ કરી બંને ચોપડા પર ચોકડા મૂકે છે, ને કહે છે, “જાઓ, બંને સમાન રીતે સળગતી ચેહમાં બળી જાઓ.”

વિનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ કહે છે-

વિનય ! વિધીયતાં રે; શ્રી જિનર્થર્મઃ શરણમ्;
અનુસંધીયતાં રે, શુચિતરચરણસ્મરણમ् ।

હે વિનય ! તું જિનર્થર્મનુંજ શરણ કરી લે. મનમાં અતિ પવિત્ર ચારિત્રના સ્મરણનું અનુસંધાન કર. અર્થાત્ હું અને ચારિત્ર બેનો જ સંબંધ સાચો; બાકી સંબંધ ખોટો; આમ વિચાર. કેમ ? એટલા માટે કે હા, કોઈ વજનમય મકાનમાં માણસ પેસી જાય, વજની દિવાયો છે. તેથી માને કે ‘હવે હું જોતું હું કે જમ ક્યાંથી આવે છે ?’ પણ તે ખોટું. જમ એમ નહિ છોડે.

પ્રવિશ્તિ વજનમયે યદિ સદને, તૃણમથ ઘટયતિ વદને । તદ્વિ ન મુજ્જતિ હત સમવર્તી નિર્દ્ય-પૌરુષનર્તી ॥ જમ ગમે ત્યાંથી પેસી શકે છે. તો મોંમાં તણખલું લઈને જાઓ જમ પાસે, ‘રાજી પણ દુશ્મનને એમ ક્ષમા આપે છે, તો જમ આપણને પણ ક્ષમા આપશો.’ પણ ના, ચાહે જમની સામે તમે છાતી ઊંચી કરો કે એના પગમાં માથું ઝુકાવો, પણ એ જમ જન્મેલા કોઈનેય છોડતો નથી. એ નિર્દ્યપણે જગતના જીવ માત્ર પર પોતાનું નૃત્ય ચલાવનારો છે. એવી મૃત્યુની જોહુકમી છે, છતાં જગતનાં જે સંયોગો પૂર્વે મખ્યા તેમાં જીવે ફોગટનાં કર્મ બાંધ્યા ! પછી અહીં મોટા કષ્ટ ભોગવવાં પડે તેમાં કોનો વાંક ? “વાંક મારા કર્મનો.” આ રીતની વિચારણા હોય ત્યાં પછી ચિત્તમાં કલેશ ન પેસે, અને ધર્મનું શરણ લીધા પછી ભલેને સામેથી સિંહ આવે, ડરવાની કોઈ જરૂર નથી.

પ્ર.- પણ વર્તમાનમાં દુઃખી, તે ભવિષ્યમાં સુખી શી રીતે થવાનો ?

૬.- એ પ્રશ્ન અજ્ઞાનનો ગણાય. મહાઅજ્ઞાનનો. કેમેકે સામાન્ય અજ્ઞાન ખેડૂત જેવા પણ સમજે છે કે આજે આંબો વાવીએ તો હમણાં તો ખેડૂતાં ધૂળ જ મળવાની ! પછી છોડવા મળશે, એ તો બે-પાંચ વર્ષ જ્યારે આંબો પાકે ત્યારે કેરીના સ્વાદ મળશે. અજ્ઞાન પણ આ સમજે છે કે વસ્તુના લાભ તે તે કાળે થાય. તે રીતે હમણાં ધર્મનું શરણ લીધું તો તેના યોગ્યકાળે તે જીવને જબરજસ્ત લાભ આપશે. બાકી વર્તમાનમાં ય ધર્મ શરણથી હૃદયમાં પ્રગટેલા બળનો ઓછો લાભ નથી.

શખીકુમારે નકી કર્યું કે “મારે અહીંયાં રહેવું યોગ્ય નથી.” એમ કરી મુંજાયેલા પિતાની મુંજામજા અને માતાના સંતાપને ટાળવા એ કોઈને કદ્યા વિના ધરમાંથી નીકળી ગયો. શેરીમાંથી અને નગરમાંથી રવાના ! પણ એવો પુણ્યશાળી છે કે નગરની બહાર ઉદ્ઘાનમાં ગયો ત્યાં શ્રી વિજયસિંહ નામે આચાર્ય ભગવંતના દર્શન થયા. પહેલા ભવમાં ‘શ્રી વિજયસેન’ અને બીજા ભવમાં ‘શ્રી ધર્મધોષ’ નામના આચાર્ય મહારાજે પ્રતિબોધ કર્યો હતો. હવે અહીં જુઓ. જુઓ ત્યારે, સમરાદિત્ય મહર્ષિનો જીવ આચાર્ય મહારાજોને જન્મે જન્મે મેળવીને આત્મપરાવર્તન અને જીવન પલટો કરવાનું ચૂક્તા નથી. તમારું કાર્ય એ રીતે ચાલુ છે ને ? ધ્યાન રાખજો, એકદમ ઉતાવળી હા કહેતા નહિ. અહીં તો પૂર્વના બે ભવમાં આચાર્ય મહારાજના આલંબને સુંદર આત્મપરાવર્તન કરેલાના પ્રતાપે આ ત્રીજા ભવમાં હજી આચાર્ય મહારાજને પાખ્યા નથી ત્યાં પણ માતાનું પોતાની સામે પાહું વૈર જોવા છતાં પોતે દ્વેષ નથી કેળવ્યો, પણ તાત્ત્વિક રીતે કષાયોની પ્રબળતા-ભયંકરતા વિચારી છે ! વૈરાગ્ય જગાડ્યો છે ! પોતાના પાપનો વિપાક વિચાર્યો છે ! આવી પણ માતાને કશું પોતાનું જોર બતાવી દેવાનું નહિ, પણ ઉલટું એને કલેશ ન થાય માટે ધરમાંથી પોતે નીકળી જવાનું મુનાસિબ ધાર્યું ! યોગ ધાર્યું ! માણસ ધારે તો કેટલી બધી ઉચ્ચ કક્ષાએ ચઢી શકે છે ! પવિત્ર અવસ્થા બનાવી શકે છે ! સંતહદ્ય સર્જ શકે છે ! ત્યારે તમને શું લાગે છે ? આવી પવિત્ર સંત અવસ્થા એ સુંદર ? કે એનાથી વિપરીત માતાની સામે જગડવા કરવાની દશા એ સુંદર ? ભૂલતા નહિ, જગડવું એ શેતાની દશા છે. એ અપવિત્ર શયતાની અવસ્થા તો જંગલના વાધ-વરુને અને યાવત્ત જંતુનેય આવડે છે. માટેસ્તો જીવ બિચારા સંસારમાં ભયા કરે છે. માનવભવે તો પવિત્ર સંતહદ્ય કેળવવાની જરૂર છે. સંતહદ્ય ક્યારે કેળવાય ? આચાર્ય મહારાજના, સંતના, સમાગમ પામીને આત્માના પરાવર્તન કર્યેથી. પછી તે ચાચ્ય પૂર્વભવે કે આ ભવે સમરાદિત્યના જીવે પ્રથમ ગુણસેનના

ભવમાંજ વિજ્યસેન નામના આર્થિક ભગવંતના ઉપદેશ અને સમાગમથી એવું ગજબ સુંદર આત્મપરાવર્તન કર્યું છે, કે ત્યાં જ અંતે અજિન ધીખતી ધૂળની વચમાં બળવાનું આવ્યું છતાં મોટા મહાત્મામુનિ જેવી મહાસમતા કેળવી છે. એથીજ પછીના સિંહરાજના ભવે અવધિજ્ઞાની મહર્ષિનું ચરિત્ર સાંભળીને અદ્ભુત પ્રેરણા મેળવી છે. પાછું ત્યાં એટલું ભવ્ય આત્મપરાવર્તન સજ્જું છે કે પોતાની સામે પુત્ર આનંદની દુષ્ટાને આનંદથી વધાવી છે. અને અહીં ? અહીં તો આર્થિક મહારાજ મળ્યા પૂર્વે જ માતાની દુષ્ટા પર સામનો નહિ, વૈરાગ્ય વિચાર્યો છે ! સાધુ પુરુષોના સમાગમને પામીને આપણે આ સાધવાનું છે. કોધની સામે ક્ષમા, દ્વેષની સામે દ્વારા, એવું એવું દાખવતા આવડે ત્યારે સમજાય કે આપણે આત્માનું પરિવર્તન કંઈક પણ સિદ્ધ કરી શક્યા છીએ.

હવે વિજ્યસેન આર્થિક મહારાજની વિશેષતાઓ અને તે શા કારણો તે જુઓ.

સંયમ શા કારણો :-

શિખીકુમારે આર્થિક મહારાજને જોયા, તે કેવા કેવા હતા ? એકવિધ સંયમ જે સર્વથા સંયમ, એમાં રક્ત હતા. કારણ કે જીવને ભાવી દુઃખો ઉપરાંત પ્રત્યક્ષમાં પણ અશાંતિ, વ્યાકુળતા વગેરે હોય તો તે અસંયમથી છે. પછી થોડું સંયમ સ્વીકારી બાકી અસંયમ ઊભું રાખે, તો તેટલા અસંયમ પૂરતી પણ અશાંતિ રહે છે. આનો ખૂબ ખૂબ ઊંડો વિચાર કરજો તો બરાબર સમજાશે કે અસંયમથી દુઃખ. ત્યારે દુનિયામાં જુઓ કે માણસને સુખ શાન્તિ મળતી હોય તો શારીરિક કષ્ટ કે બીજી સગવડો જતી કરવી પડે એની પરવા નથી રહેતી. માટે જ આર્થિક મહારાજે શાન્તિ અર્થે સંયમ લીધું છે. તો પછી પૂછો કે,

પ્ર.- ત્યારે બધા સુખશાન્તિ તો ચાહે છે તો સંયમ કેમ સ્વીકારી લેતા નથી ?

ઉ.- એનું કારણ લોકોનું અજ્ઞાન અને મૂઢતા છે. અજ્ઞાન હોવાથી એ બિચારા સંયમથી મહાસુખશાન્તિ થવાનું સમજતા નથી. મૂઢ હોવાથી અસંયમના ઘરની વાસ્તવિક અશાન્તિને સુખશાન્તિ કલ્પી લે છે. અસ્તુ.

દુર્ધ્યાન કેમ છોડ્યું ? :-

વળી આર્થિક મહારાજ આર્ત અને રૌદ્ર એવા બે પ્રકારના દુર્ધ્યાનથી મુક્ત હતા; કારણ કે એમાં માનવભવના મહાકિંમતી મનનો દુરુપ્યોગ હતો. જેમ દા.ત. મોટા શહેરના કોઈ સારા બજારમાં મોટી પેઢી ખોલીને ત્યાં પાના બાળનો અડો કે મોજમજાહનું સ્થાન જમાવી તો શકાય; પણ એ એ પેઢીનો દુરુપ્યોગ છે. એમ આ જૈન માનવ મનથી દુર્ધ્યાન કરવામાં મનનો ભયંકર દુરુપ્યોગ છે. બહારનાં કાર્ય ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨૩૩

તો પ્રારબ્ધ અને બીજા કારણો મુજબ બન્યે જાય છે; પણ મન મફતનું દુર્ધ્યાન સેવી જાતે બગડે છે, અને આત્માને બગાડે છે ! નહિતર ગમે તે પ્રસંગ પર શુભધ્યાનથી મનનો સહુપ્યોગ કરવામાં કોઈ અટકાવતું નથી; એ કરી શકીએ છીએ.

ત્રણ દંડથી રહિત કેમ ? :-

આર્થિક મહારાજ ત્રણ દંડ-મન-વચન કાયાના દંડથી રહિત હતા. શાથી ? એમને સજા લેવાની નહોતી. એ સમજતા હતા કે મન, વચન કે કાયાની ખોટી પ્રવૃત્તિથી આત્માને બિચારાને કારમી સજા ભોગવવી પડે છે. એવો એમને દઢ વિચાસ હતો કે ખોટી પ્રવૃત્તિ, પાપ પ્રવૃત્તિ, આત્મહિતને ભૂલીને કરતી પ્રવૃત્તિ એ અવશ્ય ગુનો છે; અને અવશ્ય એની સજા ભોગવવી પડે છે. સજા ભોગવવાનો જેને મોખ ન હોય તેણે તો ગુના બંધ કરો. આજે અમેરિકામાં એનું સંશોધન ચાલ્યું છે. એવા લોખ બહાર પડ્યા છે કે ‘Every effect has a cause behind it’ દરેક કાર્યની પાછળ કારણ હોય છે. એટલે આજે તમે કાંઈ પ્રતિકૂલતા અનુભવતા હો તો સમજી રાખો કે તમેજ જાતે પૂર્વે કાંઈ અજુગતું વિચાર્યું છે, કે વર્ત્યા છો. જો કે હજુ આ અધૂરું સંશોધન છે; કેમકે જન્મતાં જ બાળકને કોઈ રોગ કે ખામી હોય છે, તેની પાછળ કારણ તરીકે એણે આ જન્મમાં શું અજુગતું કરેલું કે અજુગતું વિચારેલું સમજવું ? છતાં એટલું ચોક્કસ છે કે પોતાના અશુભ વિચાર, વાણી અને વર્તાવ પોતાને સજા આપે છે. આર્થિક મહારાજ એવા સુશ હતા કે તેથી જ મન, વચન, કાયાના દંડથી વિરામ પામ્યા હતા.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૧૮, તા. ૨૧-૧-૧૯૫૬

ચાર કષાયનું મંથન કેમ ? :-

વળી સૂરિજી ભગવંત ચાર કષાયને મથી નાખનારા, કયરી નાખનારા હતા. કેમ ? દુનિયામાં દુશ્મન ગણવા જઈએ તો મોટું ગૌરવ થાય છે. ‘આ મારું આવું ખરાબ કરનારો,’ ને ‘આ મારું આવું બગાડનારો,’ ત્યારે ‘પેલો વળી મને આમ પ્રતિકૂળ વર્તનારો’ એમ ઘણા દુશ્મન માનવા પડે. એના બદલે અંદરના કોઇ, માન, માયા અને લોભને દુશ્મન સમજવાથી બહારના કોઈ દુશ્મન નહિ રહે. ત્યારે જરાક નજર કરીએ તો જણાય કે મૂળ આપણને કાંઈ લોભ જાગ્યો, કે અભિમાન કર્યું. રોષ બતાવ્યો કે કપટ કર્યું અથવા આપણે સફાઈથી બોલ્યા તો સામો દુશ્મન ઊભો થયો. આપણા લોભની વસ્તુની આડે આવતો જણાયાથી વિરોધી લાગ્યો. આપણને વસ્તુનો લોભ જ ન થયો હોત તો સામો માણસ દુશ્મન શાનો

૨૩૪ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ચાર કષાયનું મંથન કેમ ?” (ભાગ-૨૨)

લાગત ? બહારના દુશ્મનને સર્જનાર જો કોઈ હોય તો તે આપણા જ અંદરના કથાય દુશ્મનો છે. તેમ એ પણ છે કે કથાયો એ આત્માની સહજ નિર્મલ પ્રકૃતિ નથી, પણ વિકાર છે, બિગાડો છે. ત્યારે જો આપણો આખી દુનિયામાં બિગાડો, નરસું જોવું ખમી શકતા નથી, તો પછી આપણા પોતાના જ આત્માના કથાય વિકારને, કથાયરૂપી નબળી નરસી સ્થિતિને કેમ વેઠી લઈએ છીએ ? આચાર્ય મહારાજને આત્મારૂપી સુવણીમાં હવે ભેળસેળ ખપતી નહોતી, એટલે કથાયમળને કચરી દૂર હટાવી દીધો હતો.

ઈન્દ્રિય નિગ્રહ શા માટે ? :-

વળી આચાર્યદિવ પાંચેય ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા હતા. કેમ વારું ? ઈન્દ્રિયોરૂપી ભાડૂતી માણસો આત્મારૂપી શેઠને પોતાનું ઘર ભૂલાવી આડે અવળે ઉતારી દેતા હતા તેથી. જેમ દા.ત. જુગારી મિત્ર પોતાના ભાઈબંધને લલચાવીને જુગારના અડ્ઝમાં ઉતારી દે છે; એવું ઈન્દ્રિયોનું કામ છે. આત્માએ શુદ્ધ જ્ઞાનાદિમય પોતાના વીતરાગ સ્વરૂપમાં રમવાનું છે. પરંતુ એ પોતાનું ઘર ભૂલીને બાબુ રૂપ-રસાદ વિષયોમાં રમતો એટલે કે રાગદ્રેષાદિ કરતો ફરે છે ! એ કોના યોગે ? કહો, ઈન્દ્રિયોના યોગે. એટલે હવે તાંકો બનેલો આત્મા જ્ઞાણે ઈન્દ્રિયોને કહે છે, “તમે શેઠ થઈને મને વિષયોના ઈષ્ટ-અનિષ્ટ વિભાગ કરાવી રાગદ્રેષમાં રગડો છો ને ? હવે મારે એવા ભૂલા નથી પડવું. તેથી જ રાત દિ’ તમારા ‘આ ગમતું’ ‘આ અણગમતું,’ ‘હવે પાછું આ ગમતું’ એવા એવા ખેલને મારે ભજવવો નથી. મારી પાસે તત્ત્વની ભરપૂર વિચારણા છે; ક્ષમા, નિર્મળતાદિ સદ્ગુણોરૂપી નિજ ઘરના આંગણામાં રમવાનું છે.” આચાર્ય મહારાજ નિજ ઘર ન ભૂલી જવા માટે ઈન્દ્રિયોના ઊંઘે રસ્તે ચઢાવ્યા ચઢતા નહોતા.

અથવા કહો કે ઈન્દ્રિયો નિર્ભેળ શુદ્ધ સ્વરૂપદર્શન કરવાને બદલે ‘આ નરસી વસ્તુ આ વધારે નરસી, આ બહુ ખરાબ; આ સરસ, આ બહુ સરસ વસ્તુ,’ એવાં તોફાન કરે છે; અને એથી આત્માના પુણ્ય ધનને બરબાદ કરાવી પાપનાં દેવાં આત્માના માથે ચઢાવે છે. એ દેવાં પછી અહીં અને પરબરે ચૂકવવા ભારી પડે છે. માટે આચાર્ય મહારાજે એ ઈન્દ્રિયોના તોફાન ઉપર અંકુશ મૂકી દીધો હતો. તેથી એમની ઈન્દ્રિયો હવે શાંત બની જઈ રાગદ્રેષ કરાવતી નહોતી; વિષયાસક્તિ કરાવતી નહોતી.

જીવબંધુ શાથી ? :-

વળી આચાર્ય મહારાજ પૃથ્વીકાય, અપૂર્કાય, તોજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસ્કાય-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨૩૫

બંધુ બન્યા છે. એથી એની જીણામાં જીણી પણ હિંસા નહોતા કરતા; એ લેશ પણ એને ઠીજા નહોતા પહોંચાડતા. કારણ કે (૧) જગતના જીવ માત્રનો મુખ્ય ધર્મ છે સુખની ચાહના; અને હિંસામાં એનાથી પ્રતિકૂલ વર્તવાનું થાય છે. તો આપણાને પ્રતિકૂલ કોઈ વર્તે તો એ આપણો અન્યાય ગડીએ છીએ, અકર્તવ્ય માનીએ છીએ; ત્યારે આપણો બીજાના તરફ પ્રતિકૂલ વર્તવિ ન્યાયી અને કર્તવ્ય કેમ કહેવાય ? વળી (૨) હિંસામાં પોતાના આત્માની પણ વિચારસરઙી અને વલણ બગડે છે, અનાદિના કુસંસ્કાર વધે છે, માટે પણ હિંસા ત્યાજ્ય છે; ને અહિસા જ આદરણીય છે. નથી લાગતું કે સ્વાર્થવશ હિંસા કરવાનો પ્રસંગ આવે ત્યાં હૈયું કઠોર બને છે ? એ કઠોરતા, એ સ્વાર્થમાં ઘસડાવાનું વગેરે જન્મો-જન્મથી ચાલી તો આવે જ છે. અહીં પણ પૂર્વવત્ત જીવન યથેચ્છ આરંભ-સમારંભમય ચાલુ રહે, એમાં કોઈ સંકોચ-ઓછાશ ન થાય તો કુસંસ્કાર ઘટવાના કર્યારે ? હવે તો જીવ માત્રને આપણા બંધુ ગણવામાં મહાન ઉદારતા કેળવાય છે; હૈયું બહુ જ કોમળ બને છે; તેથી હિંસા વૃત્તિના-આરંભ સમારંભની વૃત્તિના ગાડ બંધ હૈયા પરથી છૂટી જાય છે. આમ તો જીવને આ દુનિયામાં કાંઈને કાંઈ નવો જૂનો આરંભ કરવામાં કોઈ સંકોચ નથી. નહિંવત્ત જરૂરિયાતમાં કે વગર જરૂરિયાતે પણ માત્ર મનની મોજમાં જટ કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવા જોઈએ છે. જ્યારે હવે એમ થાય છે કે જીણામાં જીણા જીવ જંતુ યાવત્ત પૃથ્વીકાયાદિ જીવો મારા બંધુ છે, એટલે કંઈ પણ પ્રવૃત્તિ આરંભ-સમારંભ કરતાં પહેલાં એ વિચાર આવે છે, એ જોવાય છે કે આમાં જીવનાશ કેટલો ? કેટલો જીવોનો નાશ થવાની સંભાવના ? એ ન કરું અગર ઓછું કરું તો ચાલે કે નહિ ? આમ હિંસા ઘટે.

સાત ભયોથી મુક્ત કેમ ? :-

આચાર્ય મહારાજ સાત ભયોથી મુક્તાયેલા હતા. કારણ કે જ્યાં કંઈ પણ પરિગ્રહ કે મમત્વ છે ત્યાં ભય છે. અહીં તો પોતાના શરીર પર પણ મમત્વ નથી ! એટલે કે કર્મ વાંકા થઈને આજે પરિસ્થિતિ એવી ઊભી કરે કે જેથી શરીરને બગડવું છે, નાશ પામવું છે, તો એ બદલનો લેશ માત્ર પણ ઉદ્દેગ-અફસોસી નહિ. ખુશીથી એને જતું કરવાનું ! ધર્મોપગરણ ઉપર પણ મૂર્ખાં નહિ હોવાથી ‘એ ખોવાઈ જશે તો ? બગડી જશે તો ?’ ઈત્યાદિ કોઈ જ ભય નહિ ! ત્યારે પ્રશ્ન થશે કે,

પ્ર.- પણ પાપનો ભય. પરલોકનો ભય ખરો કે નહિ ?

૩.- ના, એ પણ નીચી કણવાળા જીવને હોય છે કે જ્યાં ધર્મ સમજવા

૨૩૬ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“ચાર કથાયનું મંથન કેમ ?” (ભાગ-૨૨)

ઇતાં પૂર્ણત્વા ધર્મજીવન સ્વીકાર્યું નથી; અને તેથી જ પાપો સંપૂર્ણપણે છૂટ્યા નથી. એવા ગૃહસ્થ જીવનમાં તો સહેજે વિચાર આવવો જ જોઈએ કે ‘આ આ પ્રવૃત્તિમાં મને બહુ પાપ નહિ લાગે ને ? મારો પરલોક નહિ બગડે ને ? હું ક્યાં સુધી પાપને વળગી રહીશ ? મારું ભવાંતરમાં શું થશે ?’ આચાર્ય મહારાજ તો સર્વથા પાપથી મુક્ત છે, સંપૂર્ણ જીવન, હવેની દરેક દરેક ક્ષણ-ધર્મભય છે. પછી પાપ લાગવાની કે પરલોક બગડવાની ચિંતા શું કામ થાય ? સુંદર પરલોકની નિશ્ચિન્તતા જીવનની નિષ્પાપતામાંથી જાગે છે; એકાંત પવિત્રતામાંથી જન્મે છે. પાપરહિતને કોઈ ચિંતા નથી, ભય નથી. જીવનમાં પાપ છે, અપવિત્ર આચાર વિચાર છે, ત્યાં ભય છે.

મદ કેમ ન કરવો ? :-

આચાર્ય મહારાજ આઈ મદથી રહિત છે. શું સમજુને ? એ કે મદ કરવો તે બેકાર છે. પૌદ્રગલિક સિદ્ધિઓ પુષ્યના આધારે જ નિપઞ્જવાની. જ્યારે આત્મિક સિદ્ધિઓ પુરુષાર્થની પ્રબળતા ઉપર જન્મવાની. દા.ત. સારું ફળ, માનસન્માન, સમૃદ્ધિ, આરોગ્ય વગેરે પૌદ્રગલિક સિદ્ધિઓ તે તે પુષ્યનો ઉદ્ય હોય તો જ મળે. તેમ આત્મિક સિદ્ધિમાં જ્ઞાન, ભક્તિ, દયા, બ્રહ્મચર્ય વગેરે, તેના તેના અવરોધક જ્ઞાનાવરણીય કર્મ તૂટે તો પ્રાપ્ત થાય. તે કર્મો તોડવા માટે ઉદ્યમ કરવો પડે. એટલે પુરુષાર્થ જેટલો જોરદાર તેટલા પ્રમાણમાં એ બાધક કર્મો તૂટવાના; અને ગુણ પ્રગટવાના. હવે જુઓ કે માણસને મદ થાય છે તે કોઈ ને કોઈ પૌદ્રગલિક અગર આત્મિક સિદ્ધિ ઉપર; અર્થાત તે પુષ્યોદય કે પુરુષાર્થની ઉપર જ ને ? તો શું પુષ્યોદય કે શું પુરુષાર્થ, બંનેય સ્થિતિમાં અભિમાન કરવું યોગ્ય છે ? ના, ધન બહું મળ્યું, મનને થયું “હું મોટો ધનવાન.” પણ વિચારવું જોઈએ કે “અરે ! તું શાનો ધનવાન ? તારું પુષ્ય ધનવાન ! કેમકે ધનને પુષ્ય કમાયું છે, તું તો માત્ર પુષ્યનો સર્વન્ટ-નોકર.” તો પુષ્યની શાબાશી ઉપર નિપઞ્જતી વસ્તુ પર આપણે શાનો મદ કરીએ ? ત્યારે પુરુષાર્થથી જન્મતી વસ્તુ ઉપર પણ મદ કેમ જ કરાય ? કેમકે ત્યાં તો જે પ્રાપ્ત કર્યું તેના કરતાં અનંતગુણ હજુ મેળવવાનું બાકી છે. દા.ત. વિદ્યા; તો એથી અનંતગુણી વિદ્યા, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પછી પ્રાપ્ત નજીવા ઉપર મદ શો ? જેમકે, એક હજાર માઈલ ચાલવાનો ઉદ્યમ કરી કોઈ માણસ બડાઈ હંકે કે ‘મેં કેવો સરસ પ્રવાસ કર્યો !’ તો તે ગમાર જ દેખાય કે બીજું કાંઈ ? માટે જ, ન તો પુષ્યપ્રાપ્ત કે ન ઉદ્યમસાથ વસ્તુ પર મદ કરવો વાજબી.

નવ બ્રહ્મચર્ય ગુપ્તિ શા માટે ? :-

આચાર્ય ભગવંત બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં પ્રવીષા હતા. ભાઈ ! કેમ વારું ? સમજતા હતા કે જગતમાં બીજા બધા ગુણો કરતાં બ્રહ્મચર્યનો ગુણ એવો કિંમતી અને નાજુક છે કે આજુબાજુમાં ફરતા મોહના સુભટો ઝટ એના પર આકમણ કરવા તૈયાર ! અને પેલાને ઘવાતાં વાર નહિ. દા.ત. સસ્તામાં સ્ત્રીઓ અનેક બેટે. ત્યાં અનું ગાત્રદર્શન બહુ સુલભ. એજ મોહ સુભટનું આકમણ. એ જીયું કે બ્રહ્મચર્યને ટક્કર લાગી સમજો. બ્રહ્મચર્યની મૂળ ભાવનામાં શું છે ? ‘ચામડાના રૂપરંગમાં કાંઈ જ સારાપણું, આકર્ષિવાપણું કે એના પર લેશમાત્ર પણ રુચિ થવા જેવું કાંઈજ નથી. જે આકર્ષાવાનું છે, રુચિ કરવાની છે, તે આત્માના નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ છે. તેલિયા વાસણને પાણીના ટીપાં સાથે જાણે કોઈ નિસ્બત કોઈ ભીનાશ નહિ, એમ બ્રહ્મચારીને ભલે નિકટમાં સ્ત્રીરૂપ-સ્ત્રીકથા, વગેરે કદાચ આવી ગયા છિતાં પોતાને કોઈ નિસ્બત નહિ, કોઈ સ્નિંધતા નહિ. એટલે એમાં ઈન્દ્રિય અને મન જોડવાના જ નહિ. આમ તો એ સંયોગોની પ્રબળતા જાણીને એનાથી દૂર જ રહેવાની જ વાત. પણ નથીને કદાચ સામે આવે તો દૃદ્ધયની એનાથી તદ્દન અલિપ્તતા.

ક્ષમાદિ યતિધર્મમાં સ્થિરતા શાથી ? :-

વિજયસિંહ આચાર્ય ભગવાન ક્ષમા મૂદુતા...સંયમ, તપ...એ બધા દશ પ્રકારના યતિધર્મમાં સદા સ્થિર મનવાળા હતા, શાથી ? જગતમાં આનાથી વધીને ચઢિયાતું સારું જીવન બીજું કયું છે ? ક્યાં આ ક્ષમાદિનું શ્રેષ્ઠ જીવન ! નિર્ભિકજીવન ! સ્થિર જીવન ! અને ક્યાં જગતની તુચ્છ-કનિષ્ઠ વાતોનું જીવન ! કોધ કરનારો કોધને કાયમ ટકાવી શકતો નથી. એમ માન, માયા, લોભને પણ ફેરવવા પડે છે. ત્યારે ક્ષમા, મૂદુતા, સરળતા અને નિસ્પૂહ્યતા, એ તો સદા ટકાવી શકાય છે. એમ જ્યારે અસંયમ, અ-તપમાં ભારોભાર ચંચળતા છે; ભય છે; વિહ્લવળતા છે; પરાધીનતા છે; કેદ પંચાતી છે; ત્યારે તપ અને સંયમમાં એમાંનું કશું નહિ. તેમ એ પણ છે કે આત્માના મૂળ સ્વભાવમાં કોધાદિને જરાય સ્થાન નથી. તેથી પણ એનો ત્યાગ કરી ક્ષમા, સંયમ વગેરેથી આચાર્ય મહારાજે આત્માની ઊજળામણ કરી છે.

અગિયાર અંગના જ્ઞાતા કેમ ? :-

આચાર્ય પ્રભુ અગિયાર અંગને સારી રીતે ભણેલા હતા. શા માટે ? એ અનાદિની વાસનાઓના જે નિવારવા મંત્ર સમાન છે. એનો સૂત્રથી અને અર્થથી પાઠ કરવામાં, પર્યાલોચન કરવામાં, મનની અંદર વાસનાને વિકસવાનો અવસર જ નથી મળતો. બીજું એ પણ છે કે જગતમાં અનેક પાપશાસ્ત્રોની વચ્ચમાં આ અગિયાર અંગ મહાપવિત્ર શાસ્ત્ર છે. એની જ્યારે અહીં સુલભતા થઈ, તો પછી એનો નિર્મળ પ્રકાશ આત્મામાં કંન જાગતો ન કરી દેવો ? ફરી ફરી આવો પ્રકાશ કર્યાં મળે ? એ જો અહીં મળ્યો છે, તો અંધકાર શા માટે રાખી મૂકવો ? અજ્ઞાતની જેમ પાપશાસ્ત્રોનાં જ્ઞાન પણ મોહિન્યાત્વના કારમા અંધકાર ફેલાવે છે. ત્યારે ‘અંગ’ નામના આગમ ભાષાવાનું એ પણ કારણ છે કે જો એ ભાષ્યા હોય તો પછી દિવસ-રાત એના સ્વાધ્યાયના મહાપવિત્ર કાર્યમાં પસાર કરી શકાય; અને મનને એમાં ન એમાં યોજુ ખોટા વિકલ્પો વગેરેમાંથી બચાવી લેવાય.

બાર પ્રકારે તપ શા માટે કરવો ? :-

આચાર્ય મહારાજ ૬-૬ પ્રકારના બાબુ આત્મન્તરતપમાં મશગૂલ હતા. શાથી વારું ?

(૧) આ માટે કે જેમ સુવર્ણમાં ભેણસેળ હોય તો તે અભિનમાં તપી તપીને શુદ્ધ બને છે, તેમ આત્મા પણ તપના બહુવિધ તાપથી તપી તપીને અર્થાત્ સહર્ષ તપના કષ વેઠી વેઠીને કર્મના ભેણસેળથી છૂટી શુદ્ધ બને છે. અથવા,

(૨) તપ એટલા માટે કે આત્માએ પરાધીનપણો, ન છૂટકે, અનિચ્છાએ કષ બહુ વેઠ્યાં; કિંતુ એમાં તો એની દીનતા દેખાઈ, પણ હવે તપનાં ઈષ સહર્ષ વેઠી લેવામાં વડાઈ છે, શાબાશી છે. આત્માનું આંતરિક ઓજસ અને સતત ખીલે છે. તેથી ઊંચી સાધનાને યોગ્ય બને છે. તેમ

(૩) એ પણ છે કે પરાધીનપણાના કષ બહુ મોટા અને લાંબા. ઇતાં પાપ અટપ ખપે; અહીના સહર્ષ તપમાં કષ થોકું ને ટૂંકું; ઇતાં લાભ બહુ, પાપ બહુ ખપે. ત્યારે

(૪) એમ સમજુ રાખવાનું છે કે અહીં જો નરકાદિના કષની અપેક્ષાએ બહુ મામુલી એવા આ જિનોકત તપના કષ ન સ્વીકાર્ય તો તપના બદલે કરેલા મોજવિલાસથી ભવાંતરે દુર્ગતિના કષ ભારે વેઠવા પડશે. આચાર્ય મહારાજને આ બધો ઘ્યાલ હોવાથી તપમાં કેમ મશગૂલ ન હોય ?

(૫) તપ કરવામાં એ પણ હેતુ છે કે આપણા આત્માને તપના અભાવે કુટિલ કાયા ઉપર જે બહુ મમત્વ થઈ ગયું છે, અને પછી એ એના રાગમાં તખાઈ અનેકાનેક ભવમાં ભટકાવનારા દુર્ગુણોને ખૂબ પોષે છે અને દુષ્કૃત્યોને નિર્ભયતાથી આચરે છે; એ બધું મૂળમાં તપ નહિ હોવાના લીધે છે. બાર પ્રકારના તપના અભાવે શું શું થાય છે તે જોવા જેવું છે.

(૬) બાબુ તપના અભાવને લીધે :

(૧) અનશન તપનો અભાવ એટલે ખૂબ લાગ્યે ખાવાનું કદી બંધ નહિ !
(૨) તેમ ઉનોદરી તપના અભાવે ? પૂરું શું, સવાયું ખાવાનું ! તેમ, (૩-૪) દ્રવ્યસંક્ષેપ અને રસ ત્યાગ તપ નહિ તો જેટલી ચીજ મળે એટલી, ને જેટલા રસ મળે એટલા ઉડાવવાના ! (૫) કાયકલેશ તપ નહિ એટલે ધર્મના ખાતર કાયાને કષ આપવાની વાત નહિ, ધર્મની વાત આવે ત્યાં કાયાને પંપોળી પંપોળી સુંવાળી રાખવાનું બનવાનું. તો (૬) સંલીનતા તપના અભાવે, ખોટી પ્રવૃત્તિથી દેહને ફારગ રાખવાની વાત નહિ. આ બધું બાબુ તપ નહિ હોવાના લીધે ચાલ્યું આવ્યું છે. તેમ આત્મન્તર તપમાં,

૬ આત્મન્તર, તપ ન હોવાને લીધે :

(૧) જો પ્રાયશ્રિત, તપ નહિ, એટલે તો પછી પોતાનાં પાપકાર્ય છૂપાં રાખે, ગુરુને એ કહી પ્રાયશ્રિત લે નહિ, દિલની શરમ, અકકડતા, ‘આટલા પાપમાં શું’ એવો પાપ પ્રયે નિર્ભક્તા અને બિનજુગુપ્સા એવું એવું ચાલુ રાખે. તેમ (૨) વિનયનો તપ નહિ એટલે ઉદ્ધતાઈ, વહિલનો અનાદર કર્યે જવાનો. ત્યારે (૩) વૈયાવચ્યનો તપ નહિ તેથી સ્વાર્થસાધુતા, કુદ્ર હદ્ય, નિષ્ઠુર હદ્ય, ગુણાનુરાગને બદલે ઉપેક્ષા, આવું આવું સેવ્યે જવાનો. (૪) એવી રીતે પવિત્ર સ્વાધ્યાયનો તપ નહિ હોય તો જીવ પાપ પ્રવૃત્તિમાં, ને સંસારની જલોજથામાં રચ્યોપચ્યો રહેવાનો, નિદા વિકથાદ પ્રમાદમાં પડવાનો. દુર્ધર્યાનું ઘર, ઉંઘનો ઈજારદાર અને કષાયનો મિત્ર થવાનો. ત્યારે, (૫) શુભધ્યાન તપના અભાવે મનમાં કુવિકલ્પોનો પાર નહિ ! જડપદાર્થોની ચિંતાનું માપ નહિ ! મામુલી મામુલી વાતમાં પણ મહા આરંભ, હિંસા, જૂઠ, અનીતિ વગેરેની વિચારસરણી ચાલુ ! તેમ, (૬) કાઉસ્સગનો તો તપ નહિ હોય, તો તેથી કદાચ સારું ધ્યાન ચિંતવે તો ય કાયાની ચપળતા, દણ્ણની ચપળતા અને કદાચ મનની પણ ચપળતા ચાલુ રહેવાની. કાયોત્સર્ગમાં પ્રતિજ્ઞા સાથે વાત છે. કાયાને જિનમુદ્રામાં જ રાખવાની; વચનનું મૌન જ ધરવાનું; અને મનમાં માત્ર નિર્ધારિત શુભ ધ્યાન જ કરવાની પ્રતિજ્ઞાનું નામ કાયોત્સર્ગ છે. એ તપ જીવનમાં નહિ હોય તો મન-વચ-કાય ક્યાંથી સ્થિર રહે ? ને એની

અસ્થિરતામાં આત્મા નિઃસ્તવ, દરિદ્ર અને દુઃખી હોય એમાં નવાઈ નથી. છ બાધ્ય અને છ આભ્યન્તર તપના મહાન લાભ અને એના અભાવમાં દુર્ગુણો અને દુજૂહ્યોના તાંડવ બરાબર યાદ રાખજો.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૨, તા. ૧૧-૨-૧૯૫૬

આ બાર પ્રકારના તપની ગેરહાજરીમાં :

(૧) પુદ્ગલની કેવી કેવી વેઠ કરવી પડે છે !

(૨) દુર્ગુણોની કેવી કેવી જોહુકમીમાં તણાવું પડે છે !

(૩) આજ પર્યતની આત્માની હસ્તગત થયેલી મહાઉન્નતિ નાણ થઈને આત્માનું કેવું પાછું અધઃપતન થાય છે !

(૪) માનવ જીવનમાં સુલભ એવી ઉચ્ચ સાધનાની મળેલી અનન્ય તક કેવી સરાસર નિષ્ફળ જાય છે ! સાથે,

(૫) અનાદિની કુટેવો પાછી કેવી કેવી સદ્ગ્ર બને છે.

એ બધું આચાર્ય મહારાજ જાણો છે; તેથી એ બધું મિત્રાવવું હોય તો તપ જોઈએ એમ સમજુને તપમાં રક્ત રહેતા.

પહેલાં તપના પાંચ મહાલાભ કહ્યા છે; અહીં તપ ન હોવાથી પાંચ મહાનુક્ષાન બતાવ્યા. બંનેને નજર સામે રાખજો. યાદ કરવું હોય તો ફરીથી ટૂકમાં યાદ કરી લ્યો;

• તપ કરો તો લાભ •

૧. તપના તાપથી કર્મ બળી જઈ આત્મા સુવર્ણ જેવો શુદ્ધ થાય.

૨. આપણે કષ સહ્યામાં દીનતા, ફિક્કા, સહર્ષ તપમાં શાબાશી, આત્મતેજ અને સત્ત્વ ખીલે.

૩. અકામ કષે સહ્યાનું ધાણું, પાપ અલ્ય ખપે, તપમાં સહ્યાનું થોડું, પાપ થોક ખપે.

૪. તપથી દુર્ગતિના બ્રમજ મટી સદ્ગતિ મળે.

૫. તપથી આત્મપ્રેમ વધે કાયમમત્વ ઘટે. તેથી કાયાના પાપે દુર્ગુણ-દુજૂહ્યો પોષાતા અટકે વગેરે વગેરે.

• તપ ન કરો તો નુકશાન •

૧. પુદ્ગલની વિવિધ વેઠ ચાલુ અને વધે તેથી આત્મા ભારેકર્મ બને.

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

૨. દુર્ગુણોની જોહુકમીમાં તણાવાનું થાય. પછી દીનતા, ટળવળાટ વગેરે વધે.

૩. આજ સુધીની સાધેલી આટલી ઉન્નતિ ગુમ, અને અધઃપતન શરૂ થાય.

૪. માનવ જીવનની પરમાત્માને નિકટ થવાની અનન્ય તક એમ જ વહી જાય.

૫. અનાદિની કુટેવો, સંજ્ઞાઓ સદ્ગ્ર બને.

આચાર્ય મહારાજને જિનશાસનનો ચોળમજુદ રંગ લાગ્યો છે; અને જિનના શાસનમાં તો સંયમ (ચારિત્ર) અને તપના પરાકમ વખાણ્યા છે. તેથી આચાર્યદિવ ઓનું જ જીવન બનાવી હે એ સહજ છે. આવા આચાર્યદિવને જોઈ શિખીકુમારને તેમના પર પ્રેમ થયો. તે તેમની પાસે ગયો. મનમાં વિચારે છે “ખરે જ ! ધન્ય છે આમને, કે જેઓ અનન્યાસ્તિત (ચંચળ) પ્રેમમાં ધેલા સંસારને વિષે આવી રીતે ધર્મમાં રક્ત છે !” ‘ધન્ય’ એટલે શું ? ધન્ય એટલે એ, કે પ્રેમ સંસારની વસ્તુ પર ચંચળ હોવા છતાં સારું જગત એમાં એવું મોહી રહ્યું છે કે કોઈ આંખ ઊંચી કરીને જોતું પણ નથી ! એવા પ્રેમને વિસારી સાધુધર્મ લીધો તેની શાબાશી ! ત્યારે પ્રશ્ન થાય છે ને કે,

પ્ર.- સંસાર પ્રેમ ચંચળ ?

૩.- તો કહો, શું લગ્ન કરીને દિલમાં જે પ્રેમ હતો તે આજ સુધી એવો ને એવો જ છે ? કે પરણ્યા પછી સો વાર પસ્તાઈ ચૂક્યા છો ? તેમ નોકરી, વેપાર, મિત્રાદિસંબંધ સારા માનીને લીધા પછી ત્યાં પ્રેમ ઘટ્યા છે ને ? છતાં હવે એ છોડવાની વાત આવે તો કબૂલ રાખો ? “ના ! એ બોલશો મા, મહારાજ !” એમ ઝટ કહેવાના. દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જેના પર સ્નેહ બાંધ્યા પછી કોઈ વાર અરુચિ કરવાનો પ્રસંગ ન આવ્યો હોય ! ભલેને કિંમતી હીરાની વીંટી હોય, પણ તેના પર અખંડ રાગ રહે ખરો ? એના પર પણ કલેશ થાય કે નહિ ? આપણાને મન નહોતું અને કોઈએ પહેરવા માણી વીંટી, તો શું થાય દિલમાં ? ક્યાં આ વેઠ વસાવી, એમ જ ને ? હીરો પચીસ હજારમાં ખરીદ્યો હતો અને હવે બજાર એના બાર હજાર બોલે છે, તો એ હીરાજ પ્રત્યે શું થાય હદ્યમાં ? “આ પથરો મેં ક્યાં ખરીદ્યો ?” એવું જ ને ? બસ, આ રીતે રાગ ચંચળ છતાં જગત રાગ કરવામાં માથાબૂડ બૂડેલું છે ! કઈ સમજથી ? આ “દુનિયાના રાગ પાછળ લાતો પડે તો તે ખાવા અમારી પીઠ તૈયાર છે ! પણ એવા સંસારને દગાખોર, આત્મનાશક માનવાની કે એને છોડવાની તૈયારી નથી ! અમારું તન-મન અને ધન, દોહી કહો કે ગમે તેવી, દુનિયા માટે તૈયાર

૨૪૨ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“તપ નો લાભ-નુકશાન” (ભાગ-૨૨)

છે !” કેવી સ્થિતિ છે ? ‘દ્રોહ કરતી દુનિયા માટે તન, મન ને ધન કુરબાન ! આત્માના તારક દેવગુરુ ધર્મ માટે ? કંઈ નહિ !’ આ ઉંચા માનવભવમાં ? જાગો જાગો. સમજો અને મન પલટો.

શિખીકુમાર આચાર્ય ભગવંતને જોઈને વિચારે છે, “ધન્ય છે આમને ! ત્યારે લાવ, પૂછું તો ખરો કે આમને વૈરાગ્ય થવાનું શું કારણ કે જેથી આ આમ ધર્મમાં લાગી ગયા છે.” આચાર્યદિવની સમીપ આવી, પ્રણામ કર્યા. ગુરુએ ધર્મલાભ આપ્યા. પૂછે છે,

“ભગવંત ! આપને આ સંસાર પર કંટાળો આવવાનું શું કારણ ?”

“કેમ મહાનુભાવ ! આમ પૂછે છે ?”

“એટલા જ માટે પ્રભુ ! કે આપનું શરીર સર્વાંગે એટલું સુંદર અને મનોરમ છે, કે એ સુંદરતા અને મનોરમતાથી અનુમાન થાય છે કે આપની પાસે વૈભવ સારો હશે. તેમ વૈભવના વિસ્તારથી સમજાય છે કે સ્વજનવર્ગ પણ બહોળો હશે. તો એ બધા સારા સંયોગો છોડી આવું લુખ્યું, કર્કશ અને બીલકુલ સંગ વિનાનું ચારિત્ર આપે કેમ સ્વીકાર્યું ?”

“મહાભાગ સાંભળ, તને આ શરીરમાં સુંદરતા શી દેખાય છે કે જેમાં હાડકાં, માંસ અને લોહી ભારોભાર ભરેલાં છે ? અરે ! બહાર સફેદ બાસ્તા જેવું પણ હાડકું પડ્યું હોય તો હાથમાં લેવાનું મન નથી થતું ! માંસ હેઢી કમક્કમી આવી જુગુખસા થાય છે ! લોહી બહાર નીકળતાં તને ફરી ચૂસવાનું મન નથી થતું ! એવા હાડમાંસના પૂતુળામાં સુંદરતા લાગે છે ? જ્યાં સુધી આવી અપવિત્રતાની બુદ્ધિ શરીર પ્રતે ધારણ કરાય નહિ, ત્યાં સુધી શરીરનો રાગ ખસે નહિ; અને એ નહિ ખસે ત્યાં સુધી કેટલાય ખોટાં ખર્ચ, સગવડ, ફેશન વગેરે પાછળ, ધર્મકાર્યમાં ઉપયોગ લાગે એવા કિંમતી ધનનાં આંધણ મૂકાઈ રહ્યા છે તે ઓછા નહિ થાય. ગંદવાડની પેટી પર હીરા-માણેક શું જડવાતા ! પાપના પૈસા મફત નથી આવ્યા, કે ગંદવાડના ગાડવાને મફવામાં હોમી દઈએ ?” આ સમજાય તો પછી પરમાર્થમાં હાથ ખુલ્લા રહે. પૂર્વકાળે પૈસા પરમાર્થમાં ખૂબ ખૂબ ખર્ચાતા. આજે ? ઓછું. કેમ ? ધન ઘટી ગયું હશે ? ના, ધન તો કદાચ વધી પણ ગયું હશે; પણ સાથે લાલસાઓ અને ખર્ચા ખૂબ વધી ગયા છે ! માટે મોંકાણ તો લાલસાઓ અને ખર્ચા વધી ગયાની છે. પૂર્વે પરમાર્થ સારો થતો; કેમકે જાત માટે ઘણું થોડું જોઈતું. આજે તો પેટ જ પટારા જેવું, પછી પરમાર્થની વાટકીઓય ક્યાંથી ભરાય ? એ તો પેટ નાની વાટકી જેટલું હોય, તો છતી શક્તિએ પરમાર્થના પટારા પૂરી શકાય ! આજે, આર્થની જે દસ્તિ હતી, તે બગડી ગઈ. સોના પગારમાંથી વીસ રૂપિયા તો

ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૨૪૩

યાપટીપમાં જ જાય ! ભ્રમણાઓ વધી, વિલાસ વધ્યો, તેથી ફેસિલિટીના (સગવડના) ખર્ચા, ફેશનના ખર્ચા, મનોરંજનના ખર્ચા અને માનેલા વ્યવહારના ખર્ચા વધ્યા. બહારના રૂપનાં અંજામણ વધ્યાં. ગુલાબી મોંડા અને હાથ તરફ દાખિઓ તણાય છે. લોહી, માંસ અને હાડકાના જથ્થારૂપ આ શરીર છે, તો પછી એની ગુલાબી ચામડી પર કોણ મોહે ? પણ જે પરમાત્માદર્શન અદ્ભુત છે, પરમાત્માની વીતરાગ પ્રશાંત મુદ્રા ખૂબ જ વિચાર-પ્રેરક છે, સૌખ્યતાદાયી છે, એ જોવાનું ન રહ્યું એટલે આવા મહાન ભવમાં ઉચ્ચ પરમાત્મદર્શન કરવાને બદલે મળ-મૂત્રનાં ઉપરનાં અસ્તર જોવાનું ચાલ્યું ! પ્રજાની આ નબળી કરી વેપારીઓએ પણ પકડી લીધી તો દુકાનના બોર્ડો, છાપાઓમાં જાહેરાતો અને એનું સાહિત્ય પણ સ્ત્રીના ચિત્રોવાળું ! આ ભયાનકતા કયારે અટકે ? શરીરની સુંદરતા ભૂલાય તો.

શિખીકુમારને આચાર્ય મહારાજ કહે છે :-

“ભલા ! તને આ શરીરમાં સુંદરતા દેખાય છે ? અને પાછો સુંદર શરીર પર માને છે કે ‘વૈભવ પણ સારો હશે !’ જે વૈભવ જીવ પાસે મજૂરી સિવાય બીજું કંઈ કરાવતો નથી અને કષ સારી રીતે આપે છે, તેમાંય શું સારાપણું ? એના પર શું મમત્વ કરવાનું ? તેનાં મૂલ્યાંકન શા કરવાના ?”

‘વૈભવ મજૂરી કરાવે,’ એટલે શું ? વલણમાં પચાસ હજાર મળ્યા, કે ‘જાઓ ઉપાડી લાવો થેલા, ચાર બેન્કોમાં ગોડવો...’ બસ, બંડલ ઊંચકી ઊંચકીને ફેરબ્યા કરવાનાં ! ડિલિવરી ને ટ્રાન્સફર ! પૈસા વધ્યા પછી મજૂરી સિવાય શું વધે છે ? વધ્યું તો ત્યારે કહેવાય કે પહેલાં ચાર રોટલી ખાતો હતો તો હવે ચાલીસ ખાઈ શકતો થયો. ના, આ તો ચારને બદલે બે પણ રોટલી પૂરી ખાઈ નથી શકતો. ઊલદું દવાઓ ખાવાનું વધ્યું !

આ દસ્તિ જે લાખી જાય તો પછી હૈયાનાં ચક્ષુ ખૂલી જાય; ઘોર મોહની ઊંઘમાંથી જાગૃત થવાય ! તો થાય કે “હું તે શું મજૂર છું, કે આ ટ્રાન્સફર જ કર્યા કરું ? કલની ખબર નથી કે શું થશે !” તો એવી સ્થિતિમાં શા માટે ભરોસે રહું ?” જીવનું જ્યાં ઊપજતું નથી, ત્યાં માથાઝોડ કરવી તે નરી પાગલતા છે. માથાથી થાંભલો તોડવાનો પ્રયત્ન, તે શું છે ? માથું ફોડવાનું; થાંભલાને કંઈ નહિ થાય. વૈભવનો વિસ્તાર એટલે જીવને મજૂર બનાવનાર છે. માટે એ થંધમાંથી નીકળી જવું સાચું છે.

કુટુંબ પરિવારનો કસ કેટલો ? :

આચાર્ય મહારાજ કહે છે “તું એમ કહે છે ને કે કુટુંબ પરિવાર પણ સારા મળ્યા હશે !” અરે ભલા માણસ ! સ્નેહીજનોનો મેળો તો સ્વખ જેવો છે. એવા

૨૪૪ ભુવનભાનુ અન્સાઈકલોપીડિયા-“તપ નો લાભ-નુકશાન” (ભાગ-૨૨)

સ્વભના સમાગમ જેવા ચંચળ સ્નેહીમાં મમત્વ શું ગણવું'તું ? રાગ શું ધરવો તો ? શું ખુશી થવું'તું ? જેમ વધુ ખુશી થાય તેમ વધુ રોવાનું થાય છે. મૃત્યુની નોટિસ આવે કે ‘અરેરે...!’ ક્યાં નિયમ છે કે મોટા જ પહેલા જાય ને નાના પછી ? સગર ચક્કવર્તી ઉભો રહી ગયો અને ૬૦૦૦૦ કનેયા કુંવરો એકી કલમે ઉપડી ગયા ! માણસ હિસાબ કાઢે કે ‘હજી તો મને ૪૫ જ થયા છે, અને છોકરાને વીસ જ થયા છે;’ તો પણ છોકરાનું ત્યાં જ આયુષ્ય ખૂટ્યે આ હિસાબ શું કર્મ ઉભો રહેવા દે છે ? ના, કશું જ નહિ. એટલું માપો કુંઠંબ પરિવારનો કસ કેટલો ?”

સ્વજનો વચ્ચે પણ નિરાધારતા :

આચાર્ય મહારાજ કહે છે “ધ્યાન રાખ, શું સ્વજન સ્વજન કરે છે ? બધા વહલામાં વહલા સ્વજનોમાં રહેલો જીવ, પણ જીવારે રોગથી આકાન્ત થાય છે, ત્યારે એકલો પીડાય છે. ઘણા સ્વજનો વચ્ચે હોય તો પણ ! પચાસ માણસનું કુંઠંબ હોય, પણ એક માંદો પડે કે બીજા ઓગણપચાસ માણસો કરી કરીને શું કરે ? પથારી જાલીને બેસી રહે તેટલું જ ! પણ પથારીમાં રોગી થઈને સૂએ કોણ ? એ તો એક જ પેલો ! પછી અંદરમાં દાહજવરની પીડા કોણ વેઠે ? એ એકલો જ ! ‘અમે તો આંખમાંથી દડદ આંસું પાડીએ તેટલું જ ! અમે કંઈ અંદરનો દાહ ભોગવીએ નહિ !’ આવા સ્વજનો વચ્ચે રહેલા જીવનું આ કરુણ સ્વરૂપ છે, કે સ્વજનો ન અને રોગને લઈ શકે, કે ન અને કાઢી શકે. કરુણપણે રોતાં સ્વજનો વચ્ચે જીવ એકલો રિબાય છે, એકલો મરવા પડે છે. ત્યાં કુંઠંબ હાથ નથી પકડતું કે ‘અમે નહિ મરવા દઈએ.’ હાથ કોઈ જ ન પકડે, ન કોઈ પત્ની, ન પિતા કે માતા, ન ભાઈ કે ભગીની ! છતાં આ બધાને સ્વજન ગણીએ; અને પરમાત્મા, ભવોદ્ધારક ગુરુ, કલ્યાણ-મિત્ર સંઘ એ બધાને સગાં-સ્વજન ન ગણીએ ! કેવીક અજ્ઞાન અને પામર દશા !”

જીવ કર્મ પણ એકલો જ કરે છે. પાપ કરવામાં શૂરવીર થાય ત્યારે પણ એકલો. ફળ ભોગવતાં પણ એકલો. જન્મે એકલો અને મરે પણ એકલો. છતાં એમ લઈ બેસે છે, ‘હું એકલો નથી ! અમે ઘણા છીએ ! બહોળું કુંઠંબ છે અમાદું.’ આમ, ખરું એકત્વ ભૂલી કૂત્રિમ બહુપણું માને તો પૂછવાનું મન થાય કે ‘ભલા તમે કોણ કોણ ઘણા ? જન્મવામાં ઘણા ? કર્મ કરવામાં ઘણા ? એક સાથે એક સરખી લાગણીઓ થવામાં ઘણા ? કર્મ ભોગવવામાં ઘણા ? મરવામાં ઘણા ? છે ક્યાંય ઘણા ?’ ના, ક્યાંય નહિ. એ તો પ્રત્યેક જીવના સ્વભાવ જુદા, પુણ્ય-પાપ મરણના પ્રસંગ જુદા, ભવાંતરના ભવ જુદા, ને પૂર્વની સ્થિતિ પણ

જુદી ! સૌ પોતપોતાનું સમાલે. એમાં કોણ પોતાનું અને કોણ પર ?
રેલ્વેના પાટા પર સાવધાની :

મોટા મેળામાં શું ? જે ગામડેથી આવ્યા હોય તે પોતપોતાનું સાથે લાવેલું ભાતું થાય; અને પોતપોતાનો માલ ખરીદે. તેમ આ પણ એક મેળો જામેલો છે. કોણ કોણું સ્વજન ? ને કોણ પાર્કું માણસ ? કોઈ મેળ નથી આ સંસારમાં. સૌ પોતપોતાના કર્મ ભોગવે; ને પોતપોતાની કરણી અનુસાર પોતપોતાના કર્મ ઉપાર્જે. સંસાર એટલે કદાચ પુત્ર મરીને વૈરી થાય; અને વૈરી મરીને પુત્ર કે પિતા થઈ બેસે. તેવા તદ્દન ચંચળ સ્વભાવવાળા જીવરૂપી રમકડાં પર નાચ કરનારા સંસાર પર કોણ મોહે ? સંસારના સ્વજનો પર કોણ આસક્તિ ધરે ? અસ્થિર ભાવોભર્યા સ્વજન સ્નેહી પર આસક્તિ ધરવી એ મૂઢતા છે. અજ્ઞાન દશા છે. “આ મારા સ્નેહી છે. તેને હું કાયમ સાચવીશ.” આવો મમત્વભાવ કરવો એ મોહનું ફળ છે, સદ્બુદ્ધિનું ફળ નથી. સદ્બુદ્ધિ હોય તો પારખી જાય કે “હું કોણ છું ?” પછી બરાબર સમાધાન હોય. રેલ્વેના પાટાની વચ્ચે ઉભેલો માણસ કેવો સાવધાન હોય ? ફાટક કોસ કરતાં ખીસામાંથી પેસા ઢળી પડે, ને જુઅ કે આ ટ્રેઇન આવી તો પેસા લેવા ઉભો રહે ? કદાચ લે તો કેટલી સાવધાનીથી ? ત્યાં ગફલત કેટલી ચાલે ? તેમ માનવજીવનની કટોકટીની સ્થિતિમાં જો ધન વગેરેના લોભ અને મમતાને ફૂદી જતાં આવડે તો ભાવી અનંત સંસારરૂપી ટ્રેઇનની કયરામણમાંથી બચી જવાય; ને જો ફૂદતાં ન આવડયું તો ખલાસ જ ને ?

પૈસા, શરીર અને સ્વજનોની આ સ્થિતિ છે. ગમે તેવા સ્નેહી પર રાગ ધર્યા, પણ એમાં જીવનું કંઈ વળતું નથી. ઊલટો પાપથી ભારે થાય છે ! કર્મબંધ કરે છે ! માણસ રસે જનાર ત્રાહિત માટે જે પાપ નહિ કરે, તે પાપ સ્નેહી પાછળ કરશે ! પરિણામ પોતાને જ ભાવીમાં ભારે ભય ! આ બધી પરિસ્થિતિમાં જીવે પોતાનું રક્ષણ કરી લેવું તે આખાય ઉપદેશનો સાર છે ! ‘આત્માન રક્ષ’ આત્માને બચાવો અને બચાવવા માટે ખોળિયા માટેની રમત દૂર ખસેડો. દુનિયાના સ્વજનો ખોળિયા સાથે રમત રાખે છે, અંદરથી આત્મ-પંખેરૂ ઉડી ગયું કે એજ સ્વજનો ખોળિયાને બાળી-ફૂકી દેવાના ! આવા સંસારમાં રાગ-મમત્વ ધરવો, ને એમાં જ ભૂલા પડી જવું તે બધું મિથ્યામતિનું ફળ છે. વિજયસિંહ આચાર્ય ભગવંત શિખીકુમારને કહે છે “આ સિવાય પણ બીજો કોઈ સંસાર પર વૈરાગ્ય થવાનો હેતુ હોય તો તું કહેવાનું અમને કહે છે ને ? તો અમારું વૃત્તાન્ત સાંભળ.”

● વિજ્યસિંહ આચાર્ય ભગવંતનું ચરિત્ર ●

નાળિયેરનું ઝાડ :

લક્ષ્મીનિલય નામના નગરમાં સાગરદત્ત નામે સાર્થવાહ છે. તેને શ્રીમતી નામે પત્ની છે. તેમનો હું પુત્ર છું. હું જ્યારે કુમારાવસ્થામાં હતો ત્યારે એક વાર લક્ષ્મી નામના પર્વત ઉપર ગયો. ત્યાં એક ભાગમાં મેં આશ્રય જોયું. શું? જેમાં લીલા પાંડાં છે, અને જેણું મૂળ જમીનમાં બહુ લાંબે ગયું છે, તેવું નાળિયેરનું એક ઝાડ મેં જોયું. તે ઝાડ જોઈને મને કૌતુક થયું કે ‘અરે! આ શું આ? માત્ર આવડા નાળિયેરીના ઝાડનું આટલા જ વિભાગમાંથી ઊતરીને મૂળ ઠેઠ જમીન સુધી આવી અંદર પેસી ગયું છે! ત્યારે જરૂર આમાં કોઈ કારણ હોવું જોઈએ.’ સંસારી જીવ છે, એટલે જિજ્ઞાસા થાય છે. પણ આ જીવ ઊંચો હોવાથી આને તો આ જિજ્ઞાસાથી લાભ થવાનો છે. નહિતર આવી જિજ્ઞાસામાં તો નુકશાન છે. નવું જાણે એટલે દોડુધામ વધે !

કુદરતમાં ચમત્કાર : ધર્મચક્ર :

આચાર્ય મહારાજ કહે છે, “હું આશ્રય પામી રહ્યો હતો, ત્યાં મને એકાએક હર્ષની લાગણી થઈ આવી. સુગંધીદાર પવન વહેવા લાગ્યો. પશુઓના સમૂહે પોતાનો સ્વભાવસિદ્ધ એવો પણ વૈરભાવ છોડી દીધો. લક્ષ્મી પર્વત જાણે વિશ્વ શોભાથી ઝણકી ઊઠ્યો. વનો અને ઉધાનોના વૃક્ષો સર્વે ઋતુના પુષ્પોથી વિભૂષિત થઈ ગયા. પુષ્પો આવી ગયા પછી પૂઢું જ શું? ભમરાઓનો મનોહર, ઊંચો તાલવાળો અને રમ્ય એવો ગુંજારવ શરૂ થઈ ગયો! સૂર્ય પણ તાપ વિનાના નિર્મલ પ્રકાશથી તે પ્રદેશને ઊઠોતિત કરવામાં ખીલી ઊઠ્યો! આ જગતનું એક આશ્રય શું? પરંતુ હું આગળ વિચાર કરું, ત્યાં તો મેં તીર્થકર ભગવાનનું ધર્મચક્ર જોયું! ધર્મચક્ર પરમાત્માની આગળ ચાલતું હતું. કેવું હતું તે ?

ધર્મચક્ર કેવું? :

“ઉગતા સૂર્યના મંડલ જેવું દેદિય્યમાન! વિશુદ્ધ અસલી સુવર્ણનું બનેલું! અનેક રત્નોથી શોભતું હતું. એની સાથે આકાશમાં જ્ય જ્યારવનો નાદ વ્યાપી ગયો હતો. સાથે દેવતાઓ મંગલ ગીત ગાઈ રહ્યા હતા, પુષ્પોની વૃદ્ધિ થઈ રહી હતી. અનેક દેવતાઓથી પરમાત્મા પરિવરેલા હતા. ધર્મચક્ર જાણે સંસારરૂપી ચક્ર પર વિજય કર્યો હોય તેમ સૂર્યવતું હતું. પણ્યિમ દિશામાંથી ઊતરતું એ ધર્મચક્ર અજિતદેવ ભગવાનનું હતું. એની પાછળ કિંમતી ગુણરંનોથી શોભતા ચેતવસ્ત્રપારી અનેક સાધુઓ ચાલતા હતા ત્યાર પછી ચાલતા જગતદ્યાળું પ્રભુની સમૃદ્ધિ કેવી

અલોકિક હતી !

પ્રભુની સમૃદ્ધિ :

“દેવતાએ પ્રભુના માથે કુંદ પુષ્પ જેવું સર્ફેદ છિત્ર ધર્યું હતું! હુંદુભિના નાટે આકાશપટને ગજાવી બહેરું કરી મૂક્યું હતું! દિવ્ય ભામંડલ પ્રભુના મુખ પાછળ શોભી રહ્યું હતું! પ્રભુને ઈંદ્રો ચામર ઉલાળી રહ્યા હતા! દેવો-અસુરો અને માનવોના ટોળેટોળાં પ્રભુની સુતિ કરી રહ્યાં હતાં. કાલાગરું વગેરે ધૂપથી દિશાઓ મધ્મધાયમાન થઈ ગઈ હતી! તેમાં એવું લાગતું હતું કે પ્રભુ જાણે ગંધબતી જેવા બની ગયા હતા. એવા પ્રભુ અત્યંત સૌભ્ય હતા! તેમ એ સુવર્ણમય દિવ્ય કમલ-પંક્તિ ઉપર ચાલી રહ્યા હતા! એવા ત્રિલોકનાથ અને ભવસમુદ્ર પાર કરી ગયેલા અજિતદેવ તીર્થકર પ્રભુને જોઈને મને ખૂબ આનંદ થયો. મારું મિથ્યાત્વ ખખી ઉઠ્યું, અને ધર્મની ભાવના સ્ફૂર્તયમાન થવા માંડી. મને થયું ‘અહો મારી જાતને ધન્ય છે, કે જે મેં ત્રણ લોકના ચિંતામણિ સમાન તીર્થકર ભગવાનને જોયા!’ ત્યાં તો દેવતાઓએ પ્રભુની દેશના માટે સમોસરણ રચ્યું! કેવુંક એ સુંદર હતું?

સમવસરણ કેવું? :

“રતન, સુવર્ણ અને ચાંદીના ત્રણ કિલ્લાવાળું! કિલ્લા ઉપર રતનમય વિચિત્ર કંગરા ઝગમગે છે! સુયોગ્ય રચનાવાળા દિવ્ય તોરણો છે. મોટી ધજાઓનો સમૂહ ઊંચે ફરકતો હતો. ત્યાં અનેક ભમરાઓ ગુંજારવ કરી આનંદમય વાતાવરણ સર્જ રહ્યા હતા! સમવસરણને તોરણો, સિંહની આકૃતિઓ, ચક્ર, ધજાઓ વગેરેનોય મહાન શાશગાર હતો. વળી પ્રભુને બેસવાના સ્થાન પર સર્ફેદ ત્રણ છિત્ર સિંહાસનથી ઊંચે એવા શોભતા હતા કે તેથી સમોસરણ મનોહર લાગતું હતું. એમાં જગદુગુરુને બિરાજમાન કરવા માટે મધ્યવર્તી અશોકવૃક્ષની ચારે બાજુ વૈરુદ્ધ રતના સિંહાસન ઝણહળી રહ્યા હતા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા; હુંદુભિ અને દિવ્ય ધ્વનિના મીઠાં સુર રેલાવતા; એવી એવી મહાન શોભાઓ સમવસરણમાં દર્શયમાન હતી. આ બધું જોતાં મારા તો આનંદની અવધિ ન રહી. દેવો, અસુરો વગેરે પણ દેશના સાંભળવા ઊતરી પડ્યા. ઈંદ્રોએ વિનંતિ કરી શ્રી તીર્થકર પ્રભુને સમવસરણમાં બિરાજમાન કર્યા, અને પ્રભુને દેશના દેવા વિનંતિ કરી.

દિવ્ય જિનવાણી :

“પ્રભુએ ધર્મની વાણી રેલાવી. વાણીમાં મીઠાશ કેટલી, જાણો છો? ભારે થાક, ભૂખ વગેરે ભૂલાવી દે એટલી અજબ મધૂરતા! શાસ્ત્ર દણાંત કહે છે. તોશી ભારે અશક્ત છતાં જંગલમાં મુશીબતે લાકડાં શોધતી નિરાશ થઈને પાછી આવી હોય; શેઠે ગુસ્સે થઈ રોટલો દેવા ના પાડી ફરી લાકડાં લેવા ધકેલી; તે બિચારી

વગડામાં બહુ મહેનત કરીને લાકડાં લઈ ભારો માથે ચઢાવી સૂર્યના પ્રખર તાપમાં ચાલી આવતી હોય, વિચારો કેટલો તાપ ! કેટલો થાક ! કેટલો ભૂખ ! બધું છતાં ત્યાં જો નજીકમાં સમવસરણમાંથી પ્રભુની વાણીનો અવાજ કાન પર આવે, તો નથી ને ડોશી ભારામાંથી નીચે પડી ગયેલું લાકું ઊંચકી લેવા વાંકી વળી હોય, છતાં એવી ને એવી વાંકી સ્થિતિમાં સ્થંભી જાય અને જિનવાણી સાંભળવામાં લયલીન બની બધાં દુઃખ ભૂલી જાય.

“પ્રભુની વાણીમાં પાંત્રીસ અતિશયો હોય છે. ભૂખ ન લાગે, તરસ ન લાગે, થાક નહિ, કંટાળો નહિ, એવો અદ્ભુત વાણીનો રસ હોય છે, બાકી તો અતિશયો એટલે કે પ્રભુની વાણીની અપતીમ વિશેષતાઓ અવર્ણનીય હોય છે. દા.ત. પ્રભુ એક જ ભાષામાં બોલે, છતાં દેવો, અસુરો, માનવો, અને ભિન્ન ભિન્ન જાતના પશુ-પંખીઓની પોતપોતાની ભાષામાં એ બોલી પરિણમી જાય એ કેવી અજોડ વિશેષતાઓ ! એમ પ્રભુના એક જ વાક્યથી હજારો શ્રોતાના સંદેહને એકી સાથે જવાબ મળી જાય, એ કેવી અનુપમ શક્તિ ! આવી વાણી સાક્ષાત્ સાંભળવા માટે એના ય કોડ થાય છે. કવિ કહે છે,

‘જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરુવેલડી, દ્રાખ વિહાસે ગઈ વનવાસે પીલે રસ શેલડી;
સાકર સેતી, તરણા લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું, સ્વર્ગ દીઠું, સુરવધૂ ગાવતી.’

પ્રભુના મુખેથી અપૂર્વ મીઠાશવાળી વાણી પ્રગટતી જોઈને કલ્યવૃક્ષની વેલડી તો ‘વિહાસે’-વિહાયસમાં આકાશમાં, એટલે કે દેવલોકમાં જ ભાગી ગઈ. ત્યારે દ્રાક્ષ બિચારીએ વનવાસ લીધો. અથવા કલ્યવૃક્ષની વેલડી જેવી મીઠી જિનવાણીને જોઈ ‘વિહાસે’ અર્થાત્ મશકરી લાગવાથી દ્રાક્ષ વનવાસ કરવા ચાલી ગઈ; અને શેરડી તો બિચારી કોલુમાં ભરાઈ બેઠી તે પીલાવાનો અવસર આવ્યો. ત્યારે જિનવાણી સામે સાકર પણ મીઠાશમાં ઝાંખી પડી જવાથી સીદાઈ-શોદાઈ જાય છે; નાના સ્વરૂપવાળી બની ગઈ છે. ત્યારે ઘાસમાંય મીઠાશ હોય છે, પણ તે ય હારી જવાથી કોઈ એનો ભાવ નહોતું પૂછતું, તેથી જનાવરોએ એને આશ્રય આપ્યો. મુખમાં લઈ ચાવે છે, બાકી અમૃત પણ જિનવાણી આગળ એવો પરાજય પામી ગયું કે અહીંથી એ સ્વર્ગમાં જ ભાગી ગયું. એવી વિજયવંતી અને અમૃતથીય મહાઉત્કૃષ્ણ મીઠાશને અનુભવ કરાવનારી જિનવાણીના ગુણગાન સુરવધૂઓ, અપ્સરાઓ કરે છે. આવી વાણીના રસનો અનુભવ કરનારને જ એનો ઘ્યાલ આવી શકે.”

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૨૩, તા. ૧૮-૨-૧૯૫૬

વિજયસિંહને મહાન ભાગ્યના ઉદ્યે પ્રભુનું આવું સમવસરણ જોવા મળે છે; વાણી સાંભળવા મળે છે. વર્ણન સાંભળતા આપણાને એમ થાય છે કે આવું જોવાનું આપણાને ક્યારે મળે ! રૂપવિજયજી મહારાજ કહે છે,

“જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય તે સુર નર ખેચરા.”

પ્રભુના પાંચ કલ્યાણકોમાં દેવતાઓ અપૂર્વ ભક્તિ કરે છે. એ દશ્ય અત્યંત દર્શનીય હોય છે. એમનાં જ કેવળજ્ઞાન કલ્યાણકના પ્રસંગમાં સમોસરણ મંડાય છે. પછી તો પરમાત્મા કેવળજ્ઞાનીપણે વિચરતા હોય છે. ત્યાં જુદા જુદા સ્થળે પ્રભુની દેશના સમસ્ત જનતા સાંભળે એ માટે દેવતાઓ સમવસરણ રચે છે. એના દર્શન માત્રથી કેઠિકના મદ-મિથ્યાત્વ ઓગળી જાય છે. આપણાને સમવસરણના દર્શનની ઝંખના થાય, તે ચમત્કાર જોવા નહિ હોં તો શા માટે ? કહો,

સમવસરણ જોઈને,

(૧) એ વૈભવ સમૃદ્ધ દુન્યવી વૈભવ એની આગળ તદ્દન તુચ્છ લાગીને એનો મોહ ઉત્તરી જાય.

(૨) દેવો અને ઈન્નો જેવાને પ્રભુની સેવામાં નજરો નજર જોઈ આપણાને પ્રભુ-સેવાનો ભારે ઉછરંગ જાગે, એમ થાય કે અહો દેવતાઓ મહાન વૈભવ-વિલાસ મૂકી જો અહીં લાગી પડ્યા છે, તો મારી પાસે તો શા એવા વૈભવ વિલાસ છે કે એને ચાટો બેસી રહું અને આવી મહાકિર્મતી સેવા ગુમાવું ?

(૩) સમવસરણમાં સિંહ-વાઘ-વરણે હરણિયા-બકરા સાથે શાંતભાવે બેઠેલા જોઈ તીર્થકરદેવની અનુપમ કૃપા અને પ્રભુનો પ્રેમ-મૈત્રીમય સિદ્ધાંત મૂર્તિમાન દેખાય. તેથી આપણા હૃદયમાંથી વૈરવિરોધ અને ઈર્ષા અસુયા ચાલી જાય. મહાસમભાવ આવે. વળી,

(૪) સમવસરણમાં મોટા શેઠ શાહુકારો અને રાજા મહારાજા જેવાનેય સાપની કંચળીની જેમ સંસારનો ત્યાગ કરી ચારિત્ર લેતાં અગર લઈ ચૂકેલા જોઈ આપણાનેય ત્યાગની મહાન પ્રેરણ મળે. બાકી,

(૫) ભાવ તીર્થકરદેવના દર્શન, ગણધર ભગવંતો આદિ મહાર્ણિઓનાં દર્શન, વગેરે વગેરે કેઠ લાભો, સમવસરણ જોવા મળે, એમાં છે.

પ્રભુએ દેશના દેવા માંડી, દેવો, માનવો, તર્યચો સાંભળી રહ્યા છે. વિજયસિંહ આચાર્ય સમરાચિયના જીવ શિખીકુમારને કહે છે કે હું પણ સાંભળવા બેસી ગયો. પ્રભુએ દેશનામાં શું કહ્યું ?

પરમાત્માએ દેશનામાં શું કહ્યું ? :-

એ જ, જીવનને અશાશ્વત બતાવ્યું, “તમારું જીવન અશાશ્વત છે. કાયમ ટકવાવાળું નથી; સર્વકાળ રહેવાવાળું નથી. એક દિવસ જીવનનો અંત થવાનો છે. અહીંનું જીવન તો બહુ સંક્ષિપ્ત જીવન છે. જ્યારે આગળનો કાળ તો અનંતો છે ! એમાં ક્યાં જાણો છો કે શું શું અનુભવશો. ટૂંકાશા જીવનમાં વિજ્યય-કખાયની આંધીમાં ચઢી ગયા, અર્થકામના પુરુષાર્થમાં લીન થઈ ગયા, તો આગળનો અનંતોકાળ ભયંકર થઈ જવાનો.”

વિજ્યસિંહનો પ્રશ્ન :-

મેં પરમાત્માની દેશના સાંભળી પછી મારા મનમાં તે કૌતુક યાદ આવતાં ત્રિલોકનાથ પ્રભુને મેં પ્રશ્ન પૂછ્યો કે “પ્રભુ, આ નાણિયેરનું જે વૃક્ષ, તેનું મૂળ કેમ એટલું નીચું ગયું છે ? શું ત્યાં કોઈ ધન છે ? કોઈ નિધાન છે ? ને છે તો કેટલું છે ? કોણે સ્થાપું ? અને તેનું પરિણામ શું. ?”

પ્રભુના ઉત્તર : નાણિયેરીની નીચે નિધાન વિજ્યસિંહનું ! :

અજિતદેવ ભગવાન તેના ઉત્તર આવે છે, “સાંભળ, એ વૃક્ષનું મૂળ. તે મૂળના જીવના લોભ-દોષને લઈને જ આટલું લાંબું પહોંચ્યું છે. જ્યાં છેડો છે ત્યાં ધન છે. સાતલાખ સુવર્ણ છે. તે અને આ નાણિયેરીના જીવ, બનેએ તે દાટયું છે; અને એનું પરિણામ ધર્મની સાધના છે.” જો જો જોગાજોગ કેવો બની આવે છે ! વસ્તુ અને વાસનાની જાણે સાંકળ ! તે, વાસના જીવને વસ્તુ પાસે બેંચી લાવે છે. પણ એટલું સમજ રાખજો કે વાસનાનું બેંચાણ, જીવની વડાઈ કરવા માટે નહિ, પણ વિનાશ કરવા માટે; પુણ્યની પાયરીએથી નીચે નીચે ઉતારવા માટે; ગુણોનું દેવાળું કઠાવવા માટે. આગળ જણાશે કે નાણિયેરીનો જીવ વાસનાની સાંકળે કેવો ઊંચો મનુષ્યભવથી નીચે ઠેઠ આવા વનસ્પતિના ભવ સુધી બેંચાઈ આવ્યો છે. જડ વસ્તુની વાસના ભૂંડી છે. આવા ઉચ્ચ ભવ અને ઉચ્ચ ધર્મકાળમાં વાસનાના બને તેટલા ભૂક્કા ઉડાડવા જેવા છે.

વિજ્યસિંહ કહે છે, “અરે ! આ શું વાત ? મેં આ ધન દાટયું ? મને યાદ પણ નથી આવતું કે મેં આ જીવનમાં ધન દાટયું હોય. તો જરૂર કોઈ આગળના ભવની વાત હશે. માટે લાવ, ભગવાનને પૂછી લઉં !” એમ વિચારીને મેં ભગવાનને પૂછ્યું તેનો ઉત્તર આપતાં પરમાત્મા કહે છે;

વિજ્યસિંહ આચાર્યના પૂર્વભવ.

લક્ષ્મીનો જુદ્મ : બાલચન્દ્ર ગુણચન્દ્ર :

“આ જે વિજ્ય છે, તેમાં અમરપુર નગરમાં અમરદેવ અને એમની સુંદરી પત્નીના તમે બંને પુત્ર હતા. તેમાં તારું નામ બાલચન્દ્ર હતું. અને એ જીવનું નામ હતું ગુણચન્દ્ર. તમે બંને ગૃહસ્થના પુત્ર હતા. જ્યારે યુવાન થયા ત્યારે વેપાર કરવા વસ્ત્ર વગેરે માલ ભરી આ પ્રદેશમાં તમે આવ્યા. આવીને માલનું વેચાણ કર્યું. લાભ મનગમતો થયો. એટલામાં વિજ્યવર્મા રાજાએ લક્ષ્મીનિલય નગરના રાજ સૂરતેજ પર આકમણ કર્યું.

ધન દાટે છે :

“સૂરતેજ રાજાએ જોયું કે મારી પાસે એટલી શક્તિ નથી. એટલે પોતાનું બીજું બધું છોડી દઈ, સાર-સાર વસ્તુઓ અને નગરવાસીઓને લઈ આ પર્વત પર ચઢી ગયો. તમે બંને પણ શત્રુનું સૈન્ય જોઈ ગભરાઈ ગયા હતા, તેથી તમે પણ પૈસા લઈ રાજ સાથે પર્વત પર આવી ગયા. પરંતુ લય લાગી ગયો હતો; કે ‘રાજ અમારી પણ લૂંટ કરે તો ? માટે શું કરીએ ? ભાગી જવાય એમ નથી, ઉપદ્રવનો મામલો છે. ત્યાં ભરોસો કેમ રહે ?’ આથી તમે બંનેએ જમીનમાં ખાડો ખોદીને ધન અમાં દાટી દીધું. જીવની આ વાતમાં કેટલી બધી સાવધાની છે ! કેટલી બધી ધગશ છે ! પાછી આવી ને આવી પ્રવૃત્તિઓ કરીને એ કુવાસનાઓ દઢ થાય છે. પરિણામ, તત્ત્વને અયોગ્ય હુદય.”

ત્યાં તીર્થકર પ્રભુ વિજ્યસિંહને કહે છે : “તારા ભાઈ ગુણચન્દ્રની બુદ્ધિ બગડી. એને થયું કે ‘આ બાલચન્દ્ર અડધો ભાગ લઈ જશે ! પણ અહીં કોણ જોનાર છે ? માટે આને મારી નાખું. પછી તો સારીયે સંપત્તિ મારી થઈ જાય !’

લક્ષ્મી જગતમાં શું કરાવે છે ? અનર્થ કે અર્થ ?

અનર્થ ધર્મ શું કરાવે ? મહા અર્થ, મહા લાભ ધર્મના છતાં તમે અવસરે અવસરે સ્વાગત કોના કરો છો ? અનર્થભૂત લક્ષ્મીના ને ? ગુણ કોના યાદ કર્યા કરો છો ? તેથી લક્ષ્મીના જ. ધન્ય તમને ! પ્રવૃત્તિ હવે પલટો. ગુણ ધર્મના ગાયા કરો. લક્ષ્મીના પાપે તો ગુણચન્દ્ર ભાઈના ખૂનનો વિચાર કરીને માત્ર ન અટક્યો; પણ આમ વિચારી તેણે વિષ પ્રયોગ કરી બાલચન્દ્રને ફસાવ્યો. બાલચન્દ્ર તો સરળ સ્વભાવી હતો. તેથી એ મરીને વ્યંતરદેવ થયો. સરળ સ્વભાવની બલિહારી છે. સરળતા યોગે અહીં કદાચ નુકશાન જેવું દેખાય, પણ પરિણામ સુંદર હોય છે. ત્યારે કપટીનો મહા મરો છે. જુઓ, ગુણચન્દ્ર લક્ષ્મીનું રક્ષણ કરતો ત્યાં જ છે. ત્યાં તો એક સર્પ આવ્યો. અને ગુણચન્દ્રને ડંઘ્યો. ગુણચન્દ્ર દુર્ધ્યાનમાં મર્યો; અને મરીને થયો પહેલી નરક ભેગો ! લક્ષ્મી ત્યાંની ત્યાં ! અને બંને ભાઈઓના માર્ગ જુદા જુદા પડી ગયા !

ગુણયંદ્રના જેરથી બાળચંદ્ર દેવતા થઈ દેવદત્ત : ગુણયંદ્ર નરકે થઈ સર્પ :- તીર્થકર ભગવાન વિજયસિંહને કહે છે “તું મરીને વંતર થયો. ત્યાં કંઈક ન્યૂન એવું એક પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી તું ટક્કાપુર નગરમાં આવ્યો. સાર્થવાહ હરિનંદિની પત્ની વસુમતીનો પુત્ર થયો. તાહું નામ દેવદત્ત રાખ્યું. એટલામાં ગુણયંદ્રનું નરકાયું પણ પૂર્ણ થયું અને તે આવ્યો લક્ષ્મી પર્વત પર, સર્પ તરીકે. જાતિમરણ ન હોવા છતાં પરિગ્રહની સંજ્ઞામાં પૂર્વનું દાટેલું નિધાન પોતાનું કરીને ત્યાં બેસી પડ્યો.

“એટલામાં એવો મોકો આવી ગયો, કે નગરમાં ઉત્સવ થયો. તે ઉત્સવમાં તું આ લક્ષ્મી પર્વત પર આવ્યો. આવીને દેવતાની પૂજા કરી; દીન-અનાથને દાન આપ્યું; ભોજન કર્યું, પછી પર્વતની રમણીયતા જોતાં જોતાં, ફરતો ફરતો તું એ નિધાન પાસે પહોંચ્યો ગયો.”

દુષ્ટ ભાવનાનો દારુણ વિપાક : નિધાન પરના સર્પનો કોપ :-

“તે બિચારાએ હજુ ધન તરફ દાણ પણ નથી નાખી, ત્યાં પછી ખાડો ખોદીને કાઢી લેવાની તો વાત જ ક્યાં ? પણ સર્પને આટલું નિમિત્ત મળી ગયું કે ‘અહીંયાં મારું નિધાન છે, ને આ અહીં ક્યાં આવ્યો ? આ તો મારું લઈ જવા આવ્યો લાગે છે. તે લઈ જવા ન દઉં. ગમે તેમ કરી એનો બચાવ કરું.’ એમ કરીને દુષ્ટ ભાવનામાં ચઢ્યો. પછી શું ? દુષ્ટ ભાવનાનો દારુણ વિપાકે દુષ્ટતાનો અમલ કરવામાં પોતાનું છેલ્લું શસ્ત્ર ‘ઉંસ મારવાનું’ વાપરવાનું.” ગધેનું જેમ લાત લગાવે, ફૂતનું જેમ બટકું ભરે, તેમ આ સર્પ સીધો ઊસીને પ્રાણ લેવા જાય છે ! જેમ ચંડકૈશિકને મણ્યા’તા તો પ્રાણી માત્ર પર પરમહૃપા વરસાવનારા પ્રભુ મહાવીર સ્વામી. પણ દુષ્ટ ભાવનાના ફળરૂપે બીજું સૂજે શું ? એ તો ગયો પરમાત્માને ઊસવા ! પ્રભુને ભર્યું બટકું ! ભાવના બગાડી તો બાર વાચ્યા સમજો.

ગમે તેમ હો, પણ એક બીજી વિચારણા છે. મનુષ્ય કરતાં પ્રાણીઓ જાખ્યા ખરા કે નહિ ? મનુષ્ય તો કહેશે, ‘લગાવ અણુભોખ !’ એક સાથે હજારોને ખાખ કરવાના ! તો આજના મનુષ્યની આવી વૃત્તિના હિસાબે કહો જોઉં, કેટલા જંગલી પશુઓનો એક મનુષ્ય બને ? તુલના કેવી રીતે થાય ? મનુષ્યને પોતાના મનથી જરાક પ્રતિકૂળ બનવું જોઈએ ! પછી કેમ ? પોતાની પાસે જે શરસ્ત હોય તેનો ઉપયોગ કરવાની જ વાત ! ઘરકુટંખમાં જેમ શસ્ત્ર હોય છે ને ? કોઈની પાસે વાણી ! તો કોઈની પાસે આંખ ! કોઈની પાસે લાત, ને કોઈની પાસે ધોકો ! પણ આજના વિજ્ઞાનના હિમાયતી અને વિજ્ઞાન પર ખેલનારનું જીવન જોઈએ તો કેટલો બેદ થાય ? ભયંકર શસ્ત્રનો ઉપયોગ કરતાં કોઈ બેદ ખરો ?

સર્પ દેવદત્તને ડસ્યો :-

ગુણયંદ્રનો જીવ સર્પ થઈને બાલચંદ્રના જીવ દેવદત્તને ‘આ ધન લઈ લેશે,’ એમ માની કરડચો, તો દેવદત્તના નોકરોએ એને (સર્પને) મારી નાખ્યો. એ મરીને એજ પર્વત પર સિંહ થયો. સર્પના જેરની અતિ ઉગ્રતાને લીધે તત્કષણ જ દેવદત્ત મરીને આજ વિજયમાં કંયંગલા નગરીમાં શિવદેવ યશોધરાનો પુત્ર ઈન્દ્રદેવ નામે થયો. એ એના નગરમાં ઊછરી રહ્યો છે, અને આ સિંહ પર્વતની ગુફામાં ઊછરી રહ્યો છે. સિંહ ફરતો ફરતો નિધાન પાસે આવ્યો. પૂર્વ ભવમાં અભ્યાસ કરેલી ભાવનાથી ઓઘસંજ્ઞાએ એ નિધાનની મૂર્ખી કરે છે; મનમાં એની માલિકી માની લે છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૨૬, તા. ૧૭-૩-૧૯૫૬

કેટલોક કાળ વીતી ગયો, ત્યાં વીરદેવ રાજાએ આ ઈન્દ્રદેવને એક લક્ષ્મીનિલયનગરના રાજા માનભંગ પાસે કાર્યસર મોકલ્યો. તું ઈન્દ્રદેવ કેટલાક પુરુષોના પરિવાર સાથે અહીં આવી રહ્યો છે ત્યાં કાલકમે આ પ્રદેશમાં આવ્યો; અને નીવના વૃક્ષ નીચે બેઠો. એટલામાં ત્યાં દૂરથી પર્વતની ગુફાના નાકે બેઠેલા સિંહે તને જોયો ! લોભ-સંજ્ઞાથી સિંહના ચિત્તમાં વિપર્યાસ થયો; ભ્રમણ ઉત્પન્ન થઈ ગઈ. “આ માણસ અહીં આવ્યો છે ? ધન ઊંચકી જવા આવ્યો લાગે છે. ખબર નથી એને, કે આ તો વનનો રાજા ! ઊભો રહેજે, તને બતાવી દઉં !” એમ વિચારતોક ઉક્ખો.

આ પણ ખૂબી છે ! ઈન્દ્રદેવને આરામ કરવાનું અહીં જ સૂઝુયું ! તમે તો એમ માનો છો ને કે “માણસ હોશિયાર અને સાવધાન હોય તો શું વાંધો આવે !” પણ કર્મ જેને માટે આવા વાંધા લાવીને મૂકે, તેની સાવધાનીય રદ જાય છે ! અને કર્મ અણધારી જીવની અવનવી સ્થિતિ ઊભી કરે છે. એમાં માણસના ગુમાન પણ નકામા, અને દીનતા પણ નકામી છે. મોટો દેવ જેવોય ગમે તેવો હોશિયાર હોય, પણ એનાં નવા ઉદ્ય પામતા તિર્યં ગતિ વગેરેના કર્મ એવી સ્થિતિમાં લાવીને એને મૂકે છે કે કોઈ તેને બચાવનાર નથી !

અહીં એ જોવાનું છે કે ગુણયંદ્ર ઉગ્ર કષાયમાં નરકથી તિર્યં થતો આવ્યો છે. ત્યારે બાલચંદ્ર અકાળ મૃત્યુની પીડાએ મરવા છતાં મનુષ્ય બનતો આવ્યો છે, કેમકે મનુષ્યનો ભવ પામવા જોગું એણે આયુષ્ય બાંધું છે. મનુષ્યાયુ ધોર દુર્ઘાનમાં પણ ન બંધાય; અને ઉગ્ર કષાયમાં પણ ન બંધાય. અલ્ય કષાયમાં મનુષ્ય-આયુષ્ય બંધાય. ત્યારે રહસ્ય એ છે કે આ જીવ હળુકમી બન્યો હશે, તેથી જ અકાળ

મુત્યુની પીડામાં મન એવું નથી બગાડ્યું કે જેથી નરકાદિ હુર્ગતિમાં જવું પડે. સવાલ તમે વર્તમાન પર ગુનેગાર છો કે નહિ એ નથી. તમે બિન ગુનેગાર છતાં જો મન ભગાડી ભયંકર કષાયમાં-દ્વેષમાં પડો તો અહીં માર ખાવા છતાંય ભવિષ્યમાં હુર્ગતિના નવા માર ઊભા થાય છે. એના બદલે જો તમે અલ્ય કષાય અને અલ્ય હુધ્યનીમાં હો તો ભવિષ્ય માટે નવાં હુંબ જન્મતાં નથી. ઈન્દ્રદેવ એથી જ ગ્રણેય ભવમાં મનુષ્ય બનતો આવ્યો છે.

અજિતદેવ તીર્થકર ભગવાન વિજયસિંહ આચાર્ય મહારાજને તેમના ભવ બતાવે છે. તેમાં હજુ એ નથી બતાવ્યું કે ‘તું’ હવે ધર્મ પાય્યો.’ પણ એ બતાવ્યું કે આ શત્રુથી તું મર્યે જાય છે ! જ્યાં સુધી ધર્મનું સેવન ન કરવામાં આવે ત્યાં સુધી, અંદરમાં જે છૂપાં કર્મ પોતાનું નાટક ભજવી જાય છે, તેમાંથી બચવું તો દૂર રહ્યું પણ તેવાં હું કર્મને ફરી બાંધવાનો જાણે ઈજારો રાખ્યો હોય છે. પાપબંધ કરવા માટે મોહ માયાની ભરચક લાગણીઓ જોઈએ. તો તમને ૨૪ કલાકમાં એક પણ એવી મિનિટ જડે છે કે જ્યારે બિલકુલ માયાની લાગણી બંધ હોય ? ના ! કોઈ પણ એક દિવસ મોહ-માયાની લાગણી વિના પંસાર થયો હોય તે બતાવો ! અને તે મોહમાયા હોય એટલે સ્ટોકમાં પડેલા કેટલાંય જન્મનાં કેટલાંય પુણ્ય પાપ ધસારાબંધ ઉદ્યમાં આવતા નવાં પાપોપાર્જનને તક મળે. માટે જ મોહ લાગણીઓને બદલે એવા ધર્મનું આલંબન કરવું કે જેથી નવાં બંધાય તો નહિ પણ જૂનાંય ઘસાતા જાય. માટે આ કર્તવ્ય છે કે તપ ધર્મના બારે પ્રકારની સાધની કરી લેવી જોઈએ. બાલચન્દ્ર શું ભૂલ કરી હતી ? દુનિયાનો ન્યાયસર વેપાર કર્યો હતો. તેમાં પોતે અદ્ધો ભાગીદાર હતો. છતાં તે પોતાનું નિમિત્ત પોતાને જ નને છે ! આપણે આ નિમિત્તને આપણી આબાદીમાં કારણ માનીએ તે જુદી વાત; પણ શું આપત્તિમાં કારણ ન માની શકાય ? આ સંસારની ચીજે કેવી છે ? અવસરે એનાથી સુખ મળવું તો દૂર રહ્યું, પણ આપણી કલ્યાનમાં ન હોય તેવી આપત્તિ ઊભી કરે તેવી બને છે !

સિંહ મારે છે, ને મરાય છે :

ઇન્દ્રદેવ સહજભાવે નિધાનની નજીકના ઝાડ આગળ આવ્યો. ત્યાં તો સિંહ ગર્જ્યો ! શુફાની બહાર આવ્યો. લોભની સંજ્ઞાને પરવશ પડેલા જીવને પછી કાર્યકાર્યનો કર્યાં વિવેક જ કરવો છે ? ઊંધી જ વિચારણામાં ચેડે. “બસ ! આ મારું લેવા આવ્યો ? મારી નાખું !” ચારે પગે ત્રાટીને ઇન્દ્રદેવ પર હુમલો કર્યો. જેવો સિંહ આવ્યો તેવો જ ઇન્દ્રદેવ ઊભો થઈ ગયો. બંનેની લડાઈ થઈ. લડતાં લડતાં ઇન્દ્રદેવે સિંહને માર્યો અને સિંહે ઇન્દ્રદેવને માર્યો ! બેમાંથી એકેય બચી

શક્યા નહિ. બંને એક વખતના ભાઈ, તે આજે એકબીજાને મારી નાખનાર ભયંકર શત્રુનું કાર્ય કરે છે ! સંસારના મેળ અને અમેળ, બંનેય ખોટા છે. મેળમાં ભરોસે મરે છે; અણભનાવમાં દ્વેષની આગમાં બળે છે.

લત :- જે લક્ષ્મીનો સિંહને કોઈ ઉપયોગ નથી, કે ‘આ પૈસા લઈને એમાંથી સારું ખાવાનું ખરીદી લાવું કે બીજી મોજ કરું !’ છતાં એને આવી લક્ષ્મીની લત કેમ લાગી ? કહો કે મનુષ્ય જન્મમાં લત ઊભી કરી હતી, અને તેને પછીથી બીજા ભવોમાં પણ મજબૂત પકડી રાખી છે ! પછી પકડી રાખવાનું શાથી ? એટલા માટે કે પૂર્વના જે મનુષ્યપણામાંથી બ્રાષ થયો છે, તેની અંતઘડી સુધી એ લત લગાડી હતી. જેવી લત આપણે અંતપળ સુધી લગાડીએ તેવી લત આગલા ભવમાં ચાલુ રહે એમાં નવાઈ નથી. તો સંયમ જીવન સ્વીકારો કે સંસારની ઘણી ઘણી લતો છૂટી જાય. એમ કેમ ન કહું કે ખાતાં-પીતાં મોક્ષ મળી જાય ? કેમ ન કહું કે કુટુંબ સાચવતાં પણ સંસારથી છૂટકારો થાય ? કેમ તીર્થકર જેવા પણ ચારિત્ર લે છે ? એજ રહેસ્ય છે, કે ચારિત્ર જીવનમાં એવી લતો છૂટી જાય છે, તેથી ભવાંતરમાં તે આગળ નથી ચાલતી; તેથી ભાવી ભવો ઉજ્જવળ બની અનંત ઉજ્જવળ મોક્ષપદે જલદી પહોંચાય છે.

સંસારમાં જીવોને અનેક પ્રકારની લતો લાગેલી હોય છે. કોઈને મોજશોખની, કોઈને ખાનપાનની, તો કોઈને કપડાં અપ-ટુ-ટેટ રાખવાની ! કોઈની વળી એમ છે કે “પૈસા જ ભેગા કરો !” કોઈ વળી કહે છે ‘પૈસા-ટકા તો ઠીક, પણ જે આવે તેને દબદાવે રાખો.’ કેટલાકને લત એવી કે કેદીકની બનાવટ જ કરે ! દરેક વાતમાં માયા અને પોલિસી ! લત ! કેટલી લતો ગણવી ? પાર નથી. કોઈકને બજારમાં ડાફોડિયાં મારવાની જ લત ! કેટલાક કાનથી આનું ને તેનું, છૂપું સાંભળ્યા જ કરે ! બારણા આગળ કે ભીત ઓઠે કાન જ ધરવાની લત ! પાછું એ સાંભળીને પોતાનો જીવ બાયા કરવાની જ લત ! આમાંથી કોણ બચાવે ? કેદીકને ચેડાં કરવાની લત ! તો કેદીકને ચાળાં કરવાની લત ! તમારા સંસારમાં આવું આવું દેખો છો ને ? ગણત્રી કરતાં લતોનો પાર પમાય એમ થતી. તેવી લતોનો પણ અંત પમાડનાર છે એક માત્ર ધર્મજીવન-ચારિત્રજીવન ! એથી જ બચાય. બાકી તો સંસારી જીવની એકેક લત ભવાંતરમાં ભયંકર ભવો આપે, તો અનેક લત શું ય ન કરે ? લતો જીવની ડાકણ જેવી છે. ભયંકર પિશાચ જેવી છે. વળગીને જીવનાં સત્ત્વ અને પુણ્ય બે ય નિયોગી નાખે છે. આ જે સમજે તે ભાવી ભયાનકતામાંથી બચી શકે. તમારે બચવું છે કે નહિ ? કે પછી આની આ લત ભવિષ્યમાં ચાલુ રહે તો વાંધો નથી ?

સંયમ-જીવનમાં એનો અંત એ માટે આવી શકે કે સંયમજીવન એ પવિત્ર અને ચોવીસે કલાકનું ધર્મમય જીવન છે. તે પણ પ્રવૃત્તિરૂપ જીવન ! સમકિતીનું ધર્મમય જીવન એ હાઈક વલણરૂપ; શ્રાવકનું ધર્મજીવન એ તદ્દુપરાંત થોડી ધર્મપ્રવૃત્તિરૂપ, પણ સાધુનું જીવન સંપૂર્ણ ધર્મવલણ સાથે ધર્મપ્રવૃત્તિરૂપ જીવન ! સમકિતી જીવ દુકાને વેપાર કરવા જાય તો આચરણ પાપની છે, પણ વલણ ધર્મનું હોય છે. “ક્યારે આ પાપથી છૂટું ? અહીંયાં કેમ ઓછામાં ઓછી પાપકરણીથી પતાવું ? કેમ વધુ જીવોને બચાવું ?” ધર્મના વલણને લીધિ, દુકાને ગયો તો પણ, વિચારણા આ છે ! “આજીવિકા મળી જાય એટલે બસ, ઝટ આત્મહિતની સાધનામાં લાગી જાઉં !” આ તો સમકિતી માટે, પણ સાધુ માટે ? ચોવીસે કલાક ધર્મમય જીવન ! શાસ્ત્રોનું ભરચક અધ્યયન છે, કે જે કષાય અને દુર્ધ્વનિનું ઝેર નાબુદ કરવા અમૃતનું કામ કરે છે ! આહારાદિ સંખાના મેલ કાપવા પાણીના ધોધનું કામ કરે છે ! આવા અમૃત અને જલ વર્ષા જ્યાં હોય છે, વળી જ્યાં બાચ્ય-આભ્યન્તર તપો છે. મૈત્રી-આદિ ભાવનાઓમાં જ્યાં લયલીનતા છે, અનિત્ય, અશરણ આદિ ભાવનાઓમાં જ્યાં સર્વાગીણ સ્થાન છે; એવી સંયમની અવસ્થામાં પેલી લતોને ઊભી રહેવાનો અવસર જ ક્યાં છે ? દુર્ગતિમાં ગરકાવનારી એ બધી લતોનો સંયમ-જીવનમાં અંત આવી શકે છે. તેથી ભવાંતરમાં જીવનું બગડતું નથી. પણ આ ગુણચન્દ્રનો જીવ લત લઈને આવ્યો છે ! તેમાં વળી સિંહનો અવતાર ! એટલે ઇન્દ્રદેવ ભલે નિધાન લેવા નથી બેઠો છતાં અને જાનથી મારી નાખે છે; પણ પોતે પાણો એનાથી જ ઘવાયેલો મરે છે. બંને મરીને એક યક્ષદાસ ચંડાલની માતૃપક્ષા નામની પત્નીના પુત્ર પણે જોડિયા ભાઈ તરીકે જન્મ્યા.

પ્ર.- સિંહ મરીને મનુષ્ય કેમ થયો ? મારી નાખવાની પ્રવૃત્તિમાં મનુષ્ય થાય ?

૩.- આયુષ્યના બંધ થવા કાળે કોમળતા આવી ગઈ હોય, તો વખતે મનુષ્ય પણ થાય. આયુષ્ય બંધકાળની પૂર્વે કે પછી ભલે કૂરતા હોય; છતાં આયુષ્ય બંધકાળની આજ ખૂબી છે. મરતાં મરતાં કોમળ પરિણામ થઈ જાય તો મનુષ્યાનું પણ બાંધે. તેવી રીતે પહેલાં ધર્મ કરતાં મનુષ્યનું આયુષ્ય બાંધું, પછી ધર્મ થોડી દીધો, તો પણ એક વાર મનુષ્યનો ભવ તો મળી જાય !

ગોશાળા જેવાએ જિંદગીમાં કંઈ સારું કર્યું નહોતું, છતાં તે મરીને બારમા દેવલોકમાં ગયો ! સંભવ છે પૂર્વે સારા પરિણામમાં આયુષ્ય બાંધું હોય, કે તેણે કદાચ અંતિમ પશ્ચાતાપ વખતે જ આયુ બાંધું હોય. અંતકાળે એના હંદયમાં ભારે પશ્ચાતાપ જાગ્યો હતો. એમાં એણે શિષ્યોને કહી દીધું, “હું સાચો જિન-સર્વજ્ઞ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૨૫૭

નથી. સર્વજ્ઞ સાચા તો મહાવીર છે. હું તો એમનો શિષ્ય ગોશાળો છું. મેં એ પરમાત્માનો દ્રોહ કર્યો છે. તો હવે મારું મહું દોરડે બાંધી કૂતરાના મડદાની જેમ રાજગૂહીમાં છસુજો ! અને કહેજો કે જે ગુરુની આશાતના કરે, ઉપકારી ગુરુનો જે દ્રોહી બને, તેના આ ભવમાંય આવા હાલ થાય, તો ભવાંતરે તો શું ય નહિ થાય ?” અંદરમાં કેવો અને કેટલો જોરદાર પશ્ચાતાપ જાગ્યો હશે કે ૧૧ લાખ માનવનો ગુરુ, ૧૧ લાખ ભક્તોનો દેવ, એ પોતાના મોટા શિષ્યોને આ પ્રમાણે કહે છે !! આ પશ્ચાતાપ એવો નથી, “કે ભાઈ, જાણીએ છીએ કે ધાણું પાપ થયું, પણ શું થાય ? રાખી મૂકો અંદરમાં...” ગોશાળો આમ નથી કરતો, ગળગળો થઈ બહાર કહી બતાવે છે ! સ્વમતનો સ્થાપક હોવા છતાં પોતાના મહાન અનુયાયીને એ પ્રમાણે કહે છે ! દિલના ઊંડાણનો અને જોરદાર પશ્ચાતાપ છે. જો આવી છેવટના અવસ્થામાં પણ આયુષ્ય બંધાય તો ઉચ્ચ ભવનું આયુષ્ય ! ત્યારે બીજી બાજુ જીવનભર ધર્મ કર્યો હોય પણ આયુષ્ય બંધાતા પરિણામ ખરાબ તો એક વાર તો ખલાસ ! માટે જ માણસે હરેક પળે સાવધાન બની મન ન બગાડવા દેવું. લાખ ઉપદેશનો સાર આ, કે જીવનમાં પ્રવૃત્તિ ગમે તે ચાલુ હોય, પણ કદાપિ મનને બગાડવા દેવું નહિ. કાયા પાપમાં જતી હોય તો પણ મનને અંદરથી ધર્મની વૈરાગ્યની ભાવનામાં રાખવું.

કંઈક કોમળતામાં સિંહે મનુષ્યાયુષ્ય લીધું; પણ સિંહપણામાં અને પૂર્વે પાપ ધણાં ભેગાં કર્યો છે. એટલે અહીં મનુષ્ય થઈને પણ બીજું શાનું સુઝે ? બંને ચંડાળને ત્યાં જન્મ્યા. બંનેજા નામ અનુકૂમે કાળસેન અને ચંડસેન રાખ્યાં. બંને ભાઈઓ યુવાવસ્થાને પાખ્યા. એક દિવસ શિકાર કરવા લક્ષ્મી પર્વત પર ગયા. ભવિતવ્યતા જબરું કરે છે ! બંનેને હરોળમાં લાવીને મૂક્યા ! સિંહને ચંડાળ મનુષ્ય અને ઊંચા મનુષ્યને ય ચંડાળ મનુષ્ય ! પણ પેલાને ઊંચે ચઢવામાં જેમ નિમિત્ત, તેમ આને નીચે પડવાનું નિમિત્ત હતું. સિંહને મારી નાખવામાં માનવતાનું કોઈ ઉચ્ચ કાર્ય ન હતું. પોતે બળવાન હતો કરી લ્યો સિંહનો સામનો.

પ્ર.- ત્યારે શું સ્વરક્ષણ ન કરવું ?

૪.- રક્ષણ કાયાનું કિમતી કે આત્માનું ? કાયાનું રક્ષણ કરો, પણ માનસિક પરિણામ કેવા છે એના પર કર્મબંધનો આધાર છે. સામાન્ય રીતે લડવા-જગડવામાં હંદય કૂર બને છે, દુષ્ટ બને છે. એ ન બને એ કોક ભાગ્યવાનને. ઇન્દ્રદેવને પરિણામ કંઈક પણ બગાડ્યા તેથી કર્મે નીચે ઉતારી ચંડાલનો ભવ આપ્યો. આ તો વળી આટલે જ અટક્યું પણ જુઓ કે,

ત્રિપુષ્ટ વાસુદેવે સામે આવેલા સિંહને ચીરી નાખ્યો ! ને એવાં બીજા ધણાં

૨૫૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વિજયસિંહ આ.ના પૂર્વભવ” (ભાગ-૨૨)

પાપ કર્યા તો શું પરિણામ આવ્યું ? સાતમી નરક !

એની સામે-પાર્થનાથ ભગવાનનો જીવ, પૂર્વભવમાં રાજી હતો. ચારિત્ર લીધું; તપ કર્યો; કાયા સુકાઈ ગઈ. એક વખત જંગલમાંથી વિહાર કરીને ચાલ્યા જાય છે, ત્યાં સામેથી સિંહની ગર્જના આવી. મુનિની નજર ગઈ, મુનિ સાવધાન થઈ ગયા. હવે ? તપશ્ચયથી ઉત્પન્ન થયેલી લબ્ધિથી અટકાવે ? સામનો કરે ? ના, એવું કંઈ જ ન કરતાં જોઈ લીધું કે “આ સિંહની હવે ત્રાપ આવવાની તૈયારી છે...દરમિયાનમાં જો હું ગફલતમાં રહ્યો, તો મારા શરીરથી વિરોધના અને મારું કુમૃત્યુ થઈ જાય ! માટે તૈયારી કરી લેવા દે.” રજોહરણથી જમીન પુંજી લીધી. કેમકે સિંહ આવે ને કાયા એમ જ નીચે પડી જાય તો ત્યાં કોઈ બિચારો નિર્દ્દીષ જીવ મરી ન જાય. કેવી ઉત્તમ દશા છે ! પોતે સિંહના જડભામાં ચવાઈ જાય તેનું શું ? તેનું કંઈ નહિ ! પોતાના જીવને કોઈ કષણો દહાડો જોવાનો આવે તે તો દિવાળીનું ટાણું ! પરંતુ બીજો જીવ સહેજ પણ દુભાય તે પોતાના માટે પણ હોળી ! બહાદુરી ક્યાં ? પોતાની કાયાને બચાવવામાં કે આત્માને ?

મુનિ જમીન પુંજને નીચે બેસી ગયા. મહાત્રતોનું પુનઃઉત્સ્વારણ કરી લીધું. જ્યારથી મહાત્રત લીધા ત્યારથી અખંડ પાલનનો પુરુષાર્થ છે. પરંતુ છભસ્થતા અને પ્રમાણને લીધે સૂક્ષ્મ પણ ભંગ થયો હોય તો ? માટે ફરીથી પ્રતિજ્ઞા કરી લીધી. સર્વ જીવોને ખમાવી દીધા. અરિહંતાદિનાં શરણ સ્વીકારી લીધાં. હવે સિંહ કરી કરીને શું કરવાનો હતો ? જે જડ છે, નાશવંત છે, પારંકું છે, એના પર સવારી ! એજ ને ? સિંહ ભૂખ્યો હતો, આવીને તેણે રાજર્ષિના શરીરને ચાવી નાખ્યું ! મહર્ષિ કાળ કરીને ઉપર દેવલોકમાં ચાલી ગયા. સિંહે રસનાની ગુલામીમાં ને પેટની ગુલામીમાં નરક સાધી ! રાજર્ષિએ ભગવાનની આજ્ઞાની ગુલામીમાં ને સંયમની ગુલામીમાં સ્વર્ગ સાચ્યો.

અહીં ઈન્દ્રદેવે સિંહને સ્વરક્ષાર્થે માર્યો હશે, પણ મરીને ચંડાલ થયો તેથી એવું જ સૂઝે છે. ભવ ખરાબ ત્યાં સહેજે ખોટું સૂઝે છે. માટે સારા ભવમાં સારું બહુ કરી લેવું જોઈએ. જેથી ખરાબ ભવ ન આવે. નહિતર દુષ્ટતા સહેજે આવશે. પેલા બે એ પર્વત પર એક પશુનો શિકાર કર્યો. પશુને માર્યું, કાપી અગ્નિ સળગાવી અનું માંસ રંધીને બંને ખાવા બેસી ગયા. બંને કાળસેન અને ચંડેસેનમાં, સમજો કે, ચંડેસેનની તો આ દશા હોય પણ કાળસેનનીય આવી દશા ? કહો કે, હા, તે ભંગીના પેટે અવતર્યો છે. અને સંજ્ઞા ચીજ જ એવી ભૂંડી છે કે અવસ્થા પ્રમાણે પ્રવૃત્તિ કરાવે. બિલાડી ઉદર શોધે, સિંહ હરણિયું. સંજ્ઞાનો અને વાસનાનો આપણી પાસે ગંજાવર સ્ટોક છે. અવસર આવે કે તે તે જગ્રત થઈ જ જાય છે.

માટે હલકા ભવથી ચેતવા જેવું છે. ભૂલેચૂકે આપણે એમાં ન ફસાઈએ.

પ્રસંગ ચાલે છે પેલા દાટેલા નિધાન ઉપરનો. જુઓ એ કેવો ભાવ ભજવે છે. ચંડેસેનના હાથમાં કટારી છે. કટારીની ધાર તેજ કરીને એમજ અનથેંડની પ્રવૃત્તિ જમીન કોચવાની કરે છે. જોગાજોગ જે જમીનની નીચે નિધાન દાટેલું છે, ત્યાં જ ખોદાવા લાગ્યું. ખોદાતાં ખોદાના કાંઠાને કટારી અડી ગઈ ! “ઓહો ! આ તો માલ દેખાય છે ! ધાતુનું વાસણ દેખાય છે.” ચંડેસેન તરત જ હોશિયારીથી તેને ઢાંકવા ગયો; પણ કાળસેન તે જોઈ લીધું. ત્યારે ચંડેસેન પણ કાળસેન નિધાન જોઈ લીધું છે એ જાણી લીધું. તેના પર એ વિચારે છે -

“બરાબર ! હવે આ આપણો માલ સલામત નહિ રહે ! ખલાસ થઈ જાય ! માલ બધો ભાઈ લઈ જાય...ભાઈ હોય તેથી શું ? ભાગ પણ મફતનો શાનો અપાય ?”...ચંદ્રો કૂર વિચારણામાં ! લક્ષ્મી શું આપે છે ? ભોગસુખ તો પછી, મોહનાં તોફાન પહેલાં આપે છે.

પૂર્વના જીવનમાં પણ ભાઈનો સંબંધ જે જાળવી શક્યો નથી; તે અહીંયાં શી રીતે જાળવી શકે ? માટે વિચારે છે “એને મારી નાખું...” અરે પણ કોના માટે આ વિચારે છે ? ભાઈના માટે ! પરિચહ-સંજ્ઞા શું કામ કરે છે ? આજે તો આવી સંજ્ઞાનો વારસો જે લઈ આવ્યા છે, તેને ઓછું કે એટલું જ રાખવાનીય વાત નહિ, પણ વધારવાની જ વાત છે ! ત્યાં ભવાંતર કેવો સર્જાવાનો તેની કલ્પના પણ આવે છે ? ભવાંતરમાં ઊગરવાનો કોઈ આરો છે ? જેન શાસન મળ્યાનું પ્રયોજન તો આ છે કે આ સંજ્ઞાઓને તોડી નાખો. કહી દો એને કે “તમે મને શું પીસી નાખતી હતી, હું તમારા જડમૂળ ઉખેડી નાખીશ. હવે મારે ખાઉં-ખાઉંના ધંધા નથી કરવા, પણ તપ-ત્યાગના ધંધા કરવા છે. હવે મારે ‘લાવ-લાવ’ના ધંધા નથી કરવા, પણ હવે મારે ‘આપું-આપું’ના ધંધા કરવા છે...” આવા માનસિક પ્રબળ સંકલ્પ જોઈએ; અને એના અનુસારે વર્તાવ જોઈએ. તો આ એક જ જન્મમાં સંજ્ઞાઓ પ્રૂણ ઊઠે. કડક ભૂસ...થઈ જાય ! પછી ભવાંતરમાં કેવી સુંદર અવસ્થા સર્જય ! પણ એ સ્થિતિ ક્યારે બને ? મળેલા માનવભવમાં સંજ્ઞાઓને તોડવા ભગીરથ પુરુષાર્થ થાય તો. તે નથી, માટે આ ચંડેસેન વિચારે છે કે “ભલેને ભાઈ હોય, એ શું લઈ જાય ? એ લઈ જાય એ પૂર્વે જ એને પૂરો કરી દઉં.”

કાળસેનને તો કંઈ વિચાર નથી. એ રહ્યો વિશ્વાસમાં; અને ત્યાં પેલાએ લાગ જોઈને કટારી ચંડેસેનને લગાવી દીધી !...

લક્ષ્મી ક્યાં છે ? ધર્તીમાં !

ક્યારની છે ? કેટલાય ભવોથી !

તોઝાન કેવાં કરાવ્યાં ? ભયંકર !

એ બહાર આવી ? ના, એનો કંઈ લાભ લીધો ? ના ! લાભ તો પાપ-ભાવનાઓનો છે ! હજુ પણ જાણો એ લક્ષ્મી જ કહે છે કે “તને અનેક ભવોમાં તારાજ ન કરું તો મારું નામ લક્ષ્મી નહિ.” આ લક્ષ્મી અને વિષયોની શિરજોરી છે જીવ પર. તે શિરજોરી ક્યારે ન ચાલે ? જ્યારે જિનધર્મનું શરણું લે ત્યારે. તે લીધા પછી લક્ષ્મીને હાથનો મેલ માને; અને સાપના ભારા સમજે; વહેલી તકે એનો સર્વસંગ છોડવાનું મન હોય. એવા જાગ્રત બનેલા જીવને લક્ષ્મી શું કરે ?

ચંદ્રેને સગાભાઈને કટારી પહેરાવી દીધી. પરંતુ પેલો સીધો મરી શકે એમ નથી, કેમકે હાલ ચંડાળ છે ને ? કંઈક લોચા વાળવા માંડ્યા... “મને મારે છે ? તે પણ મારો ભાઈ થઈને ?... હરામી...તનેય હું...” ભયંકર ગુસ્સો ને ભયંકર દુધર્ણિનમાં ચઢ્યો... “હમણાં ઊઠી શરું એમ હોઉં તો તારા ટૂકડે ટૂકડા... બદમાશ !...” એવા કોક ભારે રૌદ્રધ્યાનમાં મરીને ગયો ત્રીજી નરકમાં, પાંચ સાગરોપમના આયુષ્માં !

સંજ્ઞાઓનો ઉકરડા માલ :-

સંજ્ઞાઓ શું કરે ? ક્ષણવાર જીવ પાસે દુર્ધ્યાનની રમત કરાવી અસંખ્ય વર્ષના ઘોર નરકના દુઃખમાં પટકી નાખે છે ! પછી તે કોઈ પણ સંજ્ઞા હો, વિષયની કે પરિગ્રહની, આહારની કે ભયની ! એવી સંજ્ઞાને ઉઘેડી નાખવા માત્ર એકજ ધર્મનું શરણ. લોભની સામે નિર્લોભતાનો ધર્મ; લોકસંજ્ઞાની સામે જિનજ્ઞાના પ્રબળ રાગનો ધર્મ. મન એમ જ કહે, “પ્રભુનું શાસન શું કહે છે ? શાસ્ત્ર શું માર્ગ બતાવે છે ? ભાઈ, મિત્ર, પિતા, માતા, પત્ની, પુત્ર-ભુસી થાઓ કે નાખુશ, મારે તો શાસ્ત્ર શું કહે છે તે જ ખરું.” ઓધસંજ્ઞાની સામે યોગસંજ્ઞાનો ધર્મ. ઓધસંજ્ઞામાં તો જન્મોજન્મના કુસંસ્કારનો કાટમાલ લઈ લઈને ફરીએ છીએ. ગાંડો માણસ જેમ ઉકરડામાંથી કાટમાલ ઉપાડીને ચાલે, તેમ આપણા જીવને પણ ચિત્તભ્રમ થયો છે તે ગર્વ અને ગુસ્સો, ભૂખ અને ભીખ... કોઈ કાટમાલ લઈ ચાલે છે... ‘ખબરદાર મારી સામે બોટ્યો તો... તમે કોણ મારી સામે ?... આપણાથી તો ભાઈ, ભૂખ્યા ન રહેવાય ! ધરાકને, શેઠને આમ મનાવી દઉં !’ આ બધી વાસનાઓમાં કેવળ સંસારરસ છે, ભવાભિનંદીપણું છે તેની સામે યોગસંજ્ઞા જોઈએ.

યોગસંજ્ઞામાં શું આવે ?

૧. જિનેશ્રરદેવના પ્રત્યે કુશળ ચિત્ત ! ૨. આચાર્યાદિ મહર્ષિઓનું વૈયાવચ્ચ !
૩. શાનું વિધિપૂર્વક લેખન-વાંચન ! ૪. સહજ એવો સંસાર પર ઉદ્ઘેગ !

૫. જીવનમાં નાના-મોટા અભિગ્રહો !...

આ બધું કરવાનું જે વલણ, જે ધગશ, તે યોગસંજ્ઞા, પાપસંજ્ઞાઓ દસ છે; આહાર-વિષય-પરિગ્રહ-ભય (નિદ્રા) ચાર કષાય-ઓધ અને લોક સંજ્ઞા. એને બદલે તપ-શીલ-દાન-ભાવ-ક્ષમાદિ ચાર-મોક્ષરુચિ-જિનજ્ઞાંજ્ઞા એની દસ ધર્મસંજ્ઞા. દસ પાપસંજ્ઞા સામે ધર્મની દસ સંજ્ઞાઓને જીવનમાં જળહળતી કરવી જોઈએ; અને તે માટે જ આ માનવનું જીવન છે. સંજ્ઞા એટલે સમજો છો ને ? માત્ર ઈચ્છા નહિ, પણ ધૂન, પક્ષપાત, વલણ. ભૂખ ન હોય તો ય આહારના પક્ષપાતને લીધે આહારની વાતો જે ગમે છે તેટલી તત્વની વાત નથી ગમતી. તો હવે તપ વગેરેની લગની ઊભી કરવી જોઈએ.

“આપણો કંઈ એવો લક્ષ્મીનો મોહ નથી કરતા...” આ બચાવની સાથે એ ભયાનકતા દેખાતી નથી કે લોભ ન કરો, પણ જેની સાથે સંસર્ગ રાખો છો, તે ચીજ કેવી છે ? તમારું ચિત્ત કંઈ મહાત્માનું નથી કે “આપણને લક્ષ્મી પર મોહ નહોતો...ચોર ઉપાડી ગયા તો ભલે...” અરે ચોર નહિ, શાહુકાર ! તે પણ ધરના માણસ હોય. પણ બે પૈસા ખોઈ નાખે, ખોટા ખર્ચી નાખે તો ઊંચા-નીચા થઈ જાય છે ! ખમતું નથી તેવી સ્થિતિમાં મન સવાલો કરે કે “મને લોભ નથી.” હા, નહિ હોય, ધાર્યું હાથમાં આવતું નથી માટે ને ? ‘લોભ નથી’ એમ કહો છો, પણ લક્ષ્મીના સંપર્કમાં રહ્યા રહ્યા તેમાં આધું પાણું થતાં પાપના વિચારો કેટલા જાગે છે ? ગુસ્સો ને અભિમાન કેટલા જાગે છે ? લક્ષ્મી તો એમજ રહે છે. એના સેવકો એના પર નાચીને મરે છે. અહીં લક્ષ્મી દાટ્યા પછી કોણે ખાધી ને કોણે ભોગવી ? ધરતી ભોગવી રહી છે ! પણ ભાઈ ભાઈને મારે છે. જાત ચંડાળની છે એટલે મરનારો સીધો ન મરતાં કાળી લેશ્યા અને રૌદ્રધ્યાનમાં મરે છે.

ઉચ્ચ કુળની અંદર :-

આજે આપણને જે ઊંચું કુળ મળ્યું છે, તેની કદર નથી. આવાં હલકાં કુળ મળી ગયાં હોત તો જન્મસિદ્ધ કેટલાં પાપ મળત ? કેટલી કાળી લેશ્યાઓ હોત ? અધમ કુળ એટલે ? હલકા કુળના હિસાબે મામુલી પ્રસંગમાં પણ કાળી લેશ્યાઓ ! કરપીણ રીતે મારી નાખવાની લેશ્યાઓ ! મનુષ્ય પ્રત્યે આમ, તો પછી બીજા જીવો પ્રત્યે તો શું ય ન હોય ? ત્યારે તમને એવા અદ્ભુત જૈન કુળની પ્રાપ્તિ થઈ છે, કે જેથી કેટલાય જન્મસિદ્ધ પાપ ત્યાગ થઈ ગયા છે. આવું કુળ મળવાની કદર કેટલી ? કહેશો કે ‘શું કરવાનું કદરમાં ? અમે ખુશી છીએ આવા કુળમાં આવ્યા છીએ તેથી ! પણ જુઓ શેઠ લાભ કમાવી આપે તો લાભની કદરમાં શું કરો ? ખુશી માનો એટલું જ ? ? ‘બહું સરસ કર્યું !’ કે મનમાં થાય-“ઓણે”

લાખ કમાઈ આય્યા તો હું એનું શું શું કરી વાણું ? જૈન કુળની કદર એટલે ? શું લાડવો-પેંડા ઉડાવવાની ખુશી માનવાની ? કે જૈન શાસનની હું શી શી સેવા કરી વાણું, એમ થાય ? જે જૈનશાસને આવા કુળમાં મને અનેક પાપથી સહેજે દૂર રખાવ્યો, એનું જેટલું કરું એટલું ઓછું. ખુશી સાચી હોય તો ભોગ આપો. માત્ર કીડી બચાવવી એટલી જ કદર નહિ.

‘કીડી ન મારવી...’ એ તો કુળના સંસ્કારો મધ્યા છે તેથી ટેવાયા છો. હવે એ કુળે આપણા માથે ઘણી ઘણી જવાબદારીઓ મૂકી છે એ ભાન જોઈએ. તમારું જીવન એવું ઉચ્ચગુણોએ જગમગતું બનાવો કે તમારા વગર ઉપદેશો આજુભાજુના જીવો ધર્મ પામે. કુળ માગે છે ‘ભલા જીવ ! તને આ ઊંચા કુળમાં લાવ્યા છીએ, તે કુળને ભારે કરવા નહિ, પણ એવું જીવન બનાવ કે જે બીજાઓ માટે આદર્શરૂપ થાય. તારે બીજા જીવની જેમ રંગરાગની લાલ્યો સળગાવવાની ન હોય. તારે બીજાની જેમ લક્ષ્મી-લાલાઈ પાછળ દોડધામ કરવાનું શોભે નહિ. સંસારમાં બેઠેલો છે, તો સંસારની આવશ્યકતા કેટલી, તેનું માપ કાઢી, તેમાં ઓછામાં ચાલે તેવું કરો. મહાન ધર્મચર્યાથી મધ્યમધતું, મહાન પરમાર્થ-પરોપકારથી શોભતું, ક્ષમા નમ્રતાદિ ગુણોથી ઉજ્જવળ ને ચમકતું જીવન જોઈએ. તો કદર કરી કહેવાય. નહિતર કહી દીધું કે ‘અમને જૈન કુળ મધ્યાથી ખુશી છીએ !’ એટલે બસ, પતી ગયું ? એવું તો પામરને ય આવડે. દંભી ય એટલું બોલી શકે.

જૈન કુળની કદરમાં ઘણી ઘણી રોજિદી ધર્મચર્યાઓ જોઈએ. મહાન ઉચ્ચકોટિના આત્મિક ગુણોનો વિકાસ જોઈએ. એવી સ્થિતિ બનાવો તો કુળની કદર કરી કહેવાય. “ઓહો ! આ કુળ મને આવી સ્થિતિમાં મૂકી ઘણાં પાપથી બચાવી લીધો ! તેથી મારું મન સાધનાને યોગ્ય બની ગયું ! તો હવે સાધના કેમ ચૂકું ?” એમ ધગશ જોઈએ.

કદરમાં ગ્રાણ વાતો બનાવવી જોઈએ.

(૧) ભરચક ધર્મચર્યાઓ.

(૨) અનેકાનેક ક્ષમાસમતાદિ આત્મિક ગુણોનો વિકાસ.

(૩) ભરચક પરમાર્થ-પરોપકાર.

ધર્મચર્યા માણસ કરે છે, પણ ક્ષમા ન રાખે તો તે લોકોને માટે નિંદા કરવાનું પાત્ર બને છે. માટે ક્ષમારૂપ આત્મિકગુણ પણ જોઈએ. પરંતુ કોઈ એમ માને કે “આપણે આત્મિક ગુણો માટે પ્રયત્ન કરીએ છીએ, હવે ધર્મચર્યાનું શું કામ છે ?” તો ચાલે ? ના, જરાય નહિ એને પૂછો કે તો પછી પાપચર્યામાં પણ જીવાની શી જરૂર છે ? પાપચર્યાઓ, સંસારચર્યાઓ તો એવી છે કે અવસરે ગુણોને

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૨૬૩

ક્યાંય ધકેલી મૂકશે. ત્યારે દંબના ગુણોની માન્યતામાં શો માલ છે ? બગલાનો દેખાતો ગુણ કેવો હોય ? પણ ચર્ચા કેવી ? ગુણ શાન્તિનો, ને ચર્ચા માછલાં પકડવાની ! તે ગુણ શા કામનો ? આત્મગુણો સાથે પાછું પાપચર્યા છોડી, ધર્મચર્યા વિકસાવવી જોઈએ.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૨૭, તા. ૨૪-૩-૧૯૫૬

આજે આત્મધર્મવાળા ઘણા નીકળી પડ્યા છે ! ક્ષમા રાખો, શાંતિ રાખો, આત્મદાસિ રાખો...” પણ બહાર જઈને કંઈ કરવાનું ? કહેશે “ના, બહારનું કરવાથી કંઈ લાભ નથી ! તો આપણે પૂછીએ કે ખાવાનું-હરવા-ફરવાનું-બંગલો-ઘોડા-ગાડી-મોટર... એ બધું કરો છો ખરા ? શા માટે કરો છો ? અંદરથી સુખ માની ત્યો. પણ ના, એ બધું તો કરવાનું ! માત્ર નહિ કરવાની ધર્મકિયા. કેવું કરારમું અશાન ! “આત્માના ગુણો ખીલવો ! ચરવળા-કટાસણાથી કંઈ નહિ વળે, પુષ્યની કિયાથી-ધર્મકિયાથી કાંઈ નહિ વળે.” આમ બોલી કેવોક દંભ કર્યો ! અને કહો ‘અરે ભલા, તારે પ્રત ન લેવું હોય તો કંઈ નહિ, પણ પાપ કરવાનું તો છોડી દે. તને ધર્મકિયા તરીકે પચ્ચક્ખાડા કરી તપ કરવાનું નથી ગમતું તો કાંઈ નહિ, પણ એમને એમ પણ ખાવાની કિયા તો મૂકી દે... બેસી જા ખૂણામાં આત્મચિત્તા કરતો.’ ના. ધર્મ પર ખરી પ્રીતિ નથી, પ્રવૃત્તિધર્મ પર સૂગ છે, એટલે કહી દે છે કે ‘ઓધા-ચરવણા...થી કંઈ નહી વળે...અંતરશુદ્ધિ કરો;’ અને પાપ પર પ્રીતિ છે, સૂગ નથી, તેથી પાપ પ્રવૃત્તિ લહેરથી આચરે છે.

ધર્મચર્યા જોઈએ, તે સાથે પરમાર્થ-પરોપકાર પણ જોઈએ. નહિતર સ્વાર્થ સાથો ગણાય. “ક્યાં જાઓ છો ભાઈ ?” ‘ઉપાશ્રી’ વચ્ચે સાધર્મિ મલ્યો. આંખમાંથી પાણી નીકળે છે. કહે છે “ભાઈસાબ, ઘેર છોકરાં રે છે...ને રેશનનું અનાજ લાવવા પૈસા નથી...” સાંભળીને એમ જ ચાલ્યા. મનમાં થયું આપણે આત્મગુણો સમાલો, પારકી પંચાતમાં ન પડો તો આ શું કર્યું ? ગુણોને લજાવ્યા કે શોભાવ્યા ? માટે જ કહો આત્મગુણો અને ધર્મચર્યાની સાથે જીવનમાં પરમાર્થ-પરોપકાર ઝગમગતો જોઈએ. દિલ એવું હોય કે “હું બીજાનું કેમ કરી દ્યું ?” આ માટી રૂપ પૈસાથી અને મળમૂત્ર ભરેલી કાયાથી પરમાર્થ ક્યાં ક્યાં સાધી લઈ ?” આ ઉમળકા જોઈએ. તે હોય અને અવસરે પરમાર્થ કરે તો ધર્મ કરેલો શોભે. નહિતર ધર્મી શ્રાવક ઘણા હોય, પણ કૃપાણ હોય તો ? લોકોને આકરા થઈ પડે. કેમ વારું ? પરોપકારનો અભાવ ! પરમાર્થનું નામ નહિ ! અરે કેટલાક તો વળી

૨૬૪ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વિજયસિંહ આ.ના પૂર્વભવ” (ભાગ-૨૨)

એવા હોય છે કે પાંચ પૈસા પોતાને આપવા પડતા હોય માટે આખું સારું કાર્ય ઉડાવવાની પેરવીમાં હોય ! આવા માણસો ધર્મને લજવનારા બને છે. માટે જ કહેલા ગ્રંથ ગુણથી ઝગમગતું જીવન બનાવવામાં આવે તો કુળની કદર કરી કહેવાય. કાળસેન ચંડાળે અહીં લક્ષ્ણીનો લોભ કર્યો નથી; માત્ર એના દર્શન કર્યો છે. પણ ભાઈએ માર્યો, એટલે કાળી લેશ્યા અને દુર્ધ્યાન જ એના કપાળે લાગ્યું ! તે કુળના હિસાબે-કુળ ચંડાળનું છે ! ત્યાં બચ્યું જન્મે ત્યારથી એ શબ્દો સંભળાયા કરે, ‘માર...કાપ...’ દુર્ધ્યાનમાં નરકનું આયુષ્ય બાંધ્યું.

મરીને ગયો નરકમાં. એ મર્યો એટલે ભાઈ ખુશી થઈ ગયો, “બસ, હવે આ બધો માલ મારા હાથમાં છે ! હમણાં નહિ કાહું...કોઈ જોઈ જાય તો કહે આ ચંડાળ, અને આની પાસે આટલા પૈસા ? માટે જરૂર ચોર...” નિધાનની આગળ ચોકી કરે છે. એમાં કેટલાય વર્ષ ગયાં. એક રત્તી પાઈ પણ ભોગવી ન શક્યો. પરંતુ એના દુશ્મન ચંડાળના સપાઠામાં આવી ગયો. તેના હાથે મર્યો. મરીને ગયો છઢી નરકમાં અઠાર સાગરોપમના ભયંકર દીર્ઘકાળના આયુષ્યમાં !

ભગવાન વિજયસિંહને કહે છે ‘તું કાળસેનપણામાંથી ગ્રીજી નરકમાં જઈ ધોર પીડાઓ વેઠીને નરકાંધું પૂર્ણ કરી આવ્યો આ વિજયમાં શ્રીમતી નામના ગામે. શાલીભદ્ર અને નંદિની ગૃહસ્થ પતિ-પત્નીનો પુત્ર થયો. તેનું નામ રાખ્યું બાલસુંદર. કાળક્રમે તે યુવાવસ્થાને પાય્યો. ત્યાં તેને શીલદેવ નામના મુનિ મહારાજ મળ્યા. એમની પાસે કદી પ્રાપ્ત નહિ કરેલો એવો જિનેશ્વરે કહેલો જૈનધર્મ પ્રાપ્ત કર્યો, અને શ્રાવક બન્યો. કાળ પણ પાક્યો છે, અને પુણ્યનોય ઉદ્ય છે. તેથી સામગ્રી સુંદર મળી છે; એમાં પુરુષાર્થ અજમાવ્યો એટલે શ્રાવક બન્યો. પુણ્યનો ઉદ્ય કાળ એ માત્ર સામગ્રી પમાડવા માટે છે. ધર્મની પ્રાપ્તિ એ માટે કોઈ ઉદ્યકાળ નથી; એ માટે પોતાનો પુરુષાર્થ ઉદ્યમ જોઈએ. તમારે ઉદ્યકાળ કેવો જોઈએ છે ? સીમંધર ભગવાન મળે અને એમજ કર્મ તૂટી જાય એવો ? કદી નહિ બને એ. ઉદ્યમ તો કરવો જ પડશે. નહિતર તો સમજજો કે પોતાનો ઉદ્યમ કાંઈ જ નથી ને એકલા સીમંધર સ્વામી જેને મળ્યા છે, તેમાં પણ એવા જીવો છે કે જે મરીને સાતમી નરકે જનાર છે ! અહીંથી તો હજુ વધારેમાં વધારે બે જ નરક; ત્યાંથી સાત !’

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૮, તા. ૩૧-૩-૧૯૫૬

● ઉદ્યકાળ ●

ઉદ્યકાળનો શો અર્થ ? ઉદ્ય અને કાળ નથી એટલે શું નથી ? ઉદ્ય અને કાળ બને છે. ઉદ્ય એટલે પુણ્યાઈ, કે જે ધર્મની સામગ્રી અને બળ મેળવી આપે; અને કાળ છે મનુષ્યનો સુંદર, એ મળ્યું અને ધર્મસામગ્રી મળી, હવે બોલાય એમ નથી કે “ઉદ્યકાળ નથી;” એ બોલે તો સામગ્રીનું અપમાન છે. રિસાયેલા મહેમાનને ઉપારી લાવ્યા, પાટલા પર બેસાડ્યા, ચાંદીની થાળીમાં ભોજન પીરસ્યાં, ને કોળિયોય મૌંમાં ઘાલી આય્યો. આટલું કર્યું છતાં એ કહે છે “ઉદ્યકાળ નથી” તો સમજાય કે ‘ઉદ્યકાળ’ શું નથી ? જમવા પર રીસ છે માટે જમતા નથી. એમ અહીંથાં ઠેઠ મધ્યમધતું જૈનશાસન મળ્યું અને ધર્મબળ ટકે એવા સુંદર પ્રકારના મધ્યમ સંયોગો મળ્યા. માનવભવનો સુંદર કાળ મળ્યો છતાં ‘ઉદ્યકાળ નથી’ કહીને ખસી જવા માળો તો શું એમ કહેવું કે ધર્મ પર રીસ છે ? આજે જરા વિચારો તો દેખાશે કે એવો કાળ નથી કે ચારિત્ર લેનારને પચાસ ફટકા ખાવા પડે કે રાજ્યસત્તા રોકે એવું છે ? ના, નથી. એના કરતાં જુદું છે ! કેટલાક કાયદા લોકને લાગુ પડે, પણ સાધુને નહિ ! સેલટેક્સ અમને લાગુ પડે ? ઈન્કમટેક્સ અમને લાગુ પડે ? અમે લાકડી-દંડો લઈને નીકળીએ છતાં અમને કોઈ પૂછતું નથી ! અને તમારા માટે એવા તોફાનના અવસરે નિષેધ હોય છે. ઈન્કમટેક્સ અને મલ્ટ્યુપલ સેલ્સટેક્સાદિમાં તમારો દુચો નીકળી જાય છે. અમને મૌંઘવારી નડતી નથી; જ્યારે તમારું મન જાણે છે. કહો છો ને કે કેવો ભયાનક યુગ કે ભાવમાં માત્ર ૫-૧૫ ટકા વધારો નહિ, પણ એકના ચાર ગણા ? એટલે કેટલો વધારો ? ત્રણસો ટકાનો ! અને આવક ? વધી એટલી ? ના, ક્યાંક તો આવકને ઊલટો ધક્કો પહોંચ્યો કહે છે. સાધુ થાય એને આમાંનું છે કાંઈ ? તો ચારિત્ર માટેનો કાળ કેવો કહેશો ? સારો કે ખરાબ ? અનુકૂળ કાળ છે કે નહિ ? અરે ! ખરી રીતે તો વિચારતાં નથી આવડતું. પંચસૂત્રકાર મહર્ષિ કહે છે કે ધર્માંત્રા ધર્મજાગરિકા કરે અર્થાત્ મોહનિદ્રા ત્યજીને ધર્મના ઉપયોગવાળો બને; એ વિચારે કે,

‘કો મમ કાલો, કિમેઅસ્મ ઉચ્ચિઅં’ ‘આ મને કેવોક કાળ મળ્યો છે ! આને ઉચ્ચિત મારે શું શું કરવું જોઈએ ? મારે કેવા થવું જોઈએ ?’

કાળની સુંદરતા : સમજ્યા ‘કેવો કાળ’-એટલે ? અનંતા નિગોદજીવોવાળી જેલમાંથી છૂટી પૃથ્વીકાયાદિ સ્થાવરના અને પોરા, કીડા વગેરે વિકલોંદ્રિના થાળામાંથી

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨) ૨૬૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨) ૨૬૫

ય ધૂટવાનો કાળ ! એટલું જ નહિ પણ અસંજી પંચેન્દ્રિય, તિર્યં પશુપક્ષી, અને નારક ભવ જેવા ધોર કાળમાંથી ધૂટવાનો કાળ ! એમાંય મનુષ્યભવે અનાર્થ-મલેચ્છ-હિંસક-માંસાહારી-કોળી-ભીલ વગેરેમાં નહિ ફસાવાનો કાળ ! કેવોક સુંદર કાળ છે જો મૂલ્ય આંકતા આવતે તો ! એમાં વળી ભલે ચોથા આરાનો કાળ નથી મળ્યો, છતાં ધર્મ પ્રકાશવાળો આ પાંચમા આરાનો કાળ મળ્યો છે તે ધર્મની ઓળખ સાથેનો, એ ઓદૃં છે ?

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદધિ”

વર્ષ-૪, અંક-૨૮, તા. ૭-૪-૧૯૫૬

કલિકાલ સર્વજ્ઞ હેમયંડ્રસૂરીશરજી મહારાજ જેવા કહે છે કે

યત્રાલ્પેનાપિ કાલેન ત્વદ્ભક્તઃ: ફલમાય્તે ।

કલિકાલ: સ એકોઽસ્તુ, કૃતં કૃતયુગાદિભિઃ ॥

અર્થાત્ હે ભગવન્ ! જ્યાં થોડા જ વખતમાં તારી ભક્તિનું ફળ મળે છે એવો કલિકાલ જ ભલે હો, એ એક જ બસ છે. કૃત્યુગાદિ મોટા કાળથી સર્યુ.

અથવા કહે છે,

‘સુષમાતો દુઃષમાયાં કૃપા ફલવતી તવ’ સુષ્મ આરા કરતાં આ દુષ્મ આરામાં હે પ્રભુ ! તારી કૃપા સહ્ય બની છે. એ પૂર્વના કાળે તો તું મને મળ્યો’તો જ ક્યાં ? મેં તને ઓળખ્યો જ નહોતો. પછી એવા કાળની મારે શી વડાઈ ?

‘મારે તો સુષ્માથી દુષ્મો અવસર પુષ્યનિધાન’ :-

અહીં જૈન શાસન તે જ છે જે પ્રભુ વીચરતા વખતે હતું. એજ પ્રભુની મૂર્તિ છે. એજ સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્રદૂપી મોક્ષમાર્ગ છે. એવા આ કાળની શી કમીના ગણાય તે કહો છો ઉદ્ય-કાળ નથી ? કાળ તો એવો સરસ છે કે થોડા વખતમાં અને થોડી મહેનત તથા આત્મભોગમાં લાભના થોક ઉપાર્થ શકાય. લાખો પૂર્વના ચારિત્ર અહીં નથી પાળવાના. દાન-શીલ-તપ-ભાવની મહેનત એટલી બધી લાગે એવી નથી કે એમાં થાકી જાઓ. ત્યારે આત્મભોગેય શો બહુ મોટો દઈ દેવાનો છે ? ચક્કવર્તી હોય, રાજી મહારાજ હોય એને ચારિત્ર લેવું હોય તો હજી ય મોટો ભોગ દેવો પડે એમ કહેવાય. પણ તમારે ? સાવ ભૂખે મરતો હોય અનાજના દાણાનીય મૂરી કે આવક ન હોય એને વાડકી અન્ન ક્યાંકથી મળી જાય અને હવે દાન કરવાની વાત એની આગળ આવે તો એ એને કઠીન કહેવાય; પણ

તમારે દાન કરવામાં, ધર્મક્ષેત્રમાં ખર્ચ કરવામાં શો ગજબનો આત્મભોગ દેવો પડે એવું છે ? એટલે કહો કે કાળ તો સુંદર મળ્યો જ છે. આરો તો ચોથો હોય પણ કુગુરુ-કુધર્મના ફંદામાં ફસામણ હોય, એથી અનેક ભયાનક કુકર્મ કરવાનું ચાલતું હોય ત્યાં કાળ શો સારો ? જ્યારે અહીં મહાન જૈન ધર્મ અને સદ્ગુરુઓ મળ્યા છે. સારો જૈન સંઘ મળ્યો છે. સારું તત્ત્વશ્રવણ મળે છે.

ધર્મ જરૂરી લાગ્યો છે ? :-

આ કાળ પણ સુંદર કહેવાય, અને પુણ્યનો ઉદ્ય પણ મજેનો ગણાય. પાંચ ઇન્દ્રિયો ચકોર ! વિચારક મન ! જરૂરી આરોગ્ય ! આ બધું સરસ છે. એથી ઉદ્ય અને કાળ બંને ઠીક મળી ગયા છે. છતાં જો કહો કે ‘અમારે ઉદ્યકાળ નથી એટલે ધર્મ નથી થતો,’ તો એ કહેવામાં તો, ધર્મ હજી જરૂરી જ લાગ્યો નથી એમજ સમજજું ને ? મહેમાનને ભાણે બધું સુંદર પીરસ્યું, હાર્દિક ભાવ દેખાડ્યા. આગ્રહ કર્યા, છતાં જમવાનું શરૂ નથી કરતો અને કહે છે ‘ઉદ્યકાળ નથી’ તો એ એને એ જમણની જરૂર જ લાગી નથી, એમ શું નથી સૂચવતું ? એ જમવું જરૂરી લાગે તો હાથ ન હાલે ?

ધર્મપ્રાપ્તિ કર્યારે ? :-

બાલસુંદરને ઉદ્યકાળ આવી મળવા સાથે પોતે પુરુષાર્થ આદર્યો તો સુંદર ધર્મપ્રાપ્તિ થઈ. નિગોદમાં કંઈ ન થાય. વિકલેદ્રિમાં કંશું ન મળે. અરે માનવ ભવે પણ અચરમાવર્ત કાળમાં ધર્મ ન મળે. ચરમ એટલે છેલ્લા પુદ્ગલ પરાવર્તમાંજ ધર્મ પામવાની યોગ્યતા. પણ ત્યાં ય ‘ઉદ્યકાળ નથી’ એમ લમણે હાથ દઈ નહિ બેસવાનું; કે દંબ નહિ કરવાનો; પણ ઉદ્યમ કરો તો જ ધર્મપ્રાપ્તિ થાય. બાલસુંદરને એમ ધર્મપ્રાપ્તિ થઈ. હવે શું કામ ધર્મવીપાર ન ખેડે ? સુંદર શ્રાવકપણું પાળવાનું પ્રારંભી દીધું. એટલી વીર્યસ્હૂર્તિ ન થઈ કે ચારિત્ર પામે. પણ ચારિત્રની તમના જોરદાર તો જ સમ્યક્ત્વ અને શ્રાવકપણું દીપે. તો જ એના ઊંચા ફળ આવી શકે. આને કમ ફળ નથી આવ્યું ! અહીંથી હવે આગળના જ મનુષ્ય ભવે જોશો કે ધર્મ કેટલો રોમ રોમમાં વસી ગયો હોવાથી કેવો અદ્ભુત ધર્મ વર્તાવ કરે છે ! સુંદર શ્રાવકપણું પાળી સમાધિ-મરણે મરી પહોંચ્યો વૈમાનિક દેવલોકમાં કંઈક ન્યૂન તેર સાગરોપમનું આયુષ છે ત્યાં. દેવતાઈ વૈભવ-વિલાસની વચમાં એવી તત્ત્વપરિણતિ અને ધર્મપ્રીતિ જળવી કે ત્યાંથી મરીને અહીં સુંદર મનુષ્ય ભવ પામે છે. પેલો મૂળ ગુણચંદ્રનો જીવ બિચારો નરકમાં સડે છે. તેનું હવે આયુષ પૂરું થાય છે.

● સમુદ્રદાત અને મંગળ ●

બંને જણ મરીને આજ વિજયમાં હસ્તિનાપુર નગરમાં જન્મે છે. અજિતદેવ પ્રભુ વિજયસિંહને કહે છે ‘તું દેવલોકમાંથી આવી અહીં સુહસ્તિ નામના નગરશેઠની ધર્મપત્ની કાન્તિમતીનો પુત્ર સમુદ્રદાત થયો; અને પેલો જીવ નરકમાંથી આવી અહીં તારા પિતાની ઘરદાસી સોમિલાનો પુત્ર મંગળ નામે થયો. કાળકમે બંને કુમાર થયા.

ધર્મ અને લગ્ન :-

પૂર્વના બાલસુંદરના ભવમાં ધર્મનો મજબૂત પાયો નાખ્યો છે. એકજ ભવમાં હોં ! ધર્મનું મૂલ્યાંકન કરતાં આવડે પછી પાયો મજબૂત કરવાનું કરીન નથી. દુનિયામાં જ્યાં કિમત આંકો છો ત્યાં એની લગની લાગતા ક્યાં વાર લાગે છે ? ‘નોકરી કરતાં વેપાર લાભદાયી અને ગૌરવભર્યો,’ એમ કિમત આંક્યા પછી વેપારની લગની જોરદાર લાગે જ છે. એમ આવા ઊચા ભવમાં ‘જડપુદુગલની ગડમથલ કરતાં ધર્મ પ્રવૃત્તિ ખૂબ જ લાભકારી,’ એમ કિમત હૈયે વસ્યા પછી ધર્મમાં લાગી પડવાનું સહજ. એમાં એનો મજબૂત પાયો પડે. બાલસુંદરને એવો પાયો પડેલો, તે અહીં સમુદ્રદાતના ભવમાં કુમાર અવસ્થામાં જ શ્રી અનંગદેવ ગણી મહારાજનો સત્સંગ થયો. એમની પાસેથી ભગવાન શ્રી જિનેશ્વરએવે ઉપદેશેલા શુદ્ધ ધર્મની એને પ્રાપ્તિ થઈ. સાધુ પાસેથી શું લેવાનું ? ધર્મ; સુદેવ-સુગુરુ-સુધર્મની શ્રદ્ધા, ને પ્રીતિ-ભક્તિ. બીજી આશા રાખી તો મૂર્ખાઈ થશે. રોહણાચલ પર્વતમાંથી રત્ન મળતા હોય તો ત્યાં એને બદલે પાણાશની આશા રાખે, પાણાશ લેવા જાય એ મૂર્ખાઈ જ ને ? સમુદ્રદાત ધર્મ એવો પાયો કે શ્રાવકના પ્રતિ પણ લીધા. બીજી બાજુ હવે ઊંમરમાં આવ્યા પછી લક્ષ્મીનિલયવાસી શ્રાવક અચલ સાર્થવાહની દીકરી જિનમતિ સાથે એના લગ્ન થયા. માર્ગાનુસારીનો આ ગુણ કે લગ્ન સંબંધ સમાન કુણ-શીલવાળા સાથે કરે. આજે કાળ વિષમ બની ગયો છે. કુણ-શીલ જોવાને બદલે કેળવણી, કળાચાતુરી અને રૂપરંગ જોવાય છે. ત્યારે પરિણામ પણ દેખાય છે ને ? ધર્મવૃદ્ધિની વાત તો દૂર પણ હોય એટલો ય ધર્મ ટકાવવાનો નહિ. ઊલટું બીજા તોફાન વધે. એમાં અરસપરસનો પ્રેમ તૂટે. હૈયા-હોળી શરૂ થાય; ઔહિક સુખ પણ જાય; ને પરલોક તો બગડ્યો જ. ત્યારે ઊત્તમ ધર્મીકુળ અને સદ્ગ આચારોવાળા સાથેના સંબંધમાં આ લોક ઊજળો, પરલોક ઊજળો !

શ્રાવકપણાની જણક :-

એક વાર એ પત્ની જિનમતિ નિમિત્તે લક્ષ્મીનિલય નગર તરફ નોકર મંગળને

સાથે લઈને જાય છે. કેટલાક પ્રયાણને અંતે તે પ્રદેશે આવી પહોંચ્યો કે જ્યાં પેલું નિધાન દાટેલું છે ! જુઓ ભવિતવ્યતાની મજા ! આપણા સંસારપર્યટનમાં આવી કોઈ રહશ્યમય ઘટનાઓ બનતી હશે એની ક્યાં ખબર છે ? છતાં લાગે છે એવું કે જ્ઞાણે બધું નવું જ બની રહ્યું છે. વર્તમાન ઘટનાને પૂર્વના કાળ સાથે જ્ઞાણ કોઈ સંબંધ નથી ! આ મૂર્ખાઈ છે. કદાચ કાંઈ સંબંધ ન પણ હોય છતાં મન એમ ભાવના ભાવે કે “ચાલુ ઘટનાઓની પાછળ પૂર્વે કરેલી રમતોનો મોટો ઈતિહાસ છે; આજના ધનમાલ એ પૂર્વના વારસા છે. એમાં નવું કશું નથી. શું મોહવું તું ?...” તો કેટલોય મોહ અને રાગાદિની ઘેલાછા ઓછી થાય.

નિધાન પર નફરત :-

સમુદ્રદાત ત્યાં છાયા હોવાથી વિસામો કરવા બેસે છે. એટલામાં પેલા નિધાન પરના જાડનું મૂળ અહીં નીકળેલું જોયું. તેથી મંગળ આગળ સહજત્તમાવે બોલી જવાય છે,

‘અટ્યા મંગળ, અહીં નીચે કાંઈક ધનમાલ હોવો જોઈએ.’

નોકર કહે છે, ‘તો શેઠ, એ જોઈએ આપણે.’

જોઈએ સહેજ સ્વભાવે બોલી જવામાં કામ આગળ વધ્યું. નોકર કહે છે નિધાન ખોટી કાઢીએ. સમુદ્રદાતને નિધાન લેવા પર પ્રેમ નથી, નફરત છે. એ તો સહજત્તમાવે બોલી જવાયું. પણ નોકર એને લઈ બેઠો. માણસે બોલતાં બધું વિચાર કરવા જેવો છે, નહિંતર એનાથી એવાં પાપ પ્રવર્તક વચ્ચનો બોલાઈ જવાશે કે જેની પાછળ બીજાઓ અનેક પાપમાં દોડાદોડ કરશે. અનેક સ્થાવર ગ્રસ જીવોના સંહાર મચશે.

સમુદ્રદાતને નિધાન જોઈતું નથી તેથી નોકરને કહે છે.

‘ભાઈ ! રહેવા દે, એનું આપણે કામ નહિ !’ કેમ વારું ! કારણ એજ કે શ્રાવક બન્યો છે તેથી એના પર ધર્મની છાયા એવી છે કે એને બિનજરૂરી પાપ જોઈતા નથી, એને પાપનાં સાધનોનો ભય છે. એજ સૂચવે છે કે એને ધર્મની અંતરંગ પ્રાપ્તિ થઈ છે.

ધર્મની પ્રાપ્તિ જીવનની સધણી પ્રવૃત્તિ પર છાયા પાડે તેવી હોવી જોઈએ. ધર્મની જેને હદ્યમાં સ્પર્શના કહીએ, જેને હાર્દિક પ્રાપ્તિ કહીએ, એનો અર્થ એ કે જીવનની સધણી પ્રવૃત્તિ પર એની છાયા પડે. જેમ દેહની ગતિથી આગળ પગલું પડે ત્યાં એની છાયા પડે છે; એમ અહીં વાણી, વિચાર કે વર્તાવ પર ધર્મસ્પર્શનાની છાયા પડે. એવો ધર્મ કદાચ લડાઈ લડવા ગયો, તો ત્યાંય ધર્મધ્યાયાને લીધે હારેલા શરૂ પર દયાળું હશે.

૨૭૦ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેવિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

હાથીના જીવનમાં મેધકુમારે વિચાર કર્યો- ઉભો રહે, જોવા દે, કોઈ જીવ તો નથીને ? જોયું તો સસલું દીકું ! પગ ન મૂક્યો. ભલે ત્યાં એ ધર્મ નથી પામ્યો, પણ મેધકુમારના ભવમાં ધર્મ પામવાનો છે, તેની આ ભૂમિકા છે. આછો પણ ગુણનો રંગ, ધર્મનો રંગ હોય તો તેની જીવન પર છાયા પડે છે. આ સમુદ્રદટ્ઠને તેવી છાયા છે ધર્મની. તેથી નોકરનું કહ્યું તે માનતો નથી. ‘ના, એ કામ આપણું નહિ. મેં તને જે કહ્યું હતું કૌતુકરૂપે, કે આ વસ્તુ આવી હોવી જોઈએ, તે કહેવા પુરતું જ. બાકી એની બહુ પરવા કરવાની નથી; તેથી જ તપાસ કરવાની જરૂર નથી. એવા લોભ શા માટે રાખવા ?’ આનું નામ ધર્મની છાયા. આવકપણાનો ધર્મ લીધો છે ને ? તેથી જ જો કે અહીં સંભવ લાગે છે કે અહીંયાં પૈસા છે; છતાં એને મન જોવાનું કામ નથી ! ધર્મની કેટલી બધી સુંદર અસર ! પૈસા માટે તો માણસ કેટલી મજૂરી કરે છે ? જ્યારે આ મજફત મળે છે, છતાં એ લેવાની વાત નહિ ! કેમકે ધર્મની છાયા !

ધર્મની છાયા આ શિખવે છે કે “તું જે આરંભ ને પરિગ્રહ કરે છે, તેનાથી તારું જીવન નભે છે ને ? બસ, તો પછી વધુ પરિગ્રહ કે આરંભ કરવાથી શું વિશેષ ? પાંચ મોટર છે, પણ ફરવાનું તો એક જ મોટરમાં ને ? સાત મજલાનો બંગલો છે. પણ સૂવાનું તો એક મજલે જ ને ? પરિગ્રહ વધ્યાથી ભોગ વધ્યો ? ત્યારે વધારે આરંભથી જીવનમાં શું વધે છે ? એક ડબો અનાજ રાખતા હતા, તેના બદલે એક કોઠી રાખી, પણ આ પેટની કોઠી ક્યાં મોટી થવાની છે ? એ તો જે સમાવતી હશે તેટલું જ સમાવશે. પણ માણસ પોતાની માનેલી કલ્પનામાં એવો તણાય છે કે એને પછી પાપની કોઈ લિમિટ (મર્યાદા) જ નહિ. કેમકે ધર્મની સ્પર્શના નથી ! પરંતુ આ સમુદ્રદટ્ઠને ધર્મની સ્પર્શના છે, એટલે વિચારે છે કે, ‘આપણી પાસે જે છે, તે ઘણું છે. મારે આ નવી લપનું શું કામ છે ?’”

ત્યારે તમે એજ પૂછો છો ને કે ‘અરે, પણ સામે આવે છે ને ?’

એનો ઉત્તર એ છે કે, “ભલે આવે ! અહીંયાં જ આપણી કસોટી છે. બિન જરૂરી પાપ, બિનજરૂરી દોષો, ને વધારે પડતી સાંસારિક જડ પદાર્થોની વાતો, એનો અમારે ખપ નથી. શું વિશેષ એનાથી ?” -એવું જો આપણે, ધર્મના પ્રત્યક્ષ ફળ રૂપે વારંવાર આપણા મનમાં દસાવ્યું હશે, જો વારેવારે એ ભાવનાથી આપણું હૈયું રંગી દીધું હશે, તો આવો પ્રસંગ એ બિનજરૂરી પરિગ્રહ પાપનો, બિનજરૂરી લોભ, મમતા, અને દોષનો, તથા વધારે પડતી જડલક્ષીની વાતોનો લાગશે. એ સહેજે બની આવતો અને લોભાવનારો હોવાથી કસોટીનો ગણાય. એને વશ ન થઈએ તો પાસ થયા; એમ કહેવાય. હદ્યમાં ધર્મ સ્પર્શ્યો છે, અને એનું ફળ પણ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેશ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

આવ્યું છે, એવી પ્રતીતિ એવો વિશ્વાસ થાય. ધર્મનું આ સાક્ષાત્ ફળ છે કે આવા અવસરે પણ હદ્યની સ્વસ્થતા કાયમ રહીને બિનજરૂરી પાપો વગેરેમાં ફસાવાનું ન થાય; પછી ભલે એ સામે આવ્યો. આવું જીવન બનાવ્યા વિના ઘૂટકો નથી. નહિતર જીવ આખો ને આખો પાછો તૃષ્ણા, મમતા અને રાગાદિરૂપી સંસારમાં ખોવાઈ જશે. નવરા પડ્યા કે રેઝિયો ને છાપાં ! હરવું ને ફરવું ! ખાવું ને પીવું ! આ ક્યાં ઉપડ્યો ? ઉંચે આત્મિક સ્વાતંત્ર્યમાં ? કે નીચે જડ ગુલામીમાં ?

જ્યારે ધર્મ તો શિખવે છે “પાપ ઓછું કરવાનું રાખજે. મનુષ્યની બુદ્ધિ પામ્યા પછી એનો સહૃપ્યોગ કરી રાગદ્વેષ ઘટે તેવાં સ્થાન સેવજે; વધે તેવાં સેવતો નહિ. નહિતર તારાં મૂલ્ય રહેશે નહિ; તારા અનંતકળના હુઃખી આત્માનો બચાવ થશે નહિ. દુનિયાની ધાંધક રાગદ્વેષ વધારનારી છે. નોવેલ ને નવલિકા ! રેઝિયો ને છાપાં ! કલબ ને કોમેર્ઝડ ! સિનેમા ને નાટક ! આ બધું શું છે ? રાગદ્વેષની વૃદ્ધિ કરાવી આત્મા-પરમાત્માને ભૂલાવનારું ! જૈનપણાના ખોળિયે આવ્યા પછી એ ધગશ જોઈએ કે મારા આત્માનો ખ્યાલ હરેક પળે રાખતો જાઉં; અને પરમાત્માની નિકટ કરતો જાઉં; વૈરાગ અને તત્વની રમણતામાં રમાડતો જાઉં. એને બદલે તું આજના જગતની જેમ ધેલો કેમ થાય ?” ધર્મ આ બધું શિખવે છે. અસ્તુ.

જ્યારે સમુદ્રદટ્ઠ કહે છે કે “આ આપણું કામ નહિ;”

ત્યારે નોકર કહે છે “હું તો જોઈશ.” એમ કરી મંગળિયાએ જમીન કોચવા માંદી. ત્યાં જોયું કે ‘હા ! કંઈક છે ! કંઈક દેખાયો !’ કંઈક દેખ્યા પછી પૂર્વે કરેલા કર્મના અને લોભના દોષથી એ વિચારે છે ‘ઓહો ! આ તો મોટો ખજાનો લાગે છે ! હવે આ શ્રેષ્ઠિપુત્રને ગફકલતમાં નાખી આ દલ્લો મારા હાથ કરાય તો મજાનું ! અને વિશ્વાસમાં નાખી દઉં, ને માલ હું ઉચાપત કરી જાઉં...તો ખરેખરું કામ થઈ જાય.’

અહીં હજુ એટલું સારું છે કે પહેલે તબક્કે એ નથી વિચારતો કે “મારી નાખું !” પણ આ વિચારમાં ય ત્યાં પહોંચે તેવો સંભવ છે. જુઓ લક્ષ્મી શું આપે છે ? જરાક પહેલાં શોઠ પ્રત્યે જે સદ્ભાવ હતો તેનો નાશ, અને ઠગવાની બુદ્ધિ ! એજ ને ? વધારે સારું શું ? લક્ષ્મી મળે એ ? કે સરળતા-સદ્ભાવ ટકે એ ? શ્રીમંત થઈએ એ ? કે દ્યાળું નમ અને પાપથી ડરતા રહીએ એ ? આપણી દીર્ઘ સલામતી શામાં ? આજના જડવાદી નશામાં સાચું નહિ સૂઝે. તો આજે અશાંત હાયવોય જીવને કેવા સંતાપ્યા કરે છે ! ક્યાં સુખશાન્તિ છે ? અને પરલોક ?

નોકર કળણના કંઈકને જોઈને વિચારે છે, ત્યાં સમુદ્રદટ્ઠની પણ ત્યાં નજર

272 ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“સમુદ્રદટ્ઠ અને મંગળ” (ભાગ-૨૨)

ગઈ, જતાં જ કહ્યું “ઓ ભદ્ર મંગળ ! અરે ભાઈ, રહેવા દે. આપણે એનું કામ નથી. ચાલ, નગરમાં જોઈએ.”

શું કહે છે ? “આપણે એનું કામ નથી.” તો નોકરની જેમ એ દગાબાજી ચલાવે છે ? ના, ઉપર કહ્યું તેમ એને ખરેખર જોઈતું જ નથી. વળી “દવ્યનો સંચય હું ઉપાડી જાઉં, અને આને નાખું ખાડામાં...” આવો વિચાર તો પેલો જીવ કરતો આવ્યો છે, આ નહિ. નિધાન ત્યાંનું ત્યાં છે; પણ ભવ કેટલા કરી નાંખ્યા ? સાપ...સિંહ...ચંડાલપુત્ર...અને આ દાસીપુત્ર. નિધાન અને મમત્વબુદ્ધિ એની એ છે; ભવો ફરે છે. શ્રેષ્ઠિપુત્રને તેવી બુદ્ધિ નથી; અને કરવી પણ નથી. તેથી કહે છે “ભાઈ, રહેવા દે, એનું આપણે કામ નથી.” કેવી નિઃસ્પૃહતા ! અને કેવો તૃષ્ણા પર કાબુ ! આ સરળતાથી કહે છે. પણ એના આ કથન પર મંગળિયો ખુશ થઈ ગયો. ખાડો પૂરીને બંને ત્યાંથી ચાલ્યા.

રસ્તામાં સમુદ્રદાટ મંગળને કહે છે, “જો ભદ્ર, આ બનાવને તું કોઈની આગળ કહીશ નહિ. કેમકે આ અધિકરણ છે. એવા નિધાન પર પાપનો ભયંકર આરંભ-સમારંભ થાય છે.” શું અધિકરણ એટલે ? જેનાથી જીવ હુગ્યતિનો અધિકાર થાય તે અધિકરણ. કલેશ-ટંટા અને પાપસાધનો અધિકરણ કહેવાય છે. આ શેઠ કહે છે “જો જે હોં, કોઈને કહીશ નહિ...અધિકરણ છે.” કોઈ સાંભળે ને દોડે, ને લઈ આવે; પછી તેનું શું કરે જીવહિંસા ને આરંભ-સમારંભ ! કારખાનું ને પેઢી ! શસ્ત્ર-સરંજામ વસાવે ! તેનાથી પાપખાનું ચાલે ! વળી બીજા સાથે સલાહસંપી તોડી રગડા-જગડા માંડે એ જુદું.

ગુજરાતમાં ડોસીઓ મરી જતી, તો મરતાં પહેલાં ઘરની ઘંટી વગેરે ઠેકાણે પાડીને મરતી ! ઘંટીનું પૈંકું દહેરાસરના ઓટલા આગળ દાટી આવે ! કે લોકો એના પર પગ ધોઈ પવિત્ર થઈ મંદિરમાં જાય. અધિકરણને ધર્મનું ઉપકરણ બનાયું. આરંભના આવા સાધનની કોઈને ભેટ ન અપાય. એ લઈ જનારો શું કરે ? કોઈ જીવોના કચ્ચરઘાણ ! સમુદ્રદાટ જોઈ રહ્યો છે કે આ નિધાન પણ એવું અધિકરણનું સાધન છે. એના કોઈ તીર્થયત્રાના સંધ કાઢવાનું નથી ! આજે કોઈ દાખલા છે કે પરિશ્રેષ્ઠનું પરિમાણ ઓળંગીને વધી ગયેલી લક્ષ્મી પણ જરૂર ધર્મમાં દઈ દેવાનું મન નથી થતું. ધર્મદા ખાતાના ટ્રસ્ટી બન્યા પછી એના પેસાને ધર્મમાં ખર્ચી નાખવાની બુદ્ધિ થતી નથી; ને ઊલટી સંધરી રાખવાની અને પાપની ચાલીઓ બાંધવાની હોશિયારી આવે છે. કેમ એમ ? લક્ષ્મી અધિકરણ છે.

પ્ર.- બીજો કદાચ સંધ ન કાઢે, પણ આ સમુદ્રદાટ પોતે તો કાઢી શકે ને ?

ઉ.- ખરી વસ્તુ એવી છે, કે પોતે એને (નિધાનને) ધર્મમાં લગાડે તે પહેલાં

એ નિધાન ગ્રહણ તો કરવું પડે ને ? ત્યાં જ એને મોટો વાંધો દેખાય છે કે “મારે એવો પરિશ્રેષ્ઠ શા માટે ? કાદવથી પગ બગાડીને પછી એને ધોવા, એના કરતાં બગાડવા જ નહિ, તે સારું.” શીરો ખાવા કોઈ માથું ફોડે ? દા.ત. પેસા લિધા ને ધર્મમાં ઉપયોગ કર્યો; ધર્મની ગ્રીતિ કરી; પણ ધર્મ સાથે પેસાની પણ ગ્રીતિ તો વધારી જ ને ? ‘આ પેસા લેવા જેવા છે...એનાથી સારાં કામ થશે...’ આ પેસાની જરૂરિયાત પર છાપ મારો, પછી આગળ કામ ચાલે. આ છાપ મારવાનું પાપ તો અનાદિકાળથી લઈ આવ્યા છીએ, તેને પાછું અહીંયાં ચાલુ રાખવાનું ?”

સમુદ્રદાટ એ વિચારે છે, “પેસા બહુ ખરાબ, એની દિશામાં ન જવાય ! ના, આજે હુનિયામાં એવા પ્રેમ વધી ગયેલ મળશે. પણ તેમને પૂછો કે ‘કેમ હવે ચારિત્રજીવન કર્યારે...?’” તો કહેશે, “ના સાહેબ ! એનો ઉલ્લાસ નથી જાગતો...” કારશા ? ચારિત્ર પ્રાપ્તિ માટે પાપનો જે ભયંકર તિરસ્કાર જોઈએ, તે નથી. પાપના પર હાડોહાડ દ્વેષ જોઈએ, તે નથી. તે હોય તો ચારિત્ર કેમ ન મળે ?

ધન્નાને ભગવાન મળ્યા, માત્ર તેથી ચારિત્ર નથી મલ્યું, પણ પ્રભુના વચ્ચેને “નારી નરકની દીવડી...” લાગી તો મળ્યું ! “ના, અમારે તો ભગવાન સરસ; તેમ ઘરવાળા પણ સરસ ! ગુરુ મહારાજ સરસ; પણ સાથે રૂપિયા અને કુટુંબ પણ સરસ ! ધર્મકિયાઓ સારી...તેમ લગ્નટાણાં સંસારકિયાઓ...એ બધુંય સારું.” આમ પાપ મનગમતા રહે ત્યાં ચારિત્રની શે ઉતાવળ થાય ? અથવા સંસારમાં રહ્યે રહ્યે પણ એ બધાના રાગમાં તશાઈ માયા, અનીતિ, કલેશ વગેરે કેમ નહિ થાય ? હુનિયામાં આજે જૂદું-અનીતિ અને કલેશ હુંસાતુંશી કેમ વધી ગઈ છે ? આજ કારણ છે કે પાપનો ભય નથી રહ્યો. આજના શિક્ષાશમાંથી પેસા, રંગરાગ અને આરંભ-સમારંભ એ પાપ; એની સંગત ઓછી એટલું સારું; એ તો ચાલ્યું ગયું; પણ ઉપરથી ‘જીવનધોરણ ઊંચા સારાં; પંચવર્ષીય યોજનાઓ વધારો; રેડિયો ઘરેઘર જોઈએ, સિનેમા એ તો મનોરંજન છે, જોઈએ...’ આ બધું વધી રહ્યું છે ! પાપની સૂગ ક્યાં રહી ?

સમુદ્રદાટ પેસા નથી લેતો. કેમકે નજીકમાં વિરતિજીવનની તૈયારી કરે એવી યોગ્યતાવાળો છે. પેસાના મૂલ્ય આંકનારો એ તૈયારી કરવાનો ? કહો જોઉં, પેસા લઈને સંધ કાઢનાર ઊંચો, કે પેસા છોડી સંતોષી રહેનાર ઊંચો ? આ જવાબ આપવામાં, બસ ! અંતરની લાગણી તપાસો. આપણી વૃત્તિઓ શું કામ કરી રહી છે ?

સમુદ્રદાટ મંગળિયાને કહે છે “જો જે, ધ્યાન રાખજે. આનાથી (આ નિધાનથી) પાપ વધે છે...” આ કહેવામાં પોતાની આંતરિક આંખ આગળ મોટી પાપની

જંજળ દેખાય છે. એનાથી એને કંપ છૂટે છે. ઓહો ! જરાક ગફલત થાય, ને કહી દે કોઈને કે અમુક જગાએ પૈસા છે...ને પેલો લઈ આવે...પછી કેટલાં પાપ એના પર એ આચરે ?... એકલા સ્થાવર જીવના જ સમારંભ છે ? ના, પંચેન્દ્રિય સુધીના સમારંભ છે ! પૈસા છે એટલે સામા પર જોહુકમી કરશે ! સામાને બેદાન-મેદાન કરવાની લડાઈઓય ચાલશે ! ઈર્ધ્યા, દ્રોહ, ઘમંડ, શિરજોરી બધું એના પર ! માટે જ લક્ષ્મી એ અવિકરણ. લક્ષ્મી એટલે પાપનું કારખાનું ! અભાંથી પાપનો માલ તૈયાર થતો જ જાય..." આ બધું જોઈને સમુદ્રદાનને કંપ થાય છે. કેવીક એની પાપથી ઉરનારી લેશ્યા છે ! જીવો પર કુરુણાભાવભરી લેશ્યા છે ! તોજ આ વિચાર આવી શકે. આવું મફતનું મળતું હોય ત્યાં તમને આવા વિચાર સૂઝે ને ? જેમ તાંબા પિતળ પર કલાઈ ચઢ્યા પછી કાટ ન ચઢે, તેમ આત્મા પર શ્રી વીતરાગ પરમાત્માના ધર્મનો રંગ ચઢ્યા પછી બિનજરૂરી રાગાદિ પાપનાં કાટ ન ચઢે.

આ બાજુ મંગળિયો મનમાં બીજો જ વિચાર કરે છે, "આ જબરો શેઠ છે મારો !... કેમ ભાઈ, કોઈને ન કહું ? હા હા ! બીજો કોઈ ઉઠાવી જાય તે પહેલાં પોતાને જ ઉઠાવી જવું છે ! અને મને આમ કહે છે ! ઠીક છે; પણ હું એમ ઠગાઉં એવો નથી !" એ વિચારમાં મોકે તો જવાબ આપી દીધો કે, "ઠીક ત્યારે, હું બીજાને નહિ કહું;" પણ મનમાં વસવસો રહી ગયો કે આ શેઠને ધન લઈ લેવું છે.

તાંથી શેઠની સાથે એ ચાલ્યો ખરો; પણ હવે મનમાં ઘાટ ગોઠવે છે, "એ ઉપાડી જાય, એ પહેલાં મારે લઈ લેવું જોઈએ. પણ આપણો પરાધીન...આ તો મુશ્કેલી ઊભી થઈ !" પૂર્વના કાળમાં શેઠ-નોકરનાં એવાં બંધારણ હતાં કે નોકરની કદર શેઠ ખૂબ કરતા. તેમ એ જલદી ઉદ્ધૃતાઈ ન કરી શકે, એવી શિસ્ત પણ પળાવતા. સામાજિક વ્યવસ્થામાં એ નહોતું ચાલતું, કે શેઠને અધવચ્યે મૂકી નોકર ચાલ્યો જાય. આજે તો તમારે ત્યાં આ ચાલી શકે છે ને ? તમે શેઠ ખરા, પણ નોકરના મોં તમારે સાચવવાં પડે ! કેવી કંગાળ દશા ! આ સ્થિતિમાં સ્વાધીન અને ઉદાર બનો તો જ રાહત મળો !

મંગળિયો સમુદ્રદાને રસ્તામાં મૂકીને રવાના થઈ શકે એમ હતો, પણ એ વિચાર અને નથી આવતો. એ વિચારે છે "કરવું શું ? અરે, હું તો શેઠના જ સપાટામાં પકડાયો ! કે શેઠ મને અજાણમાં રાખી ધન લઈ લેશે...પણ ના, એ લઈ લે તે પહેલાં જ હું કોઈ એવી ફસામણમાં એમને મૂકું કે એ ધનની વાત જ ભૂલી જાય."

પ્ર.- જો એ સમાજ વ્યવસ્થામાં શેઠ-નોકરના સારા સંબંધ હતા, તો આ નોકર તો ભારે ઠગી નાખવાનો વિચાર કરે છે ! તો એ સમાજ વ્યવસ્થા કેવી ?

૬.- સમાધાન સહેલું છે. આવા પ્રસંગ સેંક્રે-હજારે એક બને; અને આ તો, પૂર્વજીવનોનું વૈર ચાલી આવે છે માટે પૂર્વકાળે આવા કિર્સા કવચિત્ બનતા. આજે હાલતાં-ચાલતાં બને છે, એજ આ કાળની વિખમતા સૂચયે છે.

સસરાના ગામ પાસે આવ્યા એટલે સમુદ્રદાન મંગળિયાને કહે છે “તું જોઈ આવ, કે આપણે જે ધરે જવાનું છે, એ ધરની શું રીતિનીતિ છે. પછી આપણે જઈએ.” આમાં વિવેક છે, સમયજીતા છે. સમુદ્રદાનું આ વચન સરળ છે; પણ પેલાનું હદ્ય પાપી હોવાથી વિચારે છે, “હા ! મને કહે છે. ‘તું નગરમાં જા !’ અને પછી પોતે ધન લઈ આવે ! વાહ રે વાહ ! પણ હું એમ કંઈ ધન લેવા દઉં નહિ. હું કંઈ મૂરખ હું ? દાસીનો છોકરો હું, તેથી શું ? હું યે માણસ હું ; ભેજાવાળો હું. એ ધન ઉઠાવે તો પહોંચાડી દઉં યમસદનમાં !...”

ધન બિચારું ધનના ડેકાણે છે; અને તોફાન માણસના મગજમાં ચાલે છે ! માણસને જે ભેજું મય્યું છે, કે જે ભેજાથી ઊંચા તત્ત્વચિત્તન કરી શકાય, મહાપુરુષોના જીવન ચરિત્રોના વિચાર કરી શકાય...તે ભેજાનો ઉપયોગ આ મંગળિયો શું કરે છે ? અરે, એને હમણાં ઊભો રાખો, તમે શું ઉપયોગ કરી રહ્યા છો ? અહીં બેઠાં છો, તો ધરના-પેઢીના વિચારો સંદર્ભ બંધ છે ને ? ના ! કેમ ? અહીંયાં કરેલા વિચારોનું કંઈ ઉપજવાનું છે ? ના, પણ કંગાળ જીવ, મૂરખ જીવ, મનથી વસ્તુના લોચા વાળ્યા જ કરે છે દિવસ ને રાત ! મંગળિયો વિચારે છે; ‘હું કંઈ ઠગાઉં નહિ. નગરમાં જવું તો પડશે...પણ પેંતરો રચીને તને બચ્યાજી ! આબાદ ફસાવી દઉં !’

અજ્ઞાન જીવ એમ જ સમજે છે કે “પ્રપંચની જાળ આપણે ગોઠવીએ કે પાસા પોબાર ! એ થયા પછી આપણાને રોવાનો પ્રસંગ આવવાનો નથી...ચીજ ધરભેગી...અને પછી જિંદગી સુધી ચિંતા નહિ...!” કેવળ કરોળિયાની જાળ ! ઊંધી જ વિચારણા !

મંગળિયો નગરમાં ગયો; અને થોડી જ વારમાં ગભરાતો ગભરાતો પાછો આવ્યો ! કેમ ગભરામણમાં ? જુઓ.

મંગળિયાને ગભરાતો જોઈ, સમુદ્રદાન પૂછે છે “કેમ ભાઈ શું છે ?”

“અરે, શું કહું ? જુલમ થઈ ગયો...તમારી પત્ની સ્વીસ્વભાવ મુજબ કુળ વિસુદ્ધ આચરનારી બની ગઈ...અને તમારા સસરાનું કુળ વધારે ઉદ્વેગમાં પડી ગયું છે. એમાં પાછી મુશીબત એ થઈ ગઈ, કે એમને ખબર પડી છે કે તમે જમાઈ

અહીં આવો છો. તેથી શરમમાં પડી ગયા છે ! મોં શું બતાવવું ?” મંગળિયે બોંબગોળો ગબડાવ્યો ! એ જાણે છે કે શેઠ ધર્મિષ છે, અને વાત એવી ગોઈવીને કરે છે કે સમુદ્રાંતને ભરાબર ગળે ઉત્તરી જાય ! અને પછી પત્તીની ચિંતામાં ધન ભૂલી જઈ ઘરના રસ્તે પડી જાય.

આર્થ દેશોનો આ મહિમા કે ભવે માબાપ સંતાનને વિષયસુખ મળે એમ ઈચ્છે ખરા, પરંતુ તે અનાચારના રસ્તે નહિ જ. એમાં તે ઊલટાં નાખુશ. એવું જ પૈસા નીતિના મળે એમાં આનંદ, પણ અનીતિના મળે એમાં નહિ. આવું માત્ર કુટુંબમાં જ નહિ, પરંતુ સમાજની પણ પરિસ્થિતિ કે કુળ વિરુદ્ધ તમે આચરો તો સમાજની દસ્તિએ પણ તમે કોઈની કિંમતના !

સમુદ્રદાટ વિચારે છે “અરે, આવું બન્યું ? ધિક્કાર છે સ્ત્રીપણાને. કે જેથી શ્રાવકપણામાં ઉત્પન્ન થવા છતાં, અને જિનવચનના સારને જાણ્યા છતાં આવું ઉભયલોક વિરુદ્ધ આચરે છે !” કોણ આચરાવે છે આ ? એની માનસિક વાસના. પણ તે આ સ્થિતિમાં એણે આ કર્યું ! એમ સમુદ્રદાટને બહુ જ ખેડકારક લાગે છે ! સમુદ્રદાટે લઘ્ન કર્યા છે તે એવી રીતે જ કે સામું પાત્ર શ્રાવક કુળનું છે; અને જન્મયા પછી જૈનતાયોનું ‘દ’ નથી, પણ જાણકાર છે. આ જાણીને લઘ્ન કર્યા છે. જેથી એના જીવનમાં ધર્મ, શીલ, સદ્ગુણો, પરમાર્થવૃત્તિ વગેરે ઝગમગતાં હોય. સમુદ્રદાટ પોતે જ સમાધાન કરી લે છે “મોહના ઉદ્ય આગળ કંઈ દુષ્કર નથી. મોહભાવમાં કોઈ અશક્યતા નથી. વળી, આવું જેયા પછી હું ધરવાસમાં બેસી રહું ? સર્યું એવા ધરવાસથી. હવે તો હું ધરવાસનો ત્યાગ કરી પરમાત્માનું સાધુપણું સ્વીકારી લાં.” અહીં પૂછો ને કે

પ્ર.- “અરે ભાઈ, આટલી ઉતાવળ શા માટે કરે છે ? એક સ્ત્રી આવી છે તો બીજી પરણી લેણે.”

3.- “All,”

આ જગતમાં જે સ્નેહ છે, તેનું પરિણામ આવું જ આવે છે. કોઈને વહેલું, કોઈને મોડું. જેનું છેવટ આવું, એના આદર શા ? સમુદ્રદાટાને ત્યારે શું કરવું છે ? વિચારે છે કે “હવે તો ત્યાં જ જાઉં, કે જ્યાં મારા ગુરુદેવ અનંગદેવ આચાર્ય મહારાજ બિરાજતા હોય. વેર જશે મંગળિયો. મારે એવા ધરવાસના કલેશમાં પડવાની શી જરૂર છે ?”

પ્રશ્ન થાય કે મંગળિયે સમુદ્રદાનનું નુકશાન કર્યું કે લાભ ? એનો મર્મ સમજવા જુઓ કે આ શેઠ તો એવા નીકળ્યા કે એમને ઘેર ય જવું નથી, કે સાસરે ય જવું નથી. હવે એમને તો આત્માના રક્ષણ માટે જવું છે ! આમાં લાભ કહેશો ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨) ૨૭૭

કે નુકશાન ?

સમુક્રદંન પોતાનો આ વિચાર મંગળિયાને જણાવે છે. પણ હજુ મંગળિયો તો એમાં ય દંગો હેઠે છે ! “ઓહો ! હજુ આ મને ઠગવા મથે છે !”

શાવકને જિનની આગળ જગતની માયા ફૂચા લાગે :-

અહીં જરાક સિંહાવલોકન કરો. ટૂંકા પ્રસંગમાં કેટકેટલી ઉત્તમ વાતો આવી ગઈ. નોકરના આગ્રહ છતાં સમુદ્રદાતને નિધાન જોવું નથી ! જિનાજ્ઞાનો રંગ, લક્ષ્યની ભ્યાનકતા, અને શ્રાવકપણાની સુવાસ કેટલી બધી રોમરોમમાં અને રગેરગમાં વ્યાપી ગઈ હશે. કે જંગલના એકાંતમાં સહેજે મળી આવતા નિધાનને લેવાની વાત તો દૂર ! પણ ‘ચાલો ભવિષ્યમાં જરૂર પડ્યે અહીંથી લઈ જવું, જોઈ રાખો કેટલું છે, શું શું છે’ એવી જોવાની જિજ્ઞાસા પણ નથી થતી. સમજજો કે જીવનમાં આવું કાંઈક હશે તો જ શ્રાવકપણાની સુગંધ આવી ગણાશે; તો જ પરમાત્મા ખરેખર ગમ્યા, એમના વચનની ખરેખર દઠમાયા લાગીને એક માત્ર ધર્મના ખપી બન્યા ગણાઈએ. આવું બધું હોય તો સંસારની માયા અકારી લાગે; જિન આગળ જગતની માયા કુચા લાગે.

संसारीना कोड :

પાણું; મંગળિયાએ ખોદાને નક્કી કર્યું કે નિધાન જ છે. તો સમુદ્રદાટને ભડક લાગી ! શું મોંમાં પાણી ન છૂટવું ‘અહો ! મફતમાં માલ ! તે ય ભરપૂર ધન ! વાહ ધક્કો સફળ ! એમાં વળી નવી પત્તીને આમાંથી માલ આપી ખુશ ખુશ કરી શકાશે ! પછી તો એ આપણા ઉપર કેટલો બધો સ્નેહ કરશે ! મોહી જશે !’ કેમ ? સ્નેહ ને મોહ કરે ને ? કહો છો ને પૈસો દેખી મુનિવર ચણે ! તો તો પામર સંસારી જીવનું બિચારાનું શું ગણું ? એમાં પાણી પત્તી તો કમાવવાના અધિકાર વિનાની ! એટલે પૈસો દેખી કેમ ન પીગળે ? પ્રારંભમાં જ એને પૈસાથી નવરાત્રી નાખનાર પતિ ઉપર ભારે ઓવારી જાય. પતિ માગે તો એ દેવની જેમ પતિની આરતી ઉતારે આરતી ! છે ને એ તમારા સંસારનું નાટક ? સમુદ્રદાટને આવા કોઈ કોડ નથી થતા. કેટલું બધું અનાદિ મલિન આત્માનું પરિવર્તન કર્યું હશે ! તે પણ માત્ર બે ગ્રણ ભવમાં જ ! ધર્મ હદ્યસ્થ કરવાની પદ્ધતિ પર આધાર છે. ધર્મ સાથે દિલની કેવી સગાઈ કરો છો એના ઉપર પરિષ્ઠામનું માપ નીકળે છે.

સમુક્રદંશને એમ પત્તી ખુશ કરવાના મોહના કોડ તો નથી પણ એ ધનથી વૈભવી થવાના, મોટા વેપાર ખેલવાના, મોજ ઉડાવવાના... એવા ય કોડ નથી. શ્રાવક કોડિલો ન હોય? હોય, પણ શાનો કોડિલો? પ્રથમ નંબરે તો જીવનમાં પાપ ઓછામાં ઓછું કરવાનો; અને પણી જે કંઈ પાસે છે એમાંથી પ્રભુભક્તિ

સંધ્યાત્રા સાધ્યિક વાત્સલ્ય વગેરે ધર્મપ્રભાવક કાર્યો કરવાના કોડ.

મનનીય ચિંતન :-

શ્રાવક એટલે તો પાપનિવૃત્તિનો અખંડ ઉપાસક ! એને એમ થતું હોય કે “જાડ-પાન અને કિડાકીડીના અવતારમાંથી ધૂટટ્યો છું ! વાધ વરુ અને અન્ય પશુપણામાંથી ધૂટટ્યો છું ! સ્વર્ગીય ભોગલંપટતા અને નરકની ઘોર વેદનામાંથી બહાર નીકળ્યો છું ! તે હવે શું હું પાપમાં રગડોળાઉં ? આજ સુધી તો પરાધીન હતો અને જાતે મૂઢ હતો. આજે આવા સુંદર મનુષ્યભવ ઉપરાંત તરણ તારણ તીર્થકર પરમાત્માની ખાસ ધર્મ-બક્ષિસ પાખ્યો છું; સ્વાધીન અને સજ્ઞાન બન્યો છું. તો હવે જીવનમાંથી વીણી વીણીને દોષોને અને પાપોને દૂર કરતો જઈશ. પાપ પોષનારા હુન્યવી પ્રલોભનો સામે આવે છતાં મારે એના કોઈ જ મૂલ્ય ગણવા નથી; મારે અને ન મખ્યા જેવા માનવા છે; એના પરિગ્રહ અને ભોગમાં ફસાવું નથી...” આવું આવું વિચારીને શ્રાવક પાપનિવૃત્તિનો અખંડ ઉપાસક બન્યો રહે છે. સમુદ્રદાટે ધર્મની સ્પર્શનામાં આવું આત્મતેજ પ્રગટ કર્યું છે. એ તેજમાં બિનજરૂરી પાપના અંધારા ઉલેચાઈ ગયાં.

ખર્ચ ઘટાડો :-

જેમ ઘર કે પેઢી ચલાવવા માટે માથે પૈસાનો ખર્ચનો ભાર ચઢે છે; તેમ સાંસારિક જીવન નભાવવા અટાર પાપસ્થાનકના સેવનથી આત્મા પર પાપનો ભાર ચઢે છે. ત્યારે, જેમ કોઈ હોશિયાર આદમી પેઢી પર માલિક બની આવતા કે હોશિયાર સ્ત્રીના હાથમાં ઘર કારભાર આવી લાગતાં એક કામ એ મફતિયા કે વધારાના ખર્ચના બોજ ઘટાડવાનું કરે છે, તેમ જીવ ધર્મની હોશિયારી મેળવ્યા પછી જીવનમાંથી પાપના બોજ ઘટાડવાનું કરે છે; નવા ખોટા ખર્ચની જેમ નવા પાપના ભાર વધારતો નથી. સમુદ્રદાટ આ સ્થિતિની હોશિયારી પાખ્યો છે. તેથી નિધાન તરફ બેપરવા છે.

સલામતી :-

એ બેપરવાઈમાં જ એ પોતાની આત્મ સલામતી જુએ છે. તમે તો કદાચ આવું મફતિયું ધન મળવાનું જોતાં એ વિચાર નહિ કરો કે “પણ આપણે શું આમાં સલામત રહીશું ? કોને ખબર કોનો માલ હોય ? નથીને કોરટ લફરું થયું તો ? નથીને આ નિમિત્તે વૈરના કારણે આપણે માર ખાવો પડ્યો તો ? છેવટે ય, આ એક લાલચમાં લપટાવાની કુટેવ તાજી કરવાથી પછી બીજી કુટેવોના ભોગ બનવું પડ્યું તો ? આવું સહેજે મળી જવાથી પછી પ્રભુના ગુણગાન-સ્મરણને બદલે આના ગુણગાનની લપમાં ફસાઈ ગયા તો ? જે ચીજ કે જે પ્રસંગો વિશિષ્ટ કોટિના

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેવિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

૨૭૮

બનીને દેવગુરુ ધર્મને ભૂલાવી મગજમાં સ્થાન જમાવી બેસે, વારેવારે એની વાહવાહ યાદ આવે, એવા ચીજ-પ્રસંગ પર જીવનું કેટલું બધું બગડે ? આવી આવી બાબતો બને ત્યાં સલામતી કર્યાં સહી ?

દયા, અને અધિકરણ :-

સમુદ્રદાટ જીતની અસલામતી જોઈને બેસી ન રહેતાં કેવળ ભાવદ્યાથી પ્રેરાઈ નોકરને કહે છે ‘જોજે કોઈને આ દટાયેલાની વાત ન કરતો. એ અધિકરણ છે.’ કેટલી બધી જીવોની દયા ! લક્ષ્મી જેની પાસે જાય છે એને રાગદ્વેષ, ગર્વકલેશ, આરંભ સમારંભ વગેરે અનેક પાપોથી ભારે કરી ખુવાર કરી નાખે છે ! ત્યારે એ આરંભભાદિમાં અસંખ્ય ત્રસ-સ્થાવર જીવોનો સંહાર થાય છે એ એની ખુવારી. આમ આ નિધાનની પાદ્યણ સમુદ્રદાટ બે રીતના જીવોની ખુમારી જુએ છે. રોમરોમમાં કેટલી દયા વર્સી ગયાથી આ દાણિ, ને આ લાગણી ઉદ્ભબે ? ત્યારે જુઓ કે એની જૈન ચક્ષુ કેવી ! ચક્મકતા નાણામાં અધિકરણ દેખે છે ! માણસને શોખ થાય છે કે ‘બંગલા વધારું, બગીચા વધારું, ફર્નિચર રાચરચીલું વધારું.’ શું છે આ બધું ? અધિકરણ ! એ જીવને રોજના કેટિ રાગદ્વેષાદિ અનર્થદંડનો અધિકાર આપે ! એના કુટંબને ય આપે ! એ નિમિત્તે સૂક્ષ્મ જીવોને મોતનો અધિકાર આપે. જૈનશાસન પામીને આત્મદાસિ જીવ્યા પછી વસ્તુથી વૈષયિક આનંદ ઊભો થતો જોવાને બદલે આવા રાગ-દ્વેષ-કલેશ-સંહાર વગેરેના ખતરનાક અધિકાર કેવા ઊભા થાય છે તે જોવાનું હોય છે. તો આજના જમાનાના વિજાને ઊભા કરેલા શોખ-સગવડના સાધનોમાં લપટાઈ એનો પરિગ્રહ વધારવાને બદલે એને ‘અધિકરણ’ સમજ શક્ય એટલી જરૂરિયાતો ઘટાડવા પૂર્વક એ અધિકરણોને આધા જ રાખવા જેવા છે. જેટલા પ્રમાણમાં એનાથી બચ્યાં એટલા પ્રમાણમાં જીવને માથે ચિંતા અને પાપના ભાર ઓછા ચઢવાના. કોઈની પાસે સારી ચીજ દેખીને એ આપણી પાસે નથી. એનો જરાય ઓરતો ન કરતાં ખુશી માનવા જેવી છે કે આપણી પાસે એટલો અધિકરણ અને પાપનો ભાર ઓછો છે. વીતરાગ પ્રભુનો માર્ગ પામ્યાની આ સુવાસ છે.

મંગળિયાના જીવનમાં લક્ષ્મી એ કેવું અધિકરણ બની એ ત્યાં જ જણાય છે. હજુ તો ધન ધરતીમાં હતું છતાં એના પર ભારે રાગવાળો બન્યો અને એના યોગે શેઠને ઠગવાના વિચારમાં અને યાવત્ પ્રવૃત્તિમાં એવો ચઢી ગયો કે સમુદ્રદાટને તદ્દન ઊંધું ભળાયું ! તે પણ મહાકુલીન એવી એની પત્ની પર દુરાચારીપણાનો આરોપ ચઢાવ્યો !! આ ઓછું અધિકરણ છે ? ધન ધનના ઠેકાણે છે અને મંગળિયાના જીવનમાં તોઝાન શરૂ થઈ જાય છે ! જીવનમાં લક્ષ્મીની કિંમત ઊંચી આંકવા

૨૮૦

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“સંસારીના કોડ” (ભાગ-૨૨)

પાછળ અનેક પાપી ઉત્પાતો મયે છે. વિશ્વાસુ પર વિશ્વાસધાત આચરાય છે. સજજનને દુર્જન માની લેવાય છે ! એની સામે હવે દુર્જનતાનો વ્યવહાર શરૂ કરાય છે ! ખોટાં ખોટાં આજ ચઢાવાય છે !

અયોગ્ય વિચારણા નહિ :-

સમુદ્રદાટની પત્ની જિનમતી સુશીલ હતી, પણ મંગળે એના સંબંધમાં ઉધું ભળાયું. ત્યારે બીજી બાજુ સમુદ્રદાટે હજી સુધી મંગળ પર અવિશ્વાસ રાખવાનું કારણ ન બન્યું હોવાથી, એ સહેજે સાચું માની લીધું. પણ શ્રાવકપણાની જલક એવી છે કે એના પર કોઈ અયોગ્ય કે વગર વિચાર્યું પગલું નહિ ભરવાનું. એણે વિચાર્યું કે “ઉત્તમ કુળ અને જિન વચન મળ્યા પછી અનુચ્છિત આચરવાનું હોય ? પણ જ્યારે મોહની પ્રબળતા એ પણ આચરાવે છે, ત્યારે હવે વિશ્વાસ ક્યાં ધરવો ?” છે આમાં ક્યાંય સ્ત્રી પર ગુસ્સો કે એના બાપ પર ગુસ્સો ? “આ કેવા હલકા માણસો ? આવા સાથે ક્યાં સંબંધ જોડ્યા ? ત્યારે હું પણ એને જગતમાં ઓળખાવી દઉં...” આવું કાંઈ જ મનમાં આવતું નથી. તેમ પોતાના માબાપ પર પણ ગુસ્સો નથી આવતો કે ‘આ કેવું કુપાત્ર મને વળગાડ્યું !’ અરિહંત ભગવાનનો ધર્મ એવો કુશળ સલાટ છે કે મનનું અને હેયાનું સુંદર ઘડતર કરી દે છે. પછી આંખ સામે ભ્યાનક પ્રસંગો બને તોય એમાં તત્ત્વ જોવાનું થાય છે. મહાત્માની વિચારણા જન્મે છે. આવા ધર્મની ને એના કહેનારની બલિહારી છે. તેથી હવે નવા લગ્નની પણ ઈચ્છા નથી થતી.

સ્વાત્મરક્ષણ :-

સમુદ્રદાટે આ પ્રસંગ પરથી સમસ્ત સંસારને અવિશ્વસનીય લેખ્યો, અને ગુરુચરણે જીવન જુકાવવાનું ધારી લીધું. સ્વાત્મરક્ષણ એ એક મોટી ચીજ છે; અને તે આવા ઉચ્ચ જૈન ધર્મવાળા ઉચ્ચ માનવ જીવનમાં સાધી લેવાનું બહુ સુલભ છે. બધું સંભાળ્યું, બધું ભેગું કર્યું પણ આત્મા ન સંભાળ્યો, ને એમાં પુણ્ય ભેગું ન કર્યું તો પરલોકે એ રખી પડ્યો. આજના કાળે તો ડગલે ને પગલે એ જરૂરી છે. આજે ભયંકર વિકસી ઉઠેલી ભૌતિકતામાં જરા ભૂલ્યા કે ફસાયા ! સ્વાત્મરક્ષણ ગયું. છાપાનો દરેક ફકરો, રેઝિયોના દરેક સમાચાર મોટે ભાગે સ્વસ્થ બેઠેલા આત્માને પણ વિઝ્વળ કરી નાખનારા હોય છે; દુધ્યાનમાં અને કષાયમાં ચઢાવી દેનારા હોય છે. એવા અવસરે તો સામે જિન વચનનો ખૂબ અભ્યાસ જોઈએ, જૈન તત્ત્વોનું ગંભીર વિસ્તૃત જ્ઞાન જોઈએ કે જેથી પ્રસંગે જટ સ્વાત્મરક્ષણ કરી શકીએ.

• વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા •

નોકરનો તો માત્ર ગપગોળો જ હતો પણ સમુદ્રદાત સ્વાત્મરક્ષણની વિચારણામાં ચઢી ગયો. મનને આશ્ર્ય તો થાય ને કે “પત્નીના જીવનમાં આ શું બન્યું ?” પણ એ શાંખો છે, જિન વચનથી ભાવિત છે, તેથી સ્વતઃ સમાધાન કરી લીધું કે, “મોહન આવેશમાં કોઈ વસ્તુ અસંભવિત નથી. પણ એટલું ખું કે સંસાર જો આવી રીતે જીવને ગફલતમાં નાખતો હોય તો એવા સંસારને વળગી રહેવાનું શું કામ છે ?” સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વર દેવના પ્રરૂપેલા ધર્મને પામેલો, પ્રરૂપેલા તત્ત્વને સમજનારો આત્મા સંસારના આવા વિશેષદૂપે બનતા પ્રસંગમાં આત્મરક્ષણની ધાર્મિક ભાવના અવશ્ય ભાવે છે. જો કે જગ્રત આત્માઓ તો ચાલુ પ્રસંગને પણ વૈરાગ્ય-દાસ્તિ જુઝે છે, પણ વિશેષ પ્રસંગે તો જરૂર વૈરાગ્ય વધે. આ ઉપકાર કોનો છે ? શ્રી અરિહંતના આત્મપ્રધાન શાસનનો છે; ખુદ અરિહંતદેવના તેવા જીવનનો છે. અરિહંત પરમાત્માના જીવે પૂર્વજીવનમાંથી એવી સાધના શરૂ કરી હોય છે કે એ કોઈ એવી ખાસ ઘટના બનતાં આત્મસંરક્ષણ વૈરાગ્યના માર્ગ વળે છે; જ્યારે અણાન જગત એવી ઘટનામાં વધુ રાગદ્વેષમાં તણાય છે.

વિશ્વભૂતિ :-

વીરવિભુના જીવનમાં સાંભળી ગયા ને કે સોળમાં ભવમાં એ વિશ્વભૂતિ રાજકુમાર હતા, એને ખબર પડી કે મોટા કાકાએ જરા માયા બેલી ! એમ થયું કે “અરે ! હું એમના પર વિશ્વાસ રાખનારો અને એમણે પ્રાપ્ત્ય બેલ્યો ?” આ મથાણું બાંધીને એ રાજકુમારે શાની વિચારણા આગળ લંબાવી ? વૈરાગ્યની ! એવી કોઈ ભાવનામાં રાજકુમાર ચઢી ગયો કે, “જ્ઞાનીઓ ખરેખર !” સંસારને આવો જ કહે છે, કે જ્યાં તમે વિશ્વાસ રાખો, ત્યાં જ ધોખો. માટે એક જગાએ લાયું છે કે મૂઢ માણસોને જે સ્થાનોમાં ભારે વિશ્વાસ છે, ત્યાંથી જ તેમને અચાનક મોટો ભય આવી નરે છે. ક્યાં વિશ્વાસ રાખવો ? જગતની લક્ષ્મી પર ? વિષયો પર ? કુંઠલ પર ? માન-મરતબા પર ? અરે, પોતાની હોશિયારી પર વિશ્વાસ રાખવો ? જ્યાં વિશ્વાસ રાખ્યો, કે એના તરફથી ભયનું ભૂત વળગ્યું સમજે. એ ભૂતનું તોફાન ક્યારે જાગણે તે કહેવાય નહિ એ માનના કારણે જ, એ લક્ષ્મીના કારણે જ એ વિષયોના કારણે જ આહા ! આજે પણ જુઝો કે કેટલાય જવો પસ્તાવો કરે છે ! અને ભવિષ્ય માટે તો પૂછવું જ શું ? દુર્ગતિના મહાન દુઃખો વેઠે છે ! મેં કાકા પર વિશ્વાસ રાખ્યો, તો કાકા તરફથી શું મળ્યું ? પોલિસી

પ્રપંચ ! તો શું કાકા સાથે મારે આણબનાવ કરી બીજા સંસારી પાત્ર પર વિશ્વાસ કરવો ? નારે ના, આ તો એક નમૂનો. આ પરથી જગ્ઘાઈ ગયું કે જેવા કાકા તેવા બીજા મોહવશ જીવો. જેવા જીવો તેવા જડ પદાર્થો એટલે ? આખો સંસાર જ દગ્ગાખોર છે, માટે સંસાર સાથે જ અણબનાવ રાખવો. સંસાર સાથેનો મેળ તોડી, ખરેખરા વિશ્વાસપાત્ર આપ્તજન સદ્ગુરુ અને જિનોકત સંયમ ધર્મ સાથે જ સંબંધ જોડવો...”

સનત્કુમાર :-

નીચેથી ઉંચે કેમ અવાય ? હલકી સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિ કેમ સર્જાય ? જીવનમાં ડગલે ને પગલે ઉપસ્થિત થતા પ્રસંગોએ આંખમિયામણા કરવાથી નહિ; પણ આંખ ખુલ્લી રાખી એના પર અસાધારણ વિચારણા, ઉમદા વિચારણા કરવાથી ઉંચે અવાય; ને ઉચ્ચ સ્થિતિ સર્જાય. સનત્કુમાર ચકવર્તીને દેવોએ કહી દીધું ‘તારા શરીરમાં ભયંકર રોગ થયા છે...’ ચકવર્તી માટે આ વિચિત્ર પ્રસંગ ઉભો થયો. આ ચાલુ પ્રસંગ ન કહેવાય. ચાલુ પ્રસંગ કોને કહેવાય ? ચાલુ પ્રસંગ તો એ કે રોજ વધારે ખાય ને માંદો પડે ! રોજ ઉઠે ને રોજ સુવે ! વગેરે... પણ વિચિત્ર પ્રસંગ આવીને ઉભો, તો એ પ્રસંગે દુનિયાના મુફ્લીસ મનુષ્યની વિચારણા ન કરી ! શું એવી વિચારણા ચકી ન કરી શકત ? કરી શકત કે “હું અને આ રોગો ? બોલાવું છું ધન્વંતરી વૈદ્યોને, મંગાવું છું દુનિયાભરની ઔષધિઓને ! હીરા-માણેકને ખલમાં લસોટાવી એની દવા કરી શકાવું એમ છું...હું ચકવર્તી અને માંદો ? હું ચકવર્તી એટલે ? બિમાર છું તો રાજદરબાર બંધ કરો...આરામ કરો...આપણે ક્યાં નોકર-ચાકરનો તોટો છે ! અરે, હજારો મુકૃટબદ્ધ રાજીઓ પણ આપણા ગુલામ છે. તો શરીર સારું કરવાના લાખ ઉપયોગ કરો...” આ મુફ્લીસ હલકી વિચારણા કરી શકત એ. પણ સનત્કુમારે તે વિચારણા ન કરી ! તેમણે તો પ્રભુ શાસન શિખવે છે એવી અસાધારણ, ને ઉમદા વિચારણા કરી ! કેવીક એ વિચારણા હશે ? આવી જ કોક ને ?

“મને રોગ ? હું તો મારી જાતને રૂડી-રૂપાળી માનતો હતો ! ત્યાં આ કુટિલકાયા પર મેં માયા કરી ? જે રોગને આ શરીરમાં પેસતાં છખંડની ઠકુરાઈની શરમ ન નહી, જે રોગને આ દેહમાં ધૂસતાં છન્નુકોડ પાયદળનો ભય ન લાગ્યો કે ‘ભાઈ આવા ચકવર્તીના શરીરમાં ન ધૂસાય...કેમકે એની પાસે છન્નુકોડ સૈનિકો છે; બત્તીસ હજાર દેશના મહારાજા આશ્વાધીન છે ! નવ નિધાન છે ! ત્યાં કેમ પેસાય એવી એને કોઈની બીક ન લાગી ! અને અંદર ધૂસ્યા ! તો પછી એ ઠકુરાઈ, એ સેના, એ રાજાઓનો પરિવાર મારે શું કામનો, જો એણે દુષ્મન

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૨૮૩

રોગોને અંદર પેસતાં ન અટકાવ્યા ?...” આવી કોઈક ઉમદા વિચારણા જીવનમાં આવી પડેલા વિચિત્ર પ્રસંગ પર કરી તો કર્મના રંક ગુલામ મટી સંત સપ્રાટ બન્યા ! જીવમાંથી શિવ થવાના માર્ગે ચઢી ગયા !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૩૦, તા. ૨૧-૪-૧૯૫૬

તમારે આજ સુધીમાં કોઈ વિચિત્ર પ્રસંગ જોવાનો આવ્યો છે કે નહિ ? અને આવ્યો છે, તો એ વખતે દિમાગ (મગજ) શું કામ કરતું હતું ? ખુદ તીર્થકરદેવનો આત્મા પણ ઉંચો તો જ આવ્યો, કે જ્યારે એમણે દુનિયાના વિચિત્ર પ્રસંગ ઉપસ્થિત થતાં એના પર શાસનશૈલીની વિચારણા કરી !

સનત્કુમાર ચકવર્તી મટી સંસાર છોડી ચાલી નીકલ્યા; તો હજુ આગળ જુઓ કે તેમની પાછળ લાખોની સંખ્યામાં પરિવાર કાળો કકળાટ કરતો પૂછે લાગ્યો. આ કોકવારનો પ્રસંગ છે. પણ તેના પર ચકવર્તી મહર્ષિનો વૈરાગ્ય વધતો ગયો. તો જ આત્માનો ઉદ્દ્ય થયો. નહિતર અસ્ત થતાં વાર નહિ ! “હાય હાય... આ બધા રૂવે છે ?...” કેમકે રોનાર કોણ હતા ? એ હતા કે જેમણે મહાન ભોગ પીરસ્યા છે; કરજોડીને સહર્ષ સેવાઓ ઉઠાવી છે; આનંદના પૂર વહાય્યાં છે. એ રે છે. કેવું રે છે ? એવું કે જેથી જંગલ પણ રડી ઉઠતું હતું ! જેમના રૂદ્ધની પશુ-પંખીઓ પણ કકળી ઉઠતાં હતાં ! રૂદ્ધન કરનાર જે અંતરથી માનતા હતા કે “ચકવર્તી ! અમે તો તમારા બાળ જેવા છીએ. તમારે ઘણાય સેવક; પણ અમારે તો તમે એક આધાર છો !...” એ આવું રે, એથી કઈ વિચારણા જાગે ? શું એમ ન થાય કે “અરેરે, બિચારા આટલામાં આટલા બધા દુઃખી થાય છે, તો પછી તો એમનું શું ય થશે ! અને મેં ભલે વૈરાગ્યનો વિચાર કર્યો, પણ આ બધાના સામેય જોવા જેવું છે. આ લોકો જ્યારે આટલો બધો સ્નેહ મારા પર રાખે, મારા વિશ્વાસે જ જીવે ત્યારે મારાથી છેહ કેમ દેવાય ? કંઈ નહિ, ચાલો ઘરમાં રહી ધર્મ કરશું...” આવી કોઈ મુફ્લીસ અણાનતાભરી વિચારણા ન કરી.

આના પર તો સનત્કુમારે એ જોયું કે “આ બધાં રૂવે છે તે કોઈ મારા રોગથી રોતું નથી કે ‘અરેરે...અમારા સ્વામીને આ રોગ ? ને પાછા જંગલમાં જાય છે ?’” ના આમાંનું કંઈ નથી, બધા એક જ ભૈરવી કે ભીમપલાસમાં ગાય છે, એક જ રાગનું સંગીત બજે છે કે ‘હાય હાય ! તમે જાઓ પછી અમારું શું થાય ? એટલે ? તમારું ગમે તે થાઓ, સંસારમાં ખૂચ્યા રહીને પરભવે તમે ગમે ત્યાં ફેંકાઈ-ફેંદાઈ જાઓ, પણ અંત્યારે અમારે ક્યાંથી આનંદ લૂંટવો ?...’આવી

૨૮૪

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા” (ભાગ-૨૨)

સ્વાર્થની જ ગણત્રી છે. ચક્કવર્તી આ દર્શન કરી રહેલ છે.

પરિવાર ધારતો હતો કે ‘રોઈને પાછા વાળશું ચક્કિને. કેમકે પહેલાં એક આંસુ બતાવતાં તો ચક્કી પીગળી જતા હતા, પણ હવે તો શ્રાવજી ને ભાઈરવો વરસાવશું, પછી કેમ નહિ પીગળે ?’ મોહવશના ગમે તેવા નિર્ધારને ખંડિત કરી નાખનારા કોણ ? સ્નેહીના આંસુ; પણ સનત્કુમારે તો જોયું કે “રો ! તમે રો છો તમારે સ્વાર્થે. એમાં હું ટેકો આપું તો તમારું યે બગડે ને મારું યે બગડે. તમારી અજ્ઞાનદશા છે માટે તમે રો છો. મોક્ષમાર્ગનો ઘ્યાલ નથી માટે રો છો. જ્યારે મને તો હવે પરમતત્ત્વનો પંથ સૂર્જી ગયો ! મારે તમારા ઝણની કોઈ અસર લેવાની નહિ !”

આવી પડેલા આકસ્મિક પ્રસંગ પર ચક્કવર્તીએ પ્રભુ-શાસનને અનુસરતી અનુપમ વિચારણા કરી, તો મહા-મહર્ષિ બની ગયા ! આત્માની ભવ્ય ઉન્નતિના સાધક બન્યા.

શાન્તિનાથ ભગવાન પહેલા ભવમાં :-

પોતે રાજી છે. પોતાના બે છોકરા એક ગણિકા ખાતર અરસપરસ લડે છે. રાજાએ બંનેને સમજાવ્યા, પણ સમજતા નથી ! આ વિચિત્ર પ્રસંગ ઊભો થયો કે, પોતાના દિકરા પોતાનું કહ્યું માનતા નથી ! એના પર એમણે શું વિચારણા કરી ?

“આવું જીવતર શા કામનું ? જ્યાં આગળ આપણા પોતાના ગણાતા પુત્રો, તે આપણા વાર્યા છતાં અટકે નહિ, ને આપણા કુળને કલંક આપનારી કિયા કરે ? અરે, અમારે એવું જોવાનો દિવસ જ શા માટે જોઈએ ? માટે આપધાત કરું !” અહીં પ્રશ્ન થશે કે,

પ્ર.- આપધાત કરવો જોઈએ ?

૩.- ત્યારે શું ચલાવી લેવું જોઈએ કે એ તો સંસારમાં બધું ચાલે ? ના, ખરો રસ્તો તો એ છે કે બહુ એવું લાગે તો સંસાર છોડી દેવો. પણ આ રાજી એટલી કક્ષાએ પહોંચ્યા નથી, છતાં પણ એને એટલું તો ચોક્કસ લાગ્યું કે ‘કુણ કલંકિત થાય, તે જીવતાં જીવે જોયા કરવું એના કરતાં મૃત્યુ સારું. આપણા છોકરા અને આ ? એ કલંક આપણાથી જોવાય નહિ.’ છે આ વિચારણામાં પુત્રો પર કોઈ રોષ ? છે આ વિચારણામાં કોઈ તામસભાવ ? ના ! આ જ ખૂબી છે. સંસારના વિચિત્ર પ્રસંગને દુન્યવી પામર માણસની વિચારણામાં ન લઈ જતાં ઉમદા વૈરાગ્યની વિચારણામાં લઈ જવો તે ઉન્નતિનો અણમોલ ઉપાય છે.

અરિહંતપણ સુધીની ઉન્નતિ સર્જવાની સાધનાઓમાંની આ પણ એક સુસાધ્ય ભુવનભાનુ અન્સાઈકલોપીયિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય્ય કહા.” (ભાગ-૨૨)

સાધના છે, કે સંસારના વિચિત્ર પ્રસંગોએ વૈરાગ્યની જ વિચારણા કરવી. પણ જે આત્માને તેવા પ્રસંગોએ દુન્યવી વિચારણા જ સૂર્જે છે, તેના માટે માનવું પડે કે એનો વિકાસ નિકટમાં નથી, તેની ઉન્નતિ દૂર છે.

પરમાત્મા શ્રી અરિહંતદેવોના જીવન પર દસ્તિપાત કરીએ છીએ તો આજ ઠેર ઠેર દેખાય છે કે વિચિત્ર પ્રસંગોએ વૈરાગ્યની વિચારણા કરી, તો શ્રી નેમિનાથપ્રભુએ રથ પાછો વાખ્યો, અને સંયમના માર્ગ તૈયારી કરી.

ઋષભદેવ પરમાત્માનો જીવ મહાબલ રાજા, મંત્રીએ એક માસનું આયુષ્ય કદ્યા પછી સંસારને અસાર ઓળખી લઈ, ચારિત્ર લીધું, ને આગળ વધ્યા.

એવા એ અરિહંત પરમાત્માના અજબ જીવનનો અને એ પછી એમણે ફરમાવેલા શાસનનો જે અગાધ પ્રભાવ અને રહસ્ય છે, તેના જ પ્રતાપે આ સમુદ્રદંતને પણ વિચિત્ર પ્રસંગ ઉપસ્થિત થતાં યોગ્ય અને વૈરાગ્યભરી વિચારણા જ સૂર્જે છે !

સમુદ્રદંતની યોગ્ય વિચારણા :-

“આ પત્નીને કે જે જીનધર્મના મર્મને પિછાણારી છે, તેણે કુળવિરુદ્ધ આચર્યું ? આહા ! આવા આત્મામાં આવું બને, તો દુનિયામાં બીજે તો શું ય ન બને ? તો મારે આ દુન્યવી સંબંધ જ ન જોઈએ !...” સમુદ્રદંતના આત્મા ઉપર રોષ-તોષ-મોહના વર્ચસ્વને બદલે કેવી સુંદર શ્રી અરિહંત પરમાત્મા અને એમના શાસનની છાયા કે આટલી મહાન સાત્ત્વિક વિચારણા કરી શકે છે.

અરિહંતનો અનુપમ પ્રભાવ :

અલબત્ત આમાં પોતાની યોગ્યતા અને પુરુષાર્થ તો છે જ; પરંતુ સાથે એ પણ મહત્ત્વનું છે કે પરમાત્માનું જીવન જો લોકોત્તર ન હોત, એમની સાધના જો ભવ્ય અતિભવ્ય કોટિની ન હોત, અને એમનું શાસન અનુપમ વાતોને દર્શાવનારું ન હોત, તો ક્યાંથી આ બનત ? માટે એ અરિહંતની સતત રટણા આપણા જીવનમાં જોઈએ. રટણામાં શું જોઈએ ? આ :- અરિહંતનો પ્રભાવ કેવો અચિત્ય ! અરિહંતની શક્તિઓ કેવી કેવી અગાધ ! અરિહંતના અનુપમ ઉપકાર કયા ? અરિહંતના કેવા કેવા ગુણ ! અરિહંતનું સ્વરૂપ શું ? અરિહંતનું જન્મ જન્માન્તરનું જીવન કેવું કેવું ? અરિહંતની ઉપાસના કોણો કોણો કરી ? અરિહંતની ઉપાસનાથી લાભ કેટલા ? વગેરે આવું ધણું ધણું વારંવાર ચિંતવી શકાય. કેટલો સમય આ રટણા રાખવાની ? ચોવીસે કલાક ! માત્ર એક અરિહંતનો પ્રભાવ વિચારીએ તો ય હેઠું સ્તંભિત થઈ જાય એમ છે. એમનો પ્રભાવ અને શક્તિ એટલે દેવલોકમાંથી ચ્યાવીને માતાના ગર્ભમાં આવે ત્યાં ઈન્દ્રના સિંહાસન ડેલવા

માંડે ! એ સિંહાસન એવું કે કરોડો દેવતાઓ કે કરોડો માનવો ચળાવવા મથે પણ ચલાયમાન ન થાય ! તેને ય ચલાયમાન કોણ કરે ? અરિહંતનો પ્રભાવ ! માનવીના ગુમાન નકામા છે. શ્રી વીતરાગ પ્રભુના શાસનની અદ્ભુત આરાધનાનું પુણ્ય અંગિત્ય પ્રભાવ પાડે છે ! એવી આરાધનાનો પુરુષાર્થ કરી તીર્થકર બનાય છે. દેવલોકમાં બેઠેલો ઈન્દ્ર, રંગરાગ અને ગીતગાન જ્યાં ભરપૂર ચાલી રહ્યા હોય, નિરાંતે ઈન્દ્ર બેઠો હોય, ત્યાં પ્રભુ ચ્યાવે કે સિંહાસન ડગી ઉંડે ! “અરે, આ શુથ્યું ? કોણ દુશ્મન પાક્યો ?...” પણ ઉપયોગ મૂકૃતાં મર્મ પામી જાય, અને જરૂરી નમન-સ્તવન કરે છે.

અરિહંતનો શું પ્રભાવ છે ? :

જગતની માતાઓની કુશીમાં જેવા મલીન પદાર્થો હોય, તેવા જ પ્રભુની માતાની કુશીમાં હોય, જેવો આહાર બીજુ માતાઓ લે, તેવો જ આહાર આ માતા લે, તેમાંથી તીર્થકરનું શરીર ઘડાય, પણ એમાં લાલ લોહીનું ટીપું પણ ન હોય ! બીભત્સ માંસનો કણ પણ ન હોય ! જિંદગીભર શરીર પર રોગ કે પરસેવો થવાનો નહિ. ઉપરની ચામીનો વર્ણ, સૌંદર્ય, અને લાવણ્ય અજોડ કોટિનું. આ કોનો પ્રભાવ ? અરિહંતનો. ગર્ભમાં ભગવાન વધે, પણ માતાનું પેટ વિકૃત ન બને. જન્મ્યા પછી માતાને સ્તનપાન કરાવવાની જરૂર નહિ, આહાર-નિહાર કરે તે ચર્મચ્યક્ષુવાળાને દેખાય નહિ, દેવતાઓ ધન-ધાર્યતા ઢગલા કરી દે ! હીરામાણેકને પગમાં અથડાતા કરી દે ! આ કોનો પ્રભાવ ? તીર્થકરદેવનો ! જે પ્રભુને મોટી મોટી હજારો દેવોની માલિક સમૃદ્ધ દિક્કુમારીઓ પગે લાગીને પુણ્યભાવે વિલેપનાદિ કરે ! ઈન્દ્રો જેવા મોટા કળશોથી સ્નાન કરાવે ? આ બધું છતાં પરમાત્માને મન એની સ્વાત્માની દાણિએ ફૂટી કોડીનીય કિમત ન હોય ! રંગ માત્ર પણ ગર્વ કે ઉત્કર્ષ ન હોય ! કોઈ કંકોત્તી કે કહેણ નથી મોકલ્યાં, છતાં ઈન્દ્રો ને દેવતાઓ દોડી દોડીને આવી પ્રભુની સેવા કરે !

આવા અરિહંત પરમાત્માની રટણા કરતાં કરતાં જીવન પૂરું થઈ જાય અને બીજું કંઈ ન આવડે તો પણ લંક લાગી જાય ! પરમાત્માના પ્રભાવની સાથે એમના ગુણો વિચારીએ તો ય પાર ન આવે, ને અનંત મંગળ આપણા આત્મધરે ઊતરી પડે ! ઉપકારની વિચારણાનો અંત જ પામી શકાય એવો નથી. એમણે જગતને એક નમસ્કાર મંત્ર શીખવ્યો, તો એ કેવો ઉપકાર ? કે જે નવકારથી સાપ મરીને ધરણોન્દ્ર ! ભીલ-ભીલડી મરીને રાજા-રાણી ! સમડી મરીને રાજકુમારી ! આહા ! પરમાત્માના અનંતા ઉપકારનું તો પૂછવું જ શું ! માર્ગાનુસારિતાના નીચી કોટીના માર્ગથી માંડી મોટા ઉગ્ર કોટિની સંયમજીવન સુધીની સાધનાઓ પરમાત્માએ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૨૮૭

બતાવી ! નવકારમંત્રથી માંડી મોટા આગમ ગ્રંથો સુધીનું જ્ઞાન આપ્યું ! ‘સંસાર અસાર છે’ એ સામાન્ય વિચારણાથી માંડીને ઊંડા તત્ત્વોની વિચારણાઓ આપી દીધી ! અલોકિક શુક્લ-ધ્યાનના હિસાબ દેખાડી દીધાં ! જીવનભર થઈ શકે એવી સંવર-નિર્જરામાર્ગની સાધનાઓ બતાવી ! આ ઉપકાર ગણ્યા ગણાય એમ નથી.

મગજ એની માલદાર વિચારણાથી ભરી રાખજો, જગતના ભૂસાથી ન ભરી દેતા.

સમુદ્રદાટને નોકરે જૂં ભરાવી દીધું ! તેના પર શાંખો શ્રેષ્ઠપુત્ર નોકર મંગળિયાને કહે છે “જો ભાઈ, હવે તો મેં આ વિચાર કર્યો છે, કે ધેર ન આવું. અને સીધો ગુરુ મહારાજ પાસે જઈ ચારિત્ર લઉં. તું ધેર જઈને પિતાજીને કહે જે કે ભાઈ તો ગયા...”

સમુદ્રદાટની સીધી વાત પર દુષ્ટ મંગળિયો વિચારે છે ‘હા ! સમજ્યો, મને એકલો રવાના કરી, એને પેલો મલીદો લઈ જવો છે ! પણ હું ક્યાં કમ હું !...’ સમુદ્રદાટને કહે છે “ભાઈ, કેટલું ખરાબ થઈ ગયું ! પણ હવે તમને એકલા ન મૂકાય. મને બાપુજીએ સાથે મોકલ્યો છે, તો હું પણ ગુરુ મહારાજ નહિ મને ત્યાં સુધી સાથે જ રહીશ. પછી ભલે તમે મને મોકલી દેજો.” બહાર આમ બોલતો મંગળિયો અંદરખાને ગોઠવે છે કે “બંદા, યાદ રાખ, કે હું તારી પાછળ જ હું ! અવસર જ આવવો જોઈએ ! તું પરલોકે પહોંચે કે હું પેલો માલ હજમ કરી જાઉ !” મંગળિયાનું મન કાળું મેશ જેવું છતાં એની ભક્તિભરી વાણી સાંભળી, સમુદ્રદાટ તેને આશાસન આપે છે કે “ભાઈ, સંસાર જ એવો છે !... તારે હવે મારી પાછળ બેંચાવાની શી જરૂર છે ? છતાં પણ તારું દિલ જો દુઃખાય છે, તો ભલે તું સાથે રહેજે. આપણે કોઈ સાધુ મહારાજને પૂછીશું કે ભગવાન અનંગદેવ ગુરુ મહારાજ ક્યાં છે.” સમુદ્રદાટને હવે બીજી પત્તી પણ નથી કરવી. હવે તો મોકાર્થે ગુરુચરણે રહેવું છે.

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

વર્ષ-૪, અંક-૩૧, તા. ૨૮-૪-૧૯૫૬

સંસાર એટલે શું ? માલ ખાવાની વાત પોકળ. પણ દુર્ગતિમાં માર ખાવાનો નક્કી ! મોકા એટલે શું ? માર ખાવાની વાત નહિ, માલ ખાવાનો નક્કી ! તમારે શું જોઈએ છે ? જ્યાં માલની નક્કર વાત છે ને મારની પોકળ વાત છે તે ખ્યે ? પૂછો અંતરાત્માને. માલ કરતાં આત્મરક્ષણ ભૂલશો નહિ. આજની પ્રજાને એ શિખવવામાં આવે તો ઘણા કલેશ અને ઘણા દુર્ગુણો તથા દુષ્કૃત્યો અટકી જાય.

૨૮૮ ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા” (ભાગ-૨૨)

પણ આત્મરક્ષણ કોણ શિખવે ? જડવાઈ યુગ તો જ્ઞાનની અને ધર્મની વાત કરે તેમાં પુષ્ય-પાપ, પરલોક, સંસારપરિચછ, દુર્ગતિના ત્રાસ વગેરે મુદ્દાને સ્પર્શીય નહિ ! જો એ ભયો આંખ સામે ન તરવરે તો પછી જીવ શા માટે લક્ષ્મી આદિને બદલે ગુણો અને સત્કૃત્યોને મુખ્યતા આપે ? એ તો જડવાઈ દુનિયામાં દેખે છે કે માન પૈસાને છે, એમાંનું દસમા ભાગેય ગુણને નથી.

મંગળ છરી મારે છે :-

મંગળ એથી જ વિશ્વાસપાલનનું સુકૃત્ય છોડી પૈસાને મુખ્ય કરી એ લેવા માટે સમુદ્રદાનને ઠેઠ મારી નાખવાના વિચાર સુધી પહોંચી ગયો છે ! હાય પૈસા ! આજ તો આવું ભરપૂર બની રહ્યું છે ! સમુદ્રદાન મંગળિયા સાથે હવે ગુરુ મહારાજની પાસે જવા ચાલ્યો. આગળ સમુદ્રદાન અને પાછળ મંગળિયો. વચ્ચે અતિ વિષમ અરાયમાં લાગ મળતાં મંગળિયે વિશ્વસ્ત હૃદયવાળા સમુદ્રદાનની પીઠમાં છરી મારી ! પણ એટલામાં ત્યાં કુદરતી અનંગદેવ મહર્ષિ અનેક સાધુના પરિવાર સાથે આવી રહ્યા છે. તેમાં આગળના સાધુઓએ સમુદ્રદાનને જોયો. એ પુષ્યશાળી એવો કે અને છરી મર્મ સ્થાને ન વાગી, એટલે મૃત્યુ પામે એવું નથી. પણ લોહી નીકળ્યું છે. મનને થયું કે શું ચોર આવ્યા ? એ પાછું વળાને જુએ છે તો નોકર ભયનો માર્યો દોડી રહ્યો દેખાય છે; ને ચોર બીજા દેખાતા નથી તો આ કેમ દોડ્યો ? દોડવાનું શું કારણ ? અને ગભરાવાનું કોઈ કારણ નથી. છરી લોહીથી રંગાયેલી પડી છે. છરી હાથમાં લીધી તો ઓળખાઈ ગઈ. વિચાર કરે છે કે “આમ કરવાનું અને શું કારણ ? કારણ તો કોઈ દેખાતું નથી. તો લાવ અને જ પૂછું.” એટલે સમુદ્રદાન બૂમ પાડે છે, “અલ્યા મંગળ, તું ગભરાઈશ નહિ, આમ આવ.” પણ જ્યાં મંગળિયે સમુદ્રદાની બૂમ સાંભળી, કે એ તો વધારે જોરથી દોડવા લાગ્યો ! આ જોઈને સમુદ્રદાન વિચારે છે કે “આમાં કંઈક ગોટાળો છે ! જરૂર દાણમાં કાળું છે !” આગળ વિચાર કરતાં અને સમજાયું કે “હા ! રસ્તામાં જે નિધાન જોયું હતું, તે જોઈને અનું ચિંત ચલિત થયું લાગે છે ! લક્ષ્મીના ફંદામાં ફસાયેલો, અને નોકરની જાત ! જરૂર એ વહેમાયો લાગે છે કે ‘આ નિધાન શેઠ લઈ જશે, માટે આ જંગલના એકાંતમાં શેઠને જ ખતમ કરો !’ પણ, મારે ક્યાં જોઈતું હતું ? મારે તો સંસાર જ જોઈતો નથી, ત્યાં લક્ષ્મીને મારે શું કરવી હતી ! પણ,

લોભથી સર્વ ગુણ નાશ :-

“શાસ્ત્રે બરાબર કંધું છે કે લોભને પરવશ પડેલો જીવ શું નથી કરતો ? લોભની પરવશતામાં આત્માને કશું અકરાણીય રહેતું નથી,” આ વિશ્વબ્યાપી સત્ય ભુવનભાનુ અન્સાઈકલોપીયિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

છે. ‘સર્વગુણવિનાશકો લોભઃ ।’ લોભ એ સર્વ ગુણોનો વિનાશક છે. લોભથી સુકૃતનો નાશ થાય છે. અને લોભથી દુષ્કૃત્યો કરવામાં કંઈ કમીના નથી રહેતી. મભમણ શેઠને પૂર્વ ભવમાં મુનિને લાડવો વહોરાવ્યા પછી પાછળથી એ લાડુનો લોભ જાગ્યો, એમાં એણે કરેલા દાન સુકૃતનો એવો નાશ કર્યો અને એટલું ઘોર શોક-દુષ્કૃત્ય કર્યું કે એ પછીથી મભમણ થઈને સાતમી નરકે ગયો. પરસ્ત્રીના લોભમાં મુનિઅરણિક-નાંદિષેણ વગેરેએ સંયમ જેવા મહાન સુકૃત પણ પળવારમાં તોરી નાખ્યા ને ? નિયાશું કરનારા પણ વિષયસુખના લોભમાં સંયમને બાળી જડાંદ્રિ ખરીદીને શો સાર કાઢે છે ? નરકમાં જવાનો ને ? ઉહાપણથી જો મનુષ્ય વિચારે કે “હું આ લોભ કરું છું, તે શા માટે ? એનાથી હું જે ધારું છું, તેનું પરિશામ કેવું ? અને કેટલું આવવાનું ?” અનેક જંખનાઓ સેવતાં આત્માએ વિચારાનું જોઈએ કે ‘આ કંધી ચીજની જંખના ? ચીજ કેટલો કાળ રહેવાની અને મને શું સુખ આપી દેવાની ?’ આ જોવા જાય તો દેખાય કે માણસની બધી જંખનાઓ બેકાર છે. પૈસા નથી, જંખના કરી, મળી ગયા, તેથી શું વિશેષ ? પૈસા આવ્યા તો નવો કલેશ ઊભો થવાનો. પૈસા ન હોય ત્યારે બધાની સાથે હળતો-મળતો રહેતો હતો, હવે ? પૈસાની ગરમીથી બીજાઓ પર ઉકળાટ થશે; નફરત થશે ! ધમંડ આવશે ! ‘પૈસા આવ્યા એટલે એનું રક્ષણ કરો. ભોળા ન થાઓ !’ એવી અનેક જાતની ચિંતાઓથી મન ભરાઈ જાય છે, એ સમજી રાખો કે જગતમાં કોઈ પણ વસ્તુનો લોભ કર્યા પછી માણસના દિલમાં શાંતિ નહિ પણ ઉકળાટ વધી જાય છે. વસ્તુસ્થિતિનો વિચાર કરતાં જણાય કે લોભ ખાતર કેટકેટલી કલુષિતતા અને મલિનતા આપણે વહોરીએ છીએ ! પુષ્ય ગુમાવી પાપના સંગ્રહી બનીએ છીએ ! અકાર્યનો કેટલો હિસાબ રહેતો નથી ! જૂઠ-વગેરે પાપોનો પણ હિસાબ નહિ ! માટે એ ચોક્કસ માનજો કે લોભ જ્યાં સુધી છે, ત્યાં સુધી ઉદ્ધાર નહિ થાય. અને તો એ લોભ કાઢવા માટે મન પર કડકાઈ જોઈએ કે “મારે આટલું જ જોઈએ. એનાથી વધુ નહિ.”

જિનમતિ અંગે પણ વાત બનાવટી :-

આ નોકર નિધાનના લોભમાં પડ્યો. સમુદ્રદાનને તો સંસાર આખો છોડવો છે ! તો એને છરી કેમ લગાવી ગયો નોકર ? લોભથી ! એટલું જ નહિ પણ સમુદ્રદાન વિચારે છે કે “તો પછી એણે મને જિનમતિની જે વાત કરી તે પણ બનાવટી ! એ વાત સાચી ન હોય. નિધાનના લોભના અનુસંધાનમાં એ પણ અના મનનો તુક્કો જ ! કેમકે જિન વચનથી રંગાયેલી એ જીવ જાય પણ શીલ ન ચૂકે. તેમ એનું કુળ પણ એવું ઉત્તમ છે, કે એમાં જન્મ પામીને જિનવચનનો ૨૮૦ ભુવનભાનુ અન્સાઈકલોપીયિયા-“વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા” (ભાગ-૨૨)

સાર ગ્રહ્ય પછી એ ઉભય લોક વિરુદ્ધ કાર્ય ન જ કરે.”

ચાલાકીનો ઉપયોગ કર્યો ? :

એમ તો સમુદ્રદાત ચાલાક છે એટલે સમજતાં વાર નથી લાગતી. ધર્માત્મા ભોઈ થોડા હોય છે ? હા, અવળા વિચાર કરવાનું અને નથી આવડતું, એને નથી પાલવતું. તેથી મનની ચાલાકીનો ઉપયોગ બીજાના દોષ ખોજવામાં નહિ કરે, બીજાને ઠગવામાં નહિ કરે; જ્યાં ત્યાં વહેમાવામાં નહિ કરે. કશ્તીય બચ્ચાની તલવારનો ઉપયોગ હલકા-નબળા પ્રાણીઓની કટલમાં નથી થતો. તેમ ધર્માત્માની બુદ્ધિનો ઉપયોગ હલકા હલકા વિચારોમાં અને બીજાઓ ઉપર વર્યસ્વ જમાવ્યે જવામાં નથી થતો. છતાં જ્યારે ખાસ તેવો પ્રસંગ બની જાય ત્યારે એ મૂઢ ન હોવાના કારણે વસ્તુસ્થિતિ પરખી જાય છે, એ પરખ્યા પછી દુષ્ટતા કરનાર સાથે શો વ્યવહાર રાખવો, અના માટે કેવા વિચારો ઘડવા, એમાં સાવધાનીથી કામ લે છે. એ સ્થિતિમાંય પોતે પોતાના દિલમાં ક્ષુદ્રતાને તો સ્થાન નથી જ આપતો; પોતે દુષ્ટ વિચાર નથી જ કરતો.

જંગલમાં મંગલ ! :-

તો અહીં સમુદ્રદાત પણ એટલું જ વિચારે છે કે ‘ત્યારે જિનમતિ અંગે પણ આણે મને જૂઠ ભળાવ્યું લાગે છે...’ આ વિચાર કરે છે એટલામાં સદ્ગ્રાહ્યે ત્યાંથી સાધુઓ વિદાર કરતાં જતાં હતા; એમણે આને ઓળખ્યો. ‘અહો ! આ તો સમુદ્રદાત શ્રાવક ! અહીં ક્યાંથી ?’ સમુદ્રદાતને તો જંગલમાં મંગલ થયું ! એણે એમને વંદના કરી, વાગેલું પરી રહ્યું; મુનિઓ પ્રત્યેનો વિનય પહેલો સાચવ્યો ! બીજા પ્રાણીઓ કરતાં આપણે ઊંચે આવ્યા છીએ એ સમજવાનું આવા ગુણોમાંથી મળે છે. તેમ ઊંચે જવા માટે પણ રસ્તો આ છે, કે દુન્યવી કષ્ટ-આપદાઓ અવસરે અવસરે બાજુએ મૂક્યાય અને ઉચિત કરણી, ધર્મકરણી, ગુણાની કરણી જરાય ન જ ચુક્યા. વિવેક દીવો પ્રગટ્યા પછી કંઈ કઠીન નથી. સમુદ્રદાત ધર્મ પામીને સારો વિવેકી બન્યો છે. જંગલમાં અક્સમાત બનવા છતાં આકૂલવ્યાકૂલ થતો નથી અને સાધુ મળતાં વેંત રોદણાં રોવા બેસતો નથી. વિચારવા જેવું છે કે તમે મુસાફરી કરતા હો એમાં કોક સ્ટેશને ઊતર્યા અને ત્યાં પેટી ગૂમ થઈ. સ્ટેશન બહાર નીકળ્યા એટલામાં સાધુ મળે તો હંઙળા-ફંઙળા થઈ ‘સાહેબ ! પેટી ગઈ ! આ ચોહાખાનું...’ આવું કંક રોવા માંડો કે નહિ ? સમુદ્રદાતને માથે કેવી આફત આવી છે એ જુઓ છો ને ? છતાં શાંતપણે મુનિને જોતાં સ્વસ્થ ચિત્તે વંદના કરે છે.

મુનિ ધર્મલાભની આશિષ આપી પૂછે છે, “મહાભાગ ! અહીં ક્યાંથી ? આ શું ?”

ઉત્તરમાં સમુદ્રદાત ઘેરથી કેમ નીકળ્યો, અને રસ્તામાં અહીં સુધી શું શું બન્યું, એ કહે છે.

વાત ગંભીરને અને અનર્થવારકને જ કહેવાય :-

સાધુઓ ગંભીર હોય છે, અને અનર્થને રોકનારા હોય છે. તેથી એમને સમુદ્રદાતે પોતાની બનેલી વિગત કહી. બાકી જેને તેને, એ ન કહે. વાત પણ સાચી; આપણી ગમે તેવી ખરાબ પરિસ્થિતિ બની હોય, પરંતુ જે સામાન્ય જનો એ જાણ્યા પછી કશું સારું નીપજાવી શકતા ન હોય, પણ ઊલદું એના પર કષાયવૃદ્ધિ કરાવતા હોય, તેમજ બહાર એનો પ્રચાર કરી વધારે હલકી પરિસ્થિતિ સર્જે એવા હોય, એને જણાવવાથી શો લાભ ? એમ કંઈ જ્યાં ત્યાં અને જેને તેને જણાવ્યાથી આપણું દુઃખ થોડું જ મીટવાનું હોય છે ? થયેલું નુકશાન થોડું જ સુધરવાનું હોય છે ? માત્ર એક દિલનો ઊભરો ઠાલવવાની વાત છે. એવું સુઝ માણસ કેમ કરે ? એ તો મનમાં જ સમજ રાખે. બહાર તો ગંભીરતા જાણે કંઈ બન્યું જ નથી. માત્ર કોઈ સુયોગ મળે, ને ત્યાં કહ્યું હોય તો આશાસન-સમાધિ મળે, સારા ઉપાય જાણવા મળે. સમુદ્રદાતે સાધુઓને નોકરનો વૃત્તાન્ત કહ્યો તો ધીર અને ગંભીર એવા સાધુઓએ જુઓ કે એને કેવું આશાસન આપ્યું !

સાધુઓનું આશાસન ! :-

“જો ભાઈ કર્મની જોહુકમી અને મોહની શિખવણીમાં એવું બને એમાં નવાઈ નથી. તને તારા કર્મ આ દુઃખ આવ્યું, અને એના લોભે એને આ દુષ્ટત્ય કરાવ્યું ! ભગવાન જિનેશ્વરદેવો કહે છે કે આમ તો આ આત્મા સ્વરૂપે સર્વગુણસંપન્ન છતાં મોહનો ચઢાવ્યો ચઢે છે ! મોહની મહિરા પી છાકટો બને છે, ઘેલો બને છે ! એમાં દુષ્ટત્યો આચરે નહિ તો બીજું શું કરે ? આપણે પણ પૂર્વના કાળમાં એવું ધાણું કર્યું છે ! એ ઘેલછામાં જાતે જ પાપકર્મ વહોર્યા છે ! પછી એ કર્મ કૂર રીતે પીડે એ સહજ છે. તું તો અહોભાગ્ય માન, કે કોઈ ધર્મ સાધવાનો તારો ઉદ્યકાળ ઊભો હશે તે આટલેથી જ કામ પત્યું. આપણે જો જીવતા જીવે શ્રી જિનેશ્વરદેવ અને એમના શાસનની નિકટમાં બેઠા છીએ તો શી ફિકર છે ? કર્મ તો ભલભલાનેય ભોગવવા જ પડે છે. પણ એથી તો આત્મા ચોક્ખો થતો જાય છે ! બાકી સંસાર તો આવા અનર્થોથી ભરચક ભર્યો છે. એમાં ધર્મ સાધી લેવો એજ ડાપણનું કાર્ય છે...”

સાધુઓએ આવું કોક આશાસન આપ્યું. એટલામાં ગુરુમહારાજ અનંગદેવે આને જોયો. ત્યાં એમને સમુદ્રદાતે વંદના કરી; ગુરુજીએ ધર્મલાભ શર્દીથી અનું અભિનંદન કર્યું. અને સમાચાર પૂછ્યા;

“અહીં ક્યાંથી ? એકલો કેમ ? ધર્મપ્રવૃત્તિ શી ચાલે છે ? વ્રતોનું પાલન કેમ છે ?”

અસમાધિ-હુદ્ધાર્ણની આફત સૌથી મોટી :-

સમુદ્રદાટ એમને પણ વિનયથી બધી હકીકત કહી, જો કે પોતે તત્ત્વપરિણાતિથી રંગાયેલો છે, છતાં સંસારી ગૃહસ્થ છે, સંયોગવશ દુધ્ધાર્ણ અને અસમાધિમાં ન પડી જાય એટલા માટે ગુરુએ તાત્ત્વિક આશાસન આયું. ગુરુઓ કલ્યાણમિત્ર હોય છે. કલ્યાણમિત્રો દુધ્ધાર્ણ-અસમાધિથી બચાવવા ખાસ ઉદ્ઘાત કરે છે. કેમકે જીવને મોટામાં મોઢું નુકશાન દુધ્ધાર્ણ અને અસમાધિથી છે; મોટામાં મોટી આફત એ છે. મોત પણ આફત નથી જો ચિત્ત શુભ ધ્યાન અને સમાધિમાં હોય તો. ત્યારે મૃત્યુથી વધીને બીજી કઈ દુન્યવી આફત ગણાય ? અને કદાચ કોઈ ગણે તોય, ત્યાં જો દુધ્ધાર્ણની બચાય, અસમાધિ રોકાય, તો જીવનું મહાન રક્ષણ થવાનું. બાકી તો આફત હોય નાની, પણ મૂરખ જીવણો અસમાધિ અને દુધ્ધાર્ણની મોટી આફત વહોરે છે ! એ મોટી આફત એટલા માટે કે પહેલું તો અહીં જ જીવને વધારે વિહુવળ, અધીરો, કાયર અને અવિચારી બનાવે છે. તેથી કેટલીક વાર પેલી આફત સુધરવા જેવું હોય, પણ ઊલટું બગાડી નાખે ! દા.ત. કોઈ સારા માણસ સાથે અણબનાવ થયો. ત્યાં આપણો સમાધિ જાળવીએ, દુધ્ધાર્ણ ન કરીએ તો જતે દહે અણબનાવ મટીય જાય. નહિતર વિહુવળ થવાથી અને અવિચારી થવાથી તો પેલાની નિંદા કરવાનું મન થાય, વધુ અણગમો બતાવાય, એમ કરતાં અણબનાવ ઊલટો વધે ! એથી અવસરે એની સહાય ન મળે. આ તો અહીંનું એક નુકશાન ! બીજી પણ અહીં નુકશાન નીપજે છે. બાકી પરલોક માટે તો વૈરની ગાંઠો ! કાળાં નિકાચિત કર્મના બંધ ! દુર્ગતિની તૈયારી ! એમાં ફસાયા પછી દીર્ઘ કાળ ભવભ્રમણ ! દુધ્ધાર્ણ અને અસમાધિના ફળ બહુ કડવાં ! તેથી જ એના જેવી આફત બીજી નહિ. ત્યારે એ પણ છે કે બીજું આફત ટાળવાનું આપણા હાથમાં નથી; અને આ અસમાધિ-હુદ્ધાર્ણની આફત ટાળવાનું આપણા હાથમાં છે. તો હાથની વસ્તુને, શક્યને છોડી અશક્યમાં કોણ મથે ?

મનનો વેપાર સસ્તો છતાં ઊંચો :-

ગુરુમહારાજે સમુદ્રદાટને અસમાધિ ન રહે એ માટે ધર્મ-આશાસન આયું. આશાસન બે પ્રકારના; પાપઆશાસન અને ધર્મનું આશાસન. પાપઆશાસનમાં ઘડીભર કદાચ મન શાંત પડે; પણ ઉપાયો પાપના સૂચયા હોય; તેથી જીવ ખરાબમાંથી વધુ ખરાબ થાય. ધર્મઆશાસનમાં પૂર્વે કહું તેમ અસમાધિ અને દુધ્ધાર્ણ ટાળવાના સુયોગ્ય સૂચનો હોય તેથી જીવને સાચો રાહ સૂઝે. એવું આશાસન ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદેવિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

સમુદ્રદાટને મળ્યું. પછી તો એ સાધુ મહારાજોના સમુદ્રાયની સાથે ચાલ્યો. ખૂબી એ છે કે મંગળિયા માટે કોઈ દુષ્પ વિચારણા કે ઘોર કષાયની વિચારણા એ કરતો નથી. શી જરૂર ભાઈ ? નાહક હવે મન શા માટે બગાડવું ? બનવાનું બની ગયું. મન તો મોટમોટા ધર્મવ્યાપાર કરવા માટે મળ્યું છે. જે ઊંચા શ્રેષ્ઠ વેપાર અવસરે તન અને ધનથી નથી થઈ શકતા, તે મનથી થઈ શકે છે. ખબર છે ને આ ? કેવળજ્ઞાન આપાવનારી ક્ષપકશ્રેષ્ઠી એ મનથી થતો વેપાર છે. લક્ષ્મી-કાયાથી વેપાર પરિમિત સમય માટે થશે, મનથી ચોવીસેય કલાક ! માત્ર શુભ ઉપયોગમાં, શુભ ભાવનામાં એને કામ કરતું રાખવું જોઈએ. એમાં ખર્ચ કાંઈ નહિ, મહેનત કાંઈ નહિ, અને લાભ અપરંપાર ! માટે જ મનને કદીય સુસ્ત ન રાખો, શુભ વિચારોમાં ઉદ્ઘમી રાખો.

મોહની ચઢવણી :

મંગળે ખરું તો મનનું જેર વધાર્યું છે. પણ સાધુ આશાસનમાં કહે છે, ‘આમ મંગળ દુષ્કાર્ય કરે છે તેમાં મુખ્ય કારણ મોહન્યોછો એના આત્મામાં ઘૂસ્યો છે તે છે. મોહ ઠગારો જીવને ઊંધું ઊંધું શિખવે છે. મનુષ્ય પોતે સજજન હોવા છતાં જો દુર્જન એના પડ્યે ચઢી ગયો તો એને એ દુર્જન એવી દોરવણી કરશે કે જેના યોગે એ આખો પલટાઈ જવાનો. તેવી રીતે આ આધ્યાત્મિક ઘટના છે કે નોકરનો જીવ તો ઉત્તમ, પણ પેલો મોહ ચોછો અંદર પેસીને ધમાલ મચાવી ગયો ! વિચારજો, તમે જે કંઈ કરો છો તે અંતરના અવાજથી કરો છો કે કોઈની ચઢવણીથી ? દા.ત. આજે કોઈ પર્વનો દિવસ છે, તિથિ છે મોટી. સવારમાં ઉઠ્યા, ને તપને બદલે ખાવાનું મન થયું, તો એ અંતરાત્માનો અવાજ છે ? કે કોઈની ચઢવણી છે ? અગિયાર વાગ્યા ને વિચાર આવ્યો “બજારમાં જાઉં, ને ઠીક ઠીક પૈસા લઈ આવું.” આ કોઈની ચઢવણી છે કે અંતરાત્માનો અવાજ છે ? આમ ખબર નહિ પડે કે કોઈ ચઢાવી રહ્યું છે; ઉશ્કેરી રહ્યું છે. આપણો જ વિચાર છે એવું લાગશે. પણ ખરી રીતે બીજાની શિખવણી છે. સવારમાં ઊઠીને પર્વના દિવસે “ખાઉ” આ જીલ્ડીએ શિખવાઝ્યું ! શરીરે શિખવાઝ્યું ! પૈસા ખૂબ ખરચવા છે અગર સંધરવા છે માટે બધું મૂકીને પૈસા ભેગા કરો. આ અંતરાત્માનો અવાજ નથી, પણ “આપણે દુનિયામાં બેઠા છીએ, પૈસા હોય તો જ ભાવ પૂછાશે ! તો જ માન-મરતબો ! નહિતર કંઈ નહિ.” આવી આવી મોહની શિખવણીઓ બેઠી છે. અંતરનો શુદ્ધ અવાજ ખેંચી કાઢવા માટે તો ઘડી ભર પોતાના આત્માને જુદો તારવીને દુનિયાથી અળગા થઈ જવું પડે. અળગા એટલે ? “હમણાં મારી આંખ મિચાઈ જાય તો આ ઘર, કુટુંબ, ઈજજત આબરુ બધું મારું ખરું ? ના, તે વખતે

મારું કોણ ?” આવું કંઈક વિચારાય તો અંદરથી જ જવાબ મળે કે “કોઈ મારું નથી.” ને એ દિવસ એવો આવશે કે ‘કાઢો રે કાઢો એને સહુ કહે,...જાણો જન્મ્યો જ નહોતો ! મહું ભારે થઈ જશે...’ આવો દિવસ આવવાનો નક્કી છે, તો મારું કોણ ? અરિહંતાદિ ચારને મારા કર્યા હોય તો તે મારા રહેશે. મારું ? ધર્મની સાધના કરી હશે તો તે મારી છે ! ધર્મ કરી, પુણ્ય ભેગું કર્યું હશે તો એ આગળ જવાબ આપશે. જીવનમાં રસ્તા બે -ધર્મનો અને અધર્મનો. ધર્મથી પુણ્ય; અધર્મથી પાપ. પુણ્ય હોય તો જ સદ્ગતિ સંઘરે. પાપ તો કહે ચાલ દુર્ગતિમાં, ત્યાં શિફારસ ન ચાલે.

લક્ષ્મીથી કુટુંબને જુદું પડાય છે તેમ આત્માને :-

અંતરાત્માનો અવાજ પરખતાં શીખવું જોઈએ અરે ! પહેલાં તો અંતરનો અવાજ કાઢવાનું શીખવા જેવું છે. અંતરનો અવાજ કાઢવાનું તો જ બને કે જો આત્માને શરીર, લક્ષ્મી, કુટુંબ વગેરેથી તદ્દન જુદો પાડી એકલા એના હિતાહિતનો વિચાર કરો. માણસ અવસરે લક્ષ્મીથી કુટુંબને તદ્દન જુદું પાડી વિચાર કરવા બેસી જાય છે. બજારમાં હમણાં કમાઈ ભલે ને આવે એવી હોય, પણ સ્ત્રી માંદી પડી છે એને સંભાળ્યા વિના થોડું જ રહેવાય ? કમાઈ ન આવે તો કંઈ નહિં એમ કરી લક્ષ્મી જતી કરાય છે. ત્યારે કોઈ આગ જેવો પ્રસંગ હોય અને સ્ત્રી કે પુત્ર એવા સપદાયા હોય કે પોતે બચાવી શકે એમ ન હોય તો પોતાના શરીરને ત્યાં તદ્દન જુદું ગણી વિચારે છે, ‘સ્ત્રી બળી જાય એને લાગે છે, પણ એને બચાવવાની મહેનત કરવા જતાં કદાચ આપણેય બળી મર્યાદ તો ? આપણે એક વાર બહાર નીકળી જાઓ, પછી બહાર જઈ ગમે તે પ્રયત્ન એને બચાવી લેવા કરશું’... આમ શરીરને તદ્દન જુદું ગણી એના હિતની વાતમાં સ્ત્રી પાછળ મરાતું નથી. બસ, એવી જ રીતે આત્માને એ બધાથી તદ્દન જુદો પાડી વિચારવાનું છે. કમાઈ લક્ષ્મીની ગમે તેટલી હોય, સ્ત્રી ગમે તેવી ઘારી હોય, પરંતુ આપણા આત્માનું જો વટાઈ જતું હોય તો થોભવાનું. આત્માનું હિત નહિં બગડવા દેવાનું. આવું ક્યારે થાય ? પોતાની ખરી ચીજ પોતાનો સનાતન આત્મા લાગે ત્યારે. ભૂલશો નહિં, એ અનંત અનંત કાળનો દુઃખી છે.

ચક્રવરી-ભમરડી :

ચક્રવરી-ભમરડી ફર્યા પછી માણસ સ્થિર થયેથી સ્થિર એવા પણ જગતને ફરતું જુએ છે. તેમ આ સંસારની ચક્રવરી-ભમરડીમાં જીવ ઉંઘુ જુએ છે. અર્થાતું આત્માને પોતાની જત જોવાને બદલે શરીરને પોતાની જત સમજે છે; ને ખોટાં સુખને સાચાં માને છે ! મગજ પરથી ઘુમરડી ઊતર્યા વિના જેમ પેલો બ્રમ ટળતો

નથી એમ અહીં પણ છેલ્લા પુદ્ગલ પરાવર્ત કાળમાં આવ્યા વિના સુખ બ્રમ ટળતો નથી. તેથી જ હુખના ઉપાયમાં ફસાય છે. છેલ્લા પરાવર્તમાં પણ સદ્ગુરુના સમાગમાદિ કરી એમના ઉપદેશને મન પર લે તો બ્રમ ટળે; ને એમ થાય કે “મારે ખરી ચીજ મારો સનાતન આત્મા. અનું બગાડીને બીજાનું સુધારવાનું નહિં. આત્માનું નિકંદન નીકળે એવો બીજાનો સંગ કરવાનો નહિં.” આમ કંઈક થાય, તો પછી અંતરાત્માનો અવાજ ઉડે !

“દિવ્ય-દર્શન”-“પ્રવચન મહોદ્ધિ”

૧૮૮-૪, અંક-૩૨, તા. ૫-૫-૧૯૫૬

જિનમતિના સાચા ખબર :-

સમુદ્રદટ્ઠને નોકરના ખોટા બોલ પર પણ અંતરનો અવાજ ઉઠ્યો તો ચાલ્યો ગુરુની શોધમાં. એમાં નોકરે છરી મારી, તો વધારે કંઈ અસમાધિ કર્યા વિના સાધુ મહારાજની સાથે ચાલ્યો. થાનેશ્વરમાં આવ્યો, અને છરીના ઘા પર ઉપચાર કરી સારું કર્યું. બીજી બાજુ ત્યાં જિનમતિના સાચા ખબર મલ્યા. શા ? સુશીલતાના ! ‘શું જિનમતિ ! ખરેખર જિનની મતિની જ મૂર્તિ જોઈ લ્યો ! એવી ઊંચી શ્રાવિકાની ચર્ચા ! અંડ શીલવતી !’ ઘણી વાતો સાંભળી, કે આને નક્કી થઈ ગયું કે, “જિનમતિ સંબંધમાં જુદું હંકવામાં અહો ! મંગળની કેવી ઠગબાજી ! કેવી એણે લુચ્યાઈ કરી !”

બે પ્રશ્ન :

ત્યારે હવે એ જોવાનું છે, કે હવે એ શું કરે ? (૧) ધેરથી શા પ્રયોજને નીકળ્યો છે ? પત્નીને તેરી લાવવા. એમાં કદાચ વચ્ચમાં વિધન ઊભું થઈ ગયું, છતાં વસ્તુસ્થિતિએ કશું બગડ્યું નથી; જિનમતિ બરાબર સુશીલ જ છે, પ્રેમાળ જ છે. તો પછી હવે એને લઈને ધેર જવાનું કે નહિં ? પાછું, નોકરની ચાલબાજીથી ખોટી સમજ ઊભી થઈ હતી પણ જિનમતિનો બિચારીનો કશો દોષ નહોતો; તેમ એના કુટુંબીઓનો નહોતો. તો પછી શું એને છેહ દેવો ? તેમ પોતે પણ શું સુયોગ ગૃહસ્થાઈનું સુખ ન જોવું ? ત્યારે બીજો પ્રશ્ન એ છે કે (૨) અનંતકાળ ભટકતાં ભટકતાં જીવને હાથમાં આવેલા સદ્ગુરુ અને તાત્ત્વિકમાર્ગ એની જે કિમત જો આંકી તો હવે સ્ત્રીના મોહમાં પાઈ મારી પણ ઓછી કરવી ? પત્ની અંગેના ખોટા સમાચારથી પણ ગુરુ મહારાજ પર અને તાત્ત્વિક માર્ગ પર આકર્ષણ વધી ગયું તે પાછું ઘટાડવું ?

વાસના અને ધર્મરંગના પ્રભાવ :-

બે ય પ્રશ્ન વિચારણા માગે છે ને ? અમ ટળી ગયા પછી સહેજે થાય કે ‘ચાલો અમણા ટળી. એટલે જ આપણું છે તે બરાબર છે. સારું શ્રાવકજીવન પાળણું અને સંસારસુખની ભગ્ના પણ લેણું...વસ્તુ ક્યાં બગડી ગઈ હતી ? ફોગટ મેં ઠેઠ સુધીના વિચાર કરી નાખ્યા ! આપણું માણસ કાંઈ સાચેસાચ બગડી ગયું નહોતું ! તો હવે એને તરછોડાય પણ કેમ ?’ અનાદિ સંસારની વાસનાનો પ્રભાવ આમ સહેજે ઘરવાસમાં તાણી જાય. ત્યારે ધર્મરંગનો પ્રતાપ એ દેખાડે છે કે ‘ભલેને હમણાં કદાચ ભ્રમણાં થઈ આવી, પણ છેવટે પરિણામ શું ? જીવનનો શો ભરોસો ? પરલોકમાં આધાર કોનો ? અહીં ગમે તેવા સારાં પણ સગાં ભવાંતરમાં શી ઓથ આપવા આવે ! એ તો મહારૂલ્ભ દેવગુરુનો યોગ અને ધર્મની તક મળી છે તે જ આપણા ભવિષ્યના અનંતકાળને સુખના પ્રકાશવાળો કરી શકે. એટલે જ હવે જે જીવનની વિચારસરણી બદલી તે ધારાએ કામ કરવાનું. બન્યું તે બન્યું. એમ પણ માર્ગ સારો લાધ્યો છે ને ? કરેલો વિચાર ખોટો નથી; પછી ભલે નિભિત સાચું નથી. છતાં જે સંસારની વસ્તુએ નોકરનું મન બગાડ્યું, તે સમસ્ત સંસાર એવો જ છે, વિશ્વાસ કરવા લાયક નથી. બસ એક સદ્ગુરુનું જ સાચું શરણ છે; અને એ શરણ આ જ ભવમાં મળે ! માટે એ કાર્ય તો આ જીવનમાં જ થઈ શકે. બીજા કાર્ય તો જીવે અનંતકાળમાં ક્યાં ઓછાં કર્યા છે ? જે કંઈ નથી કર્યું, તે સદ્ગુરુને શરણે જઈ પોતાના આત્માનું સમર્પણ કરવાનું જીવે બનાવ્યું નથી. શું જીવ શેઠ શાહુકાર નહિ બન્યો હોય ? બાપ-મા-ભાઈ-બહેન નહિ બન્યો હોય ? અરે, હજારો રાણીઓનો રાજા પણ બન્યો હશે ! હજારો છોકરાઓનો પિતા પણ બન્યો હશે, પણ એનું મૂલ્ય શું ઉપજયું ? રખડપણી. હવે એ કરવામાં નવાઈ નથી. નવાઈ તો આ છે ગુરને સમર્પણની.”

સમુદ્રદંત શું કરે છે ? :

સમુદ્રદાટનું ભાવી ઉજ્જવળ છે. મહાન પુરુષવંતો જીવ છે. એને બીજો પ્રકાર સૂર્યે છે. એ જુએ છે કે, “ખોટા નિમિત્તમાંથી પણ વસ્તુ સારી મળી છે ન? વૈરાગ્ય અને સંયમભાવના સારા છે. તો હવે બીજો વિચાર નહિ કરવાનો.” શું બીજો વિચાર? એ કે ‘હજુ કંઈ બગડી ગયું નથી, જાઉં, ને જિનમિતિને ધેર લઈ જાઉં. નોકરને ઘરમાં ઘાલું નહિ...’ ના, આ ભાગ્યવાન તો એ વિચાર કરે છે કે,

“અહો ! જુઓ તો ખરા મોહની વિચિત્રતા ! દલ્લો નોકરને લેવો હતો, તે માટે પવિત્ર જિનમતિને ખોડી ચીતરી ! માટે જ આ સંસાર અનુપાદેય છે.

ભૂવનભાન એન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

۲۶۹

આદરવા યોગ્ય નથી.” એટલે એમ નહિ કે “માત્ર આ નોકર એક એવો નીકળ્યો; બાકી દુનિયામાં બધા ખરાબ થોડા જ છે ? સારાય માણસો મળે છે.” આવો સવાસલો કરવાનો ? નારે ના, એક નોકરથી આખા સંસારનું માપ કાઢવાનું ! સાકર પરની માખીની જેમ સંસાર પરથી ટપ ઊરી જનારા જીવ આવા માપ કાઢી શકે. એવા માપ પર એ વિચારે છે કે “માટે જ આ સંસાર આદરવા યોગ્ય નથી. જો આ સંસારમાં આપણે ફસ્યા રહીને મોહની વિચિત્રતાના ભોગ બનીએ તો આ નોકર જેવા અકાર્ય કરનારા બનીએ.” સારાસારી હોય તાં કંઈ નહિ, પણ હુલ્લડ જાગે ત્યારે શું થાય ? ફલાણાએ પાંચને ખતમ કર્યા ! સાંભળીને, “હવે એ હાથમાં આવે...” તો શું ખૂન કરવું છે ? બનવાનું કંઈ નથી; પણ વિચાર ખૂનનો ! ખરી રીતે સમજે તો કસાઈને પણ મારી નાખવામાં ધર્મ નથી. “ચાલો કસાઈને મારી નાખો, તો બકરા મારતો અટકશે...” ના, કાલસોકરિક કસાઈને શ્રેણિકે માર્યો નહિ, પણ કૂવામાં લટકાવ્યો. ધર્મનો માર્ગ તો એ કે સારુંયે જગત સદ્દબુદ્ધિવાળું થાઓ; આ હુલ્લડઝોરોને સદ્દબુદ્ધિ આવો.

સંસાર એટલે જાતે હલકટા અગર હલકા સાથે અથડામણી :

સંસારમાં રહ્યે રહ્યે આપણામાં મોહની વિચિત્રતા ક્યારે જાગે, ને ક્યારે આપણે પણ અકાર્ય કરનારા બનીએ, તે કહેવાય નહિ. વળી આખી દુનિયા સુધરેલી નથી, એમાં નાદાન ને હલકટ જીવો પણ છે. ઘરવાસના કારણે એમનાય સંયોગમાં આવવું પડે; અને તો આપણું ગુમાવવાનું થાય. નોકરે છરી લગાવી દીધી, પણ જીવ બચી ગયો. પણ રાતે ઉંઘમાં ગળા પર જ છરી ફેરવી દીધી હોત તો? હલકટ માણસો ક્યારે શું કરે, કર્મ ક્યારે શું કરે, કાળ ક્યારે કેવો આવે શું કહેવાય? આ પરથી સંસાર કેવો છે, તેની ઓળખાણ જીણામાં જીણી જોઈએ. અંધારામાં ઉડાડીને કોઈ પૂછે ‘સંસાર કેવો છે?’ તો જવાબ નાભિમાંથી નિકળે કે ‘સંસાર આદરવા જેવો નહિ.’

સમુદ્રદાત વિચારે છે, “ભલે જિનમતિ અખંડશીલવાળી છે, તો પણ હવે મારે ગૃહસ્થાશ્રમથી સર્યું !” નોકરનો ગપગોળો હતો, વાસ્તવિક વાત ન હતી. હવે કદાચ જિનમતિને લઈ જાય ધેર, તો લોકો આળ ચઠાવે એમ નથી. પણ સંસાર ખુદ જ આચરવા લાયક નથી, કે જે સંસાર ખુદ આપણાને દુર્જન બનાવે છે, યા દુર્જનની સાથે અથડામણીમાં લાવે છે ! માટે હવે તો હું ઉભયલોકમાં સુખકારી ચારિત્ર માર્ગને જ લઈ લઉં.” અહીં કોઈ એમ પૂછનાર નીકળે કે “ભાઈ, તે તો વિચાર કર્યો, પણ જિનમતિએ કંઈ વિચાર કર્યો છે ? એને સમજાવ, પછી તું તારું કામ કર.” પણ આ પૂછનારને ખબર નથી કે ‘આ સમુદ્રદાત તો સમજનારો

૨૬૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-“વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા” (ભાગ-૨૨)

છે કે જિનવચનના સારને અર્થાત્ જિનવચન એજ સર્વમાં સાર છે ! તેમાંથીય સાર એટલે એક ! તે જિનવચનના એકને જેણે પોતાના હદ્યમાં ઉતાર્યો છે, તેવી એ જિનમતિ પ્રાયઃ કરીને મારા મનના અભિપ્રાય મુજબ જ વર્તનારી હોય. જે મારો આદર્શ, તે જ એનો હોય. મારા જે મનોરથ તે જ એના. એ મારા સમાન અભિપ્રાયવાળી સાંભળશે કે ‘મેં દીક્ષા લીધી. તો હું યે લઈ લઉં !’ એમ કરી એ ય ચારિત્ર લઈ લેશે ! તો આ ભ્યંકર ભવ સમુદ્રમાંથી એ ય બિચારી તરી જશે. એમ એનું ને મારું બંનેનું કલ્યાણ થશે. તો હવે દીક્ષા લીધા પહેલાં એને મળવું જ નહિ. પ્રવર્જયા લીધા પહેલાં મારે એને જોવીય નહિ. ને મારી જાત એને બતાવવી પણ નહિ.” એ સમજનારો છે કે,

“ચારિત્રની આડે ઘણાં વિધો આવે છે. શુભ કામમાં વિધો ઘણાં ! એ વખતે જો વિલંબ રાખું, તો કંઈ વળી નવું જ જાગી જાય ! વિધો આવવાના ઘણા પ્રકાર છે ! માટે શુભમાં વિલંબ કરવો હવે વ્યાજભી નથી.”

જગતમાં લક્ષ્મીનો લોભ અજ્ઞાન અને પામર જીવને કેવી કેવી રીતે પાડે છે, સરવાળે હાથમાં કંઈ રહેવાનું ન હોય, છતાં લક્ષ્મી કેવી મોહિની, અંજામણ અને કેવા પ્રકારના જાહુ જીવ પર કરે છે, તેનો તાદ્દશ ચિતાર આપણને અહીં જોવા મળે છે.

નોકર મંગળે શેઠના પુત્ર સમુદ્રદાનને નિધાનના લોભથી છરી લગાવી દીધી ! તેના પર શેઠના પુત્ર સમુદ્રદાને મોટી તારવણી કાઢી; કે “સંસાર આદરણીય નથી. કેમકે એમાં લોભ, મોહ એવા વિચિત્ર છે કે શહેરી મનુષ્યને બ્રાહ્મ કરી જંગલી પણ જેવો બનાવે. જે લક્ષ્મી હાથમાં આવવાની નક્કી નથી, આવ્યા પછી ટકશે, તે પણ નક્કી નથી; ભોગવીશ એ પણ નક્કી નથી; છેવટે મૃત્યુ પછી જરાય કામ નહિ લાગે, એ વાત પાકી નિર્ણિત છે ! આવી લક્ષ્મી પાછળ એના આગમન પહેલેથી જીવને કેટકેટલાં પાપ કરવાં પડે છે ! એ એક બાજુ તો અમૃત્ય માનવજીવનનો ધર્મસમય લુંટી જાય, અને પાછી બીજી તરફ હાથમાં આવ્યા પછી એક પ્રકારનું ગાંડપણ ઊભું કરી દે ! એટલે કે જેમાં એક બાજુ મહાન ધર્મ-સમયની ખુવારી અને બીજી બાજુ મહાન વિટંબણા ! એવી લક્ષ્મી પર જ આ બધો સંસાર છે ! તો સંસાર જ આદરવા જેવો નહિ.”

ચોક્કસ સમાચાર મળી ગયા કે પત્ની જિનમતિ અખંડ શીલવાળી છે, છતાં પોતાના મનમાં જે સદ્ગુર્ખ જાગી છે, તેને મારી નહિ, પણ વિકસ્વર બનાવી ! વિવેક એનું નામ. વિચારશીલતા એનું નામ ! કે ગમે તે નિભિતે આપણા દિલમાં સદ્ગુર્ખવાના જાગી, પછી સામેથી પ્રસંગ ફરી જાય છતાં પણ હવે ભાવના ન ભુવનભાનુ અન્સાઈકલોપીયિયા-“પ્રવચન મહોદ્ધિ- સમરાઈય કહા.” (ભાગ-૨૨)

ફરે ! નિભિત ગમે તે હો, જાગેલી સદ્ગુર્ખવાનાને ટકાવીએ તો સુવિચારી કહેવાઈએ, ફગાવી દઈએ તો નિર્વિચાર કહેવાઈએ.

કોઈ કહેતો આવ્યો કે “ધર્મ બહુ સરસ ! આદરવા યોગ્ય !” એના કહેવા પર આપણને ધર્મ પર પ્રાતિ થઈ. પણ પાછળથી ખબર પડી કે એણે તો આપણને ઠગવા માટે એમ કહું હતું તો ધર્મ પર થયેલી પ્રીતિ ફગાવી દેવી ? સમુદ્રદાન વિચારે છે “એ તો જે વોસિરાયું તે વોસિરાયું ! આપણે ચારિત્ર લઈએ તો અને ખોટું લાગવાનું નથી, ઊલટી એ તો ખુશી થશે ! અને એ પણ ચારિત્ર લેશે ! કેમકે એ જિનવચન રસિક એટલે, ધર્મી પતિ પ્રત્યે તો સહેજે પતિત્રતા હોય. તેથી એ મારી પાછળ સહેજે ચારિત્ર લે. તો એમાં એય તરી જાય.”

મહાન તત્ત્વજ્ઞાન :-

જો જો હોં, આવી બધી વિચારણામાં મહાન તત્ત્વજ્ઞાન ભર્યું છે. પહેલાં તો એ જુઓ કે જૈનધર્મની કેવી ઝલક રોમેરોમમાં લાગી ગયેલી કે હજી તો યુવાનીના ઉંબરે છે ત્યાં મહાન પતિત્રતા સુશીલ અને સેવાકારી સુંદર યુવતી પત્નીના સુખ નથી લેવા. સંસારના એક ખૂણે અજૂગતું જોઈ હવે તો આ સુખને પણ જેર ભયા લાડુ જેવા સમજવા છે. આંતરચ્યકુ કેવીક ખૂલ્લી ગઈ હોય તો આ બને ! પાછું, ‘પત્નીએ બિચારીએ કેટલા કોડથી સંસાર માંડ્યો હોય, તે એણે શું સુખ જોયા ?’ એવી ખોટી દયા ખાવાની નહિ. હવે તો એના સાચાં સંગાં એટલે કે કલ્યાણમિત્ર બની એની ભાવદ્યા વિચારવાની કે એનું પારલૌકિક ભલું કેમ થાય ! હિતૈષી કોને કહેવાય ? આ લોકના સુખમાં સંગાંસેહી કે આશ્રિતને એવા ઉબાડી દે કે ભવાંતરે એ બિચારા ભવમાં ભટકતા થઈ જાય, એવું કરનારને ? સાચા હિતૈષી તો સમજતા હોય છે કે જીવને સંસાર સુખની ક્યાં નવાઈ છે ? તેમ આત્માની વાત વિસારી શરીરની સગાઈ કરનારાં સંગાંય એને ક્યાં ઓછાં મળ્યાં છે ? કલ્યાણમિત્ર સંગાંની વડાઈ એ કે એ મોક્ષના સુખની સગવડ કરી આપે. દેહના સંબંધ વિસારી આત્માનાં સંગાં થાય. સમુદ્રદાન જિનમતિ માટે આવો બને છે.

જૈનનો વિશ્વાસ :-

પણ એ કરતાં જિનમતિમાં એને વિશ્વાસ કેટલો બધો ? હજી કંઈ એના લાંબા પરિચય કર્યા નથી. પરંતુ એ શ્રાવિકાની દીકરી છે, જૈન ધર્મ પામેલી છે, જગતમાં સારભૂત જે જિનવચન, એનાય સારને સમજેલી છે, એના માટે વિશ્વાસ વગર પરિચયે રાખી શકાય. જરાક આપણા આત્મા તરફ દાણ નાખો ને જુઓ કે જિનવચનનો સાર હૈયે ઉત્તર્યો છે ? રગેરંગમાં જિનવચનના સારની ફોરમ ફેલાઈ ગઈ છે ? એય જીવો એક વખત તો સંસારના જ હતા. એમાંથી એવા ઉંચે ચઢ્યા

છે. તો તમારે ક્યારે ચઢવાનું છે ? ચઢવાનો રસ્તો આ છે; અનંતજ્ઞાની, જગતદ્યાળું શ્રી જિનેશ્વરદેવના એકેક બોલને આપણા મનમાં સ્થિર અને અનન્ય સ્થાન આપી દેવાય ‘મારે તો જિને કહું તે જ વિચારવાનું; તે રીતે જ વિચારવાનું, આવું થાય તો આત્માની રોનક ફરી જાય. જિનમતિનું તેજ વિકસી ગયું છે તેથી એના પતિત્રતાપણાની કલ્યાના પણ સમુદ્રદટ્ઠ આટલે સુધી કરે છે કે એ પણ મારી પાછળ ચારિત્ર લેશે. દેહનાં નહિ, પણ આત્માના સંબંધમાં આ સહેલું છે.

સમાચારને પાંખ :-

સમુદ્રદટ્ઠ સારો વિચાર માત્ર કરીને બેસી ન રહ્યો; એ પ્રમાણે પ્રવૃત્તિ કરી, શુભ વિચારની સાથે તેવી પ્રવૃત્તિ જોઈએ જ. અનંગદેવ ગુરુ મહારાજ પાસે સમુદ્રદટ્ઠે ચારિત્ર લીધું. હવે તો ચારિત્ર-સાધનામાં મસ્ત છે. આ ખબર જિનમતિને પહોંચ્યા. સમાચાર પહોંચતાં બહુ વાર ન લાગી. એ કાળ એવો હતો કે સારા સમાચારને પાંખ આવે ? આજે કાળા સમાચારને પાંખ આવતાં વાર નહિ ! કોઈના દોષનું પાનું હાથમાં આવ્યું કે છાપામાં ને બીજે ત્રીજે નિંદાનું પાપ શરૂ થઈ જાય ! જ્યારે નિંદાથી પૂર્વે લોકો ભડકતાં. સમજતા કે “આવા મહાપુરુષે મળેલ મોંઢાથી નિંદા ન થાય; એ મોંઢેથી તો મહાપુરુષોની સુતિ-પ્રાર્થના કરવાની.” આવા હવામાનથી પૂર્વેકણે ખરાબ સમાચારોનું ગેરેટિંગ નહોતું થતું; અને ગુણાનુરાગને લીધે સારા ખબર પ્રસરી જતા.

જિનમતિ પતિની અચાનક દીક્ષા પર વિચારે છે :-

જિનમતિને સમાચાર મળ્યા, કે “મારા પતિએ ચારિત્ર લીધું.” સાંભળીને શું થયું એને ? આજે શું થાય ? તરતનાં લગ્ન થયાં હોય, હજું કંઈ વાત-વિચાર કર્યા ન હોય, ને ખબર પડે કે “પતિદેવ ચારિત્ર લીધું !” તો શું થાય ? ઉલ્કાપાત જ ને ? “કોણ પૂછીને ચારિત્ર લીધું ? તો પછી શું કામ પરણ્યાતા ?” અને એમ જવા દઈશ એમને ?...” શું બોલે ને કેટલું બોલે, તે આપણાથી બોલાય નહિ. પરંતુ એટલું ખું કે આવા અવસરે પતો લાગી જાય કે હૃદયની ધર્મ સાથે કેટલી સગાઈ છે ! પાપ સાથે જો સગાઈ હોય છે, અને સાંભળો કે ‘પતિદેવ બજારમાં કંઈ ચીજ લેવા ગયા, ને પૂછ્યા વિના કોઈ શરત કરી પચાર હજાર રૂપિયા કમાયા !’ તો પછી પતિ ઘેર આવે ત્યારે, ભલે પોતાને પૂછ્યા વિના જ પતિ શરત કરીને રૂપિયા લાવ્યા હોય છતાં, ધમાલ કરે ? ના ! જૂઠ-ડફાણ ગમે તે કરીને છોકરો ૨૫-૫૦ હજાર કમાઈ લાવે તો ખુશી થવાય છે ને ? કેમ ? પાપ સાથે સગાઈ છે એટલે પાપનો વધારો - પાપના ખેલ-પાપની બોલબાલા...બધું ચાલે !

પરંતુ અહીં તો ધર્મ સાથે સગાઈ છે. મોહાંધતાના કુરેગ મટીને જિનવચનના રંગ લાગ્યા છે. એટલે જિનમતિએ સાંભળ્યું કે મારા પતિએ ચારિત્ર લીધું, ત્યાં એનો સંવેગ વધી ગયો. એને અનુરૂપ આ પ્રમાણે વિચારણા કરી;

જિનમતિની તત્ત્વભરી વિચારણા :

“ખરેખર ! આર્યપુત્રે ધણું સુંદર કાર્ય કર્યું !” કેમ આમ વિચારે છે ? સંવેગ વધ્યો !

સંવેગ વધ્યો ૧ એટલે ધર્મ પર પ્રીતિ વધી !

સંવેગ વધ્યો ૨ એટલે મોક્ષની અભિલાષા જોરદાર બની !

સંવેગ વધ્યો એટલે ઉ સંસારનું આકર્ષણ ધણું ઘટી ગયું, ને સંસાર પર નફરત વધી !

આવો સંવેગ કોણો વધાર્યો ? જિનવચનને, જગતમાં મહાસારભૂતને, એક જ સારભૂતને સુવિજ્ઞાત કર્યો છે, એમાં એ વચ્ચને અનુસારી પોતાના નિકટના જેહી પતિનો વર્તાવ-ચારિત્ર સ્વીકાર સાંભળે છે, એથી સંવેગ વધી જાય એમાં નવાઈ નથી. જીવના આદર્શ જિનવચને જે શિખબ્યા છે, તેનો અમલ પોતાના હૃદયનાથના જીવનમાં જોતાં પોતાનું હૈયું કેમ ન પુલકી ઊઠે ? મુક્તિના નિકટવર્તી જીવોનાં તેજ વધી ગયા હોય છે ! એટલે ગલીય વિષયભોગ તો ક્યાંય ભૂલાઈ જાય છે ! એવી આ વિચારે છે કે “આર્યપુત્રે ધણું સુંદર કાર્ય કર્યું ! શું સુંદર ? હજુ તને પરણીને તેડવા પણ નથી આવ્યા, ને સાધુ થઈ બેઠાં ! તને જરા પણ સુખ આપ્યું નથી. અને એનું એવું કાર્ય સુંદર ?...ના આ વિચાર સરખો નહિ ! કેમકે એ વિચાર તો પાપ સાથે સગાઈવાળા હૃદયનો છે ! પણ જે સમજે છે કે “જગતમાં તારણહાર એક ધર્મ જ ! ઉપકારક એકલો ધર્મ જ ! ધર્મ એજ આત્માનું સાચું સ્વરૂપ છે. જેમ સુવર્ણમાં ક્યારેક મહિનતા દેખાતી હતી, પણ એનું એ સ્વરૂપ નહોતું. એનું સ્વરૂપ તો મહાતેજસ્વી નિર્ભળતા છે. એમ આત્માનું સ્વરૂપ ધર્મ છે. એ ધર્મથી આત્મા બાદશાહ છે, સ્વતંત્ર છે, નિશ્ચિન્તા છે.” એવી જિનમતિની આંખ આગળ દેખાય છે કે “જેવી વનવગડામાં સિંહ સામે હરણિયાની દશા, તેવી આ સંસારમાં પાપ સાથે સગાઈ રાખનારા જીવની દશા ! જીવને જાણે કર્મસંસાર કહે છે ‘કરી લે નાચ ! સારા પૈસા, સારું ખાવા-પીવા મળ્યું છે તો સંધરી લે, ભોગવવાની તાકાત મળી છે તો ભોગવી લે, ઉડાવ અમનચ્યમન ઉડાવ, ને જગત પર બને તેટલી હક્કુમત જમાવ. પણ યાદ રાખજે કે જમરાજરૂપી સિંહને મોકલું એટલીવાર છે. લખલૂટ લક્ષ્મી પડી રહેશે; કુટુંબ બહોળું ઊભું રહેશે; અને તને એ ઉપાડી જશે ! તે પણ કોઈ અગમ-અગોચર પ્રદેશમાં ! કોઈ કુટુંબીને તારું

સરનામું ય ન જડે કે તું ક્યાં લઈ જવાયો ! ઉપાડી જાય ત્યારે કોઈ રોકનાર ન મળે કે એને ભાઈ ક્યાં લઈ જાઓ છો...એ તો ટીક પણ જમરાજ અંદરના પંખીને ઉપાડી જાય, પછી ખોળિયું તો કુંભી સાચવી રાખે ને ? ના ! એને તો કુંભીઓ કહે બાળી આવો !” ને પેલાને જમરાજ ઉપાડી ગયા તે ધોર સંસારસાગરમાં પટકે ! કહો જો, ત્યાં એની કેવી કારમી દશા !!

સંસાર-કલેશ-આયાસનો ભરેલો :

જિનમતિ આ સમજે છે, માટે પાપ સાથે સગાઈવાળા હદયને યોગ્ય વિચારો તે નથી કરતી. એ તો વિચારે છે કે “આ સંસાર-કલેશ અને આયાસથી ભરેલો છે. દુઃખ અને મજૂરીથી ગ્રાસમય છે. વિવિધ પ્રકારના વેઠિયા નાચ નાચવાના ! હર્ષ, શોક, હાસ્ય, ગુસ્સો...અનેક નાચ ! મજૂરી કરવાની અને પરિણામે દુઃખ ભોગવવાનું. આવો સંસાર ! લક્ષ્મીમાં, લાદીમાં,...બધે સરવાળે કલેશ અને વેઠ ! ખરેખર, આર્થપુત્ર સમજી ગયા કે આ સંસાર હું ઉપાડીશ ને પહોળો કરીશ તો આ દુઃખ અને આયાસજ કપાળે લખાવાનું છે !”

પ્ર.- પણ માણસ એટલું દુઃખ ઉપાડી લે તો સારા સ્નેહીના સંયોગ તો મળે ને ?

ઉ.- ના, એમાં ય અને વિયોગની પોક મૂકવાની ! જે સંસારમાં સ્નેહીજનોના સંપર્કી, પરિણામે એ છૂટા પડી જઈ, નાશ પામી જવાના ! જો સંયોગમાં રજી થયા તો વિયોગમાં પોક મૂકવાની ! વાંઝિયાને કોઈ પૂછે “આ તમારી પાડોશમાં કેમ પોક મૂકાઈ રહી છે ? ને તમે નિરાંતે બેઠા છો ?” તો એના જવાબમાં એ શું કહે ? “ભાઈ ! જેમ અને ત્યાં મંગળના વાજા વાગતાં હતાં, ત્યારે અમે બેસી રહ્યા હતા, તેમ અને ત્યાં મૃત્યુની પોક મૂકાય છે, તે વખતે અમે નિરાંતે કેમ ન બેસી રહીએ ? જે હસે તે રૂએ, હર્ષ કરે તે શોકમાં પડે.”

છતાં તમે કેમ સંયોગમાં ફસો છો ? કારણ છે, મનને લાગે છે કે વિયોગ નહિ થાય ત્યાં સુધી તો સુખો મળશે ને ? પણ, તમને હજુ ખબર નથી કે એ સંસારનાં સુખોના વિપાક મહાભયંકર છે. એ પરિણામે આત્માનું ધોર નિકંદન કાઢનારાં છે.

(૧) સુખભોગનો કાળ મામૂલી, જ્યારે દુઃખભોગનો કાળ અપરંપાર ને ? નબળા શરીરે સારી-ભારે ચીજ જરા વધારે ખાઈ લેતાં કેટલી વાર ? ૨-૫ મિનિટ, પણ પછી એના અજ્ઞાણ વગેરેની પીડાનો કાળ કેટલી મિનિટ ચાલે ? કહોને મિનિટો ક્યાં ગણાય ? કલાકોય નહિ, દિવસોના દિવસો. સંગ્રહણીવાળાનું તો આવી જ બન્યું ! એવું જ સંસારસુખનાં કાળ પછી. ત્યારે,

(૨) સુખની માત્રાય અલ્ય, જ્યારે દુઃખની માત્રા જોરદાર ! સુખ એક ડિગ્રીનું તો દુઃખ સો ડિગ્રીનું ! જેઠ માસની ગરમીમાંથી માણસ આવ્યો, તોલમાં હુંગાર પાણી પડ્યું હોય, નહાવાની મજા આવે ને ? પણ તેને કહે કે “જુઓ આનાથી નહાવું હોય તો નહાઓ, પણ પછીથી ઉકળતા પાણીની તોલમાં નહાવું પડશે !” તો પેલો ગરમીમાંથી આવ્યો હોવા છતાં હંડા પાણીએ નહાવાનું સુખ લે ? ‘ના ! ભાઈ, નથી જોઈતું તમારું હું પાણી’ એમ જ કહેને ? તેમ જેણે ધર્મની પ્રીતિ થઈ તે જગતના વિષયોને હંડા પાણીની તોલ જુએ છે પણ એની પાછળ પરિણામ ધીખતા પાણીની તોલ જેવાં છે ! તેથી જ અમને સુખની ઈચ્છાઓ જાગશે, પણ એને અંદરમાં કયરીશું, એને પૂરી કરવાનો અમને મોખ નથી. આવું નક્કી કર્યું છે ને !

જિનમતિ વિચારે છે કે “સંસારમાં વેઠ અને કલેશ અપાર ! સંયોગ પાછળ વિયોગ ! વિષય ભોગના વિપાક દાર્શણ !”

વિષય સુખ અલ્ય, અપાય અનાલ્ય, અનંત ! માટે એ પણ ઓરતો કરવા જેવો નથી કે સ્નેહીના વિયોગ થતા સુધીમાં તો લહેર કરીએ ! માણસ હુલ્લડ જોવાની મજા લેવા નથી જતો ! કેમ વારું ? કપાઈ મરવાનો ભય છે. ચોથા મજલે છાપરાને કિનારેથી નીચે જોવાનો આનંદ લેવા નથી દોડતો. પડી ને મરવાનું મહાદુઃખ દેખાય છે માટે. ચોરીના ધન લેવા કે એવા બીજા રાજ્યના ગુના કરવા નથી જતો. કેમકે ભારે સજા અને નાલેશી થવાનું દુઃખ દેખે છે. ગ્રણેય વાત જિનમતિની આંખ સામે રમી રહી છે તે યાદ રાખવા જેવી છે. શાની ? સંસાર, સંયોગ અને વિષયભોગની.

દુર્લભ માનવતા :

એ બધું તો ખરું, પણ મનુષ્યપણું ક્યાંથી મળે ? અરે, તેય મળે, પણ તેમાં જિનમત કર્યાંથી મળે ? જગતમાં બધું મળવું સહેલું છે, માત્ર મનુષ્યપણું અને જિનમત મળવો મુશ્કેલ છે. સાચો મોક્ષમાર્ગ દેખાડનાર અને સંસારની જડ ઉઘેડી નાખનાર જૈનધર્મ છે. બીજા તો ધર્મના નામે એવી વાત કહેનારા કે સંસારની જડ મજબૂત કરનારા ! ‘અપુત્રસ્ય ગતિનાસ્તિ’ શું ધર્મ બતાવ્યો ? પુત્રવાળા બનો ! તે માટે લઘ કરો ! તે પછી બાયડીનો પરિગ્રહ કરો ! આ બધું ધર્મ ! આ શું છે ? ધર્મના નામે પાપનું પોખરણ ! પાપને પાપ માનવાનું તો ગયું, પછી છોડવાની તો વાત જ ક્યાંથી ? જ્યારે આલોક પરલોકને સુધારનાર જૈનધર્મ છે. એની પ્રાપ્તિ થવી ઘડી કઠીન ! તમને મળી ગયો છે, તેથી કિંમત ન આંકો એ જુદી વાત. પણ દુર્ગતિમાં કે અહીં અનાર્ય મનુષ્યપણામાં ફસેલાની દસ્તિએ વિચારો તો દુર્લભતા સમજ્ય.

જિનમતિ વિચારે છે :

“આર્થપુરે તો ધણું સારું કર્યું ! જિનમતિની દુર્લભતા સમજું ઉભયલોકને સુખકારી માર્ગ લીધો. તો લાવ, હું પણ એમના દર્શનાર્થે જાઉં” હદ્યનો ગ્રવાહ કથી દિશામાં વહી રહ્યો છે ? પરમાત્માની દિશા તરફ, કે મોહની દિશા તરફ ? કોની હારોહાર લાગણીનો ગ્રવાહ ચાલી રહ્યો છે ? ભગવાનના તારક સિદ્ધાંતોની સાથે કે સંસારના પાપસિદ્ધાંતોની સાથે ? આપણે આપણી વિચારણામાં આ જોવાનું છે. ધ્યાન રાખવાની જરૂર છે કે આ જીવનમાં આપણી લાગણીઓના શુદ્ધિકરણ પર જીવનમાં વિજય મેળવવાનો છે. લાગણીઓને મલીન બનાવીએ ને બહાર ગમે તેટલું કરીએ તો પણ જીવન હારી જઈશું. તો એ જોવું જોઈએ કે લાગણીઓ ક્યાં વહી રહી છે ? લક્ષ્ય પણ નક્કી જોઈએ; અને માર્ગ પણ એ તરફનો જોઈએ. અમદાવાદથી જું હોય દિલ્હી અને બેસે મુંબઈની ગાડીમાં તો કામ લાગે ? નહિ, લક્ષ્ય કમમાં કમ હુર્ગતિમાં ન જડપાઈ જવાય એના બાંધી માર્ગ પણ એ મુજબનો જોઈએ. માર્ગમાં પહેલું આ કરો, કે લાગણીઓના વહેણ જિનોકત તત્ત્વો સાથે થઈ રહ્યા છે. જિનના તત્ત્વ તો કહે છે ‘બધું પછી, તારા આત્માનું પહેલું વિચાર.’

જિનમતિએ પોતાના માતાપિતાને પણ કહ્યું હશે ને “સાંભળ્યું ? એમણે ચારિત્ર લીધું !” હસતાં કહેવાનું, ને પેલાઓને હસતાં સાંભળવાનું ! રાજુ થઈને મા-બાપ સાંભળે, દેખ કરીને નહિ; તો જ ખોટી ધાંધલ ન મચે. જિનમતિનું હદ્ય તો નાચી ઊઠે છે ! ‘એમણે તો ધણું સરસ કામ કર્યું આ જીવનમાં ! આ જીવનમાં આવીને આજ કરવાનું હતું. અને તે મારા સંબંધી થઈને કર્યું ! તે મારે મન તો મહાગૌરવ છે ! પરણ્યા પહેલાં કર્યું હોત તો ગૌરવ ન મળત કે ‘આના પતિએ ચારિત્ર લીધું.’ જૈન ધર્મ પામેલી છોકરી છે એટલે વિચારે છે કે ‘આમાં ગૌરવ છે !’ માતાપિતાને કહે છે ‘હું ખુશી થઈ, હવે હું એમના દર્શન-વંદને જાઉં.’ રજા લીધી, અને પરિવારને લઈ શોધતી શોધતી આવી, કે જ્યાં સમુદ્રદંત સાધુ છે. આવીને સમુદ્રદંત સાધુને જોયા, જોઈને ખૂબ જ ખૂશ થઈ ગઈ ! કેમ ? મોક્ષપુરીના માર્ગ જેણે પ્રસ્થાન માંડયું છે તેવા પોતાના પતિને જોઈ મોક્ષની અભિલાષાવાળી તેના હદ્યમાં ધણો હર્ષ ઊભરાઈ ગયો. પોતાનું પણ એ જ લક્ષ છે. એને મોક્ષમાર્ગ વિના ભવ અટવીનો માર્ગ દારુણ ત્રાસવાળો છે. નજરે નિહાળું કે “હજુ હું ભવ અટવીમાં ભમું છું ને એ તો મોક્ષનગર તરફના માર્ગ ક્ષેમકૃશળ ચાલી નીકળ્યા છે !” આનંદનો એને પાર નથી. ચામડાના સુખ એને વિસરાઈ ગયા છે, અથવા ચામડી ઊર્જરાઈ જવા જેવા ભયંકર લાગ્યા છે. પછી સહેજે સાચાં આત્મસુખના વલણ બંધાય, એની લગની લાગે, ચારે બાજુ એના જ ફાંઝા મારે એમાં નવાઈ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“ગ્રવચન મહોદ્ધિ- સમરાઈચ્ય કહા.” (ભાગ-૨૨)

૩૦૫

નથી. કેટલા જીવનોની સાધના કરીને આવી હશે ? એ સાધના પણ કેવી દિલાની હશે ! કેવી જોરદાર અને સતત હશે !

ભવ અનુમોદના ! :-

ાંખ સામે આ તે સાધુ બની બેઠેલ દેખાય છે કે જેના નિમિત્તે એને જીવનભર બાળ વિધવાની જેમ સંસારના સુંવાળા લાગતા વિષયસુખ નહિ મળે. છતાં આની દાઢિ જુદી છે, તેથી હથ જોડીને કેટલા સુંદર શર્દોમાં, જુઓ એ શું કહે છે !

પોતાના સ્વાર્થ કરતાં સામાના આત્મહિતની કદર કરો :-

જિનમતિ શ્રાવિકા પતિના ચારિત્રની ઉપબૂછણા કરે છે. કયારે કરી શકે ? પોતાના સ્વાર્થને ભૂલી પતિએ કરેલું કાર્ય સારું અને સુખકારી માની એની કદર કરવાનું મન થાય ત્યારે ને ? ચારિત્રનો માર્ગ સારો અને સુખકારી છે એવું એ માનતી હતી. આજે ય માનનારા છે. પરંતુ પ્રશ્ન એટલો જ રહે છે કે પોતાના જ્યાં હુન્યવી સ્વાર્થ ઘવાય એવી વ્યક્તિ માટે પણ એ માન્ય છે કે આમણે સારું કર્યું ? જિનમતિ તો કેઠ હદ્યના ઊંડાણમાં તત્ત્વને પરિણમાવનારી બની છે; એટલે એને મન પોતાના હુન્યવી સ્વાર્થની બધું કિંમત નથી; કિંમત છે આત્માના જિનોકત હિતમાર્ગની ! એટલે પતિના આત્માની હિતેષિણી એવી એ પતિના ચારિત્ર જેવા હિતમાર્ગની સામે થવાને બદલે ભારે ઉપબૂછણા કરે છે. શ્રાવિકા તો પતિના આત્માની હિતેષિણી જ હોય ને ? માટે પોતે એની કાળજ રાખે. આ તો પતિએ પોતાની જ પ્રેરણાથી ચારિત્ર લીધું છે. તો એમાં પત્ની પોતે સ્ખલનાનું નિમિત્ત ન બની જાય એ તો ખાસ ધ્યાન રાખે જ ને ? સ્નેહીના પ્રત-પચ્ચિક્ખાણાદિ આત્મહિતના માર્ગમાં ભંગ કે અતિચારનું નિમિત્ત ન બની જવાય એ ખાસ જોવાનું છે; નહિતર સ્નેહી થઈને સ્નેહીની જ કતલ કરવા જેવું થાય. આજે પણ દીક્ષા પ્રસંગે નાખુશ સ્નેહીઓ દીક્ષા પછી કહેનારા નીકળે છે કે ‘દીક્ષા લીધી તો ભલે; હવે એને સારી રીતે પાળજો. સંસાર તરફ મન કરતા નહિ.’ શું છે આ ? જિનવચનની શ્રદ્ધાના બોલ. પ્રત લીધા પછી ભાંગવું એ મહાપાપનું કારણ છે; એવી શ્રદ્ધા ઉડી ઉડી બેઠી છે. એવાઓ કદાચ એક વાર નાખુશ હતા તેથી એને ધર્મદ્રોહી ન કહી શકીએ.



૩૦૬

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-“વિચિત્ર પ્રસંગ પર ઉમદા વિચારણા” (ભાગ-૨૨)

ગ્લાનસેવા અને ગુરુસેવા

- પૂ. મુનિરાજ શ્રી અપરાજિત વિજય મ.

ગ્લાન સાધુની વૈયાવચ્ચે એ મોટામાં મોટું કર્તવ્ય છે તેવું શાસ્ત્રવચન પૂજયશ્રીમાં પૂરેપૂરું આત્મસાત્ર થયેલું જણાતું હતું. કોઈ પણ સાધુને માંદગી આવે ત્યારે પૂજયશ્રી તેની વૈયાવચ્ચે કરવા અત્યંત તત્પર રહેતા. પોતે સંઘર્ષોર અને ગંધાધિપતિ આચાર્ય તથા સેંકડો શિષ્યોના ગુરુ હોવા છતાં નામનાં નાનો સાધુ ગ્લાન બને ત્યારે તેમની પણ સેવા માટે અત્યંત ઉત્સાહિત રહેતા. બીજા અનેક કાર્યોને ગૌણ કરીને પૂજયશ્રી ગ્લાનસેવાને મુખ્ય બનાવતા.

ગ્લાન સાધુને પોતાની દેખરેખ હેઠળ યોગ્ય ઉપચાર કરાવતા, તેના આદ્ધાર-અનુપાન આદિની બરાબર કાળજી લેતા, અવારનવાર તેના સંથારા પાસે જઈ શાતા પૂછતા અને માંદગીમાં પણ તેનું ચિત્તસમાવિમાં રહેત તેની કળા શીખવતા. ગ્લાન સાધુની સારવાર-સાંભળ માટે યોગ્ય સાધુઓની તેઓશ્રી ગોઠવણ કરતા. નિશ્ચાવરી સમૃદ્ધાયને પણ ગ્લાન સેવા માટે સદા તત્પર રહેવાની હિતશિક્ષા વારંવાર આપતા. કોઈ સાધુ અચાનક બિમાર પડે ત્યારે જરૂર પડે તો વિહારાદિના કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરીને બીજા કાર્યોને ગૌણ ગણી ગ્લાનની સારવારને પ્રધાનતા આપતા.

સંવત ૨૦૮૮માં નડીયાદમાં દીક્ષા-પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ વ્યસ્તતામાં પૂજયશ્રી રોકાયેલા હતા. ત્યારે તપસ્વી મુનિરાજશ્રી મહિપ્રભવિજય મ. તબિયતથી અસ્વસ્થ હતા. તેથી અનેક વ્યસ્તતાઓ વચ્ચેથી પણ વધુમાં વધુ સમય કાઢીને તેમની પાસે જઈને બેસતા તથા માંદગીમાં મનની સમાધિ સાચવવા શું કરવાનું તે શીખવતા. કુંભોજગિરિથ્રમાં પૂ. ધર્મજિતસૂરી મ. હાઈ-એટેકના હુમલાને કારણે સંથારાવશ હતા ત્યારે પણ પૂજયશ્રી તેમની પાસે જઈ સ્તવનો-સજ્જાયો સંભળાવતા અને વારંવાર તેમની ખબર પૂછતા. સુરતના અંતિમ ચાતુર્મસમાં પૂ. મુનિરાજ શ્રી દેવસુંદરવિજય મ. ની તબિયત અસ્વસ્થ હતી તો પૂ. ગુરુદેવશ્રી પોતે તબિયતથી અસ્વસ્થ હોવા છતાં દાદર ચરીને બીજે માળે ગ્લાન મુનિરાજની શાતા પૂછીવા રોજ જતા અને તેમને સુંદર બોધ આપતા. તે જ ચોમાસામાં તપસ્વી મુનિરાજશ્રી શોભનવિજય મ. ની પણ માંદગીમાં ખૂબ સંભાળ લીધી

ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“પ્રવચન મહોદ્ધિ-સમરાચ્ચ્ય કહા.” (ભાગ-૨૨)

૩૦૭

અને સુંદર આરાધનાઓ કરાવી. તે ચાતુર્મસમાં અનેક સાધારણ એરી મેલેરીયાના તાવમાં વારા-ફરતી પટકાયા ત્યારે પૂજયશ્રી તે બધાનું ખૂબ ધ્યાન રાખતા. ધણીવાર તેમની સેવા કરવા પણ પહોંચી જતા અને શરીર પર દબાવી દેતા.

અન્યત્ર રહેલા સાધુની બિમારીના સમાચાર મળે ત્યારે પૂજયશ્રી તરત ચિંતિત બની જતા અને જરૂર જણાય તો તે સાધુની વૈયાવચ્ચેની યોગ્ય વ્યવસાથ તરત ગોઠવી દેતા. સંવ. ૨૦૪૮ના પ્રારંભમાં પૂ. મુનિશ્રી નંદીશ્વરવિજય મ. ને પગે ફેફચર થવાથી પૂનામાં સારવાર ચાલુ હતી. પૂજયપાદશ્રીનો ત્યારે સુરતમાં બિરાજમાન હતા. પૂનામાં તે વખતે બે સાધુ તો ગ્લાનસાધુની સાથે હતા જ, તદ્વપરાંત નજીકના સ્થાનોમાંથી સાધુની ૨-૩ ટુકડીઓને પૂજયશ્રીએ પૂના તરફ વિહાર કરાવ્યો અને મુનિરાજની સેવા-વૈયાવચ્ચેની સુંદર વ્યવસ્થા ગોઠવી દીધી. ગ્લાન અને વૃદ્ધ સાધુઓની સેવા માટે પૂજયપાદશ્રી અત્યંત કાળજ અને તત્પરતા દાખવતા.

તેમ કોઈ સાધ્વીજ મહારાજની માંદગીના સમાચાર મળે ત્યારે પણ પૂજયશ્રી તેમની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા તરત કરાવી લેતા. સં. ૨૦૪૮ના સુરતના ચાતુર્મસમાં એક સાધ્વીજ મ. ને ૭૦ ઉપવાસની કઠોર તપશ્ચર્યાના પારણાં બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ સમાચાર મળતા પૂજયપાદશ્રી તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયા.

બે કલાક ત્યાં રોકાયા, સારવાર માટેનું યોગ્ય માર્ગદર્શન આપ્યું અને વ્યાખ્યિમાં સમાધિ ટકે તેવી સુંદર આરાધના કરાવી. પૂજયશ્રી ગ્લાનની સેવા માટે જેમ તત્પર હતા તેમ ગુરુજનો અને વડીલ પૂજ્યોની સેવા માટે પણ હંમેશા તત્પર રહેતા. પોતાના પરમતારક પૂ. ગુરુદેવશ્રીની નિશ્ચામાં જીવનભર રહ્યા ત્યારે પોતે પદસ્થ, વિદ્વાન, વ્યાખ્યાતા અને અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં એક અદ્ધારી સેવકની જેમ પદિલેહણ આદિ સેવકાર્યમાં સમયસર પહોંચી જતા. પોતાના ગુરુદેવશ્રીનું સ્ટ્રેચર પણ ઉપાડતા. અભ્યાસ માટે ધણીવાર છઙ્ણના પારણે છંક કરીને ગોચરી વાપરવા આદિનો સમય બચાવતા પણ ગુરુસેવા અને ગ્લાનસેવાને અભ્યાસ આદિ કોઈ પણ કારણથી ક્યારેય ગૌણ ગણી નથી.

— “ભુવનભાનું અજવાળાં” પુસ્તકમાંથી સાભાર



૩૦૮ ભુવનભાનું અન્સાઈક્લોપીડિયા-“ગ્લાનસેવા અને ગુરુસેવા” (ભાગ-૨૨)